

जीवनी

154

શ્રી

જૈનાગમ કથા કોષ



209

(100)

લેખક અને પ્રકાશક :

સુવનલાલ છગનલાલ જાંઘવી

શ્રી જિનવરાય નમઃ

શ્રી

સુદર્માસુ

જૈનાગમ કથા કોષ

લેખક અને પ્રકાશક
જીવનલાલ છિગનલાલ સંધ્વી
પંચભાઈની પોળ-અમદાવાદ

કિંમત સવા રૂપીઓ

સર્વાધિકાર સ્વાધીન

સંબુજ્ઝહા ! કિં ન બુજ્ઝહા ? સંબોહો ખલુ પેચ દુલ્લહા !
ણો હુબણમંતિ રાહથો, નો સુલહં પુણરાવિ જીવિયં ॥


નગો ! તમે કેમ સમજતા નથી ? પાછળથી એધીભીજની પ્રામિથવી મુશ્કેલ છે. કારણુંકે જેમ વીતી ગયેલી રાત્રિઓ પાછી આવતી નથી. તેમ આ જીવન (મનુષ્યભવ) ઇરીથી સહેલાઈથી મળી શકતું નથી.

—શ્રી સૂત્રકૃતાંગ સૂત્ર

મુદ્રક :

મર્ણિદાલ છગનદાલ શાહ
ધી વારવિજય (પન્ટીંગ) પ્રેસ
રતનપોળ, સાગરની ખડકી
અમદાવાદ

સ્વાત્મક લિખની શાહ—ચોગીલા.



જન્મ: સા. ૧૯૪૬

કાગળ શુદ્ધ ૧૩

અવસાન: સા. ૧૯૮૨

કાગળ શુદ્ધ ૨

અર્પણ

શ્રીયુત સ્વર્ગમનિષ્ઠ

રા. રા. નેમચંદભાઈ ઠાકેરશી શાહ.

ચાટીલા.


મુર્ખમીશી !

જૈન આગમમાંથી તારવેલાં જૈન મહાપુરુષો અને સત્તારી-ઓનાં જીવનચરિત્રાનો આ સંગ્રહ-ગ્રન્થ કોને અર્પણ કરવો, એ વિકટ પ્રશ્નાનો ઉત્તર મેળવવાની વિચારમાળા દરમ્યાન મણે આપનો પરિચય થયો. એ પરિચય દ્વારા હું જાણી શક્યો, કે આપનો જૈન ધર્મ પ્રત્યે અવિરત ગ્રેમ છે. જૈન સાહિત્યકારોને ઉત્તેજન આપી જૈન સાહિત્ય વિકાસમાન થયેલું જેવાના આપ સુંદર મનોરથે સેવો છો, એટલું જ નહિ પણ સમય સમય પર આપ સાહિત્યકારોને ઉત્તેજન આપી સક્રિય સાથ આપો છો.

વળી આપ ધંધાર્થે કલકૃતા જેવા દૂરના ક્ષેત્રમાં વસતા હોવા છતાં, આપ આપનું ધાર્મિક નિસ્કર્તાંય-સામાયિક, પ્રભુસ્તમરણાદિ અસ્થલિતપણે બુનાવ્યે જાવ છો, તેમજ આપ કલકૃતાના સ્થા. જૈન સંધમાં હમેશાં આગેવાનીભર્યો ભાગ લઈ ભગવાન મહાવીરના શાસનરક્ષણુમાં સુંદર ક્ષાળો આપી રહ્યા છો. એ વગેરે આપના ઉદ્દર અને પ્રશંસનીય કાર્યોથી આકર્ષણીંને “જૈતાગમ કથાકેષ” નામનું આ પુરસ્તક હું આપને ગ્રેમપૂર્વક અર્પણ કરી કૃતાર્થ થાડ્ય છું.

—શ્રીયુત સ્વર્ગમનિષ્ઠ.

૨૭૦ હીરાચંદ ઠકરશી શાહ—ચોડીલા.



જન્મ: સા. ૧૮૪૬

ફાગણ શુદ્ધ ૧૩

Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

અવસાન: સા. ૧૯૮૮

ફાગણ શુદ્ધ ૨

અર્પણ

શ્રીયુત સ્વર્ધમનિષ્ટ

રા. રા. નેમચંદભાઈ ઠાકેરશી શાહ.

ચાટીલા.

મુર્ખભીશી !

જૈન આગમમાંથી તારવેલાં જૈન મહાપુરુષો અને સન્નારી-ઓનાં જીવનચરિત્રાનો આ સંગ્રહ-ગ્રન્થ કોને અર્પણ કરવો, એ વિકટ પ્રક્રસ્તાનો ઉત્તર મેળવવાની વિચારમાળા દરમ્યાન મહને આપનો પરિચય થયો. એ પરિચય દ્વારા હું જાણી શક્યો, કે આપનો જૈન ધર્મ પ્રત્યે વિરત ગ્રેમ છે. જૈન સાહિત્યકારોને ઉત્તેજન આપી જૈન સાહિત્ય વિકાસમાન થયેલું જેવાના આપ સુંદર મનોરથો સેવો છો, એટલું જ નહિ પણ સમય સમય પર આપ સાહિત્યકારોને ઉત્તેજન આપી સક્રિય સાથ આપો છો.

વળી આપ ધંધાર્થી કલકૃતા જેવા દૂરતા ક્ષેત્રમાં વસતા હોવા છતાં, આપ આપનું ધાર્મિક નિસ્કર્તવ્ય-સામાયિક, ગ્રલુસ્ટમરણ્ણાદિ અસ્થલિતપણે બજાવ્યે જવ છો, તેમજ આપ કલકૃતાના રથા. જૈન સંધમાં હમેશાં આગેવાનીભર્યો ભાગ લઈ ભગવાન મહાવીરના શાસનરક્ષણમાં સુંદર ક્ષાળો આપી રહ્યા છો. એ વગેરે આપના ઉદ્ધાર અને પ્રશંસનીય કાર્યોથી આકર્ષણીં ને “જૈનાગમ કથાકેષ” નામનું આ પુસ્તક હું આપને ગ્રેમપૂર્વક અર્પણ કરી કૃતાર્થ થાડું છું.

—શ્રુતનાલિ.

સ્વ. હીરાચંદલાઈ ઠાકરશી શાહનો કુંકુ જીવન પરિચય

ચોટીલા (કાડીયાવાડ) ના સ્થા. જૈન સમાજમાં એક યશસ્વી, ધાર્મિક અને પ્રેરણાત્મક જીવન વિતાવી જનાર સ્વ. શ્રી હીરાચંદલાઈ ઠાકરશી શાહનો જીવન પરિચય આ ધાર્મિક કથાનકવાળાં પુસ્તકમાં આપતાં અમોને ધણોજ આનંદ થાય છે. આપણે આપણાં પૂર્વનેનાં રસાત્મક ધાર્મિક જીવન વૃત્તાંતો વાંચીએ, તે સાથે આધુનિક યુગના કો' વીરલાઓ પણ એ મહાપુરુષોના જીવનમાંથી પ્રેરણાની ભીડી સુવાસ લઈ, પોતાનું જીવન સુવાસિત બનાવી શકે છે; એ જાણવા ભારે લે આપણે ઉદ્ઘૂરુતા થઈએ તો, પ્રાચીન અર્વાંચીન ચરિત્રોના મેળથી આપણને વધારે પ્રેરણા મળે એ સ્વાભાવિક છે.

ચોટીલામાં શ્રી ઠાકરશી મોતીચંદનું કુંભ જાહીરીનું છે. શ્રી. હીરાચંદલાઈ, રાયચંદલાઈ અને નેમચંદલાઈ એ તેમના સુપુત્રો છે. જેમાંના શ્રી રાયચંદલાઈ હાલ ચોટીલામાં અને શ્રી નેમચંદલાઈ કલકત્તામાં કાપડનો ધિક્કો બ્યાપાર કરી રહ્યા છે. તે સાથે આ બંને સજજ્ઝનો ધર્મકાર્યમાં પોતાનો યથાશક્ય સુંદર ક્ષણો આપી રહ્યા છે.

સૌથી મોટા શ્રી હીરાચંદલાઈ હતા, તેમનો જન્મ સં. ૧૮૪૬ ના ક્ષાગળું સુદ ૧૩ ના રોજ ચોટીલામાં થયો હતો. તેમના માતુશ્રી મેંધીબાઈ હાલ હ્યાત છે. વૃદ્ધ ઉંમર છતાં તેમની ધાર્મિક ભાવનાઓ અતિ પ્રશંસનીય છે. તેમના પિતાશ્રી પણ ધર્મસંસ્કાર અને ધાર્મિક ઉચ્ચ વિચારોથી દ્વિતી હતા. આમ માતાપિતાના સુસંસ્કારો પુત્રમાં ઉત્તરે, એ સહજ કુમારુસાર સદ્ગત હીરાચંદલાઈમાં પણ ધાર્મિક સંસ્કારો સારી રીતે વિકાસ પામ્યાં હતાં.

ધર્મભાવનાની સાથે તેમનામાં ધંધાની સાહસિકતા પણ ધણી સારી હતી. શુજરાતી અભ્યાસ પૂરો કરી તેઓ ચોટીલાની પોતાની કાપડની ફુકાનમાં જોડાયા, અને ધીરે ધીરે તે વ્યવસાયને સારી રીતે ખીલવ્યો; એટલું જ નહિ પણ તેમણે વડિલ અન્ધુ તરિકેની પોતાની ઇરજ અદા

કરતાં, પોતાના બંને ભાઈઓને પણ દુકાનમાં પોતાના હાથ નીચે રાખી હોશિયાર બનાવ્યા.

સં. ૧૯૭૮ ની સાલમાં ધંધાના વધુ વિકાસાર્થી તેઓ કલકત્તા ગયા. જ્યાં તેમણે પોતાની ઉદ્ઘારતા, પ્રાભાણિકતા અને સાહસિકતા વડે કાપડની દુકાન સારી રીતે જમાવી.

માત્ર ધંધામાંજ આગળ વધી પૈસા પ્રાપ્ત કરવાં, એવો એકજ માત્ર ઉદ્દેશ તેઓનો ન હતો. પોતાના ગરીબ સ્વધર્મી બંધુઓને આર્થિક મદદ, ક્રેણવણીમાં સહાય વગેરે ગુમદાન પણ તેઓ કરતા, હુંમેશાં પ્રાતઃકાળે સામાયકત્વત કરવું, દુરસદના વખતે ધાર્મિક વાંચનનું અધ્યયન કરવું, ધાર્મિક સાહિત્ય તથા જીવદ્યાદિ શુલ્ક કાર્યોમાં યથા શક્તિ છાળો આપવો, સાધુસંતની વૈયાવર્ય-સેવાલક્ષ્મિ કરવી, વગેરે પવિત્ર જીવન ગાળવા માટે કરવાં ચોણ્ય કાર્યો કરીને તેઓ સંતોષ પામતા. દુંકમાં તેમના જીવનનાં છેક્ષાં દશ વર્ષો વ્યવહારિક પ્રવૃત્તિ કરતાં ધાર્મિક પ્રવૃત્તિમાં વધારે ગયા હતા, એમ કહીએ તો તેમાં લેશ પણ અતિશયોક્તિ નથી.

સાધારણ સ્થિતિમાંથી આગળ વધ્યા, ત્યારે તેમને ધાર્મિક કાર્યોમાં જરા વધારે ઉદ્ઘારતાથી એ પૈસા ખર્ચવાની છચ્છા થઈ અને ચાટીલામાં ધાર્મિક અને ક્રેણવણી વિષયક કાર્યોમાં યત્કિયિત મદદ આપવાની પોતાની છચ્છા તેમણે પોતાના ભાઈઓને જણાવી. બંને ભાઈઓએ તેમની આ છચ્છા સહર્ષ વધાવી લીધી; પણ ‘ધાર્યુધણીનું થાય’ એ નિયમ મુજબ હીરાચંદભાઈ નહોતા જણુતા કે માત્ર ૪૬ વર્ષની ઉંમરે મારે એકાએક આ જગતમાંથી વિદ્યાય લેવી પડ્યો; તેઓ નહોતા જણુતા કે મહારા સ્વહસ્તે નહાની સરખી સખાવત કરી હું સંતોષ મેળવો શકીશ કે કેમ?

સં. ૧૯૮૨ ની સાલ ચાલતી હતી. એ વખતે હીરાચંદભાઈ કલકત્તામાં હતા. તે વખતે તેઓ સહજ બિમાર પડ્યા. આ બિમારી પણ એવી ન હતી, કે જે જીવદેશું નીવડે. પણ હીરાચંદભાઈ માટે તો ‘આદર્યાં’ અધુરાં રહે, ને હરિ કરે સો હોય’ એવુંજ કાંઈ નિર્માણ થયું હતું; તેથી તેઓ એજ અરસામાં સં. ૧૯૮૨ના

દ્વાગણું શુદ્ધ ૨ ને દિવસે અપોરના એક વાગે એકાએક આ દ્વાતી દુનિયાનો ત્યાગ કરી ગયા.

તેમની ધારણાઓ લલે તે વખતે અધુરી રહી, પણ તેમની ગ્રેરણાઓ અધુરી રહેવા સરળાઈ ન હતી. એટલે તેમના બંધુઓ અને પુત્રોએ મળી તેમની એ ધૂચિઠા તેમના ભૂત્યુઆદ પૂર્ણ કરી. તેના ઇન્ફ્રાસ્ટ્રક્ચર તેમના બંધુઓએ ચોટીલાની કન્યાશાળામાં પોતાના માતુશ્રીના નામથી “શ્રી મોંદીબાઈ રમ” બંધાવી આપ્યો છે, તેમજ ત્યાંના સ્થાન જૈન ઉપાશ્રયમાં (ઝ. ૩૦૦૦) ના ખર્ચે ઉપરનો માળ બંધાવ્યો છે, ઉપરાંત સહૃદાતના પુષ્ય-સમરણાર્થે તેઓ ધાર્મિક પારમાર્થિક કાર્યોમાં યત્કિંચિત ખરચ્યે જાય છે; એ ખરેખર પ્રશંસનીય છે.

શ્રી રાયચંદ્રભાઈ અને નેમચંદ્રભાઈ બહેણું સંસ્કારમથી કુદુંબ ધરાવે છે. તેઓ પણ પોતાનું જીવન પ્રમાણિકપણે વીતાવી, પોતાની ધર્મ અને સમાજ પ્રત્યેની દૂરજો બળવ્યે જાય છે.

મહુંમદ હીરાચંદ્રભાઈ પોતાની પાછળ ભાઈ કેશવલાલ, ચંપકલાલ, ધીરજલાલ, બાળુલાલ વગેરે ચાર પુત્રો અને એ પુત્રીઓ વગેરેનું બહેણું કુદુંબ મૂક્તા ગયા છે, જેઓ બંધા સંસ્કારી છે. તેમાંના ભાઈ કેશવલાલ તથા ચંપકલાલ કલકત્તા ખાતે બંધામાં જોડાયલા છે; અને તેઓ પણ યત્કિંચિત ધાર્મિક દૂરજો બળવે છે.

આમ આખા સંસ્કારાત્મક સમૃદ્ધ કુદુંબનો પરિયય આપ્યા પણી ધૂચિઠીએ કે સહૃદાતના હીરાચંદ્રભાઈ પોતાના ઉજાજવળ ધાર્મિક જીવનની જે સુવાસ પોતાના જીવનમાં મૂક્તી ગયા. અને જે ગ્રેરણા તેમણે તેમના કુદુંબી જનોને આપી, તે ધાર્મિક ગ્રેરણામાં તેમના કુદુંબીજનો ઉત્તરોત્તર અલિવૃદ્ધિ કરી, જૈન ધર્મને દીપાવી, શાસનોદ્ધારનાં સત્કાર્યો કરે અને આપણે પણ સહૃદાતના ધર્મભય સરળ અને પ્રમાણિક જીવનનું અનુકરણ કરી, ધાર્મિક રસાત્મક જીવન ગાળીએ, એજ અભ્યર્થના ! ડું શાંતિ :

—જીવનલાલ.

પ્રસ્તાવના.

આજથી બરોઅર પાંચ વર્ષ પહેલાં મહારા તરફથી જૈન સિદ્ધાન્તની વાર્તાએ ભા. ૧ લો અહાર પડેલો, જેમાં જૈનાગમમાં આવેલી ૬૮ કુંક વાર્તાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો અને એ અત્ય પ્રયાસથી પણ જણાયું હતું કે જનરૂપિ ભ. મહા-વીરના શ્રીમુખે ઉગ્રચારાયલી વાણીનું રહસ્ય જણવા કેટલી આતુર છે, અને તેની વધુ પ્રતીતિ તો લારે જ થઈ કે ઉપર્યુક્ત પુરસ્તક ખ્લાસ થતાં હજુથે તેની માગણી ચાલુ જ છે. આ દરમ્યાન ધર્મજ્ઞાસુ એવા એક વર્ગ તરફથી એક એવા પ્રકારની માગણી થતી કે જૈનાગમમાં આવેલો સમર્સત કથા વિભાગ જનતાની જણ માટે પ્રકટ કરવામાં આવે, તો ધર્ણો જ લાલ થાય તેમ છે, એટલું જ નહિ પણ ધર્ણાએ સાધુ વંદણા વાંચે છે, મુખપાઠ બોલે છે, પરન્તુ તેમાં દર્શાવેલા મહાન આત્માઓની નામાવલી સિવાય, તેમનાં અપૂર્વ, ધાર્મિક અને બોધપ્રદ ચરિત્રની ક્ષેત્રપણ માહીતિ હોતી નથી. આથી આ પ્રકારનો જનતાનો વિચાર સ્વપરહિતાર્થે મહને ખૂબજ ઉપયોગી લાગ્યો, અને અનુકૂળ સંચોગો અને સમય પર આ જાતનો પ્રયાસ કરવાનો મેં નિર્ણય કર્યો.

એવા સમયમાં વીસલપુરવાળા આપણા એક સ્વધર્મીખન્ધું શ્રી નગીનદાસ હઠીશંગ શાહ (પેનશનર મહેતાજ) દારા જણવામાં આવ્યું કે તેઓએ આ જાતનો પ્રયાસ કર્યો છે; અને સમર્સત આગમ તપાસી તેમાંથી તેઓએ મહાપુરુષો અને સતીઓનાં કુંક ચરિત્રાની તારવણી કરી છે. એ હસ્તલિખિત નોંધ તપાસતાં તેમાં મને ધર્ણી ઉણુપ લાગી, ચરિત્રા અધુરાં તથા ભાષાશુદ્ધિની જરૂરિયાતવાળાં જણાયા. આ બધા પ્રકારની તુટિએ ફૂર કરો, સાધારણ રીતે સમજ શકાય, જનતા આગમના કથા સાહિત્યને જણી શકે, અને મામજમાં એક સુંદર અંથ તૈયાર થઈ શકે તેવું હોય તો શ્રી. માસ્તર સાહેબે તેમનો પ્રયાસ કેબે લાગે, ઉપકારક અને એ

હેતુથી આધાર માટે મને એ હુસ્તલિભિત યાદી આપી, અને અતિથિ-ચેકિન વગર કંડું તો આ ગ્રંથ અદ્વય પ્રખાસે, આટલો વહેદો પ્રગટ કરવામાં કારણુભૂત હોય તો તે શ્રી. નગીનદાસલાઈને આલારી છે. તેથી તેમના અને મહારા અગાઉના પુર્તકના આધારથી, તેમજ અન્ય અનેક પુર્તકોના સંશોધનથી આ ગ્રંથ તૈયાર થવા પામ્યો છે.

આપણું આગમ સાહિત્ય ધ્યાન વિશાળ છે. તેનાં એકેક શ્લોક પર, એક એક કથા પર વિવેચન કરવા એસીએ, તો વર્ષોના વર્ષો પસાર થતાં પણ તેનો પાર આવે તેમ નથી. તેમાં એટલું રહસ્ય, એટલો અધો ન્યાય, એટલો અધો બોધ છે કે ખરેખર શ્રદ્ધાવંત મનુષ્ય એકેક વિષયને વિચારપૂર્વક મનન કરે, તો તેનાં હૃદયમાં આનંદની વિચિયો ઉછળી આવે, વીરવાણીની ખૂબીનું મહત્વ સમજાય, સંસારની અસારતાનું ભાન થાય અને આ જગતમાં સહેલે કરવાં યોગ્ય કાર્યોનું યથાર્થપણું સમજાય. પરિણામે મનુષ્ય સમ્યક્ષજ્ઞાન, દર્શાન, ચારિત્ર અને તપની આરાધના કરી સંસાર પરિત કરી શકે; જન્મ ભરણનાં દુઃખોથી મુક્ત થઈ શકે.

લ૦ મહાવીરે ઉપદેશલી વાણીમાંથી શ્રી ગણુધર મહારાજાઓએ જીવને સમ્યક્ષજ્ઞાન દર્શાનની પ્રાપ્તિ માટે અને જનકલ્યાણાર્થ સૂત્રોની ચાર અનુયોગમાં ગુંઘળી કરી છે. (૧) દ્રવ્યાનુયોગ (૨) ગણિતાનુયોગ (૩) ચરિતાનુયોગ અને (૪) ચરણ કરણાનુયોગ. તેમાં ચરિતાનુયોગ સુગમ હોવાથી મનુષ્યની સમરણશક્તિ બહુધા જલ્દીથી અને રૂસપ્રદ રીતે સ્પર્શ કરી શકે છે; એટલું જ નહિ પણ પ્રાય: મનુષ્યનું જીવન અનુકરણ કરવા પ્રતિ વધારે દોરાયલું હોઈ, અનુકરણ માર્ગ વળે છે, અને તેથી તે પોતાના જીવનની તુટિયો નિહાળી, તેને સુધારી યથાર્થ પુરુષાર્થ વડે આત્મહિત સાધે છે. આ કારણે જ આજે જીવનચરિત્રાનાં પુર્તકોને વધુ મહત્વ આપવામાં આવે છે.

આમાંના એક એક ચરિત્રને ધારીએ તેટલું લંબાવી શક્કાય છે, પરન્તુ એમ કરવા જતાં એક જ અન્યમાં સંપૂર્ણ માહીતિ આપી દેવાની દૃઢિયા પાર પડી શકે નહિ, તેથી જ સામાન્ય જરૂરિયાતની માહીતિ આપવાનો આ ગ્રંથમાં પ્રયત્ન કર્યો છે.

આ અંથમાં તર આગમોભાંના કથા-સાહિત્યની માત્ર ૨૪૩ વાર્તાઓ આપવામાં આવી છે, અને અમારે મને આમાં જાણવા લાયક લગભગ સંઘળી વાર્તાઓનો સમાવેશ થાય છે. કેટલાંક પાત્રોનું ચરિત્ર મુખ્ય વાર્તાના અંતરભાગમાં ગૌણ વાર્તા તરીકે આવી જાય છે. દાખલા તરીકે હથકુમાર, વિહથકુમાર, પોટિકું વગેરે; તેથી તે અલગ આપેલ નથી. ઉપરાંત કેટલાંક હુંક ચરિત્રો કે જેની સ્થળ, દીક્ષા અને મોક્ષ સિવાય અન્ય કર્ણ માહીતિ સૂત્રોમાં નથી, તે આમાં ઉધ્ધૃત કર્યા નથી. દાખલા તરીકે શ્રેણિક રાજના પુત્રો તથા રાણીઓએ લીધેલી દીક્ષા અને તેમનું મોક્ષગમન, કૃષણની રાણીઓની દીક્ષા અને તેમનું મોક્ષગમન, કેટલાક સાર્થવાહોના પુત્રોની હીક્ષા અને તેમનું મોક્ષગમન, વગેરે.

આ કથાઅન્થમાં ૨૪ તીર્થીકરો, ચક્રવર્તીઓ, બળહેવો, વાસુહેવો, પ્રતિવાસુહેવો, ભ. મહાવીરના લક્ષ્મારાજાઓ, દશ ઉપાસકો, ચાર પ્રત્યેક ખુદ, ૧૧ ગણુધરહેવો, અનેક તપસ્વી મુનિવરો અને મહા-સતીઓ, આદર્શ ગૃહસ્થો અને સન્નારીઓ વગેરેના વૃત્તાતો આપવામાં આવ્યા છે. તે સાથે કથાઓ પરથી નીકળતો ન્યાય-સાર પણ કેટલીક વાર્તાઓને અંતે આપવામાં આવ્યો છે, જેથી વાચકને પાત્રોના ઉજનજવળ અને મ્લાન એ બંને પ્રકારના ઉલ્ક્ષેખનીય જીવનમાંથી સુયોગ્ય પ્રેરણા મળી શકે.

જેકે આમાંની પ્રત્યેક કથાની નીચે સૂત્રાધાર ટાંક્યો નથી; પણ લગભગ આમાંની ખોટા ભાગની કથાઓ શ્રી અગવતી, ઉપાસક દશાંગ, સૂત્રકૃતાંગ, નિર્યાવલિકા, અનુત્તરોવવાઈ, રાતા, અંતગડ, વિપાક, ઉત્તરાધ્યયન આદિ સૂત્રોની છે. માત્ર થોડી એક કથાઓ જેવી કે-સુલદા, સ્થૂળાલદ, સુદર્શન, વગેરે કથા અંથની છે. બીજી થોડી એક વાર્તાઓ જેનું આગમમાં પણ અધુરે ચરિત્ર જોવામાં આવે છે, અને તે પુથ્ર પુથ્ર સ્થળો થઈ પૂર્ણ તારવી શકાય છે તેવાં થોડાંક ચરિત્રોની પશ્ચાત અને અધુરી હકીકત અંથ દારા મેળવીને પૂર્ણ કરવામાં આવી છે, તે સાથે ન્યાય

જાળવવા ખૂબ જ લક્ષ રાખવામાં આવ્યું છે. છતાં આગમથી કદાચ વિરસ્ક જતી કોઈ વાર્તા માલમ પડે તો વિદ્યાનો સુચિત કરશે, કે જેથી ખીજ આવતી સમયે યથાર્થ સંશોધન કરી શકાય.

આ કથાઅંથની મુદ્ર શુદ્ધ માટે ખૂબ જ ડાળજ રાખવામાં આવી છે, છતાં શાધ્રતાને લીધે દણ્ઠદોષ અને પ્રેસદોષને અંગે રહેવા પામેલી ભૂલો વાયકો સુધારી કરેશે. અલગ મુદ્ર શુદ્ધ આપવામાં આવી નથી. મુખ્ય શુદ્ધ અને પુરવણી આ ગ્રંથને છેડે આપવામાં આવી છે.

આ પુરસ્તક આદંત તપાસી મને યોગ્ય સૂચનો અને સલાહ આપવામાં દરિયાપુરી સંપ્રદાયના વિદ્યાન મુનિશ્રી હર્ષચંદ્જ સ્વામીએ પોતાના અમૂલ્ય સમયનો જે લોગ આપ્યો છે, તે માટે હું તે વિદ્યાન મુનિનો અંત:કરણપૂર્વક આલાર ભાનું છું. તેમજ મારાં આ પ્રકાશન માટે, પ્રેમપૂર્વક સહકાર આપી, સારી સંખ્યામાં અગાઉથી ગ્રાહકો થઈ જે જે સ્વધર્મી બંધુઓએ આ ધાર્મિક ચરિત્રયુક્ત પુરસ્તકને અપનાવ્યું છે, તે અધા બંધુઓનો તથા ચોટિલાનિવાસી શ્રી રાયચંદ્લાઈ ડાકરશી તથા નેમચંદલાઈ ડાકરશી કે જેઓએ આ પુરસ્તકની સારી નકલો ખરીદીને, મને પ્રેતસાહિત કર્યો છે; તેમનો હું સહેદ્ય ઉપકાર ભાનું છું, અને ધ્યક્ષર પાસે યાચું છું કે ધાર્મિક પ્રકાશનો વડે ઉત્તરોત્તર જૈનસમાજની સાહિત્યસેવા બળવવાનું પ્રભુ મને બળ આપે.

અંતમાં મહારા અદ્ય અભ્યાસને અંગે આ પુરસ્તકમાં રહી ગયેલી તુટિઓ બદલ વિદ્યાન વાયકો ક્ષમા કરશે, અને સાથે સાથે પ્રેરણાત્મક ચરિત્રાના વાયન, મનન અને નિદિષ્યાસુનથી જૈન લગિનીઓ અને બંધુઓ યોગ્ય પ્રેરણાઓ મેળવી સ્વહિત સાધવા પ્રયત્નશીલ બનશે, તો મહારા આ પ્રયાસ કેટલેક અંશે સક્ષણ થયો ગાણ્યાશે. ધર્ત્યલમ્બ, કિ અહુના સુરેષ !

ચૈત્ર શુક્લાષ્ટમિ : ૧૯૮૩ } શ્રી સંધનો સેવક,
પંચભાઈની પોળ : અમદાવાદ } જીવનલાલ છગનલાલ સંઘવી

આનુક્રમણિકા.

વાર્તાનું નામ	પૃષ્ઠ	વાર્તાનું નામ	પૃષ્ઠ
(અ)		(આ)	
અક્રમિત	૧	અરણિક	૧૭
અમિલૂતિ	૧	અરનાથ	૧૮
અયળ	૨	અલખરાજ	૧૯
અયળ બળહેવ	૨	અરિષ્ટનેમિનેમનાથ	૧૯
અયળ ભાતા	૨	અદ્રોલ	૨૨
અજીતનાથ	૨	અર્હન્નક	૨૨
અજીતસેન	૩	અન્નુંનમાળી	૨૩
અતિઅળ	૪	અપાડાભૂતિ	૨૫
અતિમુક્તા	૪		
અતિમુક્તા કે અધ્વિંત	૫	આદ્રેકુમાર	૨૭
અદીનશનુ રાજ	૭	આનંદ ગાથાપતિ	૨૮
અનાથી મુનિ	૮	આનંદ બળહેવ	૩૧
અનાદિષ્ટિ	૧૦	આનંદકુમાર	૩૧
અનિક્ષસેન	૧૦	અંગતિ ગાથાપતિ	૩૨
અનિરુદ્ધ	૧૦		
અનંતનાથ	૧૧	(ઇ)	
અનંતસેન	૧૨	ધૃષ્ણિકાર રાજ	૩૨
અલગગસેન ચોર	૧૨	ધ્રદભૂતિ (ગૌતમ)	૩૩
અલયકુમાર	૧૩	ધૃતાચીકુમાર	૩૪
અલિય	૧૪		
અલિયંદ	૧૫	(ઉ)	
અલિનંદન	૧૫	ઉગ્રસેન રાજ	૩૭
અધ્વિંતા સુકુમાલ	૧૬	ઉજાવાળાકુમાર	૩૮
		ઉજિયકુમાર	૩૮

ઉદાહનરાજ	૪૧	કૃષ્ણારાણી	૭૭
ઉદાહન (૨)	૪૩	કૃષ્ણ વાસુદેવ	૭૭
ઉંઘરદત	૪૩	કૃષ્ણકુમાર	૮૦
(ઋ)		કુંથુનાથ	૮૦
અધિબદ્ધ આલથુ	૪૫	કુષેરકુમાર	૮૧
અધિબદ્ધેવ	૪૬	કુંભરાજ	૮૧
અધિવિદાસ	૪૮	કુંડ્યોલિક	૮૨
(અ)		કેશીસ્વામી	૮૨
અંનુ	૪૮	કૈદે	૮૫
અંજના	૪૮	કૈલાસ ગાથાપતિ	૮૫
અંધક વિષ્ણુ	૫૪	કાણિક (અજાતશત્રુ)	૮૫
અંધડ પરિપ્રાજક	૫૪	કૌશલ્યા	૮૬
અંધડ સન્યાસી	૫૬	કંસ	૮૬
(ઝ)			
(ક)			
ક્રીલમુનિ	૫૭	ખંધક મુનિ	૮૧
ક્રમળાવતી	૬૦	ખંધક સન્યાસી	૮૪
કરકંડુ	૬૧	(ગ)	
કલાવતી	૬૬	ગર્ગાચાર્ય	૮૫
કામહેવ આવક	૭૦	ગંગસુકુમાર	૮૬
કાર્તીક શેઠ	૭૨	ગર્દભાળીમુનિ	૧૦૨
કાલીકુમાર	૭૩	ગોશાળો	૧૦૩
કાલીરાણી	૭૫	ગોલદ શેઠ	૧૦૬
કાલીકુમારી	૭૬	ગૌતમ (૨)	૧૦૬
કાસવગાથાપતિ	૭૭	ગૌરીરાણી	૧૦૭
ક્રીતિંધીર્ય	૭૭	ગંગદત	૧૦૭

(ચ)			
ચિત્ત અને અંગદા	૧૦૮	જિનરક્ષ, જિનપાલ	૧૪૫.
ચુલ્લણીપિતા	૧૧૭	જરણશોડ	૧૪૮
ચુલ્લણી શતક	૧૧૮	જુહલશાવક	૧૪૯.
ચેડારાજ (ચેટક)	૧૧૯	જંખુસ્વામી	૧૫૦.
ચેલણા (ચિલણા દેવી)	૧૧૬	(ઢ)	
ચંડુ	૧૨૨	દંદણકુમાર	૧૫૨.
ચંડુશિક સર્વ	૧૨૪	(ત)	
ચંદનબાળા	૧૨૬	તામલી તાપસ	૧૫૩.
ચંદ્રધારા	૧૩૦	ત્રિપૃષ્ઠ વાસુદેવ	૧૫૪.
ચંદ્રપ્રલુ	૧૩૧	ત્રિશલા દેવી	૧૫૫.
ચંદ્રયશ	૧૩૨	તેતલી ગ્રધાન	૧૫૬.
(ઝ)		(થ)	
જમાલી	૧૩૨	થાવર્ચા પુત્ર	૧૫૮.
જથ્યધોષ	૧૩૪		
જથ્યંતી	૧૩૬	(દ)	
જથ્યસેન	૧૩૭	દત્ત	૧૬૨.
જરાકુમાર	૧૩૮	દભયંતી	૧૬૨.
જરાસંધ	૧૩૯	દશરથ રાજ	૧૬૩.
જસા	૧૪૦	દશાર્ણાલદ	૧૬૪.
જરોબદ	૧૪૦	દ્વિપૃષ્ઠ	૧૬૫.
જલીકુમાર	૧૪૨	દ્વિમુખ (પ્રત્યેક યુદ્ધ)	૧૬૬.
જિતશનુ રાજ અને		દેવદત્તા	૧૬૭.
સુખુદ્વિગ્રધાન	૧૪૨	દેવકી	૧૭૦.
જિતશનુ	૧૪૪	દેવાનંદા	૧૭૦.
જિનદાસ	૧૪૫	દ્રૌપદી	૧૭૧.

(ઘ)			
ધન્યકુમાર (ધનો)	૧૭૬	પ્રભવસ્વામી	૨૧૨
ધનાચણુગાર	૧૮૦	પ્રભાવતી	૨૧૩
ધના સાર્થવાહ	૧૮૧	પ્રભાસ ગણુધર	૨૧૩
ધર્મનાથ	૧૮૫	પ્રદેશી રાજ	૨૧૪
(ન)			
નમિ, વિનમિ	૧૮૫	પ્રસભયંડ રાજખિં	૨૨૨
નમિનાથ	૧૮૬	પાર્શ્વનાથ	૨૨૪
નમિરાજ (પ્રત્યેકખુદ)	૧૮૭	પ્રિયદર્શના	૨૨૬
નળરાજ	૧૯૩	પુંડરિક	૨૨૭
નારદ	૧૯૪	પુરુષ પુંડરિક	૨૨૮
નિર્ગંતિ (પ્રત્યેકખુદ)	૧૯૪	પુરુષસિંહ	૨૨૮
નિપધનુકુમાર	૧૯૬	(બ)	
નંદ અળહેવ	૧૯૮	અળભદ્ર	૨૩૦
નંદ ભણીયાર	૧૯૯	આલી અને સુંદરી	૨૩૦
નંદિની પિતા	૨૦૦	ઝૂષરપતિ દત્ત	૨૩૨
નંદીવધ્રંન	૨૦૧	ઝૂષપુત્રી દ્વી	૨૩૩
નંદીષેષુ મુનિ	૨૦૨	(ભ)	
નંદીષેષુ કુમાર	૨૦૫	ભરત અને ખાણાળ	૨૩૪
(પ)		ભૂગુ પુરોહિત	૨૩૮
પ્રતિખુદ	૨૦૬	ભક્ત અળહેવ	૨૩૮
પદ્મકુમાર	૨૦૬	ભોજ વિષણુ અંધક વિષણુ	૨૩૮
પદ્મપ્રભુ	૨૦૭	(મ)	
પદ્માવતી	૨૦૮	મધુવ ચક્રવર્તી	૨૩૮
પ્રદુન	૨૧૦	મરિચિ	૨૩૯
		મરુદેવી માતા	૨૪૦

મહલીનાથ	૨૪૦	(વ)
મહાપદ્મ	૨૪૫	
મહાવીર ગ્રલુ	૨૪૬	વરણ ૦૪૯ ગણુધર
મહાશતક	૨૫૦	વાયુભૂતિ ગણુધર
મહાસેન કૃષ્ણાકુમારી	૨૫૨	વાસુપૂજય
મુનિ સુવત સ્વામી	૨૫૨	વિજય અળદેવ
મૃગપુત્ર (વૈરાગ્યવંત)	૨૫૩	વિમળનાથ
મૃગલોઠીએ (મૃગપુત્ર ૨)	૨૫૫	
મૃગાવતી	૨૬૦	(શ)
મેઘકુમાર	૨૬૨	શાલિષી પિતા
મેતાર્થમુનિ	૨૬૮	શાંતિનાથ
મેતાર્થ ગણુધર	૨૭૦	શાળીલદ્ર
મૌર્યપુત્ર ગણુધર	૨૭૦	શિવરાજ ઋષિ
મંડિત ગણુધર	૨૭૧	શ્રીદેવી
		શિતળનાથ
		શ્રેયાંસનાથ
રહનેમી-રાજેમતી	૨૭૧	શ્રેયાંસકુમાર
રામ	૨૭૪	શ્રેણીક રાજ
રાવણ	૨૭૫	શાંખ રાજ
રિક્ભિમણી	૨૭૫	શાંખ અને પોખ્લી
રૂપી રાજ	૨૭૬	(સ)
રૈવતી	૨૭૭	
રેણિણી	૨૭૮	સદ્ગાલપુત્ર
રેણિણીયો ચોર	૨૮૨	સનંતકુમાર ચક્રવર્તી
		સગર ચક્રવર્તી
		સગડ કુમાર (શક્ત)
(લ)		સમુદ્રપાળ મુનિ
લક્ષ્મણ	૨૮૩	૩૦૧

સ્વયંભૂ	૩૦૬	સુષુમાદારિકા	૩૨૪
રથૂળીલદ	૩૦૭	સુલસા	૩૨૭
સીતા	૩૧૧	સુભૂમ ચક્રવર્તી	૩૨૬
સુકોશલમુનિ	૩૧૨	સુવિધિનાથ	૩૩૦
સુદર્શન (બળહેવ)	૩૧૪	સોમિલ	૩૩૦
સુધર્માસ્તવાભી	૩૧૪	સોરિયદત મચ્છીભાર	૩૩૧
સુદર્શન રોડ	૩૧૫	સંયતિ રાજ	૩૩૩
સુપ્રભઅળહેવ	૩૧૭	સંભવનાથ	૩૩૪
સુપાશ્ચનાથ	૩૧૭	(હ)	
સુખાહુ કુમાર	૩૧૮		
સુભદ્રા	૩૨૦	હરિસેન (ચક્રવર્તી)	૩૩૬
સુમતિનાથ	૩૨૩	હરિતપાળ	૩૩૬
સુરહેવ	૩૨૩	હરિકૃશાળા (મુનિ)	૩૩૬



શ્રી

જૈનાગમ કથાકોષ



૧ અકંપિત

વિમળાપુરી નગરીમાં દેવ નામના આલણની જ્યન્તી નામની ખીથી 'અકંપિત' નામનો પુત્ર થયો હતો. વેદાદિ ગ્રંથોમાં પારંગત થયા પછી, તે ગૌતમ નામના આલણ સાથે યજમાં ગયો હતો. તેને 'નારકીનું અસ્તિત્વ હરો કે નહિ' એ સંઅધી મહોદી શંકા હતી. લગવાન મહાવીરના પરિચયમાં આવતાં પ્રલુબે તેની શંકાનું સમાધાન કર્યું; આથી તેણે ગૌતમની સાથેજ લગવાન મહાવીર પાસે દીક્ષા અણુણું કરી. અકંપિત મુનિ પ્રલુબ મહાવીરના આડમા ગણુધર ગણાયા અને તે મોક્ષમાં ગયા.

૨ અભિનભૂતિ.

ગોયર નામક ગ્રામમાં વસુભૂતિ આલણની પૃથ્વી નામની ખીથી 'અભિનભૂતિ' ઉત્પત્ત થયેલા. તે ધંદભૂતિના નહાના ભાઈ હતા. ધંદભૂતિ અથવા ગૌતમ સાથે તેઓ એકવાર સોમિલ આલણના યજમાં ગયા હતા. તેમની એ માન્યતા હતી કે:- 'કર્મ' જેવી વસ્તુ જ નથી, અને જે હોય તો અમૂર્તમાન જીવ શા રીતે બાંધે? તેનો આ સંશ્ય લગવાન મહાવીરે એવી રીતે ટાજ્યે કે:- 'કેવળગ્નાતીઓ કર્મ' પ્રત્યક્ષ દેખે છે અને છદ્મસ્થ જીવો અનુમાનથી જાણે છે. આથી સંતોષ પામી અભિનભૂતિએ ગૌતમ સાથેજ દીક્ષા લીધી, અને ખીજ અણુધરપદે સ્થપાયા. અહિંસા, સંયમ અને તપનું ઉત્કૃષ્ટ પાલન કરી તેઓ મોક્ષમાં ગયા.

૩ અચળ.

‘અચળ’ એ અંધક વિશ્વુના પુત્ર હતા. તેમણે પ્રભુ નેમનાથ પાસે દીક્ષા લીધી હતી. ૧૬ વર્ષની ઉત્ત્ર સંયમ આરાધનાને અંતે તેઓ મોક્ષમાં પદ્ધાર્યો. (અંતકૃત)

૪ અચળ બળદેવ.

પોતનપુર નામની નગરીમાં પ્રજાપતિ નામે રાજ હતો. તેની ભદ્રા નામની રાણીથી અચળ નામે બળદેવ થયો. તેમણે શ્રેયાંસનાથ પ્રભુના સમયમાં ચારિત્ર લઈ ૮૫ લાખ વર્ષનું આયુષ્ય ભોગવ્યું અને તેઓ મોક્ષમાં ગયા.

૫ અચળ ભાતા.

કૌશંખી નગરીમાં વસુ નામના ઘાણણુની નંદા નામની ખીથી ઉત્પન્ન થયા હતા. તેમને ‘પુષ્ટય અને પાપ’ સંખ્યાનો સંશય હતો. અ. મહાવીરે તેમનો તે સંશય ટાણ્યો, તેથી તેમણે જૈતમ સાથે દીક્ષા લીધી અને તપ્ય સંયમની આરાધના કરી મોક્ષમાં ગયા. તેઓ ભગવાન મહાવીરના નવમા ગણુધર હતા.

૬ અજિતનાથ.

વર્તમાન ચોવીસીના છેલ્દા તીર્થ્યકર. તેઓ વનિતા નગરીમાં જિતશરૂ રાજની વિજયાદેવી નામની રાણીની કુક્ષિએ, સર્વાર્થસિદ્ધ વિમાનમાંથી અનીને વૈશાક શુદ્ધ ત્રોજને દ્વારા ઉત્પન્ન થયા હતા. તે વખતે તેમની ભાતાને ચૈદ સ્વભન આવ્યા હતા. ગર્ભિકાળ પૂરો થતાં મહાશુદ્ધ આદ્યમે તેમનો જન્મ થયો. છાપન કુમારિકા દેવીએઓ આવી સ્રુતિકાર્મ કર્યું. ધૂન્દોએ જન્મોત્ಸવ ઉજવ્યો. પિતાને અતિ આનંદ થયો. અજિતનાથ ગર્ભમાં આવ્યા લારથી રાજરાણી પાસા રમતાં, વિજયાદેવોને પાસાની રમતમાં રાજ જીતી થક્યો ન હોવાથી

પુત્રનું નામ અજીતનાથ પાડ્યું. અજીતનાથ ૧૮ લાખ પૂર્વ સુધી કુમારપણે રહ્યા. ૫૩ લાખ પૂર્વ અને એક પૂર્વિંગનું રાજ્ય ભોગવ્યું. ત્યાર પછી પોતાના કાકાના દીકરા સગરને રાજ્ય સોંપી વરસી દાન આપવું શરૂ કર્યું. દાનમાં ૩૮૮૮૦ લાખ સૌનેયા (સુવર્ણ મહોરો) યાચકોને આપ્યા. (દરેક તીર્થિકર એટલું દાન આપે) મહા શુદ્ધિ ૬ ના દિવસે પ્રભુએ ચારિત્ર લીધું. ૧૨ વર્ષ સુધી છદ્રમસ્થતામાં રહ્યા પછી પોશ શુદ્ધ ૧૧ ને દિવસે શ્રી અજીતનાથ પ્રભુને કેવળજ્ઞાન થયું. તેમને સિંહસેન આદિ ૬૫ ગણુધરો હતા. તેમના સંધમાં ૧ લાખ સાધુ ૩૩૦ હજાર સાધીઓ, ૨૬૮ હજાર આવકો અને ૫૪૫ હજાર શ્રાવિકાઓ હતાં. સાધુઓમાં ૩૭૦૦ ચૈદ પૂર્વી, ૬૪૦૦ અવધિ જાતી અને ૨૨૦૦ કેવળજ્ઞાની હતા. ૧ લાખ પૂર્વમાં ૧ પૂર્વિંગ માં ૧૨ વરસ ઓછાં કેવળજ્ઞાન રહ્યું, એકંદર ૭૨ લાખ પૂર્વનું આયુષ્ય ભોગવી ૧૦૦૦ સાધુઓ સાથે ૧ માસના સંથારે તેઓ ચૈત્ર શુદ્ધ પાંચમે મેલ્લભાઈ ગયા.

૭ અજીતસેન.

અદ્વિત્પુર નગરમાં નાગ નામે ગાથાપતિને સુલસા નામની ઝી હતી. તેને નિભિત્તિયાએ કહ્યું હતું કે-' તારે ભરેલાં બાળક અવતરણે ', આથી તેણે હરિણગમેષી નામના દેવની આરાധના કરી. દેવે પ્રસન્ન થઈને તેનો સંતાપ ટાજ્યો. પૂર્વ ઝરણાનુઅંબના યોગે દેવે દ્વારકાના વસુહેવ રાજની દેવકી રાણીને જન્મતાં જીવતાં બાળકો ઉપાડીને સુલસાની કુક્ષિમાં મૂક્યાં અને સુલસાના મૃત બાળકો ઉપાડીને દેવકીની કુક્ષિમાં મૂક્યાં. એમ છ ગર્ભનું ઉલટસુલટ સાહરણુ કર્યું. બીજી તરફ દેવકીને જન્મતા પુત્રોનો નાશ કરવાનો કંસે નિશ્ચય કર્યો હતો, પરન્તુ દેવકીથી જન્મમાભનાં પુત્રોનું પુણ્ય પ્રલાવે આયુષ્યબળ લાંબુ હોવાથી આવો યોગ મળો આવેલો. શ્રી નેમનાથ પ્રભુનો ઉપદેશ સાંભળી સુલસાના અજીતસેન પુત્રે દીક્ષા લીધી.

જ્ઞાનજ્ઞના પારણાનો અભિગ્રહ લઈ ચૌદ્ધર્વનું રાન મેળવ્યું અને ખૂબ તપશ્ચિયો કરી. ૨૦ વર્ષ ચારિત્ર પણો એક માસના સંથારે તેમો શત્રુંજ્ય પર્વત પર સિદ્ધ થયા.

૮ અતિઅણ.

ભરત પછો આ નોણ રાજ અને મહાયશાના પુત્ર હતા. ભરતરાજની જેમ અતિઅણને પણ અરિસાભુવનમાં દૈવત્યગાન થયું હતું. (અંતકૃત)

૯ અતિમુક્તા.

દારિડાના ઉભસેન રાજને અતિમુક્તા નામે પુત્ર હતો. તેણે સમય જતાં દીક્ષા અંગીકાર કરી હતી. અતિમુક્તા સાધુ નિમિત્તશાખામાં પ્રવિષ્ટ હતા. વસુદેવ અને કંસને પરસ્પર અતિ ગ્રેમ હતો. તે ગ્રેમના બદ્ધલાભમાં કંસે પોતાના કાકા દૈવકરાજની દીકરી દૈવકીલુને વસુદેવ સાથે પરણાવી હતી. પરણીને પાછા ફરતી વખતે કંસે તે જન પોતાને ત્યા રોકી હતી. કંસની સ્વી જીવયશા અને દૈવકીલુ પરસ્પર વાર્તા વિનોદ કરતાં ગોખમાં ઘેઠા હતા. તેવામાં પ્રસ્તુત અતિમુક્તા મુનિ ત્યા ગોચરી અર્થે આવી ચડયા. જીવયશાએ મુનિની મશકરી કરતાં કહ્યું કે:—દ્વિયરજુ, પધારો. આપણે દૈવકીબાનાં લગ્ની ગાઈએ. આ સાંલળી મુનિ મૌન રહ્યા. જીવયશાએ કેરી કેરી ત્રણવાર આ પ્રમાણે કહ્યું. મુનિ સમતાના સાગર હતા, છતાં આ વખતે તેમનો સંયમ કાણુમાં ન રહી શક્યો. તે બોલ્યા:—જીવયશા ! શું જોઈને તું મારી મશકરી કરે છે ? તહેને તો ખખર નથી, પરન્તુ હું તને નિમિત્તઅણથી કહું છું કે:—“આ દૈવકીલુનો સાતમો બાળક તારા પતિના અને તારા બાપના કુળનો નાશ કરશે.” આમ કહી તરત જ અતિમુક્તા મુનિ ત્યાંથી ચાલી નીકળ્યા. જીવયશા જયશ્રાન્ત બની. (વધુ વૃત્તાન્ત કંસ ચરિત્રમાં) મુનિ આ સાહસ ક્યનનો પણતાપ કરી શુદ્ધ થયા અને એ જ લવમાં મોક્ષ પાણ્યા.

૧૦ અતિમુક્તા કે અધ્યવંત.

પોલાસપુર નગરમાં વિજય રાજની શ્રીહેવી નામની રાણીથી તે જન્મ્યા હતા. બાળપણમાં જયારે તેઓ ચોગાનમાં રમતા હતા, ત્યારે તેણે ગૌચરી અર્થે જતાં ગૌતમ સ્વામીને નિહાલ્યા. જૈન સાધુને જોઈ અતિમુક્તા આશ્ર્ય પામ્યો. અને તેમની નજીક પહોંચી જઈ પૂછવા લાગ્યો:—મહાનુભાવ ! આપ કોણ છો ? અને શા મારે કરો છો ? શ્રી ગૌતમ બોલ્યા:—કુમાર ! અમે નિર્યાન્ય સાધુ છીએ અને લિક્ષા અર્થે કરીએ છીએ. આ સાંભળી અતિમુક્તા શ્રી ગૌતમની આંગળી પકડી કહેવા લાગ્યો:—અગવાન, મારે દેર પધારો. બાળકની ભાવભીની અક્ષિ જોઈ શ્રી ગૌતમ તેની સાથે સાથે રાજ્ય મહેલમાં ગયા. ત્યાં શ્રીહેવીએ મુનિને નિર્દોષ આહાર પાણી વહેરાર્યા. તે લઈ શ્રી ગૌતમ પાછા વલ્યા, ત્યારે કુમારે પૂછ્યું:—મહારાજ, આપ ક્યાં જાઓ છો ? શ્રી ગૌતમે કહ્યું:—કુમાર, આ નગરની બહાર શ્રીવનં નામના બાગમાં મારા ગુરુ પ્રભુ મહાનીર બિરાજે છે ત્યાં. કુમારે કહ્યું:—હું આવું ? જવાબમાં શ્રી ગૌતમે કહ્યું:—જેવી તારી હુંચા.

અતિમુક્તા ગૌતમ સ્વામી સાથે શ્રી મહાવીર પાસે આવ્યો, અને પ્રભુને વંદન કરી તેમની સામે બેઠો. પ્રભુએ તેને ધર્માપહેશ આપ્યો. અતિમુક્તના આતાર ચક્ષુએ ખૂલ્યાં, તેને વૈરાઘ્ય થયો. પ્રભુને કહ્યું કે હું સાધુ પ્રવન્ઝ્યા લેવા છચ્છું છું, તો હું મારા માતાપિતાની રજ લઈ આપતી પાસે આવીશ. પ્રભુએ કહ્યું:—જેવી છચ્છા.

અતિમુક્ત ધેર આવ્યો, પ્રભુના ઉપહેશની અને પોતાને થયેદા વૈરાઘ્યની વાત તેણે પોતાના માતાપિતા સમક્ષ કરી.

માતાએ કહ્યું:—કુમાર, આ બચપણમાં તું ધર્મ અને પ્રવન્ઝ્યામાં શું સમજે ?

કુમારે કહ્યું:—માતા, હું જાણું છું તે નથી જાણુતો, અને નથી જાણુતો તે જાણું છું.

માતાપિતા—આનો અર્થ શો?

અતિમુક્તા—હું જાણું છું કે જે તેને અવસ્થ્ય મરવાનું છે, પણ એ નથી જાણુતો કે કયારે અને કેવી રીતે મરવાનું છે! કયા કર્મચોગે જીવો નરક, તર્યારી ગતિમાં પરિબ્રમણ કરે છે, તે જાણુતો નથી, પણ એટલું જાણું છું કે કર્મમાં આસક્તા થવાથી ચાર ગતિમાં અથડાનું પડે છે.

માતા પિતા કુમારના ઉત્તરથી આશ્ર્ય પામ્યા. અતિમુક્તાને દીક્ષિત થતો રોકવા તેમણે અનેક પ્રક્રો પૂછ્યા, અનેક પ્રલોલનો બતાવ્યા, પરન્તુ અતિમુક્તાના વૈરાગ્ય લર્યો અને ઓધક વચ્ચેનોથી સંતોષ પામી આખરે તેઓને રણ આપવાની ફરજ પડી. એક દિવસનું રાન્ય ભોગવવા પિતાએ વિનંતિ કરી. અતિમુક્તા એક દિવસનો રાન્ય બન્યો. પિતાને હર્ષ થયો, બીજે દિવસે ધામધૂમપૂર્વક અતિ-મુક્ત શહેર બહાર નીકળી ગયો, અને પ્રલુ મહાવીર પાસે દીક્ષિત બન્યો.

એકવાર અતિમુક્ત બાળમુનિ ભારે વરસાદ પડ્યા પછી બહાર નીકલ્યા, ત્યારે તેમણે પાણુના વહેળાએ ખળખળ ચાલી જતાં જેયાં. મુનિને પોતાની સાંસારિક બાળ રમત યાદ આવી. તરત જ તેમણે બંને બાળુ પાળ આંધી પાણુના ચાલ્યા જતા પ્રવાહને રોક્યો અને તેમાં પોતાની પાસેનું પાત્ર મૂકી “આ ભારી નાવા કેવી તરે છે!” કહી હસવા કુદ્દવા લાગ્યા, આ દ્રશ્ય તેમનામાંના કેટલાક મુનિએ તે સ્થનેથી જતા હતા તેમણે જેયું. તરત જ તેઓ પ્રલુ મહાવીર પાસે પહેંચ્યા ગયા અને પૂછ્યું:—પ્રભો, આપના અતિમુક્ત નામના બાળમુનિ કેટલા બલ કરશો? પ્રભુએ કહ્યું:—તે બાળમુનિ આ બલમાં જ મોક્ષ જશો, માટે તેમની નિંદા કરશો. નહિ. પણ તેમની અક્રિત જ કરજો.

થોડીવારે અતિમુક્તને પોતાનું સાધુપણું યાદ આવ્યું. પોતાના બાળ સ્વભાવ માટે તેમને ધણો એવ થયો; પ્રાયશ્ક્રિતાર્થી તેમણે ધરિયાવહી પ્રતિકભી. પશ્ચાતાપના અગાધ જળમાં સ્નાન કરતાં તેઓ શુદ્ધ થયા. ૧૧ અંગ ભષ્યા, ગુણું સંવત્સર કર્યો. અને વિપુલગીરી પર્વત પર સંથારો કરી તેઓ નિર્વાણ (મોક્ષ) પામ્યા.

૧૧ અદીનશત્રુ રાજ.

કુરુક્ષેત્રના હરિતનાપુર નગરનો તે રાજ હતો; પૂર્વભવમાં મહાબળનો વૈશ્રમણુ નામે તે ભિત્ર હતો. તેણે ગત ભવમાં મહાબળ સાથે દીક્ષા લીધી હતી. ઉત્ત્રતપ સંયમના પ્રભાવે તે અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થયો હતો, અને લાંથી આયુષ્ય પૂર્ણ કરો તે અદીનશત્રુ નામે રાજ થયો હતો.

મહ્ષીકુંવરી (મહ્ષીનાથ) ના પિતા કુંભરાજને મહ્ષદિન નામનો એક કુમાર હતો. તેણે પોતાના મહેલના અગ્રીયમાં અનેક સ્થંભો અને ચિત્રોથી સુશોભિત એવો સભા મંડપ બંધાવ્યો હતો. ચિત્રોની હારમાળામાં એક ચિત્રકારે મહ્ષીકુંવરીનું આખેહુઅ ચિત્ર ચિત્રયું હતું. મહ્ષીકુંવરીની આ પ્રતિમા મહ્ષદિન પણ ન પારખી શક્યે! કે તે જીવન્ત પ્રતિમા છે કે જડ? આવી ઉત્તમ કળાકૃતિ માટે મહ્ષદિન તે ચિત્રકાર પર પ્રેસન્ન થવાને અદ્દલે કોધિષ્ઠ બન્યો. ચિત્રકારને ઈનામ આપવાને અદ્દલે તેણે તેનો નાશ કરવાની અનુયરોધને આજા આપી. આ સાંભળી ચિત્રકાર કંઘ્યો, પ્રજાજનો દ્યાથી એલી ઉઠ્યાઃ—મહારાજ! ચિત્રકારનો આમાં અપરાધ નથી, છતાં આપતી દાણીએ તે અપરાધી હોય, તોપણું તે એક માત્ર અંગુડાને જેવાથી સાક્ષાત આખી પ્રતિમા ચિતરી શકતો હોવાથી, તેનો ચુનહો માફ કરવો જેઠાએ. પ્રજાજનોની આ વિનંતિથી મહ્ષદિને તેનો વધ ન કરાવ્યો, પણ તેની આંગળી છેદાવી તેને દેશનિકાલની સર્જ કરી. આથી તે ચિત્રકાર હરિતના-

પુરમાં અદીનશત્રુ રાજને આશ્રયે ગયો. લાં તેણે ભવિહુંવરોનું ૩૫
ચિતરી રાજને બતાયું. રાજ મોહાધિન બન્યો.

મહ્ષીહુંવરી સાથે લગ્ન કરવાની છંછાથી રાજએ હુંબરાજ પાસે
પોતાનો હૃત મોકદ્યો, અને એ રીતે તે સ્વયંવર ભંડપમાં જયો.
(વૃત્તાન્ત શંખ રાજને મળતું). ત્યાંથી પાણી ઇરી અદીનશત્રુએ
દીક્ષા લીધી અને મોક્ષમાં ગયો.

૧૨ અનાથો મુનિ.

કૌશંખી નગરીના ધન સંચય નામક શ્રેષ્ઠિના તે પુત્ર હતા. યુવાવસ્થા થતાં પિતાએ તેમને પરણાયા હતા. પુષ્કળ ધન સંપત્તિ,
માતા, પિતા, સ્વી, અહેન, ભાઈ અને વિસ્તૃત કુંભથી પરિવૃત્ત હોઈ
સર્વ પ્રકારે તે સુખી હતા. એક દિવસે તેમને આંખની અતિશય
વેદના ઉપડી, અને તે વધતાં વધતાં શરીરનાં સમસ્ત ભાગો પર
અનેક પ્રકારના દ્વારા દ્વારા હિંદુ રોગો થયાં. આ રોગો મટાડવા તેમના
માતા પિતાએ અદ્યાંક ધન અર્યો વૈદી દ્વારા અનેક પ્રકારના ઉપયારો
કરાયા; પરન્તુ અનાથીનો આ રોગ કોઈ રીતે નષ્ટ ન થયો. અનાથી
ચિંતાબ્રદ્ધ બન્યા.

એક દિવસે ‘આ રોગ શાથી ?’ એ સંખ્યાંધી અનાથીએ (અપર
નામ ગુણસુંદર) વિચાર કર્યો, તો તેમને જણાયું કે ‘પોતાના
કર્માનુસાર જ સૌને સુખદુઃખ ભોગવવાં પડે છે,’ આથી તેમણે એવો
નિશ્ચય કર્યો કે, ‘જો મારી આ વેદના નાશ પામે, તો હું ચારિત્ર
ગૃહણ કરી સંસારનો ત્યાગ કરીશ.’ શુલ ભાવના અને પૂર્વ યોગે
તેજ રાત્રિએ તેમની આ વેદના કંઈક શાન્ત થઈ, અનાથીને તે
રાત્રીએ ઉંઘ આવી, અને જોતનેતામાં પ્રાતઃકાળ થતા, અનાથી
સર્વ રોગોથી મુક્ત બન્યા. ભીજે દિવસે સંસારના પરિતાપોનું અને
સંયમ માર્ગનું આખેલું વૃત્તાન્ત તેમણે પોતાના માતાપિતા, સ્વી આહિને
કહ્યું અને તે સર્વની રજ મેળવી, તેઓ દીક્ષિત બનીને ચાલી નીકલ્યા.

ફરતા ફરતા તેઓ રાજઅહી નગરીના મંડીકુષ ઉદ્ઘાનમાં આવી ચાડ્યા. મુનિ તે સ્થળે ધ્યાનમાં ઐઠેલા છે તેવામાં તે નગરીનો રાજ શ્રેણીક અથ્વ ખેલાવતો મુનિ સમીપ આવો પહોંચ્યો. તેણે મુનિનું સર્વીંગ સુંદર શરીર નીહાળો આશ્રમ્ય ચક્કિત બની પૂછ્યું:-મહાનુભાવ,
કૃપા કરીને કહેશો કે આપ કોણ છો ? આ સુંદર હેઠે આવો કઠિન
તપ શા માટે ?

અનાથીએ કહ્યું:-રાજની, હું અનાથી નામે નિર્ગંથ-સાધુ છું.

શ્રેણીક કહ્યું:-મહાનુભાવ, તમારો કોઈ નાથ ન હોય તો હું
તમારો નાથ થાઓ.

મુનિ—રાજની, તું પેતે જ જ્યાં અનાથ છે ત્યાં તું મારો નાથ
શી રીતે થઈ શકોશો ?

શ્રેણીક આશ્રમ્ય પામી બોલ્યોઃ—આપ મૃષાવાદ તો બોલતા
નથીને ? કેમકે હું તો અંગ અને મગધ દેશનો રાજ છું. કરોડાની
ધનસંપત્તિ અને લાખો અનુચ્ચરોનો હું માલીક છું.

મુનિ—રાજની, એ બધું જાણીને જ મેં તમને કહ્યું છે. મારું
અનાથપણું તમે સમજ શક્યા નથી. તો સાંલયોઃ—હું કૌશાંભી નગ-
રીના ધનાધ્ય શેડનો પુત્ર છું, મારે ત્યાં ધન સંપત્તિની કમીના ન
હતી. નોંધર, ચાકર, ખ્રી, માતા, પિતા, બહેન, ભાઈ વગેરે બધું મારે
હતું. હું મારા દિવસો સુખમાં નિર્ગમન કરતો, પરન્તુ કોઈ એવા
વિષમ યોગે મને આંખની અતૂલ પીડા ઉત્પન્ન થઈ, શરીરમાં દાહ
જવર થયો, મારું આખું અંગ વ્યાખ્યાધી ધેરાઈ રહ્યું. મારા આમજનો
મારા આ હુઃખ માટે ખૂઅ શોક કરવા લાગ્યા. પુષ્કળ ધન અચ્છીને
દ્વારા કરાવી, પરન્તુ મારું આ હુઃખ મટયું નહિ—કોઈ મટાડી
શક્યું નહિ. મારી ખ્રી રાત દિવસ મારી પાસે એસી રહીને આંસુઓ
સારતી, મારી માતા મને હુઃખ મુક્તા જેવા અતિ આતુર હતી.
મારા ભાઈએ અને બહેનો, નોંધરો અને ચાકરો સતત મારી સેવા

કર્યા કરતાં હતાં, પણ તેમાંનાં ડોઈ પણ મારી આ વેદના જરાયે ઓછી કરી થક્યાં નહિ. રાજનુ, આ મારું અનાથપણું હતું. તે વખતે હું સમજયો કે સૌ ડોઈ જગતનાં પ્રાણીયો અનાથ છે, ડોઈ ડોઈનો નાથ થઈ શકતો નથી, પણ જે સંયમ લઈ પોતે જ પોતાનો નાથ અનવાનો માર્ગ અહણું કરે તે જ બની શકે, અને ત્યારે જ અનાથપણું ટળી શકે. આ વિચારે એક રત્નિની ડોઈ ધન્ય પણ મારી વેદના શાંત થઈ, મેં સુખ-નિંદ્રા અનુભવી અને ખીજે હિવસે મેં મુનિપણું અંગીકાર કર્યું. રાજનુ, હવે કહે, કે તું મારો નાથ થઈ શકીશ ? વિચાર કર, કે તું પોતે નાથ છે કે અનાથ ?

રાજ વિચારમાં પડ્યો, મુનિએ તેને બોધ આપ્યો. આથી શ્રેણિક રાજ બૌદ્ધધર્મનો ઉપાસક ભટી નૈતધર્મનો અનુયાયી બન્યો. અનાથી મહા નિર્મંન્ય કર્મનો ક્ષય કરી મોક્ષ પામ્યા.

૧૩ અનાદિષ્ટ.

વસુહેવ રાજની ધારણી રાણીના એ પુત્ર હતા, ૫૦૦ ખીએ પરદ્યા હતા, પરન્તુ પ્રભુ નેમનાથના એક જ અખંડ ઉપદેશના યોગે વૈરાગ્ય પામી પ્રભુ પાસે દીક્ષિત બન્યા હતા. ચૌદ્ધર્વન્નનો અભ્યાસ કરી, વીસ વર્ષની ઉગ્ર સંયમઅારાધના કરી, શત્રુંજ્ય પર્વત પર સંચારો કરી તેએ નિર્વાણ પામ્યા. (અંતકૃત)

૧૪ અનિકસેન.

અદિલપુર નગરના નાગ ગાથાપતિની સુલસા નામક ખીના એ સૌથી મોટા પુત્ર હતા. તેમનું વૃત્તાન્ત અજીતસેનના વૃત્તાન્તને મળતું છે.

૧૫ અનિસુર્ઝ.

તેએ પ્રદુભન રાજની વૈદરની રાણીના પુત્ર હતા. ભગવાન નેમનાથના ઉપદેશે વૈરાગ્ય પામી તેમની પાસે દીક્ષિત થયા અને મહાત્મ કરી મોક્ષમાં અયા. (અંતકૃત)

૧૬ અનંતનાથ.

અયોધ્યા નગરીના સિંહસેન રાજાની સુયક્ષ્મા નામક રાણીની કુલિશમાં, પ્રાણુત દેવલોકથી ચ્યવીને, આવણુ વદ સાતમે શ્રી અનંતનાથ ઉત્પન્ન થયો હતા. તે વખતે માતાએ ૧૪ સ્વૈન દીઠાં. ગર્ભકાળ પૂરો થયે, વૈશાક વર્ષ ૧૩ ને દિવસે આ ૧૪ મા તીર્થકર શ્રી અનંતનાથનો જન્મ થયો. છૃપન કુમારિકા દેવીએ અને છદ્રોએ આવી તેમનો જન્મ મહેતસ્વ ઉજવ્યો. અનંતનાથ ગર્ભમાં આવતા દુષ્મનોએ અયોધ્યા નગરીને ધેરો ધાલેલો, પણ શત્રુઓના અનંત અળને સિંહસેન રાજ હઠાવી શક્યો હતો, તેથી પુત્રનું નામ ‘અનંતજીત’ પાડવામાં આવ્યું. તેમનું દેહમાન (શરીરની ઉંચાઈ) ૫૦ ઘનુષ્યનું હતું. પિતાના સંતોષને ખાતર તેઓ પરણ્યા. સાડા-સાત લાખ વર્ષની ઉમરે ગાઢીએ બેડા. પંદર લાખ વર્ષ રાજ્ય કર્યું. ત્યાર પછી સંયમ લેવાનો નિરધાર કર્યો. વરસીદાનમાં લાખો સુવર્ણ મહોરો આપી, એક હજાર રાજાઓ સાથે વૈશાખ વદ ૧૪ ના રોજ તેમણે સંયમ ધારણ કર્યો. તે પછી ત્રણુ વર્ષ સુધી છદ્રમસ્થ તરીકે રહ્યા અને વૈશાક વદ ચૌદશો કેવળજાન પ્રામ કર્યું. તેમને ૫૦ ગણુધર હતા. તેમાં સૌથી મોટા ‘યશ’ હતા.

અનંતનાથ પ્રખુના સંધ પરિવારમાં ૬૬ હજાર સાધુઓ હતા, તેમાં ૮૦૦ ચૌદ પૂર્વધારીઓ, ૪૩૦૦ અવધિજાની, અને ૫ હજાર કેવળજાની હતા. ૬૨ હજાર સાધીઓ, ૨૦૬ હજાર આવડો અને ૪૧૪ હજાર શ્રાવિકાઓનો પરિવાર હતો. કેવળજાનાપણે તેઓ સાડાસાત લાખ વર્ષમાં ત્રણુ વર્ષ ઓછા સમય સુધી વિહાર કર્યો. અંતે સમેતરિખભર પર્વત પર જઈ, એક માસનો અનશન કરી ચૈત્ર શુદ્ધ પાંચમે ૭ હજાર સાધુઓ સાથે તેઓ મોક્ષમાં ગયા. તેમણે એકંદર ૩૦ લાખ વર્ષનું આયુષ્ય ભોગવ્યું હતું.

૧૭ અનંતસેન

બહિલપુર નગરના નાગ ગાથાપતિના એ પુત્ર હતા. અનિઃસ્તન
સાથે નેમનાથ પ્રખુ પાસે તેમણે દીક્ષા લીધી હતી. સર્વ અધિકાર
અણતસેનના ચરિત્ર માફક છે. (અંતકૃત)

૧૮ અભગ્ગસેન ચોર

પુરિમતાલ નામના નગરમાં મહાયણ નામનો રાજ હતો. તે
નગરથી થોડેક દૂર એક ચોરપલ્લી (ચોરનું ગામ) હતી. તે ધણી
ગુફાએ અને પર્વતોની વચ્ચે આવેલી હતી. ત્યાં વિજય નામનો
સેનાપતિ રહેતો, તેના નીચે ખીજ પાંચસેં ચોરો હતા. આ વિજયચોર
મહા અધમો હતો. લોકાને કુંટલા, ગામ ખાળતો અને સર્વત્ર ત્રાસ
વર્તાવતો. વિજયચોરને ‘અભગ્ગસેન’ નામનો એક પુત્ર હતો,
તે બાપથી સવાયો હતો. અભગ્ગસેનના ત્રાસથી પુરિમતાલના પ્રજાજનો
ત્રાસી ગયા હતા, તેથી તેમણે ચોરના ત્રાસથી રૈપતને મુક્તા કરવા
માટે રાજને પ્રાર્થના કરી.

રાજના ડોટવાથે લશકર લઈ અભગ્ગસેનને પકડવા ધણ્ણા પ્રયાસો
કર્યા, પરન્તુ તે પકડાયો નહિ. આખરે રાજએ એક યુક્તિ રચી,
૧૦ દિવસનો મહોત્સવ ઉજવ્યો, તેમાં લાગ લેવા અભગ્ગસેન અને
તેના સાથીએને રાજએ કહેવડાયું. અભગ્ગસેન સાથીએ સાથે
આવ્યો. રાજએ તે બધાને દાર અને માંસમાં ચક્કયૂર બનાવી પકડયા.
પછી અભગ્ગસેન ચોરને બંધન સાથે શહેરના મુખ્ય મુખ્ય રસ્તાએ
પર ફેરબયો, પાણીને બદલે લોહી અને ખોરાકને બદલે માંસ
ખવરાવતાં ખવરાવતાં તેને શુણી પર ચડાવવામાં આવ્યો. ત્યાં તે
મરણ પામી પહેલી નરકમાં ગયો.

આ વખતે શ્રી ગૌતમ એ રસ્તેથી પસાર થયા. આ દસ્ય જોઈ
તહેમને ત્રાસ થયો. પ્રખુ મહાવીર પાસે આવી તેમણે પૂછ્યું:-પ્રખુ,
એ અભગ્ગસેન ચોરને કણ પાપનું કણ ભોગવવું પડે છે? પ્રખુએ

કણું:-હે ગૌતમ, પૂર્વ અવે તે આજ નભરમાં નિનહુવ નામે રાણીઓએ હતો, તે ઈંડાનો કેચાર કરતો-ઈંડાને શેકી-તળીને બેચતો અને પોતે પણ ખાતો. આ ધોર પાપ કરી એક હળર વર્ષનું આયુષ્ય લોગવી તે ત્રીજી નરકે અથો હતો, ત્યાંથી ચ્યાવી તે અભગગસેન ચોર થયો છે, અને હિંસા, ચોરી, અધર્મ, અણુયાચાર અને દુર્વ્યસનોનો લોગી અની ધોર પાપ કર્યું છે, તેના ફળ સ્વરૂપે રાજને તેની આ દશા કરી છે, એટલુંજ નહિ પણ તે આજે ત્રીજા પહેલારે શુણી પર ચડી રજ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી ૧ લી નરકે જશે, ત્યાંથી નીકળી જન્મ ભરણુના અનેક અવે કરી આખરે તે વારાણુસી નગરીમાં એક અભિજ્ઞને ત્યાં જન્મ લઈ, સંયમ પાળી મોક્ષમાં જશે.

૧૯ અભયકુમાર

રાજગુહના શ્રેણિક રાજની અનેક રાણીઓએ નંદા નામે રાણી હતી, તેનાથી અભયકુમાર નામનો મહા યુદ્ધશાળી પુત્ર જન્મ્યો હતો. શ્રેણિક રાજને પોતાના પાંચસે પ્રધાનોમાં અભયકુમારને મુખ્ય પ્રધાનની જગ્યા આપી હતી. અભયકુમારની યુદ્ધમતા, રાજ્યનિપુણતા અને સમાનતાના સદ્ગુણોથી તે રાજ્યમાં સર્વત્ર પ્રિય થઈ પડ્યો હતો, અનેક અપરાધીઓને તેણે પોતાની યુદ્ધમતાથી શાધી કાઢી, પ્રભાને નિશ્ચિત બનાવી હતી. ધારિણી અને ચેલણુંદિ પોતાની અપર માતાઓ હોવા છતાં તેણે તેમના દોહદ, તપ અને યુક્તિથી પૂર્ણ કરાવ્યા હતા. વૈશાલક નગરીના ચેડા રાજને પરધર્મીને કન્યા નહિ આપવાની પ્રતિસા હતી; છતાં શ્રેણિક રાજને તે ચેડા રાજની સુજયેષા નામની પુત્રીને પરણવાની ધર્યા થઈ. પિતાની ચિંતા ટાળવા અભયકુમારે યુક્તિપૂર્વક સુજયેષાનું હરણુ કરવાનું ધાર્યું, પરન્તુ સુજયેષાને ઘઢલે તેના રૂપને મળતી ચેલણું આવી; શ્રેણિક ચેલણું સાથે ઉમંગથી લબ્ન કર્યું.

ભગવાન મહાવીરના એક વખતના ઉપદેશથી અલયકુમારને ચારિત્ર લેવાની છંચળ થઈ, તેથી તેણે તે માટે પિતાની આજા માગી. શૈખિક તેને રાજ્યગાદી સુપ્રત કરવાનું કહ્યું, પરન્તુ અલયકુમારે તે ન કેતાં સંયમ માટે આગ્રહ કર્યો. શૈખિક દુઃખિત થતા કહ્યું:-કુમાર, અદે તમે રાજ્યગાદી ન લ્યો, પરન્તુ હું તમને જ્યારે 'ન' કહું ત્યારેજ તમારે જવું. અલયકુમારે પિતાની આ વિનતિ માન્ય રાખી.

પ્રસંગવશાત એવું બન્યું કે એક દિવસે ચેલ્લણું દેવીએ એક ઉદ્ઘાનમાં વસ્ત્ર ઓછા વિનાના એક ધ્યાનસ્થ મુનિને જોયા, તે રાત્રે સખ્ત ઠંડી પડી હતી, તે વખતે સાલમાં વીઠાયદો તેણુંનો હાથ અષ્ટરમાત બહાર નીકળો જતાં તેને ઠંડીનો સખ્ત આંચડો લાગ્યો, પરિણામે હાથ નિશ્ચેતન જેવો બની ગયો. આ ત્રાસથી ચેલ્લણુથી સહજ ઓલાઈ ગયું કે અહો, આવી સખ્ત ઠંડીના વખતે મેં ઉદ્ઘાનમાં જોયેલા તે મુનિ શું કરતા હશે? આ શબ્દો શૈખિકના સાંભળવામાં આવતાં તેને ચેલ્લણું પર સતીપણુનો વહેમ આવ્યો. પ્રાતઃકાળે વહેલા ઉડી તેણે ચેલ્લણું સાથે તેનો મહેલ સળગાવી મૂકવાની અલયકુમારને આજા કરી; પણ બુદ્ધિનિધાન અલયકુમાર આ અવિચારી આજાનો અમલ એકદમ કેમ કરે : તેણે યુક્તિ કરી. ચેલ્લણુના મહેલને બદલે જીર્ણ ઓરડીએ સળગાવીને, પોતે પ્રલુભ મહાવીરના દર્શન કરવા નીકળો જયા. બોજુ તરફ આજા આપીને તરતજ શૈખિક રાજ અલયકુમારની પહેલાં પ્રલુભ પાસે પહોંચ્યો ગયા હતા; ત્યા શૈખિક પ્રલુબે ચેલ્લણું સંઅંધીનો પોતાનો સંશય પૂછ્યો:-પ્રલુબે મુનિની વાત કરી ચેલ્લણાનું સતીત્વ સાંજિત કર્યું. આથી શૈખિકને ખૂન પશ્ચાતાપ થયો. તરતજ પોતે આપેલ હૂકમ બંધ રખાવવા ઉતાવળે પાછો ઇર્યો; તે વખતે અલયકુમાર, તેને સામે મળ્યો, તે સાથે શૈખિક બળતી ઓરડીએના ધૂમાડા જોયા. આથી તેણે ગુરસે થઈને અલયકુમારને કહ્યું કે:-'ન, મારી દાખિથી દૂર થા.' અલયકુમારને એટલું જ જોઈતું

હતું. તે પ્રભુ મહાવીર પાસે આવ્યો અને બોધ સાંભળી વૈરાગ્યવાન બન્યો, માતાની રજ લઈ તેણે પ્રભુ પાસે ચારિત્ર અખણું કર્યું. અતિશય તપશ્ચર્યા કરી, પાંચ વર્ષનું ચારિત્ર પાળી અભયકુમાર વિજય નામના વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયા અને ત્યાંથી મહાવિદેહમાં જન્મ ધરી, ઉત્કૃષ્ટ સંયમ પાળી મોક્ષમાં જશે.

૨૦ અભિય

વિતલય નામની નગરીના ઉદ્ઘાયન રાજનો એ પુત્ર હતો. ઉદ્ઘાયન રાજએ પોતાનું રાજ્ય અભિયને સુપ્રેત ન કરતાં, તેના બાણેજ ડેશને રાજ્ય આપ્યું, આથી તેને પિતા પર કોધ થયો; એટખું જ નહિ પણ ડેશીના હાથ નીચે રહેવું તેને ઉચ્ચિત ન લાગ્યું, તેથી તે પોતાના મસીધાઈ લાઈ રાજ ડેશિક પાસે જધ રહ્યો, ત્યાં જૈન સાધુના સંસર્ગમાં આવતાં તે જૈનધર્મી બન્યો અને શ્રાવક ધર્મ પાળવા લાગ્યો. અંત સમયે તેણે ૧૫ દિવસનું અનશન કર્યું, અને પિતાના રોખને અમાવાયા વિતા તે કાળધર્મ પામી દેવલોકમાં ગયો, ત્યાંથી ચ્યાની તે મહાવિદેહમાં જન્મ લેશે અને પૂર્વ કૃષ્ણનો પશ્ચાતાપ કરી, સંયમની આરાધના વડે મોક્ષમાં જશે.

૨૧ અભિયંદ

વિજયરાજના એ પુત્ર હતા. તેમણે નેમનાથ પ્રભુ પાસે ચારિત્ર અંગીકાર કરેલું. ૧૬ વર્ષનો દીક્ષાપર્યાય લોગવી, એક માસના અનશને તેઓ શત્રુંઝ્ય પર્વત પર સિદ્ધ થયા. (અંતકૃત)

૨૨ અભિનંદન

વર્તમાન ચોવીસીના એ ચોથા તીર્થીકર હતા. તેઓ અયોધ્યા નગરીમાં સંવર નામે રાજની સિદ્ધાર્થી નામક રાણીની કુક્ષિએ વિજય વિમાનમાંથી ચ્યાનીને વૈશાખ શુદ્ધ ૪ ના દિવસે ઉત્પન્ન થયા. માતાએ ચૈદ રવન દીકાં. ગર્ભકાળ પૂરો થતાં મહા શુદ્ધ બોજની રાત્રે તેમનો

જન્મ થયો. નિયમ મુજબ છપન કુમારિકા ફેરીઓએ આવી, સુતિકાકર્મ કર્યું. ૪૪ ઈંડ્રોએ આવી જ-મોત્સન ઉજળ્યો. ગ્રલુ ગર્ભમાં હતા તે દરમ્યાન સર્વને અભિનંદ થયેલો, તે પરથી તેમનું નામ ‘અભિનંદન’ પાડવામાં આવ્યું. બાલ્યાવસ્થા વ્યતિત કરી તેઓ યુવાવસ્થા પામ્યા ત્યારે તેમના પિતાએ ધણી રાણીઓ સાથે તેમનું પાણીગ્રહણ કર્યાયું. તેમનું દેહમાન ૩૫૦ ધનુષ્યનું હતું. સાડાખાર લાખ પૂર્વની ઉમરે પહોંચતાં પિતાએ આપેલું રાજ્ય ગ્રહણ કર્યું. સાડીછતોસ લાખ પૂર્વ અને આઠ પૂર્વાંગ સુધી રાજ્ય ચલાયું. પછી સંયમનો ભાવ થતાં વરસીદાન દેવું શરૂ કર્યું, અને મહા શુદ્ધ ૧૨ ને દિવસે પ્રવન્નાં અંગીકાર કરી, તેમની સાથે એક હજાર રાજાઓએ પણ પ્રવન્નાં લીધી.

૧૮ વર્ષ છદ્રસ્થાવસ્થામાં રહ્યા. અભિનંદન જિનને પોશ શુદ્ધ ચૌદશો કૈવલ્યજાન ઉત્પન્ન થયું. તેમને ૧૧૬ ગણુધર હતા. તેમાં સૌથી મોટા વજનાખ હતા. તેમના શાસનમાં ત્રણ લાખ સાધુ, ૬૩૦ હજાર સાધ્યી, ૨૮૮ હજાર શ્રાવકો અને ૫૨૭ હજાર શ્રાવિકાઓ હતા. સાધુમાં ૮૮૦૦ અવધિજાતી, ૧૫૦૦ ચૌદશ્પૂર્વી હતા. એક લાખ પૂર્વ માં આઠ પૂર્વાંગ અને અઢાર વર્ષ ઓછાં સમય સુધી ડેવળજાતીપણે વિચાર્યાં. અંત સમયે એક હજાર મુનિઓ સાથે સમેતશિખર પર એક માસનો અનશન કર્યો અને તેઓ વૈકાશ શુદ્ધ આડમે પચાસ લાખ પૂર્વનું આયુષ્ય પૂર્ણ કરી સિદ્ધગતિને પામ્યા.

૨૩ અધ્રવંતા સુકુમાલ

ઉજનજયિની નગરીના ધનશોઠ નામના એક ઓણિને ત્યાં નલિનીગુલ્મ નામના વિમાનમાંથી ચ્યવીને એ ઉત્પન્ન થયા હતા. યુવાવસ્થાએ પહોંચતાં તેઓ અનેક ઝોઓને પરણ્યા. બોગવિલાસમાં દિવસે નિર્ભરમન કરતાં, રાત્રિ કે દણાડો કેવી રીતે પસાર થાય છે તેની પણ તેમને ખખર પડતી ન હતી. એવામાં તે નગરમાં આર્થસુહસ્તિન નામના એક તપસ્વી મુનિ પદ્ધાર્યાં. તેમના ઉપાશ્રી સ્થાન સામે જ બરોઅર અધ્રવંતા સુકુમાલનો મહેલ હતો. મુનિ

સ્વાધ્યાય કરતા હતા, તેમાં નલિનીગુલ્મ વિમાનના અધિકારતી વાત આવી. અધ્યવંત ધ્યાન પૂર્વક આ સાંભળી રહ્યો હતો. સાંભળતાં જ તે આશ્ર્યચક્રિત બન્યો અને તેને પોતાનો પૂર્વલવ યાદ આવ્યો. જાતિ સ્મરણુજ્ઞાન થતાં તરત જ તે મુનિ પાસે આવી પહોંચ્યો. અને કહેવા લાગ્યોઃ—મુનિદૈવ, શું આપ પણ નલિનીગુલ્મ વિમાનમાંથી આવ્યા છો ? મુનિએ કહ્યુંઃ—ના. હું તો જગતાને કહેલા અધિકારનો સ્વાધ્યાય કરું છું. અધ્યવંતે કહ્યુંઃ—કૃપા કરી મને ત્યાં જવાનો રસ્તો અતાવો. મુનિએ તેને ડેવલી પ્રરૂપિત ધર્મ સંભળાવ્યો. અધ્યવંત વૈરાગ્યવાન બન્યો અને તે માતાપિતા, સ્વી આહિની રણ લાદ દીક્ષિત બની ચાલી નીડળ્યો. સત્ત્વર નલિનીગુલ્મ વિમાનમાં પહેચવા ગુરુતી આજ્ઞા લાદ તેમણે લિક્ષિતી બારમી પ્રતિમા ધારણ કરી અને સમશાનમાં જઈ કાયેતસર્ગ ધ્યાનમાં લીન થયા. ગુરુએ આ કિયાનું ઇણ મોક્ષ બતાવ્યું, પરન્તુ અધ્યવંત સુકુમારે નલિનીગુલ્મ વિમાનમાં જવાનું નિયાળું (સંકલ્પ) કર્યું. એવામાં તેની પૂર્વલવની સ્વી કોણ પૂર્વકર્મને યોગે શિયાળણી (અંથાધાર) થઈ હતી તે, ઇરતી ઇરતી આ સ્થળે આવી પહોંચ્યી. તેને અધ્યવંત સાથે પૂર્વલવનું કોણ વૈર હોય કે સ્વાભાવિક કારણથી તેણે પ્રસ્તુત મુનિનું શરીર વિદ્ધારી માંસ લક્ષણ કરવા માંડ્યું. મુનિને ઉગ્રવેદના થવા લાગી. ધીમે ધીમે તે શિયાળણીએ મુનિનું આખું શરીર દોઢી લોહાણું કરી મુક્યું. આ પરિષહથી મુનિ લેશ પણ ડગ્યા નહિ, કે મનમાં અસહ્યભાવ આપ્યો નહિ. પરિણામે મુનિ ત્યાં કાળ ધર્મ પામી સંકલ્પનાના બ્યાને નલિનીગુલ્મ વિમાનમાં ફેવપણે ઉત્પન્ન થયા.

૨૪ અરણ્યિક

તગરા નામના નગરમાં દત્ત નામના વળિંકના તે પુત્ર હતા. એક વાર ભિત્રાચાર્ય નામના કોણ સ્થવીર મહાત્મા ત્યાં પધાર્યા. તેમના ઉપરેશથી એધ પામી દત્ત તથા તેની સ્વી બદ્રાએ પોતાના ખાળક અરણ્યિક સાથે દીક્ષા લીધી. દીક્ષિત પિતાને ખાળક પર અતિ મોહ હતો,

તથી તે સારું સારું વહેલી લાવી તેને ખવડાવતા. કેટલાક દિવસો પછી પિતાના કાળધર્મ પામવાથી ગૌચરીનો બોને અરણિક પર આવી પડ્યો. તેઓ ગૌચરી નીકળ્યા; પરન્તુ અત્યાંત તાપને લીધે થાકીને એક વિશ્વાણ હવેલી નીચે એઠા. તે હવેલીમાં રહેતી એક પતિવરણહિની ઝોંગે તેમને જેયા અને દાસી દારા પોતાના આવાસમાં બોલાવ્યા. તે ખુખુસુરત ઝીંઘે અનેક પ્રકારના ખાનપાન, હાવલાવથી મુનિને મોહિત બનાવી ચારિત્ર ભષ્ટ કર્યાં. મુનિ પ્રલોભનમાં આસક્ત બની તે ઝોંગે ત્યાં જ રહ્યા.

શીજુ તરફ તેની માતા સાધ્યી અરણિકને ન હેખવાથી ઝૂરણું કરવા લાગી. ઉ દિવસ સુધી અરણિકનો પતો ન લાગવાથી તે ગાંડા જેવી બની ગઈ, અને શહેરમાં ‘અરણિક, અરણિક’ નામના પોકાર કરતી અહિં તહિં લટકવા લાગી, પણ કોઈ એ અરણિકના સમાચાર આપ્યા નથી. એક વખતે તે સાધ્યી આકંદ કરતી, અરણિકના નિવાસ-સ્થાન સમીપ આવી પહોંચી. બારીમાંથી નીચે દાંચ કરતાં અરણિકું પોતાની માતા સાધ્યીને લયશ્વાન્ત દશામાં જોઈ. જેતાં જ તે મહેલામાંથી નીચે ઉત્થો અને હું અરણિક આ રહ્યો, કંઈ માતા સાધ્યીના પગમાં પડ્યો. સાધ્યીના આનંદનો પાર ન રહ્યો. તેણું એ આરિત્રશ્રષ્ટ ન થવા અરણિકને ખૂખ સમજાવ્યો. માતાના પ્રેમને વશ થઈ અરણિકું તે વિલાસસ્થાનનો ત્યાગ કર્યો અને પુનઃ દીક્ષા લીધી. સંયમ તપની આરાધના કરતાં અંત સમયે તેમણે ધગધગતી રેતીમાં અનશન કર્યું. ઉત્ત્ર તપશ્ચર્યાં અને પ્રચંડ પશ્ચાતાપના પ્રભાવે અરણિક મુનિ સર્વ કર્મનો ક્ષય કરી કૈવલ્યજ્ઞાન પાખ્યા અને મોક્ષમાં ગયા.

૨૫ અરનાથ

હસ્તિનાપુર નગરમાં સુદર્શન રાજની મહાદેવીરાણુની કુણે નવમા ગ્રૈવેનુકથી ચ્યવીને ફાગણું શુદ્ધ ત્રોજને દિવસે તેઓ ઉત્પન્ન થયા. માતાએ ચૈંડ સ્વપ્ન નિહાળ્યાં. ગર્ભકાળ પૂરો થયે માગશર શુદ્ધ ૧૦ મે

અરનાથ પ્રલુનો જન્મ થયો. પિતા તથા દેવોએ જન્મ મહોત્સવ ઉજવ્યો. ભાતાએ સ્વપ્નમાં ચક્કના આરા દીડા હતા, તેથી પુત્રનું નામ અરનાથ પાડ્યું. ઘૌણવય થતાં અરનાથ ધણી રાણીએ પરણ્યા. ૨૧ હળર વર્ષની ઉભર થતાં તેઓ પિતાની જગ્યાએ રાજ્યાસન પર બિરાજ્યા. આયુષ્મશાળમાં ચક્કરલ ઉત્પન્ન થવાથી તેઓ છ ખંડ ગુલી, ચક્કવર્તી થયા. ૨૧ હળર વર્ષ ચક્કવર્તીપણે રહ્યા. પછી દીક્ષા કેવાનો અલિકાષ થયો. વરસીદાન આપવું શરૂ કર્યું અને તે પછી માગશર શુદ્ધ ૧૧ ના રોજ શ્રી અરનાથે સંઘમ લીધો. ત્રણ વર્ષ છદ્રસ્થતાના વિતાવતાં કાર્તિક શુદ્ધ ૧૨ ને દિવસે તેમને કૈવલ્યજ્ઞાન થયું. પ્રલુના પરિવારમાં ૫૦ હળર સાંધુ, ૬૦ હળર સાધ્વીએ ૧૮૪ હળર આવકો અને ૩૭૨ હળર આવિકાએ હતાં. તેમના સાંધુ સંઘમાં ૨૬૦૦ અવધિજ્ઞાની, ૬૧૦ ચૈદ પૂર્વધારી અને ૨૮૦૦ કેવળજ્ઞાની થયા. આખરે સમેત શિખર પર જઈ એક હળર સાંધુ સાથે શ્રી અરનાથે અનશન કર્યું. એક માસના અનશન પછી તેઓ માગશર શુદ્ધ ૧૦ ને દિવસે ૮૪ હળર વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી નિર્વાણ (મોક્ષ) પામ્યા.

૨૬ અલખરાજા.

એ વારાણુશી નગરીના રાજ હતા. ભગવાન મહાવીર દેવ પાસેથી ધર્મ સાંભળતાં તેમને વૈરાગ્ય થયો, અને પોતાના મોટા પુત્રને રાજ્ય કાર્યભાર સોંપી તેઓ પ્રલુ મહાવીર પાસે દીક્ષિત થયા. ૧૧ અંગ લણી ધણાં વર્ષ સુધી ચારિત્ર પાળયું અને અંત સમયે વિપૂલ પર્વત પર જઈ સંચારો કરી મોક્ષમાં ગયા.

૨૭ અરિષ્ઠનેમી ઉર્ઝે શ્રી નેમનાથ.

સૌર્યપુર નગરના સમુદ્રવિનિય રાજ અને શિવાહેવી રાણીના એ પુત્ર, વર્તમાન ચોવીસીના ૨૨ મા તિર્થેકર થયા. તેઓ અપરાજિત નામના અનુતર વિમાનમાંથી ચ્યવી, કારતક વદ્દ ૧૨ ના રોજ

શિવાહેવીની કુક્ષિમાં ઉત્પન્ન થયા. માતાએ ચૌદ ઉજાજવળ સ્વર્ગ
દીંઠાં. ગર્ભકાળ પૂરો થયે ચિત્રા નક્ષત્રમાં આવણું શુદ્ધ પ ના રેઝ
તેમનો જન્મ થયો. દરેક તીર્થકરની જેમ હેવીએ અને ધૂદ્રહેવોએ
આવી તેમનો જન્મભોત્સવ ઉજવ્યો. પ્રભુ દિવસે દિવસે વયવૃદ્ધિ કરવા
લાગ્યા. તેમના બધા ભાઈઓમાં તે સૌથી નાના હતા. તેમનું નામ
અરિષ્ટનેભિ અથવા નેમનાથ હતું. યુવાનાવસ્થા થતાં તેમના પિતા
તથા શ્રીકૃષ્ણ તેમના લગ્ન માટે પ્રથંખ કરવા લાગ્યા, પરન્તુ કામને
જીતનાર એવા શ્રી નેમનાથે તે વાતનો સાછુ ધૂન્કાર કર્યો. તેમનામાં
અતૂલ બળ હતું, પણ અઘાપિ તે બળનો ડોધને પરિચય થયો ન
હતો. એકવાર તેઓ આયુષ્મશાળામાં શાંકો જોવા માટે આવ્યા,
ત્યાં એક મેટો શંખ પડ્યો હતો. એક રક્ષક કંદું કે મહારાજ, આ
શંખ તો એક શ્રીકૃષ્ણ સિવાય ડોઈ ઉપાડી કે વગાડી શકે તેમ
નથી. શ્રી નેમનાથે પોતાના બળનો ઉપયોગ કર્યો. શંખ હાથમાં
લીધો અને જોરથી વગાડ્યો. શંખ વાગતાં જ પ્રજન્મનો કંપી ઉકાયા,
સર્વત્ર ડોલાહલ થયો, સમુદ્રમાં બળભળાટ થયો. અને શ્રી બળભદ્ર
તથા કૃષ્ણ ક્ષોલ પામ્યા. તેઓ વિસ્મીત બની બોલી ઉકયા, અહે !
આવો બીજો બલિષ્ટ ડોણું થયો ? તપાસ કરતાં જણાયું કે યોવનને
પહેલે પગથાયે પ્રવેશનાર શ્રી નેમનાથે તે શંખ વગાડ્યો. આ
સાંભળ તેઓ ખૂબ આનંદ પામ્યા. તેમનું બળ ઓછું કરવા શ્રીકૃષ્ણ
વગેરેએ તેમને પરણુવાની વિનતિ કરી, પણ શ્રી નેમનાથે ન માન્યું.
આખરે રાજ્યરાણીઓના આગહથી, પોતાને હળુ લેગાવલી કર્મ
બાકી છે એમ જાણુવાથી પોતે લઘુ કરવા સંમત થયા. આથી શ્રી
કૃષ્ણ સુરૂપ કંન્યાની શોધ કરવા લાગ્યા. તેવામાં સત્યલામાએ કંદું
કે મારી નહાની બેન રાજેમતી શ્રી નેમને લાયક છે. આથી શ્રી
કૃષ્ણ ઉગ્રસેન રાજ પાસે ગયા અને તેની કંન્યા રાજેમતીનું શ્રી
નેમનાથ માટે માગું કર્યું. ઉગ્રસેને પ્રસન્નવદ્ધને તે કષુલ કર્યું અને
ધરીયાં લગ્ન લીધાં. વિશાળ સૈન્ય સાથે શ્રી કૃષ્ણ, સમુદ્રવિજય

વગેરે અનેક રાજાઓ નેમનાથને પરખુાવવા માટે જાન લઈ વિવાહ મંડપે ગયા, ત્યાં એક મોટા પાંજરામાં અનેક પશુ પંખીઓ પૂરવામાં આવ્યા હતા. તેમનો કરુણ આર્તનાદ સંલગ્નાઈ રહ્યો હતો. શ્રી નેમનાથના કાને આ કરુણ ધ્વનિ પડ્યો. નેમનાથે રથ-સારથીને પૂછ્યું કે:—આ પશુ પંખીઓને પાંજરામાં કેમ પૂર્ણ છે? અને આ બધો ડિલક્લિસ્ટ શાથી? સારથીએ કહ્યું:—મહારાજ! આપના લગ્ન થઈ જતાં જ આ બધા પ્રાણીઓનો ભોગ દેવાશે અને આ લગ્ન મંડપમાં નોતરેલા કેટલાક હિંસક મનુષ્યોને એ માંસનો ઝોરાક આપી સંતોષારો. શ્રી નેમનાથ ચ્યામક્યા અને બોલ્યા:—અહો! મારા એકના લગ્ન માટે-મારા ક્ષણિક ભોગ-વિલાસને માટે શું આ અસંખ્ય જીવોનો વધ થશે? આમ ન થતું જોઈએ. એમ કહી નેમનાથે સારથીને રથ પાછો વાળવા કહ્યું. રથ પાછો ઇચ્છો, શ્રી નેમ તોરણેથી લગ્ન કર્યા વિના જ પાછા વળ્યા. કૃષ્ણ, સમુદ્રવિજય શરમીદા મહેંએ સ્વરસ્થાનકે પાછા ઇચ્છો. નેમનાથે રાજ્યમાં આવી વાર્ષિક દાન આપવું થાર્દ કર્યું. નેમનાથના પ્રચંડ વૈરાગ્યને કોઈ રોકી શક્યું નહિ. ગ્રલુએ વર્ષ અંતે આવણ શુદ્ધ આડમે દીક્ષા લીધી. તે વખતે તેમની ઉંમર ૩૦૦ વર્ષની હતી. તેમની સાથે બીજા એક હંજર રાજાઓએ પણ દીક્ષા લીધી. દીક્ષા લીધા પછી તરત જ શ્રી નેમનાથને મન: પર્યવર્ગાન અને દીક્ષા પછી ચોપનમે દિવસે એટલે આશો વદિ અમાસે* કૈવલ્યરાન થયું. તેમનું દેહમાન ૧૦ ધનુષ્ઠનું હતું. નરહત્ત વગેરે તેમને ૧૧ ગણુધરો થયા. પ્રથમ શિષ્યા યક્ષણી નામની આર્યા થયા. ૧૦ દશાર્ડો મુખ્ય શાયક અને શિવાદેવી મુખ્ય શાવિકા થયા. તેમના પરિવારમાં ૧૮ હંજર સાધુઓ, ૪૦ હંજર સાધીઓ, ૧૬૬૦૦૦ શ્રાવકો અને

* સર્વ તીર્થકરોની જન્મ, દીક્ષા, કૈવલ્યરાન અને નિર્વાણની તીથીએ આવે ત્યાં પુનર્મીયા મહિના સમજવા.

૩૪૬૦૦૦ શ્રાવિકાઓ. હતા. સાધુઓમાં ૪૦૦ ચૌહપૂર્વધારીઓ, ૧૫૦૦ અવધિજીના અને ૧૫૦૦ કેવળી હતા. પ્રલુબો ૫૨૬ સાધુઓ સાથે ગીરનાર પર અનશન કર્યું અને અશાડ શુદ્ધ ના રોજ તેઓ નિર્વાલુ પામ્યા. શ્રી નેમનાથ ૩૦૦ વર્ષ કુમારપણે રહ્યા. ૭૦૦ વર્ષની દીક્ષા પાળી, એકંદર એક હજાર વર્ષનું આયુષ્ય ભોગવ્યું હતું.

૨૮ અક્ષોલ

એ અંધક વિનું અને ધારિણીના પુત્ર હતા. તેઓ આઠ સ્વીઓ પરણ્યા હતા. શ્રી નેમનાથ પ્રલુ પાસે દીક્ષા લીધી અને સ્થનીર પાસે ૧૧ અંગ બણ્યા. બાર વર્ષ ચારિય પાળ્યું. ૧ માસનું અનશન કરી તેઓ શત્રુંજ્ય પર સિદ્ધ થયા. (અંતકૃત)

૨૯ અર્હભક્ત

શ્રી ભક્તિનાથના સમયમાં ચંપાનગરીના ડોઈ ધનશ્રેષ્ઠનો તે જૈનધર્મી આવકપુત્ર હતો, જીવ, અજીવાદિ નવતત્ત્વનો જાણું હતો. તે અર્હભક્ત એક વાર ચાર પ્રકારનાં કરિયાણ્યા (૧ ગણુત્તી બંધ વેચાય તેવાં ૨ તોળીને વેચાય તેવાં, ૩ લરીને-માપીને વેચાય તેવાં, ૪ પરખ કરીને વેચાય તેવા) લરી, સ્વજ્ઞ કુદુંઅને જમાડી-રણ લધ દેશાવર જવા નીકળ્યો. લવણું સમુદ્રમાં ધણે દૂર ગયા પછી એકાએક વાવાઓંતું તોક્કાન થયું. તેમાં એક મિથ્યાત્વી દેવ, પિશાચનું ઇપ ધરો વહાણું તરફ ધસી આવ્યો. આ જોઈ અર્હભક્ત સિવાયના બાકીના બધા લોકો અયલીત બન્યા. અર્હભક્ત નિલંઘ બની વહાણુના એકાંત ભાગમાં જઈ એઠો, અને અરિઙ્તંત તથા સિદ્ધની સ્તુતિ કરી નિશ્ચય-પૂર્વક મનોગત ઓલ્યો:-કે જે હું આ ઉપસર્ગથી બયું, તો મારે કાયોત્સર્ગ પાળવો, નહિ તો મારે જીવનપર્યેત ચારે આહારના પ્રત્યા-ઘ્યાન, એ રીતે એણે ત્યાં સાગારી સંથારા કર્યો. અને પંચ પરમેષ્ઠિના

ધ્યાનમાં તલ્લાલીન થયો. તેવામાં તે પિશાચ અર્હનુક પાસે આવ્યો અને ઓલ્યોઃ કે આ તેં લીધેલું બત મૂડી દે, નહિ તો તારો સંહાર કરીશ. અને તારાં બધાં વહાણો પણ દૂખાડી હઈશ. આ ભયની અસર અર્હનુક પર કાંઈજ ન થઈ. તેણે કલ્યું કે ધન ધાન્યાદિ સર્વ ક્ષણિક પુદ્ગળો છે, તેની મને હરકાર નથી, તું તારં ધાર્યું કરી શકે છે. નાણુવાર હેવે તેને ભયથી, લાલચથી સમજાવવાનો પ્રયત્ન કર્યો, પણ અર્હનુક ઉગ્યો નહિ. આથી હેવે વહાણુને અધર ઉપાડ્યું, પણ અર્હનુક બેશ પણ ચલિત ન થયો, આમરે હેવ તેના પર પ્રસન્ન થયો, અને વહાણુને સહિસલામત જળની સપાટી પર મૂડી, અસલ સ્વરૂપે અર્હનુક સામે આવી, હાથ જોડીને ઉભો રહ્યો અને પોતાના અપરાધની ક્ષમા માગી, વંદન કરી ચાહ્યો ગયો. હેવના ગયા પછી અર્હનુક અનશન પાડ્યું. પછી ફરતો ફરતો તે મિથિલાનગરીમાં આવ્યો. ત્યાં તેણે રાજકુમારી મલિકદુંવરીને દિવ્ય યુગલ કુંડળની બેટ આપી, ત્યાં બેપાર કરી તે પુષ્કળ દ્રોઘ કર્માયો. ત્યાંથી તે સ્વબતનમાં આવ્યો અને બાકીનો બધો વર્ખત ધર્મ ધ્યાનમાં ગુજરી હેવલોકમાં ગયો.

૩૦ અર્જુનમાણી

મગધદેશની રાજગૃહી નગરીની બહાર એક બગીયો હતો. તેનો માલીક અર્જુન નામનો માળા હતો. તેને બંધુમતી નામે ખી હતી. તે સુસ્વહૃપા હતી. ધાગમાં એક યક્ષતું હેવાલય હતું. બંને જણ્ણું બાગમાંથી ઝૂલ્યો વીણું, તે હેવાલયમાંના મુદ્ગળપાણું નામક યક્ષની પ્રતિમાની પુણ્યોથી પૂજન કરતાં, અને શહેરમાં ઝૂલ્યો વેચી પોતાનું ચુફરાન ચલાવતાં. એજ નગરીમાં અર્જુનમાળાના છ મિત્રો હતા, જેએ ધણ્ણા દુષ્ટ અને ખરાખ વર્તનવાળા હતા. કોઈ તહેવારના દ્વિવસે તે છેએ જણ્ણું ફરતા ફરતા અર્જુનમાળાના બગીયામાં આવ્યા.

તે વખતે અર્જુનમાળી યક્ષની પૂજનમાં લીન હતો, ખીજ તરફ તેની ઓં બંધુમતી ખગીચામાં ફૂલો વીણુતી હતી, તેના પર આ છએ મિત્રોની દર્શિ પડતાં તેમને હુંસુંદ્રિ થઈ, છએ જણાએ સેકેત કરી અર્જુન-માળોને બાંધ્યો, અને પછી બંધુમતી પર બળાતકાર કર્યો. આ દર્શય જોઈ અર્જુનમાળી કોધાયમાન થયો અને યક્ષને ઉપાલંબ આપતો કહેવા લાગ્યો કેઃ—હે દેવ, હું તારી રે જ સેવા પુજ કરે છું, છતાં મારી જ હાજરીમાં, મારા સામે મારા આ હુંસ મિત્રો, મારી ઓની આઅરુ પર હાથ, મૂકે છે, એ તું કેમ જોઈ શકે છે ? મને સહાય કર. અર્જુનના આ ઉપાલંબથી યક્ષે અર્જુનના શરીરમાં પ્રવેશ કર્યો, તેના બંધન પૂરી ગયા. હાથમાં હળવ મણ વજનનું સુદૃગળ રહી મયું છે એવા યક્ષમય અર્જુને ત્યાંથી દોડી જાડને, તેના છ મિત્રો અને બંધુમતી ઓનો નાશ કર્યો. અર્જુનનો કોધ મહાતો ન હતો. સાત જણુને મારી નાખ્યા પછી તે શહેર તરફ ધરયો, અને જેટલા જેટલા માણુસો તેને રસ્તામાં મળ્યા, તે બધાનો તેણે જીવ લીધ્યો. શહેરમાં હાહાકાર થયો. રાજને ખખર પડી એટલે તરત જ નગરોના દરવાજા બંધ કરાવી દીધા. અર્જુનમાળી શહેર બહાર ઝીલ્લાની એથે એથે ચારે તરફ ધૂમતો હતો, અને નજરે અડતાં માણુસોનો સંહાર કરતો હતો. (આમ પાંચ માસ અને ૧૩ દિવસસુધી અર્જુનમાળી ઇયો અને ૧૧૪૧ માણુસોનો તેણે નાશ કર્યો.) કોઈ માણુસ શહેર બહાર નીકળવાની હિંમત કરતું નહિ, એવામાં લગવાન મહાવીર ઉધાનમાં પદ્ધાર્યાના સમાચાર શહેરમાં પ્રસર્યો. તે વખતે સુદર્શન નામનો લગવાનનો એક પરમ લક્ષ્ણ શ્રાવક હતો, તે આ સમાચારથી બેસી રહી શક્યો નહિ. તેણે રાજને વિનિતિ કરી, અને અતિ આગહે તે રણ લઈ શહેર બહાર નીકળ્યો, તેવામાં તેણે સામેથી વિકરાળ સ્વરૂપે આવતા અર્જુનમાળોને જોયો. મરણાંત ઉપસર્ગ જાણી, સુદર્શને ત્યાં સાગારી સંચારો કર્યો અને કાયોત્સર્ગ ધ્યાને ઉલો. અર્જુનમાળી તેના પર ધસી આવ્યો, અને સુદૃગળ ઉપાડી જ્યાં તેને મારવા જાય

છે કે તરત જ અધિકાર્યક હેવના પ્રલાને યક્ષ તેના શરીરમાંથી નીકળી પલાયન થઈ ગયો। લગભગ છ મહિનાનો બૂધ્યો તરસ્યો અજુન દીન બની, મૂર્ખ ખાંડ જરીન પર ટળી પડ્યો। સુદર્શને આશ્ર્ય પામી પ્રલુને આલાર માન્યો। તેણે અજુનમાળીને ઓધ આપ્યો અને લંઠ મહાવીર પાસે લઈ ગયો। લગવાનના ધર્મોપદેશથી વૈરાગ્ય પામી અજુનમાળીએ દીક્ષા લીધી અને જવજ્ઞવ પર્યત છઢુ છઢુનો તપ કરવાનો નિયમ કર્યો। પારણાને દિવસે શહેરમાં ગૌચરી અર્થે નીકળતા હજરો લોકો તેના પર પથરનો વર્ષાં વરસાવી, સંતાપ આપતા, તે સધળું ઉતૃપૃષ્ઠ પરિણામે અજુન મુનિ સહન કરતા અને આત્માના સ્વરૂપને વિચારતા, આ પ્રમાણે સમલાને પરિષહ સહન કરતા અને ત્યાગની સર્વોતૃપૃષ્ઠ ધારાએ પ્રવેશતાં એજ લવમાં અજુનમાળીને કૈવલ્યજ્ઞાન થયું અને તે કર્મનો ક્ષય કરી મોક્ષ પામ્યા.

૩૧ અષાડાભૂતિ

અષાડાભૂતિ નામના એક મહાસમર્થ આચાર્ય હતા, તેમને શિષ્યનો સારો પરિવાર હતો, એક શિષ્યના અંતઃકાળ વખતે તે આચાર્યે તેને કહ્યું કે તું અહિંથી કાળ કરીને જે હેવ થાય, તો મને આવીને કહી જને, શિષ્યે કાળ કર્યો અને તે દેવલોકમાં ગયો, પણ ત્યાંની સુખ સમૃદ્ધિમાં લીન થવાથી તે ગુરુ પાસે આવ્યો નહિ. આથી આચાર્યને જૈનમાર્ગની સત્યતા વિષે સંશય થયો, ‘સ્વર્ગ, નરક કે મોક્ષ જેવું કાંઈ છેજ નહિ, અને જે હોય તો મૃત્યુ પામેલો મારો શિષ્ય મારા પ્રેમને વરશ થઈ અહિંથા કુમ ન આવે?’ માટે આ જૈન માર્ગ છોડી હેવો અને ધેર જાઈ ક્ષી સુખ લોગવવું એજ ધાણ છે. આવો વિચાર કરી અષાડાભૂતિ ધર, તરફ જવા નીકળ્યા. આ વાત એલા હેવ થયેલા શિષ્યે અવધિજ્ઞાનથી જાણ્યો, એએ ગુરુને સ્થિર કરવા તે મૃત્યુલોકમાં આવ્યો અને રસ્તે જતા આચાર્ય સન્મુખ

તેણે નાટક ખતાવ્યું. નાટકના મોહમાં ગુરુ લોભાયા, અને એ રીતે નાટક જોવામાં છ માસ વીતી ગયા, પણ ગુરુને કંઈ જાન થયું નહિ. દેવે વિચાર કર્યો કે મારા પૂર્વ ગુરુમાં દ્યાનો અંશ છે કે નહિ? એ મારે જોવું જોઈએ. એમ વિચારી તેણે નાટક પૂર્ણ કર્યું. ગુરુ પોતાના ધર તરફ આગળ વધ્યા. ત્યારે દેવે ધરેણુથી લાદેલાં એવાં છ બાળકો વિકુલ્યાં અને ગુરુની સામે મોકલ્યાં. બાળકનાં શરીર પરનાં ધરેણું દેખી ગુરુ લોભાયા; અને તેમને એકાંતમાં લઈ જઈ નામ પૂજ્યાં. છેએ બાળકોએ ‘પૃથ્વી, અપ, તેણુ, વાયુ, વનસ્પતિ અને કાય’ એમ અનુષ્ઠાને પોતાના નામ કલ્યાં. મુનિએ વિચાર્યું કે મેં છકાયની દ્યા ધર્યું પાળા, પણ કંઈ હીં નહિ. એમ કહી ગુરુએ તે છેએ બાળકોને મારો નાભ્યા અને તેમનાં શરીર પરનાં ધરેણું ઉતારો, ઓળામાં મૂક્યાં. આ જોઈ શિષ્યદેવે વિચાર્યું કે ગુરુમાં દ્યાનો અંશ પણ રહ્યો લાગતો નથી. માટે હવે તેમનામાં શરીર રહી છે કે કેમ, એ મારે જોવું જોઈએ. એમ ધારી તે દેવે એક આવક સંધ ઉત્પન્ન કર્યો. એ ચાર અંગેસર આવકો અષાડાભૂતિ પાસે આવ્યા અને તેમને ‘મતથએણ વંદામિ’ કહી નભી પડ્યા અને એલ્યા કે:—ગુરુદેવ, બિક્ષાની વેળા થઈ છે, માટે કૃપા કરી અમારા ઉતારે પધારો, કેમકે અમારે મુનિને વહોરાબ્યા પછી જ જમવાનો નિષ્મ છે. પાત્રમાં ધરેણું ભરેલાં હતાં તે ખીકથી ગુરુએ સહેજ અયભીત અતાં કહ્યું કે મારે બિક્ષા જોઈતી નથી. આવકોએ ધર્યો આમાલ કર્યો, પરંતુ ગુરુ માન્યા નહિ, એટલે આવકોએ ગુરુની ઓળા પકડી, રક્જક કરતાં અનાયાસે ઓળી ખુટી ગઈ, અંદરના ધરેણું ઉધાડાં થયાં. ગુરુ શરેન્દ્ર બિંદા બન્યા. એટસે આવકો એક પછી એક કહેવા લાગ્યા કે આ તો મારા પૃથ્વી નામના બાળકનાં ધરેણું છે, ખીંને કહે, આતો મારા ‘અપ’ નામનાં બાળકનાં છે. એમ કહી ગુરુને ધમકાવતાં કહેવા લાગ્યા કે મહારાજ! આટલા ખધા નિર્દ્ય કેમ બન્યા? બતાવો, અમારાં બાળકો કર્યાં છે? ગુરુને આચી ધર્યો એદ થયો. દેવે જોયું

કે ગુરુને હજુ શરમ છે માટે સમજી શકશે, એમ ધારી તેણે ઉત્પન્ન કરેલાં બધાં રવરૂપો સંકેતી લીધા અને શિષ્યનું સ્વરૂપ ધરી ગુરુ સમીપે ઉભા રહી વંદન કર્યું અને પછી તેણે હેવ સ્વરૂપે પ્રગટ થઈ સધળો વૃત્તાંત કલ્યો; એટલે ગુરુને કૈનધર્મની અદ્ધા દ્વદ્ધ થઈ. પુનઃ તેમણે આરિન લીધું. અદ્ધા માટે પ્રાયશ્ક્રિત લઈ શુદ્ધ થયા અને સંઘમની ઉત્કૃષ્ટ શ્રેણિમાં પ્રવેશી મોક્ષ પામ્યા.

૩૨ આર્દ્રકુમાર.

સમુદ્રની મધ્યમાં આર્દ્રકપુર નગર હતું. ત્યાં આર્દ્રક રાજ રાજ્ય કરતો. તેને આર્દ્રકા નામની રાણી હતી અને ‘આર્દ્રકુમાર’ નામે પુત્ર હતો.

રાજગૃહ નગરીના રાજ શ્રેણીક અને આર્દ્રકપુરના રાજ આર્દ્રકને સારો સંબંધ હતો, તેથી તેમના રાજપુત્રો ‘આર્દ્રકુમાર અને અભયકુમાર’ને ભિત્રાચારી થઈ હતી. આ પ્રીતિની વૃદ્ધિ માટે બંને રાજાઓ અને બંને કુમારો પરસ્પર એકખીળને અવનવી લેટ મોકલતા હતા. એકવાર અભયકુમારે વિચાર કર્યો કે હું ધર્મ પામ્યો હોવા છતાં અનાર્થભૂભિમાં વસતા મારા આર્દ્રકુમાર ભિત્રને ધર્મ ન પમાડું તો અમારી ભિત્રાચારી શા કામની? એમ વિચારી એકવાર અભયકુમારે એક પેટીમાં તેને ધર્મના ઉપકરણો મોકલ્યાં અને તે પેટી એકાંતમાં ઉધાડી જોવાનું કર્યું. આર્દ્રકુમારે તે પ્રમાણે એકાંતમાં પેટી ઉધાડી ધર્મ ઉપકરણો જોયાં. આશર્થ સાથે તે સંબંધી વિચાર કરતાં તેને યાદ આપ્યું કે ‘પૂર્વે મેં આવી વરસુએ જોઈ છે.’ વિશેષ ચિંતિન કરતાં આર્દ્રકુમારને જાતિસ્મરણ શાન થયું. તે વડે તેણે પોતાના પૂર્વાવનું ઝુનિ સ્વરૂપ જોયું, આથી તેણે અભયકુમાર પાસે જવાની પિતા પાસે

આજી માગી; પણ પિતાએ જવાની રજ ન આપી, એટલું જ નહિ પણ તે છાનોભાનો જતો ન રહે, તે માટે ૫૦૦ રક્ષકો મૂક્યા. પરન્તુ નિશ્ચયબળવાળો આર્દ્રકુમાર બધાને ભૂલથાપ આપી, આર્થભૂમિમાં આવ્યો. અને સ્વહરસ્તે દીક્ષા લધુ મુનિ થયો. તે વખતે દેવોએ આકાશવાણીથી કહું કે હે આર્દ્ર! ‘તું દીક્ષા ન લે, હજુ તારે ભોગાવલી કર્મ બાકી છે.’ પણ આર્દ્રકુમારે તે માન્યું નહિ અને દીક્ષિત થયો. કેટલાંક વર્ષોં સંયમકાળમાં ગાજ્યા પછી, એક પ્રસંગે તે વસંતપુર નગરના ઉદ્ઘાનમાં આવ્યા અને કાઉસરગ ધ્યાને ઉલા રહ્યા. તેવામાં તે શહેરની કેટલીક શ્રીમંત બાળાએ ઉદ્ઘાનમાં દેવાલયના દર્શને આવી. તેમાં શ્રીમતી નામની એક અવિવાહિતા કન્યા હતી, તે ધ્યાનસ્થ મુનિને દેખ્યો મોહિત થઈ. નવયૌવનાએ ‘વરવરની રમત રમતાં’ શ્રીમતીએ આર્દ્ર મુનિનો પગ પડ્યો ‘આ મારા વર છે’ એવી મીડી મશકરી કરી, આર્દ્રમુનિ પોતાને ઉપસર્ગ આવરો, એમ ધારી ત્યાંથી વિહાર કરી ગયા. પરન્તુ શ્રીમતીની મશકરી સાચી હતી. આર્દ્રકુમાર મુનિ સાથે પરણવાનો તેનો દદ મનોભાવ હતો.

શ્રીમતીએ વરની પસંદગીની વાત પોતાના પિતાને કહી. પિતાએ બીજે લગ્ન કરવા તેણું સમજાયું પણ તે એકની એ ન થઈ. શ્રીમતીએ દાનશાળા માંડી અને સર્વ યાચકાને સ્વહરસ્તે દાન આપવા લાગી.

આમ ખાર વર્ષ પસાર થયા. પછી દિશા ભૂલવાથી કે સંયોગ-વશાતું આર્દ્રમુનિ મુનઃ વસંતપુરમાં આવ્યા અને શ્રીમતીએ માંડેલી દાનશાળામાં બિક્ષાથેં ગયા. શ્રીમતીએ મુનિને ઓળખ્યા-પકડ્યા અને પોતાને પત્રની તરીકે સ્વીકારવા આગ્રહ કર્યો, વળી જે મુનિ તેનો સ્વીકાર ન કરે, તો પોતે આત્મહત્યા કરશો એવી શીક બતાવી.

શ્રીમતીના અપાર સૌંદર્યમાં મુનિ લોલાયા અને પોતાનો મુનિવેશ ભૂકી તેની સાથે લગ્ન કર્યું. સુખભોગ લોગવતાં શ્રીમતીથી તેમને એક પુત્ર થયો, એટલે પુનઃ ચારિત્ર લધ ચાલી નીકળવાની શ્રીમતી પણે રજ માગી. તેવામાં તે ખાગડપુત્ર આર્દ્ર પણે આવ્યો. તેની કાલી ઓલીમાં આર્દ્ર લુલાધ થયો! અને ખીંન ખાર વર્ષ એ રીતે ગૃહસ્થાશ્રમમાં વીતાવ્યા.

ઉદ્ઘાટણ પૂરો થયો—ભોગાવલી કર્મ છુટ્યું હતું. એટલે તેમણે પુનઃ દીક્ષા લીધ્યા. રસ્તામાં પોતાના ૫૦૦ સામંતો મળ્યા તેમને ઉપરેશ આપી જૈનધર્મની દીક્ષા આપી. આગળ જતાં ગૌશાલક તથા તાપસો મળ્યા, તેમને વાદમાં જીતી લીધ્યા. હસ્તી તાપસોએ વીરપ્રભુ પાસે દીક્ષા લીધી. આર્દ્રમુનિ રાજગૃહમાં આવ્યા. ત્યાં અલયકુમાર તેમને વંદન કરવા ગયા. આર્દ્ર મુનિએ અલયકુમારનો આલાર માન્યો. ત્યારબાદ આર્દ્રમુનિ મહાવીરપ્રભુ પાસે રહ્યા અને ઉત્કૃષ્ટ સંયમ તપનું આરાધન કરી મોક્ષમાં ગયા.

૩૩ આનંદ ગાથાપતિ.

મગધ દેશના વાણિજ્યગ્રામ નામના નગરમાં આનંદ નામને ગાથાપતિ (ગૃહસ્થપતિ) રહેતો હતો. તે ધણો ધનવાન હતો. તેની પાસે ચાર કોડ સોનામહેરા જમીનમાં દાટેલો હતી, ચાર કોડ વેપારમાં રોકાયેલી અને ચાર કોડ ધરવખરામાં રોકાયેલી હતી. છિપરાંત તેને ત્યાં ૪૦ હજાર ગાયોના ૪ ગોકુળ હતા. તે ધણો બુદ્ધિમાન અને બ્યવહારકુશલ હોવાથી સૌ કોઈ તેની જ સલાહ કેતું. તેને શિવાનાંદા નામની સુસ્વરૂપવાન પત્તી હતી. ૭૦ વર્ષની ઉંમર થતાં સુધીમાં તે જૈનધર્મના તર્ત્વોથી અન્યાન્ય હતો. તેવામાં કોઈ એક સમગ્રે લગવાન મહાવીર તે ગામમાં પથાર્યું. હજારા લોકાની સાથે આનંદ, પ્રભુની દેશનામાં ગયો. પ્રભુએ ગૃહસ્થ

આવક અને સાધુનું આભેહુઅ સ્વરૂપ સમજાવ્યું. આનંદને જગ્ઞાસા બુદ્ધિ જાગી. અને પ્રભુ પાસે તેમણે શ્રાવકના બારવૃત્ત અંગીકાર કર્યા. ઘેર આવી તેમણે શ્રાવક ધર્મ અંગીકાર કર્યાની વાત પોતાની પત્નીને કરીને, તેણીને પણ તેમ કરવા ઉપદેશયું. એટલે શિવાદેવીએ પણ પ્રભુ પાસે જઈ બારવૃત્ત અંગીકાર કર્યા. એ રીતે ઉલ્લય પતિ-પત્ની શ્રાવક ધર્મનું સુંદર રીતે પ્રતિપાલન કરતાં, સુખપૂર્વક સમય વિતાવવા લાગ્યા.

દેવલોક કાળ આ પ્રમાણે પસાર થયા પછી આનંદને ઉચ્ચ તપશ્ચર્યા કરવાનું મન થયું, એટલે તેમણે સગાં સંબંધાઓને જમાડી, ગૃહદ્વાર્યાંભાર પોતાના મોટા પુત્રને સોંઘેં. અને પોતે શ્રાવકની ૧૧ પ્રતિમાઓનું વહન કરવા લાગ્યા. આકરાં તપથી શરીર હુર્બંલ બન્યું. એક વખત પૈષધવૃત્તમાં ધર્મચિંત્વન કરતાં તેમને અવધિજ્ઞાન થયું. તે વડે તેમણે પૂર્વ દિશામાં લવણું સમુદ્રમાં ૫૦૦ ધનુષ્ય સુધી દીકું. અને પથ્થમ તથા દક્ષિણમાં એટલું જ અને ઉત્તરમાં ચુલહિમવંત અને વર્ષધર પર્વત જેયા. ઉંચે સૌધર્મે દેવલોક અને નીચે રત્નપ્રભા નરકનો વાસ જેયો. આ જોઈ તેઓ જૂબ પ્રસન્ન થયા અને પ્રભુ મહાવીરના દર્શનની તેમને જગ્ઞાસા થઈ.

ભાગ્યવશાત્ પ્રભુ મહાવીર તેજ ગામમાં પધાર્યા. જૈતમ મુનિ જોયરીએ નીકળ્યા. લોકાને મોઢે આનંદના અનશન અને અવધિ જાનની વાત સાંલળી શ્રી જૈતમ આનંદ શ્રાવકની પૈષધવશાળામાં ગયા. જૈતમ મુનિને આવતાં જોઈ આનંદ વિધિપૂર્વક વંદન કર્યું. અને પછી વિવેકપૂર્વક પ્રભ કર્યો કે:—મહારાજ, શ્રાવકને સંસારમાં રહેતા થકાં અવધિજ્ઞાન થાય?

જૈતમે જવાય આપ્યો:—હા, થાય.

આનંદ—પ્રભુ! મને તે થયું છે. હું લવણું સમુદ્રમાં ૫૦૦ ધનુષ્ય સુધી, તથા સૌધર્મે દેવલોક અને રત્નપ્રભા નરક દેખ્યું છું.

આ સાંભળી જૈતમ સંશયમાં પડ્યા. તેમણે કહ્યું:—આનંદ,
તમે જુદું બોલો છો, એટલું દેખી થકાય નહિ, માટે કૃપાવાદનું
પ્રાયશ્ચિત્ત હોય.

આનંદ કહ્યું:—હેવ, હું યથાર્થ કહું છું. આપ ભૂલ્યા છો
માટે આપને જ પ્રાયશ્ચિત દેવું ધટે.

શ્રી ગૌતમને આ વાત હૈયે ન એઠી. તેઓ તો સંશયત્મક
બની ‘બહુ સાર’ કહી રહ્યે પડ્યા અને પ્રલુબ મહાવીર હેવ પાસે
આવી, બનેલી વિતક કહી સંભળાવી. પ્રલુબ મહાવીરે આનંદનું કથન
સત્ય છે, અને જૈતમનું કથન અસત્ય છે, કહેતાં જ આશ્ર્ય સાથે
શ્રી ગૌતમે પ્રાયશ્ચિત લીધું અને શ્રી આનંદ પાસે આવી પોતાની
ભૂલની માડી માગી.

આનંદ શાવકે ૨૦ વર્ષનું આવક્રમત પાળયું. મરણાંતે ૧ માસનું
અનશન કર્યું અને વિશુદ્ધ પરિણામે કાળધર્મ પામી તેઓ પહેલા
સૌધર્મ નામના દેવલોકમાં ગયા, જ્યાંથી મહાવિહેનમાં જનમ
લઈ મોક્ષમાં જરો.

૩૪ આનંદ બળહેવ.

ચક્રપુરી નામક નગરીમાં મહાશિર નામે રાજ હતો, તેની
વિજયંતી નામની રાણીથી આનંદ નામે ૬ ડા બળહેવ થયા.
તેઓ પુરિય પુંડરિક નામના વાસુદેવના ઓરમાન ભાઈ હતા.
તેમણે અરનાથ પ્રલુબના શાસનમાં દીક્ષા લોધી. સંયમ તપની ઉત્કૃષ્ટ
આરાધના કરીને, ૮૫ હજાર વર્ષનું આયુષ્ય બોગવી તેઓ નિર્વાણ
પાન્યા-મોક્ષમાં ગયા.

૩૫ આનંદ કુમાર

તેઓ રાજગૃહિના શ્રેણીક રાજના પુત્ર પ્રિયસેનના પુત્ર હતા.

ઉંમર લાયક થતાં ૮ કન્યાઓ પરણ્યા. પ્રલુબ મહાવીરના ઉપરેશથી ચારિત્ર લીધું. એ વર્ષ ચારિત્ર પાળી પ્રાણુત દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયા. ત્યાંથી તેઓ મહાવિદેહ ક્ષેત્રમાં જીન્મ લઈ મોક્ષમાં જશે.

૩૬ અંગતિ ગાથાપતિ

આવસ્તી નામની નગરીમાં, પ્રલુબ પાર્શ્વનાથના સમયમાં અંગતિ નામે મહાસમર્થ ગાથાપતિ હતો. એકવાર તે નગરીમાં લગવાન પાર્શ્વનાથ પદ્મારતા, અંગતિ તેઓના વ્યાખ્યાનમાં ગયા, અને પ્રલુબના બોધથી વૈરાગ્ય પામી, પોતાના મોટા પુત્રને ગૃહકાર્યભાર સેંપી સંયતિ થયા. અહુસ્ત્રી સ્થવીર મુનિ પાસે તે ૧૧ અંગ લણ્યા, ૩૬ અઠમાદિ તપશ્ચર્થી કરી. સામાન્ય ચારિત્ર પાળી અંતિમ સમયે ૧૫ દિવસનું અનશન કર્યું. પરન્તુ વિરાધક પણે મૃત્યુ પામવાથી તેઓ ચંદ્રાવતંશક નામના વિમાનમાં જયોતિષિના ઈદ્રપણે ઉત્પન્ન થયા. ત્યાં તે એક પલ્યોપમ અને એક લાખ વર્ષનું આયુષ્ય લોગવી મહાવિદેહમાં જીન્મ લેશે અને મોક્ષમાં જશે.

૩૭ ધ્યુકાર રાજી

ધ્યુકાર નામના નગરમાં ધ્યુકાર નામે રાજ હતો. તેને કુમ-ગાવતી નામે રાણી હતી. એજ નગરમાં ભૂગુ નામનો એક પુરોહિત, તેની જશા નામની સ્ત્રી અને તેના એ પુત્રો હતા. આ રીતે આ છએ જુવો પૂર્વભવમાં પહેલા દેવલોકના નલિતીગુદમ વિમાનમાં હતા. ત્યાંથી આયુષ્ય પૂર્ણ કરી, તે છએ ધ્યુકાર નગરમાં ઉત્પન્ન થયા હતા. ડેઢ આનંદના પ્રસંગે રાજાએ પુરોહિતને કેટલુંક ધન જગીર વગેરે આપ્યા હતા. પૂર્વના શુભ ઉર્મિના ઉદ્દેશ્યે પુરોહિત, તેની સ્ત્રી જશા અને ઘને પુત્રો, વૈરાગ્ય થતાં સર્વ ધનસંપત્તિ છોડી, પ્રવર્જિત થયા. આ વાતની ધ્યુકાર રાજને ખખર પડતાં, નિર્વશાયું (ખોનવારસવાળું) ધન

રાજએ પોતાના લંડારમાં લઈ લીધું. આ વાત કમળાવતી રાણીના જણવામાં આવી એટલે તેણે રાજને કહ્યું કે:— પ્રથમ દાનમાં આપેલું ધન આપણાથી પાછું ન લેવાય. જે ઓકેલું ધાન્ય ઇરી ખાઈ શકતું હોય તો જ દાનમાં આપેલું ધન પાછું લેવાય. ધન એ તો કલેશ, ચિંતા, અને લયનું કારણ છે. તે આપણને રોગ, જન્મ અને જરાથી મુકાવનાર નથી, માટે ધનનો મોહ છોડી ધર્મ-માર્ગમાં પ્રવર્તનું એ જ આપણો ઇરજ છે. એ પ્રમાણે અનેક ઘોધ-વચનો કહી કમળાવતીએ રાજને બુજાવ્યો અને પછી બને જણાએ ચારિત્ર અંગીકાર કર્યું. તીર્થકર માર્ગની વિશુદ્ધ આરાધના કરતાં ઈષુકાર રાજ મોક્ષ પાખ્યા.

૩૮ ઈદ્રભૂતિ ઉર્ફે ગૌતમ.

ગોથર નામના ગામમાં ગૌતમગોત્રી વસુભૂતિ નામે આલણુ હતો. તેને પૃથ્વી નામની સ્ત્રી હતી. તેમને ઈદ્રભૂતિ નામે પૂત્ર હતો. તે ચારવેદ, ચૌદ વિદ્યા, આદિ છ શાસ્ત્રોમાં પ્રવિષુ હતો. ઈદ્રભૂતિ પોતાના ગૌતમ નામના ગોત્ર પરથી “ગૌતમ” તરીકે પણ ઓળખાતા. આલણુ સમાજમાં તેમનું સાડું માન હતું. એકવાર રાજગૃહિ નગરીમાં બાહુલ નામના આલણુ યજ્ઞ આરંભ્યો. તેના આમંત્રણથી ગૌતમ વગેરે મોટા મોટા ૧૧ આલણુ આચાર્યો પોતાના વિશાળ પરિવાર સાથે યજમંડપમાં આવ્યા. તે સિવાય પણ બીજા ધણ્ણા આલણુએ હતા. એજ વખતે ભોગ મહાવીર દેવ રાજગૃહિ નગરીના ગુણુર્થીલ ઉદ્ઘાનમાં પધાર્યા હતા. ત્યાં દેવતાઓએ સમવસરણુની રચના કરી. રચના કરવા માટે દેવોના યુથો યજમંડપ પાસે થઈને નીકળ્યા. તે વખતે આલણુ ખૂશ થઈને વિચારવા લાગ્યા કે, આપણુ યજમંડપ જેવા માટે દેવો આવે છે, પણ થોડીજ વારમાં દેવો ત્યાંથી પસાર થઈને ગુણુર્થીલ ઉદ્ઘાનમાં આવ્યા. તપાસ

કરતાં આદ્યાએ જાણું કે દેવો તો સર્વરૂ મહાવીર નામના એક શ્રમણ આવ્યા છે ત્યાં ગયા. આથી ગૌતમ-ઇદ્રભૂતિ અલિમાન પૂર્વક બોલી ઉઠ્યા કે:-હું એકદોજ સર્વરૂ છું. મહાવીર તો સર્વરૂ પણનો દાવો કરનાર ઇદ્રભળળીઓ છે, અને તેથીજ તેણે ધર્માં આવનાર દેવોને બ્રહ્મમાં નાખી પોતાની તરફ એંચ્યા છે. એમ વિચારી તે ગૌતમ પોતાની સાથે ૫૦૦ શિષ્યો લઈ લ. મહાવીર ખાસે આવ્યા. ત્યાં સમવસરણુની સુંદર રચના જોતાંજ તે મૂઢ ખની ગયા. શરમને લીધે તે પાછા ઈર્યા નહિ. પણ મનમાં વિચાર્યું કે મારા મનમાં હણ્ણું ધણા સંશોધણા જોતાંજ તે ને સર્વરૂ કરનાર મહાવીર મારા સંશોધણા ટાને તો હું તેને સર્વરૂ તરીકે સ્વીકાર્ય.

મનઃપર્યવર્તાન વડે પ્રલુભ મહાવીરે ગૌતમના વિચાર જાણી લીધા અને કહ્યું:-ગૌતમ! વેદમાં ત્રણ ‘દ’કાર છે તેનો તને ધણા વખતથી સંશય છે તો સાંભળ, હું તેનું સમાધાન કરું છું. તે ત્રણ ‘દ’કારના નામઃ-દાન, દ્યા અને દમ છે. આ ઉપરાંત ‘જીવ છે કે નહિ’ એ બાખતની ઇદ્રભૂતિની શાંકાનું પ્રલુબે નિવારણ કર્યું. આથી ઇદ્રભૂતિનો સંશય દૂર થયો. અને ત્યાંજ તેણે પોતાના ૫૦૦ શિષ્યો સહિત ભગવાન પાસે દીક્ષા લીધી. અને ત્રિપદી-ઉપેવા, વિધેવા, ધ્રુવેવાથી ચૌદ્ધૂર્વનું શાન મેળવ્યું. પોતાના શાનખળ વડે તેઓ સર્વ સાધુ-એમાં મુખ્ય ગણધર થયા. લખિધવાંત અને સૂત્રાર્થના પારગામી ખન્યા. તેઓ હંમેશાં ભગવાનની પાસેજ રહેતા અને છઠ છઠના પારણ્ણા કરતા. પોતાને સંશય પડે કે ન પડે, તો પણ તેઓ ભગવાનને અનેક પ્રકારના પ્રશ્નો પૂછી શાન મેળવતા. એક ભગવતી સૂત્રમાંજ તેમણે છત્રીસ હળાર પ્રશ્નો ભગવાનને પૂછ્યા છે. ભગવાન મહાવીરહેવ પર તેમનો અતીશય મોહ હતો, અને તે કારણથીજ તેમના પછી દીક્ષિત થયેલા અનેક મુનિઓ કૈવલ્યજાન પામેલા, પરન્તુ શ્રી ગૌતમને કૈવલ્યજાન નહોતું થતું. આ મોહ છોડી દેવા ભગવાન ધર્મિવાર શ્રી ગૌતમને કહેતા, પણ ઉદ્ધમાન પ્રકૃતિને

અદ્યાપિ ગૌતમ રોકી શક્યા નહિ. એકવાર છેલ્લું ચોમાસુ ભગવાને
પાવાપુરીમાં કર્યું, ત્યારે અંતસમયે ભગવાને શ્રી ગૌતમને પોતાના
પરનો રાગ દૂર થઈ કૈવલ્યજ્ઞાન પ્રગટે તે માટે દેવરામી નામના ધાર્ષણને
પ્રતિષોધ આપવા અર્થે મોક્ષયા. તે વખતે એટલે કાર્તિક વદ્દી ૦))
(ગુજરાતી આશો વદ્દી ૦))) ના દિવસે પાછળી રાત્રે ભગવાન
નિર્વાણ (મોક્ષ) પામ્યા. પ્રલુનો નિર્વાણ મહોત્સવ ઉજવવા આવતા
દેવોને દેખીને શ્રી ગૌતમે આ વાત જાણી ત્યારે તરતજ તેઓ
મૂર્ખી પામ્યા. મૂર્ખી વજ્યા પછી પ્રલુના વિરહ માટે શ્રી ગૌતમ
ગણુધર વિલાપ કરવા લાગ્યા. ‘વીર, વીર’ શબ્દનો ઉચ્ચાર કરતા
તેમને આત્મતત્વ-વીતરાગદશાનું અપૂર્વ લાન થયું અને તેઓ
ક્ષપક શ્રેણિમાં પ્રવેશ્યા કે તરતજ તેમને કૈવલ્યજ્ઞાન પ્રગટ્યું અને
તેઓ મોક્ષમાં ગયા. શ્રી ગૌતમે ૫૧મા વર્ષે દીક્ષા લીધી હતી.
૧૧ મા વર્ષના પ્રારંભે તેમને કૈવલ્યજ્ઞાન થયું હતું. ૧૨ વર્ષ કૈવલ્ય
પ્રવર્ણિયામાં વિચચરી અનેક જીવોનો ઉદ્ઘાર કરી ૬૨ વર્ષની ઉંમરે
તેઓ મોક્ષ પધાર્યા હતા.

૩૬ ધ્લિાચીકુભાર.

ધ્લિાવર્ધન શહેરમાં એક ધનદત્ત નામના શેઠનો તે પુત્ર હતો.
એકવાર કેટલાક નટ લોકો તે શહેરમાં રમવા આવ્યા અને ધનદત્ત
શેઠની હવેલી પાસે વાંસડાએ ઉભા કરી રમત શરૂ કરી. આ નટ-
લોકોને એક સુસ્વિપ્તવાન કન્યા હતી. જરૂર્ખામાં એઠા એઠા રમત
નિહાળતાં આ કન્યા પર ધ્લિાચીકુભારની દાઢિ પડતાં જ તે તેના
પર મોહિત બન્યો. અને તે નટકન્યા સાથે લગ્ન કરવાનો વિચાર
કર્યો. આ વાત તરતજ તેણે પોતાના પિતાને કહી, અને અદ્દાક
ધનના લોગે પણ તે નટકન્યા પોતાની સાથે પરણાવવાનો આગ્રહ
કર્યો. ધનદત્ત શેઠ ધ્લિાચીને તેમન કરવા, અને પોતાની જ્ઞાતિની
દૃપસુંદર કન્યા લાવી આપવા ધણું સમજાવ્યો, પણ ધ્લિાચી એકનો
એ ન થયો. ત્યારે તેના પિતાએ આ વાત નટને કરી, તેની કન્યા

ઈલાચી વેરે પરણાવવાનું કહ્યું. ત્યારે નટે જવાબ આપ્યો કે જે તમારો પુત્ર અમારી સાથે રહી નટવિદ્ધામાં ગ્રવિષ બની રાજને રીતે તો હું મારી કન્યા એને પરણાવું. આ વાત સાંભળી ઈલાચી પુત્ર ગ્રથમ તો સંકોચાયો, પરન્તુ મોહની ગ્રથળ જળ પાસે તેનું કાંઈ ચાલ્યું નહિ. નટની ઈચ્છાને તે તાથે થયો, અને મકાન, ધન વગેરે બધું છોડી ઈલાચી નટલોકો સાથે ભળી ગયો. થોડા વખતમાં તે નટવિદ્ધામાં ખૂબ પારંગત બન્યો. ફરતા ફરતા તે નટ લોકોની સાથે કોઈ એક મોટા શહેરમાં આવ્યો. કુશળ નટોની ઘ્યાતિથી ત્યાંના રાજએ રાજચોગાનમાં નટોને ઉતારી રમત શરૂ કરાવી. હજનરો પ્રણજનો જેવા આવ્યા. તે વખતે નટ કન્યાનું સુંદર રૂપ જોઈ રાજ તેના પર મોહંધ થયો. બીજુ તરફ ઈલાચી વાંસડા પર ચડી દોરી પર વિધવિધ જતના ખેલ કરવા લાગ્યો. લોકોએ હર્ષના ઉદ્ગાર કાઢ્યા, ઈલાચીએ નીચે આવી રાજને સલામ કરી, પણ રાજ મૌન રહ્યો. તેણે નટને ઈનામ ન આપ્યું. કાંઈક આમી હશે એમ ધારી પુનઃ ઈલાચી દોરી પર ચડી નાટક ભજવવા લાગ્યો અને સુંદર દસ્યો બતાવ્યા. પ્રણએ વાહવાહ પોકારી. નટે નીચે ઉતારી ફરી રાજને સલામ કરી, પણ રાજએ બીજુ વખત પણ દાન ન આપ્યું. તેની નજર તો એ નટીપરજ હતી. ત્રીજીવાર ઈલાચી વાંસ પર ચડ્યો અને ઈનામ મેળવવાની લાલચે જીવ સટોસ્ટના ખેદો કરવા લાગ્યો. ખેલ કરતાં તેની નજર એક દૂરના મહેલમાં પડી. તે વખતે એક નવયૌવતા-વખાલંકારથી સુશોલિત સ્વરપવાન ઝી એક મુનિને લાડુ વહેરારાવતી હતી, નિરસૃહિ મુનિ નીચી દણિએ ‘પોતાને જરૂર નથી’ એમ કહી લાડુ લેવાની ના પાડતા. એકાંત છતાં અલયર્યે અને સંયમનું આવું ઉત્કૃષ્ટ દસ્ય દેખી ઈલાચી મુંઝાયો, તેને પોતાની સ્થિતિ, નીચ કન્યાનો ગ્રેમ ઈત્યાદિનું ભાન થયું, ઈલાચી પશ્ચાતાપ કરવા લાગ્યો કે અહો, કચાં આ મહાત્મા, અને કચાં હું વિષયમાં લુઘ પામર કીડે! એક ઝીને ખાતર હું નાત, જત, સગાં સંખ-

ધીએં, ભાતાપિતા અને વિપૂલ સંપત્તિને છાડી શહેરે શહેર ભટકું છું; અને ભીખના દુકાથી જીવન નિર્વાહ ચલાવું છું, હું કોણ ? માર્યા સ્વરૂપ શું છે ? એ વિચારતાં જ તેને પૂર્વ રમરણ થયું અને અનિત્યભાવમાં પ્રવેશતાં કૈવલ્યજ્ઞાન થયું. દેવોએ તેને મુનિવેશ આપ્યો. નીચે ઉત્તરી તેણે પ્રજનનોને બોધ આપ્યો. જે વડે નટ કન્યા પણ વૈરાગ્ય પામી. રાજને પણ ‘નટના ભૂત્યુ ચિંત્વન’ મારે પશ્ચાત્તાપ થયો, અને એ રીતે (અંથાધારે) ઈલાચીકુમાર, નટકન્યા અને રાજને કૈવલ્યજ્ઞાન થયું. અને તેઓ મોક્ષમાં ગયા.

૪૦ ઉત્ત્રસેન રાજન.

કંસના પિતા ઉત્ત્રસેન, એ લોજવિષણુના પુત્ર હતા. પિતાની પછી પોતે ગાઢી પર એહા હતા. તેમને ધારિણી નામની સ્ત્રી હતી. એકવાર ઉત્ત્રસેન રાજને કોઈ એક તાપસને પોતાને ત્યાં જમવા મારે પારણાનું નોતર્દં આપ્યું, પરન્તુ તે વિસમૃત થવાથી તાપસને જમાડચા નહિ. આ પ્રમાણે ત્રણ વખત તેણે તાપસને જમવાનું નોતર્દં આપ્યું, પરન્તુ બધીયે વખત તે તેને તેવાનું વીસરી જ ગયો. આથી તાપસને ધણો પશ્ચાત્તાપ થયો, તેણે પોતાનું ભયંકર અપમાન થયેલું માન્યું ને તે અપમાનનો બદલો લેવાનો નિર્ણય (નિયાણું) કરતાં તે તાપસ ભૂત્યુ પામીને તેજ ઉત્ત્રસેનની પત્ની ધારિણીની કુક્ષિએ પુત્રપણે અવતર્યો. ગર્ભધારણના સમય દરમાન રાણીને અરાબ દોહદ ઉત્પન્ન થવાથી તેણીએ માન્યું કે કોઈ પાપી જીવ પોતાના ઉદરમાં ઉત્પન્ન થયો છે; આથી તેણીએ પ્રસવેલા તે કુંવરને જન્મતા વેંતજ, એક કંસાની પેટીમાં ધાલ્યો અને તે પેટી યમુના નદીમાં તરતી મૂકી. બીજી તરફ રાજને કહેવાગયું કે કુંવર જન્મીને તરત જ ભૂત્યુ પામ્યો છે. આ પેટી તરતાં તરતાં એક વણિકના હાથમાં આવી. તેણે ધેર લઈ જઈને તે પેટી ઉધાડી, તો તેમાંથી તરતનું

જન્મેલું બાળક નીકણ્યં. વણિક તેને પોતાને ત્યાં રાખી સાર સંભાળ કરવા લાગ્યો. કંસાની પેટીમાંથી નીકળેલ, માટે તેનું નામ કંસ રાખવામાં આવ્યું. કંસ અનુકૂળે વયવૃદ્ધિ કરવા લાગ્યો. વખત જતાં તે ખૂબ તોષાની નીવડયો, આથી વણિકે કંટાળાને તે પુત્ર વસુદેવ રાજને સોંપ્યો. એકવાર તે કંસ, વસુદેવની સાથે રાજ જરાસંધના દુશ્મન સિંહરથને પકડવા ગયો, તેને પકડયા પછી તે જરાસંધની પુત્રી જીવયશાને પરણ્યો. પોતે ઉત્ત્રસેન રાજનો પુત્ર છે અને ભાતાએ તેને જન્મતાં જ નહીંમાં ફેંકી દીધો હતો, આ વાતની તેને ખ્યાર પડતાજ, તેણે ઉત્ત્રસેનને કેદમાં પૂર્યો અને પોતે ગાદીપર ઘેડો. પાછળથી શ્રી કૃષ્ણુ કંસને મારી ઉત્ત્રસેનને છોડાવ્યો; પણ ઉત્ત્રસેન જરાસંધના ભયથી કૃષ્ણ સાથે નાસીને દારિકામાં આવી રહ્યો. ઉત્ત્રસેનને કંસ ઉપરાંત અતિમુક્તા પુત્ર તથા રાજેમતિ નામક પુત્રી વગેરે હતા. રાજેમતી અને અતિમુક્તા કુમારે જૈન પ્રવર્ણાં અંગીકાર કરી હતી.

૪૧ ઉજાજવાળી કુમાર.

શ્રેણિક રાજની ધારિણી નામક રાણ્ણોના એ પુત્ર અને જલી-કુમારના સગા ભાઈ હતા. યૌવનાવરસ્થા થતાં તેઓ આઠ વર્ષીએ પરણ્યા હતા. લ. મહાવીરની દેશના સંભળા તેમને વૈરાગ્ય થયો અને મહાવીર ગ્રલુ પાસે દીક્ષા લીધી. સોળ વરસ ચારિત્ર પાણ્યું. ગુણ રત્ન સંવત્તસર નામનો મહાતપ કર્યો. અને અંત સમયે અનશન કરી, મૃત્યુ પામી તેઓ જ્યાંત વિમાનમાં દેવ થયા. ત્યાંથી ચ્યવી તેઓ મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈ મોક્ષમાં જશે.

૪૨ ઉજ્જીવન કુમાર.

હસ્તિનાપુર નામનું નગર હતું. સુનંદ નામનો રાજ રાજ્ય કરતો હતો. તે નગરમાં એક જ્ઞેવા લાયક અનેક સ્તંભવાળી ચેશાળા

હતી. જેમાં ગાય, લેંસ, બળદ, પાડા વગેરે અનેક પશુઓ સુખપૂર્વક રહેતા હતા. તે ગામમાં ભીમ નામે એક કુડાછી રહેતો હતો તે ધાણોજ પાપી હતો. તેને થપ્પલા તામે સ્વી હતી. તે ગર્ભવંતી થઈ ત્યારે તેને ગાય લેંસના આંચળનું તથા ગરદનનું માંસ ખાવાનો દોહદ ઉત્પન્ન થયો. દોહદ પૂર્ણ કરવા નિરંતર તે ચિન્તાતુર રહેતી, અને આર્ત્થાન ધરતી. એક વાર ભીમને આ વાતની ખાફર પડી એટલે તે મધ્ય રાત્રીએ ગૌશાળામાં આવ્યો અને હથીયાર વડે કેટલી-એક ગાયો. તથા લેંસોની ગરદન તથા આંચળની ચામડી કાપી નાખી, અને માંસ લઈને ધેર આવ્યો. સ્વીએ તે માંસ દાઢ સાથે મેળવી લક્ષણ કરી, પોતાનો દોહદ પૂર્ણ કર્યો. અનુકૂમે નવમહિને તેણે એક બાળકનો જન્મ આપ્યો. જન્મતાવેંતજ બાળકે એક મહેઠી લથાનક ચીસ પાડી, જેને પરિણામે ગામનાં ધણ્ણા ઢોર બીકથી નાસલાગ કરવા લાગ્યા. તેથી આ બાળકનું નામ ‘ગોત્રાસિયા’ પાડયું. આ બાળક મહેઠું થયું ત્યારે તેનો બાપ ભીમ ભરી ગયો. ગોત્રાસિયો ધણ્ણા અધર્મી, કુકર્મ સેવનારો નીવાયો, તેથી રાજાએ તેને સેનાપતિ બનાવ્યો કે જેથી ગામમાં તેના હુષ્કર્મી ઓછાં થાય; છતાં ગોત્રાસીયો રોજ અધી રાતે ઉડી, અખતર પહેરી હાથમાં હથીયાર લઈ ગોશાળામાં જાય અને અનેક પશુઓના માંસ કાપી તેનું લક્ષણ કરે. આવી રીતે ધણ્ણા પાપનો મુંજ લેગો. કરીને ગોત્રાસીયો મરણ પામીને બીજુ નરકમાં ગયો.

ત્યાંથી નીકળીને તે વાણીજય નામના ગામમાં વિજયભિત્ર સાર્થકાણે ત્યાં તેની સ્ફુલદ્રા નામની સ્વીને પેટ પુત્ર પણે અવતર્યો. અવતરતાંજ તેને ઉકરડામાં હૈંકી દીધો, છતાં ફરીથી પાછો લાવ્યા; તેથી તેનું નામ ઉજ્જીવકુમાર પાડયું. અનુકૂમે યુવાવસ્થા પામતા આ ઉજ્જીવકુમાર હુર્વસની અન્યો. કોઈવાર જુગારીને ત્યાં, કોઈવાર વેશ્યાને ત્યાં, કોઈવાર કલાકને ત્યાં એમ રખડવા લાગ્યો. તે ગામમાં

એક કામધ્વજન નામની ગણિકા હતી. તે ધર્ણી ચતુર અને વિલક્ષણું હતી. ગાવામાં ધર્ણી પ્રવિષુ, હાથીની ચાલે ચાલનારી, ચંદ્રમુખી, સુશોલિત અને ચિત્તાક્ર્ષક હતી. એક હજર સોનામહોર તેને રાજ તરફથી મળતી, રથ પાલખી વગેરે રાજ તરફથી તેને બક્ષીસ આપવામાં આવ્યા હતા. અને સુખપૂર્વક તે દીવસો વ્યતીત કરતી હતી. ઉજ્જીવિકુમાર આ વેસ્થાના ત્રૈમભાં પડ્યો અને લોગ લોગવવા લાગ્યો. એકવાર રાજની સ્વીને ગુલ્લ સ્થાનમાં શળ રોગ ઉત્પન્ન થયો. તેથી રાજએ આ ઉજ્જીવિકુમારને કામધ્વજન ગણિકાના ધરમાંથી કાઢી મુક્યો. અને કામધ્વજનને પોતાના જનાનામાં રાખી.

ગણિકાના ધરમાંથી નીકળવાથી ઉજ્જીવિકુમાર મૂર્છા પામ્યો. કામધ્વજનના મોહમાં આસક્ત બનવાથી, તેમજ તેને ક્યાંછ ચેન ન પડવાથી, તે હરાયા ઢોરની માછક રખ્યા લાગ્યો અને કામધ્વજનને મળવાનો લાગ શોધવા લાગ્યો. એકવાર બરાબર લાગ જોઈને તે કામધ્વજનના ધરમાં પેસી ગયો અને તેની સાથે લોગ લોગવવા લાગ્યો. એટલામાં રાજ સ્નાન કરી, વસ્ત્રાલંકાર પહેરી કેટલાક ભાણુસોની સાથે તે કામધ્વજન ગણિકાના આવાસમાં આવી પહોંચ્યો. ત્યાં કામધ્વજનની સાથે ઉજિઝ્યકુમારને લોગવિલાસ કરતો જેયો. રાજ કોધે ભરાયો. ભાણુસો ભારકૃત તેને પકડાવ્યો અને ઘૂંઘ માર ભરાવ્યો. અને હુકમ કર્યો કે આના બધા અંગો બાંધીને ઘૂંઘ માર ભારો. તેના નાક કાન કાપી નાખો અને બને તેટકો તેના પર જુલમ ગુજરી ગામભાં ફેરવી શુણી પર ચઠાવો. આ હુકમ સાંલળી ભાણુસો તે પ્રમાણે કરવા તત્પર થયા. પ્રથમ તેને હાથ પગમાં બેડી પહેરાવી, નાક કાન કાપી નાખ્યાં, ચોર જેવા કપડા પહેરાવ્યા, મ્હેંં કાળું કર્યું, શરીર પર જેડ ચોપડી, અને ગામભાં ફેરવવા લાગ્યા. રસ્તામાં તેને ઘૂંઘ માર ભારતાં, તેના શરીરના ગ્રીણા ગ્રીણા કકડા કરી તેને ઘરરાવતાં ઘરરાવતાં, ત્રાસ પમાડતાં પમાડતાં ગામ વચ્ચેથી લઈ

જતા હતા. ઉઝીયકુમાર ત્રાસ ત્રાસ પોકારી રહ્યો હતો અને કર્મનો અદ્વો ભોગવતો હતો.

તે સમયે પ્રલુબુ મહાવીર તેજ નગરના ઉદ્ઘાનમાં ખીરાજતા હતા. શ્રી ગૌતમ પ્રલુની આજા લેખ્છ ગૌચરી અર્થે નીકલ્યા હતા. રસ્તામાં તેમણે આ દ્રશ્ય જેયું. ગૌતમે વિચાર્યું કે પૂર્વ લવના ખરાખ આચરણથી તે આવી હુઃખદ દશાને પામ્યો હશે. ત્યાંથી ગૌતમ શ્રી પ્રલુપાસે આવ્યા. રસ્તામાં જેથેલ દ્રશ્યની વાત કરી. પ્રલુએ ઉઝીયકુમારનો ઉપર કહ્યો તે પૂર્વલવ વર્ણાવ્યો. શ્રી ગૌતમે પૂછ્યું, હે પ્રલુ! હવે ઉઝીયકુમારનું શું થશે? અને ભરીને તે કયાં જરો? પ્રલુએ ઉત્તર આપ્યો. હે ગૌતમ, આ ઉઝીયકુમાર હવે ત્રણજ પહોરનું આયુષ્ય ભોગવીને, શ્રી પર ચઢીને ભરણ પામશે અને પહેલી નરકમાં જરો. ત્યાંથી ચવી તે અનંત સંસારમાં પરિબ્રમણ કરશે. છેવટે એક શેઠને ત્યાં સાધુ મહાત્માની પાસેથી ધર્મ સાંભળી દીક્ષા લેશે. ત્યાં આયુષ્ય પુર્ણ કરી પહેલા દૈવકોનું જરો. અને પછી મહાવિદેહ ક્ષેત્રમાં જન્મી સર્વ હુઃખોનો અંત કરશે.

૪૩ ઉદાયન રાજ.

સિંહુ (સૌવીર) દેશના વિતલય નગરનો તે મહારાજ હતો. મહાસેન વગેરે દશ મુકુટધંધ રાજાઓ તેની આજામાં રહેતા. એ સોણ દેશનો સ્વામી ગણુંતો. તેને પ્રભાવતી નામક રાણી હતી. એકવાર ઉદાયન રાજને, સુવર્ણગુલિકા નામક દાસીને કારણે ઉનજયિનીના રાજ ચંડપ્રધોત સાથે યુદ્ધ કરવાની ઇરજ પડી હતી, તેમાં ચંડપ્રધોતનો પરાજ્ય થયો. તેને પકડીને સ્વદેશમાં પાછા ફરતા રસ્તામાં ચોમાસુ શર થવાથી, ઉદાયન રાજને પડાવ નાખીને એક સ્થળે રોકાવું પડ્યું. ઉદાયન રાજ જૈનધર્મી અને પ્રલુ મહાવીરનો પરમભક્ત હતો. તેથી તેણે મહા પર્વ સંવત્સરીને દિવસે

પૌષધ કર્યો. ચંડપ્રદોતે પણ પૌષધ કર્યો હતો. પ્રતિકુમણુને અંતે ઉદાયન રાજએ ચંડપ્રદોતની ક્ષમાપના ભાગી, તે વખતે ચંડ પ્રદોતે ‘કેદીને ક્ષમાપના શી’ એવો જવાબ વાલ્યો. પ્રાતઃકાળે પૌષધ પાળાને ઉદાયન રાજએ ચંડપ્રદોતને બંધનમુક્ત કર્યો અને તેને દાસી સાથે પરણુવીને ઉજાજયિનીને માર્ગે રવાના કર્યો. ત્યારાદ ઉદાયન રાજ વિતલય નગરમાં આવ્યો. એક દિવસે તેને લગવાન મહાવીરના દર્શનની અલિલાષા થઈ. તેવામાં જ પ્રલુબીર તે નગરમાં પદ્ધાર્યો. આ સમાચાર સાંભળી ઉદાયન રાજ ધામધૂમ પૂર્વક પ્રલુના દર્શને ગયો, અને દેશના સાંભળી વૈરાગ્યગ્રેરિત બન્યો. તેને ચારિત્ર દેવાની ઉત્કટ ઈચ્છા થઈ, પરન્તુ તે સાથે એવો વિચાર થયો કે, જે હું માઝે રાજ્ય આરા મુત્ર અલિય કુમારને આપીશ, તો તે રાજ્યમાં આસક્ત અનીને નરકે જશે, તેથી કેશીને રાજ્ય આપવું છાણ છે. એમ ધારી તેણે શેર આવી પોતાનું રાજ્ય પોતાના ભાણેજ કેશીને આપું અને પોતે દીક્ષા લઈ ચાલી નીકલ્યો. (અલિયકુમાર રિસાઈને ચંપાનગરીમાં કોણ્ણિક પાસે જઈ રહે છે. પૂર્વકથા)

ઉદાયન મુનિ લ. મહાવીર પાસે ૧૧ અંગ ભણ્યા અને પ્રલુની આજા ભાગી એકલ વિહારી થયા. ફરતા ફરતા તેઓ વિતલય નગરમાં આવ્યા. આ સમાચાર કેશી રાજને ભળતાં, તેને વિચાર આવ્યો કે માઝા પોતાનું રાજ્ય પાછું લઈ દેવાની લાલચે અહિ આવ્યા જણાય છે. તેથી તેણે ઉદાયનને ક્ષાંઈ પણ રહેના માટે સ્થાન ન આપવાનો પ્રણને આદેશ આપ્યો; પરન્તુ આ આદેશનો અનાદર કરીને એક કુંભારે ઉદાયનમુનિને ઉતારો આપ્યો. કેશી રાજએ એક બીજી યુક્તિ રચી. તેણે એક વૈદ્ય મારકૃત તેમને આહારમાં જેરી દવા અપાવી. આ દવાથી ઉદામન મુનિને શરીરમાં અતૂલ વેદના થઈ. પરન્તુ મુનિએ કોઈ ઉપર કોણ પણ કોણ ન.

કરતાં આ બધું સમભાવે સહન કર્યું, અને આત્મભાવના પ્રદિપ કરી. અનુકૂળે ક્ષપક એણીમાં પ્રવેશતાં તેમને કૈવલ્યજ્ઞાન થયું અને તેઓ મોક્ષમાં ગયા. (અંતકૃત)

મહારાજ ઉદાયન અને ચંડપ્રદોત અને વૈશાળિના ચેડા મહારાજના જમાઈ હતા.

૪૪. ઉદાયન (૨)

કૌશાંખી નગરીના શતાનિક રાજ અને ભૂગાવતી રાણીનો તે પુત્ર હતો. શતાનિકના ભૂત્યુ પઢી ભૂગાવતી રાણીની કુશલતાથી ઉદાયન રાજ્યાસન પર બેડો હતો. તે ગાંધર્વ વિદ્યામાં પ્રવિષ્ટ હતો. એકવાર ઉજાયિની નરેશ ચંડપ્રદોતે એક લાકડાનો હાથી અનાવી, તેમાં સુલેટોને બેસાડી વનમાં છૂટો મૂક્યો. આ હાથીને ઉદાયન પકડવા ગયો, પરન્તુ તે પોતે જ પકડાઈ ગયો. અને ચંડ પ્રદોતનો કેદી અન્યો. ચંડપ્રદોતને વાસવદત્તા નામે એક અવિવાહિત પુત્રી હતી, તેને ગાંધર્વાદિ કળા શીખવવા માટે ઉદાયનને રાખ્યો. ઉદાયને વાસવદત્તાને સર્વ પ્રકારની વિદ્યા શીખવી, આથી તે બંનેને પરસપર પ્રેમ બંધાયો. સારો ચોગ અળતાં ઉદાયન અને વાસવદત્તા બંને આ ઉડુધન વિદ્યાથી નાસી ગયા. ચંડપ્રદોતે તેમને પકડવા ધણી કોશીશ કરી, પણ શાબ્દો નહિ, તેથી પ્રધાનોના સમજાવવાથી ચંડપ્રદોતે સ્વહરતે પોતાની પુત્રી વાસવદત્તા, ઉદાયનને પરણાવી અને પોતાના જમાઈ તરીકે તેને કણુલ રાખ્યો.

૪૫ ઉંઅરદત

પાડલીસંડનગર, સિદ્ધાર્થરાજ, સાગરદત્ત શાહુકાર, ગંગદત્તા નામે તેની સ્વી, તેને એક પુત્ર, નામ ઉંઅરદત.

અલુ અણાવીર તે નગરમાં મધ્યાર્થી. શ્રી ગૌતમ બિક્ષાર્થી નીકળ્યા. તેમણે એક મહા રોગીષ પુરુષ જ્યેયો. જેને ખુજલી, કોટ,

જલંદર, ભગંદર, આદિ ધણુ રોગો હતો. હાથપગ સુન્દેલાં, આંગળાયો સડેલી, નાક અનમાંથી નીકળતી રસી, મહોઢાં પર ગુમડાં, તેમાંથી નીકળતું લોહી, ઉદ્દીમાંથી નિકળતું લોહી, બણુથણુતી માંખીયો, ફોલાં કપડાં, ખાવા માટે પુટેલું હૃષ્ણં, પાણી માટે પુટેલો ધડો હાથમાં રાખી ધરધર લટકતો આવો એક લિખારી શ્રી ગૌતમે જેવાથી 'કર્મની વિચિત્રતા' પર વિચાર કરતા, તેઓ પ્રભુ મહાવીર પાસે પહોંચ્યા અને તેની હકીકત પૂછી. પ્રભુએ તેનો પૂર્વ પરિયથ આપતાં કહ્યું:—

વિજયપુર નામનું નગર હતું. કનકરથ નામે રાજ હતો. ત્યાં ધનવંતરી નામનો વૈઘ હતો. તે વैદિકળામાં પ્રવીણુ હતો અને આખા ગામની દ્વા કરતો હતો. દરદીઓમાંના કોઈને તે મચ્છીનું માંસ ખાવાનું કહેતો, કોઈને કાચખાનું માંસ ખાવાનું કહેતો, કોઈને અકરીનું, કોઈને રોજનું, કોઈને મૃગનું, કોઈને ગાયનું તો કોઈને કશુતરનું. એમ જુદા જુદા ગ્રાણીઓનું માંસ ખાવાનું સૂચવતો અને તે પોતે પણ મચ્છીનું માંસ રોજ આતો હતો. વળી દાડ પણ પીતો હતો. આવી રીતે માંસ દાડમાં ચકચૂર બની ખીજને માંસ ખાવાનો ઉપદેશ આપી મહા પાપકર્મ સેવી ઉ૨૦૦ વર્ષ જીવીને તે મરણ પામ્યો અને છઠી નરકે ગયો.

ત્યાંથી નીકળાને તે ધનવંતરી, સાગરદત્ત શાહુકારને ત્યાં ગંગદત્તા ખીની કુલિમાં આવ્યો. ગર્ભમાં ગંગદત્તાને યક્ષની પુણ કરી દાડ માંસ ખાવાનો દોહદ થયો. સાગરદત્તો તે દોહદ પુરો કરાવ્યો. યક્ષના પ્રભાવે પુત્ર ભલ્યો એમ માની તેનું નામ ઉંબરદત્ત રાખ્યું. આદ્યાવરસ્થા વીતાવી ઉંબરદત્ત ખુવાન થયો. તેના માતાપીતા મરણ પામ્યા. રાજએ તેના ધરમાંથી ઉંબરદત્તને હાંકી કાઢ્યો અને ઉંબરદત્તને થોડા વખત આદ પાપકર્મના ઉદ્યથી ઉપર પ્રમાણે મહાન

રૈંગો ઉત્પન્ન થયાં. તે મહા વેદનાના દુઃખથી ભરણું પામીને એતેર વરસનું આચુષ્ય લોગવી પહેલી નરકમાં જરો. ઉપરનું કથન સાંભળી શ્રી ગૌતમે તેનો પશ્ચાતલવ જાણવા દઈછા બતાવી. પ્રલુબે ઉત્તર આપ્યો. ઉંબરદટ પહેલી નરકમાંથી નીકળી અનંત સંસાર લટકરો અને કર્મક્ષય થતાં મોક્ષગતિને પામરો. (દુઃખવિપાક)

૪૬ ઋષભદત્ત આલણ

મગધ દેશના આલણુકુંડ નામક ગ્રામમાં ઋષભદેવ નામક આલણું હતો. તેને દેવાનંદા નામે સ્ત્રી હતી. તેની કુક્ષિમાં ભગવાન મહાવીર દેવ ઉત્પન્ન થયા. હરિણગમેષિ દેવે વર્તમાન ચોવિસીના અંતિમ તીર્થિકરને લિક્ષુક કુળમાં ઉત્પન્ન થયેલા જાણી, પ્રલુના ગર્ભનું સાહરણ કર્યું. ૮૨ દિવસ સુધી દેવાનંદાના ગર્ભસ્થાનમાં રહેલા મહાવીરના જીવને તે દેવે ક્ષત્રિયકુંડ નગરના સિદ્ધાર્થ રાજની ત્રિશલા રાણીની કુક્ષિમાં મૂક્યો, અને ત્રિશલાના ગર્ભને દેવાનંદાની કુક્ષિમાં મૂક્યો. આ સાહરણમાં પૂર્વ ઋણાતુંધનો પણ ચોગ હતો એમ અંથકારે ઉદાહરણ સહિત વર્ણવેલું છે.

કેટલાક વર્ષોં પછી ભગવાન મહાવીરે જ્યારે દીક્ષા લીધી, અને તેઓ દેશના દેતા થકા ગ્રામાનુગ્રામ વિહરતા હતા, તે સમયે ઋષભદેવ અને દેવાનંદા ભગવાનના દર્શને ગયા. ત્યાં મહાવીરને દેખી દેવાનંદાનાં ગાત્રા પુત્રગ્રેમથી વિકસિત થઈ આવ્યાં. આ વખતે પ્રલુબે જ્ઞાનઅણે પોતાના તેઓની સાથેના ભાતાપિતા તરીકેના પૂર્વ સંબંધનું વર્ણન કર્યું. આ સાંભળી બંનેને અત્યંત આનંદ થયો. પ્રલુબો ઉપદેશ સાંભળી ઋષભદેવે દેવાનંદાની સાથે દીક્ષા ગ્રહણ કરી અને કૈવલ્યજ્ઞાન પામી તે મોક્ષમાં ગયા.

૪૭ ઋષભદેવ

અયોધ્યા નગરીમાં નાભિરાજની મઝેવી નામક રાણીની કુક્ષિથી ભગવાન ઋષભદેવનો ચૈત્ર વદિ આહે જ્યન્મ થયો. નાભિ રાજ ઉ મા કુલકર હતા. તે વખતે યુગલીયા યુગ પ્રવર્ત્તતો હતો, અને સ્ત્રીઓ એક જોડકાં (પુત્ર-પુત્રી) નો પ્રસવ કરતી; જેઓ આગળ જતાં પરસ્પર લગ્ન કરતાં. ઋષભદેવની સાથે સુમંગળા નામક પુત્રીનો જ્યન્મ થયો હતો. એજ અરસામાં એક ખીજું યુગલ જ્યન્મથું હતું, તેમાંથી નરનું મૃત્યુ થતાં ‘સુનંદા’ નામની બાળિકા અચેલી. લ. ઋષભદેવ યુવાવરસ્થામાં પ્રવેશતા, સુમંગળા અને સુનંદા સાથે લગ્ન કર્યું. સુમંગળાથી તેમને ‘લરત અને આહી’ જોડલે અવતર્યાં અને સુનંદાથી ‘બાઢુઅળ અને સુંદરી’ અવતર્યાં. આ ઉપરાંત સુમંગળાને ખીજાં ૪૮ જોડલાં એટલે ૬૮ પુત્ર થયા. તે વખતે કલ્યાણનો પ્રવાહ એછો થવા લાગ્યો. અને યુગલીઓએ માંહોમાંહે લડવા લાગ્યા. આથી સધળાએ મળીને નાભિ રાજની આજાથી ઋષભદેવને પોતાના રાજ તરીકે સ્થાપ્યા. દેવોએ સિંહાસન રચ્યો પ્રભુનો રાજ્યાલિષેક કર્યો. કુષ્ઠેરે ખાર ચોજન લાંબી અને નવ ચોજન પહોળા એવી વિનીતા નગરી બનાવી અને તેનું અયોધ્યા એવું નામ આપ્યું. ઋષભદેવ રાજપણે ત્યાં રહેવા લાગ્યા. રાજ્યની રક્ષા અર્થે ભંતીઓ, રક્ષકો વગેરે નીભ્યા અને નીતિ નિયમો ધર્યા. આ વખતે કલ્યાણનો નાશ થવાથી લોકો કંદમૂળ, ફૂલફળાદિ અને કાચું ધાન્ય ખાતા. કાચા ધાન્યથી લોકોને અળર્હ થતાં પ્રભુએ તે રાંધીને ખાવાનો વિધિ બતાવ્યો, આથી લોકો પ્રસન્ન થયા. એ રીતે પ્રભુએ અસિ, મસી અને કૃષિ એ ત્રિવિદ્યાનો પ્રચાર કર્યો. સ્ત્રીઓને ૬૪ અને પુરુષોને ૭૨ કળાઓ શાખવી. આહીને જમણા હાથ વડે અદાર લીપીઓ બતાવી અને સુંદરીને ડાચા હાથથી ગણિત પતાવ્યું. એ રીતે જગત પર ઉપકાર કરી શ્રી ઋષભદેવે ત્રેસઠ લાખ પૂર્વ સુધી રાજ્ય કર્યું.

એકવાર શ્રી ઋપલહેવ ઉદ્ઘાનમાં આવ્યા, ત્યાં વસંતऋતુમાં વિકસેલાં પુષ્પો ચુંટીને આખરણું બનાવતાં લોકોને જોઈ, વિચારમનું થતાં તેમને પૂર્વી સમરણું થતાંની સાથે અવધિજ્ઞાન થયું, અને તેમાં તેમણે પૂર્વલખે અનુતરવિમાનમાં લોગવેલું સુખ જોયું. તેમને સંસાર પર તિરસ્કાર આવ્યો અને ત્યાગના અલિલાષે મહેલમાં આવી વરસીદાન આપવું શરૂ કર્યું. સમય થતાં પોતાના પુત્ર ભરતને રાજ્યાસને સ્થાપી તેઓ ચૈત્ર વદ્દિ ૮ મે દીક્ષિત બન્યા. સાધુને ક્રોણ આહાર ખપે એનું જ્ઞાન લોકોને ન હોવાથી ઋપલહેવને બાર ભાસ સુધી લિક્ષા મળી નહિ. પ્રભુની સાથે કર્યા, મહાકર્ય આદિ ચાર હજાર રાજાઓએ દીક્ષા લીધી હતી, તેઓ આ પરિસહ સહન ન કરી શકવાથી છુટા પડી વનમાં ચાલ્યા ગયા અને કંદમૂળ ફૂલ-ઇળાદિનો આહાર કરવા લાગ્યા. એક વર્ષને અંતે હરિતના-પુરમાં બાહુભળના પુત્ર સોમપ્રભ રાજના પુત્ર શ્રીયાંસકુમારે વૈશાક શુદ્ધ ઉ ના રોજ શેરડીના રસના ૧૦૮ ધડાઓની લિક્ષા આપી, પ્રભુને પારણું કરસયું.

દીક્ષા લીધા પછી એક હજાર વર્ષે પુરિમતાલ નગરમાં ફાગળ વદ્દિ ૧૧ ના રોજ પ્રભુને કૈવલ્યજ્ઞાન થયું.

તેમના સંધ્યા પરિવારમાં પુંડરિક વગેરે ૮૪ ગણુધરો, ૮૪૦૦૦ સાધુઓ, ધ્યાલી આદિ ઉ લાખ સાધ્વીઓ, ભરતાદિ ઉ લાખ ૫૦ હજાર આવડો અને સુંદરી આદિ ૫ લાખ ૫૪ હજાર આવિકાઓ હતા.

શ્રી ઋપલહેવે એક લાખ પૂર્વી સુધી દીક્ષા પાળી, ૮૩ લાખ પૂર્વી સંસારમાં રહ્યા, ૬ દિવસનું અનશન કર્યું અને મહા વદ્દિ ૧૩ ના હિવસે મોક્ષ પધાર્યો, તેજ વખતે બીજા ૧૦ હજાર મુનિ મોક્ષ ગયા.

૪૮ નાનાસિદ્ધાસ

રાજગૃહિ નગરીની લદ્રા નામક એક સાર્વવાહિનીના તે પુત્ર હતા; તર સ્ત્રોએ પરણ્યા હતા. એકવાર તેઓ લગવાન મહાવીરની દેશના સાંભળવા ગયા, ત્યાં તેમને વૈરાગ્ય થયો, અને માતા પિતા સ્ત્રી આદિકની રણ લઈ દીક્ષિત થયા. તેમનો દીક્ષા ઉત્સવ શ્રેણિક મહારાજાએ કર્યો. ધણ્યા વર્ષ સુધી તેમણે ચારિત્ર પાલયું, દુષ્કર તપ કર્યો, અને અંતિમ સમયે એક માસનું અનશન કરી તેઓ મૃત્યુ પામી. સર્વાર્થ સિદ્ધ વિમાનમાં ઉત્પન્ન થયા. ત્યાંથી તેઓ મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈ મોક્ષમાં જશે.

૪૮ અંજુ

ઇદ્રપુર નામનું નગર, ઇદ્રદત્ત રાજ, ત્યાં પુઢવીશ્રી નામની એક વેશ્યા રહેતો હતો. તેણે ચૂણ્યાદિના પ્રયોગથી રાજ, પ્રધાન, શેડ સેનાપતિ, પુરોહિત આદિ ધણ્યાને વશ કર્યા હતા. અને તે મનુષ્ય સંખ્યાના ભોગ ભોગવતો હતી. પાંત્રીસસો વર્ષ સુધી આ જાર કર્મ સેવીને તે ભરણ પામી. અને ભરીને તે છુટી નરકમાં ઉત્પન્ન થઈ. ત્યાંથી નીકળી વર્ધમાનપુર નગરમાં ધનદેવ નામના શાહુકારને ત્યાં પુત્રીપણે અવતરી. નામ અંજુ. ઇપ્માં તે અધિકાધિક સુંદર હતી. એકવાર રાજાએ હેઠે જોઈ, માણસો દ્વારા માણું કર્યું. શેડ કણુલ થયો, વિવાહ થયા અને સુખ ભોગવવા લાગ્યા. એકવાર અંજુને ગુલ્ફસ્થાનમાં શરૂ રોગ પેદા થયો. ધણ્યી ધણ્યી દ્વારાઓ કરી, પરંતુ આરામ થયો નહિ. અંજુ મહા વેદના પામતી, આકંદ કરતી, વિલાપ કરતી, દુઃખથી ક્ષીણ થતી જતી હતી. પૂર્વકર્મના ઉદ્યથી મહાકષ્ટ પામી નેવું વર્ષનું આયુષ્ય ભોગવી તે ભરણ પામી અને પહેલી નરકમાં ગઈ. ત્યાંથી નીકળી અનંત સંસારના ફેરા કરતી મનુષ્ય જન્મ પામીને મહાવિદેહમાં તે સિદ્ધ થશે.

૫૦ અંજના

પૂર્વે મહેન્દ્રપુર નામનું નગર હતું. ત્યાં મહેન્દ્ર નામે રાજ રાજ્ય કરતો. તેને સો પુત્ર અને ૧ પુત્રી હતી, તેનું નામ અંજના. તે ઇપ ગુણમાં સર્વોત્તમ હતી. યૌવનાવરસ્થા પામતાં, રાજને તેણીના લગ્ન આટે ચિંતા થઈ. એકવાર કંચેરીમાં તે પ્રસંગ ઉપસ્થિત થતાં પ્રધાને કહ્યું: મહારાજા, અંજના કુમારીને માટે પતિની શોધ કરાવતાં એ જ ઉત્તમો કુમારો જેવામાં આવ્યા છે. તેમાંના એક તો હિરણ્યાળ રાજના પુત્ર વિદુતપ્રભ અને ખીજ પ્રલહાદ રાજના પુત્ર પવનજય. પરન્તુ વિદુતપ્રભ સંબંધી સંભળાય છે કે તે ૧૮ વર્ષની ઉંમરે તપ કરવા જંગલમાં ચાલ્યા જશે અને ૨૬ મા વર્ષે મોક્ષ જશે, જ્યારે પવનજય દીર્ઘાયુષી છે. આ સાંલળી રાજએ દીર્ઘાયુષી પવનજયને પોતાની કન્યા આપવાનો નિરધાર કર્યો. એજ અરસામાં પવનજયના પિતા રતનપુરીથી ફરતા ફરતા મહેન્દ્રપુરમાં આવી ચડવાથી મહેન્દ્ર રાજએ તેનો સત્કાર કરી અંજનાના વિવાહની વાત કરી. પ્રલહાદ રાજએ આ કહેણ સ્વીકાર્ય અને લગ્નનો દિવસ નક્કી કરી ત્યાંથી વિદ્યાય થયા.

નિશ્ચિત સમયે પ્રલહાદ રાજ અતુરંગી સેના સાથે પવનજયને પરણાવવા વાજતે ગાજતે મહેન્દ્રપુરમાં આવ્યા અને શહેર બહાર સરોવર પર તંબુ નાખીને મુકામ કર્યો.

લગ્નને ત્રણ દિવસની વાર હતી. એક રાત્રે સુતા સુતા પવનજયને પોતાની ભાવિ પત્નીને જેવાનો વિચાર થયો. આ વાત તેણે પોતાના ભિત્ર પ્રહસિતને કરી. બંને જણા તેજ વખતે છાવણીમાંથી ગુપ્યુપ નીકળી અંજનાના મહેલે આવ્યા, તે વખતે સખીઓથી પરિવર્તેલી અંજના સખીઓ સાથે વાર્તાવિનોદ કરી રહી હતી. ભાવિ પતિઓની વાત નીકળતા એક સખીએ અંજનાને પવનજય જેવા પતિ મળ્યા બદલ પ્રશંસા કરીને, વિદુતપ્રભની કેમ પસંદગી ન થઈ, તેનું વર્ણન કર્યું. આ સાંલળી ધર્મનિષ્ઠ અંજનાએ વિદુ-

ત્રયના ૧૮ મા વર્ષનું ચારિત્ર અને ૨૬ મા વર્ષે મોક્ષગમનથી આશ્રમ્ય પામી તેને ધન્યવાદ આપ્યો. આ વાતચિત્ત પવનજ્યે ગુમ રીતે સાંભળી, પોતાની પતિને પોતાના બદલે ખીજની પ્રશંસા કરતી સાંભળી, તેને અંજના પર તિરસ્કાર થયો, અને લમ્બ કર્યા આદ તેના સહવાસથી અલગ રહેવાનો પવનજ્યે નિશ્ચય કર્યો.

નિયત સમયે બંનેના લમ્બ થઈ ગયા. નવદંપતી અને પ્રલહાદ રાજ ચતુરંગી સેના સાથે રતનપુરીમાં પાછા ઈર્યા. લમ્બસુખનો લાંબાવો કેવા છંચિતી અંજના તે રાત્રિયે પતિ આગમનની રાહ જેતી બેડી, પરન્તુ પવનજ્યે તેણીના મહેલમાં પ્રવેશ કર્યો નહિ. આમ એક બે ત્રણ ચાર એમ દિવસો વિતતા ગયા, પણ પવનજ્યે અંજનાના મહેલમાં દિવસે કે રાત્રિયે પગ સરખોયે ન મુક્યો. અંજના ચિંતા-મય હતી. તેણી પવનજ્યના રોષનું કારણું જાણુતી ન હતી.

એકવાર અંજનાના પિતાએ વસ્ત્ર, ધરેણું, મેવો મિહાઈ આદિ વસ્તુઓ મોકલી. અંજનાએ તે વસ્તુઓ દાસી દારા પવનજ્યને મોકલાવી; પરન્તુ પવનજ્યે તે જક્ષણે મેવો—મિહાઈ ગાનાર ગવૈયાને આપી દીધી, ધરેણું ચંડાળને આપ્યાં અને વસ્ત્રના ચૂરેચૂરા કરી નાખ્યા. આ જોઈ દાસી અંજના પાસે આવી અને બધી વાત વિદિત કરી. અંજનાના શોકનો પાર ન રહ્યો. પોતે પોતાના લાગ્યને દોષ દેવા લાગી અને પતિદેવનું હંમેશ શુલ ચિંત્વન કરતી ધર્મધ્યાનમાં વષત વ્યતિત કરવા લાગી.

પતિ વિયોગમાં આ રીતે આર વર્ષના વહાણા વાઈ ગયા. એકવાર લંકાના રાજ રાવણુનો દૂત રતનપુરીની રાજસભામાં આવ્યો અને પ્રલહાદ રાજને કહ્યું, કે દુષ્ટ યુદ્ધ વરણ અમારા રાજને તાણે ન થતાં, યુદ્ધ કરવા માગે છે, તો આપ લશકર લઈ વેળાસર મદદે પધારો. પ્રલહાદ રાજએ કયુલ કર્યું અને લશકર એકદું કરવા માંડયું.

આ વાતની પવનજયને ખર પડતાં પોતે યુદ્ધમાં જવા તૈયાર થયો. ગ્રલહાદે તેને યુદ્ધમાં ન જવા સમજાવ્યો, પરન્તુ પવનજયે તે ન માનતા, અતિ આગ્રહે યુદ્ધમાં જવાની અનુમતિ મેળવી. આ વાતની આપા ગામમાં ખર પડી. પવનજયે લશકરી પોશાક પહેરી માતા પિતા વગેરેની રજ લીધી, પણ તે અંજનાના દ્વારે આવ્યો નહિ. અંજનાને આથી ધાણું હુંઘ થયું. યુદ્ધ વિજયનો પતિને આશીર્વાદ આપવાનો નિરધાર કરી, શુક્ર આપવા માટે અંજના, એક સુવર્ણના કંચોળામાં દર્ઢી ભરીને રાજ્યદ્વાર પાસે આવી, પવનજયના માર્ગની પ્રતિક્ષા કરવા લાગી. બહાર નીકળતા પવનજયની તેના પર દાઢિ પડી, કે તરત જ તેનો મિનાજ કાયુમાં ન રહ્યો. તેણે વિચાર્યું કે હજુએ અંજના મારો કેડો મૂકૃતી નથી, અને આવા યુદ્ધગમન વખતે પણ તે મને અપશુક્રન આપવા આવી છે! એમ વિચારતા જ, તેણે અંજના પર પગપ્રહાર કર્યો, અને ત્યાંથી ચાલ્યો ગયો. અંજના આંસુ સારતી મહેલમાં પાછી દરી અને પોતાના કર્મને દોષ દેતી પતિનું કુશળ છર્ચિછવા લાગી.

પવનજયે રસ્તે ચાલતા રાત્રિ થવાથી જંગલમાં એક સ્થળે પડાવ નાખ્યો. ચંદ્રિકા પ્રકાશી રહી હતી, તેવામાં નજીકના એક સરોવરમાં પવનજયે ચકવાક પક્ષીનું એક યુગલ ચાંચમાં ચાંચ ભીલાવીને પ્રેમકીડા કરતું જોયું. તેવામાં ચકવાક પક્ષી રાત્રિ થઈ જવાની ખર પડતાં જ ચકવાકીથી છૂંદું પડી ઉડી ગયું. સ્નેહ-વિદોગી ચકવાકી વિરહ વ્યથાએ ઝૂરવા લાગી. આ દસ્ય જોતાં જ તેને વિચાર થયો કે અહો, એક પક્ષીની જાત પણ પોતાના પ્રેમ-પાત્રના વિદોગે કેટલી ઝૂરણા કરે છે, જ્યારે મેં બારબાર વર્ષથી મહારી પ્રિયતમાને ત્યજી છે, ત્યારે તેણીને કેટલી વેદના થતી હશે! આ વાત તેણે પોતાના મિત્રને કહી. મિત્રે અંજનાના શુલ શુક્રની, તેની પવિત્રતાની, અને તેની પતિ પ્રત્યેની કલ્યાણ ભાવનાની વાત કરી. આથી પવનજયને અંજનાને મળવાનો વિચાર થયો.

તેજ વખતે અંને ભિત્રો ધોડેસ્વાર થઈ છાવણીમાંથી બહાર નીકળ્યા!, અને પૂરવેગે અંજનાના મહેસુ આવી પહોંચ્યા. અંજનાના આશ્ર્યનો પાર ન રહ્યો. ઉલય દંપતી મળ્યા. અંજનાએ પવનજયને પુનરાગમનતું ડારણ પૂછ્યું. પવનજયે બધી વિતક કણી સંભળાવી. અંજનાનો લાગ્યલાનું પ્રકાશયો, કેટલોક વખત અંનેએ પ્રેમાનુભવમાં ગાળી વહેલી સવાર થતાં પવનજય છાવણીમાં જઈ પહોંચ્યો. તે વખતે પ્રેમની નિશાની રૂપ તેણે અંજનાને પોતાની વીઠી આપી.

૭-૭ મહિના યુદ્ધમાં વીતી ગયા છે, પવનજય હજુ પાછો ઈરો નથી. જ્યારે બીજુ તરફ અંજનાને પતિ સમાગમના દિવસથી ૩૮ ગંભીર રહ્યો છે. એકવાર તેની સાસુ કેતુમતી અંજનાની સ્થિતિ નિહાળવા તેણીના મહેવમાં આવી ચડી, તે વખતે અંજનાનું પ્રાયુક્તિક થયેલું વદન ક્રમ અને ઉદર ભાગ જોઈ સાસુના કોધનો પાર ન રહ્યો. તેણે અંજનાને વ્યલિચારિણી હોવાનો ઉપાલંબ આપો ધણ્ણા કંડુ શખ્દો કલ્યા. અંજનાએ વિનાન્દ્ર ભાવે પતિ આગમનતી વાત કરીને વીઠી બતાવી, પરન્તુ કેતુમતીએ આ વાત ન માનતાં અંજણા પર કુલદ્યાપણાનો આરોપ મૂક્યો. તેણે આ વાત પ્રલાદ રાજને કહી, અંજનાને પરદેશ મોકલી દેવાનો આદેશ કર્યો. આંખમાં અશ્રુ સાથે અંજનાએ પવનજય આવતા સુધી પોતાને રાજ્યમાં રાખવાની વિનિતિ કરી, પણ તે વ્યર્થ ગઈ.

કેતુમતીના હુકમનો અમલ થયો. અંજનાને કણાં વસ્ત્રો પહેરાવી, કણાં રધમાં બેસાડી તેના પિથરના રસ્તે મોકલી દેવામાં આવી. જંગલની મધ્યમાં આવતા સારથીએ રથ ઉભો રાખ્યો અને રાજના હુકમ અનુસાર અંજનાને જંગલમાં ઉત્તરી જત્તાનું કહ્યું; અને સાથે સાથે તેના પિથર મહેન્દ્રગઢનો રસ્તો બતાવ્યો. ભાગ્યને દ્વારા દેતી હિંમત ધરતી અંજના એકલી, અદુલી વનની મધ્યમાં ઉત્તરી પડી. સારથી રથ કર્ય પાછો કર્યો.

અહિ અંજનાને એક મુનિનાં દર્શન થયાં. તે આનંદ પામી. મુનિ તેનો ભાગ્ય રવિ થોડા વખતમાં પ્રકાશશે એમ કહી હિંમત આપી વિદ્યાય થયા. સાથે વસંતતિલકા દાસી હતી, તેણે પિથરમાં જવાનું અંજનાને કહ્યું, પણ એવી કલંકિત દશામાં પિથરનો આશ્રય દેવાનું અંજનાને ચોણ્ય ન લાગ્યું. પણ વસંતતિલકાના આગ્રહથી તેઓ કષ્ટ સહન કરતાં કરતાં મહેન્દ્રગઢમાં આવ્યા અને દ્વાર રક્ષક મારદૂત પોતાના આગમનના સમાચાર કહેવડાવ્યા. કાળાં વસ્ત્ર પરિધાન કરીને આવેલી અંજનાના સમાચાર સાંભળી મહેન્દ્ર રાજને અંજના વ્યલિયારિણી હોવાની શાંકા આવી. તે સાથે રાણીએ પણ અંજનાના હુલ્લાંયે સાક્ષી પૂરી કે એમજ હશે, નહિ તો આજે ખારખાર વર્ષથી પવનજય તેનો ત્યાગ શા માટે કરે? પિતા અને માતાએ એકની એક પુત્રી અંજનાને આશ્રય ન આપ્યો. તેમણે કહાંયું કે ‘એવી કલંકિત પુત્રીનું મદારે કામ નથી.’ અંજના એદ પામી ત્યાંથી ભાઈ બોજાઈએને દ્વારે ગઈ, ત્યાં પણ તેણીને ક્રાઈએ સંધરી નહિ, અંતે તે દાસી સાથે ભાગ્યને દોષ દેતી હુનઃ જંગલમાં આવી, અને એક ગુશાનો આશ્રય લઈ ધર્મ ધ્યાનમાં સમય વીતાવવા લાગી. અંજનાએ અહિ એક તેજસ્વી પુત્ર રતનનો જન્મ આપ્યો. થોડાક વખત બાદ પ્રતિસૂર્ય નામનો હનુમંડ નગરનો રાજ, જે અંજનાનો મામો થતો હતો, તે કરતો કરતો અહિ આવી ચડ્યો. તેણે અંજનાને ઓળખ્યી, અને પોતાને ત્યાં લઈ ગયો. કુમાર હનુમંડમાં ઉછ્યો એટલે તેનું હનુમાન એવું નામ પાડ્યું.

અરાખર ખાર માસ યુદ્ધ ચાલ્યું તેમાં પવનજયે વરણુને પરાજય આપ્યો. ધેર આવી અંજનાને ન દેખતાં તેણે માતાપિતાને પૂછ્યું. અંજનાના હુદ્ધ સમાચાર મળતાં તેના શોકનો પાર ન રહ્યો. પોતાના પૂર્વાગમનની વાત કહી, માતા પિતાને ઠપકો આપ્યો અને અંજના ન મળે ત્યાં સુધી તેણે ખાવા પીવાની પ્રતિજ્ઞા કરી. ચારે

તરફ અંજનાની તપાસાર્થી માણુસો મોકલી દીધા. આખરે હનુરહુન નગરમાંથી પતો ભયો. વાજતે ગાજતે અંજનાને રતનપુરીમાં લાવવામાં આવી. સાસુ સસરાએ અંજનાની મારી મારી, પરન્તુ પોતાના કર્મને જ દોષ આપી અંજનાએ પોતાનો વિવેક દર્શાવ્યો. કેટલાક સમય પછી પ્રલહાદના મૃત્યુ પછી, પવનજય રાજ થયા, અને બંનેએ અતૂલ રાજ્ય સુખ લોગવ્યું, પણ છેવટે તેમાં ન લોભાતા બંનેએ દીક્ષા ગ્રહણ કરી અને દેવલોકમાં ગયા.

નોટ—અંજનાએ તેર વર્ષ સુધી પતિ વિયોગ સહન કરી દુઃખ લોગવ્યું તે સંખંધી અંથકાર વર્ણન કરતાં કહે છે, કે પૂર્વ ભવે એ અંજનાને જૈન ધર્મ પર દોષ હતો. તેથી તેણે એકવાર એક જૈન મુનીનો ઓધો ચોરી લીધો; જેથી મુનિ આઢાર પાણી ભાડે ક્યાર્ધ જઈ શક્યા નહિ. આ ઓધો તેણીએ તેર ધડી સુધી પોતાની પાસે રાખી મૂક્યો, તેના ઇલ સ્વરૂપ તેણીને તેર વર્ષનું વિયોગ દુઃખ અનુભવવું પડ્યું.

૫૧ અંધક વિષ્ણુ

એ યદુકુળના શૌર્ય રાજના પુત્ર હતા. શૌર્યપુર નગર તેમની રાજ્યાની હતી. તેમને સુલગ્રા રાણીથી સમુદ્રવિજય, અક્ષોલ, વસુ-દૈવ આદિ દશ પુત્રો થયા. તે દશ દશાર્થ કહેવાયા. તેમણે સમુદ્રવિજયને રાજ્ય સોંપી સુપ્રતિષ્ઠ નામના મુનિ પાસે દીક્ષા લીધી અને મોકાભાં ગયા.

૫૨ અંધડ પરિત્રાજક

અંધડ નામનો એક ત્રિદંડી તાપસ હતો. જેનાં વખ્ત લાલ હતા, તથા જેના હાથમાં કુમંડલ રહી ગયું હતું, અને જેણે તપો-બળથી અનેક વિદ્યા તથા લભિધયો મેળવી હતી, તે અંધડ પરિ-

માન્યક એક વાર પ્રભુ મહાવીરની દેશનામાં ગયો. દેશના સાંભળ્યા પછી તેણે લગવાનને કહ્યું:—મહાત્મન, હું સર્વ સ્થળે હરું છું. અને હવે અહિંથી રાજગૃહ નગરમાં જવા ધર્યિછું છું, માટે આપને જો કાંઈ કાર્ય હોય તો આદેશ કરો. જવાયમાં પ્રભુએ કહ્યું કે રાજગૃહ નગરમાં નાગ રથિકની સ્ત્રી સુલસા નામની આવિકા છે. તેને મહારા ધર્મ લાલ કહેનો. “બહુ સારં” એમ કહીને તે અંખડ પ્રભુને વંદન કરીને ચાલી નીકલ્યો અને રાજગૃહમાં આવ્યો. ત્યાં આવી તેણે વિચાર્યું કે જેણીના સહૃદાયથી રંજિત થઈને લગવાન પણ ધર્મ લાલ કહેવડાવે છે તે સ્ત્રી કેવી હશે? માટે મારે જેણીની પરીક્ષા કરવી જોઈએ. એમ વિચારી તે અંખડે પ્રથમ સત્પાત્ર યતિનું રૂપ લઈને સુલસા પાસે સચિત વસ્તુ આદિની યાચના કરી, પણ તેમાં તે ચલિત ન થઈ. પછી અંખડે અલ્લાનું ઇપ ધારણ કર્યું અને સુલસાના દ્વારે આવી કહ્યું કે હું અલ્લા છું. ’ ધરના ખીજ માણસો તેને વંદન કરવા લાગ્યા, પણ સુલસાએ તેને નમસ્કાર ન કર્યો. વળો ખીજે દિવસે તેણે વિષણુનું અને ત્રીજે દિવસે શિવનું ઇપ ધારણ કરી દર્શનાર્થે આવવા સુલસાને કહેવડાયું, પરન્તુ જિનેશ્વરમાં શ્રદ્ધા ધરાવતી સુલસા ભિથ્યા વંદનાર્થે ન ગઈ. ત્યારે ચોથે દિવસે તે અંખડે સાક્ષાત જિનેશ્વર લગવાનનું ઇપ ધરીને રત્નસિંહાસન બનાવ્યું અને પોતે પચોસમે તીર્થીકર છે એમ દોકાને કહીને અંખડે દર્શનાર્થે આવવા કહેવડાયું, છતાં પણ સુલસા તેના દર્શને ન ગઈ. આથી અંખડને ખાત્રી થઈ કે ખરેખર પ્રભુ મહાવીરે સલ્લામાં સુલસાની જે પ્રશંસા કરી હતી, તે બરોઅર છે. આથી અંખડ આવકનો વેષ લઈ સુલસાને ઘેર ગયો. પોતાનો ધર્મ બન્ધુ આવેલો જાણીને સુલસાએ તેનો સત્કાર કર્યો. આ પછી અંખડે કહ્યું:—બહેન, લગવાન મહાવીરે તમને ધર્મલાલ કહ્યો છે. આ સાંભળતાં જ સુલસા અત્યંત આનંદ પામી, અને કહ્યું:—પ્રભુ સુખશાતામાં છે? અંખડે કહ્યું: હા, હું તેમનો ધર્મોપદેશ સાંભળાને

આવ્યો છું, આ સાંભળી સુલસાએ પ્રભુને આવયુક્ત વંદન કર્યું.
અંખડે અહ્મા, વિષ્ણુ, શિવ વગેરેને વંદન નહિ કરવાનું કારણ
પૂછ્યું. સુલસાએ અતીથને નહિં પૂજવાનો પોતાનો નિર્ણય વિદ્ધિ
કર્યો. સુલસાના જીબ અને દર્શનથી પ્રસન્ન થઈ અંખડે
વિદ્યાય લીધી.

૫૭ અંખડ સન્યાસી.

અંખડ નામનો એક સન્યાસી હતો. તે છું છકુના પારણા
ઉપરાંત ઘણી તપશ્ચર્યા કરતો. સન્યાસીપણામાં પણ તે આવકના
બાર વ્રતતું સુંદર રીતે પાલન કરતો. પોતાના તપ બણે તેને જીવની
શક્તિઓ વૈકેયી લખિય, અને અવધિજીન લખિય ઉત્પન્ન
થઈ હતી. તે સો ઘરનો આહાર પચાવી શકતો તેમજ સર્વથા
અલયર્ય પણ પાળતો. આવા દુષ્કર ચારિત્રથી આકૃષ્ણી તેને ૭૦૦
શિષ્ય સન્યાસીઓ થયા હતા. એકવાર તે અંખડ પોતાના ૭૦૦
શિષ્યો સાથે ગંગાનદીના કંઠાપરના કંપિલપુર નગરથી પુરિમતાલ
નગરે જવા નીકળ્યો. તે વખતે ગ્રીષ્મઋતુનો સમય હતો. સખ્ત તાપ
પડતો હતો. ચાલતા ચાલતા સધળા મહાન અટવીમાં જઈ ચડ્યા.
થાડીક અટવી ઓળંગી હશે, તેવામાં તેમની પાસેનું બધું પાણી
ખલાસ થઈ ગયું અને તૃપ્તાથી તેમનો કંડ સ્ફુર્કવા લાગ્યો. તાપસ
ધર્મ એવો હતો કે તેઓ સચિત પાણી વાપરી શકતા, પણ કોઈની
રજ વગર તે લઈ શકતા નહિ. નદીમાંથી પાણી લેવાની આજા
માટે તેઓ રસ્તામાં કોઈ આવતા જતા માણુસની પ્રતિક્ષા કરવા
લાગ્યા અને વિચારવા લાગ્યા કે અહિં ને કોઈ માણુસ આવી
યે અને નદીમાંનું પાણી લેવાની આજા આપે તો તે લઈને અમે
અમારી તૃપ્તા છીપાવીએ. પરન્તુ કોઈપણ માણુસ ત્યાં આવ્યું નહિ.
સન્યાસીઓ તૃપ્તાથી અકળાઈ ગયા અને હમણાજ પ્રાણ નશે એવી
સ્થિતિ થઈ પડી. આથી તેઓ સધળાએ નદીની રેતીમાં બિજાનું

માર્ગર્થિં અને અનસન કરીને સૂતા. ત્યારથાદ તેમણે તે કાળે વિચરતા આરિહંત હોવા, પ્રભુ ભહાવીર અને અંબડ પરિવાજકને વંદન નમસ્કાર કરીને, પૂર્વે આણાતિપાતાદિ જે બતો અભણ કર્યા હતા, તેની આલોચના લીધી, ચોડીવારે તે બધાના પ્રાણ નીકળા ગયા. અને તેઓ પાંચમા અહિદેવકોઝમાં દેવ થયા. અંબડ ખણું પાંચમા દેવસ્થોકમાં ગયો. અને ત્યાંથી ભહાવિહેઠમાં જન્મ લઈ તેજ ભવમાં મોક્ષમાં જશે.

૫૪ કપીલમુનિ.

કૌશાંખી નગરી હતી, કાશ્યપ નામનો એક શાસ્ત્રી રહેતો હતો. તેને શ્રીહેવી નામે સ્ત્રી હતી, તેનાથી તેને એક પુત્ર થયો. નામ પાડ્યું કપીલ. કાશ્યપ રાજ્યનો શાસ્ત્રી અને રાજગોર, તેથી રાજ તરફથી તેને વેતન ભળે અને કુદુંબનું ગુજરાન ચલાવે. અનુકુમે કપીલ યુવાન થયો. જ્યાં સુધી કાશ્યપ ગુજરાન ચલાવતો, ત્યાં સુધી કપીલે વિદ્યા અણુવા તરફ લક્ષ ન આપ્યું; પરિણામે તે અભણ રહ્યો. કાળાન્તરે કપીલનો પિતા કાશ્યપ ગુજરાન ગયો. અને કુદુંબ નિર્વાહની ઉપાધિ કપીલને માથે આવી. પરંતુ તે અભણ હોવાથી રાજએ ભીજો એક વિદ્યાન શાસ્ત્રી શોધી કાઢ્યો. કપીલના કુદુંબની સ્થિતિ હુઃઅદાયક થઈ પડી. એકવાર કપીલની ભાતા શ્રીહેવી બારણે ઉલ્લિ છે, તે વખતે રાજએ રાખેલ નવો શાસ્ત્રી નોકર ચાકરો સાથે સુંદર વસ્ત્રાલુપણેા પહેરી તે રસ્તેથી ચાલ્યો. જાય છે. શ્રીહેવી તેને દેખી નિરાશ થઈ અને એક ઉંડો નિઃશ્વાસ નાખી ચિંતા કરવા લાગી. કપીલે આતાને ચિંતાતું કારણ પૂછ્યું. ભાતાએ વાત કરી કે જ્યાં સુધી તહારા પિતા હતા, ત્યાં સુધી ઉપાધિ ન હતી; પણ તું તો રહ્યો અભણ; તહારા બદલે રાજએ ભીજન શાસ્ત્રીને રાખ્યા, તેમને દેખીને હું ચિંતા કરે છું. ભાટે તું જો વિદ્યાભ્યાસ કરે તો આપણું દારિદ્ર જાય; અને આપણે સુખ લોગવીયે. કપીલે કહ્યું, ભાતા, ત્યારે તમે

કહેં તો હું વિદ્યાભ્યાસ કરવા જાઓ; અહિના શાસ્ત્રી તો આપણા હરીક રહ્યા; એટલે તે વિદ્યા નહિ આપે. માટે તમે કહેં ત્યાં જાઓ. માતાએ તેને કાશ્યપના એક મિત્ર શાસ્ત્રી ધૃદદત્તને ત્યાં શ્રાવસ્તી નગરીમાં જવાનું કહ્યું. માતાની ગદ્દગદિત કંઠે રજ લઈ કપીલ શ્રાવસ્તી નગરી તરફ રવાને થયો અને ધૃદદત્તને મળ્યો. ધૃદદત્તે તેને એળાખીને વિદ્યાભ્યાસ કરાવવો શરૂ કર્યો. ધૃદદત્ત તેને એક વિધવા બાઈને ત્યાં જમવાની સગવડ કરી આપી. આ વિધવા યુવાન હતી. કપીલ પણ યુવાન હતો. વખત જતાં બંનેને ગ્રેમ બંધાયો. કપીલ વિદ્યાભ્યાસ છોડી આ વિધવાના ગ્રેમ-ઉપલોગમાં દિવસો વિતાવવા લાગ્યો. વિધવાની સ્થિતિ પણ સારી ન હતી અને અહિ પણ કપીલને માથે નિર્વાહ ચલાવવાનું આવ્યું. કપીલની ચિંતા પૈસા મેળવવા માટે વધતી ગઈ. એકવાર વિધવાએ તેને કહ્યું કે આ ગામના રાજ દાનેશ્વરી છે; અને વહેલી સવારમાં જે કોઈ રાજ્યરાખારમાં જઈને રાજને આશીર્વાદ આપે, તેને રાજ બે માસા (સેણ રતી) સેનું આપે છે. માટે તમે ત્યાં જવ. આ સાંભળી કપીલ રોજ સવારમાં વહેલો ઉડીને રાજ પાસે જાય; પરંતુ તેના પહેલાં કોઈ એ આવીને રાજને આશીર્વાદ આપ્યો જ હોય, તેથી નિરાશ થઈ કપીલ પાછો ઈરે. આમ આઠ દિવસ વીતી ગયા. એકવાર તેણે વિચાર કર્યો કે આજ તો બરાબર ચિંતા રાખીને ઉડું, અને રાજને પહેલો આશીર્વાદ આપું. એમ ધારો તે સમી સાંજમાં સૂર્ય ગયો. અર્ધ રાત્રી હતી; ચંદ્ર બરાબર ઝીલ્યો હતો, તે વખતે ચિંતામાં ને ચિંતામાં કપીલ ઉઠ્યો; અને આશીર્વાદ આપવા માટે રાજમહેલ તરફ દોડ્યો. તેવામાં પહેરેગીરાએ તેને દોડતો જોયો; ચોર ધારીને પકડ્યો. અને સવાર થતાં રાજ પાસે કેદી તરીકે તેને હાજર કર્યો. કપીલને તો એક કરતા બે, અને બે કરતાં ત્રણ ઉપાધિ થઈ. ધન લેવા જતાં બિચારો પકડાયો. તે અંસોસ કરવા લાગ્યો. જ્યારે રાજ પાસે તેને ઉલો કરવામાં આવ્યો, ત્યારે તેણે સધળી હકીકત રાજને કહી. રાજ પુશી

થયો અને દ્વા આવવાથી કપીલને ભાગે તે આપવા જણાયું. કપીલે કહ્યું. મહારાજા, અત્યારે હું ચિંતામાં છું, એટલે નિરાંતે વિચાર કરીને હું આપને કહું; રાજાએ અનુમોદન આપ્યું.

શું ભાગવું તેનો વિચાર કરવા કપીલ પાસેના એક બગીચામાં ગયો. તેણે વિચાર્યું કે એ ભાસા સોનાથી શું વળવાતું છે, લાવને પાંચ ભાસા ભાગું, પાંચથી શું વળવાતું છે. લાવને દશ ભાગું. પણ દશ કયાં સુધી ચાલશે ? સો ભાસા ભાગવા દેને, સો તો એકાદ વર્ષમાં ખરચાઈ જાય. પછી શું ? હજર ભાગું તો હીક, પણ હજરથી કંઈ પૈસાવાળા થવાય ? લાખ ભાગવા દેને, લક્ષાધિપતિ તો ધણાય છે. કોડ ભાગવા દેને, આમ વિચાર કરતાં કરતાં કપીલની તૃણણા તો વધવા લાગી. કોડ ભાગું તે કરતાં અર્ધું રાજ્ય ભાગું તો ! અર્ધા રાજ્યથી રાજનો સમોવડીઓ કહેવાઉં, ભાટે આપું રાજ્ય ભાગવા દેને, આમ વિચારતાં તે ચમક્યો, અને મન સાથે બોલ્યો :—અરે ! રાજાએ ભારા પર કૃપા કરી ભાગવાનું કહ્યું, ત્યારે રે જીવ, રાજનું જ રાજ્ય પડાવી કેવાની ઈચ્છા થઈ ? ત્યાંથી પાછો ઈરો. અર્ધું રાજ્ય પણ નહિ જોઈએ, કોડ નહિ. લાખ નહિ, શું ત્યારે હજર ? પણ એવી ઉપાધિ શાને ? શું ત્યારે સો ? સો પણ નહિ, દશ પણ નહિ, પાંચ પણ નહિ, ત્યારે બે, એ ભાસા સોનું કેવા હું શા ભાટે આવ્યો ? એક સ્વીને ખાતર, તે સ્વી કોણું ? હું કોણું ? રે જીવ, વિદ્યાભ્યાસ ભાટે આવતાં આટલી ઉપાધિ કેમ મેળવી ? કપીલની તૃણણા એઠી થતી ગઈ. તેના આત્મામાં સહવિચારો આવવા લાગ્યા. તરતજ તેણે કહ્યું કે ભારે કંઈ પણ નહિ જોઈએ, આ જગતમાં લોલ, ભાયા, માન, કોધ, રાગ, દ્વેષ એ જ ભયંકર શત્રુઓ છે તેનો જ મહારે નાશ કરવો !

એમ ચિંતવી રાજ પાસે ગયો અને કહ્યું : મહારાજ, મહારી

તુણણું બહુ વધી. હવે હું આપની પાસેથી એક દમડી પણ કેવા છુંછુંતો નથી, પણ કોલનું ભૂળ સંસાર છે તેનો જ હું ત્યાગ કરવા માગું છું. એમ કહી કપીલ ત્યાંથી ચાલ્યો ગયો. અને એક મુનિ પાસે જઈ તેણે દીક્ષા લીધી. સત્ત્વ તપ, જપ, ધ્યાન કરતાં છ મહિનામાં કપીલ મુનિને કેવળજ્ઞાન થયું. અને કપીલ કેવળી કહેવાયા.

એકવાર કપીલ મુનિ વિહાર કરતા હતા, રસ્તામાં બળભદ્ર વગેરે ૫૩૦ ચોરો મળ્યા. તે ચોરોએ કપીલને પકડ્યા અને સંગીત ગાવાનો હુકમ આપ્યો. કપીલ મુનિએ સમયસૂચકતા વાપરી, એવા તો બોધક અને વૈરાગ્યમય સંગીતો તીણા સુરથી શરૂ કર્યા કે ચોરો ત્યાંજ સ્થંભી ગયા અને તેમના જ્ઞાન અશ્વુંઓ ખુલ્લી ગયાં. આ બધા ચોરોને કપીલ મુનિએ દીક્ષા આપીને તાર્યા, આવા મહાન કાર્ય કરીને સર્વ દુઃખોનો અંત કરી કપીલ મુનિ મોદ્દું નગરીએ પધાર્યા.

પચ કુમળાવતી.

ઇદ્ધિકાર નગરના ઇદ્ધિકાર નામક રાજને કુમળાવતી નામે રાણી હતી. તે પણ નલિનીગુલ્મ વિમાનમાંથી ચ્યવીને આ કોકમાં અવતરી હતી અને ઇદ્ધિકાર રાજ સાથે લમ્બાંથીથી જોડાઈ હતી. એક પ્રસંગે રાજના ભૂગુ નામના પુરોહિતનું ધન દરભારમાં આવતું હેખ્ખી, તેને રાજ્યકર્તાઓની મોહદ્દશા અને સંસારની અસારતાનો વિચાર આવ્યો. સંસારથી તે ભય પામી. અને તરતજ તે રાજ પાસે આવી કહેવા લાગી. સ્વામિન, પાંજરામાં રહેલું પક્ષી નેમ ખુશી થાય નહિ, તેમ તમારા આ રાજ્યદ્દ્દ્દી પાંજરામાં રહી હું સુખ અનુભવી શકતી નથી; અર્થાત્ સંસારની આ મોહજનક જળમાંથી મૂક્ત થઈને હું ચારિત્ર કેવા છચ્છું છું. એમ કહી તેણે સંસારની અસારતાનું આખેહું સ્વરૂપ રાજને સમજાવ્યું. આથી રાજને પણ વૈરાગ્ય થયો.

ત્યારપણી કમળાવતી રાજ સાથે ચારિત્ર લઈને સંયમમાર્ગની આરાધના કરતી, ક્ષમક એણિભાં પ્રવેશી અને કૈવલ્યજ્ઞાન પામી, તેજ ભવમાં મોક્ષ ગઈ.

૫૬ કરકંડુ.

મગધહેશની ચંપાનગરીમાં દધિવાહન નામે રાજ રાજ્ય કરતો હતો. તે જૈન ધર્મી ચેડા રાજની પુત્રી પહુંમાવતીને પરણ્યો હતો. એકવાર પહુંમાવતીને ગર્ભકાળમાં રાજનો પોશાક પહેરી માથે છત ધરી ઉદ્ઘાનમાં કીડા કરવા જવાનો દોહદ થયો; પણ આ વાત તેનાથી રાજને કહી શકાય નહિ, તેથી ચિન્તામાં ને ચિન્તામાં તે સુક્રવા લાગી. એકવાર રાજએ રાણીનું ચિંતાતુર વદન અને શરીરની ક્ષીણુતા જોઈને ઉદાસીનતાનું કારણ પુછ્યું. રાણીએ વાત વિદ્ધિ કરી. રાજએ તેનો દોહદ પૂર્ણ કરવાનું વચ્ચે આપ્યું. રાજ રાણી બંને હાથી ઉપર બેસી ઉદ્ઘાનમાં કીડા કરવા નીકળ્યા. રસ્તે જતાં એકાએક આકાશ ચડી આવ્યું અને જોતજોતામાં ધોધમાર વરસાદ શરૂ થયો. ગાજવીજ, પવન અને વરસાદના તોશનથી હાથી ભર્સીએ ચડ્યો અને મહોન્ભરત બનીને નાડો. પુરવેગે હાથીને નાસ્તો જોઈ રાજરાણી ગલરાયાં. રાજએ પહુંમાવતીને કહ્યું: હાથી ભર્સીએ ચડ્યો છે અને તે કયાં જઈ. અટકશે તે કહી શકાય નહિ; માટે તમે આ સામે દેખાતા જાડ પાસેથી હાથી જાય, કે તરતજ તે જાડની ડાળો પકડી લેજો. હું પણ તેમ કરીશ. બંને કખુલ થયાં. હાથી જાડ નીચેથી પસાર થયો. કે તરતજ રાજએ તે જાડની ડાળો પકડી લીધી; પણ રાણી તે ડાળને પકડી શકી નહિ. હાથી રાણીને લઈ પુરવેગે દોડતો. ધણે ફૂર નીકળા ગયો. દધિવાહન રાજને આથી ધણ્યાજ શોક થયો. તે થોડીવારે જાડ પરથી નીચે ઉત્થો અને રાણીની દ્વિકર કરતો ધેર પહેંચ્યો.

હાથી કેટલેક દૂર નીકળી ગયા પછી તેને તૃપા લાગવાથી તે એક જળાશય પાસે આવી ઉભો રહ્યો. આ વખતે રાણુએ ધૂટકા-રાનો દમ ખેંચ્યો. હાથી પરથી તે ધીરેથી નીચે ઉતરી અને જગલ માર્ગ ચાલવા લાગી. તેવામાં એક તાપસે તેને જોઈ. ને તાપસ ચેડા રાજને ઓળખતો હતો. જ્યારે પદ્માવતીએ જણાવ્યું કે તે ચેડા રાજની પુત્રી છે, ત્યારે તાપસે તેને ખૂબ આશ્વાસન આપ્યું અને ખાવા માટે ઇણકળાહિ લાવી આપ્યાં. પદ્માવતીએ તે ખાધાં અને તેનો આભાર માન્યો. પછી તાપસે તેને કહ્યું : એન, અહીંથી થાડેક દૂર ધનપુર નામે ગામ છે ત્યાં તમે જવ. તમને ત્યાં શાંતિ મળશો. એમ કહી તાપસ તેને અર્ધ રસ્તે મૂકી ગયો. પદ્માવતી ત્યાંથી ધનપુર ગામમાં આવી અને હવે કયાં જવું તેનો વિચાર કરતી હતી, તેવામાં તેને એક સાધ્વીજી મળ્યા. પદ્માવતીએ હેમને વંદન કર્યું. તેનું નિસ્તેજ વંદન જોઈ સાધ્વીજીએ તેને ઉપાયમાં આવવાનું સૂચન કર્યું. પદ્માવતી સાધ્વીજીની સાથે ઉપાયએ ગઈ. સાધ્વીજીએ તેને ધર્મભોધ આપ્યો. પદ્માવતીનું હુદય વૈરાગ્યરસથી લિંજયું. તેને સંસાર પર તિરસ્કાર દૂષ્યો અને સાધ્વીજીને દીક્ષા આપવાનું કહ્યું.

પદ્માવતી ગર્ભવતી હતી. તે વાત તેણે સાધ્વીજીને કરી નહિ. સાધ્વીજીએ તો તેને દીક્ષા આપી. પદ્માવતી સંયમનો નિર્વાહ કરવા લાગી. થાડેક વખત વિત્યા બાદ પદ્માવતીનો ગર્ભકણ નણકમાં આવ્યો. ત્યારે સાધ્વીજીએ વાત જણ્ણી, એટલે તેમણે કોઈ ગૃહસ્થને ત્યાં ચુમ રીતે પદ્માવતીને રાખી અને તેનો ગર્ભકણ પૂરો કરાવ્યો. અહિં પદ્માવતીએ એક પુત્રનો જન્મ આપ્યો. સાધુ જીવનમાં પુત્રને સાથે રખાય નહિ એટલે પદ્માવતીએ તે બાળકને રલકાંખળમાં વીટયું. અને પોતાના પતિના નામવાળી વીઠી તેને પહેરાવી. બાળ-કને લઈને તે સમશાન ભૂભિમાં આવી. ત્યાં બાળકને મુક્યું અને

તને કોણું લઈ જય છે તે જેવા સારું તે જાડની ઓથે છુપાઈને ઉલ્લિ રહો. તેવામાં એક ચંડાળ ત્યાં આવ્યો અને આ બાળકને લઈ ગયો. છાની રીતે પદ્માવતી ચંડાળનું ધર જોઈ આવી અને ત્યાંથી ઉપાશ્રયમાં આવી. તેણે સાધ્વીજીને કહ્યું કે બાળક મરેલું અવતર્યું, તેથી હું તને સ્મશાન ભૂમિમાં મૂકી આવી છું. પુત્ર પ્રેમને વશ થઈ પહુંમાવતી સાધ્વી રોજ પેલા ચંડાળને ત્યાં જાય અને પુન્ત્રને રમતો જોઈ આનંદ પામે.

હવે આ પુત્ર દિનપ્રતિદિન વૃદ્ધિ પામતો જાય છે. તને ખરજવાનું દરદ થયું હતું, તેથી વારંવાર તે પોતાના શરીરને હાથથી ખણ્યા કરે, તેથી તેનું નામ કરકંડું પાડયું. કરકંડું સ્મશાન રક્ષકનું કામ કરતો. એકવાર એ સાધુ તે રસ્તે થઈને જતા હતા, તેમાંના એક સાધુ શાની હતા, તેમણે કહ્યું. જે કોઈ ભાણુસ આ વાંસની ઝડીમાંથી પેલા ઉલા વાંસને કાપી કે તો તે રાજ થાય, આ શબ્દો કરકંડુએ સાંભળ્યા, તેમજ ચંપાનગરીનો એક આલાણું તે ઝડીમાં એઠેલો, તેણે પણ સાંભળ્યું. કરકંડું એકદમ તે ઝડી પાસે દોડી ગયો. પણ તે પહેલાં પેલા આલાણે તે વાંસ કાપી લીધ્યો. કરકંડું આથી ગુસ્સે થયો. અને તેણે તે વાંસ આલાણું પાસેથી છીનવી લીધ્યો. આલાણે ગામભાં જઈ પંચ લેગું કરી ન્યાય માર્યો. પંચે કરકંડુને બોલાવી દંડ આપી દેવાનું કહ્યું. કરકંડુએ કહ્યું કે વાંસ નહિ ભળે, કેમકે અમારી રખેવાળી છે. પંચે કહ્યું, તને લાકડી આપવામાં શો વાંધો છે? આ બિચારો આલાણું છે તો આપી હે ને? કરકંડું બોલ્યો:- આ જાહુરી લાકડી છે, તે ન અપાય. કારણું કે આનાથી તો મને રાજ્ય મળવાનું છે. આ સાંભળી સધળા આલાણેં હસીને બોલ્યા: એમ છે તો લકે તું રાખ, પણ તને રાજ્ય મળે તો આ બિચારાને એક ગામ આપને હો.

અરે! એકના બદલે એ ગામ આપીશ. ચિંતા શીદને કરો છો?

એમ કહી કરકંડુ લાકડો લઈને ધેર આવ્યો. પેલા આલણુને તો કોધ માય જ નહિં. તેણે કરકંડુનો ધાર ધડી નાખવાનો વિચાર કર્યો. કરકંડુને આ વાતની ખરર પડી, એટલે તે ગામ છોડીને ચાલી નીકળ્યો, અને કંચનપુર પહેંચ્યો. ત્યાંતા એક ખગીચામાં તે વિશ્રાંતિ દેવા માટે એડો. કંચનપુરનો રાજ અપુત્રિએ ભરણ પામેલો. પ્રજાએ રાજ નાઝી કરવા એક અશ્વને ધૂટો મૂલ્યો. અશ્વ દરતો દરતો જ્યાં કરકંડુ એડો છે ત્યાં ઉદ્ઘાનમાં આવ્યો. અને તેના માથા પર હણ-હણાટ કર્યો. એટલે પ્રજાજનોએ જયવિજય ધ્વનિ કરી કરકંડુને ઉચકી લીધ્યો અને રાજ્યાસને બેસાડ્યો. આ વાતની પેલા આલણુને ખરર પડી એટલે તેને વધારે કોધ વહચો. તે કરકંડુ પાસે આવ્યો. અને તેને બીક દેખાડી. કરકંડુએ પેલો લાકડાનો દંડ દેરવ્યો. એટલે તેમાંથી અગ્નિના તણુખા નિકળવા લાગ્યા. આલણુ ગલરાયો અને એ હાથ જોડી બોલ્યો:-ભાઈ, જેના કિરમતમાં રાજ્ય હોય તેજ ભોગવી શકે. પણ તમે મને વચ્ચન આપ્યા મુજબ એક ગામ તો આપશો ને? કરકંડુએ કહ્યું. હા, જરૂર. પણ તારે કઈ જગ્યાએ ગામ જોઈએ છે? આલણુ બોલ્યો: ચંપાનગરીની પડોશમાં. કરકંડુએ ચંપાનગરીના દધિવાહન રાજ પર એક ચીડી લખી આપી. આલણુ ત્યાં ગયો અને રાજને ચીડી આપી. આ આલણુ ચંડાળ જાતિનો હતો. તેની દધિવાહનને ખરર પડતાં તે ઉસ્કેરાયો. તેણે ચીહીના ઢુકડે ઢુકડા કરી દેંડી દીધા, અને આલણુને ભાર ભારી નસાડી મૂક્યો. આલણુ કરકંડુ પાસે આવ્યો અને સધળી વાત કહી. આથી કરકંડુ બોલ્યો: શું દધિવાહનને આપણી ચંડાળ જતિ પર આટલો બધ્યો તિરસ્કાર છે? એમ કહી તેણે સેતાપતિને બોલાવી લશ્કર તૈથાર કરાયું અને દધિવાહન સામે લડવા નીકળ્યો. દધિવાહન પણ પોતાનું લશ્કર લઈ લઢવા માટે મેદાનમાં આવ્યો.

આ વાતની પદ્મમાવતી સાધ્વીને ખરર પડી. એટલે તરતજ તે કરકંડુના તંબુમાં આવી. સાધ્વીજીને દેખી કરકંડુએ પ્રણામ કર્યો.

અને આગમનનું કારણ પૂછ્યું. જવાખમાં સાધ્વીજ ઓદ્યાઃ કરકંડુ, તું જેની સાથે આ યુદ્ધ ખેલે છે, તે તારો પિતા છે, એ તું જણો છે

કરકંડુ આશ્ર્ય પામી ઓદ્યોઃ ના, મહાસતીજ. કહો કેવી રીતે ?

‘લે આ વીઠી. તે પર કંતું નામ છે ?’

વીઠી પર દધિવાહનનું નામ જોઈ કરકંડુ વિસ્મય પામ્યો. સાધ્વી ઓદ્યા. કરકંડુ, સખુર. મને એકવાર જવા હે તહારા પિતા પાસે. એમ કહી સાધ્વી દધિવાહન પાસે ગયા અને કહ્યું.

‘રાજન ! તમારી પદ્માવતી રાણીને હાથી લઈ ગયો હતો, તે પછી તેનું શું થયું તે તમે જણો છો ?’

‘નહિ, મહાસતીજ. હું તેમાંનું કથુંચે જણુતો નથી.’

‘હું પોતે જ પદ્માવતી’ સાધ્વીજ ઓદ્યા.

‘ત્યારે તમને ગલ્ભ હતો તેનું શું થયું ?’ રાજને આશ્ર્યથી પૂછ્યું.

તેજ આ કરકંડુ, કે જેની સામે તમે યુદ્ધ ખેલો છો.

રાજ દિંગમૂઢ બન્યો. યુદ્ધ બંધ થયું અને તે કરકંડુ પાસે આવી ગ્રેમથી તને લેટ્યો. સાધ્વીએ તેમને ધર્મઓધ આપ્યો. દધિવાહન રાજ વૈરાગ્ય પામ્યો અને ચંપાનગરીનું રાજ્ય કરકંડુને સૌંપી દીક્ષા લઈ ચાલી નીકળ્યો.

હવે કરકંડુ ન્યાયપૂર્વક રાજ્ય ચલાવે છે. કરકંડુને ગાયના ગોકુળ બહુ પ્રિય હતા. એકવાર એક બાળ-વાછરડાને જોઈ તને તેના પર ખૂબ ગ્રેમ થયો. તેથી તેણે ગોવાળને કહ્યું. આ ગાયને તમે દ્વારાશો નહિ અને સધજું દુધ આ વાછરડાને પીવરાવી હેણો.

ગોવાળે તે પ્રમાણે કર્યે. એટલે વાછરડો શરીરમાં હૃષ્પૃષ્ટ થયો. તે દેખ્યી કરકંદુને ધણો આનંદ થયો. સમય જતાં તે વાછરડો ધરડો થયો. તેથી તે અશક્ત અને નિર્ભળ બની ગયો. એકવાર કરકંદુંએ ગોવાળને પૂછ્યું. પેદો વાછરડો કંધાં ગયો? ગોવાળે વૃદ્ધ અને અશક્ત થયેલો વાછરડો બતાવ્યો. તરત રાજ ચમક્યો. તેણે મન સાથે વિચાર કર્યો; અહો, વાછરડાની અંતે આ દશા! થું ત્યારે જગતમાં જન્મેલા સૌ કોઈને આ સ્થિતિએ પહોંચવાતું! ખરેખર જન્મયું તે જવાતું છે, ખોલ્યું તે અવશ્ય કરમાવાતું છે. ઉદ્ય પામ્યું તે અસ્ત થવાતું છે. તો મારે શા માટે આત્મકલ્યાણ ન સાધવું. એમ આત્મભાવના ભાવતાં કરકંદુને ત્યાંજ જતિસમરણ શાન થયું. તરત તેણે સ્વયંમેવ પંચમુષ્ઠિ લોચ કર્યો અને દીક્ષા લીધી. સખત તપ જપ સંવર કરી હૃદયની ઉચ્ચ ભાવનાને વિકસાવતાં તે કૈવલ્યજ્ઞાન પામ્યા અને મોક્ષમાં ગયા. (પ્રત્યેક બુદ્ધ).

૫૭ કલાવતી.

દેવશાળ નગરના વિજયસેન રાજને શ્રીમતી નામની રાણીથી એક પુત્રી થઈ હતી. તેનું નામ કલાવતી. તેણીનું ઇપ અભાગ હતું. એકવાર એક ચિત્રકારે કલાવતીનું ચિત્ર આદેખીને ભગધ દેશમાં આવેલા શંખપુર ગામના શંખ રાજને તે બતાવ્યું. શંખરાજ તે સૌનાર્ય મુગધાની છથી જોઈને મોહવશ બન્યો; અને ચિત્રકારને તેનો પરિચય પૂછ્યો. ચિત્રકારે તે કલાવતીના ચિત્રનો પરિચય આપી, તે કંન્યા અવિવાહિત હોવાતું જણાવ્યું, એટલે શંખરાજને કલાવતી સાથે લગ્ન કરવાની ધર્ચિણ થઈ. ત્યારે ચિત્રકારે કહ્યું: મહારાજ. તે સુર્ય કંન્યાનો એવો નિરધાર છે કે તેણીના પૂછેલા ચાર પ્રશ્નોનો જે કોઈ જવાબ આપે, તેને જ તે કંન્યા વરે. વળી રાજન, વિજયસેનની સભામાં આપના સર્વગુણ સંપત્તપણાની વાત

થઈ છે, તેથી જ હું આપને મળવા આવ્યો છું. વળી એ મહિના પણી તેનો સ્વયંવર થવાનો છે, તે દરમ્યાન આપ સરસ્વતી દેવીનું આરાધન કરશો, તો દૈવકૃપાએ આપ તેણીના પ્રશ્નોના જવાબો આપવામાં અને તેણીને પરણવામાં ઇલિભૂત થઈ શકશો.

ખીજ દિવસથી શાંખરાજ સરસ્વતી દેવીની ઉપાસના કરવા લાગ્યો. તેણે અખંડ અલ્લયર્દ્ય પ્રત લીધું. રાજની અનન્ય લક્ષ્ણથી સરસ્વતી દેવી તેના પર પ્રસંગ થઈ, અને રાજ સન્મુખ આવી ઉલ્લિ. વરદાન માગવાનું કહેતાં રાજની ઇચ્છા મુજબ ‘તથાસ્તુ’ કહી દેવીએ કહ્યું:—રાજજન! સ્વયંવરમાં જઈને તમારે વચ્ચે ઉલા કરેલા સ્તંભની પુતળી પર હાથ મૂકવો એટલે તે પુતળી તેના ચાર પ્રશ્નોના જવાબ આપશો અને કલાવતી તમારી સાથે પરણશો.

દેવીના કહેવા પ્રમાણે રાજએ સ્વયંવર મંડપમાં જઈ તે પ્રમાણે કર્યું એટલે કલાવતીએ શાંખરાજને પુણ્યહાર પહેરાવ્યો અને વિધિપૂર્વક લમ્બ ઠક્કા થઈ. થોડાક દિવસ પિતુપક્ષમાં રહી, કલાવતી શાંખરાજ સાથે શાંખપુરમાં આવી. કલાવતી સહૃદયુણી અને સુર્ખાલ હોવાથી સર્વત્ર પ્રશંસા પામી, અને મનુષ્ય સંખ્યાના વિવિધ સુખો ભોગવવા લાગી. સુખલોગ ભોગવતાં તેણીને ગર્ભ રહ્યો. ગર્ભનું સુરક્ષિતપણે રક્ષણું કરતાં આહ ભાસ વ્યતિત થયા, એટલે કલાવતીને પિયરમાં તેડી જવા ભાટે જ્યસેન નામના તેના ભાઈએ પોતાની બહેન વારતે સુંદર ઐરખાં અને વસ્ત્રાભૂષણો લઈ માણુસો મોકલ્યા. ઐરખાં વગેરે જોઈ કલાવતી અત્યંત હષ્ટ પામી. શાંખરાજને કલાવતી પર અતિશય સ્નેહ હોવાથી તેણીને પિયર મોકલવાની ના કહી, એટલે આવેલ માણુસો વિદાય થયા.

આ તરફ કલાવતી, ભાઈએ મોકલેલાં ઐરખાં કાંડાપર પહેરી ભાઈની પ્રશંસા કરતી, દાસી પ્રત્યે કહેવા લાગી. અહો! તેમનો

મારા પર કેવો સ્નેહ છે, કે આવા સુંદર ઐરખાં અને વસ્ત્રાભૂપણો મારા માટે મોકલ્યા ! અહો ! હું તેમને ક્યારે ભળું ! આ શાખદો કલાવતીના મુખમાંથી નીકળતા હતા, તેવામાં જ શંખરાજ તેણીના મહેલ પાસેથી નીકળ્યો, અને આ શાખદો તેણે સાંભળ્યા. સાંભળતાં જ તે કલાવતી પર વહેભાયો. તેની નજરમાં કલાવતી કુલટા લાગી. તેણે કલાવતીનો ધૂષૃહતાપૂર્વક ત્યાગ કરવાનો નિશ્ચય કર્યો.

મહેલમાં આવી રાજએ એ ચંડાળોને બોલાવીને કહ્યું કે તમે હમણા જ રાણી કલાવતીને કાળાં વસ્ત્રો પહેરાવી, કાળા રથમાં એસાડી જંગલમાં લઈ જવ અને ત્યાં તેણીના બંને કાંડા ઐરખાં સાથે કાપી મારી પાસે હાજર કરો.

હુકમનો અમલ થઈ ગયો. કલાવતી માથે આવેલું સંકટ સહન કરવા હિંમતગાન બની અને પરમ પવિત્ર નવકારમંત્રનું સમરણું કરતી કાળાં વસ્ત્રો પહેરી રથમાં એડી. રથ અરણ્ય તરફ ચાલ્યો. મધ્ય જંગલમાં રથ થોભાવવામાં આવ્યો. ચંડાળોએ કલાવતીને નીચે ઉતારીને કહ્યું :—“અહેન ! અમારે હુંઘ સાથે કહેવું પડે છે કે મહારાજનો હુકમ છે કે તમારા બંને કાંડા ઐરખાં સાથે કાપી નાખોને મહારાજને સ્વાધીન કરવા. કલાવતી આ સાંભળી કંપી ઉડી. તેણે પોતાના ભાગ્યને દોષ આપતા કહ્યું :—ભલે લાઈએ ! સ્વામીનું કુશળ હો ! ખુશીથી તેમની આજા પ્રમાણે વર્તો, એમ કહી હિંમતપૂર્વક તેણીએ પોતાના બંને હાથ કાપી નાખવા માટે ચંડાળો સન્મુખ લંબાવ્યા; એટલે ચંડાળોએ તેના એ હાથ તરવારના એક એક ઝટકાથી કાપી નાખ્યા. કલાવતી એશુદ્ધ બની જમીન પર દળો પડી. ચંડાળો કપાયેલાં કાંડાં લઈ રાજમહાલયને માર્ગ વળ્યા.

થોડીક વારે શુદ્ધ આવ્યા ખાદ કલાવતી પ્રભુ સમરણ કરતી એકાએક એડી છે, તેવામાં પાસે વહેતી સરીતા તરફ તેની દશ્ટિ ગઈ.

તૃપાતુર થયેલી સતી પાણી પીવા સરીતા તટે પહોંચ્યો. એવામાં એકાએક પાણીનું પૂર આવ્યું; જેમાં કલાવતી તણું જય તેવી પરિસ્થિતિ ઉત્પત્ત થઈ. આવી કલાંકિત અવસ્થામાં તેનું મૃત્યુ થાય, એ કલાવતીને ધિષ ન લાગ્યું. એટલે તે વિશુદ્ધ ભાવે ગ્રલુ સમરણ કરતાં બોલી:—હે નાથ ! જે મેં આજ સુધી સાચા મનથી પતિ સેવા કરી હોય, સ્વર્ણમાં પણ પતિનું અહિત ધર્યાયું ન હોય, અને હું પવિત્ર જ હોડું, તો આ નદીનું પૂર એસરી જળે અને રહારા બંને હાથ નવપદ્મવિત થાજો. સતીના સુખમાંથી ઉપરના શષ્ઠો નીકળતાં જ નદીનો પ્રવાહ એકદમ શાંત થઈ ગયો, અને તેના કપાયેલાં કાંડાં પુનઃ સજ્જવન થયાં.

અહિં કલાવતીએ એક વૃક્ષની ઓથે આશ્રય લીધો અને એક પુત્ર રહ્નનો જન્મ આપ્યો. જંગલમાં પુત્રનો પ્રસવ થવાથી કલાવતીને ખૂબ લાગી આવ્યું; પરન્તુ કર્મનું પરિથળ સમજી, સધળું તેણીએ સમભાવે સહન કર્યું. એવામાં એક તાપસ ત્યાં આવી ચડ્યો. દ્યાથી તે કલાવતી તથા તેના બાળકને પોતાના મહમાં લઈ ગયો અને તેઓને તાપસણીના સહવાસમાં મૂક્યાં. કલાવતી અહિં ધર્મધ્યાનમાં સમય પસાર કરવા લાગી.

ઓળ તરફ ચંડળોએ કલાવતીના કાંડાં બેરખાં સહિત શાંખ રાજને સેંચ્યા. બેરખાંની સુંદરતા અને કારીગિરી જેઈ રાજ આશ્રય પામ્યો. વધુ બારીકાદ્ધિ જેતાં તેણે બેરખાં પર ‘જયસેન’ એવું નામ વાંચ્યું. તે વાંચતાં જ રાજને ધ્રાસકો પડ્યો. તે સમજ્યો કે બેરખાં કલાવતીના ભાઈના મોકલાવેલાં છે અને તેથી જ તેણી તેના ભાઈ પરનો અસીમ સ્નેહ વ્યક્ત કરતી હશે ! અહો ! હું કુવો હુષ કે પૂરતી તપાસ કર્યા વગર કલાવતી જેવી પવિત્ર સ્ત્રી પર વહેમાયો, અને તેણીની હુર્દશા કરાવી. અહો ! હવે તેણીનો ક્યાં પત્તો લાગશે ? એમ વિચારતાં રાજનું હૃદય સુંઝાયું; કલાવતીનો

પતો ન ભણે તો દેહત્યાગ કરવાનો નિશ્ચય કરી રાજએ તેની શોધ માટે ચોમેર ધોડેસ્વારો દોડાવ્યા. જંગલમાં સતીનો મેળાપ થતાં અનુચરોએ રાજની સ્થિતિ વર્ણવીને, તેણીને રાજ્યમાં આવવાનું કહ્યું. કલાવતી શંખપુરમાં આવી, રાજને પ્રણામ કર્યા. રાજએ તેની ક્ષમા માગી, તે સાથે તેણીના સાજાં થયેલાં કંડા જેઈ તે આશ્ર્યમુગ્ધ બન્યો અને તેની પવિત્રતાની વધુ ખાત્રી થઈ. રાજ અને રાણી ત્યારપદ્ધી સુખપૂર્વક રહેવા લાગ્યા.

એકવાર એક સ્થવીર મુનિ શંખપુરમાં પદ્ધારતા રાજ રાણી તેમનાં દર્શને ગયા. કલાવતીએ પોતાના પર આવેલાં કલાંકનું કારણ મુનિને પૂછ્યું. મુનિએ કહ્યું:—હે સતી, પૂર્વે તું સુલોચના નામે રાજકન્યા હતી, અને શંખ રાજનો જીવ એક પોપટ હતો. તે પોપટને તેં પાબ્યો હતો. એકવાર તે તારી પાસેથી ઉડી ગયો, તેથી તને તેના પર કોધ થયો. તે પોપટને જાડપરથી તેં માણુસો દ્વારા પકડી મંગાવ્યો અને ગુર્સાના આવેશમાં તેં તેની બંને પાંખો છેદી નાખી. પૂર્વાલવનું આ વૈર આ વખતે શંખ રાજએ વાળ્યું. તેથી તેમણે તહારા બંને હાથ કાપી નંખાવ્યા. માટે પાપ કર્મ કરતાં પહેલાં વિચાર કરવો અને ધર્મનું શરણ લેવું.

આ ઉપદેશ સાંલળી બંનેએ જાતિસમરણ જ્ઞાન થતાં ત્યાં દીક્ષા લીધી, અને ચારિત્ર પાળી દેવલોકમાં ગયા; ત્યાંથી મહા વિદ્ધમાં જન્મ ધરી તેઓ મોક્ષમાં જશે.

૫૮ કામહેવ શ્રાવકુ.

ચંપા નગરી, કામહેવ નામે ગાથાપતિ, લદ્રા નામે તેમની સ્ત્રી, રિષ્ટ્ઝ સિદ્ધિનો પાર નહિ, છ કોડ સોનૈયા જનીનમાં, છ કોડ વ્યાપારમાં, છ કોડ ધર વખરીમાં, અને છ ગોકુલ હતાં. કામહેવ

આવક તે સર્વના ઉપલોગમાં આનંદથી દિવસો પસાર કરતા હતા. એક વાર પ્રભુ મહાવીર પધાર્યા. કામહેવ, આણું આવકની જેમ પ્રભુને વંદન કરવા ગયા. પ્રભુના અપૂર્વ ઉપદેશથી પ્રતિબોધ પામ્યા, અને આવકના બાર વૃત અંગીકાર કર્યા. નિયમોનું બરાબર પાલન કરતાં કેટલાક વર્ષો વિત્યા બાદ ધરનો સધળો કારલાર જ્યેષ પુત્રને સોંપી કામહેવ ધર્મ કાર્યને માટે નિવૃત થયા. એક વાર અર્ધ રાત્રીએ કામહેવ આવક પૌષ્ઠર્વત કરીને આત્મધ્યાન ધરતાં કાયોત્તસર્ગમાં ઉલા હતા, તેવામાં તેમને ધ્યાનથી ચળાવવા માટે એક ભિથ્યાત્મ દાણ દેવ બયંકર પિશાચનું રૂપ ધારણું કરીને તેમની પાસે આવ્યો. અને બાલ્યો:-હે કામહેવ, તહારા લીધેલાં વૃત તું છોડી હે, નહિતર આ તરવારથી તારાં શરીરનાં કુકડે કુકડા કરી નાંખું છું. આ સાંભળી કામહેવ જરા પણ ક્ષોલ પામ્યા વિના ધ્યાનમાં સ્થિર જ રહ્યા. ક્રીથી તે દેવે હાથીનું રૂપ કરીને કામહેવને ખૂબ કર્યાં, છતાં કામહેવ નિશ્ચળ રહ્યા. પુનઃ દેવે સર્પનું રૂપ કરી કુંઝાડ માર્યાં અને તીક્ષ્ણ જેરી દાંતોથી ડંખ દીધો. કામહેવને અસલ વેદના થઈ, પરંતુ તે પોતાના ધ્યાનથી જરા પણ ડગ્યા નહિ. એમ સિંહ, વાધ, હાથી વગેરે અનેક રૂપો વિકુળની દેવે કામહેવ આવકને તેના વૃતથી ડગાવવા ધણું પરિસહિત આખ્યા; છેવટે તે દેવ થાક્યો. અને અવધિ રૂાન મૂકીને જેયું તો કામહેવને પોતાના કાયોત્તસર્ગમાં મેર પર્વતની જેમ અડોલ જેયાં. તેથી દેવે પોતાનું અસલ સ્વરૂપ ધારણું કરી કહ્યું:-“ ધન્ય છે કામહેવ આવક તહમારી ટેકને, શકેંદ્ર દેવતાની સભામાં તમારી પ્રફળાની પ્રશંસા મેં જેવી સાંભળી તે બરાબર છે. અવિનય માટે હું તમારી ક્ષમા માગું છું. મારો અપરાધ તમે ક્ષમા કરજો.” એટલું કહી તે દેવ સ્વરૂપનું ચાલ્યો ગયો.

સવાર થયું, કામહેવે પૌષ્ઠર્યાળામાં સાંભળ્યું કે પ્રભુ મહા-વીર પધાર્યા છે. તેથી તે પૌષ્ઠ પાર્યા પહેલાં જ પ્રભુને વંદન કરવા ગયા. પ્રભુએ પરિષદને ધર્મબોધ આપ્યો, અને કામહેવને

થએલા ઉપસર્ગોનું ધ્યાન કરી, કામહેવની માઝક વૃત્ત નિયમમાં દ્દર્ભીને, દેવતા, મનુષ્ય, તર્યાચના ઉપસર્ગોને સમભાવે સહન કરવાની પ્રભુએ પરિષદ્ધને દેશના દીધી. કામહેવ પ્રભુને વાંદી, પૌષ્ઠ પારીને ધેર ગયા. ત્યારથ્યાદ આવકની ૧૧ પ્રતિમા અણણ કરીને, અને અંતિમ અવસરે સંથારો કરીને કામહેવ આવક કાળધર્મ પામી પહેલા સુધર્મ દેવદોકભાં ગયા, અને ત્યાંથી મહાવિદ્ધ ક્ષેત્રમાં જન્મી મોક્ષમાં જશે.

૫૯ કાર્તિક શેઠ

મુનિસુવત અગવાનતા વખતમાં મહા શ્રદ્ધાવંત એવા કાર્તિક નામના શેઠ હતા. તે શુદ્ધ દેવ, ગુરુ અને ધર્મ એ ત્રિરતને અનુસરનાર હતા. તેમને ત્યાં અથાગ સમૃદ્ધ સાથે ૧૦૦૮ ગુમારતાએ હતા. કાર્તિક શેઠ મુનિસુવત અગવાન પાસે આવકના બાર પ્રત ધારણું કર્યા હતા. એક વખત અન્ય દર્શની એવા રાજના ગુરુ તે નગરમાં પધાર્યા. સધળા લોકો તેમના દર્શને ગયા. પરંતુ કાર્તિક શેઠ ગયા નહિ. એવામાં ડોઈ તે શેઠના વૈરીએ ગુરુના કાન ભંભેર્યા કે લકે આખું નગર તમારાં દર્શને આવે, પરંતુ કાર્તિક શેઠ તો આવે જ નહિ. આથી ગુરુ આવેશમાં આવી ગયા અને બોલ્યા, કે જ્યારે હું તે શેઠને નમાવું ત્યારે જ ખરો ! આવે વિચાર કરી એક દિવસે તે રાજગુરુએ એવી શરતે રાજને ત્યાં જમવાનું આમંત્રણ સ્વીકાર્યું કે કાર્તિક શેઠના વાંસા પર થાળ મૂકીને જમાડવામાં આવે. રાજને આ શરત પણ સ્વીકારી. બીજે દિવસે કાર્તિક શેઠને રાજએ પોતાને ત્યાં બોલાયા અને વાત વિદ્ધિ કરી. કાર્તિક શેઠને રાજના હુક્મને તાએ થવું પડ્યું. તે રાજગુરુના જોગામાં ભાયું મૂકીને નીચા નમ્યા, એટલે તેમના વાંભા પર તાપસે થાળ મૂકી બોજન કર્યું. ગરમ બોજનના પ્રલાવે શેઠ કંઈક દાઝયા પણ ખરા. ત્યાર પછી પોતાને વિચાર થયો, કે સંસારમાં રહેવાથી રાજના આવા હુક્મને તાએ

થવું પડ્યું, તો ધિક્કાર છે આ સંસારને. એમ વિચારી, તેમણે ચારિત્ર-પ્રત અંગીકાર કર્યું અને ઉત્ત્ર તપશ્ચર્યાં તથા જ્યંમના પ્રભાવે તેઓ કાળ કરીને સૌધર્મા નામક પ્રથમ દેવલોકના ધૂર્દ-શકેન્દ્રપણે ઉત્પન્ન થયા. તેમના વાંસા પર થાળ મૂકી જમનાર તાપસ મૃત્યુ પામીને તે શકેન્દ્રનો ઐરાવત હાથીનું રૂપ કરનાર એવો આજ્ઞાધિન દેવ થયો. અહિં અવધિજ્ઞાન વડે જોતાં તે દેવને ભાન થયું કે ગતભવતમાં આ ધૂર્દ કાર્તિક શેડ હતા, અને હું તેના વાંસા પર જમ્યો હતો, તો આ વખતે તે મારા પર સ્વારી કેમ કરે? એવા વિચારથી તેણે એ હાથી વિકુલ્યાં. જેમાંના એક પર શકેન્દ્ર પોતાનો દંડ મૂકી બીજ પર એહા. એટલે તે તાપસ દેવે ત્રીજો હાથી અનાવ્યો. એમ તાપસ રૂપ વધારતો જથ અને ધૂર્દ એકેક વરસુ મૂકતા જથ. આથી ધૂર્દે અવધિજ્ઞાનથી જોયું તો તેને જણાયું કે પૂર્વભવનો વૈરી તાપસ દેવ થયો છે, અને પોતાના ઉચ્ચત્વપણાના અલિમાને તે આ સધળી માયા રચે છે, આથી ધૂર્દે તેના પર વજનો પ્રહાર કર્યો એટલે તે ઐરાવત હાથી વશ થઈ સીધો ચાલ્યો; અને વિકુર્વેલા રૂપ સંકેલી લીધા. તીર્થીકરના જન્મોત્સવ વખતે, દીક્ષા વખતે, વાર્ષિક દાન આપતી વખતે તીર્થીકર પાસે ઉલા રહેવું એ વગેરે કિયાએ શકેન્દ્રને કરવાની હોય છે.

૬૦ કાલીકુમાર

રાજગ્રહી નગરીના અણિક રાજની ડાળી રાણીની કુલિકે કાલીકુમારનો જન્મ થયો હતો. તેના ઓરમાન ભાઈ ક્રેણિકને પોતાના પિતા અણિક રાજ પાસેથી રાજ્ય પડાવી લેવામાં તેણે મદદ કરી હોવાથી, તેને બીજ નવ ભાઈઓની ભાઇક રાજ્યમાં ભાગ મળ્યો હતો. એટલે ભગધ અને અંગ દેશનું રાજ્ય અગીયાર લાગે વહેંચાયું હતું. કાલકુમાર પોતાના રાજ્યનો વહિવિટ ક્રેણિક પાસે ચંપાનગરીમાં રહીને કરતો. ક્રેણિકને વિહલ્ય અને વેહાસ

નામના એ સગા ભાઈઓ હતા. તેઓને રાજ્યમાંથી ભાગ આપ્યો ન હતો, પણ ક્રેણિકે તેમને સિંચાનક નામનો ગંધ હસ્તિ અને અદારસરો વંકાર આપેવ હતો. વિહલ્લકુમાર વંકાર પહેરી, હાથી પર બેસી ગંગામાં જાગડીડા કરવા જતો. તે જેઠ ક્રેણિકની સ્ત્રી પદ્માવતીએ તે હાર અને હાથી તેઓની પાસેથી લઈ દેવાનું પોતાના સ્વામીને કર્યું. પ્રથમ તો ક્રેણિક તેમ કરવા કર્યુલ ન થયો, પણ સ્ત્રી હડને વશ અની, ક્રેણિકે વિહલ્લકુમાર પાસે હાર અને હાથી માગ્યા. વિહલ્લે કર્યું:— કાળકુમારાદિ ૧૦ ભાઈઓને તમે રાજ્યમાં ભાગ આપ્યો છે, તેવો ભાગ મને પણ રાજ્યમાંથી આપો, એટલે મને આ હાર અને હાથી તમને આપી દેવામાં હરકત નથી. ક્રેણિકે રાજ્યમાંથી ભાગ આપવાનું કર્યુલ ન કર્યું, અને અળાતકારે તે હાર અને હાથી લઈ દેવા માટે તેને ધમકી આપી. આથી વિહલ્લકુમાર છાનોમાનો પોતાના દાદા (માનાઆપ) ચેડારાજ (ચેટકરાજ) પાસે વિશાળા નગરીમાં જતો રહ્યો. આ વાતની ખખર પડતાં ક્રેણિકે તે હાર અને હાથી મોકલી આપવાનું અને જે તે પ્રમાણે ન બને તો યુદ્ધ કરવા તૈયાર થવાનું કહેણું મોકલાવ્યું. ચેડા રાજ યુદ્ધ કરવા તૈયાર થયા. ક્રેણિક પોતાના દરે ભાઈઓની મદદથી ચેડા રાજ પર ચડાઈ કરી. ક્રેણિક પાસે અગીયારે જણુનું થઈ ૩૩ હજાર ધોડા, ૩૩ હજાર હાથી, ૩૩ હજાર રથ અને ૩૩ કરોડ પાયદળ જેટલું લસ્કર હતું.

ચેડા રાજએ પણ કાશી અને ક્રેશલ (અયોધ્યા) દેશના ૧૮ રાજઓને કહેવડાવ્યું કે વિહલ્લકુમારને તેના હાર હાથી સાથે ચંપાનગરીમાં પાછો મોકલી દેવો કે કેમ? જવાબમાં આ અદારે દેશના રાજઓએ હાર હાથી વગેરે પાછાં ન આપતાં, યુદ્ધ કરવાની સલાહ આપી, તે સાથે તેઓ પોતપોતાનું સૈન્ય લઈ લડવા માટે ચેડા રાજની મદદ આવ્યા. આ વખતે ચેડારાજ પાસે ૫૭ હજાર

હાથી, ૫૭ હજર ધોડા, ૫૭ હજર રથ અને ૫૭ કરોડ પાયદળનું
લસ્કર થયું.

બંને વચ્ચે સામસામું દાસણ યુદ્ધ* થયું. તેમાં ચેડારાજના
હાથથી અલી-કુમાર મરણ પામ્યો અને ચોથી નરકમાં ગયો. ત્યાં
તે દશ સાગરોપમની સ્થિતિ ભોગવી, ત્યાંથી નીકળા મહાવિદેહ
ક્ષેત્રમાં અવતરશે ને મોક્ષ જરો.

૬૧ કાલીરાણી.

તે રાજગૃહ નગરના શ્રેણિક રાજની રાણી હતી. ક્રેણિકે
શ્રેણિકની ગાઢી પર બેસતાં, તેના પુત્ર કાલીકુમારને રાજ્યમાં
ભાગ આપેલો, તેથી તે પોતાના પુત્ર સાથે ક્રેણિકની રાજ્યધાની ચંપા
નગરીમાં રહેતી. ક્રેણિકને હાર હાથી માટે ચેડા રાજ સાથે વિશ્રદ્ધ
થયો તેમાં કાલીકુમાર ક્રેણિકની મદ્દહે ગયો, ત્યાં ચેડા રાજના હાથે
તેનું મૃત્યુ થયું. આ વખતે અગવાન મહાવીર ચંપાનગરીના
ઉદ્ઘાનમાં સમોસર્યા હતા. પ્રલુના દર્શને જરાં કાલીરાણીએ પોતાના
પુત્રનું શું થશે એમ પૂછતાં પ્રલુએ તેના મૃત્યુ સમાચાર આપ્યા,

* બંને વચ્ચે ધણા દિવસ સુધી યુદ્ધ ચાલ્યું તેમાં અલી
આદિક દશે કુમારો ચેટક રાજના એક એક બાળથી મૃત્યુ પામ્યા.
આથી ક્રેણિક લય પામ્યો. તેણે પોતાના ભિત્ર દેવની આરાધના
કરી. દેવ આવ્યો. તેને ક્રેણિકે ચેટક રાજનો સંહાર કરવાનું કહ્યું,
ત્યારે દેવે કહ્યું કે પ્રલુ મહાવીરના પરમ અક્તા ચેટકરાજને અમે
કાંઈ પણ નુકશાન કરી શક્યે એમ નથી. પણ જો તું કહે, તો
તારું રક્ષણ કરીએ. ક્રેણિકે હા કહી, એટલે દેવે ચેડારાજને ત્યાંથી
ઉપાડીને ભીજે મૂક્યો, જેથી ક્રેણિકનો વિજય થયો. ક્રેણિકે વિશાળા
નગરીને ઉનજરડ કરી મૂકી. આ યુદ્ધમાં ૧ કરોડ ૮૦ લાખ મનુષ્યોનો
સંહાર થયો હતો.

તेथी तेणुने त्यां मूर्छा आवी. परन्तु लगवाने ऐध आपवाथी तेणुने वैराग्य उपन्यो अने प्रभु पासे आरित्र लઈ ते चंदनआणा साध्वी पासे रही. शुरुणीनी आज्ञा लઈ तेणे रत्नावली तप करी शरीर शोधवी नाखयु. आठ वर्षना दीक्षा पर्याय पछी अंत समये एक भासनु अनशन करी, काळी-साध्वी कैवल्यशान पाभी भेक्षभां गया.

૬૨ કાલીકુમારી.

આમલકंપા નગરીમાં કાલ નામનો ગાથાપતિ રહેતો. તેને કાલશ્રી નામની પત્ની હતી. તેનાથી તેને એક પુત્રી થઈ. તેનું નામ કાલીકુમારી. તે યૌવનપણું પાભી, પણ તેનું શરીર વૃદ્ધ જેવું દેખાતું હતું. હાથ, પગ, સ્તનાદિ સર્વ અવયવો વૃદ્ધ ખ્રી જેવા દેખાતાં. તે અવિવાહિતા જ રહી. એકવાર તે પાશ્ર્વનાથ લગવાનની દેશના સાંભળવા ગઈ. ત્યાં તેને વैરાગ્ય થવાથી ભાતાપિતાની રજ લઈને તે દીક્ષિત બની. પુણ્યચુલા નામના આર્યાજી પાસે તેણી ૧૧ અંગ ભણી અને ઉચ્ચ તપ સંયમ આરાધવા લાગી. પરન્તુ કર્મવશાત પાછળથી તે આચારમાં શિથિલ બની; અને શરીરની વિલુષા-શુશુષા કરવા લાગી. હાથ, પગ, મોઢું, માથું તેમજ શરીરના અન્યાન્ય અવયવો તે ધોતી; ઉઠવાની જગ્યાએ પાણી છાંટીને પછી તે બેસતી. આવાં કાર્યોં ન કરવાનું પુણ્યચુલા આર્યાજીએ તેણીને વારંવાર કહ્યું, છતાં શિથિલ બનેલી કાલી-સાધ્વીએ તે માન્યું નહિ. એ રીતે ધણો કાળ આરિત્રમાં નિર્ગમન કરીને, પૂર્વ કૃત્યોની આલોચના લીધા વગર અંતિમ અનશન કરી તે મૃત્યુ પાભી અને ચભરચંપા કાલાવતસંક નામક વિમાનમાં દેવી-પણે ઉત્પન્ન થઈ. ત્યાં તે અદી પલ્યોપમની સ્થિતિ પૂર્ણ કરી મહાવિદેહમાં અવતરશે અને મોક્ષમાં જશે.

૬૩ કાસવ ગાથાપતિ.

રાજગૃહ નગરમાં કાસવ નામનો ગૃહસ્થપતિ રહેતો. તેણે ભગવાન મહાવીર પાસે દીક્ષા અરુણ કરી હતી. સોળ વર્ષ પર્યંત શુદ્ધ ચારિત્રનું આરાધન કર્યું. ગુણ સંવત્સરાદિ મહા તપ કર્યો. અને છેવટે વિપુલ પર્વત પર અનશન કરી, કૈવલ્ય જ્ઞાન પામી મોક્ષમાં ગયા.

૬૪ કૃત્તિવીર્ય.

ભરત ચક્રવર્તી પઢી અયોધ્યાની રાજગાડી પર છુટો રાજ થયો તે કૃત્તિવીર્ય. તેમના પિતાનું નામ અળવીર્ય. કૃત્તિવીર્યને ભરત મહારાજની જેમ અરિસાલુવનમાંજ આત્માની અપૂર્વ શ્રેણિમાં પ્રવેશતાં કૈવલ્ય જ્ઞાન થયું હતું. દેવાંશે સાધુવેશ અર્પણ કર્યો અને પઢી તેઓ ચારિત્ર અંગીકાર કરી મોક્ષમાં ગયા.

૬૫ કૃષ્ણારાણી.

તે શ્રેણિક મહારાજની રાણી હતી. તેનો પુત્ર, ચેડારાજ અને ડોણિક વર્ચ્યેના યુદ્ધ સંગ્રહમાં ભરાયો, એ જાણી તેણે કાળી રાણીની માઝેક ભગવાન મહાવીરની દેશના સાંકળી દીક્ષા અંગીકાર કરી. તપમાં વડાસિંહની કિયાનો તપ કર્યો. ૧૧ વર્ષની સંયમ પર્યાયને અંતે તે કૈવલ્યજ્ઞાન પામી મોક્ષમાં ગયા.

૬૬ કૃષ્ણ વસુદેવ.

વસુદેવ રાજની દેવકી નામક રાણીના તે પુત્ર હતા. તેમનો જન્મ તેમના માભા કંસને ત્યાં ભથુરામાં થયો. હતો. કંસને અતિમુક્તા મુનિએ કહેલું કે આ તમારી એન દેવકીને જે સાતમો ખાળક થશે, તે તને ભારશે. આથી યુક્તિપૂર્વક વસુદેવને સમજવી, દેવકીની

પ્રસુતિક્રિયા પોતાને ત્યાં કરાવવાની ભાગણી કરી. વસુદેવે તે કણુલ રાખી. ત્યારથાદ દેવકીએ પ્રસવેલાં છ બાળકો દેવતી ભાયાથી સુલસાને ત્યાં ગયા, અને સુલસાને જન્મેલાં મૃત બાળકો દેવકીને ત્યાં આવ્યા. હવે સાતમા પુત્રપ્રસવની કંસ રાહ જેવા લાગ્યો. તેણે ચોકીદારોને સર્પત ચેતવણી આપી. પરન્તુ જેનું પુણ્ય પ્રથળ હોય અને ભાવિ નિર્માણ હોય તે ક્રોણ મિથ્યા કરી શકે. યોગ એવો અન્યો કે અરાધર સાતમે ભહિને દેવકીએ સાતમા બાળક શ્રી કૃષ્ણને જન્મ આપ્યો. દેવોના પ્રભાવે ચોકીદારો ઉંઘમાં ધોરતા હતા. દેવોએ તે કૃષ્ણ બાળકને સાવધાનીથી ઉંચકી લીધો અને તેને લઈ જઈને ગોકુલ નામક ગ્રામમાં નંદ નામક ગોવાળને ત્યાં મૂક્યા. ત્યાં કૃષ્ણ મોટા થયા અને કંસનો વધ કર્યો. પરન્તુ શ્રી કૃષ્ણ તે વખતે જરાસંધની ખીકથી પશ્ચિમ લણી ચાલ્યા ગયા. ત્યાં દેવતાઓએ તેને માટે દ્વારિકાનગરી વસાવી આપી. સર્વ યાદોએ તેમને રાજ્યાસને ઐસાડી રાજ તરીકે સ્વીકાર્યા. આ વાતની અધર પડતાં પ્રતિવાસુદેવ જરાસંધે કૃષ્ણ વાસુદેવ પર ચાર્છ કરી, પરન્તુ તેમાં જરાસંધ મરાયો. પછી ખીજ દેશો શ્રીકૃષ્ણે જીત્યા અને એ રીતે તેઓ છ ખંડના અધિપતિ થયા. તે વખતે પાંડવો તેમના નિકટના સગા અને સ્નેહીઓ હતા. તેમના વખતમાં શ્રી કૃષ્ણના કાક્ષ સમુદ્રવિનિય રાજના પુત્ર શ્રી નેમનાથ તીર્થકર થયા. શ્રી કૃષ્ણ પ્રભુ નેમનાથના અનન્ય અક્તા હતા. શ્રીકૃષ્ણને દૃક્ષમણી, સત્યભામા, રાધા, પદ્માવતી આદિ ઘણી રાણીઓ હતી. તેમના નાનાભાઈ ગન્ઝસુકુમારે સગપણ કરેલી કન્યાને છોડી, પ્રવન્યા લઈ, તપ કરવા સમશાનમાં વાસ કર્યો હતો, ત્યાં તેમના સસરા સોમિલ આલાણુના ઉપસર્ગથી શ્રી ગન્ઝસુકુમારે મોક્ષમાં વાસ કર્યો. આ અધરથી ભાધના આ વેદનાજનક મૃત્યુથી શ્રી કૃષ્ણને ઘણું લાગી આવ્યું. પોતાનું મૃત્યુ કેવી રીતે થશે એ બાબત શ્રી નેમનાથને પૂછતાં પ્રભુએ શ્રી કૃષ્ણને કંણું કે-તારી દ્વારાનગરી દેવના કોપે બળશે અને જરાકુંવરના હાથે તારં મૃત્યુ થશે.

આથી લય પામી શ્રી કૃષ્ણે જીવનમાં સતકાર્યો કરવાનું પણ લીધું. તે દીક્ષા તો ન લઈ શક્યા, તેમ આવકના પ્રતો પણ ગ્રહણ ન કરી શક્યા, પરન્તુ તેમણે દ્વારિકા નગરીમાં એવો પડહ વગડાવ્યો કે જે ક્રોદ્ધને દીક્ષા લેવી હશે તેનું તમામ અર્ચ શ્રી કૃષ્ણ આપશે, અને તેમના વાલીવારસોનું પોતે રક્ષણ કરશે. આથી ધણાઓએ આ સગવડથી દીક્ષા લીધી. આ ઉપરાંત અનેક સતકર્મા વડે શ્રીકૃષ્ણની તીર્થકર નામ કર્મ ઉપાજ્ઞન કર્યું અને તેઓ હવે પછીના ઉત્સર્પણી કાળમાં અમભનાથ નામના તીર્થકર થશે. આખરે દૈપાયન* નામના અગ્નિકુમાર દેવના ક્રોપથી દ્વારિકાનગરી બળા. અગ્નિની ચોમેર ફરી વળેલી જ્વાળાઓ રોકવા શ્રીકૃષ્ણ શક્તિમાન ન થયા, એટલે શ્રીકૃષ્ણ તથા બળદેવ, એક રથમાં પોતાના પિતા વસુદેવ અને માતા દેવકીને બેસાડી, પોતે રથ હંકીને નેવા જ દ્વારિકા નગરીના દરવાજની અહાર નીકળ્યા, કે તરત જ તે દરવાજે તૂટી પડ્યો અને પોતાના માખાપ તેમાં ચંગદાર્ઢ મૃત્યુ પામ્યા. બંને લાઇ ઝડપલેર ત્યાંથી નાસી ધૂટચા અને વગડામાં ગયા. ત્યાં શ્રીકૃષ્ણને ખૂબ તૃપા લાગી. બળભદ્ર પાણીની શોધ માટે ચાલ્યા ગયા. તેવામાં કે જાડ પાસે શ્રીકૃષ્ણ એડા હતા, ત્યાં જરાકુંવરના હાથથી ધૂટેલું એક બાળ આંયું અને તે શ્રીકૃષ્ણના કંપળમાં વાગ્યું. કારમી ચીસ પાડી શ્રી કૃષ્ણ ત્યાં એક હળર વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી મૃત્યુ પામ્યા

* શૌર્યપુર નગરની બહાર આશ્રમમાં પરાશર નામનો તાપસ હતો. તેણે યમુના દ્વીપમાં જઈ ક્રોદ્ધ નીચ કુન્યા સાથે લોગવિલાસ કર્યો; પરિણામે એક પુત્ર થયો. તેનું નામ દૈપાયન. દૈપાયન આગળ જતાં અલ્લાચારી પરિવાજક થયો. અને યાદવોના સહવાસમાં મૈત્રિ-લાવથી રહેવા લાગ્યો. એકવાર શાંખ આદિ કુમારો ભહિરામાં ચકચૂર બન્યા અને દૈપાયનને મારી નાંખ્યો. મરીને તે અગ્નિકુમાર દેવ થયો. કોધના નિયાણાથી તેણે દ્વારિકા નગરીને બાળાને ભર્તમીભૂત કરી.

અને ત્રીજી નરકે ગયા. પાછળથી બળભદ્રે આવીને લાઈના મૃત્યુ પર ખૂબ આંસુ સાર્થી, પણ સધળું વ્યર્થ ગયું. આખરે તેણે શ્રી કૃષ્ણની અંતઃકિયા કરી. શ્રીકૃષ્ણ આવતી ચોવીસીમાં ભરતક્ષેત્રમાં ૧૨ મા તીર્થકર થશે.

૬૭ કૃષ્ણકુમાર.

એણિક રાજની કૃષ્ણકુમારી નામક રાણીને કૃષ્ણકુમાર નામે પુત્ર થયો હતો. તે કાલકુમારની સાથે યુદ્ધમાં ક્રાણિકની મદ્દે ગયો. ત્યાં ચેડા રાજના હાથે તેનું મૃત્યુ થયું અને તે નરકમાં ગયો. યાંથી નીકળીને તે કાળકુમારની માદ્ક મોક્ષમાં જશે.

૬૮ કુથુનાથ.

વર્તમાન ચોવિસીતાં ૧૭ મા તીર્થકર શ્રી કુથુનાથ હસ્તિનાપુરના સુર નામક રાજની શ્રી નામની રાણીની કુક્ષિમાં, સવાર્થસિદ્ધ વિમાનમાંથી ચ્યવીને આવણ વદિ ૮ ની રાત્રે ઉત્પત્ત થયા. માતાએ ૧૪ સ્વર્પન જેથાં, ગર્ભકાળ પુરો થયે વૈશાક વદિ ૧૪ ના રોજ તેમનો જન્મ થયો.

દિગું કુમારીકાચોએ શ્રીરાણીનું સુતિકાર્મ કર્યું. દ્યુત્રોએ ભાવી તીર્થકરનો જન્મોત્સવ ઉજવ્યો. માતા પિતાને અતિશય હષ્ટ થયો. ગર્ભ વખતે માતાએ કુથુનાથ નામે રતનસંચય જેથેલો, તે ઉપરથી પુત્રનું નામ કુથુનાથ પાડવામાં આવ્યું. આલ્યાવરસ્થા વીતાવી તેઓ યુવાવરસ્થા પામ્યા. ત્યારે તેમને કેટલીક સુઝ્પ કન્યાઓ પરણાવવામાં આવી. તેમનું દેહમાન ઉપ ધનુષ્યનું હતું. ૨૩૭૫૦ વર્ષની ઉભરે તેઓ પિતાની રાજગાદીપર આવ્યા. ૨૩૭૫૦ વર્ષ સુધી માંડળીક રાજાપણે રહ્યા. ત્યારપછી આયુદ્ધશાળામાં ચક્રરત્ન ઉત્પત્ત થયું, જે વડે તેમણે છસે વર્ષમાં છ ખંડ જીત્યા અને તેઓ ચક્રવર્તી કહેવાયા. ચક્રવર્તીપણામાં તેમણે ૨૩૭૫૦ વર્ષ રાજ્ય કર્યું, ત્યાર પછી વરસીદાન આપવું શરૂ કર્યું. તે પછી તેમણે એક હજાર પુરુષો સાથે વૈશાક

વહિ પાંચમે સંયમ અંગીકાર કર્યો. ૧૬ વર્ષ છદ્રમસ્થપણે રહ્યા પછી ચૈત્ર શુદ્ધ ત્રીજે તેમને કેવલ્યજ્ઞાન ગ્રામ થયું. તેઓને સ્વયંભૂ પ્રમુખ ઉપ ગણુધરો હતા. કુંથુનાથ પ્રલુના શાસન પરિવારમાં ૫૦ હજાર સાધુઓ એંધો ૧૦૬૦૦ સાધીઓ, ૧૭૮ હજાર આવડો અને ૩૮૧ હજાર આવિક્ષાઓ હતા. ૨૩૭૩૪ વર્ષ સુધી તેઓ કેવલ્ય પ્રવન્નાયોમાં રહ્યા, એ રીતે ૬૫ હજાર વર્ષનું આયુષ્ય પુરું કરી એક હજાર સાધુઓ સાથે સમેત શિખર પર એક માસના અનશને વૈશાખ વદિ ૧ ના રોજ પ્રલુ સિદ્ધ થયા.

૬૯ કુષેરકુમાર

દારિકાના રાજ શ્રીકૃષ્ણના ઓ઱ભાન ભાઈ શ્રી બળલક્ષ્મિની ધારિણી નામક રાણીથી કુષેરકુમાર ઉત્પન્ન થયા. યૌવન વય પામતાં તેઓ ૫૦૦ સ્થીઓ પરણ્યા, પ્રલુ નેમનાથની દેશના સાંભળા વૈરાગ્ય પામ્યા અને શ્રી નેમનાથ પાસે દીક્ષા અંગીકાર કરીને તેમણે ૧૪ પૂર્વનું જીન મેળવ્યું. ૨૦ વર્ષનું ચારિત્ર પાળી શ્રી શત્રુંજય પર્વત પર તેઓ સિદ્ધ થયા. (અંતકૃત)

૭૦ કુંભરાજન

તેઓ ભિથિલા નગરીના રાજ અને ભલ્લીનાથ (મહીકુંવરી) પ્રલુના સાંસારિક પિતા હતા. ભલ્લીકુંવરીના અથાગ ઇપથી મોહ પામી જિતશત્રુ વગેરે રાજઓએ તેની કુંવરી પરણાવવા માટે કુંભરાજ પાસે માગણી કરી. કુંભરાજાએ ના પાડી. તેથી છએ રાજઓએ સંપ કરી ભિથિલા નગરીને ઘેરો ઘાલ્યો. શત્રુનાં અપાર દળ સામે ભિથિલાપતિ ટક્કર ન જીવી શકવાથી તે મહેલમાં ભરાઈ બેઠો. આખરે મહીકુંવરીની યુક્તિથી તેનો લય ફૂર થયો. મહીકુંવરી અને છએ રાજઓએ પાછળથી દીક્ષા લીધી, અને કુંભરાજાએ આવકપણું અંગીકાર કર્યું. (જાતાસ્ક્રત)

૬

૭૧ કુંડકોલિક

કુપીલપુરનગરમાં કુંડકોલિક નામે ગાથાપતિ હતો. તેને પૂણા નામે રીતી હતી. રિદ્ધિસિદ્ધિ પણ ધર્ણીજ હતી. પ્રલુભ મહાવીરનો ઉપદેશ સાંભળી તે પણ કામદેવની માઝુક આવક થયા અને પવિત્ર જીવન ગાળવા લાગ્યા. એકવાર ભાગ્યાન્હકણે પોતાની નામાંકિત સુદ્રિકા (વીઠી) ઉતારીને, પ્રલુભ મહાવીર પાસેથી લીધેલાં વતનું શાંતચિત્તે સમરણું કરતા હતા, તેવામાં એક દેવ તેમની પાસે આવ્યો અને કહ્યું: હે આવક, ગોશાળાનો ધર્મ સાચો છે, અને મહાવીરનો ધર્મ બોયો છે. કેમકે ગોશાળા કહે છે કે ને થવાનું હોય તેજ થાય છે; અને મહાવીર કહે છે કે ઉદ્ઘાત કરવાથી થાય છે. તો ગોશાળાનું કથન સત્ય છે; માટે મહાવીર પાસેથી લીધેલું વત છોડી હે, નાહક તપ્ય જય કરી શા માટે આત્માને શોષે છે ! ત્યારે કુંડકોલિકે કહ્યું:—ધર્મ તો પ્રલુભ મહાવીરનોજ સત્ય છે; હે દેવ, તું અહિંજ જો કે તું દેવની જે રિદ્ધિસિદ્ધિ પાખ્યો, તે શાના પ્રતાપે ? તેં ઉદ્ઘાત ન કર્યો હોત તો તને તેમાંનું કશુષે ન મળત. માટે પ્રલુબનો જ પ્રદેપેલો ધર્મ સત્ય છે, અન્ય ધર્મની હું સ્વપ્નામાંય ઈચ્છા ન કરે. તેની તારે ખાત્રી રાખવી. ઉપર પ્રમાણે સાંભળી દેવ સ્તબ્ધ થઈ ગયો. તેણે કુંડકોલિકની દઢતાના વખાણ કર્યો. પછી તે દેવ ત્યાંથી સ્વરસ્થાનકે ગયો.

ત્યારથાદ પુત્રને ગૃહકાર્યબાર સૌંપી કુંડકોલિક સંસાર કાર્યમાંથી નિવૃત્ત થયા. ૧૧ પ્રતિમા વહન કરીને, એક માસનો સંચારો ભોગવી અણ કરીને તે સૌધર્મ દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયા અને ત્યાંથી મહાવિદેહમાં જન્મ લઈ મોક્ષ પામશે.

૭૨ કુશીસ્વામી

તેઓ ભગવાન પાર્વતીનાથના શિષ્ય હતા. ભતિ, શ્રુત અને અવધિશાની હતા. ચારિત્રવંત, ક્ષમાવંત, મહાતપસ્વી, યશવંત, શાનવંત આદિ અતુપમ લક્ષ્ણો. વડે તેઓ શોલાયમાન હતા. અનેક

શિષ્યોથી પરિવર્તેલા શ્રી કેશી સ્વામી એકવાર આવસ્તી નગરીના તિંદુક નામના ઉધાનમાં પધાર્યા. એજ અરસામાં લગવાન મહાવીરના પ્રથમ ગણુધર શ્રી ઈદ્રભૂતિ ઉર્દે ગૌતમ સ્વામી પણ તેજ આવસ્તી નગરીના ડેષ્ટક નામક ઉધાનમાં અનેક શિષ્યો સહિત પધાર્યા. આ બંને મહાપુરુષોના શિષ્યો શહેરમાં ગૌચરી અર્થે નીકળતા લેગા થયા. બંને જૈનધર્માં સાધુઓ હોવા છતાં એક ખીજનો જુહો જુહો વેશ જોઈ પરસ્પર તેઓને શાંસય થયો કે આનું કારણ શું હશે? ઉલય શિષ્યવંદે પોતપોતાના ગુરુને આ વાત કરી. આથી શ્રી ગૌતમ ગણુધરે વિચાર્યુ કે અ. પાર્શ્વનાથના શિષ્ય મારાથી મોટા ગણ્યાય, માટે નિયમ પ્રમાણે મારે કેશી સ્વામીને વંદન કરવા જરૂર જોઈએ. એમ વિચારી શ્રી ગૌતમ તિંદુક વનમાં શ્રી કેશી ગણુધર પાસે આવ્યા અને તેમને ભાવયુક્ત વંદન કર્યું. કેશી સ્વામીએ પણ તેમનો સત્કાર કરી યોગ્ય આસને ઘેસાડ્યા. આ વખતે શ્રી કેશી અને ગૌતમ ચંદ્રસ્ફૂર્ય જેવા શોલવા લાગ્યા. અન્ય ભતાવલંખીએ આ કૌતક જેવા માટે ઉધાનમાં આવ્યા. જૈનધર્માનુયાધીએ પણ એક ખીજની ચર્ચા સાંભળવાની ઉત્સુકતાથી આવ્યા. દેવલોકના દૈવતાએ પણ ત્યાં આવી પહોંચ્યા. પરસ્પર વાર્તાલાપ શરૂ થયો. તેમાં પ્રથમ કેશી સ્વામીએ શ્રી ગૌતમને પૂછ્યું:—હે ખુદ્ધિમાન! પાર્શ્વનાથ પ્રભુએ ચાર મહાવતરૂપ ધર્મ કહ્યો અને મહાવીર પ્રભુએ પાંચ મહાવત ઇપ ધર્મ કહ્યો, તો આ તથાવતનું શું કારણ હશે?

શ્રી ગૌતમે જવાબ આપ્યો:—સ્વામિન! પહેલા તીર્થકરના સાધુઓ સરળ અને જરૂર હોય છે, છેલ્લા તીર્થકરના સાધુઓ વાંકા અને જરૂર હોય છે, જ્યારે વર્ચ્યેના રર તીર્થકરના સાધુઓ સરળ અને ખુદ્ધિવંત હોય છે. તેથી પ્રભુએ એ પ્રકારનો ધર્મ કહ્યો છે. અર્થાત્ પહેલા તીર્થકરના સાધુઓ ત્વરાએ ધર્મ સમજ શકતા નથી, અને સમજયા પઢી તેઓ સારી રીતે તેની આરાધના કરે છે,

જ્યારે છેલ્લા તીર્થકરના સાધુઓ જઈથી સમજ શકે છે અરા, પરન્તુ આચાર પાલનમાં તેઓ શીથીલ બને છે. તે કારણથી પહેલા અને છેલ્લા તીર્થકરે પાંચ મહાવતો પ્રરૂપ્યા છે અને વચ્ચેના ૨૨ તીર્થકરોએ ચાર મહાવતો પ્રરૂપ્યા છે.

આ જવાબથી કેરી સ્વામી ધણુ સંતોષ પામ્યા. પુનઃ તેમણે ગૌતમની વિનય-લક્ષ્ણ કરીને બીજે પ્રશ્ન પૂછ્યો. તેમણે કર્યું-મહા-
તુલાવ ! પાર્શ્વનાથ ભગવાને બહુમૂલાં અને રંગીન વસ્ત્રો વાપરવાની
સાધુઓને દ્યુટ આપી છે, ત્યારે મહાવીર ભગવાને અલ્ય મૂલ્યવાળાં
અને શ્વેત વસ્ત્ર પહેરવાની સાધુઓને આજ્ઞા કરી છે, તો આનું
કારણ શું હશે ?

શ્રી ગૌતમે જવાખ આપ્યો, કે છેલ્લા તીર્થકરના સાધુઓ વાંકા
અને જડ હોવાથી તેઓને વસ્ત્ર પર મોહલાવ થાય, એ સ્વાલાવિક છે.
અને ૨૨ તીર્થકરના સાધુઓ મોહમાં આસક્ત બને તેવા ન હોવાથી,
રંગીન અને મૂલ્યવાન વસ્ત્રો વાપરવાની આજ્ઞા આપી છે. વળી
લીંગ પણ સાધુપણું પાળવામાં મદદગાર છે, સાધુ આચારથી બ્રહ્મ
થતો હોય, તે વખતે તે પોતાના વેશ પરથી પણ શરમાય
કું હું જૈનનો સાધુ છું, મહારાથી દુષ્કર્મ ન સેવાય. વગેરે વગેરે.

ઉપર્યુક્ત આચાર અને વેશના પ્રશ્નો ઉપરાંત બીજ ધણુ પ્રશ્નો
કેરીસ્વામીએ પૂછ્યા અને શ્રી ગૌતમે તેના સંતોષકારક ખુલાસાએઓ
કર્યાઃ આખી પરિપૂર્ણ પણ આનંદ પામી. ત્યારાદ કેરી ગણુધરે,
ગૌતમ ગણુધર પાસે ચારને બદલે પાંચ મહાવતોનું અંગીકરણ કર્યું.
બને ગણુધર દેવો પોત પોતાના શિષ્ય મંડળ સાથે અન્ય સ્થળે
વિહાર કરી ગયા. થોડાક વખત પછી શ્રી કેરી સ્વામીને કૈવલ્યજીન
થયું અને તેઓ મોક્ષમાં ગયા.

૭૩ કૈકેયી.

અથોધ્યા નગરીના રાજ દશરથની તે રાણી હતી. કૈકેયીને પરણીને આવતાં રસ્તામાં બીજા રાજાએ સાથે દશરથને યુદ્ધ થયું, તે વખતે દશરથ રાજના રથના પૈડાની ભીલી નીકળી ગઈ. આ વખતે સમયસ્યકતા વાપરીને રાણી કૈકેયીએ ભીલીની જગ્યાએ પોતાની આંગળી લરાવીને રથને ચાલુ રાખ્યો. યુદ્ધ પુરુષ થતાં કૈકેયીની આંગળીનો છુંદાઈને કુચો થઈ ગયો હતો. આ જોઈ દશરથ રાજ કૈકેયી પર પ્રસન્ન થયો અને તેણે તેણીને વરદાન ભાગવાનું કહ્યું. કૈકેયીએ તે વરદાન પ્રસંગે માગી ક્રેવાનું દશરથ રાજ પાસેથી વચ્ચેન લીધું. કૈકેયીને ભરત નામે પુત્ર થયો. શ્રી રામચંદ્રજીના રાજ્યારોહણ વખતે કૈકેયીએ પોતાનું વચ્ચેન ભાગ્યું કે શ્રી રામને વનવાસ આપો અને પોતાના પુત્ર ભરતને રાજ્ય આપો. આથી દશરથ રાજને ધણો પશ્ચાત્તાપ થયો; પરન્તુ આપેલા વચ્ચેન પ્રમાણે તેને અનુસરવું પડ્યું. કૈકેયી લોકોના ધિક્કારને પાત્ર બની અને અપમાનિત દશામાં તેને પોતાનું જીવન વીતાવવું પડ્યું.

૭૪ કૈલાસ ગાથાપતિ.

સાંકેતપુર નામક નગરમાં કૈલાસ નામનો ગાથાપતિ રહેતો. તેણે ભગવાન મહાવીર દેવ પાસે ચારિત્ર લીધું હતું. બાર વર્ષ સુધી ઉત્તમ પ્રકારનું ચારિત્ર પાળી તેઓ મોક્ષમાં ગયા.

૭૫ શ્રેણિક.

રાજગૃહી નગરીમાં શ્રેણિક રાજ રાજ્યાસન પર બિરાજતા હતા. શ્રેણિક મહારાજને નંદા નામની રાણીથી અલયકુમાર નામે પુત્ર થયો હતો. તે મહા વિચિક્ષણ અને યુદ્ધિશાળી હતો. તેથી રાજ્યકાર્યભારમાં શ્રેણિક રાજએ તેને સલાહકાર મુખ્ય મંત્રી અનાવ્યો હતો. વૈશાલક નગરીના રાજ અને પ્રભુ મહાવીરના

મામા ચેટકરાજને સાત પુત્રીઓ હતી. તેમાં ચેલણું સુરવર્ષપવાન હોવાથી શ્રેણિક મહારાજએ તેનું ભાગું કર્યું હતું. પણ ચેટક રાજનો નિયમ એવો હતો કે જૈનધર્મનીજ કન્યા આપવી. તેથી રાજ શ્રેણિક નિરાશ થયા હતા. (અધારી શ્રેણિક રાજ બૌદ્ધ ધર્મી હતા) અભયકુમાર શ્રેણિકને વંદન કરવા આવ્યા અને પિતાનું નિરાશ વંદન જોઈ કારણે પૂછતાં શ્રેણિકે ચેલણુને પરણવાની ધર્ચિછા બતાવી. અભયકુમારે પોતાની નિપુણતાથી ચેલણું રાણીને મેળવી આપી. રાજ શ્રેણિક ચેલણુને પરણ્યા અને તેની સાથે સુખ બોગવવા લાગ્યા.

કાળાન્તરે ચેલણું રાણીને ગર્ભ રહ્યો. બાદ ત્રણ મહિને ચેલણું રાણીને રાજ શ્રેણિકના કાળજનું ભાંસ ખાવાનો દોહદ થયો. આ વાત રાણીથી રાજને કેમ કહી શકાય ? તેથી નિરંતર તે રાણી સુકાવા લાગી. એકવાર તેને ચિંતામગન જોઈ શ્રેણિકે પૂછ્યું, ત્યારે તેણે સધળી હકીકત જાહેર કરી. રાજની પણ ચિંતા વધી. અભય કુમારને બોલાવ્યો, અભયકુમારે આશ્વાસન આપી દોહદ પૂર્ણ કરી આપવાનું વચ્ચે આપ્યું.

અભયકુમારે કસાઈખાનામાંથી પશુના ઉદર સ્થાનનું ભાંસ ભંગાવ્યું. રાજ શ્રેણિકને એક પલંગ પર સુવાડી, ભંગાવેલું ભાંસ તેના હૃદયપર કપડામાં વીઠીને બાંધ્યું, અને રાજ શ્રેણિકનું મ્હેં હૃદ્યાય તેવી રીતે તેના પર એક ચાદર ઓઢાડી દીધી. ચેલણું રાણી ને બોલાવીને તે પલંગની પાસેજ એક આસન પર તેને બેસાડી. શ્રેણિક રાજએ મૂર્ખી પામ્યા હોય તેવો હૃદ્યાવ શરૂ કર્યો. અભય-કુમાર પેલું ભાંસ છરી વતી કાઢ્યા જતા હતા, અને તેને એક વાસણું મુકતા હતા. ભાંસ સધળું કપાઈ રહ્યા બાદ અભયકુમારે તે ચેલણુને આપ્યું. ચેલણું રાણીએ તે ભાંસ ખાંધું અને દોહદ પુરો કર્યો. ચેલણું પ્રસન્નતાપૂર્વક ગર્ભનું રક્ષણ કરવા લાગી.

એક વખત ચેલ્લણુંએ વિચાર કર્યો કે આ બાળકે ગલ્ભમાંથીજ પિતાનું માંસ ખવડાવ્યું, આગળ જતાં આ પુત્ર રોા જુલમ નહિ કરે ! માટે આ ગલ્ભનો અત્યારથી જ નાશ કરવો શ્રેયસ્કર છે, એમ ધારી ચેલ્લણું તે બાળકના નાશ માટે ઔષધ ખાવા લાગી, પરંતુ તેમાં તે સંક્ષિપ્ત થઈ નહિ. અનુકૂળે નવ માસે પુત્રનો જન્મ થયો. જન્મ થતાંજ ચેલ્લણુંએ આ બાળકને કુળનાશક ધારીને ઉકરડામાં ફેંકી હેવરાવ્યો. ત્યાં કુકડાએ આ બાળકની આંગળી કરડી ખાધી અને તેમાંથી લોહી વહેતું હતું.

બાળકને ઉકરડામાં ફેંકીને જેવી દાસી પાછી કરતી હતી તેવામાંજ તેને શ્રેણિક રાજ મળ્યા. શ્રેણિકે પૂછતાં દાસીએ સર્વ હકીકત જાહેર કરી. રાજ દાસી સાથે ઉકરડામાં ગયા. ત્યાં આ બાળક હુઃખ્યી રહતું હતું. તરતજ શ્રેણિકે તેની આંગળી મેંમાં ધાલી લોહી ચુસી લીધું અને બાળકને લઈને અંતઃપુરમાં ચેલ્લણું પાસે આવ્યા. ચેલ્લણુંને ઠપકો આપીને આ બાળકનું રક્ષણ કરવાનું કર્યું. ચેલ્લણું રાણી ઉદાસભાવે બાળકનું રક્ષણ કરવા લાગી.

આ બાળકની આંગળી કુકડાએ કરડી ખાધી હતી, તેથી તેનું નામ ‘કુણિક’ પાડ્યું. બાલ્યાવસ્થા વીતાવી કુણિક યુવાવસ્થાને પામ્યો, ત્યારે તેને આડ સ્વીએ પરણાવવામાં આવી. કુણિક યુવરાજપદે હતો, અને રાજ્યકારભારમાં પણ પુરતું લક્ષ આપતો હતો.

એકવાર કુણિકને વિચાર થયો કે જ્યાંસુધી શ્રેણિક રાજ રાખ્યાસન પર છે ત્યાંસુધી મારાથી રાજ્ય ભોગવી શકાશે નહિ, માટે શ્રેણિકને કેદખાનામાં પૂરીને હું રાજગાઢી પર એસું. એવો વિચાર કરી પોતાના ઓરમાન વગેરે દરશ ભાઈએને ખોલાવી પોતાની ઘરચિંહા જાહેર કરી. સર્વએ અનુમતિ આપી.

પ્રસંગ સાધીને કુણિકે શ્રેણિક મહારાજને કેદખાનામાં પૂરી દીખા, અને પોતે રાજ્યગાઢી પર એસી ગયો. પછી તેણે નગરમાં પોતાની

સખત ધાક એસાડી દીધી. કોઈપણ ભાણુસ શ્રેણિક રાજને મળવા જર્ચ શકે નહિ, તેમજ તેમને ખાનપાન આપવાનું પણ કુણિકે બંધ કરાવ્યું, આ સાંલળવાથી ચેલલણા રાણીના દુઃખનો પાર રહ્યો નહિ, તે ખુબ આર્ત ધ્યાન કરવા લાગી. પણ શો ઉપાય? છતાં તેણી હિમતવાન બનીને કુણિક પાસે ગઈ, અને શ્રેણિકને મળવા જવાની રજ ભાગી. કુણિક ના કહી શક્યો નહિ, તેથી ચેલલણા રાણી રોજ શ્રેણિકને મળવા જય અને છાની રીતે ખાવાનું લઈ જઈને તેમને આપે.

આ પ્રમાણે કેટલાક દિવસ વીતી ગયા. કુણિકને એક પુત્ર હતો. તેના પર કુણિકને ઘણીજ પ્રીતિ હતી. તે બાળકને રમાડતો હતો. પાસે ચેલલણા રાણી એટલી હતી. તેને જોઈને કુણિક બોલ્યો: હે માતા, મારા એટલી પ્રીતિ જગતમાં કોઈને પુત્ર પર હશે? રાણી ચેલલણાએ જવાય આયો:-કુણિક, પુત્ર પ્રેમ તો મહારાજ શ્રેણિકનો! ભાકીનો બીજનો પ્રેમ તો સ્વાર્થી અને ક્ષણિકજ. કુણિકે કારણ પૂછ્યું. રાણી ચેલલણાએ કુણિકનો લુવનવૃત્તાંત કલ્યો અને કહ્યું કે શ્રેણિકનાજ પ્રતાપે તું જવતો રહ્યો છે, નહિ તો ક્યારનોયે સ્વધામ પહોંચ્યો ગયો હોત. વળી રાન્ય પણ તનેજ આપવાની દંચિઠા મહારાજ શ્રેણિકની હતી. પણ તું તો બહુ સારો પુત્ર થયો, એટલે રાન્યલોભને ખાતર પિતાને કેદમાં પુરતાં પણ તને દ્યા ન આવી. આ સાંલળી કુણિક ક્ષણુભર સ્થંભી ગયો અને પોતાના પ્રેમાળ પિતાને દુઃખ આપ્યા બદલ પશ્ચાતાપ કરવા લાગ્યો. તરતજ તે ચેલલણા રાણીને કહીને શ્રેણિકને કેદખાનામાંથી દૂસ્તા કરવા માટે દોડચો. લુહારને બોલાવવા જતાં મોહું થાય તેથી તે પોતે હાથમાં એક ક્ષાણનો દંડ લઈને જેલ તરફ રવાના થયો.

શ્રેણિકરાજ કર્મની વિચિત્ર સ્થિતિ ઉપર વિચાર કરતા હતા અને પોતે પાછળથી જૈનધર્મી અન્યાથી સધળું દુઃખ સમલાવ

પૂર્વક સહન કરતા હતા, તેવામાં રાજ એણિકે કુણિકને હાથમાં ખોઢાનો દંડ લઈ જલ્દીથી પોતાની સામે દોડતો આવતો જોયો. એણિકે વિચાર કર્યો કે ખરેખર, આ પુત્ર બાપનો પૂર્વલખનો વૈરીજ છે; અને જરૂર ભારો અથંકર રીતે તે સંહાર કરશે, તેથી પુત્રના હાથથી ભરવું તેના કરતાં પોતે જતેજ ભરી જવું બહેતર છે, એમ ચિંતવી તેણે તાલ પુટ વિષ પોતાના મહેંભાં નાખ્યું અને ભરણુને શરણું થયો.

કુણિક, પિતાના પાંજરા પાસે પહોંચ્યો, ત્યાં તો એણિક ને મૃત અવસ્થામાં જોયો. અંતિમ સમયે પણ પિતાનો મેળાપ ન થયો. જાણ્ણી તરતજ તે મૃધ્યા આઈ જમીન પર પડી ગયો. શુદ્ધિમાં આવતાં તે આકંદ વિલાપ કરતો પોતાના પાપનો પશ્ચાતાપ કરવા લાગ્યો. ધેર આવી ચેલખણાને વાત કરી. ચેલખણા પણ હુઃખ પાની. કાળાન્તરે કુણિક શોકમુક્તા થયો. અને રાજ જોગવવા લાગ્યો.

૭૬ કૌશલ્યા.

અયોધ્યાના દ્શરથ રાજની તે રાણી અને શ્રી રામચંદ્રજીની માતા હતી. તે મહા પતિત્રતા અને ધર્મપરાયણ હતી. સોળ સતીઓની પ્રશસ્તિમાં તેતું નામ સુખ્ય છે. તેતું શોક્ય પ્રત્યેતું, શોક્યના પુત્રો પ્રત્યેતું અને ધર્તિર જનો પ્રત્યેતું પ્રશસ્તિની વર્તન એજ તેનાં ઉદારપણાનો પરિચય કરાવે છે. કૌશલ્યા જીવી સત્તારીઓ આ જગત પર જન્મે અને ગ્રેમ-વાત્સલ્યથી પોતાની સુમધુરતાનો પરાગ જગત પર વહેતો કરે એજ બોધ કૌશલ્યાના જીવનમાંથી સૌ કોઈને મળે છે.

૭૭ કંસ.

મથુરા નગરીમાં ઉગ્રસેન રાજ રાજ્ય કરતો. તેને ધારિણી નામની રાણી હતી. તેનાથી કંસનો જન્મ થયો. કંસ જ્યારે ગર્ભમાં હતો, ત્યારે તેની માતા ધારિણીને પિતાના કાળજનું માંસ

આવાનો દોહુદ થયેલો. આથી ગલ્બને અનિષ્ટકારી સમજ, કંસનો જન્મ થતાંજ રાખુંએ તેને કંસાની પેરીમાં ધાલી, કંસના પિતાના નામની સુદ્રિકા તેને પહેરાવી, નદીમાં તરતો મૂક્યો. તરતી તરતી તે પેરી સૌરીપુરતા એક વણિકને હાથ આવી, તેણે તેમાંથી આ ભાગકને કાઢ્યો અને તેનું પાલન કરવા લાગ્યો. આગળ જતાં તે તોશાની થવાથી વણિકે તેને વસુહેવ રાજને સોંઘ્યો. વસુહેવે તેને યુદ્ધકળા શીખવી. ત્યારપછી કંસે સિંહરથ રાજને પકડ્યો અને જીવયશા નામક રાજકન્યા પરણ્યો. પછી તેણે ઉત્ત્રસેન પાસેથી ભયુરાનું રાજ્ય મેળવ્યું, અને પિતાને કેદમાં પૂછ્યો. વસુહેવ અને કંસને ભિત્રાચારી હતી. આ ભિત્રાચારીના બદલામાં કંસે પોતાના કાકા દેવક રાજની દીકરી દેવકી વસુહેવને પરણ્યાવી.

આ ઉત્સવ વખતે જીવયશાએ અતિમુક્ત મુનિની મશ્કરી કરેલી, તેના બદલામાં અતિમુક્ત મુનિએ તેને કર્યું કે આ દેવકીનો સાતમો ગલ્બ તમારા કુળનો અને તમારા પતિનો નાશ કરશે. આથી જીવયશા ગલરાઈ ગઈ. આ વાત તેણે પોતાના પતિ કંસને કહી. કંસે દેવકીની સુવાવડો પોતાને ત્યાં કરાવી; પરન્તુ તેનો નાશ કરનાર કૃષ્ણ તે દૈવયોગ જીવતો જ રહી ગયો. દેવકીને અવતરેલા પ્રથમના છ ગલ્બો માયા વડે સુલસાને ત્યાં મૂકાયા હતા, અને સુલસાના મૃત ભાગકો દેવકીની ગોદમાં પડ્યા હતા, જેને પત્થર સાથે અક્ષળાને કંસ પોતાના વૈર બદલ સંતોષ પામીને હેંકી દેતો. સાતમા શ્રી કૃષ્ણનું સાહરણ દેવે ગોકુળમાં નંદ નામના ગોવાળની યશોદા નામક સ્વિને ત્યાં કર્યું અને યશોદાને જન્મેલી પુત્રી દેવકીની ગોદમાં મુકી. દેવકીને ભાગક અવતર્યાની ખર પડતાં કંસ ત્યાં આવ્યો અને મુનિનું વચ્ચે જ્યુદું માની, તેણે તે પુત્રીનું નાક છેદી, દેવકીને સુપ્રત કરી. આગળ જતાં જયારે શ્રી કૃષ્ણ દારિકાના રાજ થયા અને પોતાના માતા

પિતાને બોલાવ્યા, ત્યારે કોઈ ભીજ એક નૈમિત્તિકને કંસે કહું કે આ જગતમાં મને ભારનાર હવે કોઈ છે ? ત્યારે તે નૈમિત્તિક મુનિતું કહેલું વચન ભિથ્યા ન જય. માટે તું તારો અશ્વ અને બળદ દ્શ્ટા સુક તેને, તેમજ તારા ભલ્લને જે કોઈ ભારશે તે તારો વૈરી સમજવો. આથી કંસે અશ્વ અને બળદ દ્શ્ટા મુક્યા, તેને શ્રી કૃષ્ણ અને બળલદ્રે માર્યા. પરંતુ કંસના જાણવામાં આ આવ્યું નહિ. તેથી તેણે પોતાની એન સત્યભામાના સ્વયંવરની રચના કરી. તેમાં ધણા રાજાઓ આવ્યા. વસુદેવે પણ પ્રસંગ જાણી પોતાના લાઈ સમુદ્ર-વિજ્ય વર્જેરેને બોલાવ્યા. શ્રી કૃષ્ણ અને બળદેવ પણ ત્યાં ગયા. તેમણે નગરમાં પ્રવેશતાંજ દરવાજ પર ઉન્મત હાથીને માર્યો, આથી કંસ વધારે સાવધાન થયો. કૃષ્ણ બળલદ સ્વયંવર મંડપમાં આવ્યા, ત્યાં ભક્ત સાથે યુદ્ધ કરી ભક્તને માર્યો. આખરે કૃષ્ણે કંસ ઉપર હુમલો કરી તેને પણાડ્યો અને તેના પર ચડી ત્યાં જ તેને મારી નાખ્યો. ત્યાર પછી ભથુરાનું રાજ્ય રાજ ઉત્ત્રસેન જે કેદમાં હતા તેમને આપ્યું અને શ્રી કૃષ્ણ સત્યભામાને પરણ્યા. આખરે દુષ્ટ કર્મ સેવનાર કંસ મૃત્યુ પામી નરકમાં ગયો.

૭૮ ખંધક મુનિ.

આવસ્તિ નગરી. જાતશત્રુ રાજ, તેમને ધારિણી નામે સ્ત્રી. તેમને એક પુત્ર અને એક પુત્રી. પુત્રનું નામ ખંધકુમાર અને પુત્રીનું નામ પુરંદરયશા, અને ઉમ્મર લાયક થયાં. ખંધકુમાર ખૂબ લણ્યા. તેમનામાં ધર્મના સંસ્કારો પણ ધણ્યા સારા. જૈન ધર્મમાં તેમને સંપૂર્ણ અદ્ધા હતી. પુરંદરયશાએ પણ જ્ઞાન સારું મેળવ્યું. પુત્રીની પુષ્ત ઉમ્મર થવાથી દંડક દેશમાં કુંભકાર નામની નગરીમાં દંડક રાજ સાથે તેનું લગ્ન કર્યું. તે દંડક રાજને પાલક નામનો એક પ્રધાન હતો. તે અલવી અને જૈન ધર્મનો દેખી હતો. એકવાર તે

આવસ્તિ નગરીમાં આવ્યો. ત્યારે ખંધક કુમારે જૈન ધર્મની ધર્થી પ્રશંસા કરી. આ તેનાથી ખમાયું નહિ. તેણે જૈન ધર્મની નિદા કરવા માંડી. પણ ખંધક કુમારની વિદ્વતા આગળ પાલક હારી ગયો તેથી ખંધક પર તેને વેર ખંધાયું. અને તે વેર વાળવાના નિશ્ચય પર આવીને પોતાને ગામ કુંલકારમાં આવ્યો.

એકદા પ્રસ્તાવે શ્રી મુનિસુવતસ્વામી આવસ્તિ નગરીમાં પધાર્યા. પરિષદ વંદન કરવા ગઈ. ખંધક કુમાર પણ ગયા, પ્રભુએ ધર્માધ આવ્યો. ખંધક કુમાર પ્રતિષ્ઠાધ પામ્યા અને ભાતા પિતાની રજા લઈ ૫૦૦ માણુસો સાથે પ્રભુ પાસે દીક્ષા લીધી અને શાન ધ્યાનમાં વિચરવા લાગ્યા.

એકવાર ખંધક મુનિએ પોતાની એનને ઉપરેશ આપવા માટે પાંચસો શિષ્યો સાથે દંડક દેશમાં જવાની પ્રભુ પાસે આજા માગી. પ્રભુ તો સર્વજ્ઞ હતા, એટલે કહ્યું કે હે ખંધક મુનિ, તમે ત્યાં જરોણ તો તમારા પર મૃત્યુનો ઉપસર્ગ આવશે. અને તે ઉપસર્ગ તમને અકલ્યાણકારી અને ભીજને કલ્યાણકારી નીવડશે. ત્યારે ખંધકે કહ્યું. પ્રભુ, મારા અહિતની સાથે ભીજનું હિત હોય તો હું જવા હરિધૂં છું. પ્રભુએ કહ્યું:-નેમ સુખ ઉપને તેમ કરો.

ખંધક મુનિ પોતાના ૫૦૦ શિષ્યો લઈને દંડક દેશ પ્રતિ પ્રયાણ કરવા લાગ્યા અને ગ્રામાનુગ્રામ વિહાર કરતાં દંડક દેશના કુંલકાર નગરના ઉદ્ઘાનમાં આવી ઉત્તર્યા. આ વાતની પેલા પાલકને અભર પડી. તેથી તેણે વેર ક્ષેવા માટે એક રાત્રીએ તે બગીચાની બાળુમાં માણુસો દ્વારા જમીન બોદાવીને તેમાં હથીયાર નંખાવ્યા. અને પછી રાજ પાસે નાઈને વાત કરી કે ખંધક કુમાર દીક્ષા લઈને આપણા ઉદ્ઘાનમાં આવ્યા છે, પણ તેનો વિચાર આપણને મારી આપણું રાજ્ય લઈ ક્ષેવાનો છે. રાજએ પાલકને કહ્યું કે તેની કંઈ સાધીતી છે ? પાલકે ઉત્તર આવ્યો, હા, જુઓ, તેમની સાથે પાંચસો

મુનિ વેશમાં માણુસો છે, અને બગીચામાં હથીયાર દાટચા છે, ચાલો હું તમને બતાવું. રાજને પાલકના આ કપટની ખખર ન હતી. રાજ ત્યાં ગયો અને પાલકે હથીયાર બતાવ્યાં. તેથી રાજ કોધે ભરાયો અને ક્રાવે તે શિક્ષા કરવાનું પાલક પ્રધાનને જણાવી દીધું.

પ્રધાને બગીચામાં એક ધાણી ઉલ્લી કરાવી અને ખંધક આદિ પાંચસે શિષ્યોને જણાવી દીધું કે રાજના તમે ગુનહેગાર છો, તેથી આ ધાણીમાં તમને ખધાને પીલીને મારી નાખવાના છે, માટે ખધા ભરવા માટે તૈયાર થઈ જવ. આ સાંલળી ખંધક આદિ અણુગારો વિચારમાં પડી ગયા; ખંધકે જાણ્યું કે પ્રલુબે કહેલો આ ભરણુંતિક ઉપસર્ગ આવ્યો. કર્મ ક્રોધિને છોડવાનું નથી. તેથી તેમણે પાંચસે શિષ્યોને ધમણોધ આપીને ભરવા માટે તૈયાર થઈ જવાનું કહ્યું. સધળા શિષ્યો તૈયાર થયા. પાલકે એક પછી એક ૪૮૮ મુનિ-ઓને ધાણીમાં પીલ્યા. મુનિઓ આત્મભાવના ભાવતાં કૈવલ્યજ્ઞાન પામી મોક્ષમાં ગયા. હવે પાછળ ખંધક મુનિ અને તેમના નહાના ગ્રિય શિષ્ય બાકી રહ્યા. ખંધક મુનિને ધણું લાગી આવ્યું, તેથી તેમણે પાલકને કહ્યું, કે મહને આ શિષ્ય ઉપર ધણો પ્રેમ છે, માટે પહેલાં મને ધાણીમાં પીલી નાખ, અને પછી આ શિષ્યને પીલને, ત્યારે પાલકે કહ્યું. તમને હુઃખ આપવા માટેજ મેં આ બધું કર્યું છે, અને જેમ તમને વધારે હુઃખ ઉપને, તેમ કરવાનો મારો ધરાહો છે, માટે મારે પ્રથમ તે શિષ્યને જ પીલવાનો છે. એમ કહી શિષ્યને પાલકે ધાણીમાં ધાલી પીલી નાખ્યો. તે શિષ્ય પણ શુલ ધ્યાનના ચોગથી કૈવલ્યજ્ઞાન પામી મોક્ષમાં ગયો. પછી ખંધક મુનિનો વારો આવ્યો. પાંચસે શિષ્યોના ભયંકર રીતે જન જવાથી ખંધક મુનિને ધણો કોધ ચડ્યો. તે બોલ્યા કેળે મારા તપ સંયમનું ક્રિ હોય તો હું આવતા ભવમાં આ દંડક દેશને બાળનારો થાઉં. આવું નિયાણું કરો ખંધક મુનિ ધાણીમાં પીલાયા અને મૃત્યુ પામીને અગ્નિકુમાર

નામે દેવ થયા. નિયાણા મુજબ અજિનકુમાર દેવે દંડક દેશ આળા ભૂક્યો અને ત્યારથી દંડકારણ હાલ કહેવાય છે.

૭૩ ખંધક સાન્ધ્યાસી.

તેઓ આવસ્તી નગરીમાં ગઈ નામના પરિવાજકના શિષ્ય હતા. ચાર વેદાદિ છ શાસ્ત્રમાં પારંગત હતા. એકવાર પ્રભુ મહાવીરના પીંગળ નામના સાધુ સાથે તેમનો મેળાય થયો, તે વર્ષતે પીંગળ મુનિએ ખંધકને પૂછ્યું કે આ લોક અનંત છે કે અંત સહિત છે? જીવ અંત સહિત કે અંત રહિત છે? સિદ્ધશિક્ષા અંત સહિત છે કે રહિત છે? સિદ્ધના જીવો અંત સહિત છે કે રહિત છે? અને કેવા મરણથી જીવ સંસાર વધારે તથા કેવા મરણથી જીવ સંસાર ઘટાડે? આ દશ પ્રશ્નો પૂછ્યા. તેનો જવાય ખંધક પરિવાજક આપી શક્યા નહિ, આથી તેમની મુંજવણુ વધી. એવામાં આવસ્તી નગરીના લોકો બોલવા લાગ્યા કે ભગવાન મહાવીર અહિથી યાડેક દૂર કયંગંલા નગરીમાં પદ્ધાર્યા છે. આ વાત સાંલળા ખંધક પ્રભુ મહાવીરના દશને જવા ચાલી નીકળ્યા; એ અરસામાં ભગવાન મહાવીર દેવ જૌતાને કહ્યું કે તમારો પૂર્વસ્નેહી ખંધક પરિવાજક અહિથા આવે છે. આથી શ્રી જૌતમે પ્રશ્ન કર્યો:-પ્રભુ, તે અહિં કૃતારે આવશે અને આપની પાસે તે સાધુપણું અંગીકાર કરશે કે કેમ? જવાયમાં ભગવંતે કહ્યું:- આવસ્તી નગરીનો ધર્મો ભાગ તે વટાવી ચૂક્યો છે અને તે મારી પાસે પ્રવર્નિત થશે. આ સાંલળા શ્રી જૌતમ તે ખંધકનો સતતાર કરવા સાખા જવા નીકળ્યા, ત્યાં સમવસરણ નજીક ખંધકનો મેળાય થયો. શ્રી જૌતમે ખંધકને પૂછ્યું:-તહમે ‘લોક અનંત છે કે અંત સહિત છે’ વગેરે પ્રશ્નોનું નિરાકરણ કરવા આવ્યા છે? ખંધકે કહ્યું:-હા, તહમે કેમ નાણ્યું? જૌતમે કહ્યું:-મારો ધર્માચાર્ય, ધર્મગુરુ શ્રી મહાવીર દેવ પાસેથી મેં નાણ્યું. ખંધકે કહ્યું: ત્યારે ચાલો,

આપણે શ્રી મહાવીર દેવ પાસે જઈએ. ખંને જણા પ્રલુભ મહાવીર પાસે આવ્યા. ખંધકે પ્રલુને વિનયપૂર્વક વંદન નમરકાર કર્યાં અને તેમની સન્મુખ એ હાથ જોડી ઉલા રહ્યા. તરતજ પ્રલુએ કહ્યું:-હે આર્ય ! પીગળ નામના સાધુએ તેમને કે દરે પ્રશ્નો પૂછ્યા છે તેના ઉત્તર આ પ્રમાણે છે. એમ કહી પ્રલુએ તે દરે પ્રશ્નોના વિસ્તાર પૂર્વક જવાબ આપ્યા. તે સર્વાંગી ખંધક સંન્યાસી સંતોષ પામ્યા. ત્યાર પછી પોતાને વીતરાગ ધર્મ સંલગ્નાવવાની ખંધકે પ્રલુને વિનંતિ કરી એટલે પ્રલુએ તેમને પંચમહાવત ઇપ સાધુ ધર્મ સંલગ્નાવ્યો. આથી ખંધકને જૈનધર્મની પ્રવન્યા ક્ષેવાની અલિલાપા થઈ. તરતજ તેમણે પોતાનો પરિપ્રાન્જક વેશ દૂર કર્યો અને પંચમુણ્ઠ લોચ કરી પ્રલુસભીપ ઉલા રહી પોતાને જૈન ભતની દીક્ષા આપવાની પ્રલુને વિનંતિ કરી, એટલે ભગવાને તેમને દીક્ષા આપી. તે પછી ખંધક મુનિએ સામાયકાદિ ૧૧ અંગનો અભ્યાસ કર્યો. ત્યારબાદ લિઙ્ગની આકરી બાર પ્રતિમાએ આદરી અને ગુણ-સંવત્તસર નામક મહાત્મા કરી શરીરને શોસવી નાખ્યું. શરીર છેકજ દુર્ભણ થઈ જતાં, તેમણે પ્રલુની રણ લઈ રાજગૃહી પાસેના વિપુલ-ગિરી પર્વત પર આવી સંથારો કર્યો. એક ભાસના સંથારાને અંતે, એકંદર ૧૨ વર્ષનો સંયમ પાળો તેઓ કાળધર્મ પામ્યા અને બારમા દૈવકોઊમાં દેવ થયા. ત્યાંથી મહાવિદ્ધ ક્ષેત્રમાં જન્મ લઈ તેઓ મોક્ષમાં જરો.

૮૦ ગગ્નિયાર્થ.

જૈન સંતપુરુષોમાં પૂર્વકાળે ગર્ભ નામના મહા વિદ્વાન આચાર્ય વિચરતા હતા. તેમને ધણા શિષ્ય થયા હતા; પરન્તુ પૂર્વના કર્મ-સંયોગે બધાયે શિષ્યો અવિનિત અને ગુરુને અસમાધિ ઉપજવે તેવા હતા. આથી ગુરુ તે સર્વ શિષ્યોનો ત્યાગ કરીને એકલવિંહારી

થયા, અને પ્રભુની આજા પ્રમાણે સમાધિપૂર્વક વિચરવા લાગ્યા. સુકોમળ, વિનિત, નિરલિમાની, સમતાવાન, ચારિત્રવાન એવા અનેક ગુણોથી અલંકૃત તે મુનિ તપ અને ચારિત્રને દીપાવતા ક્ષપક શ્રેણિમાં પ્રવેશી ડૈવલ્યજાન પામ્યા અને સાક્ષાત્ ગયા.

૮૧ ગજસુકુમાર.

સાક્ષાત દેવલોક સમી દારિકા નામની નગરી હતી. એકદા શ્રી અરિષ્ટને અભિભાવ કરતા ત્યાં પદ્ધાર્યો. તેમની સાથેના સાધુ સમુદ્દરમાં છ સાધુઓ બીજા પણ હતા. જેઓ એક ઉદરથી જન્મેલાં સગા ભાઈઓ હતા. તે છેચે ૩૫, ૨૫, ઉંમરમાં એકજ સરીઓ સુરોલિત અને સુકોમળ હતા. તેઓ દીક્ષા લઈને તરતજ છઠછઠની તપશ્ચર્યા કરી વિચરતા હતા. એકવાર છઠના પાર-ખાને દિવસે પ્રભુની આજા લઈ તેઓ છ જણા બધ્યે જણની જુદી જુદી ત્રણ ટુકડીઓ કરી દારિકા નગરીમાં લિક્ષાર્થે નીકળ્યા. તેમાં પ્રથમ એ સાધુઓની જેડીએ વસુદેવ રાજની દેવકી રાણીના મહેલમાં ગૌચરી અર્થે પ્રવેશ કર્યો. દેવકીજ આ એ મુનિવરોને જોઈ આનંદ પામી અને નમસ્કાર કરીને તેમને ભોજનગૃહમાંથી લાડુ લાવીને વહેરાવ્યા. આ મુનિઓ ગયા બાદ બીજી જેડી ઇરતી ઇરતી દેવકીજને ત્યાં આવી પહોંચ્યી. દેવકીજએ માન્યું કે આ જેડી ઇરીવાર અહીંએ કેમ આવી ? છતાં કંઈપણ પૂછ્યા વગર તેમને પણ લાડુ વહેરાવ્યા. બીજી જેડી પણ ત્યાંથી ચાલી ગઈ. ત્યારથાદ ત્રીજ એ સાધુની જેડી પણ લિક્ષાર્થે ઇરતી ઇરતી દેવકીજને ત્યાં જ આવી. દેવકી-જાએ વંદન કર્યું અને આહારપાણી વહેરાવી પૂછ્યું: અહો, ભહાતમન, શ્રીકૃષ્ણ વાસુદેવની આ વિશાળ દારિકા નગરીમાં આપને આહારની પ્રાપ્તિ શું ન થઈ, કે જેથી એકજ ધરમાં ત્રણ ત્રણ વખત આપને આવવું પડ્યું ? ઉક્ત મુનિવરો દેવકીનું કથન સમજ ગયા અને કહ્યું,

હે દેવાતુંશ્રિય ! આ નગરીમાં અમને આહારપણાણી ન મળે એવું કંઈ નથો. વળી અમે તો આ પહેલીજ વાર અહિ આવ્યા છીએ. અમારા પહેલા આવેલા સાધુઓ અમે નહિ પણ બીજાજ. તે સાંભળી આશ્વર્ય પામી દેવકીજ ઓલ્યાઃ—મહારાજ, ત્યારે આપ બધા એકજ સરીઓ લાગે છો તો આપ કોણુ છો તે કૃપા કરી કહેશો ? સાધુઓ ઓલ્યાઃ—અમે ભદ્રીલપુર નગરના રહેવાસી, નાગ ગાથાપતિ અને સુલસા દેવીના છ પુત્રો, એકજ ઉદરથી ઉત્પત્ત થયા છીએ, અને દીક્ષા લઈને છઠાઠના પારણુ કરીએ છીએ. આજે પારણાનો દિવસ હોવાથી અમે છ સાધુઓની જુદી જુદી ત્રણ જેડી કરીને લિક્ષાર્થી નીકળ્યા છીએ. એટલું કલ્યા આદ તેઓ ત્યાંથી ચાલ્યા ગયા.

દેવકીજ વિચારમાં પડ્યા કે અતિમુક્ત સાધુએ મહને કહેલું કે તમે નળકુએર સરીઓ સુસ્વરૂપવાન આઠ પુત્રોને જન્મ આપશો અને તેવા પુત્રો આ ભરતક્ષેત્રમાં કોઈ માતા જન્મશે નહિં. તો શું તે મહાત્માનું વચન ભિથ્યા ગયું ? કેમકે મને લાગે છે કે મહારા કૃષ્ણ વાસુદેવ જેવા પુત્ર જન્માવનાર બીજી માતા હજુ ભરતક્ષેત્રમાં છે. માટે હું શ્રી નેમનાથ ભગવાનને પૂછી આ શંકાનું સમાધાન કરું.

એમ ધારી દેવકીજ રથમાં એસી પ્રલુબ પાસે આવ્યા અને વંદન કર્યું. તરતજ પ્રલુબે કહ્યું, હે દેવકીજ, તહમને સંદેહ થયો હતો કે અતિમુક્તમુનિનું વચન ભિથ્યા ગયું ? દેવકીજએ કહ્યું, સત્ય વાત છે ભગવાન !

ભગવાને કહ્યું:—ભદ્રીલપુર નગરમાં નાગ નામે ગાથાપતિને સુલસા નામે સ્વી હતી. સુલસાને નહાનપણુંભાં એક નિમિત્તિયાએ કહ્યું હતું કે તહેને અરેલાં ખાળકો અવતરશે. ત્યારથી સુલસા હરિણ-ગમેધી દેવની આરાધના કરવા લાગી. દેવ પ્રસન્ન થયા. દેવકીજ, તમે અને સુલસા બને એકી જ સાથે ગર્ભ ધારણુ કરતાં. તે વખતે સુલસા

મરેલાં બાળકો જન્મતી, અને તેમે જીવતા બાળકોને જન્મ આપતા. હરીણગમેષી દેવ તમારાં બાળકોને ઉપાડી સુલસાના ગર્ભમાં મુક્તો. અને તેનાં મૃત બાળકો તહમારા ગર્ભમાં સાહરણુ કરીને મુક્તો. અને એવી રીતે તમે મૃત બાળકોને જન્મ આપતાં, હે દેવકીજી ! આ છે સાધુ તહમારાં પુત્રો છે અને અતિમુક્તામુનિનું વચન મિથ્યા નથી ગયું. આ સાંલળી દેવકીજીના આનંદનો પાર ન રહ્યો. તત્કાળ દેવકીજી, ત્યાંથી ઉત્તી પ્રભુને વંદન કરી તે છ સાધુ પુત્રોને વંદના કરવા આવી. છ પુત્રોના વાતસલ્ય પ્રેમથી દેવકીજીના સ્તનમાંથી ફૂખની ધારાઓ દ્શ્યી અને પોતે ધણાજ હર્ષથી પ્રકૃતિલિત ઘની, ત્યાંથી પ્રભુને વંદન કરી સ્વરસ્થાનકે ગઈ.

રાજમહેલ તેને સમશાનવત્ત જણાયો. તેને પુત્રો માટે બહુજ લાગી આવ્યું. તે મન સાથે એાવવા લાગી. અહો, ધિક્કારછે મહને, સાત સાત પુત્રો છતાં હું બાળ-પાલનનો લાલ મેળવી શકી નહિ, છ પુત્રોએ તો દીક્ષા લીધી, અને કૃષ્ણ પણ મહને છ મહીને વંદન કરવા આવે છે. ધન્ય છે એ માતાને, જે પોતાના બાળકોને રમાડે છે, સ્તનપાન કરાવે છે, ગોદમાં લે છે, હજ્જાવે છે, હું તો હત-ભાગિની અને પાપી છું. એમ વિચારતી તે આર્ત્થાન કરવા લાગી. તેવામાં શ્રીકૃષ્ણ આવી પહોંચ્યા. માતાને ચિંતાનું કારણ પૂછ્યું. દેવકીજીએ પુત્ર ધર્મા બતાવીને કારણ જણાવ્યું. ત્યાંથી શ્રીકૃષ્ણે અઠમ કરી દેવનું આરાધન કર્યું. આથી દેવ આવ્યો. શ્રી કૃષ્ણે પોતાને એક ભાઈની માગણી કરી. દેવે જણાવ્યું કે દેવકીજીને પુત્ર થશે; પણ યુવાન થતા તે દીક્ષા થશે. કૃષ્ણે કહ્યું. શીકર નહિ. ‘તથારસુ’ કહી દેવ ગયો. શ્રીકૃષ્ણે માતા પાસે આવી આશ્વાસન આપ્યું. દેવકીજીને ગર્ભ રહ્યો, નવ મહીને પુત્રનો પ્રસવ થયો. દેવકીજીના આનંદનો પાર રહ્યો નહિ. પુત્ર ડ્રપર્દ્યનો અવતાર, નામ પાડ્યું ગજસુકુમાર. કુમાર દિવસે ન વધે એટસો રાત્રે વધે, અને

રાત્રે ન વધે એટકો દિવસે વધે. દેવકીજીએ બાળસ્નેહના મીડાં કોડ પૂરા કર્યાં. બાળયાવસ્થા વીતાવી કુમારે યૌવનાવસ્થામાં પ્રવેશ કર્યો.

દારિકા નગરીમાં સોમિલ નામે આલણું હતો, તેને સોમા નામે એક પુત્રી હતી. તે રૂપરૂપનો લંડાર હતી. શ્રીકૃષ્ણે એકદા તેને જોઈ. ગજસુકુમાર સાથે લગ્ન કરવા ધર્યાયું. સોમાને લઈ રાજમહેલમાં સ્થાપી અને લગ્ન કરવાનો નિશ્ચય કર્યો. તેવામાં અરિષ્ટને ભિ લગવાન પધાર્યા. શ્રીકૃષ્ણે તથા ગજસુકુમાર વંદન કરવા ગયા. પ્રલુએ ધર્મભોધ આપ્યો. ગજસુકુમાર વૈરાગ્ય પામ્યા. ધેર આવી દીક્ષાનો રજન માગી. માતા તથા શ્રીકૃષ્ણે દીક્ષા નહિ દેવા ધણું સમજાવ્યા. પણ જેનું હૃદય વૈરાગ્યરસથી તરફોળ અની ગયું હોય તેને શું? દેવકીજીએ સોમા સાથે લગ્ન કરવાનું કર્યું, પણ જેના હૃદયમાં વિકારમાત્રને સ્થાન ન હોય તેને શું? આખરે રજ મળી. ગજસુકુમારે માતા, પિતા, લાઈ, સગાં, સ્ત્રી, રાજવૈભવ, એ તમામતો ત્યાગ કરી પ્રલુ પાસે દીક્ષા લીધી. પોતાના કર્મને જલદીથી ખાળી, ભર્મ કરી, જન્મ, જરા, મૃત્યુના લયંકર દુઃખોથી જેમને અચ્યાનું છે તે શું શું નથી કરતા? ગજસુકુમાર પ્રલુની આજા લઈ તેજ રાત્રીએ સ્મરણનમાં ગયા, અને બારમી લિક્ષુક પ્રતિમા ધારણ કરીને કાયોત્સર્ગ ધ્યાનમાં સ્થિર થઈને રહ્યા અને ઉત્તમ ભાવના ભાવવા લાગ્યા.

ગજસુકુમારની દીક્ષાની વાત પેલા સોમિલ આલણું જણી, તેથી તેને ધર્ણોજ કોધચડયો. પોતાની પુત્રીને રખડતી મૂકી તે માટે તેને ધણુંજ લાગી આવ્યું અને વૈર-ભાવના તેવામાં જગૃત થઈ. સોમિલ આલણું લમની તૈયારી કરવા માટે દીક્ષા સમય પહેલાં અહાર ગયેલ, અને છેક મોડી રાત્રે તે સ્મરણ આગળ થઈને ધેર જતો હતો; તેવામાં ત્યાં ગજસુકુમારને ધ્યાનરથ જોયા. જેતાંજ તે કોધિત અન્યો; અને કોઈ પણ રોતે તેણે વેર કેવાનું ધર્યાયું, સોમિલે

ચોતરણ નજર કરી, પણ સર્વત્ર શંખાકાર. મોટી રાત્રીએ રમશાનમાં ક્ષાળ હોય ? તે આનંદ પામ્યો. તરતજ આસપાસથી લાકડા વીળું લાવી અગ્નિ સળગાવ્યો. નજીકના એક તળાવ ખાસે જઈ પલણેલી માટી લાવ્યો અને તે માટીથી ગજસુકુમારનાં માથા પર ગોળ ફરતી પાળ બાંધી. ત્યારપછી તેણે સળગેલાં લાકડામાંથી ધગધગતા અંગારા લાવી તે પાળની વચ્ચે મૂક્યાં. આ લથંકર કામ કરી સોમિલ ત્યાંથી લથભિત બની નાસી ગયો, અને ઘેર પહોંચ્યો ગયો.

નેમ નેમ અંગારા બળતા જય છે, તેમ તેમ વધુને વધુ વેદના ગજસુકુમારને થતી જય છે. માથામાં મોટા મોટા ખાડાઓ પડતા જય છે, તેમ તેમ ઉચ્ચ વેદના મુનિને થતી જય છે ! પણ મુનિને ક્યાં હાલવું ચાલવું છે ? તે તો અદ્ભુત ક્ષમાની મૂર્તિ ! માથાની ખોપરી તુટ્ટી જય છે, અને તડતડ અવાજ સંભળાય છે, તેમ તેમ ગજસુકુમાર પોતાના સોમિલ સસરાને ધન્યવાદ આપતા જય છે, અને શુક્લ ધ્યાનની અપૂર્વ ભાવના ભાવતા જય છે; આમ અપૂર્વ ક્ષમાની અદ્ભુત જ્યોતિથી ગજસુકુમારના કર્મ બળને ખાક થઈ ગયા અને અપૂર્વ ક્રેવળજાન ક્રેવળજાન પ્રાપ્ત થયું. દૈવોએ તે જાણુંને ત્યાં પુષ્પોની વૃદ્ધિ કરી, દિવ્યગાનનો નાદ કર્યો.

પ્રાતઃકાળ થયું. સૂર્યનારાયણે તો પોતાના અવિયળ નિયમ મુજબ સોનેરી કિરણો જગતપર પ્રસારી દીધાં. શ્રીકૃષ્ણ મહારાજ ચતુરંગી સેના સાથે પ્રભુને વંદન કરવા નીકળ્યા. રસ્તામાં એક વૃદ્ધ ભાણુસને જોયો. જે એક ચણુાતાં મકાનમાં એક પઢી એક દુર્લભ જતો અને થાક્યી નિરાશાના ઉદ્ગારો કાઢતો. આ વૃદ્ધ ડોસાને બેઠ્યું શ્રીકૃષ્ણને દ્યા આવી. તેથી હાથીના હોદા ઉપરથી ઉતરી શ્રીકૃષ્ણે એક દુર્લભ ઉપાડીને મકાનમાં મૂકી. તરત જ આખી સેનાએ એકેક દુર્લભ ઉચ્ચારી મકાનમાં મૂકી, અને ડોસાનું કામ પૂર્ણ

કર્યું. તેણે શ્રીકૃષ્ણનો ઉપકાર માન્યો. ત્યાંથી શ્રીકૃષ્ણ પ્રલુપ પાસે પહોંચ્યા અને વંદન કર્યું. ત્યાં પોતાના ભાઈ ગજસુકુમારને શ્રીકૃષ્ણે જોયા નહિ, તેથી કયાં છે તે જાણવા પ્રલુને પૂછ્યું. પ્રલુએ કહ્યું: હું કૃષ્ણ, ગજસુકુમારે પોતાનું કામ સિદ્ધ કર્યું. શ્રી કૃષ્ણે પૂછ્યું:— કેવી રીતે બગવાન? પ્રલુએ કહ્યું:—ગજસુકુમારને જદ્દી મોક્ષ મેળવવાની ધર્મણા હતી, તેથી તે બારમી સાધુ પ્રતિમા અર્હણ કરી, મહારી રજ લઈ સમશાનમાં ગયા. ત્યાં એક પુરુષે તેમને સહાય કરી. પરિણામે તેમનું કાર્ય સિદ્ધ થયું. જેવી રીતે પેલા વૃદ્ધની ઢોટા ઉપાડી તમે તેનું કામ પૂર્ણ કર્યું તેવી રીતે.

શ્રીકૃષ્ણનાં નેત્રો લાલ થયાં, તેમને છોધ ચડચો. બગવાને કોખ ન કરવા સમજાયું. શ્રીકૃષ્ણે કહ્યું, બગવાન. ત્યારે હું તે પુરુષને કેમ ઓળખી શકું? પ્રલુએ કહ્યું. તહેમને તે પુરુષ રસ્તામાં ભળશે, અને તમને દેખીને તે ભય પામી મૂર્છાગત બની ત્યાં જ મરણ પામશે. શ્રીકૃષ્ણ પ્રલુને નમસ્કાર કરી ત્યાંથી ઉડી સ્વરસ્થાનકે જવા ચાલ્યા. સોમિલને પણ વિચાર થયો કે શ્રીકૃષ્ણ, બગવાનને વાત પૂછશે અને બગવાન સધળી હકીકત તેમને કહેશે. તેથી તે ભયલીત બની ઘેરથી નીકળી ગયો. ત્યાં રસ્તામાં જ શ્રીકૃષ્ણનો જોડો થયો. સોમિલ ગલરાયો અને ત્રાસ પામી એકદમ ત્યાં મૂર્છિત થઈ જમીન પર પડચો અને મરણને શરણ થયો. શ્રી કૃષ્ણે તેને ઓળખ્યો. ગુરુસાના આવેશમાં તેમણે તેના મૃત શરીરના કુકડેદુકડા કરી નાખ્યા અને ચંડાળા પાસે તે ફેંકવી દીધા, તથા તે જગ્યાએ પાણીનું સિંચન કરાવી શ્રીકૃષ્ણ સ્વરસ્થાનકે ગયા.

શ્રી ગજસુકુમારનો દેહ વિલય ખાયો પણ તેમનો અમર આત્મા અમરધામ (મોક્ષ)માં પહોંચી ગયો. ધન્ય છે ગજસુકુમાર સમા મહા ક્ષમાસાગર સાધુને!

૮૨. ગર્દભાળી મુનિ

ગર્દભાળી નામના એક મહા સમર્થ આચાર્ય હતા. એકવાર તેઓ પાંચાલ દેશના કંપિલપુર નગરના તેસરી નામના ઉદ્ઘાનમાં ધ્યાન ધરીને બેદા છે, તેવામાં તેજ વનપ્રદેશમાં સંયતિ નામનો રાજ શિક્ષાર અથે આવી ચડચો. રાજએ એક મૃગને બાળુ મારી વીંધી નાખ્યું, પાસે જ મુનિ ધ્યાનસ્થ બેદા હતા. તરફકીયા ખાતું તે મૃગ મુનિના ખોળામાં જઈ પડ્યું. સંયતિ રાજની દશ્ટિ મુનિ પર પડતાં તે ગલરાયો અને સ્વગત વિચારવા લાગ્યો:-અહો ! હું કેવો પાપી કે આ મહાત્માના મૃગને મેં માર્યું ! આ મૃગ મુનિનું જ હેઠાં જોઈએ અને જો મુનિ મારા પર કોપાયમાન થશે તો મારી દુર્દશા કરશે, માટે મારે મુનિની ક્ષમા માગવી જોઈએ. એવા વિચાર કરી ભયથી કંપતો સંયતિ રાજ મુનિ પાસે આવ્યો અને વિવેકપૂર્વક એ હાથ નેડી કહેવા લાગ્યો:-મહાત્મન ! મારો અપરાધ ક્ષમા કરો, મહને નહોતી ખર કે આ મૃગ આપનું હશે. સમયના જણ અને જેણે પોતાના કષાયો ઉપશમાય્યા છે એવા તે ગર્દભાળી મુનિએ ધ્યાન પારીને કર્યું:-રાજન, ગલરાયો નહિ. તહમને અલય છે, અને તહે પણ મહારી જેમ અલયદાનના દાતાર થાયો. દરેક પ્રાણીને સુખ વહાણું છે અને હુઃખ અળખામણું છે. જેમ તહમને તહમારો પ્રાણ વહાલો છે, તેવો જ દરેક જીવને પોતાનો પ્રાણ વહાલો છે, માટે પોતાના આત્મા સમાન દરેક જીવને ગણ્યવા; કોઈ જીવને મનથી વચ્ચનથી કે શરીરથી હાનિ પહોંચાડવી એ મહા અધર્મનું કારણ છે. આ રીતે અહિંસા ધર્મનું સ્થૂલ અને સ્ફુર્ત એવું તો અદ્ભુત સ્વરૂપ મુનિએ સમજાયું કે સંયતિ રાજ વૈરાગ્ય પામ્યો અને મુનિ પાસે ચારિત્ર લઈ ચાલી નીકળ્યો: મુનિ પણ ચારિત્ર ધર્મનું ઉત્કૃષ્ટ પાલન કરી મોક્ષમાં ગયા.

૮૩ ગોશાળો (ગૈશાલક)

રાજગૃહી નગરીની સમીપમાં શ્વરણ નામનું એક ગામ હતું. ત્યાં મંખવી નામે ચિત્રકાર હતો. સાધારણ ચિત્રકામ કરે, દેશ પરદેશ કરે અને જેમ તેમ કરી પોતાની આજુવિકા ચલાવે. એકવાર મંખવી તથા તેની સ્ત્રી સુભદ્રા પર્યાટન કરવા નીકલ્યાં. સુભદ્રા ગર્ભવતી હતી, ગર્ભકાળ સમીપ આવી રહેલો જોઈ એક ગામમાં ગોઅઘ્રાન નામના ધનાદ્ય આલણું ત્યાં ઉતારો કર્યો. આલણે તેઓને પોતાની ગોશાણાના એક વિલાગમાં ઉતારો આપ્યો. સુભદ્રાએ અહીંથાં એક પુત્રનો જન્મ આપ્યો. તેનું નામ ગોશાળો. બાલ્યાવસ્થા વીતાવી ગોશાળો જ્યારે યુવાનસ્થાને પામ્યો ત્યારે તે હાથમાં એક ચિત્રરેલું પાઠીયું લઈને લિક્ષા અર્થે દેશ પરદેશ કરવા લાગ્યો.

એકદા પ્રભુ મહાવીર દીક્ષા લઈને પહેલું ચાતુર્માસ અસ્તિ ગામમાં કરીને, બીજું ચાતુર્માસ રાજગૃહી નગરમાં એક વણકરની શાળામાં રહ્યા હતા, તે વખતે આ ગોશાળો કરતો કરતો ત્યાં આવ્યો અને પોતાનો સામાન-વસ્ત્ર વગેરે તેજ શાળાના એક વિલાગમાં સુકી ત્યાં નિવાસ કર્યોં. પ્રભુએ માસઅભણનું પહેલું પારણું વિજય શેડને ત્યાં વહેરીને કર્યું. સુપાત્ર દાન દેવાથો રતન, ધન, પુણ્ય વગેરે પંચ દંયની વિજય-શેઠને ત્યાં દિવ્ય વૃષ્ટિ થઈ. ગામમાં ખરર પડવાથી સૌ કોઈ વિજય શેઠને ધન્યવાદ દેવા લાગ્યા.

ગોશાળો પણ આ વાત જણ્ણી. તેણે વિચાર્યુ કે જે હું પ્રભુનો શિષ્ય થાર્ન, તો મને બાહું લાલ થાય. તેથો તે મહાવીર પાસે આવ્યો અને કહ્યું:- ‘હે પ્રભુ, હું તમારો શિષ્ય થવા માગું છું, પ્રભુએ આદર ન આપ્યો. કેટલાક વખત બાદ કરીથી તેણે પ્રભુને એજ વાત કરી. પ્રભુએ હા કહી. એટથે ગોશાળો તેમનો શિષ્ય બન્યો. ગોશાળો સાધુ છતાં દરેક વાતમાં અવળો જ હતો. પ્રભુની પ્રશંસા

જ્યાં ત્યાં થતો તેનાથી સહન ન થાય, છતાં પોતાને અનુભવ કેવો છે તેથી તે પ્રભુ સાથે વિચરતો. એકવાર પ્રભુ તથા ગોશાળો ફૂર્મ ગામ તરફ જતા હતા. રસ્તામાં એક ખેતરમાં એક તલનું જાડ હતું. તે ગોશાળો જોયું અને પ્રભુને પૂછ્યું. હે પ્રભુ, આ તલનું જાડ ઉગશે કે નહિ, અને તેના આ સાત પુણ્યના જીવો મરીને ઝ્યાં જરો? પ્રભુએ કહ્યું:—આ તલનું જાડ ઉગશે અને તેના જીવો મરીને તેની ફળીમાં સાત તલ રૂપે ઉપજશે. આ વાત ગોશાળને ઇચ્છી નહી. તેથી તરતજ તે જાડ તેણે મૂળમાંથી ઉખેડી નાખ્યું. અને અગવાનની વાત ખાટી દ્રાવવા પ્રયત્ન કર્યો. ત્યાંથી પ્રભુ વગેરે વિહાર કરી ગયા. વર્ષાઋતુનો સમય હતો. કેટલાક દિવસો બાદ વૃદ્ધિ થવાથી તે ઝેંકી દીધેલું જાડ કરીથી ત્યાં જ ઉગ્યું અને તેના જીવો પણ તેમાં જ ઉત્પન્ન થયાં. બીજુ વખત જ્યારે ગોશાળો એ જાડ જુએ છે ત્યારે પ્રભુ એજ જાડ હોવાનો જવાય આપે છે. ત્યારે ગોશાળો હંડો પડી જય છે.

ફૂર્મગ્રામની અહાર વેશ્યાયન નામનો એક તપસ્વી છદ્ધદના તપ કરી, સૂર્યસામે આતાપના લઈ રહ્યો છે, તેના ભાથામાંથી જુંએ નીચે ખરે છે, તપસ્વી જીવદ્યાને ખાતર તે જુંએ ઉપાડી કરી પોતાના ભાથામાં નાખે છે. પ્રભુ ભહાવીર તથા ગોશાળો આ રસ્તે નીકલ્યાં, ગોશાળો ઉક્ત દશ્ય જોઈને તપસ્વીની નિંદા કરવા લાગ્યો, વેશ્યાયનને કોધ ચાય્યો. તેથી તેણે ગોશાળા પર તેજુ વેશ્યા ઝેંકી. ગોશાળો દાજવા લાગ્યો, પ્રભુને દયા આવી, તેથી તેમણે શાતકેશ્યા ઝેંકી, ગોશાળને બચાવ્યો. પ્રભુનો પ્રભાવ દેખી તાપસે વંદન કર્યું.

ગોશાળને લાગ્યું કે તેજુકેશ્યા શાખ્વી જરૂરી છે. તેથી પ્રભુને તેજુકેશ્યા કેમ પ્રાપ્ત થાય તે વિષે પૂછ્યું. પ્રભુએ કહ્યું કે છ ભાસ સુધી છદ્ધદની તપશ્રયા કરવી અને સૂર્ય સામે આવાપના

બેવી. પારણુના દિવસે મુઢી અડદના બાકળાનો આહાર કરવો. ગોશાળે તે મુજબ કર્યું તેથી તેને તેજુલેશ્યાં ગ્રામ થઈ.

તેજુલેશ્યાનો તે દુરૂપયોગ કરવા લાગ્યો. એકવાર પ્રલુને તેણે પૂછ્યું, ભગવાન ! આજે હું શેનો આહાર કરીશ ? ભગવાને કહ્યું, માંસનો ! પ્રલુનું વચન મિથ્યા કરવાને ગોશાળો એક ધનવાન આવકને ત્યાં ગયો. તેની સ્વીને બાળક જીવતું ન હતું, તેથી ક્રોધિએ તેને કહેલું કે માંસની ખીર અનાવીને ક્રોધિ સાધુને વહેરાવે તો તારા પુત્રો જીવતા રહે. તેથી તે શેઠની સ્વીએ તેજ દહાડે માંસની ખીર અનાવેલી. ગોશાળાનું આગમન થતાં તે ખીર તેણે વહેરાવી. ગોશાળો તે હસ્ત સંપત્તમાં લઈ ત્યાંજ ખાઈ ગયો. તે પછી તેણે પ્રલુ પાસે આવીને કહ્યું, ભગવાન, મેં તો ખીરનો આહાર કર્યો. ભગવાને કહ્યું, ખીરનો નહિં, પણ માંસનો ! ગોશાળો ઉલ્લી કરી તો માંહેથી માંસના કકડા નીકળ્યા. આથી ગોશાળો પેવા શેઠને ત્યાં ગયો. શેઠની સ્વીએ સાધુના શાપના લયથી મકાનનું બારણું બદલી નાયેલું. ગોશાળે ત્યાં ઘણી તપાસ કરી. પણ ધરનો પતો લાગ્યો. નહિં. તેથી તે વધારે કોધાયમાન બન્યો અને તેજુલેશ્યા મૂકીને તેણે આપ્યો મહોદ્ધો બાળો નાખ્યો.

ગોશાળાના આ દુષ્કૃત્યથી સર્વાનુભૂતિ અણુગારને ખૂબ લાગી આવ્યું. તેથી તેમણે ગોશાળાને ઠપકો આપ્યો. ગોશાળાને કોધ ચડયો અને અણુગારને પણ તેજુલેશ્યાથી બાલ્યા. એકવાર પાશ્ચનાથ પ્રલુના શિષ્યો ગોશાળાને મલ્યા. વાદવિવાદ થયો. ગોશાળે તેમના પર તેજુલેશ્યા છોડી; પણ તેમને તે સ્પર્શી શકી નહીં. ગોશાળો ઠડો થઈ ગયો. તેણે પ્રલુને પૂછ્યું, પ્રલુએ કહ્યું કે તેમનું તપોથળ ભારે છે. તહારી તેજુલેશ્યાનો હું દુરૂપયોગ કરે છે માટે તે ટકી શકશે નહીં. ગોશાળાને આથી પ્રલુ પર રીસ ચડી. તેણે પ્રલુને કહ્યું કે તું છ માસમાં મરી જઈશિ. પ્રલુએ જવાબ આપ્યો. હે ગોશાલક, હું છ માસમાં નહિં મરું પણ ખીણ સોણ વર્ષ સુધી જીવીશ. પણ તું સાત દિવસમાં પિતાનવરથી પીડાઈને

મૃત્યુ પામીશ. આ સાંલળો ગોશાળો ચમક્યો. અને નમ્ર થઈ ગયો. સાતમી રાત્રીએ તેણે વિચાર કર્યો કે હું મહા પાપી છું. સાધુપુરોનો ધાત કરનાર છું! પ્રભુજેવા વિતરાગી પુરોનો સત્તસંગ પામ્યા છતાં, તેમનાથી કેટલોક કાળ જુદો રલ્યો! હું તીર્થકર છું એવી ખોટી પ્રરખણ કરીને હું ભગવાનની આજાનો વિરાધક થયો છું. માટે હવે હું સર્વ સાધુ નિર્જથને ખમાંડું છું. એવી શુભ ભાવના ભરણાંતે ભાવી, આદેયના કરી, પિતજવરથી પીડતો તે ગોશાળો મરીને ખારમા દેવલોકમાં ગયો.

૮૪ ગોલદ્ર શેડ

રાજગૃહ નગરમાં ગોલદ્ર નામના એક શેડ હતા. તેમને ભદ્રા નામની પત્ની હતી. બંને ધર્મનિષ્ઠ અને જૈનધર્મમાં અદ્ધાળું હતા. તેમને એ સંતાનો હતા. એક પુત્ર અને એક પુત્રી. પુત્રનું નામ શાળીલદ્ર અને પુત્રીનું નામ સુભદ્રા. સુભદ્રાને પ્રતિષ્ઠાનપુરના ધન સાર શેડના પુત્ર ધનાકુમાર વેરે પરખણવી હતી, જ્યારે શાળીલદ્રનું ઉર સ્વીએ સાથે પાણીગ્રહણ કરાવવામાં આવ્યું હતું. ત્યારથાદ ગોલદ્ર શેડે ચારિત્ર ગૃહણ કર્યું. ચારિત્રની શુદ્ધ આરાધનાને અંતે તેએ દેવગતિ પામ્યા. ત્યાં ઉત્પત્ત થયા પછી શાળીલદ્રના પુણ્ય પ્રભાવે ગોલદ્ર (દેવ) ને પુત્ર પર અતિશય સ્નેહ હતો, તેથી તેએ પુત્ર માટે દરરોજ વસ્ત્ર, ધરેણાં અને પકવાનાદિથી ભરપુર ૮૮ પેટીએ મોકલતા, જેના ઉપભોગમાં શાળીલદ્ર સુખ પામતો અને દેવને સંતોષ થતો. આ રીતે ધણ્યા વખત સુધી તે દેવે પુત્રપ્રેમને લીધે કર્યું. અને જ્યારે શાળીલદ્ર દીક્ષા લીધી ત્યારોજ તે દેવે, પેટીએ મોકલવાનું બંધ કર્યું. અનુકૂમે ગોલદ્ર મહાવિદેહ ક્ષેત્રમાં અવતરી મોકષમાં જશે.

૮૫ ગૈતમ (૨)

તેએ અંધક વિષણુના પુત્ર હતા. માતાનું નામ ધારિણી. શ્રી ગૌતમ યુવાવસ્થા પામતાં આડ સ્વીએ પરણ્યા. ભગવાન નેમનાથની

દેશના સંલગ્ની વૈરાગ્ય પામ્યા અને નેમ પ્રભુ પાસે દીક્ષા લીધી. સ્થવિર મુનિ પાસે તેઓ ૧૧ અંગ લણ્યા. ૧૨ વર્ષનું ચારિત્ર પાલણું. અંતિમ સમયે શાંતુજ્ય પર્વત પર અનશન કર્યું અને તેઓ મોક્ષમાં જયા.

૮૬ ગૌરીરાણી

ગૌરી એ શ્રી કૃષ્ણ વાસુદેવની રાખી હતી. તેમણે શ્રી નેમનાથ પાસે દીક્ષા લીધી અને યક્ષાણી નામક આર્યાજી પાસે રહ્યા. વીશ વર્ષનું ચારિત્ર પાલણું. ધણો તપ કરી અંતિમ સમયે એક માસનો સંથારો કરી તેઓ તેજ લવમાં મોક્ષ ગયા.

૮૭ ગંગદત્ત

હસ્તિતનાપુરમાં ગંગદત્ત નામે ભાથાપતિ હતા. એકવાર ભગવાન મુનિસુવત સ્વામી તે નગરમાં પદ્ધાર્યો. અન્ય લોકોની નેમ ગંગદત્ત પણ ભગવાનનું વ્યાખ્યાન સંલગ્નવા ગયા. દેશનાને અંતે તેઓ વૈરાગ્ય પામ્યા અને પ્રભુને કહ્યું—ભગવાન, મહને આપનો ધર્મ રૂપ્યો છે. માટે હું ધેર જરૂર, જ્યેષ્ઠ પુત્રને ગૃહકાર્યભાર સોંપી, આપના ધર્મની દીક્ષા લેવા ઈચ્છું છું. જવાયમાં ભગવાને કહ્યું:- નેમ સુખ ઉપને તેમ કરો.

ગંગદત્ત ધેર આવ્યા. એક મહોટા જમણવાર કરવામાં આવ્યો. નેમાં કુદુંખીએ વગેરેને જમાડયા. ત્યારપણી તેમણે સર્વ કુદુંખીએ સમક્ષ પોતાના ત્યાગ ભાવની વાત જણાવી. અને ગૃહકાર્યભાર મોટા પુત્રને સોંપ્યો. ત્યાંથી સર્વની રજ લઈ તેઓ પ્રભુ પાસે આવ્યા અને દીક્ષિત થયા. ત્યારથાદ ૧૧ અંગનો અભ્યાસ કર્યો. તપશ્ચર્યાને અંતે એક માસનો અનશન કરી, કાળ ધર્મને પામી ગંગદત્ત સાતમા દેવલોકમાં ગયા. ત્યાં ૧૭ સાગરની સ્થિતિ ભોગવી, તેઓ મહાવિદેશ ક્ષેત્રમાં અવતરશે અને તેજલવમાં મોક્ષ જશે.

૮૮ ચિત્ત અને અલોકત

વારાણસી નગરીમાં શાંખ રાજ રાજ્ય કરતો હતો. તેને નામુચિ નામે પ્રધાન હતો. પ્રધાન વિદ્યાકળામાં કુશળ હતો. પરંતુ તેનામાં વ્યલિચારનું મોઢું દુષ્પણ હતું. એકવાર તે રાજના અંતઃપુરમાં દાખલ થયો. અને રાણી સાથે પ્રેમ સુખ બોગવવા લાગ્યો. આ વાતની રાજને ડોઈ અનુચર દ્વારા ઘયર ભળી; એટલે તે તપાસ અર્થે અંતઃપુરમાં આવ્યો. પોતાની રાણી સાથે પ્રધાનને દુરાચાર સેવતો જોઈ રાજને ધણોજ કોધ ચડ્યો. તત્કાળ તેણે પ્રધાનને પકડીને મંગાવ્યો; તેની સર્વ માલમીલક્ત જરૂત કરી અને ભુદ્ધત નામના એક ચંડાળને ઓલાવી પ્રધાનને શહેર બહાર લઈ જઈ ગરદન મારવાનો રાજએ હુકમ ફરમાવ્યો. પ્રધાનને લઈને ચંડાળ જંગલમાં આવ્યો. અને રાજનો હુકમ તેને કહી સંભળાવ્યો. આ સાંભળી પ્રધાન ભયથી પ્રુજવા લાગ્યો, અને પોતાને નહિ મારવા તેણે ચંડાળને ધણીજ આજુલુ પૂર્વક વિનાંતિ કરી. અદલામાં ચંડાળે કહ્યું કે તું મારા એ પુત્રાને સંગીત કળા શાખવે તો હું તેને જીવતો રાખું. પ્રધાને તે કયુલ કર્યું. ચંડાળે તેને ગુમ બોંયરામાં રાખ્યો. અને તેની પાસે સંગીતવિદ્યા શાખવા તેણે પોતાના ચિત્ત અને સંભુતિ નામના એ પુત્રાને મોકલ્યા. પ્રધાન આ બંનેને સંગીત નૃત્ય આદિ કળાઓ શાખવવા લાગ્યો.

ચંડાળની સ્ત્રી પુત્રનું શિક્ષણ જેવા સારું વારંવાર આ ગુમ બોંયરામાં આવતી અને તે પ્રધાન સાથે વાર્તા વિનોદ કરતી. થોડા સમયના અંતે પ્રધાનને તથા ચંડાળ સ્ત્રીને પરસ્પર પ્રેમ અંધાયો. પ્રધાન દુરાચારી હોવાથી આ ચંડાળ સ્ત્રીની સાથે વિષય સુખ બોગવવા લાગ્યો. પાપ કરી છાતું રહી શકતું નથી. એ ન્યાયે પ્રધાનના દુષ્કૃત્યની ભુદ્ધત ચંડાળને ઘયર પડી. તેણે વિચાર કર્યો:-અહો! આ પ્રધાન કેટલો અંદો દુષ્ટ છે કે જ્યારે મેં તેને મોતથી બચાવ્યો

ત्यारै ते ભારીજ સ્વી સાથે પ્રેમ બાંધવા તત્પર થયો ! ધિક્કાર છે એ દુષ્ટાત્માને, હું હવે તેને તેના પાપનો થોડ્ય બદલો આપીશ. અને સમય આવતાં તેનો ઘાટ ઘડી નાખીશ. આમ વિચારી તે ચંડાળ પ્રધાનને મારી નાખવાની તક શોધવા લાગ્યો. આ વાતની ચંડાળના બંને પુત્રોને ખબર પડી, એટલે તેમણે વિચાર્યું કે આપણે વિદાગુરનો બચાવ કરવો જોઈએ. એમ ધારી પિતાની છંદિંદાં તેમણે પ્રધાનને કહી અને છાનીરિતે છટકી જવાનું પ્રધાનને કહ્યું; એટલે તેજ રાત્રે પ્રધાન ગુમરીતે ભોંયરામાંથી બહાર નીકળી ગયો, અને દેશ પરદેશ ફરવા લાગ્યો. કેટલાક વખતે તે હસ્તીનાપુર નગરમાં આવી પહોંચ્યો. અહિં સનંતકુમાર નામે ચક્રવર્તી રાજ રાજ્ય કરતો હતો. પ્રધાન તેની પાસે આવ્યો અને દીન વદ્દે તેણે નોકરીની ભાગણી કરી. સનંતકુમારે તેને સામાન્ય સીપાઈની નોકરી આપી; પણ પ્રધાન પોતાની બુદ્ધિ અને ખટપટના પરિણામે થોડાજ વખતમાં સનંતકુમારનો પ્રધાન બન્યો, અને સુખ લોગવવા લાગ્યો.

આ તરફ બંને ચંડાળ પુત્રો સંગીત, નૃત્ય આદિ કળામાં કુશળ બન્યા હતા. એક વાર વારાણસી નગરીમાં પ્રમોદ ભહેતસવ હતો. સર્વ નગરજનો આનંદમાં ભશચૂલ હતા. તે વખતે આ બંને ચંડાળ પુત્રો નગરજનોને પોતાની સંગીત કળા બતાવવા માટે શહેરમાં આવ્યા અને મુખ્ય રસ્તા પર ઉભા રહી હાથમાં વીણા લઈ સુભંધુર કંડું ગાન તાન કરવા લાગ્યા. સંગીતના મહુર સૂરથી પુષ્કળ માણસો મુગધ બની ગાન તાન સાંભળવા લાગ્યા. તેવામાં કેટલાક લોકોએ આ ચંડાળને ઓળખી કાઢ્યા. તેથી એકદમ તેએ ગુરસે થયા અને પોતાને અલડાવ્યા તે માટે કોધાયમાન થઈ હાથમાં લાકડી પત્થર ને કંઈ આવ્યું તે લઈ આ ચંડાળ પુત્રોને મારવા માટે પાછળ પડ્યા. બીકના માર્યા ચંડાળ પુત્રો ત્યાંથી નાસી ગયા અને જંગલમાં આધી પહોંચ્યા.

અહિં બંનેએ વિચાર કર્યો કે અહો, જગતમાં કેવા હુણ મનુષો વસે છે. આપણામાં સંગીતની સુંદર કળા હોવા છતાં ભાત્ર આપણી હૃતકી શાતિને ખાતર તેઓ આપણો તિરસ્કાર કરે છે. માટે આપણે હવે આપવાત કરવો ઉદ્દિ છે. એમ ધારી તેમણે ત્યાંથી પડીને ભરી જવાનો નિશ્ચય કર્યો. તેવામાં એક મુનિ મહાત્મા પહાડ પર એકેલા. તેમની નજર આ બંને પર પડી. મુનિએ પોતાના શાનથી આ બંનેના મનોભાવ જાણી લીધા. તેથી તે મુનિએલ્યા:-ભાઈએ, તહેમે કોણ છો, અને શો વિચાર કરો છો ? આ સાંલળી બંને જણા મુનિને પગેલાગી એલ્યા:-મહારાજ. અમે ચંડળના પુત્રો છીએ. અમારી હૃતકી શાતિને લીધે જગત અમારો તિરસ્કાર કરે છે. એટલે અમે આ પહાડ પરથી પડીને ભરી જવા ભાગીએ છીએ. આ સાંલળી મુનિએ કહ્યું. વત્સો, તમે એમ માનો છો કે ભરી જવાથી તમે સુખ પામશો ? ના. તેમ નથી. તમે પૂર્વ ભવમાં જતિનો ભદ્ર કરેલો. તેથી જ તમે આ લવે નીચ જતિ પામ્યા છો અને વળી આપવાત કરીને શા સારું વધારે હુખ્ય વહોરવા તત્પર થાવ છો ? સુખ મેળવવાનો ભાત્ર એક જ માર્ગ છે. તે એ કે તમારા આત્માને તપ અને સંયમ વડે શુદ્ધ કરવો અને પ્રભુભક્તિમાં મશગૂલ બની ઉર્ચય વિચારો અને ઉર્ચય ભાવના ભાવની. અહિંસા, સત્ય, અલ્લયર્ય, ક્ષમા, વિનય આદિ મહાન ગુણો વિકસાવવા અને શુદ્ધ સંયમ માર્ગ પ્રવર્તન કરવું. ઉપરના નિયમથી તમે આત્મકલ્યાણ સાધી શકશો. જૈન માર્ગમાં ગમે તે જતિનો મનુષ્ય દીક્ષિત થઈ શકે છે, માટે તમારી હૃતકી જતિ માટે ઐદ ન કરતા ખુશીથી દીક્ષા લ્યો. તમારો ઉર્ધ્વાર થશો. મુનિનો આ ઉપદેશ બંનેના હુદ્ધયમાં વસી ગયો. તરત જ તેમણે મુનિ પાસે દીક્ષા લીધી, અને તપ સંયમમાં આત્માને ભાવતાં તેઓ ગ્રામાનુગ્રામ વિચરવા લાગ્યા.

ક્રતા ક્રતા તેઓ હસ્તિનાપુર નગરના ઉદ્ઘાનમાં પધાર્યા. આને બંને મુનિવરોને ભાસક્ષમણું પારાણું હતું. એટલે તેમાંના

એક સંભૂતિમુનિ લિક્ષાર્થી શહેરમાં કુરવા લાગ્યા. તેવામાં નામુચિ નામના પ્રધાને પોતાના મહેલની બારીમાંથી આ મુનિને જર્તાં જેયાં. તરત જ તેણે મુનિને ઓળખી કાઢ્યા, અને વિચાર કર્યો: અરે ! આ તો પેદો ચંડળનો પુત્ર, તેણે દીક્ષા લીધી લાગે છે, મારી બધી વાત આ જાણે છે, અને કદાપિ તે મારી વાત રાજને કહેશે તો મારે અહિંથી નાસી જવું પડશે. માટે મારે આ સુનિને ગામભમાંથી હાંકી કાઢવા જોઈએ. એમ વિચારી પ્રધાન પોતાના અનુચરે સાથે નીચે આવ્યો. અને સુનિ પાસે જઈ તેમને ઘૂઅ માર મારવા લાગ્યો. મુનિ નિઃશબ્દ હતા, તપસ્વી હતા. તહેમનાથી માર સહન થઈ શક્યો નહિ. એટલે તરત તેમને અંગે અંગમાં કોધની જવાળા વ્યાપી ગઈ. પોતાની તજુલેસ્થાના ઘે તે મોઢામાંથી ધૂમાડાના ગોટેગોટા કાઢતાં ઉદ્ઘાન તરફ જવા લાગ્યા. ધૂમાડાથી આખું આકાશ અને શહેર છવાઈ ગયું. ચક્રવર્તીએ અનુચર મારદ્ધત જાણ્યું કે કોઈ એ જૈનમુનિને સત્તાવ્યા છે; તેથી આમ બન્યું છે. એટલે ચક્રવર્તી ઉદ્ઘાનમાં સંભૂતિ મુનિ પાસે આવ્યા. તે વખતે બંને મુનિવરોએ અનશન કરેલું. ચક્રવર્તીએ સંભૂતિ મુનિને વંદન કરી કહ્યું. મહારાજ, અમારો અપરાધ ક્ષમા કરો અને શાંત થાઓ. તથાપિ સંભૂતિ મુનિ શાંત થયા નહિ, એટલે ચિત્ત મુનિએ સંભૂતિ મુનિને કહ્યું: હે ક્ષમાત્રમણુ, અનંત પુણ્ય ઘે પ્રાપ્ત થયેલું ચારિત્ર શા સારં બાળીને ભરમીકૂત કરો છો. માટે સમજે અને શાંત થાવ. ઉક્ત શખ્ષેથી સંભૂતિ મુનિ શાંત પડ્યા. કુરી ચક્રવર્તીએ તેમને વંદન કર્યું, ચક્રવર્તીની સ્વી સુનંદાએ પણ મસ્તક નમાવીને સંભૂતિ મુનિના ચરણમાં વંદન કર્યું. સંભૂતિમુનિ તે વખતે ધ્યાન દશામાં લીન થયેલા હતા. જે વખતે ચક્રવર્તીની સ્વી સુનંદાએ મુનિને વંદન કર્યું, તે વખતે તેના ભાથામાં નાખેલ ચંદન બાવનાના તેલનું રીપું સંભૂતિ મુનિના ચરણ પર પડ્યું. તેલની ઠંડક અને સુગંધથી સંભૂતિ મુનિનું ચિત્ત વિદ્વાલ બન્યું. તેમણે નેત્ર ખોલી ઉંચે જેયું.

તો સાક્ષાતું દિવ્યાંગના સમી સૌંદર્યવાન સ્વી તેમના જેવામાં આવી. જોતાં જ તે એકદમ તેનામાં મુખ્ય અન્યા અને વિકાર ઉત્પન્ન થયો. તરત જ તેમણે નિયાળું કર્યું કે જે ભારા તપ સંયમનું ઇણ હોય. તો આવતા ભવે ભને આ ચ્છીરતન પ્રામ થને. અહા, કાંચન અને કામિનીનો પ્રભાવ જગત જનોપર કેવો પડે છે. જેનું અપૂર્વ ચારિત્ર બણ છે, એવા મહાન મુનિવરો. પણ સ્વીમોના સૌંદર્યભાં વિકારવશ અની આત્માનું હિત ગૂમાવી એસે છે. '

ચક્રવર્તી ત્યાંથી સ્વર્ણાનકે આવ્યા. તેમને ઘઘર પડી કે મુનિના કેદનું કારણ પ્રધાન હતો. તેથી તેમણે પ્રધાન પર ગુરસે થઈ તેના ધરાયાર લુંટી લીધા અને તેને રાજ્યમાંથી હાંકી કાઢ્યો. અને મુનિવરો કેટલાક વખત સુધી અણસણ વૃત્ત પારી કાળાન્તરે કાળધમને પામ્યા અને સૌધર્માદેવદ્વારા ક્રમાં દેવ થયા. ત્યાંથી ચિત્ત મુનિ પુરિમિતાલ નગરમાં એક ધનાદ્ય શેડને ત્યાં પુત્રપણે અવતર્યા અને સંભૂતિ મુનિ કંપિલપુર નગરમાં અલભૂતિ રાજને ત્યાં, તેની ચુલ્લણી રાણીની કુક્ષિમાં પુત્રપણે ઉપણ્યા. તેઓ વખતે રાણીએ ચૌદ સ્વર્પન દીડાં. તીર્થકર અને ચક્રવર્તીની ભાતા ચૌદ સ્વર્પન દેખે છે. અનુક્રમે સવાનવ ભાસે પુત્રનો જન્મ થયો. રાજાએ જન્મેતસવ ઉજવ્યો. અને પુત્રનું નામ ‘અલદત’ પાડયું. કેટલાક સમયે રાજ ભરણ પામ્યા. કુમાર તે વખતે બાલ્યાવસ્થામાં હતો. એટલે રાજ્યનો સધળો કાર્યાલાર રાજએ પોતાની માંદગી વખતે તેના દીર્ઘ નામના એક મિત્ર રાજને સોંઘ્યો હતો. આ દીર્ઘ રાજને ચુલ્લણી રાણી સાથે આડો સંબંધ હતો. આપો દિવસ અને રાત તે ચુલ્લણીના આવાસમાં જ પડ્યો રહે અને તેની સાથે પ્રેમ સ્ફુર લોગવે. આ વાતની અલદતને ઘઘર પડી. પોતાની ભાતાનું દુષ્પણ તેનાથી સહન ન થયું, એટલે એકવાર તેણે દીર્ઘ રાજને ચોકખું સંભળાવી દીધું કે તહે અંતઃપુરમાં ભારી ભાતા સાથે દુષ્ટ રીતે વર્તો છો, પણ યાદ રાખજો કે હું તમને કોઈ વખત જાનથી ભારી નાખીશ. આ શબ્દો સંભળતાં

દીર્ઘરાજને કાળ વ્યાપ્યો. તેણે સધળી વાત ચુક્ષણીને કરી. ચુક્ષણીએ દીર્ઘરાજને કહ્યું: સ્વામીનાથ, તમે કીકર શાદને કરો છો? હું અલદાતનો થોડાક વખતમાં જ પ્રાણું લઈ લઈશ અને આપણે સુખ ચેનથી હંમેશાની માર્ક રહીશું: ચુક્ષણી રાણી અલદાતનો જન કેવાની યુક્તિ શાધવા લાગી. તેણે નગર અહાર એક સુંદર લાખાગૃહ તૈયાર કરાવ્યું અને ત્યાં અલદાતને રહેવા કહ્યું. અલદાત ત્યાં રહેવા ગયો. આ વાત દીર્ઘરાજના પ્રધાન મારક્ષત અલદાતે જાણી, એટલે તેમણે રાતોરાત તે લાખાગૃહમાંથી છેક શહેર અહાર ભાગોળ સુધીની એક સુરંગ ખોદાવી. રાત્રે અલદાત અને પ્રધાનપુત્ર બંને તેમાં સૂર્ધ રહ્યા.

મધ્યરાત્રિનો સમય થયો. રાણી ચુક્ષણી તે લાખાગૃહ પાસે આવી પહોંચી. એક દિવાસળી તે મહેલને ચાંપી; ચાંપતાં જ બડલડ બડકા થવા લાગ્યા અને ક્ષણવારમાં આએ મહેલ સળગી ઉઠ્યો. પ્રધાન પુત્ર અને અલદાત ભયભીત થઈ ગયા. પ્રધાન પુત્રે સુરંગનું દ્વાર અલદાતને અતાવ્યું, અલદાતે પગની એક ઢોકર મારી વજનદાર દ્વાર ખોલી નાંખ્યું, બંને તેમાં દાખલ થયા અને સુરંગ વાટે શહેર અહાર નીકળી પરહેશને પંથે પડ્યા. પોતાની અજય શક્તિના બજે તેણે દેશપરહેશના અનેક રાન્યો જીત્યા, અનેક સ્વીએને પરણ્યો અને સૈન્ય લઈને તે દીર્ઘરાજ પર ચડી આવ્યો. તેને મારીને તે રાન્યાસને એડો. પોતાના અપૂર્વ બળથી અને ચક્રરતના પ્રભાવથી અલદાતે એક પછી એક અનેક દેશો જીત્યા અને છખંડ સાધી તે ચક્રવર્તી તરીકે દિવિજયી થયો.

એકવાર અલદાત રાજસભામાં એડો છે, તેવામાં નાટકીયા કોણો ત્યાં નાટક કરવા આવ્યા. નાટકના વિધવિધ પાડોનું આખેહુખ્ય ચિત્ર દેખી પૂર્વભવમાં દેવકોકમાં નાટક દેખ્યાનું તેને રમરણ થયું, અને તરત જ તેને જતિરભરણ જાન ઉત્પન્ન થયું. તે વડે અલદાતે

પોતાના પૂર્વનાં પાંચ લવો જેયા. તેમાં પોતાનો ભાઈ ચિત્ત અધા ભવોમાં સાથેનો સાથેજ જેયો. તરત તેને વિચાર થયો:-અહો ! મહારો પાંચ લવોનો સંગાથી ભાઈ આ લવમાં કયાં હશે ? એમ વિચારી તેણે એક શ્લોક રચી ગામભાં દઢેરો પીટાવ્યો કે આ મારો અર્ધો શ્લોક ને કોઈ પૂરો કરી આપે, તેને હું મારં અર્ધું રાજ્યપાટ આપીશ. તે અર્ધ શ્લોક આ પ્રમાણે હતો.

ગોપ દાસો મૃગો હંસો, મર્ત્યામરો યથા

ઉપરનો શ્લોક સર્વ કોઈ મુખ્યપાડ કરી વારંવાર બોલે; પણ તેનો બીજો અર્ધો લાગ કોઈ બરાબર બનાવી શકે નહિ.

હવે આ તરફ ચિત્ત મુનિ પુરિમિતાલમાં એક શેઠને ત્યાં જન્મેલા. ઉંમર લાયક થતા એક મુનિ પાસે ઉપરેશ સાંભળી વૈરાગ્ય પામી તેમણે દીક્ષા લીધેલી. તેમને પણ જતિરમરણ જ્ઞાન થયેલું, અને તે પણ પોતાના પૂર્વ લવોનાં સંગાથી ભાઈને બોળવા ગ્રામાતુગ્રામ વિહાર કરતા કરતા કંપિલપુર નગરના ઉદ્ઘાનમાં આવી પહોંચ્યા. ત્યાં એક ખેડૂત અર્ધશ્લોક ગોખ્યો હતો. તે તેમના સાંભળવામાં આવ્યો. એટલે તેમણે ધાર્યું કે જરૂર મહારો ભાઈ અહિંજ છે. એટલે તેમણે ખેડૂતને પાસે બોલાવી તે શ્લોક પૂરો કરી આપ્યો. ખેડૂત હર્ષ પામતો રાજ્યસલામાં ગયો અને નીચે પ્રમાણે શ્લોક બોલ્યો:-

ગોપ દાસો મૃગો હંસો, મર્ત્યામરો યથા પણ ષષ્ઠ્યો જાતિ મન્યામન્ય ભાવિ મુક્તયો

આ સાંભળી અલિક્તત આશ્ર્ય પામ્યો અને પોતાનો ભાઈ આવો દરિદ્ર થયો, એ તેને લાગી આવવાથી તલકાળ તે મૂર્છાં પામ્યો. થોડીવારે શુદ્ધ આવતાં રાજએ દમ દઈ ખેડૂતને પૂછ્યું કે આ શ્લોક તેં બનાવ્યો ? ખેડૂત હાથ જોડી બોલ્યો: ના, મહારાજ. અહિં ઉદ્ઘાન પાસે એક મુનિ પધાર્યા છે, તેમણે આ શ્લોક બનાવ્યો

છે. આ સાંભળી રાજએ ઐહુતને થોડુંક ધન આપી વિદ્યાય કર્યો અને પોતે અશ્વાર્થ થઈ ઉદ્યાનમાં આવ્યો. ત્યાં ધ્યાનસ્થ બેઠેલા ચિત્ત મુનિને તેણે વંદન કર્યું અને કહ્યું:—

અહો બંધુ ! આપણે પાંચ લક્ષીથી ભેગા હતા. ૧ લા લવમાં દાસ. ૨ સૂરગ. ૩ હંસ. ૪ ચંડાળ. ૫ દેવ. અને ૬ હૃદા લવમાં આપણે બંને જુદા પડ્યા તેનું શું કારણ ?

ચિત્ત—અહો અલ્લાહ ! સનંતકુમાર ચક્રવર્તીની સુનંદા ખીને દેખ્યા મુનિપણ્યામાં તું મોહ પામ્યો અને તેને મેળવવાનું તેં નિયાળું કર્યું. તેથી આપણે બંને આ લવે જુદા પડ્યા.

અલ્લાહ—હે લાઈ, ગત જન્મમાં મેં ચારિત્ર પાળ્યું તેનું ઇણ મને પ્રત્યક્ષ મળ્યું. પણ તમે ગત જન્મમાં ચારિત્ર પાળી લિક્ષુક બન્યા અને આ જન્મમાં પણ લિક્ષુકજ રહ્યા, તો તેનું ઇણ તમે કેમ ન પામ્યા ?

ચિત્ત—હે અલ્લાહ. કરેલાં કર્મનું ઇણ તો અવસ્થય છેજ. તું એમ ન સમજતો કે હું સુખી છું અને ચિત્ત હુઃખી છે; મહારે પણ ધણી ઋષિ હતી. પણ એકવાર સાંધુ મહાત્માએ મને સમજાવ્યું કે પ્રભુની વાણી અને જ્ઞાનદર્શનચારિત્રની લીનતામાં અપૂર્વ સુખ છે; તેથીજ મેં જગતતી ક્ષણુભંગુર ઋષિ છોડીને દીક્ષા લીધી છે.

અલ્લાહ—મહારાજ. મારે ત્યાં દેવવિમાન જેવાં સુંદર મહેદ્રો છે. અતુપમ લાવણ્યવાળી ખીઓનાં વૃંદ છે. અગણિત લક્ષમી છે. મારે આપ પણ સાંધુ ધર્મ છોડી મારી સાથે રહો. મને સાંધુપણું હુઃખ્યમય દેખાય છે.

ચિત્ત—હે રાજન ! સર્વ ગીતગાન વિલાપ સમાન છે. નાટા-રંભ વિટંખણા માત્ર છે. અલંકારો ભાર ઇય છે. કામ ભોગો હુઃખ આપનારા છે. વૃથા તેમાં મોહ ન પામ. તે સધળાનું પરિણામ કેવળ

હુઃખ છે. અને તપ સંયમ શીલતામાં ખરું સુખ રહેલું છે. માટે આ ક્ષણિક કામ ભોગો, નાશવંત લક્ષ્મી, અનિત્ય શરીર ઈલાદિનો મોહ છોડો અને પરમ પવિત્ર સુખદાયક ચારિત્ર માર્ગને અછણ કરો.

અલદાત—હે મુનિ. તમારો ઉપદેશ મારા ગળે ક્રોધ રીતે ઉતરે તેમ નથી. આ વैભવ, આ મોજરોખ, અતુલ લક્ષ્મી, સૌંદર્યવાન સ્ત્રીઓ, નોકર, ચાકર, મહેલાતો, છખંડનું આધિપત્ય એ સર્વ મહારાથી ક્રોધ રીતે છોડી શકાય તેમ નથી.

ચિત્ત—હે રાજન. જે તહારાથી તે ન છોડી શકાય તો તું જીવદ્યા આદિ ગૃહસ્થધર્મને અંગીકાર કર અને આત્માની ઉત્સુકશાની ભાવના ભાવ. જેથી તું પરદોક્ષમાં સુખ પામે.

અલદાત—મહારાજ. તેમાંનું કંઈ પણ મહારાથી અની શકે તેમ નથી. માટે વૃથા ઉપદેશ મને ન આપો.

ચિત્ત—હે અલદાત. મહારા ઉપદેશની તને કંઈ પણ અસર થઈ નહિ, તો તારી સાથે આ સધળો ભિથ્યા વાર્તાલાપ થયો. તો હું હું જરૂરિશ.

અલદાત—ભક્તે. આપની જેવી ઈચ્છા.

અલદાતને ચિત્ત મુનિનો ઉપદેશ રૂપ્યો નહિ. ચિત્તમુનિ ત્યાંથી ચાલ્યા ગયા અને તપ સંયમમાં આત્માને ભાવતા ગ્રામાનુગ્રામ વિચરવા લાગ્યા. ધણ્ણા વર્ષો સુધી અપૂર્વ ચારિત્રને પાળી, આત્માની વિશુદ્ધ ભાવના ભાવતાં ચિત્તમુનિ કૈવલ્યજ્ઞાન પામી મોક્ષમાં ગયા. અલદાત ચક્રવર્તી રાજ્યમાં આવી અનેક જુલ્દો, ડિંસા દુરાચારો આદિ મહાન પાપ કિયાઓ સેવવા લાગ્યો. એક આલણુ ખર કોધને વશ થઈ તેણે અનેક આલણોનો સંહાર કર્યો. એ રીતે અનેક પાપનો પુંજ એકડો કરીને અલદાત ચક્રવર્તી ભરણ પામીને સાતમી નરકમાં ઉત્પન્ન થયો. અને મહા દુઃખને પામ્યો.

૮૯ ચુલ્લણીપીતા.

વારાણુસી નગરીમાં ચુલ્લણી પીતા નામે ગાથાપતી હતા. તેમને સ્થાભા નામે સ્વી હતી. તેઓ રિદ્ધિ સિદ્ધિમાં આણુંદ આવકથી બમણું હતા. એક વાર પ્રલુબ મહાવીર પધાર્યા. ચુલ્લણીપીતા વંદન કરવા ગયા, અને પ્રલુના ઉપહેશથી વૈરાગ્ય પામી બારવતધારી આવક થયા. જ્યેષ્ઠ પુત્રને કાર્યાલાર સોંપીને પૌષ્ઠ્રશાળામાં આવીને તે ધર્મ ધ્યાન કરવા લાગ્યા. અર્ધ રાત્રી વીત્યા બાદ એક દેવ પ્રગટ થયો. તેણે ભયંકર રૂપ ખતાવી કામ-હેવની માઝક ચુલ્લણીપીતાને વત ભંગ કરવાનું કહ્યું. પરંતુ તે જરા પણ હશ્યા નહિ, આથી દેવે તેના જ્યેષ્ઠ પુત્રને તેની સામે લાવીને મારી નાખ્યો, અને તેના ત્રણુંકડા કરી, તેના માંસને એક ધગધગતી કડાઈમાં તળાને, તેના લોહીના છાંટા ચુલ્લણીપીતાના શરીરપર છાંટયા. પરિણામે તેને ધર્ણી વેદના થઈ, છતાં પણ પોતાના પ્રતથી તે જરા પણ ચલ્યા નહિ. પછી તે દેવે, તેના ભીજ પુત્રને લાવી જ્યેષ્ઠ પુત્રની માઝક કર્યું. છતાં ચુલ્લણીપીતા લેશ માત્ર હશ્યા નહિ. પછી દેવે તેના ત્રીજ પુત્રને લાવી તેની પણ તેવીજ દશા કરી. તેનું લોહી ચુલ્લણીપીતાના શરીર પર છાંટયું, તો પણ ચુલ્લણીપીતા જરા પણ ક્ષોલ પામ્યા નહિ. તેથી તે દેવ વધારે કોપાયમાન થયો, અને ચુલ્લણીપીતાને તેની માતાને મારી નાખવાનો ભય ખતાવ્યો. ચુલ્લણીપીતા માતાનું નામ સાંલળીને ક્ષોલ પામ્યા અને વિચાર કર્યો કે આ દેવ અનાર્ય છે, અને જેવી રીતે આ ત્રણ પુત્રોને મારી નાખ્યા, તેવીજ રીતે મહારી દેવગુરુસમાન વહાલી માતાને પણ તે મારી નાખશે; એમ ધારી ચુલ્લણીપીતા તે દેવને પકડું વા ઉઠ્યો; તરતજ તે દેવ આકાશભણી નહાસી ગયો, અને ચુલ્લણી પીતાના હાથમાં એક સ્તંભ આવ્યો; તેથી તેણે મોટા શબ્દો વડે કોલાહલ કર્યો. આ સાંલળી તેમની માતા હોડી આવ્યાં અને ભયંકર કોલાહલ કરવાનું કારણ પૂછ્યું, ચુલ્લણીપીતાએ બનેલી

સર્વ હકીકત કહી, તે સાંભળી તેમની માતાએ કહ્યું. હે પુત્ર,
કોઈએ હારા પુત્રોને ઘેરથી લઈ જઈને માર્યા નથી. પણ
કોઈ પુરુષે તને ઉપસર્ગ આએઓ છે અથવા કોઈ માયાવી
દેવે તારી પરીક્ષા કરવા આમ કર્યું લાગે છે. માટે હે પુત્ર, હારાં
વતનો આ રીતે ભંગ થયો છે; માટે પ્રાયશ્રિત લઈને શુદ્ધ થાએ.
ચુદ્ધણીપીતાએ માતાનું વચન માનીને પ્રાયશ્રિત લીધું. પછી તેમણે
૧૧ પ્રતિમા ધારણું કરી, કાળાન્તે સંથારો કરી, ચુદ્ધણીપીતા આવક
કાળધર્મ પામીને સૌધર્મ દેવલોકમાં ગયા અને ત્યાંથી મહાવિદેહ ક્ષેત્રમાં
જન્મી, સર્વ દુઃખનો અંત કરી મોક્ષ ગતિને પામશે.

૬૦ ચુદ્ધણીશતક

આલંબિકાનગરી, ચુદ્ધણીશતક ગાથાપતી, બહુલા નામે તેમની
સ્ત્રી. રિષ્ટિસિદ્ધિ કામહેવ આવક જેટલીજ. પ્રભુ મહાવીર પધાર્યા. ચુદ્ધણીશતક વંદન કરવા ગયા. પ્રભુના ઉપહેરાથી બુજયા અને બાર
પ્રતધારી આવક થયા. મોટા પુત્રને ધરનો કારબાર સૌંપી ધર્મધ્યાન
કરવા લાગ્યા. મધ્ય રાત્રે તેમને ધર્મથી ચળાવવા ભયંકર રૂપ ધારણું
કરીને એક દેવ આવ્યે, અને ચુદ્ધણીપીતાની માઝક તેના પુત્રોને તેની
સમીપ લાવી મારી નાંખ્યા, અને તેનું ભાંસ તળીને કકડા તથા
દોહી તેના શરીર પર છાંટયું. છતાં ચુદ્ધણીશતક જરા પણ ડુયા
નહિ. આખરે દેવે તેનું તમામ ધન હરણું કરીને આલંબિકા નગરી
ની ચોતરણ ફેંકી દેવાનો ભય બતાવ્યો, તેથી ચુદ્ધણીશતક ક્ષોલ
પામ્યા અને દેવને પડડવા દોડ્યા. દેવ નાસી ગયો. કોલાહલ સાંભળી
તેમની સ્ત્રી બહુલા દોડી આવી અને કોલાહલનું કારણ પૂછ્યું-
ચુદ્ધણીશતકે વાત જણાવી. તેની સ્ત્રીએ દેવતાનો ઉપસર્ગ છે, એમ
કહેવાથી ચુદ્ધણીશતકે પ્રાયશ્રિત કર્યું. ચુદ્ધણીશતકે ત્યારાં ૧૧
પ્રતિમા ધારણું કરી. અંતિમ સમયે સંથારો કર્યો અને એક માસનો
સંથારો ભોગવી કાળ કરીને તે પહેલા દેવલોકમાં ગયા, અને ત્યાંથી
ચ્યની તાણો મહાવિદેહ ક્ષેત્રમાં મોક્ષ જરે.

ચેડારાજ (ચેટકરાજ)

તેઓ ખંગળ દેશની વિશાળા નામક નગરીના રાજ હતા. તેઓ ભગવાન મહાવીરના ભામાથતા હતા. ચેડા રાજ જૈન ધર્મી હતા, એટલું જ નહિ પણ તેમણે આવકના બાર પ્રત ધારણ કર્યા હતા. પ્રતધારી છતાં તેમને અનેક રાજઓ સાથે યુદ્ધમાં ઉત્તરવું પડ્યું હતું. પ્રતધારી વિના અપરાધે કોઈના પર ધા ન કરે, કે વિના અપરાધે કોઈને હણે નહિ. પ્રતિપક્ષી લડવાનું કારણ ઉત્પન્ન કરે તો જ તે પ્રતધારી રાજઓ વિગ્રહમાં ઉત્તરતા. ચેડા રાજ મહા સમર્થ અને પરાક્રમી હતા. તેઓ એવા નિશાનાજ હતા, કે તેમણે ઇંકેલું બાણુ કદી નિષ્ઠળ ન જતું. કોણિક સાથેના યુદ્ધમાં કાલિ આદિ કુમારોને પોતાના તરફ પહેલું બાણુ છોડવાનું ચેડારાજએ કહેલું, અને તેઓના બાણો આવ્યા પછી જ, તે બાણો ચૂકવીને પોતે બાણો છોડી તેમનો સંહાર કરેલો. ચંડપ્રધોતાદિ અનેક રાજઓને તેમણે ક્ષમા આપીને છોડી મૂકેલા. કોણિક સામેના વિગ્રહમાં દેવો તેમને વિશાળા નગરીમાંથી ઉદ્ઘાટી ગયા હતા; અને છતિર પ્રદેશમાં તેમણે પોતાનું જીવન પુરું કર્યું હતું. મહારાજ ચેટકને સાત પુત્રીઓ હતી. જૈન-ધર્માને જ પોતાની કન્યા આપવાનો ચેડારાજનો નિરધાર હોવાથી પોતાની છ કન્યાઓ જૈન રાજએ વેરે પરણાવી હતી. માત્ર એક ચેલણું અભયકુમારની યુક્તિથી નહાસી જઈને રાજ એણિક (બૌદ્ધધર્મી) ને પરણી હતી, પણ પછીથી તે રાજ જૈનધર્મી થતાં ચેલણું જૈનમાર્ગાનુયાયિની અની રહી હતી.

૬૨ ચેલણા (ચિલણા દેવી)

તે વિશાળા નગરીના મહારાજ ચેટકની પુત્રી હતી. ચેલણાની ખીજ બહેન સુનયેષા અતિ શપદાન હતી, તેનાથી મોહિત અનીને એણિક રાજએ તેણીને પરણવાનો નિશ્ચય કર્યો. આ માટે અભય

કુમારે એક સુરંગ વાટે સુન્યેધાનું હરણું કરી જવા માટે યુક્તિ રચી. આ વાતની ચેલખણાને ખરર પડતાં તેણે સુન્યેધાને તની સાથે લઈ જવાનું કહ્યું. સુન્યેધાએ તે કખુલ કર્યું. અને બંને જણા સુરંગના સુખ દાર સુધી ગયા. તેવામાં સુન્યેધા પોતાનો હાર ભૂલી જવાથી તે કેવા માટે પાછી દરી. આ તરફ શ્રેણિકરાજએ ઉત્તાવ-ળમાં ચેલખણાને સુન્યેધા ધારીને ઉદાધી અને રથમાં નાખી; ત્યાંથી રાજગૃહમાં આવી શ્રેણિક રાજએ ગાંધર્વ લગ્નથી ચેલખણાનું પાણી-ગ્રહણ કર્યું.

રાણી ચેલખણા પતિલક્તા અને જૈનધર્મમાં સંપૂર્ણ શ્રદ્ધાવંત હતી. રાજ શ્રેણિક બૌદ્ધધર્મી હોવા છતાં ચેલખણાને તેનાં ધર્મપાલનમાં જરાપણ અંતરાય કરતો ન હતો. જેકે વારંવાર તેમને ધર્મ સંબંધી વાદવિવાદ થતો હતો; પરન્તુ તેઓ ધર્મના મૂળ સ્વરૂપને આખરમાં પકડી સંતોષ માની ક્રેતા અને ઉલય એક ખીજના ધર્મ પ્રમાણે વર્તતાં. એક વખત ચિહ્નણાએ શ્રેણિકના આગ્રહથી, બૌદ્ધ લિક્ષુઓને જમવા માટે નોતર્યા. જમણુભાં ખીજ રસોઈ સાથે ચિહ્નણાએ રાધીતું કર્યું હતું. તેમાં લિક્ષુઓની અમુક વસ્તુઓની કરચો કરી ભિશ્રણ કર્યું અને લિક્ષુઓને જમાડયા. જમી રહ્યા બાદ લિક્ષુઓએ પોતાની વસ્તુઓની તપાસ કરી તો તે ગેરવલ્યે પડેલી જણી. તે બાખત ચેલખણાને પૂછતાં ચેલખણાએ કહ્યું, કે આપ તો જ્ઞાની છો, તેથી તે વસ્તુઓ કયાં છે, તે તમે જણુતા જ હશો. પણ લિક્ષુઓને આવું જ્ઞાન ન હતું. આથી ચેલખણાએ તેમને એક ઝાકી આપી. તે ઝાકવાથી લિક્ષુઓને વમન થયું, જેમાંથી ખોવાયલી વસ્તુઓની કરચો નીકળી. આ જોઈ લિક્ષુઓ ઝંખવાણા પડી ગયા.

આ વાત શ્રેણિકના જણવામાં આવ્યાથી, તેણે જૈનધર્મી સાધુની અવગણના કરી, પોતાનું વૈર વાળવાનો નિર્ણય કર્યો. તેણે એક વાર એક એકલ વિહારી સાધુને પકડી એક કોટીમાં પૂર્ણ,

અને તે સાધુની સાથે તેજ કોટડીમાં એક વેશ્યાને પૂરી, કોટડીના દ્વાર બંધ કરાવ્યા. ત્યારપણી શ્રેણિકે મહેલમાં આવીને ચેલણાને કહ્યું કે તારા ગુરુ સ્ત્રીઓ સાથે રાત રહે છે અને વ્યભિચાર સેવે છે. જવાખમાં ચેલણાએ કહ્યું કે અમારા ધર્મગુરુ કંઈ સ્ત્રીઓનો સ્પર્શ ન કરે, પરન્તુ તમારા જ ધર્મગુરુઓ સંબંધમાં આવું હોય. અનેએ આ વાતની સવારમાં પ્રત્યક્ષ ખાત્રી કરવાનું નશી કર્યું.

રાજએ શહેરના લોકોને જૈન ધર્મના સાધુએનું દુષ્ણ નિહાળવા પ્રાતઃકાળ વહેલાસર કોટડી આગળ આવવાનું સૂચન કરાવી દીધું હતું.

આ તરફ સહ્ભાગ્યે મુનિ લખિધવંત હતા. તેથી જૈનધર્મ પરનું કલંક ટાળવા તેમણે પોતાની પાસેનો સાધુવેશ લખિધ વડે આળી મૂક્યો. આથી પેલી વેશ્યા લય પામાને દૂર ઉભી રહી. સાધુએ પોતાનું ઇપ પણ ફેરવી નાખ્યું. સવારે લોકોની દઢુ કોટડી પાસે જમા થઈ.

રાજ અને રાણી તે સ્થળે આવ્યા. રાણીના દેખતાં રાજએ સીલ કરવેલી કોટડી ઉઘડાવી, તો તેનાં ભારે આશ્ર્ય વરચ્ચે રાજએ જૈન સાધુને જોયા નહિ, પણ અન્ય સાધુને વેશ્યા સાથે બહાર નીકળતાં જોયા. આથી રાજ લજણ પામ્યા. ત્યારથી તેમને જૈન ધર્મ પ્રત્યે કંઈક પ્રેમાનુરાગ થયો અને ત્યારથાદ શ્રેણિકરાજ, અનાથી મુનિના સત્સંગથી ચૂસ્ત જૈન બન્યો.

ચેલણા પર રાજને અત્યંત સ્નેહ હોવાથી તેને પદરાણી પહે રથાપી હતી. ચેલણાથી શ્રેણિકને, કોણિક, હલ અને વિહલ નામના ત્રણ પુત્રો થયા હતા. કોણિક ઉદ્દર સ્થાનમાં આવતાં, સતી ચિહ્નાને શ્રેણિકના કાળજાનું માંસ ખાવાનો દોહદ ઉત્પન્ન થયેલો, તે વિચક્ષણ અભયકુમારે પૂરો કર્યો હતો. ચેલણા એક પ્રભાવશાળી અને સતી શિરોમણી સત્તારી હતી.

૯૩ ચંડપ્રદોત્ત

તે ઉજન્યિનીને રાજ હતો; અને ચેડા રાજની પુત્રી શિવા-
દેવીને પરણ્યો હતો. ચંડપ્રદોત્ત વ્યલિયારી રાજ ગણ્યાતો. તેણે
મૃગાવતીને મેળવવા માટે કૌશાંભી નગરીના શતાનિક રાજ પર
ચડાઈ કરી હતી. તેમાં શતાનિક ભય પામ્યો અને ત્રાસને લીધે
તેને કોલેઝ થવાથી તે ભરણું પામ્યો. મૃગાવતીએ જણયું કે ચંડપ્રદોત્ત
હવે મારાપર બળાત્કાર કરશે, એ ભયથી તેણે રાજ સાથે યુક્તિથી
કામ લઈ પોતાનો બચાવ કરવાનો વિચાર કર્યો. રાજ સાથે લગ્ન
કરવાનું આશ્વાસન આપી તેણીએ કૌશાંભીનો કિલ્દો સમરાવવાનું
ચંડપ્રદોતને કહ્યું. એટલે મૃગાવતી મેળવવાની લાલસાએ ચંડપ્રદોતે
કિલ્દો સમરાવવો શરૂ કર્યો. કિલ્દો પૂરો થતાં જ મૃગાવતી દરવાજ
ખંધ કરાવી મહેલમાં ભરાઈ એહી. દરમ્યાન પ્રશ્ન મહાવીર ત્યાં પદ્ધાર્યાં
એટલે મૃગાવતીએ હિંમતપૂર્વક દરવાજ ઉવડાવી નાખ્યા અને તે
પ્રશ્નની દેશના સાંભળવા ગઈ, ત્યાં તેણે વૈરાગ્ય પામી દીક્ષા લીધી.

આથી નિરાશ બની ચંડપ્રદોતે રાજગૃહી પર ચડાઈ કરી
અને તે નગરીને ઘેરો ધાય્યો. આ વખતે અલયકુમારે એક યુક્તિ
રચીને રાજગૃહની બહાર એક લોખંડના વાસણું સોનામહેરો મૂકાવી,
તે વાસણું જમીનમાં દાટાયું અને રાજને કહેવડાયું કે તમારા
સાગ્રીઠો અમારા ધનથી લલચાઈને, તમને પકડી અમારે સ્વાધીન
કરવાના છે, માટે ચેતનો. આથી ચંડપ્રદોતે ખાત્રી કરવા પોતાના
સાથીદારો માંહેના એક રાજના તંયુ આગળ બોદાયું, તો ત્યાંથી
ધન નીકળ્યું. આથી ચંડપ્રદોત્ત નહાસી ગયો, તે સાથે બીજા મદદ-
ગાર રાજનો પણ પોતાના લશકર સાથે રાજગૃહ છોડી નહાસી
ગયા. પાછળથી અલયકુમારના આ પ્રપંચની ચંડપ્રદોતને ખખર
પડી, એટલે તેણે અલયકુમારને પકડી લાવનાર માટે ભારે ધનામ
જહેર કર્યું. અલયકુમારને પકડી લાવવાનું બીજું ઉજન્યિનીની એક

વेश्याए ઝડપ्युં. તે વેશ्यા એક આવિકા હોવાનો દંલ કરી અભય-
કુમાર પાસે રાજગૃહમાં આવી. અભયકુમારે તેણુનો યોગ્ય સતકાર
કર્યો. વેશ્યા પણું અભયકુમારને આદરભાવ આપતી, અને ધાર્મિક
કિયાએ. કરતી અભયકુમારને ત્યાં રહી. દરમ્યાન લાગ સાધી તેણુંએ
અભયકુમારને એકવાર ધેન ઉત્પન્ન કરનારા પદાર્થો ખવરાવ્યા.
આથી અભયકુમાર બેલાન બન્યો, આ તકનો લાલ લઈ યુક્તિ-
પૂર્વક તે વેશ્યા અભયકુમારને ઉજાજયિનીમાં લઈ ગઈ અને રાજ
ચંડપ્રદોત્રને સૌંઘ્યો. છતાં ચંડપ્રદોતે વેશ્યાના આ કૃત્યને છિં ન
ગણ્યું. અહિં અભયકુમારે કેટલીક બાધતોમાં ચંડપ્રદોતને બચાવ્યો,
તેથી તેણું અભયકુમારને છોડી મૂક્યો. પણ ચંડપ્રદોતના જુલ્ભી
વર્તાવથી અભયકુમારે કોઈપણ ઉપાયે ચંડપ્રદોત્રને તેજ ઉજાજયિની
નગરીની મધ્યમાંથી બાંધીને લઈ જવાનો નિરધાર કર્યો.

કેટલાક વખત પછી અભયકુમાર પોતાની સાથે એ સ્વરૂપવાન
વેશ્યાએને લઈ, વળિંકના વેશમાં ઉજાજયિનીમાં આવ્યો અને ત્યાં
ચૌટા વચ્ચે દુકાન કરીને રહ્યો. તે દરમ્યાન એકવાર ચંડપ્રદોત્ર
રાજની દિશિ આ વેશ્યા પર પડી, તેથી તે કામાંધ થયો અને કોઈ
પણ રીતે આ વેશ્યાને મેળવવાનો તેણું નિશ્ચય કર્યો. એકવાર અભ-
યકુમારની ગેરહાજરીમાં રાજએ વેશ્યાને પોતાની સાથે ગ્રેમ સંબંધ
બાંધવા કર્યું, ત્યારે વેશ્યાએ કર્યું કે આ અમારો ભાઈ આજથી
સાતમે દિવસે બહાર ગામ જવાનો છે; તે જાય એટલે સુખેથી તમે
અમારા મજાને આવજો. અહિં અભયકુમારે એક બીજી યુક્તિ કરી
રાખી હતી. તે એ કે, તેણું એક બીજો માણુસ નોકર તરીકે રાખી
લીધો હતો અને તેનું પ્રદોત્ર એવું કૃત્રિમ નામ ધારણ કરાવ્યું હતું.
તેમજ તેને ગાંડ નેવો અનાવી “હું ઉદ્ઘોત છું” એમ બોલતો
બોલતો ખાટલામાં સુવાડી રોજ તેને વૈઘને ત્યાં લઈ જવામાં
આવતો. બરોઅર સાતમે દિવસે પ્રદોત્ર રાજ અભયકુમારના

આવાસે આવ્યો, એટલે લાગ જોઈ અભયકુમારના સુલાદોએ તેને બાંધ્યો. અને ખાટલામાં સ્ફુરાડી ઘાણે દિવસે બજાર વર્ચ્યેથી તેને લઈ જવા લાગ્યા. તે પ્રધોત્ર રાજ 'હું પ્રધોત્ર છું', મને બાંધીને લઈ જાય છે, કોઈ છોડવો' વગેરે મોટા અવાજે ખૂમો મારવા લાગ્યો, પરન્તુ લોકો ગાંડા પ્રધોત્રને ઓળખતા હતા, તેથી કોઈએ તેને છોડવ્યો નહિ. આખરે અભયકુમારે રાજગૃહમાં આવી, રાજ એણિકને ચંડપ્રધોત્ર સુપ્રત કર્યો. એણિક તેને મારવા તત્પર થયા, પરન્તુ ખુદ્ધિમાન અભયકુમારે સમજવીને તેને માન સહિત છૂટો કરાવ્યો અને પોતાનું વૈર લીધું. કામીપુરુષોના કેવા ખુરા હાલ થાય છે તેનો આછો પાતળો ચિતાર આ કથા આપે છે, માટે કામીજનોએ દુર્ગતિ આપનાર કામ વાસનાનો ત્યાગ કરવો.

૬૪ ચંડકૈશિકસર્પ

કોઈ એક નગર હતું. તેમાં એક સાધુ અને એક તેમનો શિષ્ય એ બંને જણા ચાતુર્માસ રલ્લા હતા. શિષ્ય અવિનિત હતો, અને હર વર્ષ ગુરુ સાથે કલેશ કરતો. છતાં ગુરુ સમભાવ રાખતા અને આત્મ ધ્યાન કરતા. ગુરુ તપ્સ્વી હતા. એક વાર માસખમણુને પારણે ગુરુ શિષ્ય બંને ગૌચરી અર્થેનીકળ્યા. વર્પાઙ્કાતુનો સમય હતો. જેથી ધણણાં સુક્ષમ જીવજંતુની ઉત્પત્તિ થઈ હતી. રસ્તામાં એક ભરી ગયેલી દેડકીના કલેવરની નીચે ગુરુનો પગ આવ્યો. શિષ્યે આ જોયું. તેથી ગુરુને કહેવા લાગ્યો. મહારાજ, તમારા પગ તણે બિચારી દેડકી કચરાઈને મરણું પામી. માટે પ્રાયશ્ચિત લ્યો. ગુરુએ ધારીને જોયું તો દેડકીનું કલેવર માત્ર હતું. અને પોતે તેની વિરાધના નથી કરી તેથી ચેલાને કહ્યું કે એ તો કલેવર છે અને પ્રથમથી જ સૃત્યું પામેલ છે, એટલે તેનું પ્રાયશ્ચિત હોય નહિ. ચેલો તો અવિનિત અને હાટાબાજ હતો. તેણે તો હકજ પકડી કે તમારે પ્રાયશ્ચિત દેવું જોઈએ. સાંજે પણ ગુરુએ કહ્યું, કે પ્રાયશ્ચિત ન

હોય. વળી રાતના પણ ગુરુને વારંવાર તે કહેવા લાગ્યો, કે મહારાજ, તમે તો વિરાધિક છો, દેડકીનું પ્રાયશ્ચિત તો લ્યો. આથી ગુરુનું મન કાખુમાં રહી ન શક્યું. શિષ્ય ઉપર કોધ ચડ્યો. તેથી તે હાથમાં રનેહરણું લઈ શિષ્યને મારવા દોડવા. શિષ્ય નાસી ગયો. ઉપાશ્રયમાં અંધાંસું હોવાથી ગુરુ કર્મસંયોગે એક થાંભલા સાથે અથડાયા. માથું કુટી ગયું, ખૂબ લોહી નીકળ્યું; છતાં તેમનો કોધ તો પ્રચંડ જ હતો. સખ્ત વાગવાને લીધે ગુરુએ ત્યાંજ દેહ મૂક્યો. ત્યાંથી મરીને તે જ્યોતિષી દેવતા થયો. ત્યાંથી ચ્યવી ચંડકૌશિક નામે તાપસ થયો, તે પણ ધણ્ણા કોધી હતો. એકવાર બાગમાં રાજકુંવરને કુલ ચુંટો દ્વારી, તાપસ કોધે ભરાયો, અને હાથમાં ઇરસી લઈને મારવા દોડ્યો. રસ્તામાં પગ લપસી ગયો, તેથી તે એક અંધ કુવામાં પડ્યો. ઇરસી પોતાનેજ વાગી અને આર્ત્થાનથી ભરણું પામીને તે ચંડકૌશિક સર્પ થયો. કોધ તો મહાતો નથી, જે કોધને દેખે તેને બાળને ભર્યમ કરે છે, એવા તે સર્પે ધણ્ણા તાપસોને બાલ્યા અને ઇરતા એકેક ગાઉ સુધી તેની ધાક એસી ગઈ. કોઈ પણ માણુસ ત્યાં આગળ જઈ શકતું નથી.

એકવાર શ્રી મહાવીર પ્રલુબ ઇરતા ઇરતા વર્ધમાન ગામ પાસે પખાર્યો. ત્યાંથી જવાને માટે એ રસ્તાએ હતા. એક વડમાર્ગ, ખીને સરળ માર્ગ. લોકોએ પ્રલુને કણ્ણું કે આ સરળ માર્ગ જરૂર નહિ, ત્યાં તો એક વિષધર-ઝરી સર્પ રહે છે. તે લોકોને ભર્યમ કરી દે છે. પ્રલુને તો કંઈ ડર ન હતો. તેથી તેઓ સરળ માર્ગ ચાલ્યા, અને જ્યાં ચંડકૌશિક સર્પનો રાખડો હતો, ત્યાં આવી પહોંચ્યા. સર્પને માણુસની ગંધ આવતા, કોધથી જેર વર્ષાવતો, પુંઝાડા મારતો બહાર નીકળ્યો. પ્રલુબ મહાવીરને ધ્યાનસ્થ જોતાં જ તેમને જેરથી ડંખ માર્યો, તત્કાળ પ્રલુના અંગુઠામાંથી લોહીના બદલે દૂધનો પ્રવાહ દ્શ્ટી નીકળ્યો. તે સામે દાણ કરતાંજ ચંડકૌશિક ચમક્યો, અને મન સાથે વિચાર કર્યો:—અહા,

આ શું, લાલ લોહીને બદલે સરૈદ હુંધ ! આ ડોઈ પ્રભાવશાળી પુરુષ છે, ચંડકૌશિક મુગધ અની ગયો, અને પ્રલુના શરીરમાંથી નિકળતો પદાર્થ પીવા લાગ્યો. તે તેને હુંધ-સાકર જેવો સ્વાદિષ્ટ લાગ્યો. પ્રલુને કહ્યું:- ‘હે ચંડકૌશિક, યુઝ, યુઝ. કોધના પ્રતાપે તે તડાડ ચોક્કું ચારિત્ર બાળાને ભર્મ કર્યું; છતાં તું હજુ કેમ કોધ મૂકતો નથી ? આ શખ્દો સાંલળતાં ચંડકૌશિક વિચારમાં પડ્યો. આત્મચિંતન કરતાં તેને જાતિસ્મરણ જાન થયું. પોતાની ભૂલોનો તે પશ્ચાતાપ કરવા લાગ્યો, અને પોતાના કરેલાં પાપમાંથી ઘૂટવા માટે ચંડકૌશિકે અણુશાણ વત લીધું. પ્રલુ વિહાર કરી ગયા. પછી તે ચંડકૌશિકે સાધુજીવન ગાળવા માંડયું. તેણે પોતાનું મહેં દરમાં રાખ્યું અને ઉંધે ભર્તકે રાફડામાં મહેં અને બહાર શરીર એવી રીતે તપશ્ચર્યા કરી. ત્રાસ એછો થવાથી ભરવાડ વગેરે લોકો તે રસ્તે થઈને જવા લાગ્યા અને તે નાગહેવ ઉપર હુંધ, સાકર, પુણ્ય વગેરે નાખવા લાગ્યા. મોહાશને લીધે ત્યાં ધણી કીડીઓ એકદી થઈને સર્પને વળગી પડી. લોહી, ચામડી વગેરે ખાઈને તે સર્પનું શરીર ચારણી જેવું અનાવી દીધું. છતાં તે સર્પ પોતાના વિષમય સ્વભાવને તદ્દન જ ભૂલી ગયો, તેણે અપૂર્વ ક્ષમા ધારણુ કરી, અને શુલધ્યાનમાં પ્રવર્તતાં કાળ કરીને તે આડમા દેવકોકમાં ગયો.

૯૫ ચંદનબાળા

ચંપાનગરીના દધિવાહન રાજને ધારણી નામની રાણીથી એક પુત્રી થઈ હતી, તેનું નામ વસુમતિ. વસુમતિ કિશોર વય થતાં ભણી, ગણી અને ધાર્મિક તથા નૈતિક ક્રેણવણી લઈને સુશીલ અની. અને સહિયરો સાથે આનંદમાં વખત વીતાવવા લાગી.

એકવાર કૌશાંભી નગરીના રાજ શતાનિકે લશકર લઈ ચંપા નગરીને ધેરો ધાત્યો. દધિવાહન પોતાના લશકરથી ઘૂઅ લડ્યો,

પણ હાવ્યો નહિ. પોતાનું લશકર ભરાયું તેથી બચવાની આશાએ દધિવાહન રાજ નગર છોડીને નાસી ગયો. લશકર ગામમાં પેઢું અને લુંટ ચલાવવા લાગ્યું. ધારિણી રાણી અને વસુમતિ મહેલમાં કલ્પાંત કરે છે, તેવામાં તે લશકરમાંનો એક ઘોડેસ્વાર તે મહેલમાં પેડો, અને બંનેને પકડીને બાંધ્યા. તે ઘોડેસ્વારે ધારિણીને કહ્યું, ચાલ મારી સાથે, હું તને મારી સ્વી બનાવવાનો છું. આ સાંભળતાં રાણીને પ્રાસફો પડ્યો, અને ત્યાંજ જુલ કચરીને તે મરી ગઈ. વસુમતિ ગલરાઈ ગઈ, ઘોડેસ્વારે વિચાર્યુ કે તેની માની માઝક આને પણ હું કહીશ, તો તે મરી જશે. તેથી તેણે બહુજ મીઠાશથી વસુમતિને આશ્વાસન આપ્યું, અને કૌશાંખી નગરીમાં લઈ ગયો. ત્યાં ઘોડેસ્વારે વિચાર કર્યો કે આ કન્યા બહુજ ખુઅસુરત છે, માટે જે તને હું વેચ્યું તો માઝ દારિદ્ર જય અને હું એશારારામ બોગવું, નોકરી કરતાં તો જંદગી ગઈ, પણ કંઈ વળ્યું નહી. તેથી તે વસુમતિને વેચવા કૌશાંખીનગરીની બજારમાં આવ્યો અને લીલામ બોલવા લાગ્યો. (ત્યાં પણ, પક્ષીઓ, ધન, માલ ઉપરાંત મનુષ્યોનું પણ તે વખતે લીલામ થતું) એવામાં એક વેશ્યાએ આવી વસુમતિને ખુખ સુંદર દેખીને મહેઠી ખીટ મૂકી, અને તે લઈ જવાની તૈયારીમાં હતી, તેવામાં ત્યાં ધનાવહ નામનો એક ધનાદ્ય શેઠ આવ્યો, વસુમતિની આકૃતિ જેતાંજ તેને લાગ્યું કે આ એક સુશીલ અને સાધ્વી સ્વી જેવી લાગે છે; અને જરૂર તે ખાનદાન કુંઠાંની હેવી જોઈએ. જે તને વેશ્યા લઈ જશે તો મહા અનર્થ થશે, તેમ ધારી તેણે મહેઠી રકમ આપીને વસુમતિને ખરીદી લીધી.

વસુમતિને તેનું નામ હામ ગામ પૂછતાં તેની આંખોમાં આંસુ લારાઈ આવ્યાં, અને તે બોલી શકી નહિ. શેઠ તને ગલરાયલી જાણીને વધુ પૂછ્યા વગર પોતાને ધેર લઈ ગયો અને પોતાની સ્વી મૂળાને સેંપી, અને તને પ્રેમપૂર્વક પુત્રી તરીકે રાખવા સૂચના કરી.

મૂળા તો ઈર્ષાનું મૂળ હતી, તેણે ધાર્યું કે હું વૃદ્ધ થઈ છું, તેથી શેડ આ કન્યાને પરણવા માટેજ લાવ્યા હશે, અને પછી મહારો કોઈ લાવજ પૂછશે નહિ.

અહિં વસુમતીનું નામ ન ભળવાથી તેનું નામ ‘ચંદનબાળા’ પાડ્યું, પણ મૂળા તો તેને ચંદના કહીનેજ બોલાવતી. મૂળાની અદેખાઈ તો દિનપ્રતિદિન વધતી જ ચાલી અને તેને બહુ દુઃખ દેવા લાગી.

એકવાર શેડ થાક્યા પાક્યા બહારથી આવેલા, ચંદનબાળાએ પગ ધોવા માટે ઉતાવળે શેડને પાણી આપ્યું. ઉતાવળને લીધે ચંદનબાળાનો ભાથાનો અંખોડો છુટી ગયો, નીચે પડવાથી તે બગડશે એમ ધારી શેડે તે અંખોડો પકડી લીધો. ચંદનબાળાએ તે ભાથામાં બરાબર બાંધ્યો, આ દસ્ય પેલી મૂળાના જોવામાં આવ્યું. તેને ખાત્રી થઈ કે જરૂર શેડ ચંદના પર મોઢીત થયા છે, તેથી ચંદનાનો ધાટ ધડી નાખવો સારો છે, એમ વિચારવા લાગી.

કોઈ કામ સારુ શેડ તે દિવસે બહાર ગામ ગયા. મૂળાને લાગ ઝાવ્યો, તેણે તરત હજામને બોલાવી ચંદનબાળાના બધા વાળ કઢાવી ભાયે મુંડો કરાવ્યો, અને પગમાં બેડીઓ પહેરાવી, એક ઓરડામાં પૂરી ખુખ્ય માર ભાર્યો, અને ઓરડાને તાળું લગાવી મૂળા પિથરમાં પહેંચી ગઈ. ચંદનબાળા કર્મનો પશ્ચાત્તાપ કરતી નવકાર મંત્રનું સમરણ કરવા લાગી, તેણે અઠમ તપ શરૂ કર્યો.

ત્રણ દિવસ પછી શેડ ધેર આવ્યા, કોઈ મળે જ નહિ. શેડે તપાસ ઘણ્યી કરી, પણ પત્તો જ ન લાગે, આખરે એક વૃદ્ધ ડોશી-માએ કલ્યાં કે ચંદનાને ઓરડામાં પૂરીને મૂળા પીથર જતી રહી છે. આ સાંભળી શેડને ઘણ્યો કોધ ચડ્યો. તરત જ તેણે ઓરડાના દ્વાર બોલ્યા. તો ચંદનબાળા બેડી છે અને પ્રલુનું સમરણ કરે છે,

માથે મુંડો જોઈ તથા તેનો આ દશા જોઈ શેષતું હૈયું દુઃખથી ભરાઈ આવ્યું.

શેડે ચંદનબાળાને કહ્યું:-બહેન, ધીરજ રાખ. હું અધી વ્યવસ્થા કરે છું. તું ત્રણુ દિવસથી ભૂખી હઠિશી, માટે રસોડામાં કંઈ હોય તો તને આપું. શેડે તપાસ કરી, પણ ખાવાનું કંઈ મળ્યું નહીં, માત્ર ત્રણુ દિવસના આદેલા બાકળા હતા, તે લઈને તેણે ચંદનબાળાને આપ્યા, અને એક સુપડું આપ્યું, જે વડે બાકળા સાંકે કરીને ખાવાનું જણ્યાવ્યું અને તે દરમીયાન પોતે લુહારને બેઠીએ તોડવા માટે બોલાવી લાવવાનું કહીને શેડ ગયા.

અહિં ચંદનબાળા એક પગ ઉંખરામાં અને એક પગ ઉંખરાની બહાર રાખીને, સુપડા વતી બાકળા સાંકે કરી ખાવાનો વિચાર કરે છે. પણ જમતા પહેલાં સાંધુ મુનિને તે ભૂલતી ન હતી, તેણે વિચાર્યું કે જે કોઈ સાંધુ મુનિરાજ બિક્ષા અર્થે અહિં આવે તો હું આ બાકળા તેમને વહોરાવી મહારો જન્મ સાર્થક કરે.

એવામાં એક અભિગૃહધારી મહાત્મા ત્યાંથી નીકળ્યા, ચંદનબાળા પ્રત્યે જોયું, ચંદનબાળા આનંદ પામી. પરંતુ તે વખતે ચંદનબાળાની આંખમાં આંસુ ન હતાં, તેથી તે મહાત્મા ત્યાંથી ચાલ્યા ગયા. આ જોઈને ચંદનબાળા પશ્ચાત્તાપ કરવા લાગી અને બોલીઃ અહો, ધિક્કાર છે મારા જીવનને, આ રંક સામે કોઈપણ જોતું નથી! એમ કહેતાં તેણી રૂદ્ધ કરવા લાગી. તત્કાળ તે મહાત્મા પાછા કર્યા અને ચંદનબાળા પાસે આવી પહોંચ્યા. ચંદનબાળાએ પોતાના જીવનનું અહોભાગ્ય માનીને તે મહાત્માને આ બાકળા વહોરાવી દીધા.

આ મહાત્મા કોણ? સર્વજ શ્રી પ્રલુ મહાવીર, તેમણે ઉપરના સધળાં બોલનો મહાન અભિગૃહ ધાર્યો હતો. પાંચ માસ અને

પચીસ દિવસે આ અભિગૃહ પ્રલુનો પુરો થયો. સુપાત્ર દાનના પ્રકાશથી તરકાળ ચંદનખાળાની બેડીઓ તુટી ગઈ. મસ્તકે સુંદર વાળ આવી ગયા અને દેવતાઓએ ત્યાં ધનની વૃષ્ટિ કરી. વાત ગામભાં પ્રસરી ગઈ, ધનાવહ શેડ લુણારને ઓલાવીને આવ્યો, પણ તે અકિતિ થઈ ગયો. તે પોતાની જલને ધન્ય માનવા લાગ્યો. અને સતીની પ્રથાંસા કરવા લાગ્યો. ધનની વૃષ્ટિ થયાની વાત સાંભળતાં મૂળા તો હાંકળી કંશળી દોડતી આવી, અને ધન લઈ લઈને ખોળાભાં મૂકવા લાગી, પણ તે તો દાઝવા લાગી. કારણું ધન મૂળાના ખોળાભાં પડતાં જ અંગારા થઈ જતા. સૌ કોઈ મૂળાને ધિજારવા લાગ્યા.

ચંદનખાળાએ ત્યાંથી દીક્ષા કેવાનો નિરધાર કર્યો. ધનાવહ શેડ આ સંધળું ધન ચંદનખાળાના દીક્ષા મહેતસવમાં ખર્ચવાનું નક્કી કર્યું.

ચંદનખાળા પ્રલુ મહાવીર પાસે દીક્ષિત થયા, અને આકરાં તપ જ્યું વડે વિશુદ્ધ સંયમ માર્ગમાં પ્રવર્તતાં તેમને ક્રેવળજાન થયું અને નિર્વાણ પામ્યા.

૬૬ ચંદ્રછાયા.

એ અંગદેશની રાજ્યધાની ચંપાનગરીના રાજ હતા. પૂર્વભવમાં તે ધરણ નામે મહાયળકુમારના ભિત્ર હતા, તેમણે મહાયળ સાથે દીક્ષા લીધી હતી, અને તપના પ્રભાવે જ્યાંત નામના અનુતર વિભાનમાં ઉત્પન્ન થયા હતા. ત્યાંથી ચ્યાવી તે ચંપા નગરીમાં રાજ્યકુમાર તરીકે અવતર્યા. યોગ્ય સમયે રાજગાઢી પર આવ્યા. તે નગરમાં અર્ધનક નામે શ્રાવક વ્યાપારી હતો. એકવાર તે વહાણો લઈ દેશાવરમાં વેપાર કરવા ગયેલો, ત્યાંથી મુણ્ણળ ધન કાબાઈને દેશમાં આવતો હતો, તેવાભાં રસ્તાભાં તેને દેવ પાસેથી દિવ્ય કુંઝનો

મહિયાં, તે તેણે દેશમાં આવી ચંદ્રછાયા રાજને લેટ આપ્યા. રાજને શેરને કાંઈ નવાઈ ઉપજવે તેવી વસ્તુ પરહેશમાં જોવામાં આવી હતી કે કેમ, તે સંખ્યાં પૂછયું. વેપારીએ કહ્યું કે ભિથિલા નગરના કુંભરાજની પુત્રી મહલીકુમારી જગતને આશ્ર્ય ઉપજવે તેવી ઇપ્સ-સુંદર કન્યા છે. આ સાંલળી રાજને તેણુંને પરણુવાની મનોભાવના થઈ, તેથી તેણે કુંભરાજને ત્યાં પોતાનો હૂત મોકલ્યો. કુંભરાજને ના કહેવાથી જિતશત્રુ વગેરે રાજનો સાથે મળી જઈને ચંદ્રછાયાએ ભિથિલાપર ચડાઈ કરી. ત્યાં મહલીકુંવરીએ સોનાની પ્રતિમા વડે તેને ઓધ પમાડ્યો, પરિણ્ણામે ચંદ્રછાયાએ દીક્ષા લીધી. સખ્ત તપ જપ કરી, અંત સમયે અનશન કરી તેઓ મોકાબી ગયા.

૨૭ ચંદ્રપ્રભુ.

ચંદ્રાનના નામની નગરીમાં મહાસેન નામે રાજ હતા. તેમને લક્ષમણા નામે રાણી હતી, તેમની કુક્ષિમાં વૈજ્યંત વિમાનમાંથી ચ્યવીને ચૈત્ર વદ્દ પાંચમે શ્રી ચંદ્રપ્રભુ ઉત્પન્ન થયા. ભાતાએ ચૌદ સ્વઘન જોયાં. પોષ વદ્દ ૧૨ના રોજ પ્રલુનો જન્મ થયો. ૫૬ દિગુકુમારિકાએ સૂતિકાકર્મ કર્યું. ૬૪ દિગ્રેને આવી ભાવી તીર્થ-કરનો જન્મોત્સવ ઉજવ્યો. ગર્ભ વખતે ભાતાને ચંદ્ર પીવાનો દેહદ ઉત્પન્ન થયેલો, તેથી પુત્રનું નામ “ચંદ્રપ્રભ” પાડ્યું. બાલ્યકાળ વીતાવી યુવાવસ્થા પામતાં ચંદ્રજિનને યોગ્ય રાજકન્યાએ સાથે લમ્બ કર્યું. તેમનું દેહમાન ૧૫૦ ધનુષ્યનું હતું.

અઠી લાખ પૂર્વ સુધી તેઓ કુમારપણે રહ્યા. તે પછી પિતાની ગાદીએ આવ્યા. સાડા ૭ લાખ પૂર્વ ઉપર ચોનીસ પૂર્વાંગ સુધી તેમણે રાન્ય કર્યું. પછી પ્રલુએ વાર્ષિક દાન આપી પોષ વદ્દ ૧૩ને દિવસે એક હજાર રાજનો સાથે ચારિત્ર ગ્રહણ કર્યું. ત્રણુ માસ છદ્મરથ અવસ્થામાં રહેતાં જ શ્રી ચંદ્રજિનને ઇલ્યુન વદ્દ

સાતમે કૈવલ્યજીન ઉત્પન્ન થયું. તેમને ૮૭ ગણુધરો હતા, તેમાં સૌથી મોટા દત્ત હતા.

ચંદ્રપ્રભુના સંધ પરિવારમાં ૨૩ લાખ સાધુ, ૩૮૦ હજાર સાધ્વીઓ, ૨૩ લાખ આવકો અને ૪૬૧ હજાર આવિકાઓ હતા. એક લાખ પૂર્વમાં ૨૪ પૂર્વિંગ અને ત્રણ માસ ઓછા, સમય સુધી ગ્રલુ કૈવલ્યજીનપણે વિચર્યા અને પછી એક હજાર મુનિઓ સાથે સમેતશિખર પર એક માસનો સંથારો કરી ભાડરવા વદ્દિ ૭ મે પ્રભુ નિર્વાણ-મોક્ષ પામ્યા, તેમનું આયુષ્ય દરશ લાખ પૂર્વનું હતું.

૮૮ ચંદ્રયશ

માલવહેશની સુદર્શન પુરી નગરીના યુગરાજ યુગભાડુની પત્ની મયણુરેહાનો તે પુત્ર હતો. પોતાના પિતા યુગભાડુનો તેમના મોટા-ભાઈ મણિરુથે ધાત કર્યો, અને નાસતાં નાસતાં છેવટે સર્પદંશથી મણિરુથ પણ મૃત્યુ પામ્યો, એટલે માલવ હેશના રાજ્યનો અધિપતિ ચંદ્રયશ થયેા. તેણે રાજ્ય સારી રીતે ચલાંયું. એકવાર હેણા નાનાભાઈ નભિરાજનો હાથી તોકાનમાં આવી પોતાની સીમમાં આવી ચડ્યો. ચંદ્રયશે તેને વશ કરી કણને લીધો. નભિરાજે તે પાછો માર્યો, ચંદ્રયશે આયેા નહિ, આથી બંને ભાઈઓ યુધ્યે ચડ્યા. પોતે બંને ભાઈઓ છે એવું એક બીજી જણતા ન હતા. આખરે મયણુરેહા, જે સાધ્વી થઈ હતી, તેણે બંનેની ઓળખાણ કરાવી; પરિણામે યુદ્ધ બંધ રહ્યું અને માળવહેશનું રાજ્ય નભિરાજને સુપ્રત કરી ચંદ્રયશ રાજાએ દીક્ષા લીધી અને તે દેવકોકમાં ગયા.

૮૯ જમાલી.

ક્ષત્રિયકુંડ નગરમાં જમાલી નામનો ક્ષત્રિય કુમાર હતો. તે રિદ્ધિ સિદ્ધિમાં સુવિભ્યાત હતો. એક વાર પ્રભુ મહાવીર વિહાર

કરતાં કરતાં ત્યાં પધાર્યા. પરિષદ વાંદળ કરવા ગઈ. જમાલી પણ વાત જાણવાથી અશ્વ પર આડદ થઈને પ્રલુને વાંદળવા ગયો. પ્રલુને દેશના આપી. જમાલી પ્રતિઓધ પામ્યો. ત્યાંથી ઘેર આવી માતા પિતાની રજ મેળવી, પાંચસો માણસો સાથે દીક્ષિત થયો. દીક્ષા લઈને જમાલીપુત્ર પ્રલુ મહાવીરની સાથે તપ સંયમથી આત્માને ભાવતાં વિચરવા લાગ્યા. એકવાર જમાલીએ પ્રલુ મહાવીરને કહ્યું કે મહારે જન પદ દેશમાં વિહાર કરવાની ઈચ્છા છે. પ્રલુ મહાવીર જાણતા હતા કે મેરું નેમ નિશ્ચળ પુરુષો જ જન પદ દેશમાં ટકી શકશે. તેથી તેઓએ તે વાતને આદર આપ્યો નહિ, અને મૌન રહ્યા. જમાલી અણુગાર પોતાની સાથે પાંચસો શિષ્યોને લઈ પ્રલુ મહાવીરની પણ અવગણુના કરીને જનપદ દેશમાં વિહાર કરવા લાગ્યા. ઇરતા ઇરતા તે શ્રાવસ્તિ નગરીના કોષ્ટક ઉદ્ઘાનમાં પધાર્યા. તે સમયે નિઃરસ અને તુચ્છ આહાર જમવાથી જમાલીના શરીરમાં રોગ ઉત્પન્ન થયો. અને અસંખ્ય વેદના થવા લાગી, તેથી પોતાને માટે પથારી કરવાનું તેમણે ભીજ મુનિને કહ્યું. પીડા અસંત થતી હોવાથી બે ત્રણ વાર તેમણે મુનિને કહ્યું: મારી પથારી કરો. છો કે કરી છે? મુનિએ જવાબ આપ્યો. તમારી પથારી કરી નથી પણ કરીએ છીએ.

જમાલીને પ્રલુ વચનમાં તરત શાંકા થઈ કે પ્રલુ મહાવીર પ્રરૂપે છે કે ‘ચાલવા માંડે તેને ચાલ્યો કહીએ. નિર્જરતો હોય તેને નિજર્થી કહીએ’ તે ખોટું છે. કેમકે પથારી કરતા થકા કરી નથી. પાથરતા છતાં પાથરી નથી. આ વાત તેમણે ભીજ સાધુઓને સમજલ્લી. તે વાત કેટલાકને ઇચ્છી અને કેટલાકને ન ઇચ્છી. ન ઇચ્છી તેઓ ચાલ્યા ગયા અને ઇચ્છી તેઓ જમાલી પાસે રહ્યા. જમાલી વિરુદ્ધ પ્રરૂપણું કરવા લાગ્યા. ત્યાંથી તે પ્રલુ મહાવીર પાસે આવ્યા અને કહ્યું કે મને કેવલ્યજ્ઞાન થયું છે, હું અરિહંત, જિન, કેવળી છું.

આ સાંભળી જૈતમ અણુગારે કહ્યું, કે જે તમે ડેવળા હોતો કહો,
કે:—દોક શાશ્વત કે અશાશ્વત. જીવ શાશ્વત કે અશાશ્વત?

જમાલી જવાબ ન આપી શક્યા. પ્રલુચે કહ્યું કે મહારા છુદુ-
મરસ્થ શિષ્યો પણ આનો જવાબ આપી શકે છે. પણ જેવું તમે બોલો
છે તેવું હું બોલતો નથી. એમ કહી પ્રલુચે દોક અને જીવનું સ્વરૂપ
સમજાવ્યું. છતાં તેમણે માન્યું નહીં અને પ્રલુચી જુદા પડી, વિરદ્ધ
પ્રશ્પણું કરતા વિચરવા લાગ્યા. ધણ્યા વર્ષ સાંધુ પ્રવળયાં પાળીને,
અલિનિવેશક મિથ્યાત્વના ઉદ્ઘથી તે મરીને છઢા લંતક દેવલોકમાં
કિલ્વીધી દેવ થયા. સંસાર પક્ષે જમાલી પ્રલુભમહાવીરના જમાઈ
થતા હતા.

૧૦૦ જ્યધોષ

તેઓ વણુરસો નગરીમાં આલણુ કુળમાં અવતર્યા હતા;
પરન્તુ જેન ધર્મની ઉલ્કષ્ટતા નિરખી તેમણે પંચમહાવત રૂપ જેન
ધર્મની દીક્ષા અંગીકાર કરી હતી. ઇરતા ઇરતા તેઓ એજ વણુ-
રસો નગરીમાં પધાર્યા અને મનોરમ નામક ઉદ્ઘાનમાં ઉત્તર્યા. તેજ
નગરીમાં વિજ્યધોષ નામના ચાર વેદમાં પારંગત એવા એક આલણે
થતું આરંભ્યો હતો, તે યજના સ્થાને જ્યધોષ મુનિ માસક્ષમણુના
પારણે લિક્ષ્યા કેવા માટે આવી ઉલા. મુનિને દેખી વિજ્યધોષ
બોલ્યો:—હે લિક્ષ્ય, આ તો વિપ્રનું ધર છે. જે વિપ્ર વેદને જાણુતો
હોય, જે યજનો અર્થી હોય, જ્યોતિષશાસ્ત્ર તથા વિપ્રશાસ્ત્રના છ
અંગનો પારગાની હોય, તેમજ જે ધર્મશાસ્ત્રનો જાત હોય તથા
પોતાના અને પરના આત્માને જે સંસાર સમુદ્રથી તારવા સમર્થ
હોય, તેવા વિપ્રોને માટે જ આ અન્ન નીપણવેલું છે; તારા જેવાને
માટે આ રસોઈ બનાવી નથી, માટે આમાંથી તને કાંઈ ભળશે
નહિ, માટે બીજે રથણે લિક્ષા ભાગવા જી. જ્યધોષ મુનિ સમતાના
સાગર હતા. તેઓ વિજ્યધોષના આ અપમાનિત શબ્દોથી કેય
પણ કોધાયમાન ન થયા. તેમણે વિચાર્યું કે આ વિજ્યધોષની

અગ્નાનતા ભારે ટાળવી જોઈએ, અને અંધકાણું આલણોની સાન ઠેકણે લાવી મોક્ષનો સાચો માર્ગ ભારે બતાવવો જોઈએ, એ આશયથી જ્યધોષ મુનિ ત્યાંથી ખર્સ્યા નહિ, પણ તેમણે વિજય-ધોષને કહ્યું:-વિપ્ર, વેદમાં મુખ્ય કોણ ? યજમાં મુખ્ય કોણ ? નક્ષત્રમાં મુખ્ય કોણ ? ધર્મમાં મુખ્ય કોણ ? અને સંસાર સમુદ્રથી ઉદ્ઘારનાર કોણ ? તે તું જણે છે ? જે જાણુતો હોય તો આ પ્રશ્નોના ઉત્તર આપ. વિજયધોષ આ પ્રશ્નોના જવાબો આપવા માટે અસર્મથ્ર હતો. તેણે જ્યધોષને કહ્યું:-મુનિ, તુંમેજ આના જવાબો કૃપા કરીને આપો.

મુનિ બોલ્યા:-વેદમાં અગિનહોત્ર મુખ્ય છે. અગિનહોત્ર કેવો હોય તે સાંભળ. ૧ જીવરૂપ કુંડું. ૨ તપ્રેષ્પ વેદિકા. ૩ કર્મરૂપી ઈધણુ. ૪ ધ્યાન રૂપ અગિન, ૫ શરીરરૂપ ગોર, ૬ શુલયોગ રૂપ ચાટવા, ૭ શુલ ભાવના તથા જીવદ્યા રૂપી આહૃતિ, એવો અગિનહોત્ર વેદમાં મુખ્ય છે. જે વેદમાં આવો અગિનહોત્ર કંદ્બો હોય તે વેદ પ્રમાણું છે. વળો એ સંયમરૂપ યજના અર્થી સાધુઓ યજને પ્રવર્તાવનાર છે, નક્ષત્રમાં ચંદ્રમા મુખ્ય છે, ધર્મના પ્રરૂપકોમાં લ૦ ઋષભદેવ અને લ૦ ભહાવીર પ્રમુખ તીર્થોકરો મુખ્ય છે; જેમ ગ્રહ, નક્ષત્ર, અને તારાઓ ચંદ્રમાની સેવા કરે છે, તેમ ઈશ્વરાદિ દ્વો તીર્થોકરોની સેવા કરે છે. જેઓ વેદ તત્ત્વના અન્યાંસું છે, મોહવંત છે અને જેમના હૃદયમાં કૃપાયરૂપી અગિન ભરેલો છે, જેઓ સ્વાધ્યાય અને તપ કરતા નથી, એવા વિગ્રો, જેઓ તપ કરે છે તેમને હું વિપ્ર કહેતો નથી; પણ જેઓ સ્વજનાદિના સ્થાનકે જવાથી નારાજ ન થાય અને ત્યાં રહેવામાં આસક્તા ન ઘને એવા તીર્થોકર દેવોએ કહેલા આલણોને જ હું આલણ કહું છું. જેણે તપ રૂપ અગિ વડે કર્મરૂપ મેળને બાલ્યો છે, તેમજ રાગ, દેપ અને દોકાદિક સાત ભય તજયા છે, તેને હું આલણ કહું છું. જેઓ ઈદ્રિયોને દમનાર, તપશ્ચર્યામાં આનંદ માનનાર અને કૃપાયોને

સમાવનાર છે, તેમને જ હું આલણુ કહું છું. જે જીવદ્યા પાળે, સત્ય બોલે, વગર આપ્યું એક તણાખણું સરખું પણ ન લ્યે, અલિચર્ય પાળે અને નિષ્પરિશ્રહી અને, તેને હું આલણુ કહું છું. સંસારના ડામભોગને વિષે લુણ્ધ ન થાય તેમજ સંયમ અને તપને માટે માત્ર શરીર નીભાવવાના હેતુથી જ ખોરાક લે છે, પણ ઈદ્રિયાની વિકારવૃદ્ધિ અર્થે ખોરાક લેતો નથી, તેને જ હું આલણુ કહું છું.

હે વિજયધોષ, આ પશુઓની હિંસાથી યજ્ઞ કરનાર તો ઉલટા દુર્ગતિમાં જનાર છે. વળી માથું મુંડવવાથી સાધુ ન કહેવાય, ઊંકાર ભણવાથી આલણુ ન કહેવાય, વનમાં વસે તેજ મુનિ, એમ ન કહેવાય અને ભગવાં પહેરે તેજ તાપસ ન કહેવાય. પરન્તુ જે શત્રુ તથા ભિત્ર પર સમભાવ રાખે તે સાધુ, અલિચર્ય પાળે તે આલણુ, શાન હેઠ તે મુનિ અને બાર પ્રકારનો તપ કરે તે તાપસ કહેવાય. આવો અહિસામય ધર્મ સર્વજ્ઞ તીર્થકર દેવોએ પ્રદાયો છે. આવી રીતે જ્યધોષ મુનિએ ‘આલણુ કેને કહેવાય’ એ સંબંધીનું યથાર્થ રહસ્ય વિજયધોષને સમજાવ્યું. વિજયધોષે આથી પ્રસન્ન થઈ જ્યધોષને આહાર પાણી લેવાનું આમંત્રણ આપ્યું, પરન્તુ જ્યધોષે કહ્યું:-હે આર્ય, મારે બિક્ષાનું ખાસ પ્રયોજન નથી, પરન્તુ આ ધોર સંસારસમુદ્રમાંથી શીંગ તરવા માટે કટિયદ્ધ થા અને સંયમ અંગીકાર કર. આ સાંભળો વિજયધોષે જ્યધોષ મુનિ પાસે જૈન ધર્મની દીક્ષા લીધી. ત્યારબાદ બંને મુનિવરો સખ્ત તપ, જ્ય, કિયાએ કરી પૂર્વ કર્મોનો ક્ષય કરી કૈવલ્યજ્ઞાન પામ્યા અને મોક્ષમાં ગયા.

૧૦૧ જ્યન્તો.

એ કૌશામ્યી નગરીના રાજ શતાનિકની બહેન અને ઉદાયન રાજની ઝેાર્થ થતી હતી. ભગવાન મહાવીરહેવની તે પરમ અમણો-પાસિકા હતી. તેને જીવ અજીવાદિ નવ તત્ત્વના રહસ્યનું સારું શાન

હતું. એકવાર ભગવાન મહાવીર તે કૌશામ્ભી નગરીમાં પધાર્યો. જયંતી શ્રાવિકા ઉદાયન રાજ, મૃગાવતી વગેરેની સાથે ભગવાનને વંદન કરવા ગઈ. ભગવાને ધર્મકથા કહી. સર્વ પરિષદ દેશના સાંલળી પાછી વળી. લારખાદ જયંતીએ ભગવાનને વંદણા—નમસ્કાર કરો પૂછ્યું:—ભગવાન, જીવ ભારેપણું શાથી પામે? ભગવાને જવાબ આપ્યો:—પ્રાણુત્પાતાદિક હિંસા કરવાથી તથા મિથ્યાત્ત્વ, દર્શન અને શત્યથી. પુનઃ જયંતીએ પૂછ્યું:—પ્રભુ, જીવ હલકો શાથી થાય? સંસાર કેવી રીતે વધારે તથા પરિત્સંસારી કેમ થાય? આ પ્રશ્નોના ચો઱્ય જવાબો પ્રભુએ આપ્યા. પુનઃ જયંતીએ પૂછ્યું: પ્રભુ, જીવને ભવસિદ્ધિપણું સ્વભાવથી હશે કે પરિણામથી? સધળા ભવ્ય જીવો સિદ્ધ થશે? પ્રભુએ કહ્યું:—હા, લારે જયંતીએ કહ્યું કે શું ત્યારે આ લોક ભવ્ય જીવો વિનાનો થશે? ભગવાને કહ્યું: ના. વળી જયંતીએ પૂછ્યું:—પ્રભુ, જીવ જગતા ભલા કે ઉંઘતા ભલા? પ્રભુએ કહ્યું કે ધર્મી જીવો જગતા ભલા અને અધર્મી જીવો ઉંઘતા ભલા. ઇરી તેણે પૂછ્યું કે જીવ બળીયા ભલા કે દુઃખા ભલા? જીવ ઉદ્ધમી ભલા કે આળસુ ભલા? ભગવંતે જગતા ઉંઘતા જીવોની માઝેક જવાબ આપ્યો. આ પ્રમાણે પ્રભુને અનેક પ્રશ્નો પૂછી, તેનું સમાધાન પામી જયંતી સ્વગૃહે ગઈ. કેટલાક વખત પછી તેણે પ્રભુ પાસે દીક્ષા લીધી. ત્યારખાદ સખ્ત તપ જપ કિયાઓ કરીને તેઓ મોક્ષમાં ગયા.

૧૦૨ જયસેના.

શ્રી નમિનાથ ભગવાનના તીર્થમાં જય નામે ખીન ચક્રવર્તી થયા. તેઓ રાજગૃહ નગરના વિજય નામક રાજની વપ્રા નામક રાણીના પુત્ર હતા. પિતાની પછી તેઓ રાજગાડી પર આવ્યા. કેટલાક સમય પછી તેમને ચક્રરત્ન વડે ચક્રવર્તીની ઋક્ષિ મળી. છ ખંડનું રાન્ય ભોગવી આખરે તેમણે ચારિત્ર લીધું અને કેવળ-રૂનાં પામી મોક્ષમાં ગયા.

૧૦૩ જરાકુમારો.

તેઓ કૃષ્ણ વાસુદેવના ઓરમાન ભાઈ હતા. ગજસુકુમારનું સોમિંગ આપેલા પરિસહ વડે મૃત્યુ થયાથી, કૃષ્ણે પોતાનું પુસ્ય ઓછું થયું જાણી શ્રી નેમનાથ પ્રલુને પૂછેલું કે મારં મૃત્યુ કેવી રીતે થશે ? પ્રલુએ કહેલું કે દૈપાયન ઝડપિના કોખનો લોગ બની દારિકા નગરી બળશે, તેમાં તમે તથા બળલદ બચી જશો. અને તમારં મૃત્યુ તમારા ઓરમાન ભાઈ જરાકુમારના હાથથી થશે. આ વાતની જરાકુમારને ખખર પડતાં, તે પોતાના હાથથી ભાઈનું મૃત્યુ થતું બચાવવા દારિકા નગરી છોડી ગયા અને વનમાં રહેવા લાગ્યા; પણ નિમિત મિથ્યા થતું નથી. એ અનુસાર દારિકા નગરી બળી લારે કૃષ્ણ અને બળલદ દારિકા છોડીને, પાંડવોને શરણે જવા ચાલી નીકળ્યા. રસ્તામાં શ્રીકૃષ્ણને તૃપા લાગી. બળલદ તેમને માટે પાણી શોધવા ગયા. દરમ્યાન જરાકુંવર કરતા કરતા તે સ્થળે આવ્યા અને કૃષ્ણના પગના પહુંચને લીધે મૃગનો લાસ થવાથી તેમણે બાણ છોડ્યું. તે બાણ કૃષ્ણના પગને વીધી કપાળમાં વાગ્યું; એટલે કૃષ્ણે ભૂમ પાડી, આ સાંલળી જરાકુમાર ચમક્યા અને કૃષ્ણને મૂર્છાગત સ્થિતિમાં જોઈ પશ્ચાત્તાપ કરતા વિલાપ કરવા લાગ્યા. તેને શ્રીકૃષ્ણે કહ્યું:-ભાઈ, બનવા કાળ ઘને છે, વૃથા શોક કરવાથી કાંઈ વળે તેમ નથી, પણ તું હવે જલ્દી અહિંથી જતો રહે, કારણ કે મારા માટે પાણી કેવા ગયેલા બળલદ અહિં આવી પહોંચશે તો તમને મારી નાખશો. જવાખમાં જરાકુમારે કહ્યું:-ભાઈ, આવી અવર્થામાં તમને અહિં મુક્તિને મારાથી કેમ જવાય, આખરે શ્રીકૃષ્ણના ખૂબ સમજવવાથી જરાકુમાર કૃષ્ણના હાથની મુદ્રિકાની નિશાની લઈ પાંડવોને ખખર આપવા માટે પાંડુ મથુરા ભણી ચાલ્યા ગયા; જ્યાં તેમણે પોતાનું શેષ જીવન વિતાવ્યું.

૧૦૪ જરાસંધ.

રાજગૃહ નગરના બૃહદ્રથ રાજનો તે પુત્ર હતો. પિતાની પછી તે ગાઢીએ એડો અને અર્ધ ભરતના ત્રણ ખંડ જીતી પ્રતિવાસુદેવ થયો. તેને જીવયશા નામે પુત્રી હતી. એક વખત તેણે સમુદ્રવિજય રાજને સિંહપુરના રાજ સિંહરથને હરાવી, પકડી લાવવાનું કહ્યું અને તે સાથે જણાયું કે તેને પકડી લાવનારને હું મારી જીવયશા નામક પુત્રી પરણાવીશ. શ્રીકૃષ્ણના પિતા વસુદેવે પોતે લડવા જવાની સમુદ્રવિજય પાસે માગણી કરી અને તે કંસને લઈને સિંહરથ સામે લડવા ગયા. લડાઈબાં સિંહરથ રાજને કેદ કરી જરાસંધ આગળ રજુ કર્યો. જરાસંધે વસુદેવને પોતાની પુત્રી જીવયશા આપવાનું કહ્યું, ત્યારે વસુદેવે કહ્યું કે સિંહરથને પકડનાર ઉત્ત્રસેન રાજનો પુત્ર આ કંસ છે, માટે તેમની સાથે આપની પુત્રી જીવયશા પરણાવો. આથી જરાસંધે પોતાની પુત્રી કંસને પરણાવી. અને નગરની માગણીઓ કંસે મથુરા માયું તે જરાસંધે તેને આપ્યું. કંસ લશકર લઈ મથુરા આવ્યો અને ઉત્ત્રસેનને કેદ કરી પોતે રાજ થયો. પાછળથી કંસને શ્રીકૃષ્ણે માર્યો, તેથી જીવયશા પોતાના બાપ જરાસંધ આગળ ફરિયાદ કરવા ગઈ. આથી જરાસંધે સમુદ્રવિજય પાસે રામ (બળબદ્ર) તથા કૃષ્ણની માગણી કરી, પણ સમુદ્રવિજયને પુત્રોને સંહાર માટે સોંપવા ઉચિત ન લાગવાથી તેમ જ જરાસંધ જેવા સમર્થ પ્રતિવાસુદેવ સામે લડવા જેટલું સામર્થ્ય ન હોવાથા, એક નૈમિત્તિકની સલાહથી તેઓ મથુરા અને સૌરીપુરથી નાસી પશ્ચિમ લણી ચાલ્યા ગયા. તેમને પકડવા જરાસંધે પ્રથમ પોતાના પુત્ર કાળને મોકલ્યો, પણ શ્રીકૃષ્ણના પુરુષ બળે રસ્તાબાં દેવોએ તેને માર્યો. યાદવો આગળ વધ્યા. સમુદ્રકાંડે આવી શ્રીકૃષ્ણે અઠમ તપ કર્યો. આથી દેવે આવી તેમને દ્વારિકા નગરી વસાવી આપી. યાદવોએ દ્વારિકાબાં કૃષ્ણને રાજ હરાવ્યો. આ વાત જરાસંધે જણવાથી તે

એક મોટું લસ્કર લઈ દારિકા પર ચડી આવ્યો. જરાસંધ ગ્રતિ-
વાસુદેવ વાસુદેવ શ્રીકૃષ્ણને મારવા ચક્રતન છોડ્યું, તે ચક્ર કૃષ્ણના
શરીરની પ્રદક્ષિણા કરી કૃષ્ણના હાથમાં બેઢું, તેજ ચક્રતન વડે
શ્રીકૃષ્ણે જરાસંધનો નાશ કર્યો.

૧૦૫ જસા.

ઇષુકાર નગરમાં ભૂગુ નામના પુરોહિતને જસા નામની સ્ત્રી
હતી. તે ઇષુકાર રાજની સાથે નલિનીગુલ્ભ વિમાનમાંથી ચ્યવી
હતી. તેમને એ પુત્રો હતો. તે પુત્રો વૈરાગ્ય પામી દીક્ષા લેવા માટે
તત્પર થયા, ત્યારે ભૂગુ પુરોહિતને પણ દીક્ષા લેવાનો પોતાનો મનોભાવ
થયો, તે તેણે પોતાની પત્ની જસાને જણાવ્યો. જસાએ કહ્યું:-સ્વામિન,
હમણા થોડો વખત આપણે સંસારના સુખો લોગવીએ, પછી દીક્ષા
લઈશું. ત્યારે પુરોહિતે કહ્યું કે આપણા પુત્રો જ્યારે ચારિત્ર ગ્રહણ
કરે છે, સારે આપણે ઝાડના ફુંદાની જેમ સંસારમાં પડી રહીએ
તે નકામું છે. માટે હું તો સંયમ લઈશ જ. આ સાંભળી જસાને
પણ દીક્ષિત થવાનો અભિલાષ થયો. અને તેણે તેઓની સાથે
દીક્ષા લીધી. સખત તપ, જ્ય, ક્રિયાએ કરીને જસા કૈવલ્યરાન
પામી મોક્ષમાં ગઈ.

૧૦૬ જશોભદ.

નલિનીગુલ્ભ વિમાનમાંથી ચ્યવીને, ઇષુકાર નગરમાં ભૂગુપુરો-
હિતની જસા નામની સ્ત્રીની કુક્ષિએ તે પુત્રપણે અવતર્યો. તેને
દેનભદ્ર નામે બીજે એક લાઈ હતો. બંને લાઈએ દેવદોકમાં સાથે
હતો. અહિંયા બંનેને સ્નેહ ધર્યો હતો. ભૂગુ પુરોહિતે પોતાના
બંને પુત્રોને વેદાદિ શાસ્ત્રોમાં પારંગત બનાવ્યા અને કહ્યું કે:-
રહ્યે જૈનના સાધુનો કદી સંગ ન કરશા; કારણુકે તેઓ ઊળીમાં
શસ્ત્રો રાખે છે, ને બાળકોને જેર જુલભી સાધુ કરે છે; અને

જે કોઈ સાધુ ન થાય, તો તેને મારી નાખે છે. આ પ્રમાણે કહેવાથી બંને પુત્રો સાધુથી હંમેશાં સાવધાન રહેતા. ભૂગુ પુરોહિતે પણ નગરમાંથી નીકળી બહાર પરામાં વાસ કર્યો હતો. એક પ્રસંગે બંને ભાઈઓ શહેરમાં આવતા હતા, તેવામાં એક જૈન મુનિ શહેરમાંથી જોયરી લઈ સ્વરસ્થાનકે જતાં તેમને સામા અલ્યા. પોતાના પિતાએ આપેલી શીખામણુથી જરોભર અને દેવભર નામના બંને આલ્યાણ પુત્રો ભયભીત બની પાછા ફરી, આડે રસ્તે ચાલ્યા. મુનિને પણ તેજ રસ્તે જવાનું હતું, આથી તેઓ બંને વધુ ભયભીત બન્યા, અને ઉતાવળે હોડવા લાગ્યા. કેટલેક દૂર ગયા પછી તેઓ એક ઝાડ પર ચડી ગયા. મુનિએ પણ અણણુતાં તેજ ઝાડ તળે વિસામે લીધો અને રજેહરણ વડે જમીન પુંજુને ત્યાં પોતાની જોળી મૂકી. ત્યારબાદ તેઓ પાત્ર ખુલ્ખાં કરી લાવેલ આહારનું ભોજન કરવા એઠા. મુનિની શાંત મુદ્રા અને જોળામાં શસ્ત્રને બદલે આહાર જોઈ બંને ભાઈઓ વિસ્મય પામ્યા અને પોતાના પિતાનું વચ્ચન તેમને એઢું માલમ પડ્યું. મુનિ આહાર કરી રહ્યા બાદ બંને ભાઈઓએ નીચે ઉતરી મુનિના પગમાં વંદન કર્યું. મુનિએ તેમની હકીકતથી વાકેદ થઈ સંસારનું અસારપણું સમજાવ્યું. આથી બંને ભાઈઓને ત્યાં જતિસ્મરણ જાન થયું. ઘેર આવી માણાપ પાસે ચારિત્ર અહણું કરવાની તેમણે રણ માગી. માણાપે તે માટે આનાકાની કરી અને તેમને પરણાવી આપી સંસારસુખનો લહાવો કેવાનું કહ્યું. પરન્તુ વૈરાગ્યવાન બંને ભાઈઓને તે રુચ્યું નહિ, એટલું જ નહિ પણ તેમણે સંસારનું અનિત્યપણું માતા પિતાને સમજાવ્યું; અને પોતાનો દીક્ષા કેવાનો દદ મનોભાવ બ્યક્ત કરી માતા પિતાને પણ દીક્ષિત થવા ઉપદેશ આપ્યો. આખરે બંને ભાઈઓ સાથે તેમના માતા પિતાએ દીક્ષા લીધી. તેમનું ધન ધ્યિકાર રાજને અહણ કર્યું; તે ઉપરથી ધ્યિકાર રાજની રાણી કમળાવતીએ (પૂર્વવત) રાજને બોધ આપી વૈરાગ્ય પ્રેરિત કર્યો, આખરે રાજરાણી, પુરોહિત તથા

તેની સ્વી, અને બંને પુત્રો એમ છએ જણાએ સાથે દીક્ષા લીધી, અને છએ જણ ચારિત્રની ઉત્કૃષ્ટ આરાધના કરી મોક્ષમાં ગયા.

૧૦૭ જાલીકુમાર.

રાજગૃહિના મહારાજા શ્રેણિકની ધારિણી નામક રાણીના તે પુત્ર હતા. યૌવનાવસ્થા પામતાં રાજએ તેમને આઠ કન્યાઓ પરણાવી હતી. ભગવાન મહાવીર દેવ પાસેથી તેમણે ધર્મ ક્રથા સાંભળી, માતા પિતા સાથે ચર્ચા કરી, અનુમતિ મેળવી દીક્ષા અંગીકાર કરી હતી. તેઓ મેધકુમારની માઝેક ૧૧ અંગ લાયા, ગુણુસંવત્સર તપ કર્યો, ૧૬ વર્ષ ચારિત્ર પાણ્યું અને આખરે વિપુલગિરી પર્વત પર અનશન કરી કાળધર્મ પામીને તેઓ વિજય નામના વિમાનમાં ઉર સાગરોપમની સ્થિતિએ દેવપણે ઉત્પજ થયા. ત્યાંથી મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈ તેઓ મોક્ષમાં જરો.

૧૦૮ જિતશત્રુરાજ અને સુયુદ્ધ પ્રધાન.

ચંપા નામની નગરી હતી. તેમાં જિતશત્રુ નામે રાજ રાજ્ય કરતો હતો. તેને સુયુદ્ધ નામનો પ્રધાન હતો, જે જ્વાળવના સ્વર્ણપને જાણવાવોણા, અને યુદ્ધિશાળી હતો. તે ચંપાનગરીના ઈશાન ખૂણામાં એક પાણીથી લરેલી ખાઈ હતી. જે ચરણી, રધીર, માંસ વગેરેથી લરેલી હતી, અને તેમાંથી ધણીજ ફુર્ણિ નીકળતી હતી. એક વખત રાજએ અનેક પ્રકારના ભિષ્ટભોજન જર્બ્યા બાદ પ્રધાનને પૂછ્યું. પ્રધાનજી, આજે હું વિવિધ જાતના સ્વાહિષ્ટ ભોજન જર્બ્યો છું. કહો, તે કેવાં આનંદદાયક હતા ! સુયુદ્ધ પ્રધાને ઉત્તર ન આપ્યો. રાજએ વારંવાર કહ્યું ત્યારે તેણે જવાબ આપ્યો; તેમાં કંઈ હર્ષ પામવા જેવું નથી. પુદ્ગળનો હંમેશાં એવો જ સ્વભાવ હોય છે. તેમાં શું આશ્રય છે. રાજએ આ વચ્ચેનો સત્ય આન્યા નહીં. એકવાર

તે રાજ પેલી દુર્ગધભય આઈ પાસે થઈને નીકળ્યો. આઈની દુર્ગધિથી રાજએ નાક આડું વબ્બ ધર્યું અને આગળ જઈને પ્રધાનને કહ્યું કે આ આઈનું પાણી દુર્ગધવાળું છે. કેમ ખરું કે નહીં? પ્રધાને જવાય આપ્યો કે પુદ્ગળનો સ્વલ્ભાવ છે તેમાં આશ્રય પામવા જેવું કાંઈ નથી. રાજને આ સાંલળી નવાઈ લાગી. તેણે કહ્યું કે પ્રધાનજી, તમે કદાગ્રહી છો. પ્રધાને વિચાર્ય કે રાજ જિનપ્રણિત ભાવેને જાણુતો નથી. માટે તેમને સમજાવવાં. પ્રધાને કુંભારને ત્યાંથી ધડો ભંગાવ્યો અને સંધ્યાકાળે, જે વખતે માર્ગ શાંત હતો, અને મનુષ્યોના પગરવનો સંચાર ન હતો, તે વખતે પેલી દુર્ગધી આઈની પાસે ગયો અને તેમાંથી પેલા ધડામાં પાણી ભર્યું. તેમાં રાખ નાખીને ધડાને બંધ કર્યો, અને સાત દિવસ સુધી રાખ્યો. ત્યારથાદ તેમાંનું પાણી ડલવીને બીજા ધડામાં નાખ્યું અને તેમાં રાખ નાખીને ધડાને બંધ કરી સાત દિવસ સુધી રાખ્યો. એમ વારંવાર કરતાં સાત અઠવાડીયા સુધી પાણી બદલાવ્યા કર્યું. પરિણામે તે પાણી આરોગ્યકારી, સ્વચ્છ સ્ક્ષાટિક રત્ન સમાન, દુર્ગધ વગરનું બની ગયું. પછી સુષુદ્ધિપ્રધાને માણુસોને કહ્યું કે આ પાણી જિતશત્રુ રાજને ભોજન વખતે આપણે. માણુસોએ તે પ્રમાણે કર્યું. રાજએ પાણી પીધું અને ધણો જ વિસ્મય પાખ્યો અને કહ્યું કે આ પાણી ધણું જ આનંદકારી છે. કથાંથી લાવ્યા? માણુસોએ કહ્યું કે આ પાણી અમને સુષુદ્ધિપ્રધાને આપ્યું છે. રાજએ પ્રધાનને ઓલાવીને પૂછ્યું. લારે પ્રધાને કહ્યું કે આ પેલી આઈનું પાણી છે. રાજએ માન્યું નહીં. પ્રધાને સર્વ ક્ષકીઠત કહી. છતાં રાજને વિશ્વાસ ન આવ્યો તેથી રાજએ માણુસો દારા આઈનું પાણી ભંગાવ્યું અને ધડામાં ભરી સ્વચ્છ કરાવ્યું. તો પાણી સ્વચ્છ, પીવા ચોાય થયું. રાજ આશ્રય પાખ્યો. પ્રધાને જિનપ્રણિત ધર્મ સંલળાવ્યો. રાજ તે સાંલળી ભારતવિધારી આવક થયો. કેટલાક સમય બાદ કોઈ સ્થવીર મહાત્મા ચંપાનગરીમાં પદ્ધાર્યો. સુષુદ્ધિપ્રધાન અને જીતશત્રુ રાજ વંદન કરવા ગયા. મુનિએ ધર્મ

દેશના આપી. બંને પ્રતિભોધ પામ્યા અને દીક્ષા લીધી. ધરણા વર્ષ સંયમ પાળી, તપ જ્યું ધ્યાન ધરી, સંથારો કરી નિર્વાણ પદને પામ્યા.

ન્યાય—મિથ્યાત્તથી જેનું મન સુગંધ બન્યું છે તેવા પાપમાં પડેલા જવો, ગુણરહિત હોલા છત્તા સહૃગુરુના પસાયથી આધિના પાણીની જેમ ગુણવાળા થાય છે.

૧૦૯ જિતશત્રુ.

પંચાલ દેશના કાંપિલ્યપુર નગરનો તે રાજ હતો. તે પૂર્વભવમાં અલિયંદ નામે મહાબુદ્ધનો મિત્ર હતો. તેણે મહાબુદ્ધ સાથે દીક્ષા લઈ સખ્ત તપ સંયમનું પાલન કર્યું, પરિણામે તે જ્યાંત નામના અનુત્તર વિમાનમાં દેવ થયો. ત્યાંથી ચ્યાવી જિતશત્રુ નામે રાજ થયો. તેના દરખારમાં એકવાર ‘ચોક્ખા’ નામની એક પરિવાજિકા આવી. તે પરિવાજિકા મિથિલા નગરીમાં રહેતી અને લોકોને પોતાના મતનો ઉપદેશ આપતી. એક વાર તેણું એ મિથિલાના અંતઃપુરમાં પ્રવેશ કરીને મહીકુંવરીને પોતાના મતનો બોધ આપ્યો. મહીકુંવરીએ તેને પૂછ્યું કે તમારો ધર્મ શો છે ? જવાબમાં તેણું એ પોતાનો ધર્મ સંભળાવ્યો. (જે શુક્રદેવ પરિવાજકે થાવચ્ચાપુત્રને કહ્યો હતો તે પ્રમાણે) આથી મહીકુંવરીએ તેના ધર્મનું પોકળ પણ બતાવી વિનયમૂળ ધર્મ કહ્યો. પરિવાજિકા નિરુત્તર રહી એટલે મહીકુંવરીની દાસીએ તેને ધુતકારીને કાઢી મૂકી. આથી કોપાયમાન થઈને તે પરિવાજિકા જિતશત્રુ રાજના અંતઃપુરમાં આવી અને ત્યાં પોતાનો શૌચમૂળ ધર્મ સંભળાવ્યો. જિતશત્રુ રાજને પોતાની સ્ત્રીએના રૂપ સૌંદર્યનું અલિમાન હતું, તેથી તેણે તે પરિવાજિકાને પૂછ્યું કે ભારા જેવું અંતઃપુર તહે કયાંઈ જેયું ? આથી વૈરવાળવાને ઉત્સુક બનેલી તે પરિવાજિકાએ કહ્યું:-રાજન, મિથિલા નરેશ કુંભરાજની પુત્રી મહીકુંવરીના રૂપ સૌંદર્ય આગળ તહારું અંતઃપુર પાણી ભરે છે. એમ કહી તેણું એ મહીકુંવરીના અથાગ રૂપનું

રાજ સમક્ષ વર્ણન કર્યું. આથી મોઢ પામી જિતશ્રુત રાજએ ભક્તીકુંવરીનું માગું કરવા કુંભ રાજ પાસે પોતાનો હુત મોકલ્યો. કુંભરાજએ પોતાની પુત્રી તેને પરણાવવાની ના કહી, એટલે જિતશ્રુતે અહીનથ્રુ, રૂપી, ચંદ્રછાયા, પ્રતિષુદ્ધ, તથા શંખ વગેરે રાજએ. સાથે સંકેત કરીને ભિથિલા પર ચડાઈ કરી. લાં ભક્તી-કુંવરીની યુક્તિ તથા બોધથી જિતશ્રુત વૈરાગ્ય પામ્યો. અને તેણે ખીજ રાજએની સાથે દીક્ષા લીધી.

૧૧૦ જિનદાસ.

તે સૌગંધી નામક નગરીના અપ્રતિહત નામના રાજના ભહાચંદ્રકુમારના પુત્ર હતા. તેમની માતાનું નામ અર્હદતા. એકવાર ભગવાન ભહાવીર તે નગરમાં પદ્ધાર્યો. જિનદાસ દેશના સાંભળવા ગયા. અને વૈરાગ્ય પામી તેમણે આવકધર્મ અંગીકાર કર્યો. પૂર્વભાવમાં ભજિભિકા નામક નગરીમાં મેધરથ રાજના ભવમાં સૌધર્મ નામક અણગારને તેમણે સુપાત્ર દાન આપ્યું હતું, તેથી તેઓ અલાંત સુખસાધની પામ્યા હતા, પરન્તુ તેમાં ન લોભાતા પાછળથી જિનદાસે ગ્રલુ ભહાવીરહેવ પાસે ચારિત્ર અંગીકાર કર્યું, અને તેજ ભવમાં તેઓ મોક્ષ ગયા. (સુખવિપાક).

૧૧૧ જિનરક્ષા, જિનપાત્ર.

કુણિંગ રાજની ચંપાનગરીમાં માકંડિય નામનો એક સાર્થ્વાહ રહેતો હતો. તેને લદ્રા નામની સ્ત્રી હતી. તેનાથી તેને બે પુત્રો થયા હતા. એકનું નામ જીનરક્ષ અને ખીજનું નામ જીનપાત્ર. તેઓ ઉમર લાયક થત્થાં વ્યાપારાર્થે અગ્યાર વખત લવણું સમુક્રમાં જઈ આવ્યા હતા અને પુષ્કળ દવ્ય લાવ્યા હતા. એક વખત તેઓ બંનેએ બારમી વખત લવણુસમુક્રમાં જવાનો નિશ્ચય કર્યો. માતાપિતાને પૂછ્યું. માતાપિતાએ કહ્યું કે તમારી આ બારમી મુસાફરી હુઃખદાયક

થરો; માટે જવું નહીં. પરંતુ તે બંને જણાએ ન આનતાં હું કરીને વહાણમાં બેસી પર્યાટને નીકળી પડ્યાં. લવણુસમુદ્રમાં મધ્ય દરિયામાં તેઓ પહોંચ્યા ત્યારે નાવ તોષાને ચડ્યું. વિજળી, ગર્જના થવા લાગી અને પ્રતિકૂળ વાયુને લીધે નાવ ડોલવા લાગ્યું અને ધીમે ધીમે તેમાં પાણી ભરાતાં નાવ કુષ્યં. ધણા માણુસો તેમાં દૂખી મૃદ્યાં. કર્મસંચોગે આ બંને જણને તરતાં તરતાં એક લાકડાનું પાટીયું હાથ આવી ગયું. તેના આધારથી તેઓ બંને રતનદીપ નામના એટ પાસે આવ્યા. ત્યાં થોડું પાણી દેખીને સંતોષ પામ્યા, અને ત્યાં કિનારે ઉતરી જમીનપર આવ્યા, તે પછી તેઓ પોતાના પર આવેલી આકૃત માટે પરસ્પર વાતો કરવા લાગ્યા. હવે આ દીપના મધ્ય ભાગના એક ભહેલમાં રતનદીપા નામની એક દેવી રહેતી હતી. તે ધણીજ ઘરાય હતી. તેણે અવધિજીનથી આ એ જણાને એકોલા જેયાં. તેથી તે હાથમાં તરવાર લઈ શાધ ગતિથી તેમની પાસે આવી પહોંચ્યી અને એલી : જે તમે મારી સાથે કામલોગ ભોગવશો તો હું તમને જીવતા રાખીશ. નહિતો આ તરવારથી તમારા બંનેના ભર્તક ઉડાવી દઈશ. તેની વક્તાના ભયથી આ બંને કષ્યુલ થયાં. તેથી તે દેવી તે બનેને પોતાના ભહેલમાં લઈ ગઈ, અને તેમની સાથે વિપૂલ ભોગ ભોગવવા લાગી.

એક વખત રતનદીપા દેવીએ આ બંનેને કણ્ણું કે તમે કોઈ વખત ઉદ્વેગ પામો અને ઇરવા જવાતું ભન થાય તો બધી દિશામાં જણો, પણ દક્ષિણ દિશાના વનખંડમાં ન જતા, તે મુજબ તેઓ દરેક દિશામાં જતા પણ દક્ષિણ દિશામાં ન જતા. એકવાર તેઓને વિચાર થયો કે દેવીએ દક્ષિણ દિશામાં જવાતી શા માટે ના કહી હશે ! ત્યાં કંધક હોવું જોઈએ. એમ ધારી તેઓ બંને દક્ષિણ દિશામાં જવા તત્પર થયા. ત્યાં જતાં પ્રથમ તેમને એક સર્વના મડાંની પારાવાર હુર્ગધ આવી તે સહન ન થઈ શકવાથી તેઓ મહેં ઢાંકો દક્ષિણ દિશાના વનખંડમાં આવ્યા, ત્યાં એક વધસ્થાન તેમણે જેયું.

અને શરીર ઉપર એક માળુસને ચઢેલો જોઈને આ બંને ભયભિત થયા. પેલા માળુસને કારણ પૂછ્યું ત્યારે તેણે કહ્યું કે આ વધરથાન રતનદીપા નામની દેવીનું છે. હું કાકંડી નગરીનો એક ધોડાનો વેપારી છું. લવણુસમુદ્રમાં મુસાફરી કરતાં વહાણ ભાંગવાથી એક પાટીયાને આધારે આ દીપમાં આવ્યો. અહિં મને આ દેવી લઈ ગઈ અને એક અલ્પ અપરાધને ખાતર તે દેવીએ મહારી આ દુર્દીશા કરીછે! આ સાંભળી તેઓ બંને વધારે ભયભિત થયા અને દેવીના પંજમાંથી દૂષ્ટવાનો તેમણે વિચાર કર્યો. દૂષ્ટવાનું કારણ પૂછતાં, પેલા શુણી પર ચઢેલા પુરુષે કહ્યું કે પૂર્વ દિશાના ખંડમાં શેલગ નામના યક્ષનું મંદિર છે. તેની પૂજા કરશો તો તમે દૂષ્ટરો. તે મુજબ તેઓએ કર્યું, પરિણામે શેલગ યક્ષ ગ્રસન્ન થયો, અને તેઓને પોતાની પીઠ પર ઐસાડી લવણુસમુદ્રમાં થઈ ચંપાનગરી તરફ ચાલ્યો.

હવે પેલી રતનદીપા દેવી બહાર દ્વારા ઘેર આવી. લાં પેલા એ પુત્રોને જોયા નહીં. તેથી તે ચારે દિશાના વનખંડમાં જઈ આવી, પણ ક્યાંઈ તેમનો પત્તો લાગ્યો નહીં. તેથી અવધિજાન મૂકી જોયું તો તેમને શેલગ યક્ષની પીઠ પર ઐસીને લવણુસમુદ્રમાં જતાં જોયા, તેથી ક્રાપાયમાન થઈ હાથમાં તરવાર લઈ શાંદ્રગતિથી દોડતી તે કુમારો પાસે આવી પહોંચ્યો. પ્રથમ તો તેણી તે બંનેને મૃત્યુનો ભય દેખાડવા લાગી. પણ યક્ષના વચન મુજબ તેમાંના ક્રોધએ તેણીના સામું જોયું નહીં, પછી બંને જણા પ્રત્યે તે દેવી હાવભાવ કરતી, શોક વિલાપ કરતી કરુણ સ્વરે પોતાની પાસે આવવા વિનવવા લાગી. આથી જીનરક્ષનું મન ચલિત થયું. આ વાત યક્ષના જણવામાં આવવાથી તેણે જીનરક્ષને છોડી દીધ્યો. રતનદીપા જીનરક્ષને અહણું કરીને ઓલી:-રે દાસ, હવે તું મૃત્યુના મુખમાં આવ્યો છે. એમ કણી તેને ઉપાડી આકાશમાં ઉછાલ્યો. અને પછી તેના શરીરના કુક્કે કુકડા કરી મારી નાખ્યો.

બીજુ બાળુ જીનપાળ ડાયો નહીં, તેથી યક્ષે તેને ચંપા નગરીમાં

તને ધેર પહોંચાડ્યો. ભાતપીતાને તે મળ્યો અને સધળી વાત નિવેદન કરી. કાળાન્તરે તે ધર્મઓધ પામ્યો અને દીક્ષા લીધી. યાવતું તે મોક્ષગતિને પામશે.

ન્યાય—હે આયુષ્યવંત શ્રમજ્ઞ ! જેવી રોતે અનરક્ષ કામ બોગમાં મૂર્છિત બનીને, હુઃખી થયો; તેમ તમે દીક્ષા લધને મનુષ્યના કામબોગમાં આશકત બનશો, તો આ ભવમાં નિંદા પામશો અને પરભવમાં હુઃખી થશો. જેમ જીનપાળનું એક રંગાડું પણ ચંદ્રિત ન થશું, તેથી થશે. તને ચંપાનગરીમાં પહોંચાડ્યો તેમ તમે આશકત નહિ બનો તો પરમસુખાકારી સિદ્ધધગતિને પામશો.

૧૧૨ જીરણ શેઠ.

પ્રભુ મહાવીરના વખતમાં વિશાળા. નામક નગરીમાં જીરણ નામના શેઠ હતા, તે જૈનધર્મના આસ્તિક અને સંત મહાત્માઓના પૂર્ણ લક્ત હતા. અ. મહાવીર છદ્દમસ્થાવરસ્થામાં વિશાળા નગરીમાં એક વખત ચાતુર્માસ રહ્યા. હેમતા દર્શને વારંવાર જીરણશેઠ જતા અને પ્રભુને વિનતિ કરતા કે પ્રભો ! આ સેવકને કોઈવાર પારણુનો લાલ આપી ઉપકૃત કરશો. પ્રભુ ધ્યાનમાં હોય, તેથી કાંઈ ઓલે નહિ. જીરણ શેઠ હરહંમેશ ભાવના ભાવ્યા કરે કે પ્રભુ મહાવીર જેવા મહાપુરુષ પારણુને દિવસે જૌયારી અર્થે મારે ત્યાં પધારે તો મારો મનુષ્ય જન્મ સાર્થક થાય. એમ ચિંતવતા ચિંતવતા કારતક વદ્દ એકમનો દિવસ આવ્યો. તે દિવસે પ્રભુને પારણું કરવાનું હતું. જીરણ શેઠ વિચાર્યું કુ મહારાં એવાં ભાગ્ય કયાંથી હોય કે પ્રભુ આ દિવસે મારે ત્યાં પધારે અને મને પાવન કરે ! આ જતની ભાવનામાં જીરણ શેઠ તદ્વાલીન છે, તેવામાં જ પ્રભુ મહાવીર કરતા કરતા પુરણ નામના શેઠને ત્યાં જઈ ચડ્યા. પુરણ શેઠનું ઘર જીરણશેઠના ઘરની સમીપમાં જ હતું, તેમ પુરણ શેઠ સંતલક્ત પણ ન હતો,

છતાં લોક્યવહારે તેણે દાસીને કર્યું કે:-જ, પેલા આંગણે આવેલા ભિખારીને ધરમાં જે કાંઈ હોય તે આપ. શેઠના હૃકમથી દાસીએ ભગવાનને અડદના બાકળા વહોરાય્યા. ભગવાને લાંજ તે બાકળાનું શોજન કર્યું, કે તરત જ તે સ્થળે હેવે પંચ દ્રવ્યની વૃષ્ટિ કરી અને ઉદ્ઘોષણા કરી, કે ‘અહોદાનં, મહાદાનં’ અર્થાતું ધન્ય છે, સુપાત્રને દાન દીધું-મહાદાન દીધું. આ શખ્ષે જરણ શેઠના સાંલ-ગવામાં આવતાં તે ચમક્યા. તેમણે જાણ્યું કે ભી મહાવીરે પુરણ શેઠને લાં પારણું કર્યું, મહારી ભાવના ન ઇણો ! અહો હું કેવો નિર્ભાગી ! એમ ચિંતવી તે શોક કરવા લાગ્યા. કાળાન્તરે જરણ શેઠ સુપાત્ર દાન આપવાની ભાવનાએ મૃત્યુ પામી દેવલોકમાં ગયા. ત્યાંથી તેઓ મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈ તેજ ભવમાં મોક્ષ જશે.

૧૧૩ જુડલશ્રાવક.

પ્રભુ નેમનાથના સમયમાં ભહિલપુર નગરમાં એક ધનાઢ્ય ગાથાપતિ હતા. તેમની પાસે ૧૬ કરોડ સોના અહોરોની રોકડ, તેટલી જ કિંમતની ધરવખરી, અને તેટલી જ મુડી વ્યાપારમાં રોકાયલી હતી. તે ઉપરાંત જાયોના ૧૬ ગોકુળ હતા. તેઓ ઉર સ્વીએ સાથે સંસાર સંબંધના વિવિધ સુખ લોગવતા હતા. પ્રભુ નેમનાથની દેશના સાંલળવાથી તેમને સ્થૂલ વૈરાગ્ય સ્ક્રોર્સ અને પ્રભુ પાસે આવકના બારવત ધારણ કર્યા. તેમાં તેમણે માત્ર ચણુની દાળ, ચોપા અને પાણી એ ત્રણ જ વસ્તુઓની ખાવા માટે છૂટ રાખી, બાકીના સધળાં દ્રવ્યોનો ત્યાગ કર્યો, તેમ જ એક વીંતી સિવાયના ખીજાં તમામ આભરણો ત્યાગ્યા, બહુમૂલાં વસ્ત્રો ત્યાગ્યા; મૈથુનનો સર્વથા ત્યાગ કર્યો, વણી છઠ, અઠમાદિ સખ્ત તપશ્ચર્યા કરીને તેમણે શરીરને શોપવી નાખ્યું, શરીર કૃપ થયેલું જોઈતેમની સ્વીએઓ શરીર દુર્બળ થયાનું કારણ પૂછ્યું, ત્યારે જુડલ શ્રાવકે પ્રભુ નેમનાથ પાસે પોતે આવક્રમત અંગીકાર કર્યાની હકીકતા કહી.

આથી સ્વીઓએ જુદુલ શાવકને ભોગવિલાસ કરવાનું આમંત્રણું કર્યું, પણ જુદુલ શાવક પોતાની પ્રતિજ્ઞાથી જરાપણ ડગ્યા નહિ. નિરાશ થઈ સ્વીઓ પાછી ઇરી. જુદુલ શાવકે વિચાર્યું કે આજે મને સ્વીઓનાં દર્શન થયા, તે ઢીક થયું નહિ. એમ ધારી તેમણે શાવકની ૧૧ પડિમા ધારણ કરી. અનુકમે ૧૦ પડિમાઓ પુરી થયાં; પછી ૧૧ મી પડિમા લીધી. ૧૬ દિવસો પસાર થતાં તેમને અવધિજ્ઞાન થયું; ત્યારે તેમને જણાયું કે પોતાને અગ્નિનો ઉપસર્ગ થશે; અને તેમાં મૃત્યુ થશે. આથી તેમણે જીવનપર્યેતનું અનશન કર્યું. એ દરમ્યાન તેમની સ્વીઓ, નેમની અધમ માગણી જુદુલ શાવકે કયુલ રાખી ન હતી, તેઓ વૈર લેવાની છિંછાએ ત્યાં આવી અને ધ્યાન ધરીને જયાં જુદુલ શાવક બેઠા છે, તે પૌપદ્ધશાળા સળગાવી મૂકી. એકંદર પાંચસો વર્ષનું આયુષ્ય, તથા ત્રીસર્વનું શાવકપણું પાળી, એ માસના અનશને જુદુલ શાવક અગ્નિના ઉપસર્ગ મૃત્યુ પામ્યા અને છિંશાન દેવલોકમાં દેવ થયા. ત્યાંથી ચ્યાવી તેઓ મહાવિદેહ ક્ષેત્રમાં જન્મી મોક્ષમાં જશે.

૧૧૪ જંયુસ્વામી.

રાજગૃહ નગરમાં રાજાઓને વિષે શિરોમણી અને ઈક્ષ તુલ્ય મહોદી સમૃદ્ધિવાળા એણિક રાજ રાજ્ય કરતો હતો. તેજ નગરમાં ઋપભદ્રતા નામે એક ધનાદ્ય શેઠ રહેતો હતો, તેને ધારિણી નામની સુશીલ અને ધર્મપરાયણ પત્ની હતી. બંનેને સંસારસુખ ભોગવતાં કેટલેક કાળે એક પુત્ર થયો. નામ પાડયું જંયુકુમાર. માતાપિતાના ગુણો સ્વાભાવિક રીતે બાળકમાં ઉછરે, એ અનુસાર જંયુકુમારની આકૃતિ શાન્ત, તેજસ્વી, વૈરાગ્યવંત દેખ્યી સૌ કોઈને અપાર આનંદ થતો. બાલ્યકાળ વટાવી જંયુકુમાર યૌવનાવસ્થા પામ્યા, ત્યારે તેમના પિતાએ તેમનું લગ્ન કરવાનું છિંછયું. એ અરસામાં જ તેજ નગરના પૃથક પૃથક આઠ ધનવાન શાહુકારો પોતાની પુત્રીઓનું

સગપણુ કરવા માટે ઝડપલદત શેડને ત્યાં આવ્યા; અને વિનતિ કરી. તેમની વિનતિ ભાન્ય રાખી ઝડપલદત શેડ પોતાના પુત્ર જંબુકુમારનું સગપણુ ગ્રસ્તુત શ્રેષ્ઠિઓની આડ પુત્રીએ સાથે કર્યુ. શ્રેષ્ઠિઓ આનંદ પામી સ્વર્ણાનકે ગયા.

આ અવસરમાં ભવ્ય પ્રાણીઓને ઉપહેશ આપતા, શ્રી સુધર્માસ્વામી રાજગૃહ નગરના ઉદ્ઘાનમાં સમોસર્યાં. આ સમાચાર સાંભળતાં જંબુકુમાર અતિ હષ્ટ પાન્યા અને એક વાયુ સરખા વેગવાળા રથમાં બેસીને શ્રી સુધર્મ ગણુધરને વંદન કરવા ગયા. દેશના સાંભળી જંબુકુમારને સંસાર પર તિરસ્કાર દ્યુટ્યો. ધેર આવી તેમણે દીક્ષા ક્ષેવાની વાત પોતાના ભાતાપિતાને કહી. ભાતાપિતાએ લગ્ન કરવાનો આગ્રહ કર્યો. જંબુકુમાર ભાતાપિતાની છંછાને તાએ થયા. ઝડપલદતે પેલા આડ શ્રેષ્ઠિઓને બોલાવીને કહી દીધું કે મારો પુત્ર લગ્ન કર્યો પછી તરત જ દીક્ષા લઈ ચાલી નીકળવાનો છે, માટે તમારો વિચાર હોય તોજ લગ્ન કરો. પેલા શ્રેષ્ઠિઓએ આ હકીકત પોતાની પુત્રીએને જણાવી. પુત્રીએએ કહું કે તેઓ દીક્ષા ક્ષેણો, તો અમે પણ લઈશું, પરન્તુ જે વિવાહ થયો તે થયો જ. આખરે જંબુકુમારનું તે આડ સ્વીઓ સાથે લગ્ન થયું. જેણે સંસારના વિષયભોગ વિષસમાન ગણ્યા છે એવા ધર્મનિષ જંબુકુમારે તે રાત્રિયે અલયર્ય પાળયું, એજ વખતે પ્રલવ નામનો સુખ્ય ચોર પોતાના ૫૦૦ સાચ્ચીત ચોરો. સાથે જંબુકુમારનો ધનભંડાર લૂંટવા આવ્યો. પ્રલવ પાસે અવસ્વાપિની વિદ્ધા હોવાથી, તેણે વિવાહમાં આવેલા તમામ માણુસોને ધેનમાં નિદ્રાધિન કરી દીધા. જંબુકુમાર પર આ વિદ્ધાની અસર થઈ નહિ. પ્રલવ ચોરે પુષ્કળ ધન એકદું કર્યું. અને જેવો જ તે ચાલવા જાય છે, કે તરત જ જંબુકુમારની અલયર્ય રૂપી સ્થંભન વિદ્ધાના જેરે પ્રલવચોરના પગ ત્યાં જ ચોટી ગયા. પ્રલવે જંબુકુમારને પોતાને છોડવા વિનંતિ કરી, બદલામાં જંબુકુમારે સંસારની

અસારતાનું વર્ષનું કર્યું. પરિણામે પ્રભવને દીક્ષા લેવાનો અભિલાષ થયો. તેજ રાત્રીએ વિધવિધ દૃષ્ટાતો આપીને જંબુકુમારે પોતાની આઠ સ્વીએને ખુઝવી. સૌ દીક્ષા! લેવા તત્પર થયા. છેવટે જંબુકુમારે, પ્રભવાદિ ૫૦૦ ચોર, પોતાના માતાપિતા, આઠ સ્વીએ અને તેમના માતાપિતા એમ પરં જણ સાથે દીક્ષા લીધી; અને સુધર્મગણુધર સાથે ગ્રામાનુગ્રામ વિચરતા અનેક પ્રશ્નોનું સમાધાન કરી શાલ્યમાં ખારંગત થયા. તેમણે ૧૬ વર્ષની વયે દીક્ષા લીધી. ૩૬ મા વર્ષે કૈવલ્યજ્ઞાન થયું. ૪૪ વર્ષ કૈવલ્ય પ્રવર્ણિતમાં રહ્યા અને ૮૦ વર્ષની ઉંમરે તેઓ મોક્ષ પામ્યા. તેમની પાટે શ્રી પ્રભવસ્વામી એહા.

૧૧૫ ઢંઢણુકુમાર.

શ્રી કૃષ્ણને ઢંઢણા નામે રાણી હતી, તેને એક પુત્ર થયો. નામ ઢંઢણુકુમાર. એકવાર શ્રી નેમીશ્વર ભગવાન ત્યાં પધાર્યા. ઢંઢણુકુમાર પ્રભુની દેશનામાં ગયા. ત્યાં તેમને વૈરાગ્ય થયો અને માતાપિતાની રણ મેળવી તેમણે દીક્ષા લીધી. પૂર્વ કર્મના ઉદ્દે ઢંઢણુમુનિને આહારની પ્રાપ્તિ થતી ન હતી, એટલું જ નહિ પણ ઢંઢણુમુનિને કોઈ બીજા સાધુએ સાથે ગૌચરી જાય, તો તે સાધુએને પણ આહારની પ્રાપ્તિ ન થાય. આથી ઢંઢણુમુનિએ એવો અલિગહ લીધો કે પોતાની લખિધ વડે આહાર મળે તો જ સ્વીકારવો. આ રીતે ૭ માસ વીતી ગયા, પણ ઢંઢણુમુનિને આહાર મળ્યો નહિ. એકવાર ભગવાન નેમિનાથ ઢંઢણુમુનિ આદિ શિષ્ય પરીવાર સાથે દારિકામાં પધાર્યા, ઢંઢણુમુનિ ગૌચરીએ નીકળ્યા. રસ્તામાં શ્રી કૃષ્ણ મળ્યા, તેમણે ઢંઢણુમુનિને વંદન કર્યું. આ લેઈ પાસેની એક હવેલીમાં રહેતા ગૃહસ્થને લાગ્યું કે આ મુનિ પ્રભાવશાળી જણાય છે. એમ વિચારી તેણે ઢંઢણુમુનિને મોદક વહોરાવ્યા. તે લઈ મુનિ શ્રી નેમનાથ પાસે આવ્યા. અને પોતાની લખિધએ મળેલા આહારની વાત કરી, લારે શ્રી નેમનાથ કહ્યું કે તમને મળેલો આહાર તમારી લખિધનો નથો,

પણ તે શ્રી કૃષ્ણની લખિનો છે, એમ કહી સવિસતર વાત કરી. દંદણે કહ્યું : અલુ ! અને કથાં કર્મને કારણે આહારની પ્રાપ્તિ નહિ થતી હોય ! અલુએ જવાબ આયો :—મગધ દેશના પૂર્વિંદ્ર નગરમાં પૂર્વભવે તું પારાશર નામે એક સુખી ઘેરૂત હતો. તારા તાથામાં ૧૦૦ હળ હતા. એકવાર હળ ઘેરનાર ૧૦૦ માણસો માટે ભાત આવ્યું. સખ્ત ઉનાળો હતો; ઘેરૂતો થાકી ગયા હતા, છતાં તેં એ બધાને ઘેતરનો એક આંટો વધુ ઝેરવી ભૂખતું હુઃખ આવ્યું. આ રીતે તેં ૧૦૦ ઘેરૂત અને ૧૨૦૦ બળદ એમ ૧૮૦૦ જીવોને ભાત પાણીનો અંતરાય પાડ્યો. તે નિકાચિત કર્મનું ઇન્હે મુનિ, આ વખતે તમારે ભોગવવું પડે છે. દંદણુમુનિ ચેત્યા. તેમણે લાવેલા લાડુઓ કુઝો કરી એક જગ્યાએ પરઠવી દીધા, અને પશ્ચાતાપની ભાવના ભાવતાં આત્માની અદ્ભુત શૈલિમાં પ્રવેશ્યા, કે તરત જ તેમને કૈવલ્યજીન થયું. કેટલોક વખત કૈવલ્યપણે વિચરી તેઓ મોક્ષમાં ગયા.

૧૧૬ તામલી તાપસ.

જંયુદીપના ભરતક્ષેત્રમાં તામલીપ્તી નામની નગરી હતી. તે નગરીમાં મૌર્યપુત્ર તામલી નામનો મહાઋદ્ધિવંત ગાથાપતિ રહેતો હતો. એકવાર મધ્યરાત્રીએ તેને એવો વિચાર થયો કે મેં પૂર્વ જન્મમાં દાનાદિ સુકૃત કર્યું છે. તપશ્ચર્યા કરી છે. તેનાં શુલ ઇન અત્યારે હું ભોગવી રહ્યો છું. તો હવે મહારે આ જન્મમાં પણ પરલવને માટે શુલ કૃત્ય કરવું જોઈએ.

સૂર્યોદય થયો. તામલી ગાથાપતિ સ્વરથ થયો. જ્યેષ્ઠપુત્રને શોખાવી આત્મસાધના કરવાનો વિચાર જણાવ્યો. જ્યેષ્ઠપુત્રને ગૃહ-કાર્યલાર સોંપી સન્યસ્થ-કર્મની દીક્ષા લઈને તે ચાલી નીકળ્યો. હાથમાં કાષ્ટનું પાત્ર રહી ગયું છે. પગમાં પાદુકા પહેરી છે. ભગવાં

વસ્તો ધારણ કર્યાં છે. કેશલોચ કર્યો છે. અને છઠ ઉપર છઠ કરી આતાપના ભૂમિમાં ઉચ્ચ તપશ્ચર્યાં કરવા માંડી છે, પારણાને દિવસે ઉચ્ચય, નિય, મધ્યમ ઝૂળમાં લિક્ષાર્થે નીકળે છે અને માત્ર પાકેલા ચોખા વહેરીને લાવે છે. તે ચોખાને એકવીસવાર પાણીથી ધોવે છે, અને તેનું સત્ત્વ માત્ર રહે ત્યારે જ તેનો આહાર કરે છે અને જીવન નભાવે છે. વળી તે પાછી ઉચ્ચ તપશ્ચર્યાં સાધવા લાગે છે. અટ્ય આહાર અને મહાન તપશ્ચર્યાના યોગે તેનું શરીર હીણ, ક્ષીણ થઈ ગયું. શરીરમાં માત્ર હાડકાંચો દેખાવા લાગ્યા. અને હવે હું લાયું જીવીશ નહી એવું તેને લાગવાથી પોતાની પાસેનું કંભંડલ, કાષ્ટપાત્ર તથા પાદુકાને તેણે દૂર દેંકી દીધાં અને પાહોપગમન સંથારો કર્યો.

તેની મહાન તપશ્ચર્યાના પરીઅળે દેવલોકમાં બલીયંચા રાજ્યધાનીના દેવેંદ્રનું આસન ચલિત થયું. લાંના દેવ દેવીઓએ ઉપયોગ મૂક્યો અને જેયું તો તામલી તાપસને સંથારો કરતાં જેયો. તેથી તેને બલીયંચામાં ઈદ થવાનો સંકલ્પ (નિયાણુ) કરાવવા, દેવો મૃત્યુલોકમાં તામલી તાપસ પાસે આવી પહોંચ્યા. દેવોએ બત્તીસ પ્રકારના નાટકો કરી તામલીતાપસને વંદન કર્યું. અને બલીયંચામાં ઈદ થવાનો સંકલ્પ કરવા તામલીતાપસને કર્યું. પરંતુ તામલીતાપસે ગણકાર્યું નહિ, અને મૌન રહ્યો. દેવો કોધ પામીને સ્વસ્થાનકે ગર્યા. તે સમગ્રે ઈશાન દેવલોકમાં પણ ઈદની જગ્યા ખાલી પડી.

તામલીતાપસ એ માસ સંથારામાં રહી, સાઠ હજાર વર્ષનું આયુષ્ય લોગવી ભરણ પામ્યો અને ઈશાન દેવલોકમાં ઈદ થયો. આ વાતની બલીયંચાના દેવહેવીઓને ખ્યાર પડી, તેથી તેઓ ઉચ્ચ ધારણ કરી, કોધથી લાલચોળ બની મૃત્યુ લોકમાં ઉતરી પડ્યા, અને તામલીતાપસના શબ્દને રસીથી બાંધ્યું. તેનાપર થુંકયા અને તે શબ્દને ઘસડીને તે નગરીની વચ્ચે લાવી દેવો ઐલવા લાગ્યા:—સ્વયં,

મનઃકલિપત પ્રવજન્યો લઈને અને અજ્ઞાન તપશ્ચયો કરીને તામલીતાપસ ઈશાન દેવદ્રોહમાં દેવ થયો છે, આ ગ્રભાણે તેની નિદા કરી દેવો સ્વસ્થાનકે ગયાં. ઈશાનના દેવહેવીઓએ જાણ્યું કે અમારા ઈદ્ર તામલીતાપસના મૃતહેડની દુર્દીશા થઈ છે! તેથી તેમણે તે વાત તામલીતાપસને કરી. તેથી તે કોધથી લાલગોળ બની, લલાટમાં બ્રકુટી ચડાવી, બલીયંચાને ઉંચે નીચે ચોતરણ જેવા લાગ્યો. તેના હિંય પ્રભાવથી તે રાજ્યધાની અંગિના અંગાર જેવી લાગવા લાગી. તેથી ત્યાંના દેવહેવીઓ ખીકથી થરથરવા લાગ્યા. ઈશાન-ઇદ્રનો કોધ જાણી તેઓ તેમની પાસે આવ્યાં અને ક્ષમા માગી. પુનઃ આનું કામ નહિ કરવાનું કહ્યું. ઈશાનઇદ્રે તેજુલેસ્યા પાછી ખેંચી લીધી. તે વખતથી બલીયંચાના દેવો ઈશાનઇદ્રની આજ્ઞા પાળે છે.

૧૧૭ ત્રિપૃષ્ઠ વાસુદેવ.

પોતનપુર નગરમાં ગ્રજપતિ નામે રાજ હતો. તેને મૃગાવતી નામની રાણી હતી. તેનાથી ત્રિપૃષ્ઠ નામે મહા બલિષ્ઠ પુત્ર થયો. તેઓ અશ્વશ્રીવ નામના પ્રતિવાસુદેવને મારી પહેલા વાસુદેવ થયા. ભગવાન ઋષભદેવના પુત્ર ભરત, અને તે ભરતના પુત્ર ભરિચિનો જીવ તે આ ત્રિપૃષ્ઠ, તથા બ૦ મહાવીરનો ડેટલાક ભવે પહેલાનો જીવ તે પણ આ ત્રિપૃષ્ઠ. ત્રિપૃષ્ઠને સંગીતનો ધણો શોખ હતો. તેણે એકવાર પોતાના શથ્યા પાલકને કહ્યું કે હું ઉંઘી જઉં ત્યારે આ ગવૈયાનું ગાન બંધ કરાવજે. ગવૈયાના ભધુર સંગીતના સ્વાદમાં ત્રિપૃષ્ઠ ઉંઘી જવા છતાં શથ્યા પાલકે ગાન બંધ ન કરાયું, આથી ત્રિપૃષ્ઠ જગી જતાં તેને પારાવાર કોધ ચડ્યો અને તે શથ્યા પાલકના કાનમાં ઉનું-ધગધગતું સીસું રેડાયું. શૈથ્યાપાલક ત્રાસ પામી ભરણ પામ્યો. આ નિકાચિત કર્મથંધનો ઉદ્ય લ. મહાવીરના ભવમાં તેને આવ્યો, અને તે શથ્યાપાલકના જીવે ભરવાડ રૂપે પ્રભુ મહાવીરના કાનમાં વૃક્ષની ખીલીએ ડોકી દારણ વેદના ઉપજવી અને પોતાનું

चैर वाल्युं त्रिपृष्ठ, श्रेयांसनाथ तीर्थकरना वर्खतमां ८४ लाख वर्षनुं
आयुष्य भोगवी मृत्यु पास्यो अने सातभी नरके गयो.

૧૧૮ ત્રિશલાદેવી.

તेऽमो ક્ષત્રિયકુંડ નગરના સિદ્ધાર્થ રાજની રાણી અને પ્રભુ
મહાવીરની માતા હતા. તેમને નંદીવર્ધન અને વર્ધમાન (મહાવીર) એ
એ પુત્રો ઉપરાંત એક પુત્રી હતી. ત્રિશલાદેવી એ વિશાળા નગ-
રીના ચેડા રાજની બહેન થતા હતા. તેઓ પ્રભુ પાર્વતીનાથના શાસ-
નમાં આવકથમાં પાળતા. લ. મહાવીર દેવે દીક્ષા લીધી, તે ખેલાં
તેઓ કાળથમાં પામી દશમા દેવકોકમાં ગયા.

૧૧૯ તેતલીપ્રધાન.

તેતલીપુર નામનું નગર હતું. તેમાં કનકરથ નામનો રાજ રાજ્ય
કરતો હતો. તેને મહાયુદ્ધિશાળી તેતલીપુત્ર નામનો પ્રધાન હતો.
તે પ્રધાન એક વાર ધોડેસ્વાર થઈને કેટલાક સ્વારો સાથે ક્રવા-
જતો હતો. રસ્તાભાં તેણે એક અભ્ય મકાનની અગાસીમાં એક સુંદર
બાળાને જોઈ. આ બાળા સર્વીંગ સુંદર અને અપૂર્વ લાવણ્યવાળી
હતી. પ્રધાન આ બાળાને જોઈ મોહિત થયો. પ્રધાન ધેર આવ્યો.
પરંતુ તેને ચેન પડ્યું નહીં. તેથી પોતાના માણુસને ઓલાવીને પેલી
બાળા કોણ્ણ છે તેની તપાસ કરાવી. માણુસોકારા જણ્યું કે તે એક
મહા જાદ્ધિનાંત કાલાદે નામે સોનીની પુત્રી છે. અને તેનું નામ પોઢીલા છે.
પ્રધાનને તેની સાથે લસ કરવાની છંચા થઈ, તેથી દૂત દારા સોનીને
ત્યાં તેની પુત્રી તેતલીપુત્ર પ્રધાનને આપવા કહેણ્ણ મોકલાવ્યું. દૂતો
ગયા અને વાત કરી. સોની પોતાની ધજજત આખરુ વધશે એમ
ધારી ભાગું કાયુલ કર્યું, પ્રધાન આ પોઢીલા કન્યાને પરણ્યો. અને
અનેક પ્રકારના સુખ ભોગવત્તા લાગ્યો.

તે નગરનો કનકરથ રાજ સ્વીઓનાં રૂપ સૌંદર્યમાં સુગંધ હતો

અને સદાકાળ અંતઃપુરમાંજ પડી રહેતો, વળા તેને પુત્ર ઉપર અભાવ હતો. એટથે કોઈપણ પુત્રનો જન્મ તેને ત્યાં થાય, તો તે તેના હાથ અગર પગની આંગળીએ કાપી નાખે અગર તો અંગુઠો કાપે, અગર નાક કાપે, અગર કાન કાપે. એકદા અંગ તો ઓછું કરેજ કે જેથી તે રાજ્યને માટે લાયક રહે નહિ. એકદા તેની પદ્ભાવતી રાણીને એવો વિચાર થયો કે રાજ, પુત્ર થાય તો તેના અંગોપાંગનું છેદન કરે છે, માટે મારે પુત્ર કદમ્બિ થાય તો અગાઉથી તેનો પ્રથંધ કરવો. જેધાએ, તેમ ધારી તેતલીપુત્ર પ્રધાનને ખોલાવી ખંડોખસ્ત કર્યો. હવે પોઢીલાને (પ્રધાનની સ્વી) તથા પદ્ભાવતી એ બંનેને સાથેજ ગર્ભ રહેલો. પોઢીલાએ મૃત પુત્રીને જન્મ આપ્યો. અને પદ્ભાવતીએ જીવિત પુત્રને જન્મ આપ્યો. પદ્ભાવતીએ પુત્ર જન્મતાંની સાથેજ દાસી દારા તેતલીપુત્રને ખોલાવી પુત્રને સૌંઘ્યો. તેતલીપુત્ર ખાનગી રીતે પુત્રને લઈ ગયો. અને પોતાને ત્યાં જન્મેલી મૃતપુત્રી પદ્ભાવતીને સૌંપી ગયો. રાજને મૃતપુત્રી જન્મ્યાની ખખર આપી અને તેની નિવારણ કિયા કરી. તેતલીપુત્રે રાજનાં પુત્રને પોતાને ધેર લઈ જઈ પોઢીલાને સૌંઘ્યો, અને સત્ય હકીકત કહીને ઉછેરવા કહ્યું. તે કુમારનું નામ ‘કનકધ્વજ’ પાડવામાં આવ્યું. કુમાર બાલ્યાવસ્થા વીતાવી, ૭૨ કળા શીખી યૌવનાવસ્થાને પાખ્યો અને આનંદ કરવા લાગ્યો.

કાળાન્તરે તેતલીપુત્રને પોઢીલા સ્વી પર અભાવ થયો. પોઢીલા આર્થિકાન ધ્યાતી શોકમાં દીવસો વીતાવવા લાગી. એકદા સુત્રતા નામના સાધ્વીજ પોઢીલાને ધેર વહેરવા પધાર્યા. પોઢીલાએ નમસ્કાર કરી આનંદપૂર્વક દાન દીધું અને પૂછ્યું! અહે આર્થાજ, આપ કોઈ વર્ષાકરણ મંત્ર મહે આપશો કે જેથી મહારા પર કોપેલા સ્વામી મારો સ્વીકાર કરે! આર્થાજએ કહ્યું, હે દેવાણુગ્રિય! અમે વ્રતધારી આર્થાજએ ધીએ; અમારે તે સંખ્યાધી કંઈ પણ કહી શકાય.

નહી, પણ તમારે જો છંચિછા હોય તો હું સર્વજ્ઞ પ્રભુનો વિચિત્ર ધર્મ સમગ્રવું, પોદીલાએ હા કહી. આર્યાંજીએ ધર્મ બોધ આપ્યો. પોદીલા પ્રતિઅભિપ્રાય પામી અને બારવત અંગીકાર કર્યો. ત્યાર બાદ કેટલોક સમય વિન્યો છતાં તેતકીપુત્રને પોદીલા પર પ્રેમ આવ્યો નહી, તેથી પોદીલાને દીક્ષા ક્ષેવાની અભિવાષા થઈ અને પતિની આજા માગી. પતિએ કહ્યું કે તમે દીક્ષા લઈને દેવ થાવ, તો મહને બોધ પમાડવો એવી શરતે હું રજ આપું. પોદીલાએ તે કખુલ્યું અને દીક્ષા લીધી. તપ્ય જ્ય સંવર કિયાએ અને અંતિમ સંથારો કરી પોદીલા દેવલોકમાં ગઈ.

કનકરથ નામનો રાજ વખત જતાં ગુજરી ગયો. તેને પુત્ર ન હેઠાથી, ગાડી કોને આપવી તે માટે નગરજનનો વિચારમાં પદ્ધા. પછી તે સર્વે તેતકીપુત્ર પાસે ગયા અને રાજ્યપુત્ર કોઈ હોય તો લાવી આપવાની વિનંતિ કરી. પ્રધાને પ્રથમની હકીકત જાહેર કરી. કોઝો ખુશી થયાં, અને કનકધ્વજ કુમારને રાજ્યાસને સ્થાપ્યો. કનકધ્વજ પણ તેતકીપુત્ર પર ધણેજ પ્રેમ રાખતો અને દરેક કાર્યમાં તેનીજ મુખ્ય સલાહ કેતો. તેતકીપુત્ર રાજ્યકાર્યાલારના વૈભવમાં અને મોજશોખમાં રહેવા લાગ્યો. આ વાતની પોદીલ દેવને ખખર પડી, તેથી તેણે રાજ અને પ્રધાન ઉલય વચ્ચે પ્રેમ સંબંધ તોડવાનો પ્રયત્ન કર્યો. પરિણામે કનકધ્વજનો પ્રેમ પ્રધાન ઉપરથી એકાએક ખસી ગયો. પ્રધાનને રાજએ તેમજ તેના કોઈ પણ અતુચ્ચરોએ માન ન આપ્યું. પ્રધાન શોકમાં પડ્યો અને આ તિરસ્કૃત જીવન જીવવા કરતાં મૃત્યુ શ્રેયસ્કર છે, એમ ધારી આત્મહત્યા કરવા પ્રયત્ન કર્યો. જેરથી, તરવારથી, દ્રાંસાથી, અસ્ત્રથી, એમ અનેક પ્રથોગો તેણે કર્યો. છતાં દેવની ચમત્કૃતિથી એકેયમાં તે સંકળ ન થયો. ત્યારે પોદીલ દેવ આવ્યો અને ઉપદેશ આપી પૂછ્યું. હે તેતકીપુત્ર, આગળ મોટી ઉંડી ખાઈ છે, અને પાછળ હાથીનો ભય છે, બંને બાળુમાં અંધકાર છે, વચ્ચે

પાણીની વર્ષાધારા ચાલી રહી છે, ગામ અગ્નિથી બળ રહ્યું છે અને અટવીમાં મોટો દવ લાગ્યો છે. તે સમયે કર્યાં જવું ? તેતલીપુત્ર જવાબ આપ્યો:-ભયલિત મનુષ્યને તેવા સમયે ચારિત્રનું જ શરણ છે. પોઢીલે કહ્યું:-સત્ય છે, ત્યારે તમે ચારિત્ર અંગીકાર કરો. એમ કહીને તે સ્વસ્થાનકે ગયો. તેતલીપુત્ર આત્મચિંતન કરવા લાગ્યો અને શુક્લ ધ્યાનના યોગથી તેને જાતિ સ્મરણ જ્ઞાન થયું. પૂર્વલવ યાદ આવ્યો. તેણે તરત સ્વયંમેવ પંચમુષ્ટિ લોચ કરી પંચમહાપ્રત ધારણ કર્યાં, અને શુલ્પ પરિણામની ધારા વર્ષાવતાં, જ્ઞાનાવરણીય આદિ ચાર કર્મનો ક્ષય કરી, કૈવલ્યજ્ઞાન, કૈવલ્ય દર્શનને પામ્યા.

કનકધ્વજને આ વાતની ખર્ચર પડી, તેથી તે ચિંતાતુર થઈ તેતલીપુત્ર પાસે ક્ષમા યાચવા આવ્યો. તેણે વંદન કર્યું અને અવિનયની ક્ષમા માણી, અક્તિ કરવા લાગ્યો. તેતલીપુત્ર તેને ધર્મઓધ આપ્યો. રાજાએ બારવત અંગીકાર કર્યાં. ધણા વર્ષ સુધી કેવળ પ્રવન્યાં પાળાને તેતલીપુત્ર સિદ્ધ થયા.

૧૨૦ થાવર્ચર્યાપુત્ર.

સુવર્ણના કોટવાળી મહિનેરતનના કાંગરાવાળી, ધનપતિ કુઝેરની બુદ્ધિથી ઉત્પન્ન થયેલી દારિકા નામની નગરી હતી. તે નગરીમાં એક મહા રિદ્ધિવંત થાવર્ચર્યા નામની ગાથાપતિનીને એક પુત્ર હતો, તેનું નામ થાવર્ચર્યાપુત્ર. યૌવનાવસ્થાએ પામતાં થાવર્ચર્યાપુત્રને ઘત્રીસ સ્વીએ પરણાવવામાં આવી. તે સ્વીએના પ્રેમસૌંદર્યમાં થાવર્ચર્યાપુત્ર સમય પસાર કરતો હતો. એકદા પ્રસંગે દારિકા નગરીના નંદનવન નામના ઉદ્ઘાનમાં ૨૨ મા તીર્થકર શ્રી નેમનાથ પ્રભુ પધાર્યા. પરિષ્ઠદ્વ દર્શન કરવાને નીકળી. જેમ મેઘકુમાર દર્શન કરવાને નીકળ્યા હતા, તેમ થાવર્ચર્યાપુત્ર પણ નીકળ્યા. પ્રભુએ ધર્મોપદેશ આપ્યો. થાવર્ચર્યાપુત્રને વૈરાગ્ય થયો. ધેર આવી માતા પાસે દીક્ષાની

આજા માગી. આતાપુત્રનો સંવાદ થયો. પુત્રનો તોવ વૈરાગ્ય જોઈ માતા સંવાદમાં જીતી નહીં. પરિણામે દીક્ષાની રણ આપવી પડી. ત્યાંથી તે રાજ્યદરખારમાં શ્રીકૃષ્ણ વાસુદેવ પાસે ગાંધી, સર્વવાત વિદ્ધિત કરી અને છત, સુગટ, ચામર વગેરેની ભાગણી કરી. કૃષ્ણ વાસુદેવે પોતે જ થાવર્ચર્ચાપુત્રનો દીક્ષામહોત્સવ કરવાનું કહ્યું. પ્રથમ તો શ્રી કૃષ્ણનું થાવર્ચર્ચાકુમારને દીક્ષા નહિ લેવા અને પોતાના આશ્રય તળે આવવા સમજાવ્યું. કુમારે જવાબ આપ્યો:-મહારાજા, જો તમે જન્મ, જરા અને મૃત્યુનો નાશ કરો શકતા હો તો હું તમારા આશ્રયે આવું. કૃષ્ણનું કહ્યું. તે તો દેવ કે દાનવોથી પણ બની શકે તેમ નથી. “છેવટે કૃષ્ણ વાસુદેવે નગરમાં જેને દીક્ષા લેવી હોય તે લે, તેમનાં સગાં, કુદુંબનો નિર્વાહ હું કરીશ.” એવો અમર પડહ વગડાવ્યો. પરિણામે એક હજાર પુરુષો દીક્ષા લેવા તૈયાર થયા. થાવર્ચર્ચાપુત્રે પંચમુદ્રિ લોચ કર્યો અને નેમનાથ પ્રભુ પાસે દીક્ષિત થયાં. ચૌદુર્યોનો અભ્યાસ કરી તપ સંવરમાં આત્માને ભાવતાં થાવર્ચર્ચાપુત્ર વિચરવા લાગ્યા.

એક વખત થાવર્ચર્ચાપુત્રે પોતાના એક હજાર શિષ્યો સાથે જનપદ દેશમાં વિહાર કરવા માટે ભગવાન પાસે આજા માગી. ભગવાને આજા આપી. જનપદદેશના શૈક્ષણિક ગામના શૈક્ષણિકાની તથા પંચક પ્રમુખ તેના પાંચસો મંત્રિને પોતાના ઉપદેશથી આવક ધર્મ અંગીકાર કરાવ્યો. તે વખતે સાંઘમતવાળો શુક નામે પરિવાજક હતો. તે અનેક લોકોને પોતાનો શુચિધર્મની ઉપદેશ આપી પ્રતિબોધિતો, અને સુદર્શન નામે મહારષ્ટ્રિવંત શેઠ શુચિ એ ધર્મનું મૂળ છે, એ સત્તમ-માની તેનો અનુયાયી થયો. પરંતુ થાવર્ચર્ચાપુત્રે ‘વિનય એ ધર્મનું મૂળ’ છે એ સચોટ સમજાવવાથી સુદર્શન આવક થયો હતો. આ વાતની શુકને ખખર પડવાથી તે સુદર્શન પાસે આવ્યો, સુદર્શને તેને થાવર્ચર્ચાપુત્ર પાસે મોકલ્યો. બંનેનો સંવાદ થયો. થાવર્ચર્ચાપુત્રની

અદ્ભુત શાનશક્તિથી શુક પ્રતિભોધ પામ્યો અને તેણે પોતાના હજર પરિવાજનો સહિત થાવર્ચ્યાપુત્ર પાસે જૈનમતની દીક્ષા લીધી. થાવર્ચ્યાપુત્ર ધણ્યાજ્ઞવોને પ્રતિભોધ પમાડી, ધણ્યા વર્ષ સંયમ પાળી, ઉગ્ર તપશ્ચર્યા કરી, પાદોપગમ સંથારો કરી કૈવલ્યજ્ઞાન પામ્યા અને સર્વ દુઃખોથી રહિત બની સિદ્ધગતિને વર્યા.

શુક અણુગાર એકદા વિહાર કરતા કરતા શેલગપુર નગરના ઉદ્ઘાનમાં આવ્યો. પરિષદ વાંદવા આવી. શેલગ નગરીનો રાજ શેલગ પણ દર્શન કરવા આવ્યો. શુક અણુગારે ધર્મોપહેશ આવ્યો. રાજ બુઝ્યો. અને પોતાના પાંચસો મંત્રિઓ સાથે તેણે દીક્ષા લીધી. શુકઅણુગાર શેલગ રાજ્યિને પાંચસો મંત્રિસાધુઓ શિષ્યપણે સોંપી પોતે એક હજર શિષ્યો સાથે વિહાર કરતાં પુંડરિક પર્વતપર સિદ્ધ થયા.

એક વખ્ત શેલગ રાજ્યિને લુણ્યો, સુકો, અનિયમિત આહાર જ્યમવાથી તેમના ડ્રેમણ શરીરમાં વેદના ઉત્પન્ન થઈ. તેમનું શરીર નિર્બળ બની ગયું. ઇરતાં ઇરતાં તેઓ પોતાના શેલગપુર નગરના ઉદ્ઘાનમાં પદ્ધાર્યા. પરિષદ વંદન કરવા આવી. તેમાં તેમનો પુત્ર મંડુક પણ આવ્યો. રાજ્યિનું રોગિષ્ટ અને વ્યાધિમય શરીર જોઈને પુત્રે કહ્યું:—આપ ભારી દાનશાળામાં પદ્ધારો, હું આપના આચારને યોગ્ય દવા વગેરેથી ચિકિત્સા કરાવીશ. આપ નિર્દેખ શાયા સંથારો વગેરે લઈ લ્યો; શેલગ ઋડિયે કણ્ણુલ કર્યું, અને તેઓ પોતાના શિષ્યો સાથે શહેરમાં ગયા. તેમના પુત્રે વૈદો વગેરેને બોલાવી ઉપયાર કરાવ્યા. પરિણામે શેલગ રાજ્યિનો રોગ શાંત થયો. રોગ શાંત થવાથી તે વિપુલ અન, પાણી તથા સ્વાદિષ્ટ આહારમાં લુણ્ધ થઈ કિયા રહિત શિથિલાચારે વિચરવા લાગ્યા. અને ગ્રાસુક પીઠ વગેરે ને કંઈ લાવેલ તે પાછા આપ્યા નહિ. તેથી પંથક સિવાયના તેમના ૪૮૮ શિષ્યો તેમને છોડીને ચાલ્યા ગયા. એક વખ્ત શિથિલાચારી શેલગ

રાત્રિએ સુખમાં સુતા હતા. તે વખતે પંથક નામના શિષ્યે ક્ષમાશ્રમણું કેતા પોતાના માથાથી શેલગ ઝડપિના પગને સંધર્ષણું કર્યું. શેલગઝડપિ જાગી ગયા અને પંથક ઉપર કોધિષ્ટ બન્યા. પંથકે કારણું જણાવી ક્ષમા માગી. પંથકનો વિનયભાવ જેર્ધ શેલગને વિચાર થયો કે અહે! રાજ્યપાટ છોડીને મેં દીક્ષા લીધી, છતાં હું સરસ આહારમાં લુખ્ખ બનીને શિથિલાચારી બન્યો. ધિક્કાર છે મને, એમ કંઈ તેઓ પશ્ચાત્તાપ કરવા લાગ્યા અને પાપની આલોચના કરી શુદ્ધ થયા. ત્યારથાદ છોડીને ગયેલા પેલા શિષ્યો તેમને સાધુના ખરા ભાવમાં આવેલા જાણી શેલગને મળ્યા. આપરે ધણાં વર્ષ સુધી શુદ્ધ ચારિત્ર પાળી શેલગ રાજ્યિં પણ મોક્ષ ગતિને પામ્યાં.

ન્યાય—ને કોઈ સાધુ સાધીની શેલગ રાજ્યિંની માફક દીક્ષા લઈને પ્રમાદ-પણે વીચરે, તો આ લોકમાં નિંદાને પાત્ર થઈ સંસારચક્રમાં પરિ-ભ્રમણું કરે, અને ને પ્રમાદ રહિત ભાવ સાધુપણે વીચરે, પ્રભુઆજ્ઞામાં રહી જ્ઞાન દર્શન ચારિત્રની વૃદ્ધિ કરે તો ચાર તીર્થમાં પૂજયનિક બને અને ચાર જતિનો અંત કરી સિદ્ધગતિને પામે.

૧૨૧ દસ્ત.

કાશી નગરમાં અગિનસિંહ નામે રાજ હતો, તેને શેષવતી નામક રાજીની હતી. તેનાથી એક મહા બ્લિષ્ટ પુત્ર થયો, તેનું નામ દસ્ત. તેણે પ્રલહાદ નામના પ્રતિવાસુદેવને માર્યો, જેથી તે ઉ મો વાસુદેવ કહેવાયો. પદ હંજર વર્ષનું આયુષ્ય ભોગવી, અરનાથ અને ભક્તીનાથ પ્રભુના આંતરામાં તે મૃત્યુ પામીને પાંચમી નરકે ગયો.

૧૨૨ દમયંતી.

વૈદ્યબૈશમાં કુંડનપુર નગરના લીમકરાજની પુત્રી અને અયોધ્યાપતિ નગરાજની પત્ની સતી દમયંતી સ્વયંવર મંડ-પમાં અનેક સુરનરાદિકને છોડી નગરાજ સાથે લગ્નથી જોડાઈ. તેમને એ બાળક થયા હતા. પાછળથી નળ પોતાના ભાઈ

કુભેર સાથે જુગાડ રમ્યા, પરિણામે નળને રાજ્યપાટ હારીને વનમાં જઈ રહેલું પડ્યું. સત્તી દમયંતી તેમની સાથે વનમાં આવી અને ત્યાં અનેક સંકટો સથાં. પારધી, વ્યાપારી, વ્યાધ આદ્ય અનેકના રાસદાયક પંજામાંથી બચી, શિયળનું રક્ષણ કરી તે અચળપુરમાં ઋતુપર્ણ રાજને લાં પોતાની માસીને ઘેર આવી. ત્યાં પણ કર્મવશાત્ર તેના પર હાર ચોર્યાનો આરોપ આવ્યો. સત્તીના શિયળ ગ્રલાવે હાર જડચો અને તેની માસીને આ આરોપ બદલ પશ્ચાત્તાપ થયો. આખરે પોતાના પિતા લીમક-રાજના માણસોની સાથે તે પિતાના રાજ્યમાં ગઈ. ત્યાં નળના મેળાપ માટે કુરી સ્વયંવર મંડપની કૃત્રિમ ચોજના કરી. કુમડા સ્વરૂપે નળરાજ સ્વયંવર મંડપમાં હાજર થયા. બંને મળ્યા. અને અત્યંતુ આનંદ થયો. વનવાસ કાળ પૂરો થયે નળ તથા દમયંતી પોતાના રાજ્યમાં ગયા. રાજ્ય ગ્રામ થયું. મનુષ્ય સંબંધી સુખ ભોગવતાં આખરે દમયંતીને વૈરાગ્ય થયો; અને તેણે દીક્ષા લીધી. પ્રત નિયમોનું સુંદર પાલન કરી, યથાસમયે કાળધર્મ પામી દમયંતી દેવલોકમાં ગઈ. તે મહાસત્તી તરિકે જગપ્રસિદ્ધ બની.

૧૨૩ દશારથરાજી.

તેઓ અયોધ્યા નગરીના અજ રાજના પુત્ર હતા. તેમને કૌશલ્યા, સુભિત્રા, અને કૈક્યો એ ત્રણ રાણીઓ હતી. તેમાં કૌશલ્યાથી રામ, (પદમ) સુભિત્રાથી લક્ષ્મણ અને શત્રુંઠ, તથા કૈક્યોથી ભરત એમ ચાર પુત્રો થયા. પોતે વૃદ્ધ થવાથી રામને ગાહી આપી દીક્ષા લેવાનો વિચાર કર્યો, આથી પ્રજનવર્ગ તથા અંતઃપુરમાં આનંદ થયો, પરન્તુ કૈક્યોને મનમાં અહેખાઈ આવી, તેથી તેણે અગાઉ મળેલાં વચ્ચનો દુર્ઘયોગ કરી ‘રામને વનવાસ અને ભરતને રાજ્ય’ એ પ્રકારની ભાગણી કરી, સત્યવાહી પુરષો જીવન કરતાં વચ્ચની કિંમત વધારે ગણે છે,’ એ સુજય દુઃખીત મને

અને શ્રીરામના અત્યાગ્રહથી તેમણે પોતાના વચનનું પાલન કર્યું.
રામ, લક્ષ્મણ અને સીતા વન તરફ વિદ્યાય થયા કે તરત જ
પુત્રના વિરહશોકે દશરથરાજ મૂર્ખ પામ્યા અને એજ સ્થિતિમાં
મૃત્યુ પામ્યા.

૧૨૪ દશાર્થભદ્ર.

ભ. મહાવીર ભરતક્ષેત્ર પર વિચરતા હતા. એ અરસામાં
તેમનો પરમ લક્ત દશાર્થભદ્ર નામનો રાજ દશાર્થભદ્ર દેશનો
અધિપતિ હતો. તેને એવો નિયમ હતો કે 'પ્રભુ મહાવીર હાલ
ક્યા સ્થળે અસરાજમાન છે' એના વર્તમાન અલ્યા પછી જ તે
જમતો. એક પ્રસંગે ભ. મહાવીર તેજ નગરીમાં પદ્ધાર્યા. ધામધૂમ
પૂર્વક દશાર્થભદ્ર પ્રભુને વાંદવા ગયા. આ વખતે તેમને અલિમાન
થયું કે આવી મહાન ઋક્ષિ અને શોલાથી મહારા સિવાય પ્રભુને
કોણું વાંદવા જતું હશે? આ અધ્યવસાયની ખખર દેવસલામાં
શકેન્દ્રને પડી, તેથી તે દેવે રાજનું અલિમાન ઉતારવા એક ૫૦૦
મોઢાવાળો હાથી બનાવ્યો, અને દરેક મોઢામાં આઠ આઠ દંતુશણો
સ્થાપ્યા. દરેક દંતુશળમાં આઠ આઠ વાવો બનાવી. દરેક વાવમાં
લાખ લાખ પાંખડીવાળાં કુમળો બનાવ્યા; તથા દરેક પાંખડીમાં
નાટયપ્રયોગો ગોડાવ્યા. આવી ઋક્ષિવડે તે ભગવાનના દર્શને
આવતો હોય તેવો તેણે દેખાવ કર્યો. આ જોઈ દશાર્થભદ્ર રાજનું
માન ગળી ગયું. તપાસને અંતે તેને જણાયું કે, આ બધી વ્યુહ
રચના દેવતી છે; આથી તેણે દેવનું માન લંગ કરવાનો નિશ્ચય
કરી પ્રભુ પાસે આવી દીક્ષા લીધી. શકેન્દ્ર દીક્ષા બેવા માટે અસ-
મર્થ હતો, તેથી તેણે દશાર્થભદ્રના પગમાં પડી તેની ક્ષમા માગી.
દશાર્થભદ્રે ચારિત્રનું અદ્ભુત પાલન કર્યું, ખૂબ તપશ્ચર્યા કરી,
અને કૈવલ્યજ્ઞાન પામી તેઓ મોક્ષમાં ગયા.

૧૨૫ દ્વિપૃષ્ઠ.

દારિકાનગરીમાં ખલ નામે રાજ હતા. તેમને પહ્રમાદેવી નામક રાણી હતી. તેનાથી એક મહા વલિછ પુત્ર થયો. નામ દ્વિપૃષ્ઠ. દ્વિપૃષ્ઠ રાજ થયા પછી તારક નામના પ્રતિવાસુદેવને માર્યો અને બીજે વાસુદેવ થયો. વાસુપૂજય પ્રલુના વખતમાં ૭૨ લાખ વર્ષનું આયુષ્ય લોગવી, ભરણ પામીને તે છી નરકે ગયો.

૧૨૬ દ્વિમુખ (પ્રત્યેક ઘુષ્ટ)

પાંચાળ દેશના કંપિલપુર નગરમાં જ્ય નામે રાજ રાજ્ય કરતો હતો. તેને ગુણમાળા નામે રાણી હતી. ઉલય દંપતી બહુજ ધર્મિષ્ટ હતા. તેમને જૈન ધર્મ પ્રત્યે ધણો પ્રેમ હતો. એકવાર રાજ કચેરી ભરીને સલામાં એડો છે, તેવામાં એક પરદેશી ચારણુ રાજસલામાં દાખલ થયો, અને મહારાજના ગુણોની પ્રશંસા કરવા લાગ્યો. આ સાંલળી રાજ બોલ્યો:-બારોટજ, તમે દેશ દેશાવરમાં ફરો છો, અનેક રાજસલામાં જાઓ છો, તો તમે મારી સલામાં ડોઈ વરતુની ઉણુપ જોઈ શકતા હો તો જરૂર કહો, કેમકે માત્ર આત્મશ્લાધા મહને પસંદ નથી. આ સાંલળી બારોટે રાજસલામાં ચોતરક નજર કરી, તો તેને એક વરતુની ઉણુપ લાગી. એટલે તે રાજ પ્રત્યે બોલ્યો:-મહારાજ, આપની રાજસલામાં બધુયે સુંદર અને વ્યવસ્થિત છે, પણ એક ચિત્રશાળા નથી, તેજ મોટી ઉણુપ છે. આ સાંલળી રાજએ કહ્યું : બરાબર છે બારોટજ, તમારું કહેવું બરાબર છે. એમ કહી તરત જ રાજએ કુશળ ચિત્રકારોને બોલાવ્યા. અને સલાના હોલમાં એક ચિત્રશાળા તૈયાર કરવાનું કહ્યું.

ચિત્રકારોએ આવી કામ શરૂ કર્યું. અથમ તે મકાનનો પાયો એદવા માંડયો કે તરતજ તે પાયામાંથી એક રલજડિત્ર મુગટ નીકળ્યો. કારીગરોએ તે મુગટ રાજને આપ્યો. દિવ્ય મુગટ જોઈ

રાજ આનંદ પામ્યો અને તેણે તે પોતાને માથે મુક્યો. મુગટ ક્રેવા શાસે છે તે જાણવા સાંચ રાજએ પોતાનું મહેં આરીસામાં જોયું. એટલે તેમાં તેને પોતાના એ મહેં દેખાયા. તે ઉપરથી તેનું નામ દ્વિમુખ તરીકે ગ્રસિક્ષ થયું.

ચિત્રકારોએ ચિત્રશાળા તૈયાર કરી. તેની આરોહણ કિયા માટે તે ભક્તાનની વર્ણે તેમણે એક સુશોભિત સ્તંભ ઉલ્લો કર્યો. સ્તંભને વખ્તાલંકારોથી શાણગારી લભ્ય અને આકર્ષક બનાવ્યો. રાજ આ ચિત્રશાળાની આરોહણ કિયા કરવા માટે આવ્યો. ચિત્રશાળાની નમુનેદાર કારીગરી જોઈ તે ખૂબ સંતોષ પામ્યો. એટલું જ નહિ પણ સ્તંભની ચમત્કૃતિ અને મોહક દેખાવ જોઈ રાજના આનંદનો પાર રહ્યો નહિ. તે હર્ષપૂર્વક બારોટ પ્રત્યે ઓલ્યો: કેમ બારોટજુ. હવે આ ચિત્રશાળા બરાબર છે ને? બારોટે જવાબ આપ્યો:

હા, મહારાજ. અત્યાર સુધી આવી ચિત્રશાળા મેં કયાંઈ જોઈ નથી. રાજ આનંદ પામી સ્વર્થાનકે આવ્યો.

કેટલાક દિવસ બાદ પેદો ઉલ્લો કરવામાં આવેલો સ્તંભ ઉખાડી લેવામાં આવ્યો. તેના પરંથી વખ્તાલંકારો ઉતારી લઈ ને ભાણુસોએ તે લાકડાનો સ્તંભ ચિત્રશાળાના એક ખુણામાં આડો ફેંકી દીધો. વખત જતાં આ લાકડા પર ૨૯ ધૂળ વગેરે જમા થયું. પરિણામે સ્તંભ તહન બેડોળ લાકડાના હુંકા જેવો અતી ગયો. એકદા પ્રસંગે રાજ ફરીથી આ ચિત્ર-સલામાં આવ્યો. ત્યાં તેણે એક ખુણામાં લાકડાનું હુંકા પડેલું જોયું. તે જોઈને તેણે પાસે ઉલ્લોલા રક્ષકને પૂછ્યું. અલ્યા, આ લાકડું અહિં કેમ મુક્યું છે? રક્ષકે જવાબ આપ્યો:-મહારાજ, આપે સલામંડપ કરાવ્યો, તે વખતે ને સ્તંભ બોડવામાં આવ્યો હતો, તે સ્તંભ ઉતારી લઈને અહિયાં મુક્યો છે.

રાજ આશ્રમ પાભી મન સાથે ખોલી ઉડ્યો. પેલાં લખ
અને સુંદર સ્તંભતી આખરે આ દશા ? શું ત્યારે તે ભાગ વચ્ચે
અને અલંકારોથી જ સુંદર લાગતો ? ખરેખર માર્ણ શરીર પણ
એક વખત આ દશાને પામશે ! અત્યારે સુશોભિત હેખાતાં ઝારા
આ શરીરની પણ આખરે આ લાકડાનાં હુંડા જેવી દુર્દશા
થવાની જ ! તો પછી આજેજ, અરે અત્યારે જ શા માટે આ
શરીર પરથી ભમતા ન ઉતારવી ? કાળનો કયાં ભરંસો છે ? ખરેખર
પર વસ્તુઓનું ભાગ આ જીવને મુંજવે છે, પૌદ્યગણિક વસ્તુઓના
મોહમાં અંધ બની ખરેખર મેં આત્મકલ્યાણ સાધ્યું નહિ.

(એક મુસુકુએ ખરેજ કહ્યું છે કે—

પર વસ્તુમાં નહિ મુંજવો, એની દધા મુજને રહી;

એ ત્યાગવા સિદ્ધાંત કે પશ્ચાત્ હુંખ તે સુખ નહિ.

હું કોણું છું ? કયાંથી થયો ? શું સ્વરૂપ છે માર્ણ ખરું ?

કોના સખંધે વળગણું છે ? રાખું કે એ પરિહિરું ?

હા. ખરેખર એ બધી વળગણુંએ ત્યાગવા ચોંચ છે.) એમ
કહી દ્વિસુખ રાજએ ત્યાંજ પોતાના સધળાં વચ્ચાલંકારો ઉતારી
નાયા, અને પંચમુષ્ટિ લોચ કરી સ્વયંમેવ દીક્ષા લઈ ચાલતા થયા.
ખૂબ તપ, જપ, સંવર કરી કૈવલ્યજાનને પાભી દ્વિસુખ પ્રત્યેકખુદ
મોક્ષપદને પામ્યા.

૧૨૭ દેવદત્તા.

સુગ્રતિષ્ઠિત નામનું નગર હતું. મહાસેન નામે રાજ હતો. તેને
ધારિણી પ્રમુખ એક હજાર રાણીએ હતી. ધારિણીને એક પુત્ર
થયો હતો. તેનું નામ સિંહસેન, કુમાર યુવાવસ્થા પાંચંતાં તેને ૫૦૦
સંજકન્યાએ પરણાવી, પાંચસો સુંદર મહેલો બંધાવી આપ્યા,
પાંચસો ક્રોડ સોનૈંયાં, પાંચસો હાથી, એમ દરેક પાંચસો પાંચસો

ચીને આપી. કુમાર સુખપૂર્વક રહેવા લાગ્યો. એટલાક વર્ષે રાજ મૃત્યુ પામ્યો. અને સિંહસેનકુમારને ગાડી ભળી. પાંચસો ખીઓમાં સામદેવી તેની પટરાણી હતી. સિંહસેન સામદેવી રાણીમાં મોહાંધ ઘન્યો. હતો. અને બાકીની છોઈ ખીનો તે આદર કરતો નહિ; તેથી બાકીની ૪૮૮ ખીઓએ ભળીને સામદેવીને મારી નાખવાનો વિચાર કર્યો. આ વાતની સામદેવીને ઘરર પડી. તેથી તે શોક-શુવનમાં જઈને આર્થિકાન ધરતી ચિંતામગ્ન થઈને બેડી. રાજ આવ્યો, ચિંતાનું કારણ પૂછતાં તેણે હકીકત જહેર કરી. રાજએ ઉપાય કરવાનું આશ્વાસન આપી રાણીને સંતુષ્ટ કરી.

રાજએ માણુસો દ્વારા એક ‘મહેમાન ધર’ બંધાવ્યુ. અને તેમાં આવવા માટે તેની ૪૮૮ રાણીઓને નોતરી. રાણીઓ ત્યાં આવી. રાજએ તેમના માટે સ્વાધિપ લોજન, સુંદર વખાલુપણો, ઇણ કુલ ગંધમાળા વગેરે મોકલાબ્યાં. રાણીઓ ખુશી થઈ. લોજન કરી, સુંદર અલંકારો સળ તેઓ સધળી નૃત્યગાન કરતી આનંદ કરવા લાગી. એટલામાં સિંહસેન પોતાના માણુસો સાથે ત્યાં આવ્યો. તેણે મહેમાનધરના ચારે તરફના દરવાજ બંધ કરાવી, મકાનને આગ લગાડી. ૪૮૮ રાણીઓ પીડાથી આકંદ કરતી બળીને લરમ થઈ ગઈ.

સિંહસેન રાજ ધોર પાપ કર્મથી મરીને છડી નરકમાં ગયો. ત્યાંથી નીકળી રોહિદ નગરમાં દત્ત સાર્થવાહની ખી કન્હશ્રીની કુક્ષિમાં પુત્રીપણે તે ઉત્પન્ન થયો. આ પુત્રીનું નામ દેવદત્તા. તે ધરણી ખૂઅસુરત હતી. બાલ્યાવસ્થા વીતાવી યુવાન બની.

એકવાર દેવદત્તા નહાઈ ધોઈ, વખાલંકાર ફેરી આનંદ કરી રહી હતી, તેવામાં રોહિદ નગરનો સમણુદ્દત્ત નામનો રાજ તેના ધર પાસેથી નીકળ્યો. દેવદત્તાનું રૂપ જોઈ રાજ વિસ્મય પામ્યો. તપાસ કરતાં જણાયું કે તે દત્ત સાર્થવાહની પુત્રી દેવદત્તા છે અને તે કુંવારી છે.

રાજએ પોતાના યુવરાજને માટે દાને ત્યાં તે પુત્રીનું માગું કરાવ્યું. દા સાર્થવાહ કિસુલ થયો. વિવાહ નક્કી થયો. અને ઘણોજ ધામ-
ધૂમથો દેવદત્તા તથા યુવરાજ પુસનંદી લગ્નથી જોડાયાં.

ત્યારાદ સમયુક્ત રાજ મરી ગયો. પુસનંદી રાજગાદીપર
આવ્યો. અને તે પોતાની મા શ્રીહેવીનો ભક્ત બની ગયો. રોજ શ્રી-
હેવીના પગમાં પડે, તેને વંદન કરે અને ઘણો વખત તે ત્યાંજ ગાણે.
આથી દેવદત્તાને અદેખાઈ થઈ આવી, અને તેણી શ્રીહેવીનો ઘાટ ઘડ-
વાનો વિચાર કરવા લાગી. એકવાર શ્રીહેવી એકાંતમાં બેડી હતી. પાસે
કોઈજ ન હતું. આ તકનો લાલ લઈ દેવદત્તા ત્યાં આવી પહોંચી.
તેણે એક લોખાંડનો ખીલો તપાવ્યો. અને જ્યારે તે ખીલો ખૂઅ લાલચોળ
થયો, ત્યારે તેણે તે લઈને શ્રીહેવીના ગુણ અંગમાં પેસાડી દીવો.
તથો તે ખૂઅ જોરથી કારમી ચીસ પાડીને મૃત્યુને શરણ થઈ ગઈ.
આ લથાનક ચીસ સંભળીને દાસી એકદમ ત્યાં દોડી આવી.
એવામાં દેવદત્તાને તેણે નાસતી જોઈ. શ્રીહેવીને ભરણ પામેલી
દેખીને તેને ઘણું દુઃખ થયું. આ વાત તરત તેણે રાજ પાસે જઈને
જાહેર કરી. વાત સંભળતાંજ પુસનંદી મૂર્છિત થઈને જમીન પર
દળી પડ્યો. કેટલીક વારે શુદ્ધ આવ્યા બાદ તે ઘણું રોયો. પછી
તેણે માતાની મૃત્યુદિયા કરી. રાજએ દેવદત્તાને પકડી મંગાવી. તેને
બાંધી, અને કંસીનો હુકમ કરમાવ્યો.

હુકમ મુજબ તેને કંસીએ ચડાવવામાં આવી. અને ભરીને તે
પહેલી નરકે ગઈ. ત્યાંથી નીકળીને તે પૃથ્વી, પાણી, અદ્દિન, વાયુ
અને વનસપતિમાં થઈ પશુ, પક્ષી, તિર્યચાહિયોનીમાં લટકી, અનંત
સંસાર પરિબ્રમણ કરતી યાવત મોક્ષગતિને પામશે.

સારઃ—ઇધાંનિ અને કામાંનિ કેટલા બધાં કર છે, તે આ વાત
પરથી સમનારો.

૧૨૮ દેવકી.

દારિકાના ઉત્ત્રસેન રાજના ભાઈ દેવકિરાજની તે પુત્રી હતી. તેનું લગ્ન દારિકાના અંધકવિશુન! પુત્ર વસુદેવ સાથે થયું હતું. તેના કાકના દીકરા કંસનો તેના પર વધારે પ્રેમ હતો. અતિસુક્તા સુનિદ્વારા કહેવામાં આવેલું કે દેવકીનો સાતમો ગર્ભ કંસને મારશે. આ પ્રમાણે કંસે જણ્યાથી દેવકીની સુવાવડો પોતાને ત્યાં કરાવવાનો તેણે પ્રયંધ કર્યો. દેવકીના પ્રથમના અનિકસેન વગેરે છ બાળકો દેવના સાહરણુથી સુલસાને લાં મૂકાયા હતા અને વૃદ્ધિ પામી શ્રી નેમનાથ પાસે તેઓએ દીક્ષા લીધી હતી. દેવકીજી તો જણુતી હતી કે પોતાને મૃત બાળકોનું જન્મયા છે. ત્યારાદ સાતમા બાળક શ્રી-કૃષ્ણનું પણ દેવ વડે સાહરણ થયું અને તે ગોકુલમાં ઉછ્યાં. ત્યાર પછી શ્રીકૃષ્ણ જ્યારે દારિકાના રાજ થયા અને અનિકસેનાદિ છ પુત્રો સાધુવેશે દેવકીને ત્યાં ગૌચરી અર્થે પધાર્યાં, ત્યારે તેઓનું સમાન રૂપ આદિ લોઈ દેવકીના શરીરમાંથી પુત્ર પ્રેમ સ્પૂરી આવ્યો. આ વાતનો લેદ જ્યારે ભગવાન નેમનાથે દેવકીને કલ્યો, ત્યારે તેને પુત્રને રમાડવા, હસાવવા વગેરેનું સહભાગ્ય પ્રાપ્ત ન થવાથી, પશ્ચાત્તાપ થયો. દેવકીની આ ચિંતા ટાળવા શ્રીકૃષ્ણે દેવનું આરાધન કર્યું, અને દેવકારા જણુવામાં આન્યું કે તેને એક પુત્ર થશે, આથી દેવકી આનંદ પામી. આખરે તેણે ગંજસુકુમાર નામે મહા ભાગ્યશાળી પુત્રરત્નનો જન્મ આપ્યો, દેવકીએ બાળકને રમાડવાનો પોતાનો મહદલિલાષ પૂરો કર્યો. ત્યારાદ દારિકાનગરી બળા, અને દેવકી પોતાના પતિ વસુદેવ સાથે રથમાં બેસી તરાએ નગરીની બહાર નીકળતી હતી, તેવામાં એકએક દરવાળે તૂટી પડવાથી તે ચંગદાઈને મૃત્યુ પામી.

૧૨૯ દેવાનંદા.

અધ્બુતાઙુંડ નગરમાં ઋષલદત અધ્બુતાઙુની તે પતની હતી. ભગવાન મહાવીરદેવ દશમા દેવલોકથી ચ્યવી તેની કુદ્ધિમાં ઉત્પન્ન

થયા. તીર્થકરની ભાવાની નેમ દેવાનંદાએ ૧૪ સ્વમ દીડાં. લિક્ષુક કુળમાં સર્વજ્ઞ તીર્થકરો કદી જન્મે નહિ, પણ આ વખતે એક અછેં (આશ્રમ) થયું જાણ્યું, હરિણગમેધી હેવે ૮૨મી રાત્રીએ મહાવીરના આ ગર્ભનું સાહરણ કર્યું અને ક્ષત્રિયકુંડમાં ત્રિશલાટેવીની કુક્ષિમાં તે ગર્ભ મૂક્યો. તે વખતે ત્રિશલાની કુક્ષિમાં પુત્રીનો ને ગર્ભ હતો, તે હેવે દેવાનંદાની કુક્ષિમાં મૂક્યો, આ વખતે દેવાનંદાએ પ્રથમ આવેલાં સ્વર્ણ નાશ પાભતાં હોય તેવાં સ્વર્ણ જોયાં, તેથી તેણે શાક કર્યો. લ. મહાવીર કૈવલ્યજ્ઞાન થયા પછી એક પ્રસંગે આલણુંડ (આલણુંડ)માં પદ્ધાર્યાં. ત્યાં દેવાનંદા પોતાના સ્વામી સાથે પ્રખુના દર્શને ગઈ. લગવાનને દેખી દેવાનંદાના સ્તનવિભાગમાંથી પુત્રપ્રેમની નેમ દૂધની ધારાએ દૂઠી. તેણીના અંગો પ્રફુલ્લિત થયાં. આ દેખાવ શ્રી ગૌતમે જોયો. તેથી તેમણે લગવાનને તેનું કારણ પૂછ્યું. લગવાને કલ્યું કે તે આ લવની ભારી ભાતા છે, એમ કહી સર્વ હકીકત કહી. આથી દેવાનંદાને ઘણો હર્ષ થયો. તેણે દીક્ષા લીધી અને તેજ ભવમાં દેવાનંદા કર્મનો ક્ષય કરી મોક્ષ પામી.

૧૩૦ દ્રૌપદી.

ચંપા નામની નગરી હતી. તેમાં ત્રણુ આલણો રહેતા હતા. નામ. ૧ સોામ ૨ સોમદાત ઉ સોમભૂત. તેઓ ધણુજ ધનાદ્ય હતા. તેઓને ત્રણુ સ્ત્રીએ હતી. તેમનાં નામ અતુક્રમે. ૧ નાગશ્રી, ૨ ભૂતશ્રી, ૩ યક્ષશ્રી. એકદા તે બધાએ વિચાર કર્યો કે આપણી પાસે પુષ્કળ દૃષ્ય છે. માટે વારાકરતી દરેક ધેર બધાંએ જમવું. તે પ્રમાણે એક પછી એક વારા કરતી દરેકને ધેર બધા સાથે જમતા. એક વખત નાગશ્રી આલણીને ત્યાં બધાયને જમવાનો વારો આવ્યો. નાગશ્રીએ ભાતભાતની સ્વાદિષ્ટ રસોઈનાવી, વળી ખૂઅ સંભાર નાખીને તુંઅડીનું શાક બનાવ્યું, સ્વાદ માટે ચાખી જોતાં તે શાક કડવું અર નેવું લાગ્યું. તેથી વિચાર કર્યો કે આવું શાક હું.

પીરસીશ, તો મારી હાંસી થશે, નિંદા થશે. માટે તેની વ્યવસ્થા કરે. ત્યારથાદ તેણે ખીજું શાક બનાવ્યું અને બધા આનંદ પૂર્વક જમ્યા. તે વખતે ધર્મધોષ નામના મુનિ તે ઉદ્ઘાનમાં ખીરાજતા. તેમને ધર્મ-ઇચ્છિ નામના મહાન તપસ્વી શિષ્ય હતા, જે માસખમણુની તપશ્ચર્યા કરતા. માસખમણુને પારણે તેઓ ગૌચરી અર્થે કરતાં કરતાં આ નાગશ્રી આલણુને ઘેર જરૂર ચડયા. આલણી હર્ષ પામી. અને આ કડવી તુંઅડીનું શાક વહેરાવવાનું પાત્ર મહારાજને જાણુને તે શાક તેણે વહેરાવ્યું. ધર્મઇચ્છિ અણગાર ગૌચરી કરીને ગુરુ પાસે આવ્યા અને નિયમ મુજબ આહાર બતાવ્યો. કડવી તુંઅડીની ગંધથી ધર્મધોષ મુનિએ તે શાકમાંનું એક બિંદુ લઈને ચાખી જોયું તો તેમને તે કડવું વિષ સમાન લાગ્યું. તેથી તેમણે કહ્યું કે હે શિષ્ય, આ શાક એર સમાન છે માટે તે તમે ખાશો નહિ અને ખાશો તો મરણ પામશો, માટે આ શાકને એકાંત નિર્દેખ જમીનમાં પરડી આવો. ધર્મઇચ્છિ અણગાર તે શાક લઈને એકાંત સ્થળે ગયા. અને જ્યાં શાકનું એક બિંદુ નીચે નાખ્યું, લાં તો શાકની ગંધથી હજરો કીડીએ લેગી થઈ ગઈ. અને તે ખાવાથી બધી મરણને શરણ થઈ. આથી ધર્મઇચ્છિએ વિચાર કર્યો કે કડવી તુંઅડીના એક બિંદુ માત્રથી હજરો કીડીએનો નાશ થયો. તો આ બધા શાકથી કેટલાંએ જીવાના જાન જરે! તો મહારે પોતાને આ શાક ખાઈ જવું છિદ્ધ છે. તેમ ધારી તેઓ ત્યાંને ત્યાં બધું શાક ખાઈ ગયા. શાક કેવળ એર સમાન હતું તેથી તેની અસર પ્રણભી ગઈ. ધર્મઇચ્છિને અતુલ વેદના ઉત્પન્ન થઈ. ધર્મઇચ્છિ અણગારે સંથારો કર્યો. પંચ ભરમેણિનું રમરણ કરતાં ભાવ સમાધિમાં તેઓ ભૂત્ય પામ્યા, અને સર્વાર્થસિદ્ધ વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયા.

ધર્મધોષ સ્થવીરે આ વાત જાણી, શાક ક્યાંથી આવ્યું તે વાત તેમણે પોતાના શિષ્યોને કરી. વાત ગામભાં પણ પ્રસરી અને બધા લોકો નાગશ્રીને ધિક્કારવા લાગ્યાં. ત્રણ આલણોએ પણ વાત

જાણી, તેથી કોધાતુર બનીને તેમણે નાગશ્રીને માર મારીને ધરમાંથી કાઢી મૂકી. રસ્તામાં પણ ધણા લોકો તેને ખોજવતાં, મારતાં, અને ધિક્કારતાં હતાં. ક્યાર્થી તેને આશ્રય ન મળ્યો. જ્યાં ત્યાં તે લટકવા લાગી. તેને સોળ રોગ ઉત્પન્ન થયા. તે મહાવેદનાના પરિણામે મૃત્યુ પામી, અને મરીને છડી નરકમાં ગઠ્યી.

ત્યાંથી નીકળી અનેક તિર્યંચ નરકના ભવ કરતી તે ચંપાન-ગરીમાં સાગરદત્ત સાર્થ્વાહને ત્યાં પુત્રીપણે અવતરી. તેનું સુકુમારીકા નામ પાડવામાં આવ્યું. બાલ્યાવસ્થા વીતાવી તેણે યુવાવસ્થામાં પ્રવેશ કર્યો. પછી તેને તેજ નગરીમાં જીનદત્ત શેદના સાગર નામનાં પુત્ર સાથે પરણાવી. સુકુમારીકાના શરીરમાં પાપના ઉદ્યે અમૃતજીવર હતો. એટલે કોઈ માણુસ તેને અડકે તો અમૃતની માઝક તે દાઢે. તેના શરીરનો સ્પર્શ માત્ર તરવારની ધાર સમાન લાગે. સાગરપુત્ર સુકુમારીકાનો સ્પર્શ કરવા જતાં દાઝ્યો. તેથી ભય પામ્યો, અને સુકુમારીકાને છોડી તેજ રાત્રીએ ધરમાંથી ચાલી ગયો. આ વાતની જીનદત્ત શેદને તથા ધણાને ખખર પડી. સાગરદત્ત સાર્થ્વાહે વાત જાણી તેથી પોતાની પુત્રીને ધેર લાવ્યો અને ભીજે પરણાવવાનો વિચાર કર્યો. તેવામાં એક લટકતો ભીખારી સાર્થ્વાહે જોયો, તેથી તેને ઓલાવી ભાન પાન આપી જમાડ્યો. સુંદર વચ્ચા-ભુષણો પહેરાવી સુકુમારીકા સાથે તેના લમ કર્યો. લમની પહેલી રાત્રીએ તે દરિદ્રી સુકુમારીકા પાસે જતાં, તે પણ દાઝ્યો અને વેદના પામ્યો. તેથી તે પણ ત્યાંથી નાસી પલાયન કરી ગયો.

સુકુમારીકા હવે પોતાના કર્મનો પશ્ચાત્તાપ કરવા લાગી. તેવામાં ગોવાલિકા નામના સાધ્વીજ તહેને ત્યાં પદ્ધાર્યો. સાધ્વીજએ ઉપદેશ આપ્યો. સુકુમારીકાને વૈરાગ્ય થયો. અને પિતાની આજા લઈને તેણીએ દીક્ષા લીધી. એકુવખત નગરીની બહાર ઉદ્ઘાનની પાસે છઠ છઠનો તપ કરી આતાપના લેવાનો વિચાર તેણે સાધ્વીજ પાસે જહેર કર્યો.

સાધીજુએ બહાર એકલા નહિ રહેતા, સમુદ્રાયમાં રહી તપ કરવાનું કહ્યું. પરંતુ તે નહિ માનતા સુકુમારીકા સાધીજ બહાર ઉદાન પાસે જઈ તપ કરવા લાગ્યા.

એકવાર તે ઉદાનની પાસે પાંચ પુરુષો દેવદત્તા નામની ગણિંડાને લઈ કીડા કરતા હતા, અને તે પાંચેય પુરુષો વિકાર વશ બની દેવદત્તાની સાથે પ્રેમવિનોદ કરતા હતા અને મનુષ્ય સંબંધીના બોગ બોગવતા હતા. આ દ્રષ્ટ્ય પેલી સુકુમારીકા આર્યાના જેવામાં આવ્યું. તેથી તેણે સંકલ્પ કર્યો કે ભારા તપ સંયમ અલ્લાર્યાનું ઇળ હોય તો આવતા ભવમાં હું પાંચ પુરુષો સાથે બોગ બોગવતી વિચરે. સંકલ્પ પુરો કરી તે આતાપના ભૂમિમાંથી સ્વરસ્થાનકે ઉપાશ્રયમાં આવી. ત્યાં તે ચારિત્રની વિરાધના કરવા લાગી. વારંવાર હાથ પગ ધોવે, ભર્તક ધોવે, ઝોડું ધોવે. તેથી ગોવાલિકા આર્યાજુએ કહ્યું કે આપણને શરીરની દુગંછા કરવાનું કલ્પે નહિ. છતાં તે નહિ માનતાં સ્વર્ચંદ્રપણે રહેવા લાગી. કાળાન્તરે તે મૃત્યુ પામીને ખીજ દેવલોકમાં ગઈ.

પાંચાળદેશ, કંપીલપુર નગર, ત્યાં દ્રૌપદી રાજ રાજ્ય કરતો હતો. તેને ચુલણી નામની રાણી હતી. તેને ત્યાં આ સુકુમાર દેવી પુત્રીપણે અવતરી, અને તેનું નામ દ્રૌપદી રાખવામાં આવ્યું. અપૂર્વ સુખ સામગ્રીમાં અને અનેક દાસદાસીઓનાં લાલન પાલનથી બાલ્યાવસ્થા વીતાવી તે ઘૌવનાવસ્થાને પામી. દુપદરાજાએ પુત્રીની ઘૌવનાવસ્થા અને સૌંદર્ય જોઈને સ્વયંવરથી લગ્ન કરવાની ધર્ચિછા બતાવી. રાજાએ સ્વયંવર બનાવ્યો, અને કૃષ્ણ વાસુદેવ, સમુદ્રવિજય, બળદેવ. ઉગ્રસેન આદિ અનેક રાજાઓને દુતદારા કુમકુમપત્રિકા મોકલી સ્વયંવરમાં નોતર્યા. પરિણામે ધણા રાજાઓ ત્યાં આવ્યા. પાંચ પાંડવો પણ આવ્યા. દ્રૌપદી પોતાની દાસીઓ સાથે અશ્વરથ પર ઐસીને સભામંડપમાં આવી અને કૃષ્ણવાસુદેવ પ્રમુખ અનેક રાજાઓને

ગ્રણાભ કર્યો. ત્યારખાદ પુષ્પમાળા કેને પહેરાવવી તે માટે દરેક રાજાઓને વઠાવીને પૂર્વના નિયાણા (સંકલ્પ)ને વશ થઈને, તે પાંચ પાંડવોની પાસે આવી, અને તેમના કંઠમાં પુષ્પમાળા પહેરાવી. કુપદરાજાએ પાંચ પાંડવોને સન્માનપૂર્વક રાજ્યલુલુલિનમાં લાવીને દ્રૌપદીનું પાણીશ્વરણ કરાવ્યું. પાંચ પાંડવો દ્રૌપદી સાથે પોતાના હસ્તીનાપુર નગરમાં ગયા અને સુખ લોગવવા લાગ્યા.

એકવાર પાંચ પાંડવો દ્રૌપદી સાથે અંતઃપુરમાં એઠા હતા. તેવામાં નારદજી આવ્યા. પાંડવોએ ઉલા થઈ નમસ્કાર કર્યો. નારદને અપ્રતીત, અસંયતિ, અગ્રત્યાખ્યાની જણીને દ્રૌપદીએ વંદન ન કર્યું. આથી નારદને લાગ્યું કે પાંચ પાંડવોની સ્ત્રી થઈ છે. તેથી તેને અભિમાન આવ્યું જણ્યા છે, માટે તેને વિપત્તિ આપવી જોઈએ, એમ ચિંતની નારદ ત્યાંથી રજ લઈને ગયા.

ત્યાંથી તે અમરકંકા રાજ્યધાનીમાં જર્દી પદ્મનાભ રાજ પાસે આવ્યા, અને દ્રૌપદીના ઇપના ધણ્યાજ વખાણ કર્યો. રાજને દ્રૌપદી મેળવવાની છદ્ધા થઈ. તેણે દેવની સહાય માગી. દેવ કહ્યું કે દ્રૌપદીને હું લાવી આપીશ, પરંતુ તું તેની સાથે સ્નેહ બાંધવામાં સક્ષળ થઈશ નહિ. તે મહા સતી અને પતિવતા છે. પદ્મનાભના તપથી દેવ આવ્યો. તેણે હસ્તિનાપુરમાંથી પલંગમાં સૂતેલી દ્રૌપદીને ઉપાડી અમરકંકામાં લાવ્યો. રાજાએ દ્રૌપદીને ધણ્યું સમજાવી. પણ તે સક્ષળ થયો નહિ. પાંડવોને ખખર પડી. નારદજી આવ્યા. વાત કરી, નારદે અમરકંકામાં એકવાર દ્રૌપદીને જોઈ હતી તેમ કહ્યું. પરિણામે પાંડવો તથા શ્રી કૃષ્ણ મહામહેનતે ત્યાં ગયા અને દ્રૌપદીને લાવ્યા. અનુક્રમે સુખ લોગવતાં દ્રૌપદીને મુત્ર થયો. પાંડુસેન તેનું નામ પાડ્યું. કુમાર યુવાવસ્થાને પામ્યો.

એકવાર સ્થવીર મહાત્મા પધાર્યા. પાંડવો દ્રૌપદી સાથે વંદન

કરવા ગયા. સ્થવીર મહાતમાએ ધર્મબોધ આપ્યો. અધા વૈરાગ્ય પામ્યા અને પાંડુસેન પુત્રને રાજ્ય સેંપી દીક્ષા લીધી.

દ્રૌપદી ૧૧ અંગ લણી, ધણ્ણ વર્ષ સંયમ પાળી એક ભાસનો સંથારો કરી પાંચમા અહંકરણોકમાં દેવતાપણે ઉત્પન્ન થઈ. ત્યાંથી નીકળી તે મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈ મોક્ષ જરો.

ન્યાય—નિયાણું એ ખુરી વસ્તુ છે, મહાન તર કરવા છતાં તેનાથી સુકૃત થઈ શકતું નથી. જેમ દ્રૌપદીએ સુકુમારીકાના ભવમાં નિયાણું કર્યું તેમ, અધિય વસ્તુનું દાન સુપાત્રને આપતું તે મહાન અનર્થ છે, જેની રીતે નામશીએ કડવી તુંણીનું દાન ધર્મર્થથી અલગારને આપ્યું તેમ.

૧૩૧ ધન્યકુમાર (ધન્નો).

પ્રતિષ્ઠાનપુર (પૈટણપુર) નગરમાં ધનસાર નામે શેડ હતો. તેને ચાર દીકરા હતા. ૧ ધનદા, ૨ ધનદેવ, ૩ ધનચંદ્ર ૪ ધન્ય-કુમાર ઉર્ફે ધન્નો. ધન્નો સૌથી નહાનો, પણ ખુદ્ધિમાં, ગુણુમાં, ઇપમાં સર્વથી અધિક હતો. ધનનાના જન્મવાથી ધનસારના ધનમાં ખૂબ વૃદ્ધિ થયેલી, તેથી શેડ તેના પર ખીજ કરતાં વિશેષ ગ્રેમ રાખતા, આથી તેના ખીજ લાઈએ ધનનાની અહેખાઈ કરવા લાગ્યા. ધનસારે તેની અહેખાઈ ન કરવા ત્રણે પુત્રોને ધણું સમજાવ્યા. પણ તેઓ માન્યા નહિ. તેના બાપે દરેકના લાગ્યની પરીક્ષા કરવા કેટલુંક ધન આપ્યું, પરન્તુ ધના સિવાય ખીજાએએ પોતાનું ધન ગૂમાવ્યું, જ્યારે ધનનાએ પોતાની તીવ્યખુદ્ધિ વડે ધણું ધન ગ્રામ કર્યું. આથી લાઈએની છર્ષા વધો. તેમણે ધનાને મારી નાખવાનો વિચાર કર્યો. આ વાત ધનનાના જાણવામાં આવ્યાથી તે છાનોમાનો નાસી ગયો. કરતો કરતો તે ઉજજથિનીમાં આવ્યો. ત્યાં પોતાના પરાકમથી તે રાજ્યનો પ્રધાન થયો. સમય જતાં ધનસાર શેઠની સધળા સંપત્તિ નાશ પામી. તે લિખારી બની ગયો; તેથી તે

પોતાના પુત્રો, પુત્રવધુઓ વગેરેને લઈ મળુરી કરવા માટે દેશાવર જવા નીકળ્યો. ઇરતા ઇરતા સધળાં ઉજજયિનીમાં આવ્યા, અને ત્યાં મળુરી કરવા લાગ્યા. એકવાર ધનકુમારે તેમને ઓળખ્યા. માતા-પિતા તથા ભાઈઓની આવી હુર્દશા થએલી જોઈ તે ખેદ પામ્યો. તેણે સધળાઓને પોતાના મહેબમાં રાખ્યા. અહિં પણ ધનાના ભાઈઓ તેની અદેખાઈ કરવા લાગ્યા. તેઓએ ધનાની સુડીમાં ભાગ માય્યો. ક્ષેણના જ્યે ધનાએ સધળી સંપત્તિ તેમને સ્વાધીન કરી દીધી અને પોતે પરહેશ જવા નીકળ્યો. ગંગા નદીના કિનારા પર આવતાં ગંગાદેવીએ તેના સત્યની પરીક્ષા કરવા માટે પોતાની સાથે પ્રેમ સંબંધ બાંધવા કહ્યું, પરન્તુ ધન્યકુમાર પોતાની ટેકમાં વિચલિત ન થયો. આથી પ્રસન્ન થઈ ને ગંગાદેવીએ તેને ચિંતામણી રતન આપ્યું. તે લઈ તે રાજગૃહ નગરમાં આવ્યો, ત્યાં કુસુમપાળ નામક શેઠના બગીચામાં તેણે વિશ્રાન્ત લીધી. ધનાના પગલાથી સૂકાઈ ગયેલો બગીચો નવપદ્ધવિત થયો. બાગરક્ષકે શેઠને આ ખાર આપ્યા. શેડે ધનાને પોતાને ત્યાં તેડી જઈ, ભાગ્યશાળી માની તેને કુસુમશી નામની પોતાની પુત્રી પરણાવી. ધનો અહિં સુખ ભોગવવા લાગ્યો.

એ અરસામાં શ્રેણિક મહારાજનો હાથી ભર્સીએ ચડ્યો અને બંધન તોડાવી નાડો; તેને ધનાએ વશ કર્યો. (આ વખતે અભ્ય-કુમાર ઉજજયિનીમાં કેદ હતો) તેથી શ્રેણિક રાજએ પોતાની સોમશી નામક પુત્રી તેને પરણાવી. તે રાજગૃહમાં શાંતિલક્ષ્ણા પિતા ગોલ્દ શેઠ રહેતા હતા. તેને એક કાણો દગ દગવા આવેલો, તેનાથી ધનાએ શેઠને બચાવ્યા, તેથી ગોલ્દરશેડે ધનાને પોતાની પુત્રી સુલદ્રા પરણાવી. ધન્યકુમાર મનુષ્ય સંબંધીના સુખ ભોગવતો સુખેથી હિવસો પસાર કરવા લાગ્યો. પરન્તુ હજુયે તેને માટે શાંતિથી બેસવાનું ન હતું. ઉજજયિનીમાં રહેલા તેના ભાઈઓ થોડાજ વખતમાં બધો

લક્ષ્મી પાપના યોગે પરવારી બેઠા, એટલે તેઓ રાજગૃહમાં આવ્યા. અહિં પણ ધનાએ તેમને આશ્રય આપીને પોતાને ત્યાં રાખ્યા; પરંતુ ‘સંજન પોતાની સંજનતા છોડે નહિ, અને દુર્જન દુર્જનતા છોડે નહિ’ એ નિયમ મુજબ અહિંયા પણ ભાઈઓએ કલેશનો આરંભ કરી દીધો; એટલે ધનો તે નગર છોડી કૌશાંખીમાં આવ્યો, ત્યાં તેણે રાજના રત્નની પરીક્ષા કરી, તેથી રાજએ તેને રત્નમંજરી નામની પોતાની કન્યા પરણાવી, તથા પાંચસો ગામ આપ્યાં. ધનકુમાર ધનપુર નામનું શહેર વસાવી ત્યાં રહેવા લાગ્યો. તે શહેરમાં પાણીની તંગી હોવાથી તેણે એક મોટું સરોવર જોદાવવા માંડ્યું.

દુર્જનના ભાગ્યમાં દુઃખ જ હોય છે એ મુજબ રાજગૃહમાંની વિપુલ સંપત્તિ પણ ધનાના ભાઈઓ ગુમાવી બેઠા, એટલું જ નહિ પણ તેમને ખાવાનાં સાંસા પડવા લાગ્યા. આથી તે બધા મળ્ણુરી શોધતા શોધતા ધનપુરમાં આવ્યા. તેમની સાથે ધનાની સ્વી સુભદ્રા પણ આવી. સધળાએ તળાવ પર કડીયા કામ કરવા લાગ્યા; અને નજીકમાં એક ઝુંપડું બાંધીને રહ્યા. સમય જતાં ધનાને આ ખખર પડી, એટલે તેણે ધીરે ધીરે યુક્તિસર પ્રગટ થવાનું દૃચ્છિયું. તેણે પોતાને લ્યાંથી છાશ લઈ જવાનું પોતાના વૃષ્ટ પિતાને કહ્યું. આથી પોતાની લોાંઝાઈએ તેને લ્યાંથી છાશ લઈ જવા લાગી. તેમને ધનકુમાર આધી પાતળી છાશ આપવાનો પ્રથાંધ કરતો. અને પોતાની સ્વી સુભદ્રાને જડી છાશ, તથા દર્ઢી, દૂધ વગેરે આપતો. આથી વૃષ્ટ ડોસો ખૂશ થતો. એકવાર ધનાએ પોતાની પત્નીના શિયળની પરીક્ષા કરી; તેણે સુભદ્રાને લલચાવીને પોતાને આધિન થવાનું કહ્યું, પણ સુભદ્રા પોતાના પાતિત્રત્યથી ઉગી નહિ, આખરે ધનો પ્રગટ થયો. સુભદ્રાના હર્ષનો પાર રહ્યો નહિ. સુભદ્રાને તેની ઝુંપડીમાં ન જવા હેતાં, ધનાએ ત્યાંજ રાખી, આથી તેના ભાઈએ તપાસ કરવા ધનાની ડેલીએ આવ્યા. તેમને પણ ધનાએ લ્યાં જ

રાયા. છેવટે ધનાએ સધળી હકીકત જણાવી, આથી ભાઈઓ તથા માતા પિતા પ્રસન્ન થયા. ધનાએ પોંતાને મળેલાં ૫૦૦ ગામો-માંથી દરેક ભાઈને લાગ વહેંચી આપ્યો. છતાં પણ દુર્જનોએ પોતાની દુર્જનતા છોડી નહિ, તેથી ધનો પુનઃ રાજગૃહમાં આવ્યો. રસ્તામાં લક્ષ્મીપુરના રાજની દીકરી ગુણ્ણાવળી તથા તેના મંત્રીની પુત્રી સરસ્વતીને તે પરણ્યો. આ ઉપરાંત તે એ અણ્ણિવર્ણોની કન્યાએ પરણ્યો. એકંદર ધનનો આઠ સ્ત્રીઓ પરણ્યો; અને રાજગૃહમાં આવી ચૂખ્પૂર્વક રહેવા લાગ્યો.

એકવાર ધન્યકુમાર સ્નાન કરે છે, સુભદ્રા તેને તેલનું મર્દન કરે છે, તેવામાં એકાએક સુભદ્રાની આંખોમાંથી ઉણ્ણ આંસુઓ ટપક્યાં અને ધનનાના શરીર પર પડ્યા. ધનાએ ચમકીને સુભદ્રાને પૂછ્યું:-શા હુઃએ ચક્ષુઓમાં આંસુ લરાયાં છે ?

સુભદ્રાએ કહ્યું:-નાથ, હુઃખની વાત છે કે ભારા ભાઈ શાળી-લક્ષ્મને વૈરાગ્ય થયો. છે અને તે દરરોજ એક એક પત્નીનો લાગ કરે છે, એ રીતે ઉર દિવસે ઉર સ્ત્રીઓનો ત્યાગ કરીને તે દીક્ષા દેશો, એ હુઃએ હું રહું છું.

ધનો સંસારની અસારતાના તરંગે ચાડ્યો. વિચાર કરી તે બોલ્યો:-પ્રિયા, શાળીલક્ષ્મ રોજ એકેક સ્ત્રી લાગે, એ તો કાયરતાની નિશાની કહેવાય.

સુભદ્રા બોલી:-નાથ, કહેવું સહેલું છે, પણ કરવું અધરે છે.

ધનાએ કહ્યું:-લે, લારે, મેં આજથી ભારી આડેય સ્ત્રીઓને ત્યાગી. હું હવે દીક્ષા લઈશી.

સુભદ્રા બોલી:-નાથ ! એકાએક આમ ન થાય.

“ વીર પુરુષનું વચન મિથ્યા ન થાય ” એમ કહી ધનો ઉલ્લો થયો. કપડાં પહેર્યાં, અને શાળીલક્ષ્મને દારે જઈ તેને વૈરાગ્યનો

બોધ આપ્યો. શાળીભાડ અને ધનાએ સર્વની રજ લઈ દીક્ષા લીધી. ઉત્ત્ર તપશ્ચયાં અને સંયમની આરાધનાને અંતે એક ભાસનું અનશન કરી ધના અણુગાર સર્વાર્થસિદ્ધ વિમાનમાં ગયા અને લાંથો મહા-વિદેહમાં જન્મ લઈ મોક્ષમાં જશે.

૧૩૨ ધના અણુગાર.

કાકંડી નગરીમાં ભદ્ર નામની સાર્થવાહિનીના તે પુત્ર હતા. યૌવનાવસ્થા પામતાં તેમને ઉચ્ચય કુળની ઉર કન્યાએ પરણાવવામાં આવી, અને તેઓ મનુષ્ય સંબંધીનું વિપુલ સુખ લોગવતા હતા. એકદા ઉઠ મહાવીર તે નગરીમાં પધાર્યા. દ્વેકોનો કોલાહલ સંભળી તેઓ પણ લોકોની સાથે પ્રલુની દેશનામાં ગયા. દેશના સંભળી તેમને તીવ્ર વૈરાગ્ય સ્કૂર્યો અને ભાતા તથા સ્ત્રી વગેરેની રજ મેળવી તેમણે દીક્ષા લીધી. ધનાકુમારનો દીક્ષા મહોત્સવ નિતશત્રુ રાજે કર્યો. દીક્ષા લીધા પછી તરત જ તેમણે ઉત્ત્ર તપ કરી કર્મ ક્ષય કરવાનો નિર્ણય કર્યો. તેમણે પ્રલુને કહ્યું: ભગવાન, તમારી આજ્ઞા હોય તો હું આજ્ઞથી જ છઠ છદ્દનો તપ કરું અને પારણાને દિવસે આયંખીલ કરું અને તે એવી રીતે કે, ધરધણીને ખાતાં વધે, તેમજ તે આહાર કોઈ પણ અતિથિને આપવાનો ન હોય, અને તે કાઢી નાખવાનો હોય એવો આહાર ભર્યા હાથે કોઈ વહેરાને તો જ ક્ષેવો. ભગવાને આ પ્રકારનો તપ કરવાની તેને અનુમતિ આપી. ધના અણુગારે આ પ્રમાણે લાંખા વખત સુધી તપશ્ચયાં કરી શરીરને સ્ફુરેલુકે (શોષવી) કરી નાખ્યું. એકવાર શ્રેણીક રાજ પ્રલુભ મહાવીરને વંદન કરવા આચ્યા, તેમણે પ્રલુને પૂછ્યું:—ભગવાન ! આપના ૧૪ હન્જર સાધુમાં ઉત્કૃષ્ટ કરણી કરનાર કયા સાધુ છે ? ભગવાને કહ્યું: ધના અણુગાર. શ્રેણીકે પૂછ્યું: પ્રલુ, કેવી રીતે ? વીર પ્રલુએ ધના અણુગારના ઉત્કૃષ્ટ તપનું વર્ણન કર્યું, તે સંભળી

અણિક ખૂબ આનંદ પામ્યા અને ધજા અણગાર પાસે જઈ વંદન કરી બોલ્યા:-હે મહા મુનિ, હે મહા તપસ્વી, આપનો જન્મ સાર્થક હૈ. એ પ્રમાણે વંદન-સુતિ કરી અણિક સ્વર્થાનકે ગયા. લારાદ શરીર હાડપિંજર જેવું થઈ ગયેલું જાણી ધ્યનના અણગાર ગ્રલુની આજા લઈ વિપુલગીરી પર્વત પર ગયા અને ત્યાં અનશાન કર્યું. એક માસના અનશનને અંતે તેઓ કાળધર્મ પામ્યા. અને ઇક્તા નવ માસનું ચારિત્ર પાળ્યું હોવા છતાં, ઉત્કૃષ્ટ તપના પ્રલાવે તેઓ સર્વાર્થસિદ્ધ વિમાનમાં દેવ થયા. લાંધી મહાવિદેહમાં અવતરી તેઓ મોક્ષમાં જશે.

૧૩૩ ધજા સાર્થવાહ

રાજગૃહી નગરીમાં મહા ઋષિવંત ધજા નામનો સાર્થવાહ રહેતો હતો, તેને લક્ષ નામની સુરવરૂપવાન સ્ત્રી હતી. તેને કોઈ પણ જાતની કમીતા ન હતી. વિપુલ ધન, ધાન્ય, નોકર ચાકર, સુંદર સ્ત્રી ધર્ત્યાદિ સર્વ વાતે તે સુખ્યી હતો, પરંતુ તેને એકેય પુત્ર ન હતો, એજ તેને સુખ્ય હુઃખ હતું. લક્ષ અહનિશ ચિંતવતી કે ધન્ય છે તે માતાને કે જેને ધેર પારણું જુદે છે, જે પુત્રને સ્તનપાન કરાવે છે, બાળકને રમાડે છે અને જીવનનો અણુમેદ્યો આનંદ ભોગવે છે. લક્ષને પુત્ર ન હોવાથી તે અહનિશ શોકમાં દીવસો વીતાવતી.

એક હિસ લક્ષ પોતાના ભરથારની આજા લઈને રાજગૃહી નગરીની બહાર યક્ષના મંદિરમાં ગઈ. તેની પૂજા કરી સેવા ભક્તિ કરવા લાગી. જે પોતાને પુત્ર પ્રાપ્તિ થાય તો મંદિરના ભંડારમાં વિપુલ દ્રોઘ ખર્યવાની લક્ષાએ ત્યાં પ્રતિરૂપ કરી અને પોતાને ધેર આવી. કાળીનાન્તરે તે ગર્ભવતી થઈ. ગર્ભધારણના બે માસ પછી તેને યક્ષના દર્શાન કરવાનો હોઢ થયો. તેથી તે સુંદર વખ્તાલંકાર પહેરી યક્ષના મંદિરે ગઈ, યક્ષની ધૂપ વગેરેથી પૂજા કરી સ્વર્થાનકે આવી. અતુક્રમે

नव भासे पुत्रनो ग्रसव थयो. हेवे पुत्र आध्यो एवी मान्यताथी तेनुं नाम ‘देवदत्तकुमार’ पाउयुं. केटलांय वर्षे तेने पुत्र सांपडयांथी तेना आनंदनो पार न्हेतो. पुत्रने विविध वस्त्रालंकारो, आलरण्णो पहेराववाभां ते बहु ज आनंद भानती. एक वर्खत अद्राओ तेना पंथक नाभना दासपुत्रनी साथे आ देवदत्त कुमारने पुष्कण आकु-षण्णो पहेरावी रभाइवा भाटे बहार भोडल्यो. पंथक नाभनो दास केटलाङ्क भागडो साथे कुमारने आणकिडा कराववा भाटे लाई गयो.

कुमार अहिंतहिं इरतो हतो. पंथकनी नजर अन्य भागडो तरइ हती. ते तक्नो लाल लाई ते गाभभां वसनार अने चौर्य-कणाभां प्रविष्ट एवो विजय नाभनो चोर त्यां आव्यो. देवदत्त पर धरेण्णां लेईने तेनुं भन मूर्छित थयुं, एक तरइ रभता आ देवदत्त कुमारने एकदम उपाडीने चोर त्यांथी पलायन करी गयो. एक अगीचा पासे आवी ते भागडना शरीर परथी धरेण्णां उतारी भागडने तेणु भारी नाख्युं अने पासेना एक झूवाभां तेनुं शर्म इंको दृष्टि चोर खोताना रहेवाना स्थाने चाल्यो गयो.

थोडीवारे देवदत्तने साचवनार पंथके देवदत्त तरइ लेवा भांडयुं तो त्यां देवदत्तने जेयो नही. पंथकने ध्रासडो पडयो. आम तेम तेनी तपास करवा भांडी, पण अंडी ते भागडनो पतो लाग्यो नहि. पंथक निस्तेज अने शोकातुर वद्दने धेर आव्यो अने कुमार ग्रुम थथानी वात जणावी. वात सांलणां धनो मूर्छांगत थर्छने धरणी पर ढणी पडयो. अद्रा होडी आवी, तेना हुःअनो पणु पार न रह्यो. आम आल तूटी पडयो हेय तेनुं तेने लाग्युं. धनो शुद्धिभां आव्या बाद क्रोटवाण पासे गयो, पुष्कण द्रव्यनी भेट धरी अने कुमारने शोधी आपवा क्रोटवाणने कह्युं. क्रोटवाण हथीयारो लाई कुमारनी शोधभां नीकणी पडयो. नगरी बहार उघान पासे एक झूवाभां ते भागडनुं भृत शरीर लेवाभां आव्युं त्यांथी कुमारने

મારનારના પગરવનો કોટવાળે કીનો લીધો, અને વિજય ચોર જે જગ્યાએ રહેતો લાં જ તે ગયો. ચોરને પકડીને બાંધ્યો અને તપાસ કરતાં સર્વ આભરણો નીકળ્યાં. ત્યાંથી તે ચોરને બાંધી રાજ્ય દરખારમાં લાવ્યો અને તેને કેદખાનામાં પૂરવામાં આવ્યો. કાળાન્તરે ધના સાર્થવાહનો શોક વિસારે પડ્યો.

એક દિવસ ધના સાર્થવાહ રાજ્યના દાણ ચોરી જેવા કોઈ અલ્પ ગુન્હા માટે અપરાધમાં આવ્યો, તેથી કોટવાળ તેને કેદખાનામાં લઈ ગયો અને જ્યાં વિજય ચોરની કોટડી હતી તેમાં જ તેની સાથે ધના સાર્થવાહને પણ બાંધીને પૂરવામાં આવ્યો. ધના સાર્થવાહની સ્ત્રી પોતાના પતિ માટે વિવિધ જાતની રસોઈ બનાવીને પંથક નામના દાસની જોડે મોકલાવતી, જે સાર્થવાહ જમતો અને દિવસો વ્યતિત કરતો.

એક વખત વિજય નામના ચોરે, ભુખ્તૃષાથી પીડાતો હોછને, આવેલાં ભોજનમાંથી પોતાને થોડું ક આપવા ધનાને વિનાંતિ કરી. ધનાએ ગુરુસામાં જવાય આખ્યો કે હું આ અજ વધે તો ફેંકી દઉં, પરંતુ તને તેમાંથી લગાર માત્ર પણ ન આપું. કેમકે તું મારા પુત્રનો ધાતક છે, તેમ કહી તેણે વિજય ચોરને અજ ન આપ્યું. ખોરાક ખાવાથી ધનાને જંગલ જવાની ઢર્ચણ થઈ, તેથી તેણે વિજય ચોરને સાથે આવવા વિનાંતિ કરી, પણ વિજય ચોરે તેનું કહેવું માન્યું નહિ. અંતે બહુ આજુજુ કરવાથી ધના સાર્થવાહ પોતાને માટે આવેલ ખોરાકમાંથી તેને આપે, એવી સરતે વિજય ચોર ધના સાર્થવાહની સાથે ગયો. બીજે દીવસે ભાત લઈને પંથક આવ્યો અને ધનાને આપ્યું. ધનાએ પંથકના દેખતા વિજય ચોરને તેમાંથી ભાગ આખ્યો. પંથક ઘેર ગયો અને લદાને આ વાત કરી; લદાને શોકનો પાર ન રહ્યો.

કેટલોક વખત વીલા બાદ ધનાના સગાં સંખાંધીઓએ રાજને

દંડ આપીને ધનાને છોડાવ્યો. ધનો ધેર આવતાં કુદુંખીઓએ તેનો આદર-સતકાર કર્યો; પરંતુ લદાએ તેનો આદર કર્યો નહિ. ધનાને આશ્રય થયું. કારણ પૂછતાં લદાએ જણાવ્યું કે પુત્રનો ધાતક વિજય ચોર, તેને અનુ આપવાથી મને કોષ કેમ ન થાય? ધનાએ કહ્યું, આપણો દુઃમન વિજય ચોર તેને તું સનેહિ તરીકે ગણું; કેમકે મને જંગલ જવાની છંચા થવાથી મારી સાથે લઈ જવાની ખાતર અનુ આપવાની સરતે મારે તેમ કરવું પડ્યું હતું; પણ ધર્મભાવથી કે પ્રેમ ભાવથી મેં તેને અનુ આપ્યું નહતું. આ સાંલળી લદાને સંતોષ થયો અને તે પતિને પ્રેમથી મળો.

વિજય નામનો ચોર લુખતૃપાથી પીડાઈને, ચાખુક વગેરેના મારથી અશક્ત બનીને, આર્ત્થાનથી કેદખાનામાંજ ભરણ પામ્યો અને મરીને નરકે ગયો, ત્યાં અનંત દુઃખ ભોગવીને સંસાર પરિભ્રમણ કરશે.

તે સમયે રાજગૃહી નગરીના ઉદ્ઘાનમાં ધર્મધીષ નામના સ્થનીર પધાર્યા, ધના સાર્થવાડ વંદણા કરવા ગયો. ધર્મોપદેશ સાંલળી દૈરાગ્ય પામ્યો અને તેણે દીક્ષા લીધી. ધણ્ણા વર્ષ સાધુ પ્રવનજ્યા પાળી એક માસનો સંથારો કરી તે સુધર્મ નામના પહેલા દેવદોક્ભા ગયો અને ત્યાંથી મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈ મોક્ષમાં જશે.

ન્યાય—જેમ વિજય ચોર ધન માર્ગમાં લુખ્ય થયો તેમ જેન સાધુ યા સાધ્વી દીક્ષા લેછને ધન, માલ, મળિ, રતન વગેરેમાં લુખ્ય થાય, તો સંસાર પરિભ્રમણ કર્યો. પડે જેમ ધનાએ તેને સનેહિ ગણી આહાર ન આપ્યો, તેમ સાધુ સાધ્વીએ ઝ્રિ, રસ, વિષય માટે શરીરને ખોરાક ન આપતાં જ્ઞાન, દર્શન, ચારિત્રની વૃદ્ધિ મારેજ આપે, તો ધનનાની માફક સંસાર પરિત કરી શકે.

૧૩૪. ધર્મનાથ

રલપુર નગરના ભાતુરાજની સુવતા રાણીના ઉદ્ઘાતનાં ભગવાન ધર્મનાથ વૈજ્યંત વિમાનમાંથી ચયવી વૈશાક શુદ્ધ સાતમે ઉત્પન્ન થયા. માતાએ ચૌદ સ્વર્ણ દીહાં. મહા શુદ્ધ ત્રીજે પ્રલુનો જન્મ થયો. દિગ્કુમારી દેવીઓએ સૂતિકાકર્મ કર્યું. ઈદ્રોએ પ્રલુને મેર પર્વત પર લઈ જઈને જન્મોત્સવ કર્યો. પિતાએ પણ જન્મોત્સવ ઉજવ્યો. માતાને પ્રલુન ગર્ભમાં આવતાં ધર્મ કરવાનો દોહુદ થએલો હોવાથી આ લાવી તીર્થકરનું “ધર્મનાથ” એવું નામ પાડ્યું. ધર્મનાથ યૌવનાવસ્થા પામ્યા ત્યારે તેમને અનેક રાજ-કંન્યાઓ પરણ્યાવવામાં આવી. અઢી લાખ વર્ષ વ્યતીત થયા પછી ધર્મનાથ પિતાની રાજગાદી પર આવ્યા. પાંચ લાખ વર્ષો સુધી રાજ્ય ભોગવ્યું. તે પછી વરસીદાન આપી, મહા શુદ્ધ ૧૩ ના રોજ છુટ તપ કરી ૧ હજાર પુરુષો સાથે તેમણે દીક્ષા લીધી. પ્રલુને બે વર્ષ છદ્મસ્થાવસ્થામાં રહ્યા. ત્યારાદ પોશ શુદ્ધ પુનમે તેમને કૈવલ્યશાન થયું. તેમને અરિષ્ટ આદિ ૪૩ ગણુધરો થયા. અઢી લાખમાં બે વર્ષ ઓછા સમય સુધી તેઓ કૈવલ્ય પ્રવર્ણયામાં વિચચારા. અનેક લખ્ય જીવાનો ઉદ્ઘાર કર્યો. ધર્મનાથ પ્રલુના સંધ પરિવારમાં ૬૪ હજાર સાંધુ, ૧૨૪૦૦ સાધ્વીઓ, ૨૪૦ હજાર શ્રાવકો અને ૪૧૩ હજાર શ્રાવકિઓ હતો. છેવટે ૧૦૮ મુનિઓ સાથે એક ભાસના અનશને જોઈ શુદ્ધ પાંચમે, પ્રલુન સમેત શિખર પર સિદ્ધ થયા. ધર્મનાથ જિનતું એકંદર આચુષ્ય દર્શા લાખ વર્ષનું હતું.

૧૩૫. નમિ, વિનમિ.

અયોધ્યાની આસપાસના પ્રદેશમાં વસતા કર્ય નામક રાજને નમિ નામનો પુત્ર હતો. ભગવાન ઋષિભદેવે દીક્ષા લીધી ત્યારે તે પ્રલુની આશાથી મહાકર્ય રાજના વિનમિ પુત્ર સાથે દેશાવર ગણો હતો. ઓછા આવતાં તેણે પોતાના પિતાને વનમાં

નોયા. તપાસ કરતા જણાયું કે ઋષભહેવતી સાથે તેમણે પણ દીક્ષા લીધી હતી. આથી રાજ્યની ધર્માચ્છેષણે નભિ અને વિનભિ પ્રભુ પાસે આવ્યા અને તેમની સેવા કરવા લાગ્યા. એવામાં નાગકુમારનો ઈંડ ધરણેન્દ્ર ત્યાં આવ્યો. તેણે તેઓને ભરતરાજ પાસે રાજ્ય માગવાનું કહ્યું, પરન્તુ નભિ વિનભિએ તો પ્રભુ પાસે જ રાજ્ય માગવાનો પોતાનો વિચાર જણાવ્યો. આથી ધરણેન્દ્રે પ્રસન થઈ તેમને ધણી વિદ્યાએ શીખવી; જેથી તેઓ વિદ્યાધર કહેવાયા. નભિએ વૈતાંચ પર્વત પર ૫૦ નગરો વસાવ્યા. જ્યારે ભરતરાજએ ચક્રવર્તી થતી વખતે દેશ સાધવા માંડ્યા લારે નભિ, વિનભિ તેમની સામે થયા. પણ ભરતરાજ પાસે તેમનું કંઈ ચાલ્યું નહિ. આખરે વિનભિ રાજએ પોતાની સુભદ્રા નામની દીકરી ભરતને પરણાવી. તે સ્વીરતન તરીકે ઓણખાઈ. નભિએ પણ ભરત મહારાજને અમૃત્ય વસ્તુએ ભેટ આપી. આગળ જતાં બંને જણાએ પ્રભુ પાસે દીક્ષા લીધી.

૧૩૬ નભિનાથ.

ભિથિલા નગરીમાં વિજ્ય નામના રાજની વદ્રા નામની રાણીની કુક્ષિમાં રર મા તીર્યકર શ્રી નભિનાથ વિજ્ય નામના વિમાનમાંથી ચ્યવીને આશ્વિન શુદ્ધ પૂર્ણિમાએ ઉત્પન થયા. માતાએ યૌદ સ્વપ્ન જોયાં. ગર્ભકાળ પૂરો થયે શ્રાવણ વદિ આઠમે પ્રભુનો જન્મ થયો. હટ્પન કુમારિકા તથા ઈંડ્રોએ આવી જન્મોત્ત્સવ ઉજવ્યો. ગર્ભના પ્રભાવથી સર્વ રાજએ વિજ્ય રાજને નભી પણ્યા હતા, તેથી પુત્રનું “નભિનાથ” એવું નામ આપ્યું. યૌવનવય થતાં તેઓએ પિતાની આજ્ઞાથી અનેક રાજ-કન્યાએ સાથે લમ કર્યું. ૨૫૦૦ વર્ષે તેઓ પિતાના રાજ્યાસને આવ્યા. પાંચ હજાર વર્ષ સુધી રાજ્ય કર્યું. ત્યાર પછી સંયમ દેવાનો અભિલાષ ધરી વરસીદાન આપ્યું અને અશાડ વદિ ૬ ના દિવસે પ્રભુએ ચારિત્ર અંગિકાર કર્યું. નવ માસ છિદ્રસ્થપણાના

વ्यतित થતાં જ માગશર શુદ્ધિ ૧૧ ના રોજ તેમને કૈવલ્યજીનાન થયું. ગ્રલુના સંધ પરિવારમાં ૨૦ હજાર સાંખુઓ, ૪૧ હજાર સાંખીઓ, ૧૭૦ હજાર આવકો અને ૩૪૮ હજાર આવિકાઓ હતા. ૨૫૦૦ વર્ષનું ચારિત્ર પાળી, સમેતશિખર પર એક માસનો સંચારો કરી શ્રી નમિનાથ તીર્થકર વૈશાક વદિ ૧૦ મે મોક્ષ પદ્ધાર્યા. તેમનું એકંદર આયુષ્ય દશ હજાર વર્ષનું હતું.

૧૩૭ નમિરાજ.

માળવા દેશના સુદર્શન નગરમાં મણીરથ રાજ રાજ્ય કરતો હતો. તેને યુગઆડુ નામે નહાનો ભાઈ હતો. તે યુગઆડુને મદન-રેખા નામની ખ્રી હતી. તે ઇપણે બંડાર હતી. તેનું મુખ પૂર્ણિમાના ચંદ્રને શરમાવે તેવું હતું. એકવાર મદનરેખાનું દેટિષ્ય-માન મુખાવિંદ મણીરથના જેવામાં આવ્યું. જેતાંજ તે ચક્કિત થઈ ગયો. તેના છદ્યમાં વિકાર ઉત્પન્ન થયો. અને કોઈપણ રીતે તેણે મદનરેખાની સાથે સ્નેહ બાંધવાનું છચ્છયું. તે રાજમંદિરમાં આંચ્યો. પણ તેને ઝાંચી ચેન પડ્યું નહિ. પળેપળે મદનરેખાનું મુખાવિંદ લેની નજર સામે તરવા લાગ્યું. મદનરેખાનો પોતાના પર સ્નેહ થાય તે સારું તે અનેક પ્રકારના સુંદર વખ્તો, આલુખણો, મેવા, મીઠાઈ વગેરે મોકલવા લાગ્યો. મદનરેખા પતિવૃત્તા ખ્રી હતી. તે સ્વપ્નેય અન્યને ચાહે તેવી ન હતી. મણીરથ ને ને ચીને મોકલે, તેના મદનરેખા સહ્ખ્ય સ્વીકાર કરતી. તે એમ સમજતી હતી કે પોતાના પરના નિર્દોષ સ્નેહને લીધે મણીરથ આ સધળું મોકલે છે; પણ તેને મણીરથની અધમ વાસનાની ઘણર ન હતી. વખત જતાં મણીરથને લાગ્યું કે મદનરેખા અને ચાહે છે. તેથીજ સર્વ વસ્તુઓનો તે સ્નેહપૂર્વક સ્વીકાર કરે છે. એકવાર મણીરથે દાસીને મદનરેખા પાસે મોકલી કહાયું કે મણીરથ તમને પ્રેમથી રહાય છે, માટે તમે તેમની પાસે જઈ આનંદ કરો અને મન-

ગમતાં સુખ ભોગવો. તમને યુગઆહુ તરફથી જોઈએ તેવું સુખ મળતું નથી. આ ઉપરથી મદનરેખા તરત મણીરથનો દુષ્ટ લાવ સમજ ગઈ. તેણે દાસીને જણાવી દીકું કે જ, લુચ્ચી, અહિંથી જલ્દી ચાલી જ. નહિતો અહિંજ હું તારા શરીરની હુર્દથા કરી નાખીશ. કરી આવી વાત મારી પાસે કરી છે તો અહિંથી તું જવતી જવા નહિ પામે. દાસો ત્યાંથી નાસી છુટી અને સંઘળી વાત મણીરથને કરી. મણીરથે વિચાર્યુ કે જ્યાં સુધી યુગઆહુ જવતો છે, ત્યાં સુધી તે મારી સાથે સ્નેહ નહિ કરે. એમ ધારી તે યુગઆહુને મારી નાખવાની તક શોધવા લાગ્યો.

સાંજનો સમય હતો. યુગઆહુ અને મદનરેખા કરવા માટે બગીચામાં આન્યા હતા. ખુશનુમા પવનતી લહેર આવતી હતી. યુગઆહુ આરામ લેવા એક બાંદડાપર સૂતો. મદનરેખા સુગંધીદાર પુષ્પો બાગમાં સુંટતી હતી. તે વખતે મણીરથ હાથમાં તરવાર લઈને ધામે પગલે બગીચામાં દાખલ થયો. અને પાછળથી આવી તેણે પોતાની તરવાર મ્યાનમાંથી કાડી યુગઆહુના ગળા પર ચલાવી દીધી. યુગઆહુ કારમી ચીસ પાડી બેહોશ બની ગયો. આ લયંકર ચીસ સાંબળી મદનરેખા યુગઆહુ પાસે દોડી આવે, તે પહેલાં જ મણીરથ પૂર વેગે દોડતો ત્યાંથી પસાર થઈ ગયો. અંધકારના આછા પ્રકાશમાં મદનરેખાએ મણીરથને આપણ્યો. તે સમજ કે આ દુષ્ટે મહારી સાથે સ્નેહ બાંધવા આ લયંકર કૃત્યું કર્યું છે. એર ! પણ મહારે હવે મહારા પતિની સહાગતિ થાય તેમ કરવું જોઈએ. એમ ધારી મદનરેખાએ છેલ્દાં શાસ લેતાં યુગઆહુના હૃદયમાં ધર્મતું શરણું આપણું. થોડીનારે યુગઆહુ મૃત્યુ પામ્યો અને શુલક્ષેષ્યાના પરિણામે તે દેવલોકમાં ગયો. અહિં મદનરેખાએ વિચાર કર્યો કે હવે મહારાં શું થશે ? દુષ્ટ મણીરથ મહારાપર અળાતકાર કરશે અને મહારાં શિથળ અંડિત કરશે. માટે મહારે તેના રાન્યમાં રહેવું ઉચિત નથી. એમ ધારી તે મનમાં ધૈર્ય ધારણું

કરીને ઉદ્ઘાનની ખાંડાર નીકળી અને જંગલમાં ચાલી ગઈ. ભાઈના ગળા પર તરવાર ચલાવી મહોરથ મહનરેખા મેળવવાના સ્વર્પન સેવતો ઉદ્ઘાનમાંથી પૂર ઝડપે હોડતો રાજમહેલ તરફ આવતો હતો. તેજ વખતે એક લયંકર સર્પ પર તેનો પગ પડ્યો. સર્પ ક્રોધાયમાન થયો અને તરતજ તેણે જેરથી મહોરથના પગને ડંખ દીધ્યો. મહોરથ લયંકર ચીસ પાડી તત્કાળ ભરણું શરણ થઈ ગયો, અને નરકમાં ગયો.

જંગલના લયાનક કષ્ટો સહન કરતી મહનરેખાએ એક વૃક્ષની ઓથે આશ્રય લીધો. ત્યાં તેણે એક પુત્રરતનનો જન્મ આપ્યો. આ પુત્રને એક ચીરમાં વીઠી તેણે વૃક્ષ નીચે મૂક્યો. પોતાના પતિની વીઠી તે પુત્રને પહેરાવી અને તે સ્નાન કરવા માટે નજીકના સરોવર પર આવી. તેવામાં એક મહોન્મત થયેકો હાથી ત્યાં આવી પહોંચ્યો. અને મહનરેખાને તેણે પોતાની સુંદરી લઈ અધર આકાશમાં ઉછાળી. મહનરેખા લયભીત બની. તેવામાં મહિંપ્રભ નામના વિદ્યાધરનું વિમાન આકાશમાર્ગ ઉડતું હતું. તે વિમાનમાં મહનરેખા જઈને પડી. મૃત્યુદ્વોકની અપ્સરા જેવી સ્વીને દેખી વિદ્યાધરનું મન ચલિત થયું, અને મહનરેખાને પોતાની સ્વી બનાવવાનું તેણે ચિંતન્યું. તરત તેણે પોતાનું વિમાન પાછું ફેરફયું. મહનરેખાએ વિદ્યાધરને પૂછ્યું. આપ ક્યાં જાઓ છો? મહિંપ્રભ બોલ્યો: હે દેવી! હું મહારા સાધુ થયેલા પિતાને વંદન કરવા જાઉં છું. પરંતુ તમારા જેવી સુંદર સ્વીને મહને લાલ મળ્યો, તેથી આ વિમાન પાછું વાળી ઘેર લઈ જાઉં છું. તમને ત્યાં મૂકીને પછીજ હું પિતાના દર્શને જઈશ. આ સાંભળી મહનરેખાએ કહ્યું. મહને પણ સાધુદર્શનની છુંછા છે. તો કૃપા કરી મને સાથે લઈ જાવ. વિદ્યાધર કાયુલ થયો. વિમાન સીધે રસ્તે ચાલવા લાગ્યું અને થોડા વખતમાં તેઓ મહિંપ્રભના દીક્ષિત પિતા મહોચૂડ પાસે આવી પહોંચ્યા. બંનેએ તમને વંદન કર્યું. સાધુ રાની હતા. તેઓ મહિંપ્રભનો દુષ્ટ હેતુ

જાણી ગયા. એટલે મદનરેખાને નહિ સતાવવાનો અને સતી સ્વીનું રક્ષણું કરવાનો તેમણે ભણિપ્રભને ઉપદેશ આપ્યો. ભણિપ્રભ પ્રતિષ્ઠાપ પામ્યો.

મદનરેખાએ જાણી મુનિને વંદન કરી પૂછ્યું. મહારાજ, મહારા બાળકને ઓળામાં બાંધીને હું વૃક્ષ નીચે મૂકી આવી છું. તો કૃપા કરી કહેશો કે તેની શા સ્થિતિ છે? મુનિ બોલ્યા:-હે સતી, મિથિલા નગરીનો પદ્મરથ રાજ કિંડા કરવા જંગલમાં આવ્યો હતો, તે તારા પુત્રને જેવાથી પોતાને પુત્ર ન હોવાથી તેને લઈ ગયો છે. ને સર્વ પ્રકારે સુખશાંતિમાં છે. તહારા પુત્ર પર રાજને ધણો જ ગ્રેમ છે. તે બાળકના રાજ્યમાં આવવાથી સર્વ રાજએ પદ્મરથને નમ્યાં, તેથી તેનું નામ ‘નમિરાજ’ પાડ્યું છે. આ સાંભળી મદનરેખા ઘૂમ આનંદ પામી. તેવામાં એક દેવ નાટચાનંદ કરતો ત્યાં આવી પહોંચ્યો. પ્રથમ તેણે મદનરેખાને વંદન કર્યું અને પછી મુનિને વંદન કર્યું. આ જોઈ વિદ્યાધરે આશ્રય પામી આમ બનવાનું મુનિને કારણું પુછ્યું. મુનિએ કહ્યું. મદનરેખા આ દેવની પૂર્વ જન્મની સ્વી છે. ને તેણે પોતાના પતિને મૃત્યુ વખતે ધર્મતું શરણું આપેલું; તેથી ઉપકારને વશ થઈ દેવે આ પ્રમાણે કર્યું છે. આ સાંભળી ભણિરથને આનંદ થયો અને તેણે સતીને ધન્યવાદ આપ્યો. તેવામાં આ આવેલો દેવ સતીને વિમાનમાં ઉપાડી ચાલતો થયો.

રસ્તે જતાં તેણે સતીને કહ્યું, હે પવિત્ર સ્વી, ભણીરથ મહોની નાખીને રાજમહેન તરફ જતો હતો, તેવામાં તેને સર્વ કરિવાથી તે ભરી ગયો છે અને સુદર્શન નગરનું રાજ્ય તહારા મોટા પુત્ર સૂર્યધશને મલ્યું છે. માટે હવે તું કહે ત્યાં તને હું લઈ જાઓ. આ સાંભળી મદનરેખાએ કહ્યું: દેવ! મહારે દીક્ષા લેવી છે તો મને સુવતા આર્થિક પાસે દીક્ષા અપાવો. દેવે તે પ્રમાણે કર્યું. મદનરેખા દીક્ષા લઈ આત્મકલ્યાણ કરવા લાગી.

અહિં નમિરાજ અનેક સુખમય સામગ્રીમાં વૃદ્ધિ પામ્યા. યુવાવસ્થાએ પહોંચતા તેમને એક હજાર સ્ક્રીએ પરણાવવામાં આવી. કેટલાક સમય બાદ પદ્મમરથ રાજ નમિરાજને રાજ્યાસને સ્થાપી દીક્ષા લઈ ચાલી નીકળ્યા. એકવાર નમિરાજનો સુલદ્ર નામનો હાથી મહોન્મત થઈને નાસી ગયો. તે હાથીને સુદર્શન નગરના સૂર્યધશ રાજના સુલદ્રાએ પકડીને બાંધ્યો. નમિરાજને આ વાતની ખખર પડી. એટલે પોતાનો હાથી પાછો મોકલવાનું સૂર્યધશને તેણે કહેવડાયું; પણ સૂર્યધશે તે આન્યું નહિ. પરિણામે બન્ને વર્ચે યુદ્ધ શરૂ થયું. સૌ પોતપોતાનું લશ્કર લઈ લડવા માટે રણસંગ્રહમાં આવી પહોંચ્યા. આ વાતની મદનરેખાને ખખર પડી; બને લાઈએને લડતા અટકાવવા માટે તે પ્રથમ નમિરાજની છાવણીમાં ગઈ. નમિરાજે તને દેખી વંદન કર્યું અને અયોગ્ય સમયે છાવણીમાં આવવાનું પ્રયોજન પૂછ્યું. જવાખમાં સાધ્વીએ કહ્યું. નમિરાજ, તને ખખર છે કે તું કોની સાથે આ યુદ્ધ ખેલે છે?

હા. સુદર્શનના રાજ સૂર્યધશ સાથે.

પણ તે તારો સર્ગો ભાઈ થાય છે. ભાઈ ભાઈની સાથે લડવું શું ઉચિત છે?

જરૂર નહિ. સતીજ. ચાદો હું અત્યારે જ લડત બંધ કરી મહારા ભાઈને મળવા આવું છું.

સખુર. હમણાં નહિ. મહને પ્રથમ જવા હે સૂર્યધશની છાવણીમાં.

મદનરેખા સૂર્યધશની છાવણીમાં ગઈ. સૂર્યધશે સાધ્વીને દેખી વંદન કર્યું. મદનરેખા ઓલીઃ સૂર્યધશ. હું તહારી માતા મદનરેખા છું.

સૂર્યધશ—તો તહમારો ગર્ભ કયાં?

આ નમિરાજ, તેજ મહારો ગર્ભ અને તહારો નહાનો ભાઈ!

સૂર્યયશ આશ્વર્ય પાણ્યો. અંતે ભાઈ પ્રેમથી મળ્યાં. સૂર્યયશ પોતાનું રાજ્ય નભિરાજને સોંપી દીક્ષા લઈ ચાલી નીકળ્યો. માતા સાધ્વી મદનરેખા યુદ્ધ વિરામ કરાવી ત્યાંથી ચાલી ગઈ. નભિરાજ રાજ્યસુખ લોગવવા લાગ્યા.

કેટલેક કાળે નભિરાજના શરીરમાં દાહનવર નામનો રોગ થયો, અનેક રાણીઓ આસપાસ એસીને તેમને ચંદ્દન બાવનાના તેલનું વિલેપન કરવા લાગી. રાણીઓએ હાથમાં કંકણો પહેરેલાં. તેલનું મર્દન કરતાં કંકણનો થતો અવાજ નભિરાજને હુઃખદાયક લાગ્યો. તેથી તે અવાજ બંધ કરવા તેમણે રાણીઓને કહ્યું. રાણીઓએ ઇકત એકેક કંકણ હાથ પર રાખી બાકીના કંકણો ઉતારી નાખ્યા. પરિણામે અવાજ બંધ થયો. નભિરાજને શાંતિ થઈ. તરતાજ નભિરાજ વિચારમાં પડ્યાઃ અહો ! કેવી અનુપમ શાંતિ ! અધાં કંકણો કેવો કોલાહલ મચાવી રહ્યા હતા ! ખરેખર એકલપણામાંજ સુખ છે. નભિરાજના વિચારો વૈરાગ્યભાવમાં પ્રવેશ્યા. આ ધન, વૈભવ, નોકર ચાકર એ સર્વ ભાત્ર કોલાહલભય અને વિધનરૂપ છે. ભાત્ર એકાંત ભાવમાંજ પરમ સુખ છે. જે મહારો આ રોગ નાયુદ થાય તો જરૂર હું દીક્ષા લઈ એકાંતવાસ સ્વીકારે. આ પ્રમાણે વિચાર કરતાં તેને શાંત નિંદા આવી ગઈ. પ્રાતઃકાળ થતાંજ નભિરાજનો રોગ નાયુદ થયો. વીર પુરુષો જે વિચાર કરે છે, તેને માટે તેઓ મજૂમજ હોય છે. નભિરાજે સર્વ રાજ્ય રિદ્ધિનો ત્યાગ કર્યો. સ્વીઓનાં, નગર જનોનાં સ્નેહભય વિલાપને છોડી, તેઓ આત્મકલ્યાણ અર્થે દીક્ષા લઈ ચાલી નીકળ્યા. તે વખતે તેમને દીક્ષા નહિ કેવા માટે દેવે આવી દશ પ્રશ્નો પૂછ્યા. (વિસ્તાર સુત્રમાં) તે સર્વના આત્માને લાગુ પડતાં યોગ્ય ઉત્તરો આપો નભિરાજે સ્વનિશ્ચયમાં મજૂમ રહી પ્રવન્યાં અંગીકાર કરી. સખ્ત તપજ્યપ સંવર કિયાઓ કરી, કૈવલ્યજ્ઞાન પામી તેઓ શાશ્વત સિદ્ધગતિને પામ્યા. ધન્ય છે પ્રત્યેકબુદ્ધ શ્રી નભિરાજને. હેમને આપણા અગણિત વંદન હો !

૧૩૮ નળરાજ.

તે અયોધ્યાપતિ નૈષધ રાજના યુવરાજ પુત્ર હતા; અને લીમક રાજની પુત્રી ભહાસતી દમયંતીને પરણ્યા હતા. સંસાર સુખ લોગવતાં તેમને ૧ પુત્ર અને ૧ પુત્રી એમ એ બાળકો થયા હતા. પિતાની ગાદીએ આવતાં, સત્ય અને ન્યાયપૂર્વક રાજ્ય ચલાવવાથી તેઓ કોકપ્રિય રાજ તરીકે સર્વત્ર પ્રશંસા પામ્યા હતા. પરન્તુ કર્મવશાત્ર એક દિવસે તેમનામાં દુર્યુદ્ધિએ વાસ કર્યો; તેથી તેઓ પોતાના ભાઈ કુષેર સાથે જુગાર રમ્યા. પરિણામે રાજ્યપાટ સર્વ ગુમાવીને તેમને વનનો પંથ સ્વીકારવો પડ્યો. છોકરાંઓને તેમના મોસાળ મોકલાવી, સતી દમયંતી વનના દુઃખ સહન કરવા પતિ સાથે ચાલી. એક રાત્રે દમયંતીને વગડામાં એકાકી મૂડી, નળરાજ તેને છોડી ચાલી ગયા. રસ્તે જતાં નળનો પિતા નૈષધ, કે જે અહ્લ નામના દેવલોકમાં દેવ થયો હતો, તેણે અવધિજ્ઞાનથી નળ પર આવેલી આકૃત નોઈ, તેથી તેણે અળતા અગ્રિમાં સર્પનું રૂપ વિકુર્ણી ભૂમ પાડી, આથી તે સર્પને અચાવવા નળરાજ ત્યાં ગયા અને સર્પને બહાર કાઢી અચાવ્યો, પરન્તુ તેના અદલામાં સર્પે નળને ડંશ મારી કુષ્ઠો અનાવી દીધો. નળે આશ્રય ચકિત અની કહ્યું: શાહખાશ, સર્પ ! ઉપકારનો અદલો તેં અહુ સારો આખ્યો ! સર્પે પોતાનું દેવરવરૂપ પ્રગટ કરી કહ્યું:-હે નળ, આ રૂપથી તને લાલ છે, કેમકે શત્રુઓથી ગુમ રહી શકાશે, એમ કહી તે દેવેનળને એક કરંડીએ અને શ્રીકૃષ્ણ આપ્યું, તે સાથે તેણે કહ્યું, કે તારે મૂળ સ્વરૂપ પ્રગટ કરવું હોય ત્યારે આ શ્રીકૃષ્ણ ઝાડને, એટલે તેમાંથી વસ્તો નીકળશે તે ખેણે, અને કરંડીયામાંનો હાર પહેરતાં તારું મૂળ સ્વરૂપ થઈ જશે. નળે સર્પનો આલાર માન્યો. સર્પ અદશ્ય થયો. પછી નળરાજ સુસુમા નામક નગરમાં ગયા, લાં એક ઉન્મત હાથીને વશ કર્યો. આંથી ત્યાંના દધિપર્ણ રાજએ નળને શારપાવ આપી, પોતાની પાસે રામ્યા. આખરે દમયંતીના પિતાએ

સ્વયંવર રહ્યો, તેમાં દધિપર્ણ રાજને આમંત્રણ આપ્યું. નળ રથ વિદ્યામાં પ્રવિષુ હતા. એટલે તે દધિપર્ણ સાથે સ્વયંવર ભંડપમાં ગયા. ત્યાં નળે પોતાનું અસલ સ્વરૂપ પ્રગટ કર્યું. લીમકરાજ, દમ્યંતી વગેરે આનંદ પામ્યા. કુદેરે નળને તેનું રાજ્ય પાછું સોંપ્યું. આખરે નળરાજએ પોતાનું રાજ્ય પોતાના પુત્રને સોંપી દીક્ષા લીધી અને તેઓ દેવલોકમાં ગયા.

૧૩૮ નારદ

એ એક મહાસમર્થ પરિવાજક હતા. તેમણે આકાશગામિની વિદ્યા ગ્રામ કરી હતી. તેમના અલ્ફર્ચર્ય સંખ્યાંધી જગતમાં એટલી પ્રતિક્રિયા હતી કે તેઓ રાજ મહારાજાનોના અંતઃપુરમાં એકાકી જરૂર શક્તા. એકવાર તેઓ પાંડવોના અંતઃપુરમાં ગયા, ત્યાં ભાતા કુંતા વગેરેએ તેમને વંદન કર્યું, પરન્તુ સમ્યક્ષદાષ્ટ સતી દ્રૌપદીએ તેમને વંદન કર્યું નહિ, આથી નારદને રોપ થયો. તેમણે દ્રૌપદીનું અલિભાન ઉતારવાનો નિશ્ચય કર્યો, અને ધાતકીખંડમાં પદ્મોધર નામના રાજ પાસે જરૂર દ્રૌપદીના અથાગ ઇપસૈંદર્યની પ્રશંસા કરી, રાજને કામવિહવલ બનાવ્યો. પદ્મોધર રાજએ દેવ મારકૃતે દ્રૌપદીનું હુરણ કર્યું, આખરે પાંડવોએ યુદ્ધ કરી દ્રૌપદીને મેળવી. નારદનો જાતિસ્વભાવ એક ખીજને લડાવી ભારવાનો હતો, અને તેથી તેમને આનંદ થતો. કૃષ્ણ અને તેમની પત્નીએ ઇક્ષમણી તથા સત્યભામા વચ્ચે વારંવાર તેઓ ચકમક ઉત્પન્ત કરાવતા અને પાછા તેઓ પોતેજ સમાવી દેતા. તપશ્ચર્યાં અને અલ્ફર્ચર્યના પ્રતાપે નારદમુનિ ભૂત્યુ પામી દેવલોકમાં ગયા, ત્યાંથી મનુષ્યનો એકન લવ કરી તેઓ મોક્ષમાં જશે.

૧૪૦ નિર્ગતિ (પ્રત્યેકખુદુ)

ગાંધાર દેશમાં પુણ્યવૃદ્ધ નામનું નગર હતું, ત્યાં સિંહરથ નામે રાજ હતો. એકવાર તે નગરમાં ક્રોધ એક સોદાગર કેટલાક

ધોડાઓ લઈ વેચવા આવ્યો, તેમાંનો એક સુંદર ધોડો રાજએ ખરીધો, અને તેની પરીક્ષા કરવા માટે, રાજ તે ધોડાને લઈ શહેર અહાર આવ્યો અને ધોડા પર બેસી તેણે લગામ બેંચી, કે તરતજ તે ધોડો પવન વેગે ઉડ્યો. તેને ઉભો રાખવા રાજએ લગામ બેંચી, પણ તે અવળી લગામનો હોવાથી ઉભો ન રહ્યો, આખરે રાજએ જાણ્યું કે તે અવળી લગામનો હોવો જોઈએ, એમ ધારી અવળી લગામ બેંચતા ધોડો ઉભો રહ્યો. આ વખતે રાજ હજરો ગાડી ફૂર નીકળી ગયો હતો; અને એક વિશાળ પહાડ પર આવ્યો હતો. રાજ ધોડા પરથી નીચે ઉત્થો, તો તેણે બાળુમાં એક મોટો રાજ-મહાલય જોયો: રાજ તે મહેલમાં દાખલ થયો. આખો મહેલ સુનકાર હતો. તે જોઈ રાજ આશ્ર્ય પામ્યો, તેવામાં જ એક નવયુવાન સુંદરીએ રાજ સામે આવી, તેને આવકાર આપ્યો.

રાજએ આશ્ર્ય પામી તે સુંદરીનો પરિયય પૂછ્યો, એટલે સુંદરીએ કહ્યું: રાજન! હું વૈતાદ્ય પર્વત પરના તોરણુપુર નામક નગરના રાજની પુત્રી છું. મારું નામ કનકમાળા છે. મારા ઇપ પર મોહિત થઈ વાસવદત નામનો વિદ્યાધર મને પરણુવાની છંચાથી અહિ લઈ આવ્યો છે. આ વાતની મારા ભાઈને ખખર પડતાં તે મને બચાવવા આવ્યો, પરિણામે એઉ વચ્ચે યુદ્ધ થયું. તેમાં વિદ્યાધર તથા મહારો લાઈ મૃત્યુ પામ્યા. રાજન! હું હવે અહિ એકલીજ છું. હું તમારા ઇપ પર પ્રસન થઈ છું, માટે આપ મારી સાથે લખ કરો. રાજએ કનકમાળાની વિનતિ સ્વીકારી, તેની સાથે ગાંધર્વ લખ કર્યું. લારણાદ બંને રાન્યમાં આવ્યા અને હમેશાં વિમાનમાં બેસી ઇરવા જવા લાગ્યા, તેથી સિંહરથ રાજતું ‘નિર્ગતિ’ એવું નામ પડ્યું.

નિર્ગતિ રાજને બગીચામાં ઇરવાનો બહુ શોખ હતો. તે રૈજ બગીચામાં આવે અને લીલીછમ જેવી વનરસ્પતિ દેખી આનંદ પામે. એકવાર નિર્ગતિ (નિર્ગતિ) રાજની દણ્ણ ઇણ્ણૂલથી ખીલેલા એક

આંખા પર પડી. તે દેખી રાજને અત્યંત આનંદ થયો. એમ કરતાં વસંત અને ગ્રીઝમઙ્ગળ પસાર થઈ. અને તે આંખો સુદૃઢયો. તે દરમ્યાન રાજની દિશિ ફરીવાર તેજ આંખા પર પડી. આ વખતે આંખો વેરાન હતો. તેના પર ફૂલ, ફળ વગેરે ન હતાં. આંખાને નિસ્તેજ દેખી રાજ વિચારમાં પડ્યો; અહો ! થોડા વખત પહેલાં ખીલેકો આ આંખો આજે એકાએક નિસ્તેજ કેમ દેખાય છે ? તેનાં ફળ ફૂલ વગેરે ક્યાં ગયાં ? શું દરેક ચીજમાં અસ્ત થવાનો ગુણુ હશે ? હા. જરૂર, નિર્ગતિ રાજ આત્મવિચારણાને માર્ગ વલ્યો. તેને જરૂર અને ચેતનનું ભાન થયું. શરીર અને આત્માની બિનતા તેણે પ્રલક્ષ નોઈ. પૌર્ણગલિક અને આત્મિક સ્થિતિનું તેણે ભાન આવ્યું. તરતજ તેને જાતિસ્મરણ શાન ઉત્પન્ન થયું. રાજ ધેર આવ્યો. વૈરાગ્ય દશા વધી અને તેજ દશામાં તેણે સ્વયંમેવ પંચ-મુણ્ઠ લોચ કરી દીક્ષા અંગીકાર કરી. અમુક દિવસે ૧ કરકંડુ, ૨ દ્વિમુખ, ૩ નમિરાજ, ૪ નિર્ગતિ એ ચારેય પ્રત્યેકખુદ એકદા થયા અને એક બીજના દોષને જોતાં આત્મભાવના ભાવતાં, કૈવિલ્યશાન પામ્યા અને મોક્ષમાં ગયા.

૧૪૧ નિષધકુમાર.

દારિકા નગરીના રાજ શ્રીકૃષ્ણના મોટાભાઈ ઘણાલદ્રને રેવતી નામની પત્ની હતી. તેને મહા પ્રતાપી એવો નિષધકુમાર નામે પુત્ર થયો. કિશોરાવસ્થામાં ૭૨ કળાએ શીખી તેચ્ચવિષુ બન્યો. યુવાવસ્થા પામતાં પિતાએ તેને ૫૦ કન્યાએ સાથે પાણીંગ્રહણ કરાવ્યું. એકદા પ્રસ્તાવે ભગવાન નેમિનાથ ગ્રામાનુગ્રામ વિહાર કરતાં ત્યાં પધાર્યા. નિષધકુમાર સુંદર વસ્ત્રાભુષણ પહેરી, રથમાં બેસી, મહોટાં સૈન્ય સાથે પ્રલુને વંદન કરવા ગયો. ભગવાને દેશના આપી. નિષધકુમારે વૈરાગ્ય પામી પ્રલુની પાસે શ્રાવકના ખાર પ્રત ધારણ કર્યા.

નિષધકુમારનું તેજરવી સુખવદન જોઈ વરદત્ત નામના ગણુધરે

ભગવાન નેમનાથને પૂછ્યું:—પ્રલુ, નિષધકુમાર આવું સુંદર રૂપ શાથી પામ્યા?

પ્રલુએ જવાય આપ્યો: આ જંબુદ્ધીપના ભરતકોત્રમાં રોહિડ નગરમાં મહાયળ નામે રાજ હતો. તેને પદ્મા નામની રાણી હતી, તેનાથી તેમને વીરંગત નામે પુત્ર થયો. તેને બત્રીસ કન્યાઓ પરણાવામાં આવી. સ્ત્રીઓ સાથે સુખ લોગવતો, તે કુમાર આનંદમાં પોતાના દિવસો પસાર કરતો હતો. તેવામાં ઝોઈ એક પ્રસંગે સિદ્ધાર્થ નામના મહાગુણવંત આચાર્ય તે રોહિડ નગરમાં પધાર્યા. પરિષદ વંદન કરવા ગઈ, તેમની સાથે વીરંગત કુમાર પણ ગયો. મુનિની દેશના સાંભળી વીરંગતે વૈરાગ્ય પામી દીક્ષા લીધી, અને છટ્ઠ, અઠમાદિ ઉચ્ચ તપશ્ચર્થાં કરવા માંડી. અંતિમ સમયે એ માસતું અનશન કરી, શુદ્ધ ચારિત્ર પાળી વીરંગત મુનિ કાળધર્મપામી પાંચમા દેવલોકમાં દેવ થયા. ત્યાંથી ચ્યાવી તપને પ્રભાવે તે અહિ અવતર્યા છે.

પ્રલુ નેમનાથ ત્યારપણી પોતાના શિષ્ય સમુદ્દરય સાથે ત્યાંથી વિહાર કરી ગયા. નિષધકુમાર નિરતિચારપણે આવકના વ્રતોતું પાલન કરે છે. એકવાર પૌષ્ઠકિયામાં તેમણે લાવના ભાવી કે ધન્ય છે તે નગર, ગ્રામ, પ્રજાજનોને કે જ્યાં પ્રભુ બિરાજતા હશે; ભગવાનની અમૃત દેશનાનો લાભ લઈ કર્ણું પવિત્ર કરતા હશે! મહારાં એવાં ક્યાંથી પુણ્ય હોય કે પ્રભુ આ સમીપના નંદનવનમાં પધારે અને હું તહેંમના દર્શન કરી જન્મ સંકળ કરેં. બરાણર એજ વખતે દીનદિયાળ પ્રભુ નંદનવનમાં પધાર્યા. નિષધકુમારને ગ્રાતઃકાળે સમાચાર મળ્યા, એટલે તે પૌષ્ઠ પારી ઘેર આવ્યા; પણ તે હ્રદ્ય સહિત પ્રલુ દર્શને જવા તત્પર થયા. તેઓ ચાર ધંટવાળા એક સુંદર રથમાં બેઢા અને મોટા સમારંભપૂર્વક ભગવાનના દર્શને ગયા. દેશના સાંભળી વૈરાગ્યવાન બન્યા અને ભાતાપિતાની રજ મેળવી દીક્ષિત થયા. તે પણ તેઓ ૧૧ અંગ બણ્યા, ઉચ્ચ તપશ્ચર્થાં કરી, અને નવ વર્ષનું ચારિત્ર પાળી, ૨૧ દિવસનું અનશન કરી, સર્વાર્થ-

સિદ્ધ વિમાનમાં દેવપણે ઉત્પત્ત થયા; ત્યાંથી મહાવિદેહમાં જન્મ લઈ તેઓ મોક્ષમાં જરો.

૧૪૨ નંદ ખળદેવ.

કાશીદેશમાં અભિસિંહ નામનો રાજ હતો. તેને જ્યંતી નામે રાણી હતી. તેનાથી નંદ નામે પુત્ર થયો. તે સાતમો ખળદેવ કહેવાયો. તેમણે લગવાન અરનાથ સ્વામીના શાસનમાં દીક્ષા લીધી. ૫૦ હજર વર્ષનું આયુષ્ય લોગવી તેઓ નિર્વાણ (મોક્ષ) પામ્યા.

૧૪૩ નંદ મણીયાર.

એક સમયે અમણુભગવંત મહાવીર પ્રભુ રાજગૃહી નગરીના ગુણરાલ ઉદ્ઘાનમાં પધાર્યા. તે વાત સુધર્મ દેવલોકના દર્દુર નામના દેવ અવધિજ્ઞાનથી જાણી, તેથી તે દેવ પ્રભુને વંદન કરવા આવ્યો. સભામાં નાટ્યકળા આદિ કરીને પ્રભુને વાંહીને તે દેવ સ્વર્ણાનકે ગયો. તે સમયે ભ્રમ મહાવીરના પદ્ધતિષ્ઠ શ્રી ગૌતમ સ્વામીએ પૂછ્યું. હે લગવાન, આટલી દિવ્ય દેવતાઙ્કિ આ દેવને કેવી રીતે પ્રામ થઈ ? લગવાને કહ્યું :—

આ રાજગૃહ નગરમાં નંદ નામનો મણીયાર રહેતો હતો. તે ધણો ઋદ્ધિવંત હતો. એક સમયે ઇરતો ઇરતો હું આ નગરીના ઉદ્ઘાનમાં આવ્યો. રાજ શ્રેણિક અને પરિપદ વંદન કરવાને આવી. તે વખતે નંદમણીયાર પણ વંદન કરવા આવ્યો. અને ધર્મ સાંભળીને નંદમણીયાર બારવ્રતધારી શ્રાવક થયો. પછી હું ત્યાંથી નીકળીને બહાર દેશમાં વિહાર કરવા લાગ્યો. હવે નંદમણીયારને સાધુ દર્શન, અને સેવા લક્ષ્ણનો યોગ ન મળવાથી તે સમકાળીથી બ્રહ્મ થવા લાગ્યો, અને મિથ્યાત્વી બની ગયો. એક વખત ગ્રીઝમરતુના જેઠ માસમાં નંદમણીયાર અઠમભક્ત તપ કરીને પૌષ્ઠરશાળામાં રહ્યો હતો, તે વખતે

તેને ધણીજ તૃપા લાગી. તેને વિચાર થયો કે ધણું પરોપકારી પુરુષો રાજરાજેશ્વરો રાજગૃહ નગરની બહાર વાવ, તળાવો બંધાવે છે. જેમાં ધણું લોકો સ્નાન કરે છે અને પાણી પીએ છે. તેથી હું પણ શ્રેણિક રાજને પૂછીને એક સુંદર વાવ બંધાવું. એમ ચીતવતાં તેણે બાકીનો દિવસ અને રાત્રી પૂરી કરી. ખીજ દિવસનું પ્રભાત થયું. નંદમણિયાર પૌષ્ઠ પારીને ઘેર ગયો. દંતમંજન આદિ કિયા-ઓથી પરવારી, સુંદર વસ્ત્રાલંકારો ખેણે તથા મુલ્યવાન બેટ લઈને તે શહેરની બહાર વાવ બંધાવવાનો પોતાનો વિચાર શ્રેણિક રાજ પ્રત્યે જહેર કર્યો. રાજએ પરવાનગી આપી. નંદમણિયારે એક સુંદર વાવ બંધાવી. તેને ફરતી ચારે દિશામાં અનુકૂળે ચિત્રશાળા, ભોજનશાળા, ચિકિત્સા કરવાની શાળા, અને અલંકારશાળા બનાવરાવી. આનો લાલ લઈ ધણું લોકો નંદમણિયારના વખાણું કરવા લાગ્યા. આ સંભળી નંદમણિયારના આનંદનો પાર રહ્યો નહિ.

એક વખત નંદમણિયારના શરીરમાં સોળ પ્રકારના રોગ ઉત્પન્ન થયા. આખા ગામભાં દંદેરો પીટાવ્યો કે નંદમણિયારના સોળ રોગ-માંથી એક પણ રોગ કોઈ મટાડશે તો તેને પુષ્કળ ધન આપવામાં આવશે. ધણું વૈદ્યો દાક્તરો આવ્યા, ધણું ઉપચારો કર્યા પણ તેમાંના કોઈ તેનો એકપણ રોગ મટાડી શક્યા નહિ. વેદનાની મહા પીડાથી નંદમણિયાર મૃત્યુ પામ્યો. અને નંદપુષ્કરણી નામની વાવમાં મૂર્છિત બન્યો હોવાથી, તે મરીને તેજ વાવમાં દેડકાપણે ઉત્પન્ન થયો. આ દેડકા ગલ્લ સુક્ત થઈ, બાલ્યાવસ્થા વીતાવી યુવાવસ્થા ગ્રામ થવાથી વાવમાં ફરવા લાગ્યો. તે વાવમાં સ્નાન કરતાં, પાણી પીતાં ધણું લોકો શાંતિ પામી એલતા કે નંદમણિયારને ધન્ય છે કે તેણે આવી સુંદર વાવ બંધાવી. ધણું ભાણુસો પાસેથી આવું સંભળાને દેડકાને વિચાર થયો કે આવા શબ્દો મેં પૂર્વે કયાંક સંભળ્યા છે. એમ

ચિંતન કરતાં શુઅ પરિણુભવના યોગથી તેને જલિસમરણુ જ્ઞાન થયું અને તેનો પૂર્વભવ જાણ્યો. મહાવીર ભગવાને આપેક્ષો એધ, અને લીધેલાં મૃત તેને યાદ આવ્યાં અને પોતે ભિથ્યાત્મી થયો હતો તેને માટે પશ્ચાત્તાપ કરવા લાગ્યો. આ વખતે તેણે અલિગ્રહ કર્યો કે જીવન પર્યાત ૪૬ ૪૬ના પારણા કરવાં, અને પારણાને દિવસે વાવમાં દોડાએ અરાય કરેલું પાણી (નિર્દોષ) અને તેમના શરીરનો મેલ લઈને નિર્વિહ કરવો. (ધન્ય છે, તિર્યેચ જેવું પ્રાણી, સમજણ આવતાં કેવું કહિન કાર્ય કરે છે!) આવી રીતે તે જીવન વીતાવવા લાગ્યો.

એકદા પ્રભુ મહાવીર તેજ નગરીમાં સમોસર્યાં. પ્રભુ પધાર્યાંની વાત દેડકાએ નગરજનો પાસેથી વાવ પાસે સાંભળી. શ્રેણિક રાજ ચતુરંગી સેના સાથે પ્રભુના દર્શન કરવા નીકળ્યા. આ તરફ દેડકાને પણ પ્રભુના દર્શનની પરમ જરૂરાસા થઈ. તે પણ નીકળ્યો. રસ્તે જતાં રાજના કોઈ અશ્વના પગ તળે તે દેડકો કચરાયો. તેથી તે એકાંતમાં જઈ અરિહંત, ધર્માચાર્ય પ્રભુ મહાવીરનું સમરણ કરી નમસ્કાર કરવા લાગ્યો. અને ત્યાંજ સંથારો કરી ઉચ્ચતમ ભાવના ભાવવા લાગ્યો. ત્યાંથી તે સમાધિમરણે કાળ કરી પહેલા સૌધર્મ દેવદ્યોકમાં દર્દુર નામે દેવ થયો. ત્યાંથી ચ્યાવીને મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈ તેજ અવમાં તે મોક્ષ જશે.

૧૪૪ નંદિનીપિતા

આવસ્તિનગરીમાં નંદિનીપિતા નામે મહાઋદ્ધિવંત ગાથાપતિ હતો, તેને અશ્વિની નામે સુર્યીલ અને સુસ્વરંપવાન સ્વી હતી. એકદા પ્રભુ મહાવીર પધાર્યાં. નંદિનીપિતા વંદન કરવા ગયા, અને પ્રભુના ઉપહેશથી ધર્મએધ પામી બારતધારી શ્રાવક થયા. ૧૫ વર્ષ શ્રાવકપણુભાં ધેર રહ્યા પણી તેમને પ્રતિમા અંગીકાર કરી, વિચરવાની ઈચ્છા થઈ. તેથી તેઓ ધરનો સધળો કારખાર જ્યેષ્ઠ પુત્રને સૌંપી સંસારકાર્યભાંથી તદન જ

નિવૃત્ત થઈ ગયા, અને પૌષ્ઠ્રશાળામાં જઈ પ્રતિમા ધારણું કરીને આત્માના અપૂર્વ ભાવમાં વિચરવા લાગ્યા. છેલ્લી પ્રતિમા પૂરી થતાં, તપથી શરીર ક્ષીણ બનવાથી નંદિનીપિતાએ અંતિમ સંથારો શરીર કર્યો. એક માસનો સંથારો ભોગવી, શાનદર્શનચારિની આરાધનામાં તલ્લાલીન બની નંદિનીપિતા મૃત્યુ પામ્યા અને પહેલા દેવકોઙમાં દેવપણે ઉત્પન્ન થયા. ત્યાંથી મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ પામી, ચારિત્ર લઈને તેજ ભવમાં તે મોક્ષગતિને પામશે.

૧૪૫ નંદીવર્ધન.*

સિંહપુર નામનું નગર હતું. સિંહરથ નામે રાજ હતો. ત્યાં દુર્યોધન નામે ક્રોટવાળ હતો. તે ધણેણ જ પાપી, જુલ્મી અને દુરાચારી હતો. તેણે અપરાધીઓને શિક્ષા કરવા માટે ગરમ તાંયુ, ગરમ સીસુ ગરમ પાણી, ધોડાનો પેશાખ, ભેંશ બકરી વગેરેનું મૂત્ર, હાથકડીઓ, સાંકળો, હંટર, રસી, તલવાર, છરી, ખીલા, હથોડા વગેરે વસ્તુઓ રાખી હતી જેનાથી તે ચોર, જુગારી, રાજ્યદોહી, પરબી લંપટ આદિ અપરાધીઓને ત્રાસ ત્રાસ વર્તાવતો હતો. ક્રોધના મહેંભાં તે ઉત્તું ધગધગતું સીસું રેડતો. તો ક્રોધના મહેંભાં ઉકળતું તાંયુ રેડતો. ક્રોધને હાથકડી પહેરાવવી, તો ક્રોધને સાંકળથા બાંધવા, ક્રોધને ઝૂવામાં જંધાં લટકાવવા, ક્રોધના કપાળમાં ખીલા ઢોકવા, ક્રોધના નાક કાન કાપવા, તો ક્રોધને ધોડાનો પેશાખ પાવો, વગેરે પ્રકારના અહા જુલ્મ વર્તાવતાં આ ક્રોટવાળે પાપના પુષ્કળ દળ ભેગાં કર્યાં. પરિણામે એકત્રીસ સો વર્ષનું આયુષ્ય ભોગવી તે ક્રોટવાળ મૃત્યુ પામીને, છડી નરકમાં ગયો.

ત્યાંથી નીકળાને તે ભથુરા નગરીમાં શ્રીદાસ રાજની બાંધુશ્રી નામની રાણીને પેટે પુત્રપણે અવતર્યો. તેનું નામ પાઊયું નંદીવર્ધન. અનેક લાલનપાલનમાં ઉછરી કુમાર યુવાવસ્થા પામ્યો. લારે તે અંતઃપુરમાં

* ખીલ નંદીવર્ધન પ્રભુ મહાવીરના ભાઈ હતા. તેમનું ચદ્રિત્ર લીધું નથી.

મુહිત બન્યો. તે યુવરાજ છતાં જલ્દી રાજ્ય મેળવવા ખાતર પોતાના પિતાનું મૃત્યુ ઈચ્છી, મારી નાખવાની યુક્તિ બોણવા લાગ્યો. તેણે મિત્ર નામના એક હજમને ઓલાવ્યો. જે રાજ્યનો વિશ્વાસુ હજમ હતો અને અંતઃપુરમાં પણ જતો. નંદીવર્ધને પોતાનો વિચાર તેને જણાવ્યો અને હજમત કરતાં કરતાં પોતાના પિતાના ગળામાં અસ્કો ઘોસી દેવા હજમને કહ્યું, સાથે સાથે અધું રાજ્ય આપવાની લાલય બતાવી. હજમે તે કબુલ કર્યું; પરંતુ પાછળથી તેને વિચાર થયો કે જો રાજ આ વાત જણે તો ભારા રાઈ રાઈ જેવડા ટુકડા કરે; તેથી તે ખીન્યો અને રાજ પાસે જઈ તણે નંદીવર્ધનની દુષ્ટાની વાત જહેર કરી. આથી રાજ ધણે ગુસ્સે થયો અને નંદીવર્ધનને પકડી મંગાવ્યો. તેના હાથ પગ બાંધ્યા અને તેને દોખંડના ધગધગતા સિંહાસન પર બેસાડ્યો. તેના પર ધગધગતું સીચું, તાંબુ રેડાંયું અને ખૂબ ઉકેલાં તેલથી તેનો અલિષેક કરાવ્યો. દોખંડના ધગધગતા હાર તેના કંઠમાં પહેરાવ્યા. દોખંડનો ગરમ મુગટ પણ પહેરાવ્યો, નંદીવર્ધન ખૂબ પોકાર કરવા લાગ્યો, પણ કર્મના કાયદાની સામે કોઈ થર્છ શકતું નથી. પરિણામે કાળને અવસરે તે કાળ કરીને પહેલી નરકમાં ગયો. ત્યાંથી અનંત સંસારમાં ભટકી આપરે મુક્તાદશાને પામશે.

સાર:—રાજભાલાં એ જુરી વસ્તુ છે. (૨) ગુન્હેગારને અદ્ય ગુન્હાના બદ્લામાં ભયંકર ચિક્ષા કરવી એ પણ એક મહાન ગુન્હો છે.

૧૪૬ નંદીષેણ મુનિ.

મગધ દેશમાં નંદી નામે ગામ હતું. ત્યાં એક ગરીબ આલણું હતો, તેને સોભિલા નામની સ્ત્રી હતી. તેમને નંદીષેણ નામે પુત્ર થયો. પૂર્વના પાપકર્મના ઉદ્યે નંદીષેણનું શરીર કદરપું હતું. પેટ મોદું, નાક વાંકું, કાન તૂટેલા, આંખ ત્રાંસી, માથાના વાળ પીળા, શરીર દીગાણું, આવી બેડોળ સ્થિતિ બેઈ સૌ કોઈને નંદીષેણ પ્રતિ સૂગ ચડતી. કાળાન્તરે માબાપ ભરી જતાં નંદીષેણ એકદો થર્છ પડ્યો,

એટલે તેના મામાને દ્યા આવવાથી તે તેને પોતાને ધેર લઈ ગયો. તેના મામાને સાત પુત્રીઓ હતી, તેમાંની કોઈ એકને તેણે આ નંદીષેણું સાથે લગ્ન કરવાનું કહ્યું, પરન્તુ કોઈ પુત્રીએ તે કખુલ કર્યું નહિ. આથી પોતાના કર્મને દોષ આપી નંદીષેણું મામાના ધરમાંથી ચાલી નીકળ્યો.

કૃતો કૃતો તે રત્નપુર નગરના એક ઉદ્ઘાનમાં આવ્યો. ત્યાં એક સુખી ગૃહસ્થનું યુગલ એકખીનને આલિંગન આપી કીડાસુખ ભોગવતું હતું, તે જોઈ નંદીષેણુને પોતાના દુઃખી જીવન પર કંટાળો આવ્યો, તેણે આત્મહક્ત્યા કરવાનો વિચાર કર્યો અને નજીકના જંગલમાં આવ્યો, ત્યાં સુસ્થિત નામના એક મુનિના તહેને દર્શન થયા. મુનિએ તેનો પરિયય પૂછી મનુષ્યના કામભોગ અને સંપત્તિ અનિષ્ટકારી હોવાનો અદ્ભુત બોધ આપ્યો, પરિણામે વૈરાગ્ય પામી નંદીષેણું દીક્ષા લીધી. દીક્ષા લઈ તેમણે જીવનભર છઠ છઠના પારણા કરવાનો અભિગ્રહ લીધો; અને ગુરુની સેવા કરતાં ગ્રામાનુગ્રામ વિચરવા લાગ્યા. તેમને એવો નિયમ હતો કે એકાદ મુનિની વૈયાવર્ચય (સેવા) કર્યા પછી જ પોતાને આહાર કરવેા. આમ ધણાં વર્ષ સુધી તેમણે કર્યું, પરિણામે તેમની લક્ષ્ણિના સ્થળે સ્થળે વખાણું થવા લાગ્યા.

એકવાર ધ્યાની સલામાં આ નંદીષેણું મુનિના વખાણું થયા. તે એક ભિથ્યાત્મી દેવને ઇચ્છા નહિ. તેણે મુનિની પરીક્ષા કરવાનો નિશ્ચય કર્યો; અને એક રોગઅરત સાધુનું ઇપ ધરી તે રત્નપુરીના ઉદ્ઘાનમાં બેઠો; વળી તે દેવ બીજા એક સાધુનું ઇપ ધરી, નંદીષેણું પાસે આવ્યો. તે વખતે નંદીષેણું મુનિ પારણું કરવા એસતા હતા. દેવ બોલ્યો: રે, નંદીષેણું, આવો જ તારો સેવાલાવ કે? મારા ગુરુ અતિસારના રોગથી પીડાય છે, ને તું નિરાંતે બોજન કરે છે? નંદીષેણું ચમકીને બોલ્યો: મહારાજ, મારુ કરો. ચાલો ખતાવો, કર્યાં છે તે ગુરુ મહારાજ?

લોજન લોજનને ટેકાણે રહ્યું. નંદીષેણુ સત્વર ઉભા થયા અને પેલા મુનિ (દેવ)ની સાથે ઉધાનમાં ગયા; ત્યાં રહી તેઓ વૃદ્ધ સાધુની સેવા કરવા લાગ્યા. ત્યારપણી નંદીષેણુ કહ્યું. મહારાજ, આપ મારી સાથે ઉપાશ્રયે પધારો, તો હું આપની સેવા ચાકરી સારી રીતે કરી શકું.

“તું જુઓ છે કે નહિ! મહારાથી ચાલી શકાય એવું છે?” વૃદ્ધ સાધુએ ગુર્સે થઈને કહ્યું. “મહારાજ, હું આપને મારી ખાંધ પર એસાડીને લઈ જઈશ.” નંદીષેણુ જરાય આપ્યો.

સેવામૂર્તિ નંદીષેણુ વૃદ્ધ સાધુને પોતાની ખાંધ પર લઈ ચાલવા માંડ્યું. રસ્તામાં પેલા દેવસાધુએ નંદીષેણુના શરીરપર હુર્ગધમંય વિષા કરીને શરીર બગાડી મૂક્યું. છતાં નંદીષેણુ મનમાં જરા પણ એદ પામ્યા નહિ. જેતજેતામાં તે દેવ નંદીષેણુનું આખું શરીર મળ, મૂત્ર અને વિષાથી ભરી દે છે, અને તેના મુખ સામું જુઓ છે, પરન્તુ નંદીષેણુના મુખ પર જ્વાનિની છાયા સરખી પણ દેખાતી નથો. એમ કરતાં ઉપાશ્રય આગળ તેઓ આવે છે; અને ધીરેથી નંદીષેણુ વૃદ્ધ સાધુને નીચે ઉતારે છે, ત્યાં તે સાધુ અદશ્ય થઈ દેવ સ્વરૂપે પ્રગટ થાય છે, અને બધી વાત કહી નંદીષેણુની સેવાની પ્રશંસા કરી સ્વરસ્થાનકે જાય છે.

આ રીતે નંદીષેણુ સેવાલાવમાં ભગ્ન રહી તપશ્ચર્યા સહિત વિશુદ્ધ ચારિત્ર પાળવા લાગ્યા. એકંદર તેઓ બાર હજર વર્ષનું ચારિત્ર પાળી, અંતિમ સમયે અનશન કરી, મૃત્યુ પામી આડમા દેવલોકમાં દેવ થયા; પરન્તુ સંથારા વખતે પૂર્વ સમયની દરિદ્રાવસ્થા તથા સ્ત્રીઓનો ગ્રેમ તેમને યાદ આવવાથી નિયાણું કરેલું કે હું આવતા ભવમાં અનેક સ્ત્રીઓ અને અપૂર્વ લક્ષ્મીનો લોકતા થાડ્યા. આ નિયાણાના ગ્રલાવે તેઓ દેવલોકમાંથી ચ્યવી, સૌરીપુર નગરમાં અંધક વિષણુ રાજની સુલદા રાણીની કુક્ષિમાં દરભા પુત્ર “વસુદેવ” નામે ઉત્પત્ત થયા. તેમનું કામદેવ સરખું ૩૫ દેખીને અનેક સ્ત્રીઓ

તેમના પર મુગધ બની. એકંદર તેઓ બહેંતેર હજર સ્વીએના સ્વામી થયા. સૌથી છેલ્લી તેઓ દેવક રાજની પુત્રી દેવકીને પરણ્યા. નિયાણુના પ્રતાપે તેમને સંસાર વધારવો પડ્યો.

૧૪૭ નંદીષેણુ કુમાર.

તેઓ શ્રેણિક રાજના પુત્ર હતા. લ. મહાવીરની દેશના સાંભળા, તેમને વૈરાગ્ય થવાથી દીક્ષા લેવા તત્પર થયા. તેવામાં એક દેવે અંતરિક્ષમાંથી નંદીષેણુને કહ્યું: હે કુમાર, હમણા તું દીક્ષા ન લે, તારે હજુ બોગાવલી કર્મ બાકી છે, છતાં નંદીષેણુ તે માન્યું નહિ. ભગવાન મહાવીરે પણ તેને ધીરજ ધરવાનું કહેવા છતાં, તેણે દીક્ષા લીધી; અને આકરી તપશ્ચર્થાઓ કરવા માંડી. એકવાર ગૌચરી અર્થે નીકળતાં તેઓ એક વેશ્યાને ધેર જઈ ચડ્યા. મુનિને દેખી વેશ્યાને વિકાર થયો. વેશ્યાએ કહ્યું: મહારાજ, અહિ તો અર્થની લિક્ષા છે ! સમજ્યા ? એમ કહેતાં જ તે હસી પડી. મુનિ લોભાયા. તેમણે પોતાના તપથળે ઉત્પન્ન થયેલી લભિધનો ઉપયોગ કરી તે સ્થળે ધનનો એક મેટ્રો ટગલો કર્યો અને તેઓ રસ્તે પડ્યા. વેશ્યાએ મુનિ પાસે જઈ કહ્યું: મહારાજ, આ તમારું ધન તમે લઈ જાઓ, મારે ન જોઈએ. જો તમે અહિ મારી સાથે રહેવાનું કબુલ કરો, તો જ હું આ ધન લઉં. નંદીષેણુ વેશ્યાનું કથન કબુલ કર્યું. તેમણે પોતાનો સાધુવેશ ઉત્તારી નાખ્યો, અને તેઓ વેશ્યાને ત્યાં રહ્યા. પરન્તુ એવા નિયમ કર્યો કે હમેશાં ૧૦ પુરણોને બુજવી દીક્ષા અપાવ્યા પછી જ પોતાને આહાર કરવો. આ આકરી પ્રતિશા પણ નંદીષેણુ પોતાના તપોધળ અને જ્ઞાનના પ્રભાવે પાળવા લાગ્યા. કોઈ એક દિવસે તેમણે ૬ પુરણોને બુજવ્યા અને દીક્ષિત બનાવ્યા, પરન્તુ એક જણને દીક્ષા આપવાનું બાકી રહ્યું. નંદીષેણુ ધણો પ્રયત્ન કર્યો, પણ દીક્ષા લેનાર દશમો પુરષ કોઈ નીકળ્યો નહિ. આથી નંદીષેણુ પોતે જ દીક્ષા લીધી; અને પ્રભુ પાસે જઈ પોતાના પૂર્વ

પાપની આલોચના કરી. અતે શુદ્ધ ચારિત્ર પાળી નંદીષેણુ કાળજીમાં
પાખી દેવલોકમાં ગયા.

૧૪૮ પ્રતિભુષ્ટ.

તે ક્રોશલ દેશની સાંકેતિક નગરીનો રાજ હતો. પૂર્વભવમાં
મહાયા કુમારનો તે ભિત્ર હતો. ત્યાં સંયમ પાળી, ધણેણુ તપ કરવાથી
તે જ્યાંત વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયો હતો. ત્યાંથી ચ્યાવી અહિંયા
તે રાજ થયો હતો. તેને પદ્મા નામની રાણી હતી. તે સાંકેતિક નાગદેવના
નાગદેવનું એક દેવળ હતું, રાજ અને રાણી એકદા તે નાગદેવના
પૂજન અર્થે ગયાં. ત્યાં દેવળમાં શોભાયમાન એવો એક દામકાંડ
(ખીઓની આકૃતિવાળો ચિત્રેલો વિભાગ) હતો. તે જોઈ રાજએ
પ્રધાનને પૂછ્યું કે તેમે આવો દામકાંડ કયાંય જોયો છે? પ્રધાને
કહ્યું: હા. ભિથિલા નગરીમાં ભલ્લીકુંવરીની વર્ષગાંડ વખતે જોવામાં
આવેલા દામકાંડ આગળ આ કાંઈ હિસાયમાં નથી, એમ કહી સાથે
સાથે સુધૂષ્ણ પ્રધાને ભલ્લીકુંવરીનાં ૩૫, ગુણુની પ્રશંસા કરી. તે
સાંભળી રાજને તે ભલ્લીકુંવરી પરણુવાની ઈચ્છા થઈ. આથી તેણે
કહેવાથી પ્રતિભુષે જિતશનું વગેરે રાજએ સાથે સંધી કરીને
ભિથિલા પર ચડાઈ કરી. તેમાં ભલ્લીકુંવરીએ સોનાની બનાવેલ
પ્રતિમાથી પ્રતિભુષ રાજને બુજીવ્યો અને તેણે દીક્ષા લીધી. સપ્ત
તપ, સંયમ પાળી અંત સમયે સમેતશિખર પર સંથારો કરી પ્રતિ-
ભુષ મોક્ષ પામ્યા.

૧૪૯ પદ્મકુમારો.

અણિક રાજના પુત્ર કાલીકુમારની પદ્માવતી રાણીની કુલ્લિથી
પદ્મકુમારનો જન્મ થયો. માતાએ સિંહનું સ્વખન જોયું. સ્વખન પાઠકે
મહાભાગ્યવાન પુત્ર અવતરણ એવું તે સ્વખનનું ઇણ કહ્યું.

અતુક્મે નવમાસ પૂરા થયે ખાળકનો જન્મ થયો. માતાના નામ પરથી તેનું પદ્મકુમાર એવું નામ આપ્યું. ઉંમર લાયક થતાં તેને આડ કન્યાએ પરણાવવામાં આવી.

એકવાર લ. મહાવીર ચંપાનગરીમાં પધાર્યા. રાજ કેણિકની સાથે પદ્મકુમાર પણ પ્રભુને વંદન કરવા ગયો. પ્રભુની દેશના સાંભળી તેને વૈરાગ્ય થયો. અને ઘેર આવી માતા પિતાદિકની રજ મેળવી દીક્ષા લીધી. સ્થવિર મુનિ પાસે ૧૧ અંગ લઈયા. છઠ, અઠમ આદિ ઉચ્ચ તપશ્ચર્થા કરવા લાગ્યા. અંતિમ સમયે વિપુલગીરી પર એક માસનું અનશન કર્યું અને ૫ વર્ષનું ચારિત્ર પાળ કાળને અવસરે કાળ કરીને તેઓ પહેલા સૌધર્મ નામક દેવલોકમાં એ સાગરના આયુષ્યે હેવ થયા. ત્યાંથી મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈ તેઓ મોક્ષમાં જશે.

૧૫૦ પદ્મમપ્રભુ.

વર્તમાન ચોવિસીના છદ્રા તીર્થકર શ્રી પદ્મપ્રભુ કૌશાંખી નગરીમાં ધર નામના રાજની સુસીમા નામક રાણીની કુલ્લિમાં, નવમા ગ્રૈવેયક વિમાનમાંથી ચ્યવીને મહા વદિ છદ્રને રોજ ઉત્પન્ન થયા. માતાને ચૌદ સ્વપ્ન આવ્યાં. માતાને પદ્મની શાયામાં સૂવાનો દોહદ થયો; તે દેવોએ પૂરો કર્યો. તેમનો જન્મ કાર્તિક વદિ ખારશના રોજ થયો. ૫૬ કુમારિકા દેવીએએ અને ધ્રુવોએ આવી પ્રભુનો જન્મોત્સવ ઉજવ્યો. પિતાને અતિશય આનંદ થયો, અને પદ્મનાથ એવું તેમને નામ આપ્યું. તેમનું દેહમાન ૨૫૦ ધનુષ્યનું હતું. યૌવનવય પ્રામથ્યાં માતાપિતાના આગ્રહથી અનેક રાજકન્યાએ સાથે તેમણે લગ્ન કર્યું. ૭૧ લાખ પૂર્વ તેઓ કુમારાવસ્થામાં રહ્યા. પછી પિતાનું રાજ્ય અરહણ કર્યું. ૨૧૧ લાખ પૂર્વ અને ૧૬ પૂર્વાંગ સુધી તેમણે રાજ્ય લોગ્યું. લોકાંતિક દેવોની સૂચનાથી પ્રભુએ એક વરસ સુધી અદિગુક દાન આપ્યું. પછી છદ્ર લક્તા કરી કાર્તિક વદિ ૧૩ ના રોજ

પ્રભુએ સ્વયં મેવ આરિત્ર અંગીકાર કર્યું. છ માસ છદ્ધસ્થાવસ્થામાં રહ્યા પછી, પ્રભુએ છડ કરીને વડ નીચે કાયોત્સર્ગ કર્યો, ત્યાં પ્રભુને ચૈત્ર શુદ્ધ પૂર્ણિમાએ કેવળજ્ઞાન થયું. શ્રી પદ્મપ્રભુને ૧૦૭ ગણધરો હતા, તેમાં સુવત સૌથી મોટા હતા. તેમના શાસન પરિવારમાં ૩૩૦ હજાર સાધુઓ, ૪૨૦ હજાર સાધીઓ, ૨૭૬ હજાર આવકો, અને ૫૦૫ હજાર આવિકાઓ હતા. કેવલ્યજ્ઞાન આપું થયા પછી, એક લાખ પૂર્વમાં ૧૬ પૂર્વાંગ અને ૪ માસ ઓછા, એટલો સમય ગયો ત્યારે પદ્મપ્રભુએ સમેત શિખર પર અનશન કર્યું. એક માસનું અનશન ભોગવી ભાગશર વદિ ૧૧ ના રોજ ૩૦૮ અનશનવાળા મુનિઓ સાથે પ્રભુ નિર્વાણ પહેંચ્યા. તેમનું એકંદર આયુષ્ય ૩૦ લાખ પૂર્વનું હતું.

૧૫૧ પદ્માવતી.

દ્વારિકા નગરીના શ્રીકૃષ્ણ રાજને પદ્માવતી નામે રાણી હતી. એકવાર નેમનાથ પ્રભુ ત્યાં પદ્માર્થા. શ્રીકૃષ્ણ તથા પદ્માવતી વંદન કરવા ગયા. પ્રભુએ ધર્મબૈધ આપ્યો. પદ્માવતી વૈરાગ્ય પામી ધેર આવ્યા. ત્યાર બાદ શ્રીકૃષ્ણે પ્રભુને પૂછ્યું:—હે ભગવાન् ! આ દેવલોક સમી દ્વારિકા નગરીનો નાશ શાથી થશે ?

પ્રભુએ કહ્યું:—

* દ્વૈપાયન નામના અભિનુક્તમાર દેવના કોપથી તારી નગરીનો

* શૈર્યપુર નગરની બહાર આશ્રમમાં પરાશર નામનો તાપસ હતો. તેણે યમુના દ્વીપમાં જઈ કોઠ નીચ કન્યા સાથે ભોગપિલાસ કર્યો. પરિણામે એક પુત્ર થયો તેનું નામ દ્વૈપાયન. દ્વૈપાયન આગળ જતાં અલખચારી પરિવાજક થયો અને યાદવોના સહવાસમાં મૈત્રીભાવથી રહેવા લાગ્યો. એકવાર શાંખ આદિ કુમારો મહિરાર્માં અંધ બન્યા અને તેઓએ દ્વૈપાયનને મારી નાખ્યો. મરીને તે અભિનુક્તમાર દેવ થયો. અને કોધના નિયાણાથી તેણે દ્વારિકા નગરીને બાળીને લસમીભૂત કરી.

વિનાશ થરો. તે સાંલળી કૃષ્ણ વિચારવા લાગ્યા કે ધન્ય છે જલી, અમાલી, પ્રભુભ્ન, દ્રબ્દનેભિ આદિ કુમારોને, કેજેઓએ રાજવૈભવનો લાગ કરી પ્રભુ પાસે દીક્ષા લીધો ! હું તો અભાગ્યવાનુ, અપુણ્યવંત છું અને કામભોગોમાં મૂર્ખાં પામ્યો છું, જેથી દીક્ષા કેવા સમર્થ નથી. પ્રભુએ તેનો મનોભાવ તરતજ કહી દીધો અને કહ્યું કે વાસુદ્વેવા દીક્ષા કેતા નથી, લીધો નથી અને કેશે પણ નહિ. કૃષ્ણે કહ્યું:- ત્યારે હે પ્રભો ! હું અહિંથી મૃત્યુ પામીને કયાં જઈશા ? પ્રભુએ કહ્યું:-હે કૃષ્ણ, દ્વારિકા નગરી બળતી હશે લારે તું તારા માતાપીતા અને લાઈની સાથે નીકળો જઈશા. રસ્તામાં તારા માતાપિતા મરણ પામશે. ત્યાંથી તું અને બળદેવ પાંડવ મથુરા ભણી જતાં કોસંખીવનના વૃક્ષની નીચે પૃથ્વીશિલા પર જરાકુમારના બાણથી વીધાઈને તું મરણ પામીશ અને મરીને ત્રીજી નરકમાં જઈશા. આ સાંલળી શ્રીકૃષ્ણ ત્રાસ પામ્યા અને ચિંતા કરવા લાગ્યા. પ્રભુએ કહ્યું. ચિંતા ન કર કૃષ્ણ. ત્યાંથી તું નીકળીને જંયુદીપના ભરતક્ષેત્રમાં પાંડુહેશના શતદાર નગરમાં આમમ નામે અરિહંત-તીર્થેકર થઈશા અને મોક્ષમાં જઈશા. આ સાંલળી કૃષ્ણને ધણો હર્ષ આવી ગયો. તેમણે સાથળ પર હાથ પછાડી હર્ષમય શાષ્ટ્રાચ્ચાર વડે સિંહનાદ કર્યો. ત્યાંથી પ્રભુને વંદન કરી શ્રીકૃષ્ણ ધેર આવ્યા.

શ્રીકૃષ્ણ રાજ્યમાં આવી દેઢેરો પીટાવ્યો કે અગિનકુમાર હેવના પ્રકોપથી દ્વારિકા નગરી બળીને અસમ થવાની છે, માટે જેને દીક્ષા કેવી હોય તે તૈયાર થઈ જાય અને તેમના કુંભના નિર્વાહની સઘળી વ્યવસ્થા હું કરીશ.

શ્રી કૃષ્ણની રાણી પદ્માવતીને વૈરાગ્ય થચો હતો તેથી તે દીક્ષા કેવા માટે તૈયાર થઈ અને શ્રીકૃષ્ણની આજા માગી. શ્રીકૃષ્ણ વાસુદેવે ધામધૂમપૂર્વક પદ્માવતીનો દીક્ષા-મહોત્સવ કર્યો અને નેમનાથ પ્રભુ

પાસે દીક્ષિત બનાવી. પદ્માવતી દીક્ષા લઈને સખ્ત તપ, જ્યુ, ક્રિયા કરવા લાગી. અંત સમયે એક મહિનાનો સંચારો કરી, પદ્માવતી નિર્વાણપદ્ધને પ્રાપ્ત થયા.

૧૫૨ પ્રદૂષન.

દારિકાના શ્રીકૃષ્ણ રાજને ઇકિમણી નામની રાણી હતી. તેને પ્રદૂષન નામે પુત્ર થયો હતો. એકવાર અતિમુક્ત મુનિ ઇકિમણીના આવાસે આવ્યા, તેમને જોઈ સત્યભાભા પણ ઇકિમણીના આવાસે આવી. બંનેએ મુનિને વંદન કર્યું. ઇકિમણીએ મુનિને જીનવંત જાણી પૂછ્યું કે મહાત્મન! મહને પુત્ર થશે કે નહિ? મુનિએ કહ્યું: તમને શ્રીકૃષ્ણ જેવો મહા પરાક્રમી પુત્ર થશે. એમ કહી મુનિ વિદ્યાય થયા. મુનિના કથનથી બંને સ્ત્રીએ વર્ચ્યે વાંધો પડ્યો. સત્યભાભાએ કહ્યું કે મને પુત્ર થવાનું મુનિએ કહ્યું છે, જ્યારે ઇકિમણી બોલી કે મેં પ્રશ્ન પૂછ્યો હતો, આટે મુનિએ મને જ પુત્ર થવાનું કહ્યું છે. આ વાત કૃષ્ણ પાસે પહેંચી. બંનેએ એવી શરત કરી કે જેનો પુત્ર પહેલો પરણો, તેના ઉત્ત્સવમાં બીજુએ પોતાના કેશ આપવા. સમય જતાં બંનેએ એક એક પુત્રનો જન્મ આપ્યો. પહેલાં ઇકિમણીએ અને પછી સત્યભાભાએ. ઇકિમણીના પુત્રનું નામ પ્રદૂષન પાડ્યું. થોડાક વખત પછી પ્રદૂષન કુમારનો પૂર્વભવનો એક દૈરી દેવ ઇકિમણીનું ઇપ ધારણ કરી પ્રદૂષનને શ્રીકૃષ્ણ પાસેથી લઈ ગયો. દેવ તેને ભારી નાખવાનો વિચાર કર્યો, પરન્તુ તેનું આયુષ્ય લાંબું હોવાથી, તેમજ તે અરિમ શરીરી (છેલ્લું શરીર) હોવાથી દેવ તેને કાંઈ ધર્મ કરી શક્યો નહિ, પણ તેને એક શિલા પર મુક્તી તે જતો રહ્યો. એવામાં મેધકુટ નગરના કાલસંખર નામક વિદ્યાધરનું વિમાન તે રસ્તેથી પસાર થયું. પુષ્યયોગે તે વિદ્યાધરે તેને પોતાના વિમાનમાં લીધો, અને ઘેર જઈને પોતાની કનકમાળા

નામની સ્વીને સાંખ્યો. તે ત્યાં મોટો થવા લાગ્યો. અહિં થોડીવારે ઇકિમણ્ણીએ કૃષ્ણ પાસે પુત્રને પાછો માગ્યો, ત્યારે કૃષ્ણે કહ્યું કે રહ્યે હમણા જ તેને લઈ ગયા છો ને? ઇકિમણ્ણીએ કહ્યું: નાથ, મને છેતરો છો શાને? આ સાંભળી કૃષ્ણ ચમક્યા. તેમણે વિચાર્યુ કે જરૂર કોઈએ દર્જો કર્યો છે, એમ ધારી પ્રશ્નુભની સધને ઠેકાણે તપાસ કરાવી, પણ કચાંય પતો ન લાગ્યો. આખરે થોડાક વખત પછી નારદજીબિ લાં આવ્યા. તેમને પૂછતાં નારહે કહ્યું:-રાજુનું ગલારાઓ નાલિ. પ્રશ્નુભન જીવતો છે અને ૧૬ વરસે તે તમારે ઘેર આવશે. ઇકિમણ્ણીએ નારદને પૂછ્યું. જીવિદેવ, મને પુત્રનો આપદો લાંખો. વિદોગ થવાનું શું કારણ? નારહે કહ્યું:-દેવી, તમે પૂર્વલવભાં મોરલીના ઈડાં રમાડવા માટે હાથમાં લીધાં હતાં, તે વખતે તમારો હાથ કંકુવાળો હોવાથી તે ઈડાં લાલચોળ (રાતાં) બની ગયાં; જેથી મોરલીએ તે ઓળખ્યાં નાલિ, આખરે વરસાદ થવાથી તે ઈડાં ધોવાયાં, જેથી મોરલીએ ઓળખ્યાં, ને સેવ્યાં. પણ તેટલાભાં ૧૬ ઘડીનો સમય પસાર થયો; તેના ઇણ ઇપે તમને તમારા પુત્રનો ૧૬ વર્ષનો વિદોગ થશે, એવું સીમંધર સ્વામીએ મને કહ્યું હતું, એમ કહી નારદ જીબિ લાંથી વિદાય થયા.

પ્રશ્નુભન અદ્ધિયાં ૧૬ વર્ષનો થયો, તે વખતે તેનું અથાગ ઇપ જેઈ, કનકમાળાની દશ્ટિમાં વિકાર ઉત્પન્ન થયો; અને તેણીએ પ્રશ્નુભન પાસે ગ્રેમસંભોગની માગણો કરી; પોતાની ઈચ્છા તુમ કરવા કનકમાળાએ તેને ગૌરી અને પ્રતસિંહે નામની એ વિદ્વાઓ શીખવી. આ વિદ્વા ભળવા છતાં પણ પ્રશ્નુભને અનાચારનું સેવન કર્યું નાહિ અને તે બહાર જતો રહ્યો. કનકમાળાએ સ્વી ચરિત્ર કરી પ્રશ્નુભન સાથે લડવા પોતાના પુત્રોને ઉસ્કેર્યાં. બંને વચ્ચે યુદ્ધ થયું, તેમાં પ્રશ્નુભને તેના પુત્રોને હરાવી મારી નાખ્યા. તેવામાં સમય પૂરો થયો હોઈ નારદ જીબિ ત્યાં આવી ચડયા. તેમણે પ્રશ્નુભને તેની માતાનો

વિલાપ તથા કેશ આપવાની પ્રતિજ્ઞાની વાત કરી, આથી મહુમાન
નારદ સાથે દ્વારિકામાં ગયો. ભાતાપિતાને ધણો આનંદ થયો. કૃષ્ણ
તેને ધણી રાજ્ય કન્યાઓ પરણાવી. પ્રધુમને અનિરુદ્ધ વગેરે પુત્રો
થયા. છેવટે તેમણે નેમ પ્રભુ પાસે દીક્ષા લીધી અને મોક્ષમાં ગયા.

૧૫૩ પ્રભવ સ્વામી.

ભરતક્ષેત્રમાં વિધ્યાચળ પર્વત પાસે જયપુર નામનું નગર
હતું. ત્યાંના વિધ્ય રાજને એ પુત્રો હતા. મહોટાનું નામ પ્રભવ,
અને નહાનાનું નામ પ્રભુ. પ્રભવ મહોટા હોવા છતાં, કાંઈ ડારણસર
રાજએ તેને રાજ્ય ન આપતાં પ્રભુને રાજ્ય સોંઘ્યું, તેથી પ્રભવ
અલિમાનપૂર્વક નગરની બહાર નીકળી ગયો. અને વિધ્યાચળ
પર્વતની વિષમ ભૂમિમાં એક ગામ વસાવીને રહ્યો. તેણે પોતાના
નેવા પાંચસો સાગ્રીતો ઉલા કર્યો, અને તે સર્વત્ર લૂંટકાટ
ચ્યાવવા લાગ્યો.

એવા સમયમાં જંયુકુમારનું લગ્ન થયું, અને શસુર પક્ષ
તરફથી વિપુલ સંપત્તિ મળતાં આ વખતે જંયુકુમાર પાસે ૮૮ કોડ
સાનામહોરેની મિલકત થઈ હતી. આ વાતની પ્રભવને ખખર પડી એટલે
તે પોતાના ૫૦૦ સાગ્રીત ચોરો સાથે જંયુકુમારને ધેર આવ્યો.
ત્યાં જંયુકુમારના પુષ્ય પ્રભાવે તે રથંલી ગયો; અને જંયુકુમારના
ઉપદેશે વૈરાગ્ય પામી, તેણે દીક્ષા લીધી. દીક્ષા લઈ તેમણે આકરી
તપથ્રયાએ કરવા માંડી અને તેઓ સ્ત્રો સિદ્ધાન્તમાં પારંગત થયા.
જંયુસ્વામીના નિર્વાણ પછી તેમની પાટ પર શ્રી પ્રભવ સ્વામી
અન્ગરન્યા. તેઓ ૧૦૫ વર્ષનું આયુષ્ય લોગવી, મહાવીર પ્રભુ પછી
૭૫ વર્ષે એટલે વિકભ સંવત પૂર્વે ૩૬૫ માં કાળધર્મ. પામી
દ્વારોકમાં ગયા.

૧૫૪ પ્રભાવતી.*

વિશાળા નગરીના એટક રાજને ઉ પુત્રીએ હતી. તેમાં એક પ્રભાવતી પણ હતી. તેને સિંહુ-સોવીર દેશના ઉદાયન રાજ વેરે પરણાવવામાં આવી હતી. તેમને અલિચિ નામે પુત્ર થયો હતો. જી. મહાવીરની દેશના સંખળી પ્રભાવતીને દીક્ષા લેવાની અલિલાષા થઈ અને ઉદાયન રાજ પાસે રજ માગતાં તેણે કર્યું કે તહેમે દેવપદવી પામે. તો મને પ્રતિભોધ આપવા આવજો. રાણીએ આ કલ્યાલ કર્યું અને દીક્ષા લીધી. ખૂબ તપશ્ચર્યાં અને અંતિમ સમયે અનશન કરી પદ્માવતી દેવલોકમાં ગઈ, એટલે આપેલાં વચન પ્રમાણે તેણે ઉદાયન રાજને પ્રતિભોધ પમાડ્યો.

૧૫૫ પ્રભાસ ગણધર†

રાજગૃહિ નગરીમાં ખલ નામના આલાણુને અતિલદ્રા નામની પતની હતી, તેનાથી તેમને એક પુત્ર થયો. તે કર્કરાશી તથા પુષ્પ નક્ષત્રમાં જન્મવાથી તેનું નામ પ્રભાસ પાડ્યું. અનુકૂમે તે વેદાદિ સર્વ શાસ્ત્રોમાં પારંગત થયા. આ પ્રભાસ આલાણુ ૩૦૦ શિષ્યોના

* જૈનાગમમાં પ્રભાવતી, ધારિણી વગેરે નામનાં ચરિત્રો ધરાં આવે છે, પરંતુ તે બહુ જ ઓછી માહિતીવાળાં, અને ખાસ આપવા લેવાં ન હોઈ અતે આપ્યાં નથી.

—સં.

+ જી. મહાવીરને જે ૧૧ ગણધરો થયા તે સર્વ આલાણો હતા. તે અગ્નિયારે સમર્થ અધ્યાપકો અપાયા નગરીમાં સેમિલના યજ્ઞમાં આવેલા, દરેકને જુદી જુદી શાંકાએ હતી, તે સધળી જી. મહાવીરે દ્વાર કરી, તેથી તે અધ્યાપકોએ પોતાના ૪૪૦૦ શિષ્યોં સહિત પ્રભુ પાસે દીક્ષા લીધી હતી, અને તેઓ પોતાના જ્ઞાન, ચારિત્રના બળો પ્રભુ મહાવીરના જણધરો (૫૩ શિષ્યો) થયા હતા.

—સં.

અધ્યાપક હતા. તેમને 'મોક્ષ છે કે નહિ' એ બાયતનો સંશ્યુદ્ધ હતો. તે ભગવાન મહાવીરે નિવાર્યો. એટલે તેમણે ૧૬ વર્ષની નહાની વયે દીક્ષા લીધી. તેઓ પ્રભુ મહાવીરના ૧૧ મા ગણ્યખરપદે આવ્યા. ૮ વર્ષ છદ્રમસ્થાવસ્થામાં રહ્યા. તે પછી ૨૫ મા વર્ષે તેમને કૈવલ્યરૂપાન થયું. ૧૬ વર્ષ કૈવલ્ય પ્રવર્ણામાં વિચર્યા, એકંદર ૪૦ વર્ષનું આયુષ્ય લોગવી તેઓ મોક્ષમાં જયા.

૧૫૬ પ્રદેશી રાજ

શ્વેતાંબિકા નામની નગરી હતી. ત્યાં પરદેશી નામે રાજ રાજ્ય કરતો હતો. તે રાજ ધણ્ણોજ અધમી હતો, લાંચ દૃશ્વત ખેતો, તેમજ રૈયત પાસેથી જુલ્મ કરી ખૂબ કર ઉધરાવતો. તેને પરદોકનો ખેશ માત્ર ડર ન હતો, તે કેવળ નાસ્તિક હતો. પરદોકને અનતો નહીં. શુભાશુલ કર્મના ઇળને પણ માનતો નહિ. જીવ હિંસાએ કરીને, માંસ દાડ ખાઈને, મોજશોખમાં આ પ્રદેશી રાજ પોતાનું જીવન વિતાવતો હતો. તેને સુરિકાન્તા નામની રાણી હતી અને સૂર્યકાન્ત નામનો પુત્ર હતો, અને ચિત્ત સારથી નામે એક ખુદ્ધિશાળી મંત્રી હતો. આ રાજને કુણ્ણાલ દેશના આવર્સિત નગરીના જીતશરૂ રાજ સાથે સારો સંબંધ હતો. એકવાર પરદેશી રાજએ ચિત્ત સારથી સાથે મહા મૂલ્યવાન નજરાણું જીતશરૂ રાજને ભેટ આપવા સારું મોકલાવ્યું. ચિત્તસારથી પ્રધાન કેટલાક માણુસો ખર્ઝને અશ્વરથમાં બેસીને આવર્સિત નગરીમાં ગયો. રાજ પાસે જરૂરને તેણે નજરાણું ભેટ મૂક્યું. જીતશરૂ રાજ ધણ્ણોજ સંતોષ પાએયો. અને ચિત્ત પ્રધાનનો સત્કાર સન્માન કરીને તેને થોડોક વખત રહેવા માટે એક સુંદર મહેલ આપ્યો, જેમાં ચિત્ત સારથી આનંદ-પૂર્વક રહેવા લાગ્યો.

એકવાર પાર્શ્વનાથ ભગવાનના શિષ્ય ચાર રૂપ અને ચૌદ

પૂર્વના જાણુનાર શ્રી કેશીસ્વામી આવસ્તિ નગરીનાં કોષ્ટક ઉદ્ઘાનમાં
પધાર્યા. લોકોના ટોળેટાળાં શ્રી કેશી સ્વામીને વંદન કરવા જવા
લાગ્યા. આ દૃષ્ટિ ચિત્ત સારથીના જેવામાં આવ્યું. માણુસોને પૂછતાં
જણાયું કે શ્રી કેશી સ્વામી નામના વિદ્ધાન મહાત્મા પધાર્યા છે.
ચિત્ત સારથી સ્નાન કરી, વસ્ત્રાલંકારો પહેરી કોષ્ટક ઉદ્ઘાનમાં
ગયા. શ્રી કેશી સ્વામીને વંદન કર્યું. કેશી સ્વામીએ દેશના આપી,
ચિત્ત સારથી પ્રતિભોધ પામ્યો, અને કેશી સ્વામીને વંદન કરી તેણે
કહ્યું:-પ્રભુ, તમારો ઉપદેશ ખરેખર બુડતા જીવોને આધારભૂત છે,
મહને તમારા ધર્મ પ્રત્યે માન અને ઇચ્છિ ઉત્પત્ત થયાં છે. માટે હું
સાધુ થઈ શકતો નથી; પરંતુ આવકના બાર વત અંગીકાર કરવો,
કેશી સ્વામીએ તેને બાર વત ધરાવ્યા. ચિત્ત સારથી તેમનો ઉપાસક
થયો અને પછી તે સ્વરથાનકે ગયો.

કેટલોક વખત વીત્યા બાદ ચિત્ત સારથી શ્વેતાંબિકા નગરીમાં
જવા તૈયાર થયો. અશ્વ રથ પર બેસીને માણુસો સાથે તેણે પ્રયાણ કરવા
માંડ્યું. પ્રથમ તે કેશી સ્વામીને વંદન કરવા આવ્યો, તેમને વંદન
કરીને કહ્યું:-પ્રભુ, હું શ્વેતાંબિકા નગરીમાં જઉં છું, આપ લાં કૃપા
કરી પધારશો. કેશી સ્વામી આ સાંભળી મૌન રહ્યા. ચિત્તે કૃતીથી
આમંત્રણ કર્યું. છતાં તેઓ મૌન રહ્યા. જ્યારે ત્રીજી વખત કહ્યું, ત્યારે
કેશી સ્વામી એલ્યુદ્દીઃ—હે ચિત્ત સારથી, લયંકર વન હોય, જેમાં
વાધ, વર, સિંહ રહેતા હોય અને જીવોનો સંહાર કરતા હોય, લાં
પશુ પક્ષીએ આવે ખરાં? ચિત્તે કહ્યું:-ન આવે, પ્રભુ.

કેશી—તો પછી તમારી નગરીનો રાજ અધર્મી છે, તો હું લાં
કુલી રીતે આવું?

ચિત્ત—પ્રભુ, આપને પ્રદેશી રાજ સાથે શું નિસ્ખત છે? લાં ધણા
સાર્થવાહ, શેઠ, શાહુકારો રહે છે તે બધા આપને વંદન કરવા
આવશે અને આહાર પાણી વહેરાવશે.

ત्यारे કેશી સ્વામીએ કહ્યું કે સમય જોઈને તે તરફ વિહાર કરીશ. ત્યાંથી ચિત્ત સારથી શ્વેતાંબિકા નગરીમાં ગયો. પછી તે નગરીના મૃગ નામના ઉદ્ઘાનમાં આવ્યો અને ચિત્ત સારથીએ તે ઉદ્ઘાનના માળાને કહ્યું કે અહીંથા કેશી નામના સ્વામી પધારે તો હું વંદન કરી તેમનો આદર સત્કાર કરને. પાટ, પાટલા, મકાનનું આમંત્રણ કરને, પછી મણે ખર્ચ આપને. આઠલી સુચના આપીને ચિત્ત સારથી રાજકુદમારથી આવ્યો. આવસ્તિના રાજ તરફથી મળેલું નજરાણું તેણે પ્રદેશી રાજને ચરણે મૂક્યું. રાજ પ્રસન્ન થયો.

કેટલોક સમય વીત્યા બાદ શ્રી કેશી સ્વામી ગ્રામાનુભાગ વિહાર કરતા કરતા શ્વેતાંબિકા નગરીના મૃગ ઉદ્ઘાનમાં પધાર્યા. વન-પાલકે ત્થેમને જોઈ વંદન કર્યું. પાટ, પાટલા વગેરે ચીજેનો બંદોબ્સ્ત કરી આપ્યો, અને ત્યાંથી નીકળી તરતજ તેણે કેશીસ્વામી પધાર્યાંતી ચિત્ત સારથીને ખર્ચ આપી. ચિત્ત સારથીનું હૃદય પોતાના ધર્માચાર્યના આવાગમનના સમાચારથી આનંદથી પ્રકુષ્ઠિત થયું. આસન પરથી ઉલાથ ત્થેણે કેશી સ્વામીને ભાવપૂર્વક વંદન કર્યું: પછી વખાલંકારો પહેંચી અશ્વરથમાં બેસી તે વાંદવા ગયો. ત્યાં કેશી સ્વામીને ભાવપૂર્વક નમરકાર કરીને તેણે કહ્યું:-પ્રભુ, અમારા રાજ અધર્મી છે, તો તેમને આપ ધર્મઐધ આપો તો ધર્મો લાભ થશે. ત્યારે કેશી સ્વામી ઐદ્યા:-હે ચિત્ત, જીવ ચાર પ્રકારે કેવળી પ્રકૃપિત ધર્મ સાંભળી શકતો નથી. (૧) આરામ અથવા ઉદ્ઘાનમાં રહીને સાંધુ મહારાજ પાસે જર્દને વંદણા નમરકાર ન કરે. (૨) ઉપાશ્રયમાં જર્દને વંદન ન કરે, (૩) ગૌચરી અર્થે આવેલ સાંધુ મુનિની સેવા લક્ષ્ણ ન કરે, તેમને ભાવનાથો અજપાણી ન વહેાગવે. (૪) જ્યાં મુનિ મહારાજને દેખે ત્યાં તેમને વંદન ન કરે અને પોતાનું મ્હેં ધૂપાવે. વળી ચાર પ્રકારે જીવ ધર્મને સાંભળી શકે છે.

(૧) આરામ અથવા ઉદ્ઘાનમાં રહેતા થકાં વંદન કરે. (૨)

ઉપાશ્રમાં વંદણા, સેવા અક્ષિત કરે, (૩) ગોચરી વખતે સાધુમુનિની સેવા કરે, ભાત પાણી વહેરાવે. (૪) જ્યાં જ્યાં સાધુ મુનિને હેઠે ત્યાં ત્યાં પ્રેમપૂર્વક વંદન કરે. હે ચિત્ત. તહમારા પ્રદેશી રાજ આરામભાં પડયા રહે છે. સાધુ મુનિનો સતકાર કરતા નથી, તો હું તેમને કઈ રીતે ધર્મ બોધ આપું? ત્યારે ચિત્ત સારથીએ કહ્યું. પ્રભુ, મારે તેમની સાથે ઘોડા જોવાને માટે ઇરવા નીકળવું છે, તો તે રીતે હું તેમને આપની પાસે લાવીશ. આપ ધર્મબોધ આપજો. એટલું કહી ચિત્ત વંદન કરીને સ્વર્થાનકે ગયો.

પ્રભાત થયું. ચિત્ત સારથીએ પ્રદેશી રાજને કહ્યું કે કંખોજ દેશથી જે ચાર ઘોડા આવ્યા છે, તે ઘોડાઓ ચાલવામાં કેવા છે તે જોવા સાર પદ્ધારો. આપણે બંને જઈએ. પ્રદેશી રાજ તે સાંભળી તૈયાર થયો. રાજ અને ચિત્ત એક રથમાં બેસી તે ઘોડાઓ તે રથને જોડી ઇરવા માટે ચાલી નીકળ્યા. ઘોડાઓ પાણીદાર હતા તેથી લગામ મુકૃતાની સાથે પૂરપાટ હોડવા લાગ્યા અને થોડાક વખતમાં તો હજરો ગાડ નીકળી ગયા. રાજને ભૂખ, તરસ અને થાક લાગવાથી રથને પાછો ફેરવવા ચિત્તને કહ્યું. ચિત્તસારથીએ રથને પાછો ફેરવ્યો, અને જ્યાં મૃગવન નામનું ઉદ્ઘાન હતું. અને જેમાં શ્રી કેશી સ્વામી ઉત્તરેલા, ત્યાં રથને લાવ્યા. ઘોડાઓ ત્યાં દૂરા કર્યા અને બંને જણા એક વૃક્ષની નીચે વિસામો લેવા બેઠા. અહિંયા કેશી સ્વામી બુલંદ અવાજથી લોકોને ધર્મપદેશ આપી રહ્યા હતા. અવાજ સાંભળી પરદેશી રાજ મનમાં વિચારવા લાગ્યો કે આ જડ જેવો લાગે છે. તેમજ તેને સાંભળનારા કોકો પણ જડ છે, કે જેએ ભાત જડની જ ઉપાસના કરે છે. વળી આ ભાપણું કરનારા ભાણુસે ભારા બાગની કેટલી બધી જમીન રોકી છે. પણ આ ભાણુસ દેખાવમાં ધણોજ કાંતિવાળો જણ્યાય છે, એમ ધારી તે ભાણુસને એળખવા માટે રાજએ ચિત્ત પ્રધાનને પૂછ્યું. ચિત્તે કહ્યું,

કે મહારાજ ! આ તો એક મહાન પુરુષ છે, વળી તે અવધિતાનો છે અને જીવ શરીરને જુદાં ભાને છે. આ સંબળી રાજને તેની પાસે જવાનો ભાવ થયો. ચિત્ત અને પરહેશી શ્રી કેશી સ્વામી પાસે આવ્યા. પરહેશી રાજને સામે ઉલા રહીને કેશી સ્વામીને પૂછ્યું:-

‘શું તમે અવધિતાની છો ? અને શરીર તથા જીવને જુદા જુદા ભાનો છો ?

કેશી—હે પ્રદેશી રાજ, કોઈ વેપારી દાખણી ચોરી કરે તેની માફક તું વિનય લક્ષ્ણ કર્યા વગર પ્રશ્ન પૂછે છે તે ઉચિત નથી. હે રાજ, મને દેખી તને એવો વિચાર થયો હતો કે આ જડ માણુસ છે અને સાંભળનારા પણ જડ છે. તેમજ આ ભારો બગીચો રોકીને બેઠો છે ?

પ્રદેશી—હા, સત્ય છે. આપની પાસે એવું કયું ગાન છે કે જેથી આપે ભારા મનનો ભાવ જાણ્યો ?

કેશી—અમારા જેવા સાધુને પાંચ શાન હોય છે, પણ મને ચાર શાન છે. તેથી તમારા મનનો ભાવ મેં જાણ્યો. પાંચમું કેવળ શાન શ્રી અરિહંત લગવાનને હોય.

પ્રદેશી—લગવાન, હું અહિં એસું ?

કેશી—આ તમારી ઉદ્ઘાન ભૂમિ છે. તેથી તમે જાણો.

પ્રદેશી—તમારી પાસે એવું પ્રમાણ છે કે જેથી તમે જીવ અને શરીર જુદા ભાનો છો ?

કેશી—હા, ભારી પાસે પ્રમાણ છે.

પ્રદેશી—મારા દાદા હતા. તે મારા પર બહુજ પ્રીતિ રાખતા. તે ધખાજ અધર્મી અને માંસાહારી હતા, તેથી તમારા કહેવા

પ્રમાણે તે નારકીભાં હશે. તો મને આવીને તે એમ કેમ નથી કહેતા કે તું અધર્મ કરીશ નહિ. નહિતો નારકીભાં જરૂરિશ. જો તે આવીને મને કહે, તો હું જવ શરીર જુદા માનું.

ક્રેશી—હે રાજન, તારી સ્તુરિકાન્તા નામની રાણી કોઈ ખીંજ પુરુષ સાથે કામલોગ સેવે તો તું શું કરે ?

પ્રદેશી—હું તે પુરુષના હાથ પગ કાપી તેને શળી પર ચઢાવી દઉં.

ક્રેશી—જો તે પુરુષ તને કહે કે મને થોડોક વખત જીવતો રાખો, હું મારા સગા સંખ્યાંધીઓને કહી આવું કે વ્યલિચાર કોઈ કરશો નહિ. નહિતો મારા કેવી દુર્દી થશે. તો હે રાજન, તું તને થોડોક વખત માટે પણ છૂટો કરે ખરો ?

પ્રદેશી—જરા પણ નહિ.

ક્રેશી—તારા દાદા અહિં આવવાની છચ્છા કરે છે, પણ પરમાધામી દોકો તને ખૂબ માર મારે છે, એક ક્ષણું પણ તને છૂટો કરતા નથી, તો તે અહિં કેવી રીતે આવે ?

પ્રદેશી—અગવાન ! તમે કહો છો કે નરકમાંથી આવી શકે નહિ, તો મારી દાદી ધર્મનિઃ ધર્મિષ્ટ હતી. તે દેવદ્યોકમાંથી આવીને મને ધર્મ કરવાનું કેમ કહેતી નથી ?

ક્રેશી—હે રાજન ! તમે સ્નાન કરી, સ્વર્ચ વસ્ત્ર પહેરી, દેવમંદિરમાં જતા હો, તે વખતે કોઈ ભાણુસ પાયખાનામાં ઉલો રહીને તમને ત્યાં એલાવી એસવાનું કહે તો જવ ખરા ?

પ્રદેશી—નહિ, સાહેબ. તે તો અશ્વચિ સ્થાનક છે તેથી હું ત્યાં જાઉં જ નહિ.

ક્રેશી—તેવી રીતે તારી દાદી મતુષ્યલોકમાં આવવાની છચ્છા કરે

છે, પણ તે દેવતાની રિદ્ધિ સિદ્ધિમાં મૂળી પામવાથી આ દુર્ગિધ વાળા મનુષ્યલોકમાં આવી શકતી નથી; માટે શરીર અને જીવ જુદા છે એમ જરૂર માન.

પ્રદેશી—એકવાર મારો ક્રોટવાળ એક ચોરને પડડી લાવ્યો. મેં તેને દ્વારાની કુંભીમાં ધાલ્યો, અને સજજડ ઢાંકણું વાસી દીધું. કેટલાક વખત પછી મેં જોયું તો ચોર મરી ગયો હતો અને તે કુંભીને કયાંઈ છિદ્ર ન હતું, તો કયે રસ્તેથી જીવ બહાર નીકળી ગયો?

કેશી—એક દાનશાળા હોય, તેને બારી બારણું હોય નહિ, તેમજ કયાંઈ છિદ્ર હોય નહિ. તેમાં પેસીને એક ભાણુસ બેરી વગાડે તો બહાર સંભળાય કે નહિ?

પ્રદેશી—હા, તેનો અવાજ બહાર સંભળાય.

કેશી—તેવી રીતે જીવની ગતિ છે. પૃથ્વીશાલા પર્વતને લેદીને જેમ બહાર નીકળી જાય છે. તેજ પ્રમાણે શરીર અને જીવ જુદાં છે.

પ્રદેશી—એકવાર મારો ક્રોટવાળ ચોરને પડડી લાવ્યો. મેં તેનું વજન કર્યું. પછી મેં ચોરને મારી નાખ્યો, અને વજન કર્યું તો પહેલા અને પછીના વજનમાં કંઈક ઝ ફેર ન પડ્યો, તેથી મને લાગે છે કે શરીર અને જીવ જુદાં નથી.

કેશી—ચામડાની ખાલી ભરશક હોય, તેમાં પવન ભરવામાં આવે તો વજનમાં કંઈક ફેર લાગે છે? જે ન લાગે તો માન કે શરીર અને જીવ જુદાં છે.

પ્રદેશી—એકવાર મેં એક ચોરને મારી તેના એ કકડા કર્યા. પણ જીવ જોવામાં આવ્યો નહિ, પછી ત્રણું કકડા કર્યા, પછી ચાર એમ અનેક કકડા કર્યા, છતાં કયાંય મને જીવ દેખાયો નહિ. તેથી હું માનું છું કે શરીર અને જીવ જુદાં નથી.

કેરી—એક વાર એક પુરુષે રંધવા માટે લાકડાં સળગાવ્યાં. પછી તે કામસર કયાંથી ગયો, ત્યારથાદ આવીને જેયું તો લાકડાં બુઝાઈ ગયેલાં, તેણે લાકડાંને ફેરવીને ચોતરદ જેયું, પણ કયાંઈ અભિ દેખાયો નહિ. માટે હે રાજ, તું મુંદ ન થા, અને સમજ કે શરીર અને જીવ જુદાં છે.

પ્રદેશી—મહારાજ ! ક્ષત્રિય, ગાથાપતિ, આદ્ધાર અને ઝડપિ એ ચાર પ્રકારની પરિષદ્ધમાં તમે મને મુંદ કહીને મહાં અપમાન ન કરો.

કેરી—હે પ્રદેશી, તમે જાણો છો, છતાં મારી સાથે વક્તાથી (આડાઈથી) કેમ વર્તો છો ?

પ્રદેશી—મહારાજ, મેં પ્રથમથી જ વિચાર કરેલો કે હું વક્તાથી વર્તીશ તેમ તેમ મને જીનનો લાલ મળશે.

કેરી—રાજની, વ્યવહાર કેટલા પ્રકારનો છે તે તમે જાણો છો ?

પ્રદેશી—હા, ચાર પ્રકારનો (૧) માગનારને આપે પણ વચ્ચનથી સંતોષે નહિ. (૨) વચ્ચનથી સંતોષ પમાડે, પણ કંઈ આપે નહિ. (૩) આપે અને સંતોષ પમાડે, (૪) આપે નહિ અને સંતોષ પણ પમાડે નહિ. તેમાં આપે અને સંતોષે તે ઉત્તમ અને છેલ્ખો કનિષ્ઠ છે.

પ્રદેશી—પ્રભુ, હાથી અને કંથવાનો જીવ પણ સરખો હશે ?

કેરી—હા, રાજની, જેમ એક મકાનમાં દીવા મૂકી મકાન બંધ કરે તો તેનો પ્રકાશ બહાર નહિ આવતાં તે મકાનમાં જ રહે. વળી તે દીવા ઉપર ટોપલો ઢાંઢી હે તો તે ટોપલા કેટલી જ જગ્યામાં પ્રકાશ આપે, તેવી રીતે જીવ કર્મોદયથી જ શરીરનો બંધ કરે, તેટલામાં જ અવગ્રાહીને રહે.

આ સાંભળી પ્રહેશી રાજ ધર્મ પામ્યો. કેશી સ્વામી પાસેથી તેણે ખારપત ધારણ કર્યાં. તેણે પોતાના રાજ્યનો ચોથો લાગ પરમાર્થ માટે કાઢ્યો, દાનશાળા બંધાવી, પોતાના રાજ્યને રામરાજ્ય બનાવી દીધું અને પ્રત નિયમ સામાયક પૌષ્ઠ વગેરે આવકની કિયાયો. કરતો પરહેશી રાજ આત્મભાવના ભાવવા લાગ્યો. કેશીસ્વામી પરહેશી રાજને સદાય રમણીક રહેવાનો બોધ આપી વિહાર કરી ગયા.

પ્રહેશી રાજ સતત ધર્મ ધ્યાનમાં ભસ્ત રહે છે. રાજ્ય પોતાના પુત્રને સોંઘું છે. તેની રાણી સૂરિકાન્તા રાજના આ કૃલથી ઈંધીં પામી. રાજ આયો દહાડો પૌષ્ઠશાળામાં રહી ધ્યાન ધરે તે તેને ગમ્યું નહિ. તેથી સૂરિકાન્તાએ રાજને મારી નાખવાનો વિચાર કર્યો. એક વાર પ્રહેશી રાજ આનંદમાં હતા, તે વખતે રાણીએ લાત-ભાતની સ્વાદિષ્ટ રસોઈ બનાવી. તેમાં એર ભેળબું અને રાજને તે રસોઈ જમાડી. (અંથાધારે) એરથી રાજને શરીરમાં ખૂબ વેદના ઉત્પન્ન થઈ. રાજ જાણી ગયો કે આ કૃલ મારી રાણીએ કર્યું છે. છતાં એક રોમમાં પણ તેણે રાણીનું દુષ્ટ ચિંતયું નહિ. એરના પ્રસરવાથી ખૂબ વેદના પામી આત્મ ચિંતવન કરતાં, સર્વ વર્ગની ક્ષમાપના લઈ સુમાધિપૂર્વક પરહેશી રાજ મૃત્યુ પામ્યા અને સૌધર્મ દેવલોકમાં સુર્યાલ નામે મહા ઋષિવંત દેવ થયા. ધન્ય છે પ્રહેશી રાજને, કે જે નાસ્તિક છતાં કેશી સ્વામી જેવા મહાપુરુષના સમાગમથી આત્મકલ્યાણ પામ્યા.

૧૫૭ પ્રસરચંદ્ર રાજપી.

તેઓ પોતનપુર નગરીના રાજ હતા. પ્રભુ મહાવીરની દેશના સાંભળા, પોતાના બાળપુત્રને ગાદીએ બેસાડી તેમણે દીક્ષા લીધી; અને લ. મહાવીર પાસે સૂત્રનો સારો અદ્યાસ કર્યો. તેઓ કરતા કરતા પ્રભુ સાથે રાજગૃહ નગરમાં આવ્યા; અને એક સ્થળે ધ્યાનસ્થ

રહ્યા. તેવામાં શ્રેણિક મહારાજ પોતાના સુસુખ અને દુર્ભુખ નામના એ સૈનિકો સાથે પ્રલુના દર્શને જવા નીકળ્યા. ત્યાં રસ્તામાં ધ્યાનસ્થ પ્રસન્નચંદ્ર રાજર્ષિને જોઈ દુર્ભુખ બોલ્યો:—અરે સુસુખ, જે તો ખરો કે આ ધ્યાનમાં બેડેલા મુનિને તેના બાળપુત્રની જરાયે દ્યા નથી, દુઃખનો તેની નગરી પર ચડી આવ્યા છે, અને તેઓ તેના બાળપુત્રનું રાજ્ય લઈ ક્ષેત્ર, તેમજ તેની પત્ની પણ કૃયાંઈ ચાલી ગઈ છે. સૈનિકના આ શબ્દો પ્રસન્નચંદ્રે સાંભળ્યા કે તરત જ તેનું ધ્યાન લંગ થયું. મુનિ આર્તધ્યાન ધરવા લાગ્યા. આ વખતે શ્રેણિકે પ્રલુ મહાવીરને પૂછ્યું:—ભગવાન, આ વખતે પેલા ધ્યાનસ્થ મુનિ કાળધર્મ પામે તો કઈ ગતિમાં જય? પ્રલુ બોલ્યા:—“સાતમી નરકે.” શ્રેણિક આ સાંભળી આશ્ર્યાન્વિત બન્યા, તેણે વિચાર્યુ કે સાધુની સાતમી નરક હોય નહિ, માટે ભારા સાંભળવામાં ભૂલ થઈ હોશે, એમ વિચારી પુન: શ્રેણિકે પૂછ્યું: પ્રલુ, કઈ ગતિ? ભગવાને કહ્યું:—અત્યારે તેઓ કાળધર્મ પામે તો સર્વાર્થસિદ્ધ વિમાનમાં જય. શ્રેણિકને આ લેદની ખખર પડી નહિ. તેણે ભગવાનને તેનું કારણું પૂછ્યું. ભગવાને કહ્યું: હે શ્રેણિક, તારા દુર્ભુખ સૈનિકે જ્યારે કહ્યું કે આ મુનિના સાંસારિક બાળપુત્ર પર દુઃખનો ચડી આવ્યા છે, ત્યારે પ્રસન્નચંદ્ર રાજર્ષિ આર્તધ્યાન ધરવા લાગ્યા, અને મનના પ્રણામો વડે હથિયારો બનાવી દુઃખનો પર ફેંકવા લાગ્યા. આથી તેઓ સાતમી નરકના અધિકારી થયા, પણ જ્યારે પોતાના માનસિક કલ્પનાના હથિયારો ખૂટી ગયા ત્યારે તેઓ પૂર્ણ કોધાયમાન થઈને પોતાના ભાથા પરનો કોખંડી મુગટ શત્રુઓ પર ફેંકી તેમનો નાશ કરવાનું છચ્છયું, તે વખતે જેવોજ તેમણે ભાથા પર પોતાનો હાથ મૂક્યો, કે તરત જ તેમનું મરતક કોચ કરેલું જણ્ણી, તેમને મુનિપણાનું ભાન આવ્યું. તેઓ મુનિપણામાં કલ્પેલી દુર્લીવનાનો ત્યાગ કરી શુક્લ લેસ્યામાં અત્યારે પ્રવૃત્ત થયા છે તેથી તેઓ જે આ વખતે કાળધર્મ પામે તો સર્વાર્થસિદ્ધ વિમાનમાં જય. આમ વાત કરે છે,

ત્યાં તો પ્રસન્નયંદ્ર મુનિને કૈવલ્યજ્ઞાન થયું; તેનો ઉત્સવ ઉજવવા દેવતાઓ જતા હતા, વાનિંગો સાંભળી શ્રેણિકે પૂછ્યું: પ્રભુ, આ શું? પ્રભુએ કહ્યું: પ્રસન્નયંદ્ર મુનિને કૈવલ્યજ્ઞાન થયું તેનો દેવતાઓ ઉત્સવ કરે છે. આ સાંભળી શ્રેણિકરાળ પ્રસન્ન થયા, અને પ્રભુને નમસ્કાર કરી સ્વસ્થાનકે ગયા. જૈનાગમનું રહસ્ય જાવનાના બળ પર અવલંખેલું છે તે આ વાત પરથી સમજશે.

૧૫૮ પાર્શ્વનાથ.

વારાણસી નગરીના અશ્વસેન રાજને વામાદેવી નામની પટરાણી હતી. તે રાણીએ એકવાર ચૈત્ર વદ્દ ચોથની રાત્રિએ સુખશાયામાં સૂતા થકા, ચૌદ સ્વમ જોયાં. સ્વમપાઠકોએ સ્વમો જાણી રાજ રાણીને કહ્યું કે તમારે ત્યાં મહાન તીર્થીકરનો જન્મ થશે. આ સાંભળી રાજ રાણીને અત્યંત હર્ષ થયો. રાણી સુખપૂર્વક ગર્ભનું પાલન કરવા લાગી. સવા નવ આસે પોશ વદ્દ ૧૦ ના રોજ ત્રૈવીસમાં તીર્થીકર શ્રી પાર્શ્વનાથનો જન્મ થયો. ઇદ્રોએ આવી તેમનો જન્મોત્સવ ઉજવ્યો. પિતાએ સંબંધીજનોને આદરપૂર્વક જમાડી, વામાદેવીએ કૃષ્ણપક્ષની એક રાત્રિએ સ્વમામાં પસાર થતાં સપને જોવાથી પુત્રનું નામ પાર્શ્વનાથ પાડ્યું. ભાલ્યકાળ વીતાવી પાર્શ્વનાથ યુવાવસ્થા પામ્યા, ત્યારે તેમને કુશરથળ નગરના પ્રસન્નજિત રાજએ પોતાની પ્રભાવતી નામે પુત્રી પરણાવી. પાર્શ્વકુમાર પ્રભાવતી સાથે મનુષ્ય સંબંધીના સુખભોગ લોગવવા લાગ્યા. એકવાર પાર્શ્વકુમારે ગોખમાં ઘેડા ઘેડા કેટલાક લોડાને ફૂલ વગેરેની છાબડીઓ લઈને હર્ષભેર શહેર બહાર જતા જોયાં. સેવક પુરુષને પૂછતાં તેમણે જાણ્યું કુ કમઠ નામનો એક તાપસ આવ્યો છે, તેની પૂજા કરવા માટે દોકો જય છે. આથી પાર્શ્વકુમાર ત્યાં ગયા. કમઠ ત્યાં પંચામિ વડે તપશ્ચર્યા કરે છે; તે સ્થળે જેને મતિ, શુત અને અવધિજ્ઞાન થયેલું છે એવા શ્રી પાર્શ્વકુમારે અભિમાં નાખેલાં પેલા લાકડામાં સપને જોયો. આથી તેમણે પેલા તાપસને કહ્યું:—મહાત્મન, તમે તપશ્ચર્યા

કરો છો, પણ તેમાં જીવની હિંસા થાય છે, એનો આપને ખ્યાલ છે ? એમ કહી પાર્શ્વકુમારે પોતાના સેવક પાસે સર્પવાળું પોછું લાકું ખોકેના દેખતાં અહાર કઢાયું અને ધીરેથી તે ચીરાયું : તો અર્ધ દાંજેલો એવો એક સર્પ તેમાંથી નીકળ્યો. પાર્શ્વકુમારે , તેને નવકારમંત્ર સંભળાવ્યો, જેને પ્રભાવે તે સર્પ સહભાવનાએ મૃત્યુ પામીને ધરણેન્દ્ર નામે દેવ થયો. ખોકેએ ત્યાં તાપસની નિંદા કરી. હડ્ધુત થયેલા તાપસે અન્ય રથને જઈને ધોર તપશ્ચર્યા કરવા માંડી. થથા સમયે તે મૃત્યુ પામીને અજ્ઞાન કષ્ટસહનને કારણે ભુવનપતિ દેવલોકમાં મેધમાળી નામનો દેવ થયો.

પાર્શ્વકુમાર ધેર આવ્યા. પોતાને ભોગાવલી કર્મ પુરં થયું જાણી તેમણે દીક્ષા લેવાનો વિચાર કર્યો. તે વખતે અવસર જાણી લોકાંતિક દેવોએ આવી તેમને પ્રાર્થના કરી કે હે સ્વામી, તીર્થ પ્રવર્તાવે. જૈન માર્ગનો ઉદ્ધાર કરો. આથી પાર્શ્વનાથે વાર્ષિક દાન આપવું શરૂ કર્યું. ત્યારથાદ તેઓ દીક્ષિત બની ચાલી નીકળ્યા. તેમની સાથે ખીજા ૩૦૦ રાજાઓએ પણ દીક્ષા લીધી. પાર્શ્વપ્રભુએ ૩૦ વર્ષ પૂરા થતાં સંયમ ગ્રહણ કર્યો. તેજ વખતે તેમને મનઃ પર્યવર્જાન પ્રાપ્ત થયું.

ગ્રામાનુશ્રામ વિહાર કરતાં પાર્શ્વપ્રભુ એકવાર એક તાપસના આશ્રમ પાસે આવ્યા અને ત્યાં કાયોત્સર્ગ ધ્યાને ઉલા. આ વખતે પેલા મેધમાળી દેવે પ્રભુને ધ્યાનમાં ઉલેલા જેયા. તરત જ તેને પોતાનું પૂર્વ લવનું વૈરયાદ આવ્યું, એટલે તેણે ભગવાનને ઉપસર્ગ આપવા માટે હાથીઓ તથા સિંહો વગેરેના અનેક ઝોપો ધરી ઉપદ્રવ કરવા લાગ્યો. પણ ભગવાન પોતાના ધ્યાનથી લેશ પણ ચલિત ન થયા. એટલે તેણે આકાશમાં વિજળીઓ તથા ગર્જનાઓ સાથે મુશળધાર મેધની વૃષ્ટિ કરી. જોતનોતામાં મેધના અસ્થલિત પ્રવાહે પ્રભુના કાન સુધી પાણી આવી ગયું; છતાં પ્રભુ ડગ્યા નહિ. જ્યારે તે પાણી નાકના અગ્રભાગ ઉપર પહોંચ્યું, ત્યારે ધરણેન્દ્ર દેવનું આસન ચલ્યું. તેણે અવધિરાનથી જોતાં જાણ્યું કે કમઠ તાપસનો જીવ મેધમાળી

પ્રભુને ઉપદ્રવ કરે છે, આથી શીધ તે ત્યાં આવ્યો. પ્રભુને વંદન કરીને તે ધરણેન્દ્ર દેવે પ્રભુના ચરણ નીચે કેવળીના આસન જેવું એક સુવણ્ણુ કમળ બનાવ્યું. અને પોતાના સર્પવત શરીરથી પ્રભુની પીઠ તથા પડખાને ઢાકી દઈ સાત ઇંચ વડે પ્રભુના માથે છત ધર્યું. પાસે ધરણેન્દ્રની સ્ત્રીઓ ગીત નૃત્ય કરવા લાગી. ત્યારથાદ તે દેવે મેઘમાળીને ઠપકો આપ્યો. મેઘમાળીએ પોતાની ભૂલ કબુલીને ઉપસગને હરી લીધો. અપકારી ઉપર ઉપકાર કરીને અનેક જીવોને તેઓના પૂર્વ લવો કહી સંભળાવીને પ્રભુએ તાર્યા; અને પોતે કર્મદળનો ક્ષય કરી કેવલયજ્ઞાન પામ્યા.

દીક્ષા લીધા પછી ૮૪ દિવસે પ્રભુને ચૈત્ર વદ્દ ૧૪ ના રોજ કુલજ્ઞાન થયું. તેમને આર્યદત વગેરે ૧૦ ગણુધરો થયા. પાર્શ્વપ્રભુના શાસન પરિવારમાં ૧૬૦૦૦ સાધુઓ, ૩૮૦૦૦ સાધ્વીઓ, ૧ લાખ ૬૪ હજાર આવકો અને ૩ લાખ ૭૭ હજાર આવિકાઓ હતાં. ૭૦ વર્ષનું ચારિત્ર પાળી, એકદર ૧૦૦ વર્ષનું આયુષ્ય લોગવી પ્રભુ આવણ શુદ્ધ આઠમે મોક્ષ પદ્ધાર્યા.

પાર્શ્વપ્રભુના માતા, પિતા અને સ્ત્રી પ્રભાવતીએ પણ દીક્ષા લીધી હતી, અને તેઓ પણ મોક્ષમાં ગયા.

૧૫૯ પ્રિયદર્શના.

તે પ્રભુ મહાવીરની પુત્રી હતી. તેને જમાલી વેરે પરણાવવામાં આવી હતી. પ્રિયદર્શનાએ પ્રભુના ઉપદેશથી પોતાના સ્વામી સાથે એક હજાર સ્ત્રીઓ સહિત દીક્ષા લીધી હતી, અને તેઓ ચંદ્રભાગા સાથે વિચરતા હતા. એકદા જમાલીની અદ્ધા ઇરી. તે માનવા લાગ્યો. કે “કાર્ય કરવા માંડયું ત્યાંથી કર્યું કહેવાય નાહિ” પ્રિયદર્શના પણ તેમના પૂર્વ પતિના આ મતમાં ભળી ગયા. ઇરતા ઇરતા તેઓ શ્રાવસ્તિ નગરીમાં દંક નામના કુંભારની શાળામાં ઉત્ત્યો. દંક વીર-પ્રભુનો ભક્તા હતો. તેણે પ્રિયદર્શનાને ડેકાણે લાવવા તે ન જણે તેમ તેમના પર એક અમિનો તણુંદો નાખ્યો, આથી પ્રિયદર્શના

સાધ્વીનું વલ્લ બળવા લાગ્યું. એટલે તેમણે દંકને કહ્યું કે તમારા પ્રમાદથી મારું વલ્લ બળ્યું. દંકે કહ્યું: મહાસતીજી, તમે મૃત્યા ઓદો છો. તમારા મત પ્રમાણે તો આપું વલ્લ બળ્યા પછીજ વલ્લ બળ્યું કહેવાયું. ‘બળવા માંડ્યું ત્યાંથી બળ્યું’ એવો તો પ્રભુ મહાવીરનો મત છે. આથી પ્રિયર્થનાચે પોતાની ભૂલ જોઈ અને પ્રભુ પાસે પ્રાયશ્રિત લીધું.

૧૬૦ પુંડરિક, કુંડરિક.

પૂર્વ મહાવિહેઠ ક્ષેત્રમાં પુંડરીકિની નામની રાજધાની હતી. લાં મહાપદ્મ નામે રાજ રાજ્ય કરતો હતો. તેને પદ્માવતી નામે રાણી હતી, તેનાથી તેને એ પુત્રો થયા. ૧ પુંડરીક, ૨ કુંડરીક. તે સમયે ધર્મધૈર્ય નામના સ્થવીર તે નગરીના નક્ષતીવન ઉદ્ઘાનમાં પદ્ધાર્યા. પદ્મરાજ વંદન કરવા આવ્યા. મુનિઓ ધર્મ બોધ આપ્યો. રાજ વૈરાગ્ય પામ્યો અને પુંડરીકને રાજ અને કુંડરીકને યુવરાજ પદે સ્થાપી તે દીક્ષિત થયો. પુનઃ ધર્મધૈર્ય સ્થવીર કુરતા કુરતા તે નગરીમાં પદ્ધાર્યા. પુંડરીક અને કુંડરીક વાંદવા ગયા. ધર્મબોધ સાંભળી પુંડરીક શાવક થયો અને કુંડરીક દીક્ષા લીધી. નિઃરસ આહાર કરવાથી કુંડરીકને એકવાર શરીરમાં દાહનજવર થયો. નેથી મહા વેદના થઈ. અનુક્રમે શરીર ક્ષીણ થયું. કેટલેક કાળે કુરીથી સ્થવીર ભગવાન કુંડરીક સાથે તે નગરીમાં પદ્ધાર્યા. પુંડરીક વંદન કરવા આવ્યો. પોતાના ભાઈની વ્યાધિમય સ્થિતિ જોવાથી પોતાની દાનશાળામાં ચોગ્ય ઔપધથી ઉપયારો કરવાનું તેણે સ્થવીરને જણાઈયું. સ્થવીર ભગવાને રજ આપી. કુંડરીક પોતાના સંસારી ભાઈની દાનશાળામાં ગયા. અનેક પ્રકારની વિશુદ્ધ દવાઓથી શરીર સારું થઈ ગયું. પછી કુંડરીક ભાતભાતના સ્વાદિષ્ટ ભોજન જરૂરવા લાગ્યા. પરિણામે સંયમમાં સ્થિર ન રહેતાં તેઓ શિથિલાચારી અની ગયા, તેમજ દીક્ષા છોડીને સંસારમાં પ્રવેશવાના સંકલ્પો કરવા લાગ્યા. એકદા તેઓ પુંડરીકિની નગરીના રાજમહેલ પાછળના

અશોક ઉધાનમાં આવી આર્તિધ્યાન ધરતા એહા છે, તેની પુંડરિકને ખખર પડી, તેથી તેઓ અંતઃપુર સહિત કુંડરિક પાસે આવ્યા અને બોલ્યા. અહો ભહેદલાગી મુનિ, આપને ધન્ય છે કે આપ દીક્ષા લઈને આત્મકલ્યાણ કરો છો, હું તો અભાગ્યવાન છું, પાપી છું કે મારાથી દીક્ષા લઈ શકતી નથી. ઉપરના કથનને કુંડરિકે આદર ન આપ્યો અને વિચારમનું દર્શામાં રહ્યા. પુંડરિકે મનોભાવ જણવા પુનઃ પ્રશ્ન કર્યો:—સારે શું આપ ભોગોની છિંછા રાખો છો? કુંડરિકે જવાબ આપ્યો:—હા, મારે ભોગોની છિંછા છે.

પુંડરિકે તરત કૌંદુંબિક પુરુષોને બોલાવી કુંડરિકનો રાજ્યાલિષેક કરાવ્યો. અને તેમને રાજ્યાસને બેસાડ્યા; તે પછી પુંડરિકે પોતાનો પંચમુષ્ઠિ લોય કર્યો અને સ્વયંમેવ દીક્ષા લીધી. અને જ્યાં સુધી ધર્મધોષ સ્થવીર ભગવાનના દર્શન ન થાય લાં સુધી આહાર નહિ દેવાનો નિયમ કરી તેઓ ત્યાંથી ચાલી નીકળ્યા.

આ તરફ કુંડરિક રાજને, કામોત્પાદક વર્સુઓનો આહાર કરવાથી એકદમ તે વર્સુ પચી નહિ. પરિણામે ઉત્ત્ર વેદના ઉત્પન્ન થઈ. ખૂઅ પીડા પામને ભયંકર વ્યાધિમાં તે મૃત્યુને શરણ થયો, અને મરીને તે સાતમી નરકમાં ગયો.

પુંડરિક સ્થવીર ભગવાનને મળ્યા, વંદન કર્યું, અને તેમની સાથે તપસંયમમાં વિચરવા લાગ્યા. અરસ નિઃરસ આહાર પુંડરિકને પણ પર્યો નહિ. તેથી તેના શરીરમાં અતુલ વેદના ઉત્પન્ન થઈ અને શરીર નિર્ઝણ થવા લાગ્યું. તેથી તેમણે પંચ પરમેષ્ઠિનું સમરણ કરી, ધર્માચારને વંદન કરી સંખેખના કરી. પરિણામે કાળને અવસરે કાળ કરીને તે સર્વાર્થસિદ્ધ વિમાનમાં દૈવપણે ઉત્પન્ન થયા. ત્યાંથી ચ્યાવી મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈ તેઓ મોક્ષમાં જશે.

ન્યાય—કુંડરીકની ભાડક કોષ સાધુ સાધવીલ દીક્ષા લઈને કામ જોગમાં મૂર્છિત બનશે તો આલોક પરલોકમાં દુઃખી થશે અને કામજોગમાં પુંડરીકની ભાડક મૂર્છિત નહિ બને તો ચારે તીર્થમાં સત્કાર સન્માન પામી સંસાર સાગર તરી પાર પામશે.

૧૬૧ પુરુષોત્તમ.

દારિકા નગરીમાં સોમ નામે રાજ હતા, તેમને સીતાદેવી નામે રાણી હતી. તેમનાથી પુરુષોત્તમ નામના ચોથા વાસુદેવનો જન્મ થયો. તેઓ મધુ નામના પ્રતિવાસુદેવને મારી ગાદીએ બેઠા અને વાસુદેવ કહેવાયા. અનંતનાથ પ્રલુના સમયમાં ૩૦ લાખ વર્ષનું આયુષ્ય લોગવી તેઓ મૃત્યુ પામ્યા અને છી નરકે ગયા.

૧૬૨ પુરુષ પુંડરિક.

ચક્પુરી નામની નગરીમાં મહાશિર રાજની લક્ષ્મીવતી રાણીના એ પુત્ર હતા. યુવાન વય થતાં તેમણે બલિ નામના પ્રતિવાસુદેવને માર્યો અને ૬ હિં વાસુદેવ તરીકે નામાંકિત થયા. ૬૫ હજાર વર્ષનું આયુષ્ય લોગવી અરનાથ અને બલિનાથ પ્રલુના આંતરામાં મૃત્યુ પામીને તેઓ છી નરકે ગયા.

૧૬૩ પુરુષસિંહ.

એ અશ્વપુર નગરના શિવરાજ નામના રાજની અમૃતદેવી નામક રાણીના પુત્ર હતા. નિષ્કુંલ નામના પ્રતિવાસુદેવને મારી પાંચમા વાસુદેવ તરીકે તે પ્રસિદ્ધ થયા. ધર્મનાથ પ્રલુના સમયમાં ૧૦ લાખ વર્ષનું આયુષ્ય લોગવી, મૃત્યુ પામી તેઓ ૬ હિં નરકમાં ગયા.

૧૬૪ અળાલદ્ર.

શ્રી નેમનાથ ગ્રલુના સમયમાં દ્વારિકા નગરીના રાજ શ્રી કૃષ્ણ વાસુદેવના મોટા ભાઈ અળાલદ્ર નામે નવમા અળદેવ હતા. તેમના પિતાનું નામ વસુદેવ, અને માતાનું નામ રોહિણી. કૃષ્ણ અને અળાલદ્રને અત્યંત સ્નેહ હતો. (વાસુદેવ અને અળદેવ જેવી પ્રોતિ ખીજ કોઈને હોય નહિ) જ્યારે દ્વારિકા નગરી અળી, અને કૃષ્ણ તથા અળદેવ તે અન્નિ શભાવવા અસમર્થ અન્યા ત્યારે તેઓ પોતાના માતાપિતાને રથમાં બેસાડી, અશ્વને અદ્ભુતે પોતે રથને બેંચી, ત્વરાએ બહાર નીકળતા હતા, તે વખતે નગરીનો દરવાજે તૂટી પડવાથી તેમના માતાપિતા ચંગદાઈને ભરણ પામ્યા અને બંને ભાઈઓ જલ્દીથી નાસી છૂટી વનમાં આવ્યા. ત્યાં શ્રી કૃષ્ણનું મૃત્યુ થયું. અળદેવ પોતાના ભાઈના શબ્દ (મૃતક) પર આંસુ સારતા સ્થિરવત્ત બેસી રહ્યા. તે વખતે તેમને બોધ આપવા દેવતાએ ત્યાં એક ધાર્ણી ઉભી કરી તેમાં રેતી પીલવા લાગ્યા. આથી અળબદ્રે તેમને કહ્યું કે વૃથા ભહેનત કેમ કરો છો ? શું આ રીતે રેતી પીલવાથી તેલ નીકળે તેમ છે ? ત્યારે તે દેવોએ કહ્યું કે આમ ભાઈના શબ્દ પર દિવસોના દિવસો સુધી આંસુ પાડી બેસી રહેવાથી શું તે જીવતો થાય તેમ છે ? આથી અળદેવ સમજ્યા અને તેમણે શ્રી કૃષ્ણની અંતઃક્રિયા કરી. ત્યારબાદ અળબદ્ર દીક્ષા લઈ ચાલી નીકળ્યા; સખ્ત તપ કરીને, તેઓ કાળધર્મ પામી પાંચમા અલ દેવલોકમાં દેવ થયા. ત્યાંથી નીકળી તેઓ આવતી ચોવીસીમાં તીર્થીકર થશે.

૧૬૫ આલી અને સુંદરી.

ભગવાન ઋષિબદેવને સુમંગળા અને સુનંદા નામની બે સદ્ગુણસંપત્ત રાણીએ હતી. તેમાંની પહેલી સુમંગળા દેવીએ જે જોડકનો જન્મ આપ્યો તેના નામ ૧ ભરત અને ૨ આલી અને

સુંદરીએ ને જોડકણો જન્મ આપ્યો તેના નામ હતું બાહુથળી ર
સુંદરી. જ્યારે તેઓ કળા શીખવાની ઉંમરે પહેંચ્યા ત્યારે શ્રી
અષભદેવજીએ આહ્વાને ૧૮ જાતની લેખનકળા અને સુંદરીને ગણિત
વિદ્યા શીખવી.

જ્યારે આદિનાથ પ્રભુએ પહેલ વહેલી ધર્મદેશના આપી, તે
વખતે બાર પરિષહ પૈકીની મનુષ્યની પરિષહમાં એઠેલા ભરતરાજના
૫૦૦ પુત્રો તથા ૭૦૦ પૌત્રોએ વૈરાગ્ય પામી પ્રભુના
હાથથી દીક્ષા લીધી. તે વખતે આહ્વીએ પણ ભરતરાજની આજાથી
દીક્ષા અંગીકાર કરી હતી. સુંદરીનું રૂપ અથાગ હતું. તેણીને પણ
દીક્ષા લેવાની ધૂઢ્છા થઈ, તેને બાહુથળીએ અનુમોદન આપ્યું,
પરન્તુ ભરતને લાગ્યું કે જો સુંદરી પણ દીક્ષા લેશે, તો સ્વીરત્ન
ઘનાવે એવી સર્વોત્તમ-સહગુણ સંપત્ત કોઈ સ્વી નથી, એમ ધારી
તેમણે રજ ન આપી. આથી સુંદરી ચિંતા કરવા લાગી. તેણે
વિચાર્યું કે ખરેખર, મારું સુંદર સ્વરૂપ જ ભારા વિચારોને આડે
આવે છે, મારે એ રૂપને નાણ કરવું, જેથી ભરતજ પોતે મને સ્વી-
રત્ન થવાની ના પાડશે. આવો વિચાર કરી સુંદરીએ તપ કરવાનો
નિશ્ચય કર્યો.

એ અરસામાં ભરતરાજ છખંડ સાધવા માટે નોકલ્યા; અને
તે છ ખંડ સાધતા તેમને સાડ હજર વર્ષ વીતી ગયા. આ
તકનો લાલ લઈ સુંદરીએ હૃદ, દધી, ધી, તેલ, ગોળ અને કડા
વિગ્ય એ છ વસ્તુઓનો ત્યાગ કર્યો, અર્થાત તેણીએ સાડ હજર
વર્ષ સુધી આયંભિલ તપ કર્યો. આથી સુંદરીનું સુકોમળ અને
સ્વરૂપવાન શરીર કરમાઈ ગયું. તેણી લોહી માંસ વગરના હાડપિંજર
જેવી દેખાવા લાગી. ભરત મહારાજ ચક્રવર્તી બની રાજ્યમાં આવ્યા,
તે વખતે સુંદરીનો શિથિલ અનેલો દેહ જોઈ, તેણીની વૈરાગ્ય દ્શાની
તેમને ખર્યર પડી. આથી ભરતરાજએ આનંદપૂર્વક સુંદરીને દીક્ષા

સેવાની પરવાનગી આપી. એવામાં લ. ઋષભદેવ ત્યાં પધાર્યા. ભારતરાજાએ સુંદરીની દીક્ષામાં અંતરાય આપ્યા બદલ ગ્રલુ પાસે પશ્ચાત્તાપ કર્યો. સુંદરીએ સાં દીક્ષા લીધી. સખ્ત તપશ્ચયી કરતાં અને ચારિત્રનું વિશુદ્ધ પાલન કરતાં આહી અને સુંદરીને કૈવલ્ય-શાન થયું. કેટલોક કાળ કૈવલ્યપ્રવન્નયીમાં વિચરી, અનેક જીવોનો ઉદ્ધાર કરી તેમણે અષ્ટાપદ પર્વત પર અનશન કર્યું અને તેઓ મોક્ષમાં ગયા.

૧૬૬ બૃહસ્પતિદત્ત.

સર્વભદ્ર નામનું નગર હતું, જીતશનું નામે રાજ હતો, તેને એક મહેશ્વરદત્ત નામનો પુરોહિત હતો. જે ચાર વેદને જાણુનારો હતો. આ પુરોહિત, રાજને રાજ્યની વૃદ્ધિ અર્થે હોમ કરાવતો હતો. આ હોમ શેનો હતો? આહણુ, ક્ષત્રિય, વૈશ્ય અને ક્ષુદ્રના જીવતા બાળકોનો તે હોમ કરાવતો હતો. જીવતા તેઓનું માંસ કાઢી તેના પિંડ બનાવી તે હોમમાં રાજ પાસે હોમાવતો હતો. આઠમ ચૌદશને હિન દરેક વર્ગમાંથી બ્રહ્મએ બાળક લઈ આઠ બાળકો, ચોથે મહિને સોણ બાળકો, છુટે મહિને ત૨, અને વર્ષ પુરુષ થતાં ૬૪. તથા શત્રુભય હોય ત્યારે ૪૩૨ બાળકોના પ્રાણું લઈ ઉપરદ્વશાતિનો હોમ કરાવતો હતો. આવી રીતે પુષ્કળ પાપ ઉપાર્જન કરીને મહેશ્વરદત્ત ત્રણું હન્દર વર્ષનું આયુષ્ય લોગવી ભરી ગયો અને પાંચમી નરકમાં ગયો. ત્યાં સતતર સાગરની સ્થીતિ લોગવી કૌશાંખી નગરીમાં સોમદત્ત પુરોહિતની સ્ત્રી વસુદત્તાની કુખ્યમાં ઉત્પન્ન થયો. જન્મ થતાં તેનું નામ બૃહસ્પતિદત્ત રાખવામાં આવ્યું. યુવાવસ્થાએ તે પહેંચ્યો. ત્યારે કૌશાંખી નગરીના શતાનિક રાજના કુંવર ઉદાયન સાથે તેને ભિત્રાચારી થઈ, શતાનિક રાજ કાળકુમે મૃત્યુ પામ્યા અને ઉદાયનને રાજ્ય મળ્યું. બૃહસ્પતિદત્ત પુરોહિત બન્યો. અને ઉદાયનના અંતેઉરમાં જવા આવવા લાગ્યો. પરિણામે

ઉદાયનની સ્વી પદ્માવતી પર તે આશકતા થયો. એક વાર પદ્માવતી સાથે બૃહસ્પતિદિત્તને લોગ લોગવતો ઉદાયને જોયો. આથી તે અત્યંત કોષે ભરાયો. અને બૃહસ્પતિદિત્તને શ્રીએ ચડાવવાનો હુકમ ઇરમાવ્યો.

બૃહસ્પતિદિત્તને શ્રી પર ચડાવવામાં આવ્યો. તે ધણોજ આકંદ વિલાપ કરવા લાગ્યો. પણ ‘કર્મ ક્રોધિને છોડતું નથી.’ એ ન્યાયે તે ત્યાં ભરણું પામ્યો અને પહેલી નરકમાં ગયો. ત્યાંથી નીકળી, અનંત સંસાર પરિબ્રમણ કરી આપરે તે કર્મ રહિત થશે.

૧૬૭ અહુપુત્રી દેવી.

વારાણસી નગરીમાં લદ નામે સાર્થવાહને સુલદ્રા નામે સ્વી હતી. તે ધણી જ સુકોમળ અને સૌન્દર્યવાન હતી. તેને ત્યાં રિદ્ધિ-સિદ્ધિ પણ ધણી હતી. પરંતુ સુલદ્રાને એકે પુત્ર કે પુત્રી ન હતી, તેથી તે રોજ આર્તધ્યાન ધરતી હતી. તે સમયે સુવત્તા નામના સાધ્વીજ તેને ત્યાં પદ્ધાર્યો. સુલદ્રા હર્ષ પામી. તેણે સાધ્વી-જીને ભાવયુક્ત વંદણા કરી નિર્દેખ આહારપાણી વહોરાંધ્યાં. ત્યારબાદ સુલદ્રાએ સાધ્વીજીને પૂછ્યું:-હે સતીજી, મારે પૂર્વના પાપના ઉદ્યે એકે પુત્ર પુત્રી નથી. માટે આપની પાસે વિદ્યામંત્ર હોય તો કૃપા કરી આપો, જેથી મને પુત્ર કે પુત્રીનો પ્રસવ થાય. ત્યારે સાધ્વીજીએ જવાય આપ્યો. હે લદ્રા, અમો નિર્ભિની ધીએ. અમારે આવી વાત સંભળવી પણ કલ્પે નહિ, તો પછી તેનો ઉપાય તો શી રીતે બતાવી શકાય ? તમે કહો તો તમને સર્વરૂ પ્રણિત ધર્મ સંભળાવીએ. સુલદ્રાએ છચ્છા બતાવી, તેથી સાધ્વીજાએ તેને ધર્મ સંભળાવ્યો, તે ધર્મ પામી અને બારત્રતધારી શ્રાવિકા બની.

ધણો કાળ વીતી ગયો, છતાં સુલદ્રાને કંઈ પ્રસવ થયો નહિ. એકદા ધર્મ જગરણ જગતાં સુલદ્રાને દીક્ષા લેવાનો ભાવ થયો.

પતિની આજા માગી. પતિએ અનુમતિ પ્રથમ આપી નહિ, પરંતુ સુભદ્રાએ હઠ પકડી. તેને સમજવી ન શકવાથી છેવટે દીક્ષાની અનુમતિ આપી. સુભદ્રા સુવતા આર્યાજી પાસે દીક્ષિત બની અને સંયમમાં વિચરવા લાગી. દીક્ષિત થવા છતાં નાનાં બાળકો પ્રત્યેનો તેનો રાગ જરાયે ઓછો ન થયો. તે બાળકોમાં મૂર્છિત બની. અને નગરજનનોનાં જ્યાં જ્યાં બાળકો હેખે, ત્યાં ત્યાં તે રમાઉવા લાગી. ઉપાશ્રયમાં બાળકોને હેખે તો તેને સ્નેહપૂર્વક રમાડે, કેટલાકના હાથપગ રંગે, કેટલાકના હોઠ રંગે, કેટલાકની આંખોમાં કાજળ આંજણે, કેટલાકને પોતાની ગોદમાં લઈ સુવાડે, કેટલાંકને ઘ્વણાવે, ફૂધ પીવણાવે. આવી રીતે પુત્ર પુત્રીઓમાં આસક્તા બનીને તે આનંદ મેળવવા લાગી. આ વાતની સુવતા આર્યાજીને ખખર પડવાથી તેને તેમ ન કરવા કહ્યું અને સાધુ-માગની પરિચય કરાવી તેને ગ્રાયશ્વિત લેવા કહ્યું, છતાં તેણે માન્યું નહિ. અને પુનઃ તે પ્રમાણે કરવા લાગી; તેથી અન્ય સાધ્વીજીઓએ સુભદ્રા આર્યાજીનો સતકાર કર્યો નહિ. સુભદ્રા સ્વચ્છંદી બનીને તેમનાથી જુદી પડી, અને એક અલગ ઉપાશ્રયમાં એકાંત રહેવા લાગી. પરિણામે તે શિથિલાચારી બની ગઈ. આવી રીતે ધણ્યા વર્ષ સંયમ પાળાને, પંદર દિવસનો સંથારો કરી સુભદ્રા કાળધર્મ પામી અને સુધર્મ દેવલોકમાં ‘બહુપુત્રી’ નામે વિમાનમાં દેવીપણે ઉત્પજ થઈ.

ભગવાન મહાવીર કહે છે કે તે બહુપુત્રીદેવી લાંથી ચલોને જંયુ-દ્વીપના ભરતક્ષેત્રમાં એક આલાણુને ધેર, સોભા નામની પુત્રીપણે અવતરશે. આ સોભાને રાષ્ટ્રકુંડ નામના એક આલાણુ સાથે પરણાવવામાં આવશે. તેની સાથે સોભા ધણ્યા પ્રકારનાં સુખ લોગવતી રહેશે. તેની સાથે વિષયસુખ લોગવતાં ૧૬ વર્ષમાં તે ઉર બાળકોને જન્મ આપશે. આ બધા બાળકોની સારસંભાળ રાખત્તા તે પૂરેપૂરી કંટાળશે, પોતાના જીવતર પર તેને ધિક્કાર છૂટશે અને વંધ્યા ક્રીને તે

ધન્યવાદ આપશે. એવામાં સુપ્રતા નામના કોઈ સાધ્વીજ પધારશે. બહુપુત્રીહેવી ધર્મ સાંભળી વૈસગ્ય પામશે અને દીક્ષા દેશે. સખ્ત, તસ્, જ્ય, ધ્યાન ધરી ધણ્ણા વર્ષ સંયમ પાળી એક માસનો સંથારો કરશે અને કાળ કરીને શકેંદ્ર દેવના સામાનિક દેવપણે ઉત્પત્ત થશે. લાંધી મહાવિદેહમાં જન્મ લઈ, સંયમ લઈને તે મોક્ષમાં જરો.

૧૬૭ ભરત અને બાહુભળ.

ભરત અને બાહુભળ એ રૂપલદેવ ભગવાનના પુત્રો હતા. રૂપલદેવ ભગવાન પોતાનું રાજ્ય આ એ પુત્રોને સોંપી, દીક્ષા લઈ ચાલી નીકળ્યા હતા. ભરત અને બાહુભળના બળની આખા જગતમાં જોડી નહિ. રાજ્યાસને આવ્યા પછી ભરત રાજએ મોટી મોટી લડાઈએ કરી. મોટા મોટા રાજ્યો જીત્યા અને છ ખંડ જીતીને છેવટે તેઓ ચક્રવર્તી થયા. બાહુભળ પણ ધણ્ણા જરૂરા હતા. એકવાર ભરત રાજને વિચાર થયો કે છ ખંડ રાજ્યોને હું જીત્યો. પણ મારા ભાઈ બાહુભળનું બળ વધારે છે માટે તેમને જીતું તોજ હું ખરો કહેવાની. એમ ધારી બાહુભળને પોતાની સાથે લડવાનું આમંત્રણ મોકલ્યું. બાહુભળ પણ ભરતથી ગાંધ્યા જય તેમ ન હતા. તે ભરતને નમે તેવા ન હતા. બંને ભાઈઓ યુદ્ધ કરવા તૈયાર થયા. યુદ્ધમાં અનેક માણસોનો સંહાર થાય, તે કરતાં બંનેએ સામસામાં લડવું એમ ઉચિત ધારીને બંને ભાઈઓ લડવા માટે રણમેદાનમાં ઉત્તરી પડ્યા.

ભરતે પોતાનું ચક સણુણણુણ કરતું બાહુભળ પર છોડ્યું; પણ એકજ ઉદ્દરથી ઉત્પત્ત થયેલા ભાઈ પર તેચક કંઈ પણ અસર કરી શકે નહિ, તેવો નિયમ હોવાથી ભરતનું તે ચક બાહુભળના શરીરની આસપાસ કરીને પાછું ભરત પાસે આવી ગયું. આથી બાહુભળજીને ધણ્ણા કોધ ચડ્યો. તેમણે ભરતને મારવા માટે પોતાની વજ સમાન મુડી ઉપાડી. ત્યાં જ બાહુભળને લાગ્યું કે માત્ર રાજ્ય

દોષને ખાતર ભાઈને મુણ્ઠિ ભારવી ઢીક નહિ, લદે લરતજ રાજ્ય ભોગવે. મહારે રાજ્ય જોઈતું નથી. ત્યારે શું આ ઉપાડેલી મુણ્ઠિ વીર પુરુષો પાછી મૂકે ખરા ? એ પણ કાયરતાની નિશાની છે, તેમ ધારી તરતજ તે સુધી વડે બાહુભળજુએ પોતાના ભાથાના કેશનો દોય કર્યો અને દીક્ષા લઈ ચાલી નીકળ્યા. તેમને ઇષ્ટભદેવ ભગવાનને વંદન કરવા જવાની ધર્માથી થઈ. પણ તેમને વિચાર થયો કે ઇષ્ટભદેવ ભગવાન પાસે ભારા નાના ભાઈઓએ દીક્ષા લીધી છે. અને નિયમ સુન્ધર ભારે તેમને વંદન કરવું પડશે. હું તો મોટો છું અને તેઓ નાના છે. તો હું તેમને શા માટે વંદન કરું ? માટે ખૂબ તપશ્ચર્યા કરી તેમના પહેલા કેવળજ્ઞાન પામું. એવું અલિમાન બાહુભળજુને આવ્યું. આથી તેઓ ધોર તપ કરવા વનમાં ગયા.

નહિ ખાવું, નહિ પીવું, ઉંચા હાથ, યોગધ્યાનની દશામાં. આવી રીતે કરતાં બાર બાર મહિના થઈ ગયાં. શરીર દુર્બળ બની ગયું. પક્ષીઓએ તેમના ભાથા પર ભાળા ધાત્યા છે, હાડકાંઓ ભાલી ખોખાં જેવા થઈ ગયાં છે, અને ખૂબ ઉત્ત્રતપસ્યા થઈ છે, છતાં બાહુભળને કેવળજ્ઞાન થતું નથી.

ઇષ્ટભદેવ ભગવાને વાત જણ્ણો. બાહુભળ માનના હેઠાપર ચડચા છે, તેથી તેમને જ્ઞાન થતું નથી. તેમ ધારી પ્રલુબે લરત અને બાહુભળના બહેન, બાલી અને સુંદરી જેઓ દીક્ષિત બની સાધ્વીજીઓ થયા હતા, તેમને બાહુભળ પાસે ઉપદેશ કરવા મોકલ્યા. આ એ મહાન સતીઓએ આવી બાહુભળજુને વંદન કરી કહ્યું:-

‘વીરા મોરા, ગજથકી ઉતરો, ગજથકી કેવળ (જ્ઞાન) ન હોય.’ વીરા મોરા, ગજથકી ઉતરો. એટલું કહી બંને સાધ્વીજીઓ ચાલી ગઈ. બાહુભળ આ સાંભળી ચમક્યા. વિચાર કર્યો કે હું તો હાથી ઉપર ચડયો નથી અને નીચે જમીન પર તપશ્ચર્યા કરું છું. છતાં આ સાધ્વીઓ આમ કેમ ખોલ્યા. સાધ્વીજ જુહું ખોલે નહિ. એમ ધારી વિચાર કરતાં જણાયું કે હા, ખરેખર હું માન ઇપી હાથી

ઉપર ચડચો છું, નાના લાઈને વંદન ન કરવું એ માન છે. માટે ખરાયર છે. માન એજ મને તુકશાન કરે છે. એમ કહી બાહુભળ-જુએ નહાના લાઈએને વાંદવા જવા માટે જેવો પગ ઉપાડચો કે તરતજ તેમને કેવલ્યજાન ઉત્પજ થયું.

હવે ભરતજ રાજ્યાસન પર રહીને બહુજ ન્યાય અને નીતિપૂર્વક રાજ્ય ચલાવે છે. તેમનું રાજ્ય રામ રાજ્ય જેવું વખણ્યાય છે. પ્રણ પણ સુખી છે. એકવાર ભરતરાજ સુંદર વખાલંકારો પહેરી પોતાનું ઇપ જેવા અરીસાભૂવનમાં જય છે. અરીસામાં પોતાનું ઇપ ધારી ધારીને જુવે છે અને પોતાના ઇપની અશંસા કરે છે, ગુણની પ્રશંસા કરે છે, અધિકારની પ્રશંસા કરે છે, તેવામાં તેમની નજર આંગળી તરફ ગઈ, આંગળીમાં વીઠી પહેરવી ભૂલી ગયા છે. તેથી તેઓ વિચારવા લાગ્યા કે વીઠી વિના આ આંગળી કેવી ખરાય લાગે છે? લારે શું આ અલંકારોથી જ હું શોભાયમાન લાગું છું? અલંકારો ન હોય તો શું હું ખરાય લાગું? જેવા તો હે. એમ ધારી તેમણે મુગટ, કુંડળ, હાર વગેરે એક પછી એક અલંકારો ઉતારી નાખ્યા. પછી શરીર સામે જોઈ તેઓ વિચારવા લાગ્યા. આ શરીર, આ ઇપ, કેટલો ફેર? લારે શું બાલ્ય વસ્તુમાંજ હું લોભાયો? બહારના સુખમાંજ હું મોદ્દી? લારે ખરં સુખ કર્યું? આત્માનું સુખ કર્યું? વિચાર કરતાં જણાયું કે જીન દર્શન અને ચારિત્ર એ જ આત્માનું ખરં સુખ છે. આ લક્ષ્મી, આ રાજ્યૈલવ, બધીએ ઉપાધિ માત્ર છે, તેનો લાગ શા માટે ન કરવો? અને ખરં અક્ષય સુખ કેમ ન જેળવવું? એમ વિચારતાં ચોગદશામાં ભરતજ ચડચા અને લાં જ આરીસાભૂવનમાં તેમને કેવળજાન થયું.

ધન્ય છે, ભરત અને બાહુભળ સમા લડવીર મહાપુરુષોને ત્લેમને આપણા વંદન હો!

૧૬૯ ભૂગુ પુરોહિત

તે ઈષુકાર રાજનો પુરોહિત હતો. તે નલિનીગુલ્મ વિમાન-માંથી ચ્યવી અહિં ઉત્પન્ન થયો હતો. તેને જશા નામની પત્ની હતી. તેનાથી તેમને એ પુત્રો થયા. વેદાદિ શાસ્ત્રમાં પારંગત થયા પછી, અને પુત્રો દીક્ષા લેવા તત્પર થયા. તેમના ઉપરોક્ષાથી ભૂગુ પુરોહિતને પણ વૈરાગ્ય થયો અને તેણે દીક્ષા લીધી. દીક્ષા લઈ ખૂબ તપશ્ચર્યા અને સંયમની આરાધનાને અંતે તેઓ કૈવલ્યજીન પામી મોક્ષમાં ગયા.

૧૭૦ ભદ્ર અળદેવ

દારિકા નગરીમાં સુભદ્ર નામના રાજ હતા. તેમને સુગ્રભા નામની રાણી હતી. તેનાથી ભદ્ર નામના ત્રીજ અળદેવ થયા. તેઓ સ્વયંભૂ નામના વાસુદેવના ભાઈ હતા. તેઓ દીક્ષા લઈ, ૧૫ લાખ વર્ષનું આયુષ્ય જોગવી, વિમળનાથ પ્રભુના સમયમાં મોક્ષે ગયા.

૧૭૧ ભોજ વિષ્ણુ—અંધક વિષ્ણુ

મથુરા નગરીમાં હરિવંશ કુળમાં સોારિ અને વીર નામના બે ભાઈઓ હતા. જેમાં સોારિએ સોારિયપુર (શૌરિપુર.) અને વીરે સોવીર નામનું નગર વસાયું હતું. તે સોારિ રાજને અંધક વિશ્નુ નામે પુત્ર હતો, એ અંધક વિશ્નુને ભદ્રા નામની રાણી હતી. તેનાથી તેમને સમુદ્રવિજય વગેરે ૧૦ પુત્રો તથા કુંતી અને માદ્રી એમ બે પુત્રીઓ જન્મી હતી. જ્યારે વીર રાજને ભોજવિશ્નુ નામે પુત્ર હતો. તે ભોજવિશ્નુને ઉત્ત્રસેન, દેવક વગેરે પુત્રો થયા હતા. આખરે ભોજવિષ્ણુએ પોતાનું રાજ્ય ઉત્ત્રસેનને સોંપી દીક્ષા લીધી હતી.

૧૭૨ ભધવ ચક્રવર્તી

આવશિત નગરીમાં સમુદ્રવિજય નામે રાજ હતા. તેમને ભદ્રા નામની સુશીલ રાણી હતી. એક રાત્રે રાણીએ ૧૪ સ્વખન નિહાલ્યાં.

સ્વર્ણ પાઠકોએ રાણીને મહાભાગ્યશાળી પુત્રરત્ન સાંપડશે એવું સ્વર્ણનું કુળ કહ્યું. રાણીએ મધ્ય નામના ત્રીજી ચક્રવર્તીને જન્મ આપ્યો. યુવાવસ્થા પામતાં મધ્યે છખ્યંડ સાધ્યા. ત્યારબાદ સંયમ અંગીકાર કર્યો. પાંચ લાખ વર્ષનું આયુષ્ય લોગવી તેઓ મોક્ષમાં ગયા.

૧૭૩ ભરિચિ

તેઓ ઋષભદેવ પ્રલુના જ્યેષ્ઠ પુત્ર ભરતરાજના કુવર હતા. તેમણે ઋષભદેવ પાસે દીક્ષા લીધી હતી; પરન્તુ પાછળથી ઉનાળામાં તૃપાનો પરિષહ પડ્યો, તે સહન ન થઈ શકવાથી તેમણે જૈન-મુનિનો વેશ છોડીને ત્રિદંડી તાપસનો વેશ ધારણ કર્યો. છતાં તેઓ જૈનધર્મના સિદ્ધાન્તોનો જ ઉપદેશ આપતા; અને સંસારથી કંટા-જેલાએને લ. ઋષભદેવ પાસે મોકલતા. એક વર્ષ ભરિચિનું શરીર નરમ પડ્યું. ચાકરી કરનાર તેમને કોઈ શિષ્ય ન હોવાથી, શિષ્ય કરવાની લાલચ થઈ. તે વર્ષતે તેમણે ત્યાગ લેનાર કોઈ એક ગૃહસ્થને કહ્યું કે મારી પાસેજ ધર્મનાં સાચાં તત્ત્વો છે, એમ કહી ભરિચિએ મૃષા ઘોલી પોતાનો સંસાર વધાર્યો.

કોઈ એક પ્રસંગે લ. ઋષભદેવ દેશના આપતા હતા. દેશના પૂરી થયા પછી ભરત મહારાજાએ પ્રલુને પૂછ્યું. ભગવાન, આ પરિષહમાં કોઈ આપના જેવો મહાસમર્થ, મહાભાગ્યશાળી પુરુષ છે? પ્રલુ બોલ્યા:-“ હા, તમારો ભરિચિ નામનો કુમાર, જે હાલ ત્રિદંડી વેશમાં વિચરે છે તે આ ચોવીસીમાં છેલ્લો તીર્થકર થશે. વળી તેજ ભરિચિ ‘ત્રિપૃષ્ઠ’ નામનો પહેલો વાસુદેવ થશે, તેમજ એજ ભરીચિ મહાવિહેઠ ક્ષેત્રમાં ચક્રવર્તી થશે.” આ સાંલળી ભરત ભરિચિ પાસે આવ્યા અને વંદન કરીને બોલ્યા:- હે મહા-ભાગ્યવાનુ, તમે વાસુદેવ, ચક્રવર્તી અને તીર્થકર થશો. માટે હું તમને વંદન કરું છું. આ સાંલળી ભરિચિના આનંદનો પાર રહ્યો નાહિ. તે સાથે તેઓ અલિમાન ઇપી મદ હરિતએ ચડ્યા અને નાચ્યા, કુદ્દતા બોલ્યા:-અહો, મારું કુળ કેવું એષ છે! મારા

દાદા પ્રથમ તીર્થકર, મારા પિતા પ્રથમ ચક્રવર્તી, અને હું પ્રથમ વાસુદેવ; તેમજ ચક્રવર્તી અને તીર્થકર થઈશ ! આ અભિમાનને લીધે મરિયિએ ત્યાંજ નીચ ગોત્ર કર્મ ઉપાજ્ઞન કર્યું. તેમણે ધણ્યા બવો કર્યો અને નીચ ગોત્ર કર્મનું છળ તેમણે મહાવીરના ભવભાં લિક્ષુક કુળમાં ઉત્પજ થઈને ભોગયું. મરિયિ તે પછી કાળધર્મ પામીને પાંચમા અલદેવકોક્ભાં ગયા.

૧૭૪ મરુદેવી માતા

અચોધ્યા નગરીમાં ત્રીજ આરાના યુગલ યુગમાં નાલિરાજ અને મરુદેવી એકી સાથે (જોડલે) જન્મ્યા હતા. નિયમ મુજબ બંનેએ વિવાહ કર્યો. તેમને એક યુગલ અવતર્યું, તે ઋષભદેવ અને સુભંગલાના નામથી પ્રસિદ્ધ થયું. લ. ઋષભદેવે દીક્ષા લીધી, ત્યારથી મરુદેવી પુત્રમોહને લીધે ધણ્યા શોકભાં રહેતા; ને વારંવાર લરતને ભગવાનની સારસંભાગ રાખવાનું સૂચન કરતા. જ્યારે પ્રભુને અચોધ્યામાં કૈવલ્યજ્ઞાન થયું ત્યારે મરુદેવી માતાને હાથીપર ઐસાડી લરત મહારાજ પ્રભુની સુખસાધણી બતાવવા લઈ ગયા. ત્યાં સમવસરણની અપૂર્વ રચના જોઈ સંસારની અસારતાનું મરુદેવીને ભાન થયું. તેઓ ભાવનાના પ્રવાહમાં વલ્યા, અનુક્રમે ક્ષપક શ્રેણિમાં પ્રવેશતાં હાથી પરજ તેમને કૈવલ્યજ્ઞાન થયું; અને તેઓ મોક્ષભાં ગયા.

૧૭૫ મહીનાથ

જંબુદીપના મહાવિદેહ ક્ષેત્રમાં વિતશોકા નામની રાજ્યધાની હતી. તેમાં બળ રાજ રાજ્ય કરતો હતો, તેને ધારિણી પ્રમુખ એક હંજર રાણીએ હતી. ધારિણી દેવીને મહાબળ નામનો કુમાર હતો. તેને રૂપ, સૌન્દર્યવાન પાંચસો રાજ્યકંન્યાએ પરણાવવામાં આવી હતી. તેમની સાથે મહાબળ મનુષ્યના કામભોગ સંબંધીનું સુખ ભોગવતો રહેતો હતો. એકદા ધર્મધોષ નામના સ્થવીર તે નગરીના ઉધાનમાં પધાર્યા. પરિષદ વંદન કરવા ગઈ. બળરાજ પણ વંદન કરવા આવ્યો. મુનિની દેશનાથી રાજ વૈરાગ્ય પામ્યો અને મહાબળને રાજ્ય સોંપી દીક્ષા લઈ ચાલી નીકલ્યો.

આ મહાયળકુમારને છ બાળમિત્રો હતા, જે સધળા સાથે જરૂરેલા અને વૃદ્ધિ પામેલા હતા. તેમજ તે સાતે જણાએ સાથે દીક્ષા કેવાનો નિરધાર કર્યો હતો. તે સમયે ધીરુંલ ઉદ્ઘાનમાં ધર્મધૈર્ય નામના સ્થવીર પધાર્યા. મહાયળ વંદન કરવા ગયો. મુનિના ઉપરેશથી તે બોધ પામ્યો અને પોતાના છ બાળમિત્રોને પૂછી દીક્ષા કેવાનું ધર્મધૈર્ય મુનિને કહીને તે સ્વસ્થાનકે ગયો.

ત્યારથાદ તે પોતાના છ મિત્રો પાસે આવ્યો અને સર્વ વાત નિવેદન કરી. છ મિત્રો પણ દીક્ષા કેવા તૈયાર થયા. મહાયળ પોતાના પુત્રને રાજ્ય સોંપી છ જણાની સાથે ધર્મધૈર્ય મુનિ પાસે દીક્ષા લીધી અને તપ સંયમમાં વિચરવા લાગ્યા.

એક વખતે આ સાતે જણાએ મળીને એવો નિશ્ચય કર્યો કે આપણે બધાએ સરખી જ તપશ્ચર્યા કરવી. બધા કણુલ થયા અને ઉપરા ઉપરી ઉપવાસ, છઠ, અઠમ આદિ નાની મહોટી તપશ્ચર્યા કરવા માંડી. મહાયળ વિચાર કર્યો કે હું બધાથી વધારે તપશ્ચર્યા કરેં. એમ ધારી જયારે પેલા છ જણ એક ઉપવાસ કરે લારે મહાયળ એ ઉપવાસ કરે, પેલા એ ઉપવાસ કરે લારે મહાયળ ત્રણ ઉપવાસ કરે. એમ દરેક વખતે એકેક ઉપવાસની મહાયળ વધારે તપશ્ચર્યા કરે. આ પ્રમાણે પેલાથી છાની અને ભાયા કપટપણે ધણા વર્ષો સુધી તપશ્ચર્યા કરી. આ ભાયા કપટના પરિણામનો બાંધ પડ્યો અને મહાયળ મુનિએ સ્વીનામ કર્મ ઉપાર્જન કર્યું. અદ્ભુત તપશ્ચર્યા અને વીસ સ્થાનકના સેવન વડે મહાયળ તીર્થીકર ગોત્ર બાંધ્યું. અનુક્રમે સાતે જણા કાળ ધર્મને પામી અનુત્તર વિમાનમાં ઉત્પજ થયા. ત્યાંથી નીકળી પેલા છ મિત્રો ભરતક્ષેત્રના જુદા જુદા નગરમાં રાજ્ય-કુમારોપણે ઉત્પજ થયા, અને મહાયળ કુમાર ત્યાંથી ચ્યવી મિથિલાનગરીમાં કુંભરાજની પ્રભાવતી રાણીની કુલ્લિએ પુત્રીપણે ઉત્પજ થયા. પોતે તીર્થીકર થશે, તેથી છપન કુમારીકાઓએ અને ૬૪ ધૈર્યોએ

આવી ભક્તીકુંવરીનો જન્મ મહોત્સવ કર્યો. પ્રભાવતી દેવીને ગલ્ભમાં પુષ્પની શૈથયામાં એસવાનો હોણ ઉત્પન્ન થયો હતો અને જે વાણિયાંતર દેવોએ પૂર્ણ કર્યો હતો. તેથી તેનું નામ ભક્તીકુંવરી પાડવામાં આવ્યું. ભક્તીકુંવરીનું ૩૫, સૌંદર્યમાં, લાવણ્યમાં અપ્સરા અને ઉર્વશીને ભૂલાવે તેવું સુમતોહર કંતિવાળું અને અનુપમ દેહિયમાન હતું. સમરત બરતક્ષેત્રમાં તેનાં ઇપની હરીકાઈ કરી શકે તેવું કોઈ જ ન હતું. અનુક્રમે ભલ્લીકુંવરી અનેક ધાવમાતાઓના લાલનપાલન વડે વૃદ્ધિગંત થવા લાગી. તીર્થકરોને જન્મથીજ અવધિજ્ઞાન હોય છે. તેથી તેણે પૂર્વભવના છએ આળભિત્રોને જુદા જુદા રાન્યોમાં જન્મેલા જોયા. અને તે સર્વને ખુઝાવવાને માટે તેણીએ નિશ્ચય કર્યો.

ભક્તીકુંવરીએ અશોક વનમાં એક મોહનધર બંધાવ્યું, તેમાં અનેક ચાંબલા ઉલા કરાવ્યા, તેની અંદર મધ્યમાં એક ગુમધર કરાવ્યું, તેને ઇરતી છ જાળોએ બનાવવામાં આવી. વર્ચ્યે એક ભણ્યુપીહિકા અથવા ચયુતરો ઉલ્લા કરવામાં આવ્યો. અને એક કુશળ ચિત્રકાર પાસે પોતાના સ્વરૂપ જેવી સુંદર અને લાવણ્યવાળી એક સુવર્ણની પ્રતિમા કરાવીને તે ભણ્યુપીહિકા પર ઉભી રાખી. તેના ભરતક પર એક છિદ્વાળું દાર અનાવ્યું. અને ભક્તીકુંવરી તે ઉચ્ચારીને તેમાં રોજ અજ વગેરે નાખવા લાગી. દરરોજ આહાર નાખવાથી તેની અંદર ભરેલા સર્પ અથવા મૃત ગાય અથવા ભરેલા ભાણુસનું શરીર સડી જથ્ય અને જે દુર્ગધ દ્યુટે તેવી દુર્ગધ ઉત્પન્ન થઈ.

ભક્તીકુંવરીના ઇપ સૌંદર્યની પ્રશંસા આખા દેશમાં પહોંચી ગઈ હતી. પેલા છ બાળભિત્રો, જેઓ કાળાન્તરે રાન્યાસન પર આવ્યા હતા; તેમનાં સાંભળવામાં પણ ભક્તીકુંવરીના સૌંદર્યની વાત આવી હતી. તેથી તેઓને ભક્તીકુંવરીને પરણુવાનો ભાવ ઉત્પન્ન થયો. હતો. તેમણે પોતાના દૂતોને કુંભરાજ પાસે ભક્તીકુંવરીનું માગું કરવા મોકલ્યા. કુંભરાજને દૂતોએ જ્યારે ચા વાત કરી ત્યારે કુંભરાજ

ધણો જ ગુસ્સે થયો. અને હૃતોને તેણે કાડી મૂક્યા. પરિણામે છચે રાજીઓ. સંધી કરીને પોતાનું લશ્કર લઈ કુંભરાજ પર ચડી આવ્યા અને નગરીને ઘેરો ધાત્યો. કુંભરાજ લડ્યો, પરંતુ છ જણાના એકન સૈન્ય સામે તે દ્રાવી શક્યો નહિ, તેથી તે મહેલમાં પેસી શોક કરવા લાગ્યો.

મહીકુંવરીએ વાત જાણી તેથી તેણે પિતા પાસે જઈ શોક ન કરવાનું કહ્યું અને જણાવ્યું કે પિતાજી, તમે હૃત મોકલી તે છચે રાજીઓને જણાવો કે હું તમને મહીકુંવરી આપીશ. અને તેઓને મિથિલા નગરીમાં પ્રવેશ કરાવી જે ગુમ ધર બનાવ્યું છે તેમાં રાખો. રાજીએ તે પ્રમાણે કર્યું. જ્યારે પેલા છ રાજીઓને ગુમધરમાં લઈ જવામાં આવ્યા ત્યારે ઢાંકણાવાળી જે પ્રતિમા બનાવેલી તે દેખીને અધા મૂર્છિત થઈ ગયા, સાક્ષાત મહીકુંવરી માનીને તેના પ્રત્યે તેઓ અનિમેષ નજરે જોઈ જ રહ્યા.

ત્યારથાદ મહીકુંવરીએ પાછળથી તે પ્રતિમા પાસે આવીને તેનું ઢાંકણું ખોલી નાખ્યું, કે તરતજ તેમાંથી પારાવાર હુર્ગધ છૂટી. તે સહન ન થઈ શકવાથી છ રાજીઓ નાક આડું કપડું રાખોને પાછળ ફરીને ઉલા રહ્યા; ત્યારે મહીકુંવરીએ કહ્યું. હે રાજીઓ, તમે શા ભાટે નાક આડું વસ્ત્ર રાખો છો? રાજીઓએ કહ્યું કે આ હુર્ગધથી અમારાથી રહેવાતું નથી. મહીકુંવરીએ કહ્યું. આ સુવર્ણ પ્રતિમા છે. તેમાં હું ડેશાં એકેક પિંડ (કોળાયો) ખારાકનો નાખ્તી. તેનાથી આટલી તીવ્ર હુર્ગધ થઈ; તો વમન, પિત, શુક, રૂધિર, ખરાય ઉશ્વાસ નિઃશ્વાસ, મૂત્ર, વિષાથી ભરેલાં આ ઉદારીક શરીરમાં કેટલી હુર્ગધ હશે? વિચાર કરો, હે રાજન, વિચાર કરો; અને તમે અનુષ્યના કામલોગમાં આશક્તા ન બનો. આથી ત્રીજા ભવમાં આપણે મહાયણ પ્રમુખ સાત મિત્રો હતા, સાથે જન્મેલાં, સાથે જ દીક્ષા લીધી હતી. અને સરખો જ તપ કરતા હતા. પણ હું તમારાથી કપટભાવે એકેક

ઉપવાસ વધારે કરતી હતી. તે કપટના પરિણામે હું સ્વીપણે ઉત્પન્ન થઈ છું, અને તમે રાજ્યકુમારાપણે ઉત્પન્ન થયા છો. જ્યાંત વિમાનમાં આપણે એવો સંકલ્પ કર્યો હતો કે મૃત્યુલોકમાં ગયા પણી ને પ્રથમ સમજે તેણે બીજાને પ્રતિયોગ આપવો અને દરેકે દીક્ષા લેવી. તે થું તમે ભૂલી ગયા ? તમે પૂર્વભવ યાદ કરો. તે સાંભળી સધળા રાજાઓ વિચારમાં પડ્યા અને શુક્લ ધ્યાનથી ઉપયોગ મૂક્તાં તેઓને જાતિસ્મરણ જ્ઞાન ઉપન્યંતરના દ્વારા ખોલવામાં આવ્યા. છએ જણાઓ ભક્તીકુંવરી પાસે આવ્યા. ભક્તીકુંવરીએ કહ્યું કે હું સંસાર ભયથી ઉદ્વેગ પામી છું અને દીક્ષા લેવા ચાહું છું. એલો:- તમારી શ્રી ઈંદ્રિય છે ? બધાએ દીક્ષા લેવાનું વચ્ચે આપ્યું. તેઓ રાજ્યમાં જઈ પોતાના પુત્રોને રાજ્ય સોંપી દીક્ષા લેવાનું કહીને ગયા.

ભક્તીકુંવરી દીક્ષા લેવા તત્પર થઈ. વરસીદાન આપવું શરૂ કર્યું. દેવતાનું આસન ચલ્યું, લોકાન્તિક દેવો આવ્યા. ધર્મભાગ્ પ્રવર્તીવવાની ઉદ્ઘોષણા કરો. માતાપિતાએ દીક્ષાની રજ આપી. સોનારપાના કળશો બનાવરાની ભક્તી તીર્થકરનો અલિષેક કરાવ્યો, ધ્રોએ દીક્ષા મહેત્તસવ ઉજવ્યો. સહસ્રવન ઉદ્ઘાનમાં અરોકૃપ્યા પાસે આવીને ભક્તીપ્રલુએ સ્વયંમેવ પંચમુષ્ટિ લોચ કર્યો, અને તેઓ પ્રવર્જિત થયા. છએ રાજાઓ તથા કુંભરાજ ભક્તીપ્રલુનું વ્યાઘ્યાન સાંભળવા આવ્યા. કુંભરાજ આવક થયો. છએ રાજાઓએ દીક્ષા લીધી. ભક્તીપ્રલુને દીક્ષા લીધા યાદ તરતજ મનઃપર્યવ જ્ઞાન ઉપનિષદ થયું. સમ્પત તપ જ્ય કરી, ચોપન હજર વર્ષસુધી સંયમ પાળી, તેઓ કેવળજ્ઞાન, કેવળ દર્શનને પામ્યા. અને એક હજર વર્ષ સુધી કેવળ પ્રવર્જયામાં રહી, અવ્યાખ્યાધ એવી મોક્ષગતિને પ્રાપ્ત થયા. ભક્તીનાથ પ્રલુના સંધ પરિવારમાં ૪૦ હજર સાધુએ, ૫૫ હજર સાધીએ, ૧૮૩ હજર શ્રાવકો અને ૩૭૦ હજર આવિકાએ હતા.

સાર—મહાન તપશ્ચર્યા અને સંયમને સેવતા છતાં, માયાથી તીર્થકર

લેવાને પણ સ્વીપણું પ્રાપ્ત થયું અને જૈનાગમમાં એક અછેરું ગણ્યાયું.
માટે માચાથી વિરક્ત બનવાનો આ વાર્તા સૌ કોઈ ને જોધ આપે છે.

૧૭૬ મહાપદ્મ.

ગજપુર નગરમાં પદ્મોત્તર નામે રાજ હતા. તેમને જવાલા
નામની રાણી હતી. તેમને એ પુત્રો થયા. ૧ વિષણુકુમાર, ૨ મહાપદ્મ.
વિષણુકુમારે પિતાની હૃતાતિમાંજ દીક્ષા લીધી હતી. જ્યારે મહાપદ્મ
મહા સમર્થ હોઈ નવમા ચક્રવર્તી થયા. પિતાએ પણ દીક્ષા લેવાથી
તેઓએ રાજ્યાસને આવી છખંડતી સાધના કરી. તેમને નમુચી
નામે એક પ્રધાન હતો. તે જૈન ધર્મનો દેવી હતો. એકવાર તે પ્રધાન
થયા પહેલાં ધર્મ નામના રાજની યવંતી નામક નગરીમાં સુવત
નામના આચાર્ય સાથે ધર્મચર્ચા કરવા ગયો હતો, ત્યાં તે પરાજય
પામ્યો, તેથી તેણે રાત્રિને વખતે તે મુનિનો સંહાર કરવાનો વિચાર
કર્યો, પરન્તુ શાસનહેવના પ્રભાવે તે તે સ્થળે સ્થંભી ગયો. સવાર
થતાં કોકોએ તેનો તિરસ્કાર કર્યો; રાજાએ ત્યાંથી તેને કાઢી મૂક્યો;
આગળ જતાં તે મહાપદ્મ ચક્રવર્તીનિની પ્રધાન થયો. અહિ તેણે યમહુર્ગ
નગરના બળસિંહ નામક માંડલિક રાજનું બંડ સમાંયું, તેથી પ્રસન્ન થઈને
ચક્રવર્તીએ તેને ધનામ માગવાનું કહ્યું. તે ધનામ પ્રસંગે માગી લેવાનું
પ્રધાને જણાયું. એ અરસામાં પેલા સુવ્રતાચાર્ય તે નગરમાં પ્રધાર્ય
એટલે પેલું વચ્ચે યાદ કરી પ્રધાને પોતાને માત્ર ૭ દિવસનું રાજ્ય
આપવાનું ચક્રવર્તીનિ કહ્યું. મહાપદ્મે તે કખુલ કર્યું. પ્રધાને એક
મોટા યજ આરંભ્યો, તે વખતે તેણે સુવ્રતાચાર્ય પાસે લેટણું
માગ્યું; પણ જૈન મુનિ પાસે શું હોય? એટલે પ્રધાને તેમને પોતાના
રાજ્યની હદ છોડી જવાનું કહ્યું. આ વખતે ચક્રવર્તીના લાઈ વિષણુ-
કુમાર, જેઓ સાધુ થયા હતા તેઓ ત્યાં હતા, તેમણે પોતાની
લઘિં વડે નમુચી પ્રધાનને જમીનમાં દાટી લીધો. પાછળથી તેનું

પ્રાયશ્વિત લઈ કૈવલ્યજ્ઞાન પામી તેઓ મોક્ષમાં ગયા. મહાપદમે ત્યારાદ દીક્ષા લીધી અને સખ્ત તપશ્ચયી શડ કરી. છેવટે ૩૦ હજાર વર્ષનું આયુષ્ય લોગવી મહાપદ્મ કૈવલ્યજ્ઞાન પામી મોક્ષમાં ગયા.

૧૭૭ પ્રભુ મહાવીર.

મગધ દેશના કૃત્રિમકુંડ નગરમાં સિદ્ધાર્થ રાજની રાણી ત્રિશલા-દેવીની કુક્ષિએ શ્રી મહાવીર પ્રભુ આજથી લગભગ અઢી હજાર વર્ષ પહેલાં ચૈત્ર શુદ્ધ તેરસે જન્મ્યા હતા. મહાવીર પ્રભુનો જન્મ થવાથી રાજ્યમાં અગણિત ધન ધાન્યની વૃદ્ધિ થઈ, તેથી તેમનું નામ વર્ધમાનકુમાર પાડવામાં આવ્યું. પ્રભુ મહાવીરના જીવે ઋપલદેવ લગવાનના વખતમાં ભરતપુત્ર ભરિયીના ભવમાં પોતે વાસુદેવ, ચક્રવર્તી તથા તીર્થેકર થશે, તેનું અભિમાન કર્યું હતું, તેથી તેઓ આલણુકુંડ ગ્રામમાં ઇપલદાત આલણુને* લાં તેની દેવાનંદા આલણીના ગર્ભમાં ઉત્પત્ત થયા હતા. પરંતુ તીર્થેકરો કંદાપિ બિક્ષુક કુળમાં જન્મ પામે નહિ, તેથી હરિણગમેષી દેવે પ્રભુ મહાવીરના જીવનું ઉત્તીર્ણ રાત્રિએ દેવાનંદાની કુક્ષિમાંથી સાહરણ કર્યું, અને તે ગર્ભ ત્રિશલા-દેવીની કુક્ષિમાં મૂક્યો, અને ત્યાં પ્રભુ મહાવીરનો જન્મ થયો. (આમ ગર્ભ ઉલટાવવામાં પણ હરિણગમેષી દેવનો હેતુ હતો. માત્ર અન્યાય જ ન હતો. કારણ કે પૂર્વે દેવાનંદા અને ત્રિશલા બંને દેરાણી જેઠાણી હતા અને દેવાનંદાએ પોતાની દેરાણી ત્રિશલાનો રતનનો કરંડીયો છાનો માનો ચોરી લીધો હતો. ત્રિશલાના જીવે તે વખતે ધાણું કલ્યાં, છતાં દેવાનંદાએ તે રતનનો કરંડીયો પાછો આપ્યો નહિ; પણ પચાવી પાડ્યો. તે નિકાચિત કર્મનો આ વખતે ઉદ્ય આવવાથી દેવાનંદાનો રતનસમાન પ્રભુ મહાવીરનો જીવ દેવે સાહરણ કર્યો.) ગર્ભમાં ત્રિશલા માતાને દુઃખ

* તીર્થેકરા હેમેશાં કૃત્રિમકુળમાં જ જન્મે છે. શાસ્ત્રારેયે આલણુકુળને બિક્ષુકુળ ગણી જ. મહાવીરના સંબંધમાં અનંતકાળે આ અછેર્ય (આશ્ચર્ય) થયું માન્યું છે.

થાય તેથી પ્રલુએ એકવાર હલનયદન અંધ રાજ્યું, પરિણામે ત્રિશલાને ગર્ભની શીકર થઈ કે ગર્ભ જીવતો હશે કે નહિ; તેથી માતાના સંતોષની ખાતર પ્રલુ મહાવીરે ગર્ભમાં હલનયદનની કિયા કરી. આમ ગર્ભમાંથીજ પ્રલુએ માતા પરનો અપૂર્વ પ્રેમ અતાવવા ભાડ્યો. જન્મ થયા બાદ તેમણે પોતાની ટચલી આંગળી વડે મેરુ પર્વતને ડગાવ્યો; આ પરાક્રમ જોઈને હેવોએ વર્ધમાનકુમારતું નામ ‘મહાવીર’ પાડ્યું.

ત્રીશ વર્ષ સુધી મહાવીર ગૃહસ્થાવાસમાં રહ્યા. યશોદા નામની સ્ત્રીથી તેમને પ્રિયર્દ્દર્શના નામે એક પુત્રી થઈ. ગૃહસ્થાવાસ છતાં તેમનું જીવન તો સદાય સાધુ જીવન જોવું જ હતું. સર્વ કર્મથી સુક્તા થવા તેમણે માતાપિતાની આજ્ઞા માગી; પરંતુ પુત્ર પરનો અતુલ પ્રેમ, તેથી માતા પિતાએ રજ ન આપી, એટલે તેમની આજ્ઞાની ખાતર તેઓ થોડો વખત સંસારમાં રહ્યા. ત્યારાદ તેમના માતાપિતા ગુજરી ગયા એટલે તેમણે દીક્ષા દેવા માટે મોટા ભાઈ નંદીવર્ધનની આજ્ઞા માગી, ભાઈ પરનો અતિશય સ્નેહ એટલે નંદીવર્ધને જણાવ્યું કે ભાઈ! માતાપિતા તો હમણા જ સ્વર્ગવાસ પામ્યા છે, વળી તમારા વિયોગનું દુઃખ મને કર્યાં આપો છો? કૃપા કરી આ રાજગાઢી લોગવો. પ્રલુ મહાવીરે રાજગાઢી નહિ લોગવતાં દીક્ષા દેવાનો લાવ પ્રદર્શિત કર્યોં. નંદીવર્ધને એ વર્ષ રોકાવાનું કર્યું. પ્રલુ મહાવીર એ વર્ષ વધુ રોકાયા. અને ૩૦ વર્ષ બાદ તરત જ પ્રલુ મહાવીર રાજવૈકલ્પ, સ્ત્રી, પુત્રી, ભાઈ, અનુયરો એ સર્વનો ત્યાગ કરી જગત જીવોના કલ્યાણ અર્થે દીક્ષા લઈ ચાલી નીકળ્યા. એજ વખતે પ્રલુને મન:પર્યવજાન પ્રાપ્ત થયું. દીક્ષા સમયે પ્રલુને દ્યુદે એક હેવ દૂષ્ય (વસ્ત્ર) આપ્યું હતું, પરંતુ તેઓ એટલી બધી તીવ્ર વૈરાગ્યદશાને પામ્યા હતા કે એ વસ્ત્ર હું શિયાળામાં પહેરીશ એવો વિચાર સરખોચે તેમણે કદી કર્યો ન હતો. તે વસ્ત્ર તેરમહિના સુધી પ્રલુના ખભા પર પડી રહ્યું હતું. ગમે તેવી સખ્ત

ટાં હોય, તો પણ પ્રભુ કંઈ હાથ સંકોચયતા નહિ, સખ્ત ઉનાળો હોય, છતાં પ્રભુ તે સ્થળે ખુલ્લા પગે ઉલા રહી તપ કરતા હતા. દીક્ષા વખતે પ્રભુને કરવામાં આવેલા સુગંધી દૃષ્યના વિલેપથી ભમરા, ભધમાખ વગેરે અનેક જંતુઓ ચાર માસ સુધી ડંખ મારી લોહી ચૂસતા હતા, છતાં શ્રી પ્રભુએ તેમને ઉડાડવાનો જરા પણ પ્રયાસ કર્યો ન હતો.

ભગવાન કોઈ વખત નિર્જન ઝુંપડાઓમાં, પાણી પીવાની પરબોમાં, લુહાર વગેરેની કોડોમાં, અથવા ધાસની ગંભીરી રહેતા; કોઈ વખતે બાગમાં, પરામાં કે શહેરમાં રહેતા, અને કોઈ કોઈવાર રમશાન, નિર્જન સ્થળ, ઝાડ, ગુફાએ વગેરે ઢેકાણે રહેતા, જ્યાં તેમને અનેક પ્રકારના પરિસહેલા પડતાં. જ્યારે પ્રભુ અનાર્થ દેશમાં ગયા હતા, ત્યારે તો તેમના પર આવેલા પરિસહેલા અવર્ણનિય હતા. અનાર્થ વસ્તી, ધર્મને કોઈ સમજે નહિ, એટલે પ્રભુ વહોરવા જય તો આહારના બદલે માર, અને પાણીને બદલે પ્રહાર મળતો. પ્રભુની પાછળ અનાર્થ લોડો હૂતરા દોડાવે, પ્રભુને કરડાવે, કોઈ લાકડી મારે, કોઈ પત્થર ફેંકે, એવી દ્શાને આ ક્ષમાસાગર પ્રભુ આત્મ કલ્યાણના સાધનભૂત ગણી આ સર્વ સમભાવે સહન કરે.

દેવોએ પણ પ્રભુને ધ્યાનથી ચળાવવા, સર્વના, વિઠીના, હાથીના, સિંહના એમ અનેક ડેપો કરી ખૂબ પરિસહ આપેલો, પણ કરુણાસિધુ શ્રી પ્રભુ એ સર્વ સહન કરતા.

ત્રિપૃષ્ઠ વાસુદેવના ભવમાં પ્રભુ મહાવીરના જીવે એક શય્યાપાલ-કના કાનમાં ઉતું ધગધગતું સીસું રેડાબ્યું હતું, તે મહાન નિકાયિત કર્મનો ઉદ્ય પ્રભુને આ ભવમાં આવ્યો હતો. એકવાર પ્રભુ મહાવીર કાયોત્સર્ગ ધ્યાનમાં હતા, તેવામાં કોઈ એક ભરવાડ પોતાના બે ખળદોને પ્રભુની સમીપમાં ચરતા મૂકી ચાલ્યો ગયો. બળદ ચરતા

ચરતા દૂર જતા રહ્યા. ભરવાડે આવીને પૂછ્યું, હે જોગી, મહારા અળદો ક્યાં છે ? પણ ધ્યાનસ્થ પ્રલુશ શાના ઉત્તર આપે ! ભરવાડે ધાર્યું કે આ ધૂતારાએ જરૂર મારા બળદો સંતાખ્યા હશે, તેમ માની તેને ધણેણ કોધ ચડચો અને પ્રલુના ડાનમાં વૃક્ષના ખીલા ઠોક્યા. આથી પ્રલુને દાઢણ વેદના થઈ, છતાં પ્રલુએ તેના પરજરા પણ રોષ કર્યો નહિ. ધણું દેવોએ તેમને રહાય આપવા માટે કહ્યું. પણ પ્રલુએ કહેલું કે તીર્થકરો કોઈની સહાય દર્શિતા નથી. આવી રીતે પ્રલુએ સાડાભાર વર્ષ અને એક પખવાડીયા સુધી સખ્ત તપ જ્યે ધ્યાન ધર્યું. તેટલી સુદૃતમાં તેમણે માત્ર ઉ૪૬ દિવસ જ આહાર લીધો હતો. એક ઉપવાસથી માંડિને છ છ માસ સુધીના ઉપવાસ કર્યા હતા. એક અલિગ્રહ પાંચ માસ પચીસ દિવસનો થયો હતો. જે ચંદ્રનાળાએ પૂરો કરાવ્યો હતો. આવી વોર તપશ્ચર્યા કરી પ્રલુ મહાવીર વૈશાક શુદ્ધ ૧૦ મે જૂંબક ગામની બહાર આવેકી ઝડ્ઝુવાલિકા નામની નહીના તટ ઉપર કૈવલ્ય જીન, કૈવલ્ય દર્શનને પામ્યા. લારખાદ જગત જીવોના કલ્યાણને માટે ઉપરેશ શરૂ કર્યો. સાધુ, સાધ્વી, આવક અને આવિકા એ ચાર તીર્થની સ્થાપના કરી અને જગતમાં અહિંસા, સત્ય, દયા, પરોપકાર, ક્ષમા, અલઘર્ય, ઔદ્ય એ ઉત્તમ તત્ત્વોનું સ્વરૂપ બતાવી જગતને કલ્યાણને પંથે વાળવાનો રહ્યો. પ્રલુ મહાવીર આ જૈનશાસનના છેલ્લા તીર્થકર થયા. તેમના પરિવારમાં દુર્દ્રભૂતિ (ગૌતમ) પ્રમુખ ૧૪૦૦૦ મુનિ, ચંદ્રનાળા પ્રમુખ ૩૬૦૦૦ સાધ્વી, શંખજી, શતકજી પ્રમુખ ૧૫૬૦૦૦ આવક, સુલસા, રેવતી પ્રમુખ ૩૧૮૦૦૦ આવિકા, ૭૦૦ કૈવળજીની, ૭૦૦ વૈકેયી લઘિધધારી, ૧૩૦૦ અવધિજીની, ૫૦૦ મન:પર્યવજીની, ૩૦૦ ચૌદ પૂર્વધારી વગેરે હતા. તેમણે જૈન ધર્મનો દેશ પરદેશમાં વિજય વાવટો ઇરકાવ્યો અને ૩૦ વર્ષ કૈવલ્ય પ્રવર્ણયોમાં રહી પ્રલુ મહાવીર ૭૨ વર્ષની ઊભરે આરો વદિ ૦)) ને દિવસે શુક્લ ધ્યાનને ભાવતાં નિર્વાણુપદને પામ્યા.

અમણુપણું અંગીકાર કર્યા પછી, મોક્ષ પ્રાપ્તિ થતા સુધીના ૪૨ ચાતુર્ભાસ લ. મહાવીરે નીચેનાં સ્થળોમાં કર્યા હતા. ૧ અસ્થિત્રામે, ૩ પૃષ્ઠચંપામાં, ૧૨ વૈશાલી વાણીય આમભાં, ૧૪ નાલંદા-રાજગૃહમાં, ૬ મિથિલામાં, ૨ લદ્રિકા નગરીમાં, ૧ આલંલિકા નગરીમાં ૧ અન્ય અનિશ્ચિત સ્થાને, ૧ આવરસ્તિમાં ૧ અપાપા નગરીમાં.

છેલ્લું ચાતુર્ભાસ ભગવાને અપાપા નગરીમાં હસ્તિપાળ રાજની શુલ્કશાળામાં કર્યું. તે વખતે પ્રભુએ પોતાનો નિર્વાણ સમય નજીકમાં આવ્યો જાણી સોળ પ્રહર સુધી અસ્થલિત દેશના આપી, જે સાંભળવા અદાર દેશના રાજઓ હાજર હતાં. આ દેશના પરથી ગણુધર દેવોએ દ્વારશાંગી સૂત્રોની રચના કરી હતી.

૧૭૮ મહાશતક.

રાજગૃહ નગરીમાં મહાશતક નામે ગાથાપતિ હતા. તે મહા ઋષિવંત હતા, તેમને રેવતી પ્રમુખ તેર સ્ત્રીએ હતી. એકદા પ્રભુ મહાવીર પધારવાથી મહાશતક વંદન કરવા ગયા. પ્રભુના સહાયથી તે વૈરાગ્ય પામ્યા અને પ્રભુ પાસે બારવત અંગીકાર કરી ધર્મધ્યાન કરવા લાગ્યા. દિવસ અને રાત્રિનો ધર્ણો ભાગ મહાશતક ધર્મધ્યાનમાં વીતાવતા હોવાથી રેવતીને આ ગમતું નહિ, તેમજ અધુરામાં પુરં તેને શોકયોનું પણ પૂરેપૂરં સાલ હતું. તેથી તે મહાશતક સાથે સંપૂર્ણ સુખ ભોગવી શકતી ન હતી. બીજ સ્ત્રીએ પ્રત્યે દિનપ્રતિદિન રેવતીની અદેખાઈ વધતી હતી, તેથી તેણે આ બારે સ્ત્રીએને મારી નાખવાનો, અને તે દરેકની એકેક કોડ સોનામહોરો અને ગોકુલ પોતાને સ્વાધીન કરી લેવાનો સંકલ્પ કર્યો. યોગ્ય વખતે બરાબર તક સાધીને આ રેવતીએ તેની બારે

શોકથોને, એરી પદ્ધતિના પ્રયોગથી મારી નાખી, અને સર્વ લક્ષમી પોતાને સ્વાધીન કરીને તે મહાશતક સાથે સુખ ભોગવવા લાગી.

રેવતી એકલી રહેવાથી અને તેને ખૂબ પૈસો મળવાથી તે છકી ગઈ, એટલું જ નહિ પણ તે સ્વર્ચંદ્રી બનીને દાર, માંસ ધર્માદિની પણ વ્યસની બની ગઈ. એક વાર રાજ શ્રેણિકે રાજગૃહ નગરીમાં દેઢેરો પીઠાવી જહેર કર્યું કે મારા રાજ્યમાં કોઈ એ પચેંદ્રિય જીવાની હિંસા કરવી નહિ. આથી માંસલક્ષી રેવતીને ધણું લાગી આવ્યું. પોતાને માંસ ખાવાનું વ્યસન, તે વગર કાલે જ નહિ. એટલે તે પોતાની ગોશાળા (ગોકુલ)માંથી રોજ બધે ગાયોને કપાવી તેનું માંસ ભક્ષણ કરવા લાગી.

વખત જતાં મહાશતક ગૃહ કારબાર પોતાના પુત્રને સોંપી, નિવૃત્ત બની પૌષ્ઠ્રશાળામાં ધર્મધ્યાન કરવા લાગ્યા. રેવતી એક વખત મહિરાપાન કરીને, વિષયાસકત બની પૌષ્ઠ્રશાળામાં મહાશતક પાસે આવી, અને તેણે પોતાની સાથે ભોગ ભોગવવાનું મહાશતકને આમંત્રણ કર્યું. મહાશતક ધર્મ કાર્યમાં લીન હતા. તેમણે રેવતીને કંઈ પણ ઉત્તર આપ્યો નહિ. રેવતી તો વધારે વિકાલ બનીને વારવાર મહાશતકને ભોગ ભોગવવાનું કહેવા લાગી. છતાં મહાશતક કંઈ પણ એલયા નહિ. અંતે નિરાશ થઈને રેવતી ત્યાંથી ચાલી ગઈ. સમય જતાં મહાશતકે ૧૧ પ્રતિમા ધારણ કરી, તપ કરતાં તેમનું શરીર દુર્ઘણ થયું એટલે મહાશતકે સંથારો કર્યો. આત્માના શુલ્ષ્યાનમાં પ્રવર્તતાં મહાશતકને અવધિજ્ઞાન ઉત્પન્ન થયું.

દૂરી પાછી રેવતી, મહિરામાં ચકચુર બનીને મહાશતક પાસે આવી, અને પોતાની સાથે ભોગ ભોગવવાનું મહાશતકને કહ્યું. મહાશતકે જવાબ ન આપ્યો. તેથી વારવાર તે કહેવા લાગી. આથી મહાશતકને કોધ ચડ્યો, તેમણે રેવતીને કહ્યું, હે માંસલક્ષી રેવતી, આજથી તું સાતમે દિવસે રોગઅરસ્ત થઈને ભરણ પામીશ, અને

પહેલી નરકમાં ચોરાર્દી હજાર વર્ષની સ્થિતિએ ઉપજીશ. આ સાંલળી રેવતી હિન બની ગઈ, અને અયભીત બની કલ્પાંત કરવા લાગી. પરિણામે તે રોગઅસ્ત બની. સાત રાત્રિ થતાં તે મરણ પામી, અને પહેલી નરકે ગઈ.

તે સમયે પ્રલુબ મહાવીર પધાર્યા. ‘મહાશતકે રેવતી પ્રત્યે વાપરેલા અધિત્યિત શખ્ષો આવકને ઓલવા કલ્પે નહિ’ તે વાત મહાશતકને કરવા અને તેનું પ્રાયશ્ક્રિત લેવડાવવા માટે શ્રી ગૌતમને મહાશતક પાસે મોકલ્યા. ગૌતમને દેખી મહાશતકે વંદન કર્યું. શ્રી ગૌતમે અધિત્યિત શખ્ષોનું મહાશતકને પ્રાયશ્ક્રિત કરાવ્યું. મહાશતક પ્રાયશ્ક્રિત લઈ વિશુદ્ધ થયા. અનુક્રમે ધર્મનું યથાયોગ્ય આરાધન કરી, એક માસનો સંથારો ભોગવી મહાશતક કાળ કરીને પહેલા દેવદોકમાં ગયા. ત્યાંથી તેઓ મહાવિહેઠ ક્ષેત્રમાં જન્મ પામી મોક્ષ ગતિને પ્રાપ્ત કરશે.

૧૭૯ મહાસેન કૃષ્ણાકુમારી

તે રાજગૃહિના એણિક રાજની રાણી અને મહાસેન કુમારની ભાતા હતી. પુત્ર મરણના શોકથી કાલો રાણીની માર્ગક તેણે મહાવીરદેવ પાસે ચારિત્ર લીધું; અને વર્ધમાન તપ શરૂ કર્યો. તે એવી રીતે કે:—૧ આયંબિલ, ૧ ઉપવાસ, ૨ આયંબિલ ૧ ઉપવાસ એમ આયંબિલમાં એકેક વધે અને તે ઉપર ૧ ઉપવાસ કરે, એમ ૧૦૦ આયંબિલ એક સાથે કર્યા. બીજે તપ પણ ધર્ણે કર્યો. ચંદનબાળા ગુરુણીને પૂછી તેમણે સંથારો કર્યો; સંથારામાં શિખેલા ૧૧ અંગની સજાય (સ્વાધ્યાય) કરતાં, એક માસના અનશનને અંતે ૧૭ વર્ષ ચારિત્ર પાળી તેઓ મોક્ષમાં ગયા.

૧૮૦ મુનિસુત્રત સ્વામી

વીસમા તીર્થીકર, રાજગૃહ નગરના સુભિત્ર રાજની પદ્માવતી રાણીની કુક્ષિમાં, દશમા પ્રાણુત દેવદોકમાંથી ચ્યવીને શ્રાવણ શુદ્ધ પૂનમે ઉત્પન્ન થયા. ભાતાને ચૌદ સ્વપ્ન આવ્યાં. ગર્ભકાળ પુરો

થયે જ્યેષ્ઠ વદિ અણ્ણમીએ પ્રલુનો જન્મ થયો. ૫૬ કુમારિકા દેવી-ઓએ સૂતિકાડમ્ કર્યું. ઈંગ્રોએ જન્મોત્સવ ઉજવ્યો. ગર્ભસમય દરમ્યાન સુભિત્ર રાણી સારાં વ્રતવાળા થયા હતા, તે પરથી પુત્રનું ‘મુનિસુવત’ એવું નામ પાડ્યું. ઘોવન ગ્રામ થતાં મુનિ સુવતકુમારે પ્રભાવતી આદિ અનેક રાજકન્યાઓ સાથે પાણીયહણ કર્યું. પ્રભાવતીને એક સુવત નામે પુત્ર થયો હતો. સાડા સાત હજાર વર્ષની ઉંમરે મુનિસુવત પિતાની ગાદીએ બેઠા. સાડા સાત હજાર વર્ષ રાજ્ય ભોગવ્યું. તે પછી વરસી દાન આપી તેમણે એક હજાર પુરુષો સાથે દ્રાગણ્ણ શુદ્ધ આઠમે સંયમ યહણ કર્યો. ૧૧ માસ છદ્રસ્થપણામાં રહ્યા પછી પ્રલુને દ્રાગણ્ણ વદિ બારશે કેવલ્યજ્ઞાન થયું.

મુનિસુવત સ્વામીના સંધ પરિવારમાં ૩૦ હજાર સાધુઓ, ૫૦ હજાર સાધ્વીઓ, ૧૭૨ હજાર આવકો અને ૩૫૦ હજાર આવિકાઓ હતા. ૧૫૦૦૦ વર્ષ ચારિત્ર પાળી ૩૦ હજાર વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી એક માસના અનશને, સમેતશિખર પર એક હજાર પુરુષો સાથે પ્રલુને જેઠ વદિ કેના રોજ સિદ્ધ થયા.

૧૮૧ મૃગાપુત્ર. (વૈરાગ્યવંત)

સુશ્રીએ નામનું નગર હતું. લાં બળભદ્ર નામે રાજ હતો. તેની રાણીનું નામ મૃગાવતી. તેને એક પુત્ર થયો. નામ મૃગાપુત્ર. રાજ્યની સમૃદ્ધ સામદ્ધીઓના ઉપભોગથી વૃદ્ધ પામતા મૃગાપુત્ર બાલ્યાવસ્થા વીતાવી યુવાવસ્થાને પામ્યા. લારે તેઓ અનેક રાજકન્યાને પરણ્યા અને તેમની સાથે સુખ ભોગવતા સમય પસાર કરવા લાગ્યા.

મધ્યાનહનો સમય છે, મૃગાપુત્ર જમી પરવારી પોતાના રાજ્ય મહેલની એક અટારીમાં બેસી નગરની ચર્ચા જેઠ રહ્યા છે, આવતાં જતાં મનુષ્યો તરફ નિહાળે છે. તેવામાં ત્યાં આગળથી પસાર થતાં એક મહાન આત્મ યોગી મુનિવર તેમના જેવામાં આવ્યા. મુનિની

ચાલવાની શાંત ગતિ, તેમનો પહેરવેશ, તેમનું ચળકતું લક્ષાઈ જોઈ મૃગપુત્ર તે મુનિના સામે અનિમેષ નેત્રે જોઈજ રહ્યા. પૂર્વ સંસારના બણે મૃગપુત્રને લાગ્યું કે પૂર્વે મેં આવું સ્વરૂપ કયાંક જોયું છે. મુનિ સ્વરૂપના ભાવ ચિંતવતા ચિંતવતા મૃગપુત્રને જાતિસ્મરણ જ્ઞાન થયું. પૂર્વભવમાં પોતે પાળેલું ચારિત્ર યાદ આવ્યું. સંસાર ઉપર તત્કાળ તેમને અર્થિયાધી. અને જન્મ મરણના ફેરાથી મુક્ત થવાનો તેમણે દ્વારા સંકલ્પ કર્યો. તરતજ તેઓ અતપિતા પાસે આવ્યા અને કહ્યું: હે માતા પિતા, મહને પૂર્વ ભવનું સ્મરણ થયું છે. તિર્યંચયોનિમાં જન્મભી મેં ધણા ધણા દુઃખો ભોગન્યાં છે. અને ચારિત્ર પાળવાથી હું મનુષ્યભવ પામ્યો છું; એટલે મહાન પુષ્યના પરિથિતે પ્રાપ્ત થયેલો આ મનુષ્ય ભવ હું સંસારના રાગ, રંગ, મોહ ભાયામાં વેડશી દેવા ભાગતો નથો. હું સંસાર લયથી ત્રાસ પામ્યો છું, માટે મહને દીક્ષા કેવાની રજ આપો. વળી અત્યારે જે સુખ હું ભોગવું છું તે પણ ક્ષણિક અને અસ્થિર છે. આ રાજવૈભવ, બાદશાહી મહેલાતો, અખૂટ ધન, ધાન્યના ડોડારો, બાગ, બગીચાઓ, સોનું, રૂપું, હીરા, માણેક, સ્ત્રી, પુત્ર, ભાઈઓને, એમાંની એક પણ ચીજ સાથે આવવાની નથી. આ શરીર પણ સાથે આવવાનું નથી. માત્ર જીવે કરેલાં પાપ અને પુષ્યજ પરલવે જીવના સાથી છે. વળી જેમ કોઈ ધરમાં આગ લાગી હોય, અને સોનું રૂપું હીરા માણેક કે જે કાંઈ સાર વસ્તુઓ કાઢી કેવામાં આવે છે, તેમ આ સંસારમાં પણ જન્મ, જરા, મૃત્યુનો દાવાનળ સળગી રહ્યો છે. અને હવે સમજયા પણી એક ક્ષણ હું તેમાં આસક્ત રહેવા ધર્ચિછતો નથો. માટે હે માતાપિતા, મને સહર્ષ દીક્ષા કેવાની રજ આપો.

માતાપિતા ઓદ્ધ્યા:—હે પુત્ર, તું સુકોમળ છે, તે હજુ તડકો છાંયડો જેચો નથી. ચારિત્ર પાળવું ધણું દુષ્કર છે. ચારિત્ર એ તરવારની ધાર જેવું છે, કોદાના ચણા ચાવવા અરોઅર છે. એક અગાધ

જળનો સમુદ્ર ભૂલ વડે તરવો દુષ્કર, તેમ સંસારથી સમુદ્ર તરવો ધણો જ કઠિન. છે. સંયમ માર્ગમાં આવતાં ઉપસર્ગો, પરિષહો એ લયાનક છે. ગરમ પાણી પીવું, જમીનપર સ્થાઈ રહેવું, તાપમાં ઉધાડા પગે ક્રવું, ટાઢમાં પૂરતાં વસ્તો ન મળે, માથે કેશનો લોચ કરવો, છકાય જીવની દ્યા પાળવી, સત્ય બોલવું, રણ વગર એક સળી સરખી પણ ન લેવાય, આ યૌવનકાળમાં અલ્લાચ્યર્ય પાળવું, સર્વ પરિથિત, માયા, ભમતા, મોહનો ત્યાગ કરવો, કૃધા, તૃપા, ટાદ, તાપ ડાંસ, મચ્છર, સર્પ આદિના પરિસહો તહારાથી સહન નહિથિએ શકે; માટે હે પુત્ર, દીક્ષા લેવાનું મુલતવી રાખી આ વિપુલ લોગ સાધનો ભળ્યાં છે, તેને સુખપૂર્વક ભોગવો, અને વૃદ્ધાવસ્થા પામતા ખુશીથી સંયમ માર્ગને અછણું કરજો. મૃગાપુને જવાબ આપ્યો. હે માતાપિતા, મળેલી સર્વ સામગ્રીનો ત્યાગ કરવો તેમાંજ ખરી વીરતા-ત્યાગ ભાવના રહેલી છે. વળી મનુષ્યથી અનંતગણી રિદ્ધિ દેવગતિમાં આ જીવે અનેકવાર મેળવો છે. તેનાથી પણ આ જીવ ધરાયો નથી તો આ ક્ષણિક રિદ્ધિ, ભોગ ઉપસોગોથી શું ધરાવાનો હતો? જેના હૃદયકાટો, જીનચક્ષુઓ ખુલ્લી ગયાં છે, જે દદ છે, નિરપૃહિ છે તેને જગતમાં કંઈ પણ મુશ્કેલ હોતું નથી; માત્ર આત્મભળની દિવ્ય નયોત્ત પ્રકાશતાં બધી મુશ્કેલીઓ, ઉપસર્ગોનો અંત આવી જય છે. વળી હે માતા, આ જીવે કર્યાં હુઃખ સહન નથી કર્યું? નારકી તિર્યચ અને મનુષ્ય ગતિના અનંત હુઃખો આ જીવે અનંતવાર ભોગન્યા છે. નર્કની ધગધગતી કુંભીમાં અનંતવાર પહ્યો છું, વાળુકા નદીની અગ્રિ જેવી ધગધગતી રેતીમાં મને અનંતીવાર બાળ્યો છે, ઝાડ ઉપર ઉધે ભરતકે બાંધી ખરમાધામીઓએ મને કરવત વડે કાખ્યો છે. કાંટાવાળા શાલ્મલી વૃક્ષ સાથે બંધાઈ ધણી વેદના મેં ભોગવી છે. શેરરીની માર્ક મને ધાણીમાં પીલ્યો છે, તરવાર, ભાલા ક્રસી વડે ભારા રાઈ રાઈ જેવડા દુકડા કર્યા છે. એ વખતે ભારો આકંદ, મહારો વિલાપ ઝોણું સાંલળે માતા? ગાડા સાથે જેતરાધને, હળ સાથે ધસડાધને, પાણીને

અદ્ધે ધગધગતા ત્રાંભા સીસાના રસ પીને, આહારને અદ્ધે મહારા શરીરનું ભાંસ ખાઈને, મેં અનંતી વેદના લોગવી છે. એ અપાર હુઃખનું વર્ણન શું કરું ભાતા? મહારા આત્માનું તમે લલું ધર્યાયતા હો, મહને એવા હુઃખોમાંથી બચાવવા માગતા હો, તો હે માતાપિતા, મહને આનંદપૂર્વક દીક્ષિત થવા ધો.

મૃગાપુત્રનો અપૂર્વ વૈરાગ્ય, તેના અંતરની સંસારભયની ઉદ્વેગતા, તેના ચારિત્રની હિંમત એ વગેરેથી તેના ભાતા પિતા ખુશ થયા અને દીક્ષાની રજ આપી.

મૃગાપુત્ર દીક્ષિત થયા, સર્વ સુખ વૈભવોનો તેમણે ત્યાગ કર્યો અને આત્મ ધ્યાનમાં વિચરવા લાગ્યા. ઉથ તપશ્ચર્યા, અખંડ સંયમ સાધના, વિશુદ્ધ કિયાઓ વડે જીવનનું શ્રેય સાધતાં સાધતાં, ક્ષપક શ્રેણિમાં પ્રવેશી મૃગાપુત્ર કૈવલ્યજીન, કૈવલ્ય દર્શનને પામ્યા અને લોકાંશે સિદ્ધ થયા.

૧૮૨ મૃગલોઠીઓ (મૃગાપુત્ર ૨)

જંબુદ્રીપના ભરતક્ષેત્રમાં શતદ્વાર નામની નગરી હતી. તે નગરીને સો દરવાજ હતા. તેમાં ધનપતિ નામે રાજ રાજ્ય કરતો હતો. તે નગરના અભિ ઘૂણામાં વિજ્ય વર્ધમાન નામનું ગામ હતું. તે ગામમાં એકાઈ રાડોડ નામે હાકોર હતો. તેના નીચે બીજા પાંચસો ગામ હતા. એકાઈ રાડોડ ધણો કૂર, જુદ્ધમી અને અધર્મી હતો. તે પાપ કે પુણ્યને ગણુંતો જ નહિ. તે રૈયતને નીચોવી, અન્યાયથી કર ઉધરાની પૈસા એકઠા કરવાનું જ માત્ર શીખ્યો.

હતો, એટલું જ નહિ પણ ગામમાં ચોરીઓ કરાવી, રસ્તે જતાં લોડોને લુંઠી, પોતાની તિજોરીમાં ધન ભેગું કરતો. પ્રજા તેનાથી ત્રાસ ત્રાસ પોકારી રહી હતી. છતાં તે એપરવાહ બનીને પ્રજાને નિર્ધન બનાવી, દુઃખી કરતો અને પોતે સ્વચ્છદ્વષે મોજ શોખ કરી દિવસો વીતાવતો હતો. એકવાર આ એકાઈ રાડોડના શરીરમાં સોળ પ્રકારના મહા રોગ ઉત્પન્ન થયા, રાડોડ દુઃખી પીડાવા લાગ્યો. ગામમાં દોઢેરો પીડાવી ધણા વૈદ દાક્તરને ઉપયાર અર્થે તેણે તેડાવ્યા, પરંતુ તેનો એક પણ રોગ મટયો. નહિ. મહાવેદના પામી, અઠીસો વર્ષનું આયુષ્ય લોગવી તે પાપકર્મના ઉદ્યથી ભરણ પામીને રતનપ્રભા નામે પહેલી નરકમાં ગયો.

લાંથી નીકળીને, તે મૃગાગામ નામના નગરમાં વિજ્યક્ષત્રિય રાજની મૃગાવતી રાણીની કુલ્ભિમાં પુત્રપણે ઉત્પન્ન થયો. ઉત્પન્ન થતાં જ મૃગાવતી રાણીના શરીરમાં અતુલ વેદના થઈ. જે દિવસે મૃગાવતીના શરીરમાં આ ગર્ભ આવ્યો, તેજ દિવસથી વિજ્યક્ષત્રિય રાજની પ્રીતિ મૃગાવતી ઉપરથી ઓછી થઈ. મૃગાવતીએ વિચાર કર્યો કે રાજ ભારાપર પહેલાં ધણી જ પ્રીતિ રાખતા. પરંતુ જ્યારથી આ ગર્ભ પેદમાં આવ્યો છે, લારથી રાજની ભારા પર અપ્રીતિ થઈ છે, ભાટે આ ગર્ભને ઔષધ વગેરેથી પાડી નાખવો, એમ ધારી તે ગર્ભપાતને ભાટે ધણા ઉપયારો કરવા લાગી, છતાં ગર્ભપતન થયું નહિ, તેથી તે ઉદાસીન ભાવે રક્ષણ કરવા લાગી.

તે બાળકને ગર્ભાવસ્થામાંથી ભર્તમાંથી નામનો રોગ થયો હતો. તેથી બાળક જે વસ્તુનો આહાર કરે તે વસ્તુ તત્કાળ વિધ્વંસ થઈને રક્ત (દોઢી) થઈ જય. નવ માસ પૂર્ણ થતાં મૃગાવતીએ તે પુત્રને જન્મ આપ્યો. નામ મૃગપુત્ર. જન્મતાંજ તે આંધળો, ડોડો, સુંગો, અંગોપાંગ રહિત, માત્ર દ્વિદ્યોના આકાર રૂપે હતો. આવું ભયંકર બાળક જોઈને મૃગાવતીએ લયલીત બની, ત્રાસ પામીને તેને ઉકરડામાં ઝેંકો હેવાનો વિચાર કર્યો.

રાજને વાત જણ્યાવી. પ્રથમનો જ આ પુત્ર હોવાથી તેને મારવાથી બીજ ખાળકો નહિ જવે, એમ રાજએ અલિગ્રાય આપવાથી પતિની આજા માની રાણી તેનું રક્ષણ કરવા લાગી.

મૃગાવતીએ તે ખાળકને એક લોંયરામાં રાખ્યું, અને રોજ તેને આહાર આપવા લાગી. ખાળક આહાર કરે કે તરત જ તે લોહી થઈ જય, અને ક્રી તે ક્રોણનો ખાળક આહાર કરે. આવી દુર્ગધમય નર્ક સમાન સ્થિતિ ભોગવતો આ કુમાર દિવસો વ્યતીત કરતો હતો.

એકદા પ્રસ્તાવે શ્રમણ ભગવંત શ્રી ભણવીર પ્રભુ મૃગા ગામના ચંદ્નપાદપ નામના ઉદ્ઘાનમાં પદ્ધાર્યો. વિજયરાજ અને પરિષદ વંદન કરવા આવી. તે વખતે તે ગામમાં રહેતો એક જન્માંધ લીખારી, જેના ખેંચપર પુષ્કળ માંખીયો બણુબણુટી હતી તે પોતાની સાથેના એક દેખતા માણુસની સહાયથી પ્રભુની સભામાં આવ્યો. પ્રભુએ બધાને ધર્મહેશના આપી. સૌ વંદન કરી પોતપોતાના સ્થાનકે ગયાં.

તે સમયે પ્રભુના પછું શિષ્ય શ્રી ગૌતમસ્વામી પેલા અંધ માણુસને દેખી ઉત્પન્ન થયેલા વિચારેનો નિર્ણય કરવા પ્રભુ પાસે આવ્યા. તેમણે વિનયપૂર્વક પૂછ્યું. હે પ્રભુ, બીજ કોઈ સ્વીએ પેલા જન્માંધ માણુસની જેમ બીજ ઝોડી એવા ખાળકને જન્મ આવ્યો છે? પ્રભુએ કહ્યું. હા, દેવાનુપ્રિય. આ ગામમાં વિજયક્ષત્રિય રાજને ત્યાં મૃગાવતી રાણીને એક પુત્ર અવતર્યો છે. જે જન્મથી અંધળો, જહેરા, મુંગો, લુકો છે, જે પોતાના શરીરનાં માંસ કોહી ઈલાદિનો વારંવાર આહાર કરે છે. વળી તેને એક ગુમ લોંયરામાં રાખવામાં આવ્યો છે. ગૌતમસ્વામીને આ કથન સંભળવાથી તેને જેવાનો વિચાર થયો અને પ્રભુની આજા મેળવી તેઓ મૃગાવતીને ત્યાં ગયા.

શ્રી ગૌતમસ્વામીને દેખી મૃગાવતી આનંદ પામી. એમ પૂર્વક
નમસ્કાર કરી આગમનતું કારણ પૂછ્યું. શ્રી ગૌતમે મૃગાવતીના પુત્રને
જોવાની દુર્ઘટા જણાવી. મૃગાવતીએ પોતાના બીજ ચાર પુત્રોને
તેમની પાસે લાવી બતાવ્યા. ગૌતમે કહ્યું:—આ પુત્રો નહિ, પરંતુ
તમે જે ગુમ લોંધરામાં રાખ્યો છે, તેને જોવાની મહારી દુર્ઘટા છે.
મૃગાવતી આશ્ર્ય પામી. વાત ક્યાંથી જણ્ણો, તે પૂછ્યું. ગૌતમે
જવાબ આપ્યો:—મહારા ધર્માચાર્ય ત્રિકાળજાની શ્રી મહાવીર પ્રભુના
કહેવાથી. મૃગાવતીએ બતાવવા કહ્યું અને પોતાની પાછળ પાછળ
વસ્ત્ર આડું રાખીને આવવા જણાયું. મૃગાવતી એક નહાતી ગાડી
લઈ તેમાં ભાવાની વસ્તુઓ મૂકી ખેંચતી ખેંચતી લોંધરામાં દાખલ
થએ. ગૌતમસ્વામી પણ તેની પાછળ પાછળ ચાલ્યા અને તેઓ બાળક
પાસે આવ્યાં. બાળકની ર્થીતિ જોતાં જ ગૌતમસ્વામી ચમક્યા
અને કર્મના અચળ સિદ્ધાંત પર વિચાર કરવા લાગ્યા. પૂર્વભવમાં
આ મૃગાપુત્રે મહાન પાપ કર્મ ઉપરાન્યું હશે જેના વડે આ નારકી
જેવું હુઃખ લોગવે છે. ત્યાર બાદ ગૌતમસ્વામી ત્યાંથી પ્રભુ પાસે
ગયા. સર્વ વાત વિહિત કરી. મૃગાપુત્રનો પૂર્વભવ પૂછ્યો. પ્રભુ
મહાવીરે તેનો પૂર્વભવ (શરૂઆતની વાર્તામાં કહ્યો તે) કહી
સંભળાયો. ત્યાર પછીની ર્થીતિ શ્રી ગૌતમે પૂછ્યી. શ્રી પ્રભુએ
ઉત્તર આપ્યો:—હે ગૌતમ, મૃગાપુત્ર ૨૬ વર્ષનું આયુષ્ય લોગવી
સિંહ થશે, ત્યાંથી પહેલી નરકે જશે. ત્યાંથી ચ્યાવી તે ધો (નોળાયો)
થશે. ત્યાંથી બીજ નરકમાં જશે, ત્યાંથી પક્ષી થશે, ત્યાંથી ત્રીજ
નરકમાં જશે, એમ સાત નરક સુધી જશે. એમ અનંત સંસાર
પરિભ્રમણ કરતાં કરતાં મનુષ્ય જન્મમાં આવીને દીક્ષા કેશે અને
પહેલા દેવલોકમાં જશે. ત્યાંથી ચ્યાવી આખરે મહાવિદેશ ક્ષેત્રમાં
જ મોક્ષગતિને પામશે.

૧૮૩ ભૂગાવતી.

તે વિશાળા નગરીના ચેટક રાજની પુત્રી હતી. તેને કૌશાંભી નગરીના રાજ શતાનિક સાથે પરણાવી હતી. સતીઓની પ્રશસ્તિમાં તેમનું નામ મુખ્ય છે. એકવાર કોઈ એક ચિત્રકારે ભૂગાવતીના સુરોલિત દેહનું સ્વરૂપ ચીતરીને ઉજાજિનીના રાજ ચંડપ્રદોતને અતાવ્યું, આથી કામમાં હમેશાં અંધ છે એવા ઉજાજિની પતિએ કૌશાંભી ઉપર ચડાઈ કરી, તે વખતે શતાનિક રાજ ભયનો માર્યો અતિસાર રોગથી મૃત્યુ પામ્યો. ભૂગાવતીએ સમયસ્થુકતા વાપરી ચંડપ્રદોતને કહેવરાવ્યું કે હું તમારી સાથે જરૂર લખ્ય કરીશ. કારણ કે ઉજાજિની જેવી મહાનગરીની હું પદ્ધરાણી અનું એવો અપૂર્વ લાલ કોણું ચૂભાવે? પરન્તુ મારે બાળપુત્ર નહાનો છે, જેથી તેને મારે કૌશાંભીનો કિલ્બો મજબૂત બનાવો, તેમજ ધન, ધાન્ય તથા હથિયારોથી શહેરને સમૃદ્ધ કરો, કે જેથી મારા પુત્રને ડેઈ દુઃખનો હરાવી ન શકે. પ્રદોત રાજ ભૂગાવતીના આ પ્રપંચમાં લોલાયો; અને શહેર બહારથી બધી તૈયારીએ કરવા લાગ્યો. તે વખતે ભૂગાવતીએ નગરીના દ્વાર બંધ કરાવી દીધા. ચંડપ્રદોત પોતે છેતરાયો છે, એમ સમજ તે કૌશાંભીને ધેરો ધાલી પડ્યો.

આ સ્થિતિમાં ભૂગાવતીએ હવે શું કરવું તેનો નિર્ણય કર્યો. ભૂગથી જ તે સંસ્કારી અને ધર્મિષ્ટ હોવાથી તેનામાં વેરાગ્ય ભાવનાના આંદોલનો ખડ થયા. તેણોએ લ. મહાવીર પાસે દીક્ષા લેવાનો નિર્ણય કર્યો. એજ અરસામાં પ્રલુ મહાવીર ગ્રામાનુગ્રામ વિહાર કરતાં કૌશાંભીના ઉદ્ઘાનમાં આવી સમોસર્યા. વાયુવેગે પ્રલુ પધાર્યાની વાત શહેરમાં પ્રસરી ગઈ. આ વાત જણી ભૂગાવતીને અનહંદ આનંદ થયો. તેણે નગરીના દ્વાર તરત જ ઉદ્ઘાની નાખ્યા અને તે પ્રલુ મહાવીરના દર્શને નીકળી. બીજી તરફ ચંડપ્રદોત પણ પ્રલુની દેશનામાં આવ્યો. લ. મહાવીરની અમૃત સરખી

देशना सांखणी तभाव ज्ञवो पोता तुं वैर भूली गया; ते मुज्रम् यंडप्रधोतनो विकार अने मृगावती परनो कोध शांत थઈ गयो। देशना सांखणी मृगावतीअे प्रक्षुने कहुः—नाथ, आपनी वाणी अरेखर पतितोनो उद्धार करनारी छे। प्रक्षु ! हुं आपनी पासे संथम लेवा धृच्छुं छुं, तो राज्य यंडप्रधोतती आज्ञा लઈने हुं दीक्षित अनीश। तरतज मृगावती यंडप्रधोत् पासे आवी अने ऐकीः—राजन्, तहमे भारा पिता तूल्य छो, हुं दीक्षित थवा धृच्छुं छुं। अने आ उदायनकुभारने तमने सोंपुं छुं। आज्ञा आपो तो दीक्षा लउं। गमे तेवा विकारी अने पापी भनुष्यो सतीना शियणना प्रकाश आगण शांत अनी जय छे ते मुज्रम् यंडप्रधोत् शांत अने निर्विकारी अन्योः तेणु कहुः पुत्री, भुशाथी तहमे दीक्षा लઈ नैन भार्ग दिपावो। हुं तभारा पुत्रनुं रक्षणु करीश। आ प्रभाणु आज्ञा भणवाथी मृगावतीअे दीक्षा लीधी। मृगावती यंडनभाणा साध्वीनी शिष्या अनी। उदायनने कौशांखीना राज्यासने स्थापी यंडप्रधोत् पोताना वतनभां गयो।

ऐक वर्षत यंद्र अने सूर्यहेव विभानभां ऐसी प्रक्षुने वांटवा आव्या हता। ते वर्षते यंडनभाणा पणु मृगावती साथे प्रक्षुवंडनार्थे आव्या हता। पोताने उडवानो सभय जाणी यंडनभाणा पोताना उपाश्रये गया। पणु मृगावती हजु दिवस छे ऐम धारी त्यांज ऐसी रक्षा। यंद्रसूर्य लांथी विदाय थया के तरतज रात्री पडी, आथी लय पामी मृगावती शीघ्र उपाश्रये आव्या। ते वर्षते यंडनभाणाअे मृगावतीने कहुँ के तभारा नेवी कुलिन सन्नारीने राने ऐकलां व्याहार रहेवुं ए शुं चोऽय छे ? मृगावतीने पोतानी भूलनो पश्चात्ताप थयो। तेणु यंडनभाणानी क्षमा भागी; छतां पोतानी भूलनो डाघ हृदयभांथी खस्यो नहि। मृगावती वधु पश्चात्ताप करतां शुक्ल भावनाअे यउचां अने धाती कर्मनो क्षय थतां ज तेमने

કૈવલ્યજ્ઞાન થયું. આ વખતે ચંદ્રનભાગાની પથારી પાસેથી સપ્ત જતો હતો, તે મૃગાવતીએ પોતાનાં દિવ્ય જ્ઞાન વડે જોયો, તેથી તેમણે ચંદ્રનભાગાનો હાથ ઉંચો કર્યો. આથી ચંદ્રનભાગાએ જગૃત થઈ તેમ કરવાનું કારણ પૂછ્યું: મૃગાવતીએ કહ્યું. આપની પથારી પાસે સર્વ હતો. ચંદ્રનભાગા બોલ્યા: ત્હમે આ અંધારી રાતે કેમ જણ્યું? મૃગાવતીએ વિવેકપૂર્વક જવાબ આપ્યો. મહાસતીજી, મહને આપના પ્રતાપે કૈવળજ્ઞાન થયું છે. આ સાંભળી ચંદ્રનભાગા ચમક્યા અને વિચારવા લાગ્યા કે અહો, મેં કૈવળીની આશાતના કરી. એમ ચિંતવતાં ચંદ્રનભાગાને પણ કૈવલ્યજ્ઞાન થયું. કેટલોક સમય કૈવલ્ય પ્રવર્ણિંભાં ગાળી મૃગાવતી મોક્ષમાં ગયા.

૧૮૪ મેધકુમાર.

સૌંદર્યસમી રાજગૃહી નગરીનો મહારાજ ઐણિક એક દિવસે સવારમાં પોતાના રાજ્યભૂવનમાં સિંહાસન પર અલંત શોક સાગરમાં એડો હતો. તેની મુખમુદ્રા નિરસેજ જણ્યાતી હતી. અને તે કોઈ મહાન કાર્ય પૂર્ણ કરવાના મનોરથેમાં મન હતો. તે સમયે અભય-કુમાર નામનો મહાભુદ્ધિશાળી મંત્રી અને સુપુત્ર નિત્યનિયમ પ્રમાણે પિતાશ્રીના પાયવંદન કરવા આવ્યો. શોકમાં ગરકાવ થયેલા મહારાજએ કુમારનો સતકાર ન કર્યો. બુદ્ધિવાન કુમારે પિતાશ્રીની શોકજન્ય દશા નિહાળી અતિ નભ્રતાથી ઉદ્દાસીનતાનું કારણ પૂછ્યું અને પોતાની અલઘતિ અનુસાર છિં કાર્ય સિદ્ધ કરવાનું વચન આપ્યું. મહારાજ ઐણિકે સર્વ વાત નિવેદન કરી.

તે ચિંતા શાની હતી? અભયકુમારની નાની ભાતા ધારિણી દ્વીપને ગર્ભાવસ્થામાં અકાળે મેધ વરસતો જોવાની ઉત્કટ ધર્યા થઈ હતો, અને તે ધર્યા પૂર્ણ કરવા ચિંતાતુર હતી. અહિનીશ આત્મધ્યાન ધ્યાતી, દિવસે દિવસે તે ક્ષીણું થતી જતી હતી. આ વાતની

દાસી દ્વારા રાજ શ્રેણિકને ખખર પડી. રાજ શ્રેણિક દોહદ + પૂર્ણ
કરવાનું ધારિણી રાણીને વચ્ચન આપીને પોતાના આવાસમાં ચિંતામન્મ
થેડો હતો. પિતાને આશ્વાસન આપ્યા બાદ અલયકુમાર વિચારમાં
પડ્યો. દેવતાની સહાય વગર માનવજલિની ભગ્નૂર નથી કે આકાશે
મેઘ પૃથ્વી ઉપર વરસાવી શકે. અલયકુમારે પોતાના પૂર્વ પરિયય-
વાળા પહેલા દેવલોકના સુધર્મ નામના દેવનું સ્મરણું કરવા પૌષ્ઠ
શાળામાં જઈ અહુમ લક્ષ્ણ પૌષ્ઠ કર્યો. તપના પ્રલાવથી દેવનું
આસન ચલિત થયું. દેવ આવ્યો અને પોતાને ભોલાવવાનું કારણ
પૂછ્યું. અલયકુમારે સર્વવાત નિવેદન કરી. વચ્ચન આપી દેવ ગયો
અને ધારિણી દેવીની ઈચ્છા મુજબ અકાશે મેઘની વૃષ્ટિ થઈ. ધારિણી
રાણી શ્રેણિક રાજ સાથે નગર-ઉદ્ઘાન વગેરે સ્થળે દરી, અને
વરસાદથી ઉગેલી વનરસ્પતિ વગેરેનું અનુપમ સૌંદર્ય નિહાળી સંતોષ
પામી. દોહદ પૂર્ણ થયો અને તે આનંદથી ગર્ભનું રક્ષણું કરવા લાગી.
સવા નવ માસે પુત્રનો જન્મ થયો. રાજ્યમાં સર્વત્ર આનંદ છવાઈ
રહ્યો. ગર્ભમાં મેઘનો દોહદ ઉત્પત્ત થયો હતો, તેથી તેનું નામ
'મેઘકુમાર' પાડવામાં આવ્યું. પાંચ ધાવમાતાએ અને અનેક
દાસીઓના લાલનપાલન વડે કુમાર વધવા લાગ્યા. નવ વર્ષ કળાચાર્ય
પાસે ભણવા મૂક્યા અને ૭૨ કળામાં પ્રવીણ થયા. અનુક્રમે
યૈવનાવસ્થા પામ્યા, લારે તેમને અલંત સૌંદર્યવાન, યૈવનરસ ભરપુર
એવી આડ સ્વીઓ પરણાવવામાં આવી. એક દેદિઘ્યમાન, સુશોલિત
રાજ્યકુલવનમાં કુમાર તે સૌંદર્યમુંધા રમણિઓના વિલાસમાં આનંદ
ઉપભોગ કરવા લાગ્યા.

એકદા પ્રસ્તાવે શ્રમણ ભગવંત શ્રી મહાવીર પ્રભુ આમાનુગ્રામ
વિહાર કરતા રાજગૃહી નગરીના ઉદ્ઘાનમાં પધાર્યા. નગરજનોના
ટોળોણાં પ્રભુમહાવીરના દર્શન કરવાને હર્ષાતુર વદને ઉદ્ઘાન તરફ

+ ડહોણા, ઈચ્છા.

જવા લાગ્યાં. સુખ વૈભવમાં મનુ રહેલા મેધકુમારે રાજ્યભુવનની અટારીમાંથી આ દશ્ય જોયું. અનુચરોને પૂછતાં જલણું કે ગ્રલુ મહાવીરના દર્શન કરવા માનવ મેદની જય છે. મેધકુમાર હર્ષ પાખ્યા. સતતર સ્નાન કરી વસ્ત્રાભુષણો પહેરી, સમુદ્દરય સહિત ગ્રલુના દર્શન કરવા નીકળ્યા. ઉદ્ઘાનમાં જઈ, એ ચરમતીર્થકર શ્રી મહાવીર ગ્રલુને ત્રણવાર પ્રદક્ષિણા દઈ મેધકુમારે સાવયુક્ત વંદન કર્યું. શ્રી જગતાયક દેવે શ્રુત, ચારિત્ર, ધર્મની દેશના આપો. મિથ્યાત્વ, અવૃત્ત, કૃપાયથી જવ બંધાય છે અને જ્ઞાન ચારિત્રની વિશુદ્ધ કિયાઓથી જવ મુક્ત દર્શાને પામે છે, એવા ગ્રલુના અપૂર્વ ઉપદેશથી પરિષ્ઠ રંજિત થઈ સ્વસ્થાનકે ગઈ. મેધકુમાર ગ્રલુની અદ્ભુત વાળી સાંલળી અત્યંત હર્ષ પાખ્યા, અને નમસ્કાર કરી ગ્રલુ ગ્રત્યે એ હાથ જોડી ઓલ્યા:-હે ગ્રલુ, મને નિર્જિથના પ્રવચનની શ્રદ્ધા થઈ છે. તે ગ્રત્યે સંપૂર્ણ રૂચિ થઈ છે. કિંતુ હે નાથ, મારા માતાપિતાનો આજ્ઞા લઈને હું આપની પાસે દીક્ષિત થઈશ. એટલું કહી મેધકુમાર ઉદ્ઘાન, ગ્રલુને વંદન કર્યું અને પરિવાર સહિત સ્વસ્થાનકે ગયા.

ત્યાંથી મેધકુમાર સતતર માતાપિતા પાસે આવ્યા, અને સર્વ વાત નિવેદન કરી. દીક્ષા લેવાની વાત સાંલળતાં ધારિણોહેવીને પારાવાર હુંઘ થયું. ગાત્રો શિથિલ થવા લાગ્યાં, શરીર કંપવા લાગ્યું, અને પુત્ર વિયોગ થશે એવા હુઃઐતપાદક વિચારોમાં એકદમ મૂર્છિત થઈને જમીન પર તે ઢળી પડી. દાસદાસીઓ એકદ્દાં થઈ શિતળ જળ છાંટી ઉપચાર કરવા લાગ્યાં. કેટલીક વારે તે સાવધ થઈને આકંદ અને વિલાપ કરતી મેધકુમાર ગ્રત્યે કહેવા લાગી. ‘પ્રાણુથી પણ અધિક પ્રિય હે પુત્ર, તહારો ક્ષણુ માત્ર વિયોગ મારાથી સહન નહિ થઈ શકે, જ્યાં સુધી મારા દેહમાં પ્રાણ છે, ત્યાં સુધી તમે આ મનુષ્ય સંબંધીના કામ લોગ સુખે સુખે લોગવો. આ વિપુલ રાજ્ય લક્ષ્મી, અનુપમ સૈંદર્યવાન લલનાઓના ઉપલોગમાં અમૃત્ય માનવ

દેહનું સાર્થક કરો, અને ખડગની ધાર સમાન કટિન સંયમ
માર્ગ ગ્રહણ કરવાના વિચારો છોડી દો.'

મેઘકુમારે કહ્યું:-માતા, આ ક્ષણભંગુર મનુષ્ય દેહનો વિશ્વાસ
શો ? વિદ્યુતના ચમકારસમું; પાણીના પરપોટા જેવું, અને સંધ્યાના
રંગ સરખું આ આયુષ્ય અસ્થિર છે, ક્ષણિક છે, અને આગળ કે
પાછળ જરૂર આ નાશવંત શરીરને છોડચા વગર દૂષ્ટકો નથી જ.
તો પછી અત્યારે જ એ સર્વ મોહ અને મમતા કેમ ન તજવાં ?
વળી મનુષ્યનું શરીર ભાત્ર હુર્ગધનું જ લાજન છે, તેમાં ભળ, મૂત્ર,
શ્વેષમ અને ઇધિરનો પાર નથી. માટે તે લક્ષનાઓનાં અશ્વચિ કામ
ભોગોને તિલાંજલી આપવી, અને અનર્થનું મૂળ જેવી લક્ષ્મીનો
સાગ કરવો એમાંજ ખરી વીરતા રહેલી છે. યમૃતના દરખારમાં
જતી વખતે તેમાંનું કશુંચે સાથે આવવાનું નથી; માટે એ કનક અને
કાંતાનો ત્યાગ કરી અપૂર્વ સંયમ માર્ગમાં પ્રવૃત્ત થવાની મારી પરમ
જ્ઞાસા છે. માટે હે માતા ! મને સહર્ષ દિક્ષા લેવાની રણ આપો.
અનેક પ્રકારની આશાઓ અને લાલચો આપવા છતાં, મેઘકુમારને
તેના વિચારોમાંથી એક ડગ પણ હદાવવા તેના માતાપિતા સમર્થ
ન થયાં. તેથી માતાપિતાએ દીક્ષાની પરવાનગી આપો. પરંતુ પોતાના
સંતોષને માટે એક દિવસનું રાજ્ય ભોગવવાની સરત, મેઘકુમારે
કશુલ કરી. કૌરુંબિક પુરુષોને બોલાવી મેઘકુમારને રાજ્યાલિષેક કર્યો.
અનેક સૂવર્ણનું દાન કરી, એક દિવસનું રાજ્ય ભોગવી, સર્વ
વસ્ત્રાલંકારો ઉતારી મેઘકુમારે પંચમુહિ લોચ કર્યો. એક પાલખીમાં
એસી રાજગૃહમાંથી નીકળી ગુણશિલ ઉદ્ઘાનમાં પ્રભુ મહાવીર પાસે તે
આવ્યા અને રાજ ઐણિક તથા ધારિણી દેવીએ પ્રભુ મહાવીરને પુત્ર
લિક્ષા અર્પણ કરો. પ્રભુએ મેઘકુમારને દીક્ષિત બનાવી પોતાની
પાસે શિષ્ય તરીકે રાખ્યા.

મેઘકુમારે સંજાય ધ્યાનમાં દિવસ પસાર કર્યો. રાત્રી થઈ અને
નિયમ મુજબ તેમને સ્વાવાની પથારી સર્વ મોટા સાધુઓથી છેક્ષી,
અને જવા આવવાના દ્વાર પાસેજ કરવામાં આવી. રાત્રિના વખતમાં

અનેક મુનિઓ વારંવાર લધુનીતિ વગેરેના કાર્ય નિમિતે જતાં આવતાં દાર પાસે સ્ફુરેલા તે નવદીક્ષિત મુનિના શરોરની અરાખર વૈયાવચ્ચ થવા લાગી. એટલે જતાં આવતાં બંને વખત મુનિઓના પગનો સ્પર્શ મેઘકુમારને થતો. તેથી મેઘકુમારને બહુ હુઃખ થતું. નિરાંતે ઉંધી શકાય નહિ, ઉંધ આવવા લાગે કે તરત એકાદ મુનિના પગ મેઘકુમારના પગ સાથે અથડાયજ; તેથી તેમણે આખી રાત્રી ઉંધ વિના હુઃખમાં જ પસાર કરી. પરિણામે અશુભ વિચારોએ તેમના હૃદયમાં સ્થાન લીધું. મેઘકુમારથી આ પરિષિહ સહન ન થયો. તેમને ગૃહસ્થાવાસના સુખ સાંભળ્યા, અને કંઈન સાધુઆર્ગથી નિવૃત્ત થવાની આકંક્ષા ઉત્પત્ત થઈ.

પ્રભાતે તેઓ પ્રલુ ભહાવીરને વંદન કરવા આવ્યા. તત્કષણ તે સર્વજ્ઞ પ્રલુએ મેઘકુમારે રાત્રિમાં કરેલાં અશુભ વિચારો કહી દીધાં. મેઘકુમારે તે કંબુલ કર્યું. પ્રલુ ભહાવીરે તેનો પૂર્વ ભવ વર્ણિતતાં કહ્યું, હે મેઘકુમાર, તું પૂર્વભવમાં એક સર્વોપરિ હાથી હતો. અનેક હાથી અને હાથણી-ઓના સમૂહ વર્ચ્યે તું અભિમાન સહિત વસતો હતો. ગ્રીઝ રહુનો સમય હતો. એક વખત વનમાં દાવાનળ સળગ્યો. હાથી, હાથ-ણીઓ અને અનેક પણ પંખીઓ ભયભાંત થઈને આભતેમ નાસવા લાગ્યાં. તહારા ત્રીજા ભવમાં પણ આવીજ સ્થિતિ થયેલી હોવાથી તે તને યાદ આવી, અને તહારી વિશુદ્ધ કેસ્યાના શુભ પરિણામથી તને જતિ સ્મરણ જ્ઞાન થયું. લારાદ લાંથી નાસીને એક જગ્યામાં આસપાસના તમામ વૃક્ષો તેં મૂળમાંથી ઉઘેડી નાખ્યાં અને જાડ પાન વગરનું એક મેદાન તેં બનાવ્યું કે જ્યાં અભિ ગ્રસરી શકે નહિ. લાં તે મેદાનમાં તું નિર્ભય રીતે રહ્યો. તે મેદાનમાં હાથી, સિંહ, વાઘ, શિયાળ વગેરે અનેક પ્રાણીઓએ આશ્રય લીધો. તે વખતે હે મેઘ, તાંડ શરીર ખણુવા માટે તેં એક પગ ઉપાડ્યો. અનેક પ્રાણીઓની ગીયોગીયમાં અને જગ્યા માટે હલન ચલન થતાં, તારા પગ મૂકવાની જગ્યા નીચે એક સસ્કો આવી રહ્યો. શરીર ખણીને

તેં પગ નીચે મૂકવાનો વિચાર કર્યો, તેવામાં તે જગ્યાએ એક સસદો તારા જોવામાં આવ્યો. પ્રાણી જીવની મહાન દ્યાની ખાતર તેં તારો પગ નીચે ન મૂકતાં અધર રાખ્યો. હે મેઘ, તે જીવદ્યાના મહાન પ્રભાવે તેં તારો સંસાર કાપી નાખ્યો, અને મહાન રલચિંતા-મણિ સમાન અમૃત્ય મનુષ્યભવનો બંધ કર્યો. તે વનદવ અઠી દિવસ સુધી રહ્યો. અને પછી શાંત થવાથી પ્રાણીએ ફરવા લાગ્યા. સસદો પણ ત્યાંથી ખસી ગયો. આટદો વખત અધર પગે ઉભો રહેવાથી, તું નિર્ભળ, અશક્ત બની ગયો. અને પગ નીચે મૂકતાની સાથે જ તું એકદમ નીચે દળો પડ્યો. અત્યંત વેદના પામી લાં જ તું ભરણ પામ્યો અને તે જીવદ્યાના પ્રતાપે તું મેઘકુમાર થયો. તિર્યચના લવમાં જ્યાં સમક્ષિ પ્રાપ્તિની આશા પણ નહોતી, તે વખતે અપાર કષ્ટ વેદીને તેં સમતા દાખવી ! તો ઉત્તમ ફૂળમાં જન્મીને, અને જૈન ધર્મ પામીને સાધુ મુનિના હાથપગના સંધર્ષણુંની અલ્પ કિન્નામના પણ હે મેઘ, તું સહન ન કરી શક્યો તે કેટલા ઘેદની વાત ?

મેઘ મુનિ આશ્રમભુગ્ધ બન્યા. ગતરાત્રિએ કરેલાં અશુભ વિચારોનો તેઓ પશ્ચાત્તાપ કરવા લાગ્યા. આમ વિચાર કરતાં તેમને જાતિ સ્મરણુ જ્ઞાન થયું. તે વડે ભગવાનની વાત સત્ય માનીને વૈરાગ્ય ભાવનામાં ચડ્યા. પ્રભુ પાસે પુનઃ તેમણે દીક્ષા લીધી. સખ્ત તપ જપ ધ્યાન ધરી સર્વ નિર્ગંધને ખમાવીને સંથારો કર્યો, એક ભાસનો સંથારો ભોગવી સમાધિ સહિત કાળ કરી તેઓ સર્વાર્થ-સિદ્ધ વિભાનમાં દેવતાપણે ઉત્પત્ત થયા અને ત્યાંથી ચ્યવી મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પત્ત થઈને મોક્ષ જશે.

ન્યાય—જેવી રીતે ભગવાન મહાવીરે મેઘકુમારને મધુર વચનથી સમજલવી સંયમમાર્ગમાં સ્થિર કર્યા, તેવાજ રીતે આચાર્યો કેષપણ અવિનિત શિષ્યને મધુર વચનથી સમજલવી સંયમ માર્ગમાં સ્થિર કરે.

૧૮૫ મેતાર્ય મુનિ.

ઉનાળાના સખ્ત તાપમાં મેતાર્ય નામના એક જૈન મુનિ ગૌચરી અર્થે રાજગૃહિ નગરીમાં નીકળ્યા છે. મુનિવર ભણાન તપોસી અને સહનશીલતાનો અવતાર છે. એક માસના ઉપવાસ છતાં તેમનું તેજ, ગંભીરતા અને આત્મશક્તા જેવાને તેવાજ સુદૃઢ છે. લિક્ષાર્થે કૃતા કૃતા આ મેતાર્ય મુનિવર એક સોનીના ઘર પાસે થઈને જતા હતા. સોનીની દષ્ટિ આ સાધુ ઉપર પડી. સોનીએ ઉલા ધર્થ તેમને વંદન કરીને વહેરાવાનું આમંત્રણ કર્યું. મુનિ આહાર માટે સોનીના ઘરમાં ગયા. સોની ક્રાઈ આહકને માટે સોનાની જવમાળા તૈયાર કરતો હતો. અને તે માટે તે સોનાના જવલાં બનાવતો હતો. મુનિને વહેરાવવા માટે કામ એમને એમ પડતું મુક્કીને સોની રસોાળમાં ગયો અને મુનિને પ્રેમપૂર્વક આહાર પાણી વહેરાવ્યાં. જે વખતે સોની આ મુનિને વહેરાવતો હતો, તે વખતે એક કૌંચ નામનું પક્ષી સોનીના ઘરમાં આવ્યું અને પેદાં સોનાનાં બનાવેલાં જવલાં ચરી ગયું. પછી તે ઉડીને સામેના એક ઝાડની ડળી પર બેસી ગયું. આ દશ્ય મેતાર્ય મુનિના જેવામાં આવ્યું. મેતાર્ય મુનિ આહાર લઈને બહાર નીકળ્યા.

હવે પેદાં સોની મુનિને વહેરાવીને કામ હાથમાં લેવા જય છે કે તરતજ પેદાં જવલાં તેના જેવામાં આવ્યાં નહિ. સોનીને રાંકા થઈ કે જરૂર આ મુનિએ જવલાં લીધા હશે. તેથી તે મુનિ પાછળ દોડ્યો; મુનિ અહુદ્વર નહોતા ગયા તેથી સોની તરતજ મુનિને પકડી લાવ્યો અને તેમને કહેવા લાગ્યો:—હે મુનિ, મહારાં જવલાં ચોરી ને લઈ જાવ છો તે પાછા લાવો. મુનિ મૌન રહ્યા, ક્રીવાર સોનીએ કહ્યું, છતાં મુનિ બોલ્યા નહિ. મેતાર્ય મુનિને લાગ્યું કે જે હું કહીશ કે આ ઝાડ પર બેઠેલું પક્ષી તારા જવલાં ચરી ગયું છે, તો જરૂર આ સોની આ બિચારા પક્ષીને મારી નાખશે. સોનીએ

ત્રીજીવાર મુનિ પાસે જવલાં ભાગ્યાં. છતાં મુનિ શાંત રહ્યા તેથી સોની વધારે કોધાયમાન થયો. તેણે મુનિને ખૂબ માર ભાર્યો અને ચામડાની દોરીથી મુનિના હાથ પગ વગેરે મજબુત રીતે બાંધ્યા. પછી તેણે મુનિને જવલાં આપવાનું કહ્યું, પણ શાંતમૂર્તિ મુનિવરને તો પરિષહ સહન કરવાનો હતો. તેઓ પોતાના જીવ સમાન જ ખીજ જીવોને પણ ગણુત્તા હતા, તેથી તે સધળું શાંતિથી સહન કરવા લાગ્યા. પછી સોનીએ મુનિને સખત તાપથી ધગધગતી રેતીમાં બેસાડ્યા, અને તે માર મારવા લાગ્યો. સખત તાપથી આ તપસ્વી મુનિનું શરીર ક્ષીણ થવા લાગ્યું, અને ચામડી ઉત્તરવા લાગી. માથામાં પણ ખાડા પડવા ભાંડ્યા. પરિણામે મેતાર્ય મુનિની ઘોધરી ક્ષાટી અને તડ દઢને અવાજ થયો. સોનીએ જાણ્યું કે હવે મુનિ મહારા જવલાં પાછા આપશે, પણ મુનિવર તો જેમ જેમ પરિસહ પડતો જાય તેમ તેમ સમલાવે સહન કરે, જરા પણ રોષ સોની ઉપર ન લાવે અને આત્માની અપૂર્વ ભાવનાનું રમરણ કરે. આવી રીતે આત્માની ઉચ્ચ્ય દશાને ભાવતાં ત્યાંજ શ્રી મેતાર્ય મુનિવરને ક્રેવળ જ્ઞાન ઉત્પજ થયું. તેમનો અમર આત્મા દેહથી જુહે પડીને નિર્વાણુપદને પામ્યો.

તેવામાં એક બાઈ માથે લાકડાનો ભારો લઈને જતી હતી. અતિશય લાર લાગવાથી તેણે તે ભારો સોનીના ઘર આગળ જોરથી પછાડ્યો. ભારો નીચે પડવાથી મોટો અવાજ થયો. જેથી પેદું ઝાડપર ઘેડેલું કૌંચ પક્ષી ખીન્યું. તેનું મોદું એકદમ પહોળું થઈ ગયું. આથી પેલાં ચરી ગયેલાં જવલાં તેના મોઠામાંથી બહાર નીકળી ગયાં અને નીચે પડ્યાં.

સોનીની નજર તરત જવલાં તરફ ગઈ. જવલાંને જોતાંજ તે દૃંગાગર થઈ ગયો. મુનિને વિના વાંકે હુઃઅ આપ્યા અદલ તે ખૂબ પશ્ચાત્તાપ કરવા લાગ્યો. સોનીને લાગ્યું કે મુનિવરને ભારી નાખ્યાની

વात જે રાજ જણુશે તો મારા આર વાગી જશે. હાય ! હું હવે શું કરું ? એમ વિચારી તે સોનીએ મુનિ પાસે જર્ઝ મેતાર્થ મુનિવરના કપડાં પહેરી લીધાં, અને દીક્ષિત બનીને તે લાંથી ચાલી નીકળ્યો. સખ્ત તપ જ્યું કરી, સંયમ પ્રવર્ણાં પાળીને તેણે પણ આત્માનું કલ્યાણ કર્યું. ધન્ય છે મેતાર્થ મુનિ નેવા મહાનુભાવી ક્ષમાશ્રમણને.

૧૮૬ મેતાર્થ ગણુધર.

વર્ષદેશમાં આવેલાં તુંગિક ગામમાં વસતા ડૌડિન્ય ગૌત્રના દા નામના આલણ અને વર્ણદેવા ભાતાના તેઓ પુત્ર હતા. ઉમર લાયક થતા વેદાદિ છ શાસ્ત્રમાં પ્રવિષુ બની, તેઓ ૩૦૦ શિષ્યોના અધ્યાપક થયા. તેમને 'પરલોક છે કે નહિ' એ વિષયનો સંશય હતો, તે લગવાન્ મહાવીરે હૂર કર્યો, આથી તેમણે પોતાના શિષ્યો સહિત ૩૭ વર્ષની ઉંમરે પ્રભુ પાસે દીક્ષા લીધી; અને લ. મહાવીરના દશમા ગણુધરપદે આવ્યા. ૧૦ વર્ષ છદ્રમસ્થપણુંમાં રહ્યા, ૪૭ મા વર્ષમાં કૈવલ્યજ્ઞાન પામ્યા, ૧૬ વર્ષ કૈવલ્ય પ્રવર્ણાંમાં વિચરી એકંદર ૬૨ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી તેઓ નિર્વાણ પામ્યા.

૧૮૭ મૌર્યપુત્ર ગણુધર.

પ્રભુ મહાવીરના સાતમા ગણુધર મૌર્યપુત્ર થયા. તેઓ કાશ્યપગોત્રના મૌર્યગામ નિવાસી મૌર્ય નામક આલણના પુત્ર હતા. તેમની ભાતાનું નામ વિજયદેવા. તેઓ ચાર વેદ, ચૌદ વિદ્યાદિ અનેક શાસ્ત્રોમાં પારંગત હતા, અને ૩૫૦ શિષ્યોના અધ્યાપક હતા. તેમને 'હેવો છે કે નહિ' એ બાઅતનો સંદેહ હતો, તે લ. મહાવીરે હૂર કર્યો, એટલે ૬૫ વર્ષની ઉંમરે તેઓ દીક્ષિત બની ગણુધર બન્યા. ૧૪ વર્ષ છદ્રમસ્થપણુંમાં રહ્યા, ૮૦ મા વર્ષની શરૂઆતમાં કૈવલ્યજ્ઞાન થયું. ૧૬ વર્ષ કૈવલ્ય પ્રવર્ણાંમાં વિચરી

અનેક જીવોનો ઉદ્ઘાર કરી, તેઓ ૬૫ વર્ષનું આયુષ્ય ભોગવી પ્રભુની હૃતિમાં જ નિર્વાણ-મોક્ષ પદ્ધાર્યા.

૧૮૮ મંડિત ગણુધર.

છુટા ગણુધર શ્રી મંડિત, વાસિષ્ઠ ગૌત્રના, મૌર્ય ગામના રહિશ હતા. તેમના પિતાતું નામ ધનદેવ અને ભાતાતું નામ વિજયદેવી. તેઓ ધણા જ ખુદ્ધિમાન હતા, તેથી દુંક સમયમાં ચૌદ વિદ્યામાં પારંગત થયા. તેમને ૩૫૦ શિષ્યો હતા. તેમને ‘બંધ અને મોક્ષ’ની બાબતમાં સંશય હતો, તે ભગવાને નિવાર્યો, એટલે તેમણે ૫૪ મા વર્ષે પ્રભુ પાસે નૈત્રેપ્રવન્નર્યા અંગીકાર કરી; અને ગણુધરપદ પામ્યા. ૧૪ વર્ષ છદ્ધમરથ અવસ્થામાં રહ્યા પછી ૬૮ મા વર્ષે તેમને કૈવલ્યજ્ઞાન થયું. ૧૧ વર્ષ કેવળીપણે વિચર્યા પછી, ૮૩ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી તેઓ મુક્તિપદને પામ્યા.

૧૮૯ રહનેમી—રાજેમતી

ધનપતિ કુભેરની બનાવેલી, સોનાના ગઠ અને રત્નના કંગરા-વાળી દ્વારિકાનગરીમાં શ્રીકૃષ્ણ વાસુદેવ રાજ્યાસને હતા. તેમના અધિકાર નીચે ખીણ સોળ હજાર રાજ્યો તે જ નગરીમાં રાજ્ય કરતા હતા. તેમાંના એક રાજ ઉત્ત્રસેન પણ હતા. તેમને ધારિણી નામની રાણી હતી. તેમને એક પુત્રી હતી. નામ ‘રાજેમતી.’ શ્રી નેમી-શ્રર ભગવાન સંસારમાં હતા, અને લભ નહોતા કરતા, પણ કૃષ્ણ વાસુદેવે ખૂબ કહેવાથી લભ માટે તે કખુલ થયા અને તેમનો વિવાહ આ રાજેમતી સાથે નક્કી કરવામાં આવ્યો. લભને દિવસે શ્રી નેમનાથ જ્યારે તોરણે આવ્યા, ત્યારે પશુઓનો કરુણવિલાપ સાંભળીને તેમનાથ પ્રભુ તોરણેથી પાછા કર્યા, અને દીક્ષા લીધી. રાજેમતી પણ ભહાન સંસ્કારી હતી. તે સર્વાર્થસિદ્ધ વિમાનમાંથી ચ્યાવીને અહિં અવતરી હતી. રાજેમતીને ખીને પરણવા માટે

ધણાંશોએ કહ્યું, પણ તેણે તો તે અધી વાત તિરસ્કારી કાઢી, અને કહ્યું કે જગતમાં સ્વીઓને એકજ પતિ હોઈ શકે. અને મહારા પતિએ જ્યારે આત્મ-સાધના કરવા માટે દીક્ષા લીધી છે, લારે મહારે પણ તે જ રસ્તે જવું જોઈએ. એમ કહીને રાજેમતી પણ દીક્ષા લઈને ચાલી નીકળ્યા અને તપસંયમમાં આત્માને આવતાં વિચરવા લાગ્યા.

એકવાર રાજેમતી સાધ્વીજ નેમનાથ પ્રલુને વાંદીને પાછા આવે છે, તેવામાં વૃષ્ટિ થઈ અને પોતાના કપડાં પાણીથી લિંગયાં. તે સુકૃવવા માટે રસ્તામાં આવતી એક ગુઝામાં તેઓ દાખલ થયાં, અને ત્યાં તમામ કપડાં ઉતારી નમ્ન દથામાં રહી તે કપડાં સુકૃવવા મુક્યાં.

આ તરફ નેમનાથ પ્રલુના ભાઈ રહનેમિ (રથનેમિ) એ પણ દીક્ષા લીધી હતી. તેઓ ગોચરી કરીને પ્રલુ પાસે વંદન કરવા જતા હતા; પણ રસ્તામાં વૃષ્ટિ થવાથી તેઓ પણ તે જ ગુઝામાં પેડા, કે જ્યાં રાજેમતી ગયા હતા. ગુઝામાં અંધકાર હતો, પણ રાજેમતીનું રૂપ દિવ્ય પ્રકાશ જેવું હતું. તેવામાં રહનેમિની નજર રાજેમતો ઉપર ગઈ. રાજેમતીને નમ્ન દથામાં જેતાં રહનેમિને કાખવિકાર ઉત્પન્ન થયો. તે મોહાંધ બની ગયા. તરતજ તેઓ રાજેમતી પાસે આવી એલ્યા. અહો રાજેમતિ, શું તમારું રૂપ છે! આટલી નાની ઉંમરમાં તમારે દીક્ષા લેવી ચો઱્ય નથી. વળી હું પણ ભોગ ભોગવાની છચ્છા રાખું છું માટે મારી પાસે આવો. આપણે સુખ ભોગવીએ. રાજેમતી એલી:-અહો રહનેમિ, તમે આ શું એકો છો? સંસાર છોડો ત્યાગી થયા છતાં સ્વી ભોગની આકંક્ષા શું હજુ તમે રાખી રહ્યા છો?

રહનેમિ—ડા. સંસાર છોડ્યો એ વાત ખરી, પણ તહમારા લેવી સુંદર સ્વી ભળતી હોય તો સાધુપણું છોડી દેવું મને હીક લાગે છે. વળી આપણે બંને સુખ ભોગ ભોગવશું અને પછી સાધુ ક્યાં નથી થઈ શકતું?

રાજેમતી—ધિક્કાર છે, તમારા જીવનને, રહનેમિ, ધિક્કાર છે.
 તમારા ભાઈ ને મેળનાથે મને વિષ સમાન માનીને છાંડો અને
 શું તમે તે છાંડેલા વિષને કરો લોગવવા માગો છો ?
 અગંધન કૂળના સર્પો મરી જતાં પણ વમેલું વિષ પાછું
 ચૂસતાં નથી.

તો મહાન રત્નચિંતામણી સમાન મળેલા આ સાધુમાર્ગથી
 બ્રષ્ટ બની તમારા ભાઈથી છાંડયેલી હું, તેની સાથે શું તમે લોગ
 લોગવવા માગો છો? સ્વપ્નેથ પણ તેમ બનનાર નથી. વળી હું સાધ્વી
 છું એટલે તમારી તે છાંઢા ત્રિકાળે પણ તૃપ્ત થવાની નથી. એક તિર્યંચ
 સર્પ નેવાં પ્રાણીઓ પણ સમજો, અને તમે દીક્ષિત છતાં ભોગની
 છુંચા ધરાવો છો? સમજો, રહનેમિ ! સમજો, તમારો આત્મ ધર્મ
 વિચારો. હું ઉત્સેન રાજાની પુત્રી છું, તમે સમુદ્રકુમારના પુત્ર છો.
 મહેરબાની કરી આપણા બંનેનાં કૂળ તરફ એકવાર નજર કરો. વળી
 સંયમી બનીને જ્યાંત્યાં ફરતાં તમે ધણી સૌંદર્યવાન સ્વીઓ જેરો, અને
 તેમાં મનલુખ્ય કરો. તો અનંત સંસારમાં ભ્રમણું કરતા છતાં પણ
 તમારો પાર નહિ આવે. ઉત્તમ મનુષ્યભવ, ઉચ્ચયકુળમાં જન્મ,
 શાસ્ત્ર શ્રવણ, સદ્ગુરુનો સમાગમ, જૈનધર્મ અને સંયમ, જીવને
 અનંતકાળે પણ મળવા હુલ્લાલ છે ! જાઓ, જાઓ, રહનેમિ, જાઓ,
 તમારા બ્રષ્ટ વિચારો છોડી, વિશુદ્ધ થવા શ્રી નેમીશ્વર ભગવાન પાસે
 જાઓ, અને પાપની આલોચના લઈ સંયમમાર્ગને સુધારો.

આ સાંભળી રહનેમિ છાંડગાર થઈ ગયા. રાજેમતીના બોધક
 વચ્ચેનો રહનેમિના હૃદયમાં આરપાર ઉત્તરી ગયા. તેમણે તરતજ રાજે-
 મતીની ક્ષમા માગી. તે સાથે પોતાને ઘરાય વાસનાથી ડેકાણે લાવવા
 માટે તેની પ્રશંસા કરી. રહનેમિ નેમપ્રભુ પાસે જઈ આલોચના લઈ
 શુદ્ધ થયા, અને સંયમમાર્ગમાં અદ્ભુત રીતે આગળ વધી કૈવલ્ય-
 શાનને પામ્યા.

રાજેમતીએ રહનેમિને સ્થિર કર્યા, લાંથી કપડા પહેરી તેઓ.
 ૧૮

પ્રભુને વંદન કરવા ગયા. ત્યારબાદ સંયમ, તપ, કિયાઓમાં આત્માને લાવતાં કૈવલ્યજ્ઞાન પામી રાજેમતી પણ મોક્ષમાં ગયા.

ધર્મ છે, રાજેમતી સમા આળ અહ્લયારી સતી-સાધીને. તેમને આપણું ત્રિકાળ વંદન હોજો.

૧૯૦ રામ

તેચો મુનિસુપત સ્વામીના વખતમાં બળદેવ તરીકે પ્રસિદ્ધ થયા. તેમના ભાઈ લક્ષ્મણ વાસુદેવ તરીકે પ્રસિદ્ધ થયા. રામયંદ અયોધ્યાના સૂર્યવંશી રાજ દશરથના મોટા પુત્ર હતા. તેમની માતાનું નામ કૌશલ્યા. શ્રી રામ વિહેઠ દેશના જનક રાજની પુત્રી સીતાને પરણ્યા હતા. ઉંમર લાયક થતાં, તેમની અપર માતા કેંકેયાની સ્વાર્થ બુદ્ધિને કારણે પિતાના વચન પાલનને ખાતર તેમણે વનવાસ સ્વીકાર્યો. તેમની સાથે સીતા અને લક્ષ્મણ પણ વનમાં ગયાં; લાં એક પર્ણુંકુદ્રિ બાંધીને રહ્યા. રામ લક્ષ્મણની ગેરહાજરીનો લાલ લઈ, લંડાનો રાજ રાવણું સીતાનું હરણ કરી ગયો. સીતા મહાસતી હોઈ રાવણની દુર્ભુદ્ધિને તાઢે થયા નહિ. રાવણું સ્ત્રી મંહોદરીએ પોતાના પતિને સતીને નહિ સંતાપતા પાછી સોંપી દેવાની વિનંતિ કરી, પરન્તુ ‘વિનાશ કાળે વિપરીત બુદ્ધિ’ એ અનુસાર ધમંડી રાવણે કોઈનું હિતકથન ગળુકાર્યું નહિ. આખરે સીતાનો પત્તો ભણતાં, રામયંદ તથા લક્ષ્મણે હતુમંત, સુશ્રીવ આદિ યોજાઓની મદદ લઈ લંડા પર ચડાઈ કરી, ત્યાં લક્ષ્મણે પ્રતિવાસુદેવ રાજ રાવણને ભાર્યાં, અને તેનું રાજ્ય તેના ભાઈ વિલિષણને સોંપ્યું. લારબાદ સીતાને લઈ રામયંદજી વગેરે પાછા આવ્યા. વનવાસ કાળ પૂરો થયે તેચો અયોધ્યામાં આવ્યા અને રાજ્ય સંભાળ્યું. ધણ્યા વર્ષો સુધી તેચો લક્ષ્મણ સાથે રહ્યા. લારબાદ લક્ષ્મણનું મૃત્યુ થતાં શ્રી રામે દીક્ષા લીધી; અને મહાતપ કરી તેચો કૈવલ્ય જ્ઞાન પામી મોક્ષમાં ગયા. (રામનું બીજું નામ પદ્મ પણ હતું.)

૧૬૧ રાવણ

મુનિસુવત સ્વામીના સમયમાં દક્ષિણ ભરતની લંડા નામની નગરીનો તે પ્રતિવાસુદેવ રાજ હતો. તે ત્રણ ખંડનો અધિપતિ હતો; એરથે અર્ધ ભરત તેના તાણામાં હતો. તેને કુંભકર્ણ અને વિલિષણ નામના એ લાઈઓ હતા, તેમજ ધૂદ્રિજિત આદિ અનેક પુત્રો અને ભંડોદરી આદિ અનેક રાણીઓ હતી. રાવણ મહા સમૃદ્ધિશાળી હોવા હતાં, તેને એક એવો નિયમ હતો કે જે સ્વી પોતાને ન ધર્યું, તેને પરણું નહિ. આમ હતાં તે પોતાની બહેનના ભંભેરવાથી એક દિવસ ઉંફુરાયો, અને શ્રી રામચંદ્રની સુર્ખીલ પતની સીતાહેવીને ઉપાડી લાવ્યો. આખરે યુદ્ધ થયું, તેણે પોતાનું ચક્ર લક્ષમણ પર છોડ્યું, પરન્તુ વાસુદેવ લક્ષમણને તે કંઈ અસર ન કરી શક્યું. લક્ષમણે તેજ ચક્ર પોતાને હાથ કરી, તેજ ચક્ર વડે રાવણનું મૃત્યુ નીપળાવ્યું. રાવણ મૃત્યુ પામીને નરકમાં ગયો.*

૧૬૨ ઝકિમણી

તે દારિકાના રાજ શ્રી કૃષ્ણની રાણી અને વિદ્યાર્થી દેશના ભીમક રાજની પુત્રી હતી. તેણીનું રૂપ અથાગ હતું. એકવાર નારદે તેણીના ઇપના વખાણ શ્રી કૃષ્ણ પાસે કર્યા, આથી કૃષ્ણને તેણીની સાથે લગ્ન કરવાની ધર્યા થઈ. આ વખતે વિદ્યાર્થીમાં ભીમકનો પુત્ર ઝકિમ રાજગાઢી પર હતો, તેનો પાસે કૃષ્ણ દૂત મોકલ્યો. ઝકિમ

*૨૪ તીર્થંકરી, ૧૨ ચક્રવર્તીઓ, ૬ વાસુદેવો, ૬ પ્રતિવાસુદેવો અને ૬ બળદેવો એ દર્શાવાના (૩૬૪૪) પુરુષો કહેવાય છે. ચક્રવર્તીઓની ગતિ મોકાશ, દેવલોક અને નર્કની હોય છે. વાસુદેવો અને પ્રતિવાસુદેવો નર્કના અધિકારી હોય છે અને બળદેવો દેવલોક અને મોકાશના અધિકારી હોય છે. નરકે જનારા ચક્રવર્તી તથા વાસુદેવો થોડાક જીવે કરી છેવટે મોકાશના જ અધિકારી બને છે એવો જૈનાગમનો સિદ્ધાંત છે.—સં.

રાજએ હૃતને કહ્યું કે તારા રાજ ગોવાળના પુત્ર છે, માટે તેની સાથે મારી ઐન નહિ પરણાવું, તેને તો શિશુપાળ રાજ સાથેજ પરણાવવી છે. આથી હૃત વિદ્યાય થયો. આ તરફ નારદજાધિએ ઇકિમણી પાસે જઈ કૃષ્ણનાં રૂપ ગુણુના વખાણ કર્યા, એટલે ઇકિમણીની દ્વારા યુક્તિથી કૃષ્ણને છાની રીતે વિદર્ભના ઉદ્ઘાનમાં ઓલાવવામાં આવ્યા, ત્યાં નાગહેવની પૂજન કરવાને બહાને ઇકિમણી પોતાની દ્વારા સાથે તે ઉદ્ઘાનમાંના દેવલે ગઈ, ત્યાં શ્રી કૃષ્ણું આવી તેણીનું હરણ કર્યું, એજ વખતે ઇકિમણીનો વિવાહ પ્રસંગ હતો અને શિશુપાળ પોતાના સૈન્ય સાથે પરણવા માટે ત્યાં આવ્યો હતો. ઇકિમણીના હરણના સમાચાર તરતજ શહેરમાં કરો વળ્યા. એટલે શિશુપાળ તથા ઇકિમરાજ કોધે ભરાયા; અને ઇકિમણીને પ્રપંચથી રથમાં બેસાડીને ઉપાડી જતાં કૃષ્ણ અને બળભદ્રની તેઓએ પુંડ પકડી. બળભદ્રે તેમનો સામનો કર્યો, અને ઇકિમને પકડીને બાંધ્યો, પરન્તુ છેવટે દ્યા લાવી તેને છોડી મૂક્યો. શિશુપાળ પણ નિરાશ બની પાછો ઇઝ્યો. શ્રી કૃષ્ણું દારિકામાં પહોંચ્યો જઈ ઇકિમણી સાથે લગ્ન કર્યું. તેનાથી તેમને પ્રદુર્ભન નામે મહાસમર્થ પુત્ર થયો. આખરે દારિકાનો દાહ સાંખલ્યા પછી બીજુ રાણીઓ સાથે ઇકિમણીએ દીક્ષા લીધી અને આત્મ કલ્યાણ કર્યું.

૧૯૩ ઇધીરાજ

તે કૃષ્ણાલ દેશની આવસ્તિ નગરોનો રાજ હતો. પૂર્વભવમાંતે વસુ નામના રાજ અને મહાભલ કુમારનો ભિત્ર હતો. તે મહાભલ સાથે દીક્ષા લઈ સખ્ત તપ કરી જયંત નામના અનુતાર વિમાનમાં દેવ થયો હતો. ત્યાંથી ચ્યાવી આવસ્તિમાં તે રાજ થયો. તેને સુખાહુ નામે કુંવરી હતી. તેનો ચાતુર્માસિક સ્નાનનો ઉત્સવ આવવાથી, તે નિભિતે રાજમાર્ગમાં પુષ્પનો વિશાળ અને સુશોલિત મંડપ કરાવી વચ્ચે એક સુવર્ણની ખાટ મૂકાવી તેનાપર સુખાહુ કુંવરીને બેસાડીને રાણીઓએ તેણીને

રનાન કરાવ્યું, અને સુંદર વખાલંકારો પહેરાવી રાજ પાસે મોકલી. આ વખતે કુમારીનું ઇપ અથાગ હતું. તેથી આનંદ પામી ઇપીરાજએ પોતાના વર્ષધર નામના દ્વાતને બોલાવીને કહ્યું, કે તહે ઘણે સ્થળે કરો છો, તો આજના જેવો મહાન ઉત્સવ તહે કયાંઈ જોયો છે? દ્વાતે કહ્યું: મહારાજ! મિથિલા નગરીના કુંભરાજની પુત્રી મહીકુંવરીની જરૂરમાં વખતે થયેલા ઉત્સવ આગળ આપતો આ ઉત્સવ કાંઈ ગણુની માં નથી, એમ કહી તેણે મહીકુંવરીના શરીર સૌંદર્યનું વર્ણન કર્યું. તે સાંભળી રાજને મહીકુંવરીને પરણવાની ધર્યા થઈ. તેથી કુંભરાજ પાસે તેણે પોતાનો દ્વાત મોકલ્યો. કુંભરાજએ ના કહી, તેથી જિતશત્રુ આદિ રાજએ સાથે સંપ કરી ઇપી રાજ મિથિલા પર અડી આવ્યો. તેમાં મહીકુંવરીની યુક્તિથી તેણે બોધ પામી દીક્ષા લીધી. અંતે સમેતશિખર પર અનશન કરી ઇપીરાજ મોકલ્યા.

૧૯૪ રેવતી.

મેદ્ક ગામભાં કોઈ એક ઐછિની તે પત્ની હતી. જૈનશાસન પ્રત્યે તેને અતિશય પ્રેમ હોવાથી પ્રલુભ મહાવીરની તે પરમ ઉપાસિકા હતી. એકવાર જ્યારે ગોશાળાએ પ્રલુભ પર તેજુલેશ્યા હેંકી અને પ્રભુનો દેહ લોહખંડવાળો થયો, તે ભટાડવાના હેતુથી પ્રલુભે પોતાના સિંહ નામના અણુગારને રેવતીને લાં મોકલ્યા. પ્રભુને થયેલા ઉપસર્ગથી રેવતી જાત હતી, તેથી તેણે પ્રભુનું દરદ ભાટે તે માટે કોહળાપાક બનાવ્યો હતો, અને ધરના માણુસો માટે ભીજેરાંપાક બનાવ્યો હતો. સિંહ અણુગાર રેવતીને ત્યાં પધાર્યા કે તેણીએ મુનિને વંદન કરી કહ્યું: મહારાજ, આજે મારું ધર પાવન થયું. આપતે શું જોઈએ? સિંહઅણુગાર બોલ્યા: પ્રલુભે મને તમારે લાં બનાવેલો પાક વહોઠી લાવવાની આજા આપી છે. આ સાંભળી રેવતી હ્યું પામી અને કોહળાપાક લઈ આવીને મુનિને વહોઠાવવા લાગી. મુનિએ કહ્યું. આ તો તહે પ્રલુભે માટેજ બનાવ્યો છે, તેથી તે અકલ્પનીય

છે. માટે ખીલેરાપાક, જે તમે અનાવ્યો છે તે વહેરાવો. રેવતીઓલીઃ મહારાજ, તે તો વાપરી નાખ્યો. સિંહમુનિ બોલ્યાઃ પ્રભુના કહેવાથી હું જાણું છું કે તે પાક તમારા વાસણુભાં થોડો મોટી રદ્ધી છે. આ જાણું હર્ષ પામી, રેવતીએ ખીલેરાપાકનું પાત્ર લાવી, તેમાં ચોટેથો થોડોક ખીલેરાપાક ઉત્કૃષ્ટ ભાવથી સિંહમુનિને વહેરાવ્યો. આ ભાવનાના પ્રતાપે રેવતી આવિકાએ તીર્થકર નામ કર્મ ઉપાર્જન કર્યું. અનુક્રમે ગૃહસ્થધર્મનું નિરતિયારપણે પાલન કરી તે દેવલોકમાં ગઈ.

૧૮૫ રોણિણી.

શ્રેણિક રાજની રાજગૃહી નગરીમાં ધનાસાર્થવાહ નામનો મહાઋદ્વિતીંત શેડ રહેતો હતો. તેને ધનપાળ, ધનદેવ, ધનગોપ અને ધનરક્ષિત એ નામના ચાર પુત્રો હતા. તે ચારે પુત્રોને ચાર સ્ત્રીએ હતી. જેમના નામ ૧ ઉઝીયા, ૨ ભોગવતી, ૩ રક્ષિતા, ૪ રોણિણી અનુક્રમે હતાં. એક વખત ધનાસાર્થવાહને વિચાર થયો કે હું મહારા કુદુંઘમાં અગ્રગણ્ય છું. દરેક કાર્ય મહારી સલાહથી જ કરવામાં આવે છે. પરંતુ મહારી ગેરહાજરીમાં અગર મહારા મૃત્યુ પછી મારી સંઘળી મીલ્કતની શી વ્યવસ્થા થશે, અથવા તે સારી રીતે કોણું સાચવી શકશે, અગર કુદુંઘમાંના કોઈ માણુસને કુરસ્તે જતા અથવા અકાર્ય કરતાં કોણું અટકાવશે; માટે હું મહારી ચાર પુત્રવધુઓને ડાંગરના પાંચ અખંડ દાણા આપીને પરોક્ષા કરું કે તેમાં કોણું અને કેવી રીતે તેની રક્ષા કરે છે, અથવા વૃદ્ધિ કરે છે.

એવો વિચાર કરીને ખીલે દિવસે સવારમાં શેડે ભિત્રજીતિ વગે-રેને જમણું આપ્યું. તેમાં ચાર પુત્રવધુઓને બોલાવી સત્કાર સન્માન આપી જમાડી. પછી જીતિજનો વર્ષે મોટી પુત્રવધુ ઉઝીયાને બોલાવી, અને કહ્યું:-‘ વહુ, લ્યો આ પાંચ ડાંગરના દાણા, અને

જથારે હું પાછા માગું ત્યારે તે મને આપણો.’ ત્યાર પછી બીજી ત્રીજી અને ચોથી એમ દરેક સ્વીને બોલાવીને દરેકને પાંચ પાંચ ડાંગરના દાણા આપ્યાં અને પોતે માગે લારે પાછા આપવા જણાવ્યું.

પ્રથમ મોટી વહુએ તે દાણા લઈને વિચાર કર્યો કે મારા ક્રાડારમાં ડાંગર ધણી ભરી છે, તો મારા સસરા માગશે તે વખતે તેમાંથી લાવીને આપીશ. એમ કહીને તેણે તે પાંચ દાણા ફેંકી દીધા.

ભોગવતી નામની બીજી પુત્રવધુ પણ એવો જ વિચાર કરીને, તે ડાંગર ઉપરથી ફેઠારા ઉતારીને દાણા આઈ ગઈ, અને પોતાના કામે લાગી.

ત્રીજી રક્ષિતા નામની પુત્રવધુ તે દાણા લઈને એકાંતમાં ગઈ અને વિચાર કર્યો કે મારા સસરાએ ભિન્ન, જાતિ, કુટુંબ ઈસાદિ સર્વની સંભુલ્ય આ પાંચ દાણા મને આપ્યા છે, માટે તેમાં કંઈક ભેદ હોવો જોઈએ. એમ ધારી તે પાંચ દાણાને એક વખતમાં બાંધી તેને રતના કરંડીયામાં રાખ્યા, અને તે કરંડીયાને એક પેટીમાં રાખ્યો. પછી તે પેટી ઓસીકા નીચે રાખી સવાર સાંજ એ વખત રોજ તેની સંભાળ કરવા લાગી.

રોહિણી નામની સૌથી નાની પુત્રવધુએ રક્ષિતા માઝક વિચાર કર્યો કે આમાં કંઈક કારણ હોવું જોઈએ. માટે આ દાણાની બરાબર રક્ષા કરવી જોઈએ. એટલું જ નહિ પણ તેમાં વૃદ્ધિ કરવી જોઈએ. એમ ધારી તેણે પોતાના ઘરના નોકરને બોલાવીને કહ્યું કે ‘આ ડાંગરના દાણા લઈ જાઓ, અને બહુ વર્ષાદ થાય તે વખતે એક નાની ક્યારી બનાવી, તેમાં આ પાંચ દાણા વાવળો, અને તે ક્યારીને ફરતી એક વાડ બનાવી તેની બરાબર રક્ષા કરનો. પ્રથમ વર્ષાકાંતુમાં તેણે તે દાણા વવરાવ્યા, બીજી સાલ પણ ઉત્પન્ન થયેલા સધળા દાણા વવરાવ્યા, એમ દર વર્ષાકાંતુમાં તમામ ઉત્પન્ન થતી ડાંગર વાવતાં તેમાં પુષ્કળ વૃદ્ધિ થતી ગઈ. અનુકૂમે ચાર વર્ષ સુધી તે વાવી. તૈયાર થયે તેને

કાપીને ખળાં બનાવ્યાં. તેમાં તેને ભસળી, સ્વર્ચ કરી તે ડાંગર વાસણોમાં ભરી લીધી અને તેની રક્ષા કરવા લાગી.

પાંચમે વર્ષે ધજાએ તે દાણા પાછા માગવાનો વિચાર કર્યો. એક દિવસે સ્વજન, ભિત્ર, રાતિ તથા પુત્રવધુએ વગેરેને બોલાવી, ભોજન વગેરે જમાડી શેડે તેમનું સન્માન કર્યું. લારાદ સૌથી પહેલાં મોટી પુત્રવધુને બોલાવીને પ્રથમ આપેલા પાંચ દાણા પાછા માગ્યા. ઉજ્જીવ્યાએ કોહારમાં જઈ તેમાંથી પાંચ દાણા લાવી ધજાસાર્થવાહને આપ્યા. ધજાસાર્થવાહે ઉજ્જીવ્યાને સોગન આપીને કલ્યું કે હે પુત્રી, મેં તને ને પાંચ ડાંગરના દાણા આપ્યા હતા તે આ છે કે બીજી ? ઉજ્જીવ્યાએ સલ્ય હક્કીકિત જહેર કરતાં તે દાણા બીજ હોવાનું જણાવ્યું. ધજા સાર્થવાહ તેના પર ગુર્સે થયો અને તને ધરનું ઝાડું કાઢવાનું, પાણી છાંટવાનું, છાણ વાસીદું કરવાનું તથા લીંપવા ગુંપવાનું વગેરે ધરની બહારનું દાસ, દાસીનું કામ સોંપ્યું.

લારાદ બીજ ભોગવતીને પૂછ્યું, તેણે પણ તેવો જ જવાબ આપ્યો. તેણી તે દાણા ખાઈ ગઈ હતી તેથી તને ડાંગર ખાંડવાનું, ધજિં દળવાનું, રસોઈ કરવાનું, વાસણ માંજવાનું, અને ધરની અંદરનું પરચુરણ કામ સોંપવામાં આવ્યું.

ત્રીજ રક્ષિતા નામની પુત્રવધુ પાસે જ્યારે તે દાણા માગવામાં આવ્યા, ત્યારે તે ધેર ગઈ અને રતનના કરંડીયામાંથી વસ્ત્રથી બાંધેલા દાણા લાવી. જ્યારે તને તેજ દાણા હોવા વિષે પૂછવામાં આવ્યું ત્યારે તેણે સધળી સત્ય વાત નિવેદન કરી. ધનના સાર્થવાહ આનંદ પાગ્યો અને તેણે સર્વ હીરા, ભાણેક, સુવર્ણ વગેરે ધનલંડારની કુંચીએ રક્ષિતાને સોંપી.

છેવટે રોહિણી નામની ચોથી પુત્રવધુને પૂછવામાં આવ્યું. ત્યારે તેણે કલ્યું:- ‘હે તાત ! મને પુષ્કળ ગાડ ગાડીએ આપો, જેથી હું

તમારા તે પાંચ દાણા લાવી આપું.' ધનાએ કહ્યું:-પુત્રી, ભારા પાંચ દાણા ગાડા ગાડીઓબાં તું કેવી રીતે લાવીશ ? તે સાંભળા તેણે ઉપરોક્તા સર્વ વાત વિદિત કરી. ધના સાર્થવાહે ગાડા આપ્યાં. રોહિણીએ પાકેલી તમામ ડાંગરથી તે ગાડાએ ભરાવ્યાં. જે રાજગૃહી નગરીના રાજમાર્ગની મધ્યમાં થઈને તે ડાંગરથી ભરેલાં ગાડાઓ જતાં જોઈને નગરજનોએ વાત જણવાથી, સર્વ ક્રાઈ ધનાસાર્થવાહની રોહિણી નામની પુત્રવધુની મુક્તાંક્ષે પ્રશાંસા કરવા લાગ્યા. ધનાસાર્થ-વાહ ડાંગરના ભરેલાં ગાડાઓ જોઈને ઘૂંઘ આનંદ પામ્યો અને તેના આશ્રયનો પાર ન રહ્યો. પછી તેણે તે રોહિણીને, દરેક કાર્યમાં સલાહ આપવાનું કામ સોંઘું, અને તેણીને ધરમાં સર્વથી મોટી સ્થાપિત કરવામાં આવી.

ન્યાય—જેવી રીતે હજારીયા ડાંગરના પાંચ દાણા નાખી હેવાર્યા, લોકમાં નિંદાને પાત્ર બની, હલકું કામ કરી હુઃખી થઈ. તેવી રીતે સાધુ સાધ્વી પંચ મહાપ્રત અંગીકાર કરીને પ્રમાદવશ શિથિલ બનીને પંચમહાપ્રતને ફેંકી હે, તો તેઓ આ ભવમાં નિંદાને પાત્ર બને, અને પરભવમાં હુઃખી થાય.

જેમ ભોગવતી તે પાંચ દાણાને ખાઈ ગઈ, ને મહેનત મજુરીનું કામ કરીને હુઃખી થઈ, તેમ સાધુ સાધ્વી, પંચમહાપ્રત ધારણ કરીને, રસના લોહુપી બની પ્રત ભંગ કરે તો હિંદના નિંદા પામે અને સંસારમાં પરિબ્રંભણ કરે.

જેમ રક્ષિતાએ પાંચ દાણાનું ઉમદા રીતે રક્ષણ કર્યું તેમ સાધુ સાધ્વી પંચ મહાપ્રતનું મૂળ ગુણમાં રહીને યથાર્થ રક્ષણ કરે તો ચાર તીર્થમાં પુજયનિક બને, અને આત્મકલ્યાણ સાધે.

જેમ રોહિણી પાંચદાણાની વૃદ્ધિ કરીને પ્રશાંસા પામો, તેમ સાધુ સાધ્વી પંચ મહાપ્રત લઈને, સંયમ તપમાં વૃદ્ધિ કરે તો આ ભવમાં સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકા એ ચારે તીર્થમાં પ્રશાંસા પામે, પુજનિક બને અને પરભવમાં અનંત સંસારનો છેદ કરી સિદ્ધગતિને પામે.

૧૯૬ રોહિણીયો ચોર.

રાજગૃહ નગરની પાસે આવેલા વૈભારગીરી પર્વતની ગુઝામાં રોહિણીયો નામનો પુરુષ ચોરીનો ધંધો કરતો હતો. એકવાર તેના બાપે તેને કહેલું કે, મહાવીર નામનો એક માણુસ છે તેનો ઉપદેશ કરી સાંભળતો નહિ, તેમજ મહાવીર જ્યાં હોય તે રસ્તે પણ ન જતો, કારણું કે તેથી આપણા ધંધાને ધણી હાનિ પહેંચશે. પુત્રે પિતાની આ શિક્ષા બરાબર મનમાં ધારણું કરી રાખી. જ્યાં મહાવીરનું નામ સાંભળે ત્યાંથી તે હૂર નાસી જતો. ટ્રાઈ એકવાર ઉદ્ઘાનમાં ઐસી ગ્રલુ મહાવીર ધર્મોપદેશ આપી રહ્યા હતા, તેજ સ્થળે રોહિણીયાને અચાનક આવવું પડ્યું. રોહિણીયા માટે આ સિવાય પસાર થવા માટે બીજો એકે રસ્તો ન હતો, તેથી તેણે કાનમાં આંગળીઓ ધાલી દીધી કે રખેને મહાવીરનો ઉપદેશ પોતાના કાનમાં પ્રવેશ કરી દે. દૈવયોગે રોહિણીયાના પગમાં કાંઠો વાગ્યો, તે કાઢવા તેણે કાને દીધેલો હાથ પગ આગળ લાવી કોટો કાઢવાનો પ્રયત્ન કર્યો. એજ વખતે પ્રભુના ઉપદેશમાંના નીચેના શબ્દો તેની શ્રવણોન્દ્રિયમાં પણ્યાઃ-(૧) દેવ. પૃથ્વીથી અદ્ધર ચાલે તેમજ તેઓ આંખોનું પલકું મારે નહિ. આ શબ્દો રોહિણીયે સાંભળ્યા. કેટલાક વખત પછી ચોરી કરતાં તે પકડાયો. તે વખતે તેણે પોતાનું નામ દામ બોડું આપ્યું, તેમજ તેની પાસેથી ચોરીની વસ્તુઓ કાંઈ નીકળી નહિ, આથી તેને ચોર દ્રાવવા સંબંધમાં શ્રેણીક રાજ સંશયમાં પણ્યો. આ કામ તેણે અભયકુમારને સોંપ્યું. અભયકુમારે એક યુક્તિ રચી. તેણે રોહિણીયાને ધેનવાળો કુશી પદાર્થ ખવરાવ્યો એટથે તે બેલાન બન્યો. પછી તેને ઉંચકીને એક વિમાન જેવા રાજમહેલમાં સૂવાડયો. ત્યાં એ સ્થીએ દેવીએ તરીકે રાખી. ધેન ઉત્તર્યા પછી પેલી એ સ્થીએ હોલીએ:-અહો ! નાથ, તહે એવાં શાં દાન પુણ્ય કર્યાં કે આ દૈવલોકમાં અમારા સ્વામી તરીકે ઉત્પત્ત થયા ! રોહિણીયા વિચારમાં

પડચો કે શું હું આ સત્ય જોઉં છું કે સ્વમ ? શું આ સાક્ષાત દૈલીએ છે ? હું દેવ થયો હુઠિશ ? આ વખતે તેને અગવાનનાં વચ્ચનો યાદ આવ્યાં. તેણે પેલી સ્ત્રીએ સામે જોયું તો તેમના પગ જમીનને અડકેલા હતા, તેમની આંખો ક્ષણે ક્ષણે પલકારા મારી રહી હતી. આથી તે સમજ્યો કે ખરેખર ષડ્યંત્ર રચવામાં આવ્યું છે. હવે ભારે ભારે ચોરીને ધંધો ત્યજી દેવો જોઈએ, અને જે મહાવીરનું એકજ માત્ર વાક્ય સંબળવાથી આટલું જણવાતું ભલ્યું તો ત્યેમના હંમેશના સંસર્ગથી કેટલોયે લાલ મળે, એમ વિચારી અભયકુમાર આવતાં તેણે પોતાની ચોરીના કૃત્યેનો પદ્ધતાપ કરી પ્રવન્ઝ્યા લેવાની વાત વિદિત કરી. અભયકુમારે તેને છોડી દીધો. રાહિણીએ એકદું કરેલું તમામ ધન શ્રેણીકરાનને સોંપ્યું અને તે દીક્ષા લઈ ચાલી નીકળ્યો; સખ્ખ તપાદિ કરી તે દેવલોકમાં ગયો.

૧૯૭ લક્ષમણુ.

અયોધ્યાના રાજ દ્શરથની સુભિત્રા રાણીથી ઉત્પત્ત થયેલા પુત્ર. રાવણ નામના પ્રતિવાસુદેવને મારી આઠમા વાસુદેવ તરીકે તેઓ પ્રસિદ્ધ થયા; અને રામ બળદેવ તરીકે પ્રસિદ્ધ થયા. ત્રણ ખંડ જીતી લક્ષમણુ અયોધ્યાના રાજસિંહાસને અર્ધચક્રવર્તી તરીકે વિરાન્યા. તેમનું બીજું નામ નારાયણ હતું. આરહણર વર્ષનું આયુષ્ય લોગવી, મુનિસુપ્રત સ્વામીના નિર્વાણ પછી તેઓ મૃત્યુ પામી ચોથી નરકે ગયા.

૧૯૮ વરેણુ.

વિશાળા નગરીના ચેડારાનના નાગ નામના રથિકનો પુત્ર. તે લ. મહાવીરનો પરમ અક્તા હતો. તેણે શ્રાવકના બારથી કર્યા હતા. તે મહાસમર્થ સેનાપતિ પણ હતો, અને તપશ્રયામાં પણ તે મહાસમર્થ હતો. એકવાર છઠુના પારણે આઠમ કરવાની તેની ઘર્યિછી

છતાં રાજએ કહેણુ મોકલ્યું કે આને તમારે શ્રેણીક સાથેના યુદ્ધમાં સેનાપતિ તરીકે જવાતું છે. આથી પોતાના દેશની રક્ષાને આતર તે સેનાપતિ બની યુદ્ધે ચડ્યો. પરન્તુ પહેલા વ્રતની વિધિ અનુસાર પહેલા ધા તેણે ન કર્યો પણ જ્યારે શ્રેણીકના સેનાપતિએ વરણું પર પહેલા ધા કર્યો, અને વરણુનાગતું ભર્મસ્થાન લેદાયું, ત્યારે જ તેણે એકજ ધાથી તે સેનાપતિને સરધામ પહેંચાડી દીધો; આ વખતે તે ભૂતવત સ્થિતિમાં હતો, તેથી તેણે રખુલેતની બહાર જઈને એક જગ્યા પ્રમાર્જન કરીને આદોયના લઈ સંચારો કર્યો અને પ્રભુનું સ્મરણું કરવા લાગ્યો. શુદ્ધ પરિણામે તે કાળધર્મ પામીને પહેલા સૌધર્મ દેવલોકમાં ગયો; અને ત્યાંથી મહાવિદેહમાં જન્મ લઈ તેજ અવમાં તે મોકભાં જરે.

૧૯૯ વ્યક્ત ગણધર.

લ. મહાવીરના ચોથા ગણધર વ્યક્ત મહારાજ, કોલાક ગામના રહિશ હતા. તેમના પિતાતું નામ ધનભિત્ર. માતાતું નામ વારણી, તેઓ લારદાજગોત્રના આલણુ હતા. તેમને ‘પૃથ્વી આદિ પાંચ ભૂત છે કે નહિ’ એ સંબંધી સંશય હતો. તે દૂર થતાં તેમણે પોતાના ૫૦૦ શિષ્યો સાથે પ્રભુ મહાવીર પાસે દીક્ષા લીધી, અને ગણધર પદ પર આવ્યા. તેમણે ધૂર્ભૂતિની માઝક પ૧ મા વર્ષો દીક્ષા લીધી હતી. ૧૨ વર્ષ છદ્મસ્થપણે રહી ખૂબ અભ્યાસ કર્યો. ૧૩ મા વર્ષો કૈવલ્યજ્ઞાન પામ્યા, ૧૮ વર્ષ કૈવળીપણે વિચર્યા અને ૨૦ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી તેઓ મોકભાં ગયા.

૨૦૦ વાયુભૂતિગણધર.

તેઓ પહેલા અને બીજ ગણધર ધૂર્ભૂતિ તથા અગ્રભૂતિના ભાઈ થાય. તેઓ ગૌતમ ગોત્રના વસુભૂતિ આલણુ અને પૃથ્વી માતાના પુત્ર હતા. તેમને “આ શરીર છે તેજ આત્મા છે કે

શરીરથી આત્મા લિન છે' એવો સંદેહ હતો. લ. મહાવીરના સમાગમમાં આવતાં ભગવાને તે સંદેહ દૂર કર્યો, એટલે તેમણે પોતાના ૫૦૦ શિષ્યો સહિત ૪૩ મા વર્ષે દીક્ષા લીધી. ૧૦ વર્ષ છદ્રમસ્થ-પણ્યામાં રહ્યા પછી ૫૩ મા વર્ષે કૈવલ્યજ્ઞાન પામ્યા. ૧૮ વર્ષ કૈવલ્ય પ્રવર્ણયીમાં વિચરી, ૭૦ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી પ્રભુની હ્યાતિમાં તેઓ નિર્વાણ પામ્યા. વાયુભૂતિપ્રભુ મહાવીરના ત્રીજા ગણુધર હતા.

૨૦૧ વાસુપૂજય.

ચંપાપુરીના વસુપૂજય રાજની જ્યાદેવી નામક રાણીની કુલિમાં દશમા દેવલોકમાંથી ચ્યાને જેઠ શુદ્ધ ૬ ની રાત્રિએ તેઓ ઉત્પન્ન થયા. માતાએ ૧૪ સ્વમ દીઢાં. સ્વમપાઠકોએ મહા-ભાગ્યશાળી તીર્થકરનો જન્મ થવાનું કહ્યું. રાજરાણી આનંદ પામ્યા. અનુકમે ગર્ભકાળ પૂરો થયે, ક્ષાગર વદ્દ ૧૪ ના રોજ પ્રભુનો જન્મ થયો. ઈદ્રોએ જન્મોત્સવ ઉજવ્યો. પિતાએ તેમનું 'વાસુપૂજય' એવું નામ આપ્યું. યૌવનવય થતાં પિતાએ તેમને પરણવાનો અને રાન્યાસને ઘેસવાનો આગ્રહ કર્યો; પરન્તુ તેમણે ના કહી. આ સમયે લોકાંતિક દેવોએ આવી પ્રભુને ધર્મભાગ્ય પ્રવર્તાવવાની ઉહ્ઘેષણ કરી, એટલે તેમણે વરસીદાન આપી ૬૦૦ રાન્યાઓ સાથે, છઠુતપ સહિત ક્ષાગર વદી અમાસે દીક્ષા અંગીકાર કરી. વાસુપૂજય સ્વામીના વખતમાં ખીજ વાસુદેવ દ્વિપૃષ્ઠ, બળદેવ વિજય અને પ્રતિવાસુદેવ તારક એ ત્રણ શ્લાઘનીય પુરુષો થયા.

એક માસ છદ્રમસ્થપણે રહ્યા પછી, મહા શુદ્ધ ૨ ને દિવસે છફ્ટની તપશ્ચર્યામાં પ્રભુને કૈવલ્યજ્ઞાન થયું. તેમને સૂક્ષ્મ વગેરે ૬૬ ગણુધરો થયા. તેમના સંધ પરિવારમાં ૭૨ હજાર સાંધુ, ૧ લાખ સાંધીએ, ૨૧૫ હજાર શ્રાવકો અને ૪૩૬ હજાર શ્રાવિકાએ હતા. વાસુપૂજય સ્વામી પોતાનો મોક્ષકાળ સમીપ જાણી ચંપા-

નગરીમાં પધાર્યા. ત્યાં ૬૦૦ મુનિ સાથે અનશન તપ કર્યો. એક માસને અંતે અશાડ શુદ્ધ ચૌદરો પ્રભુ મોક્ષપદને માળ્યા. તેમનું કુલ આયુષ્ય ૭૨ લાખ વર્ષનું હતું.

૨૦૨ વિજય બળદેવ.

તેઓ દ્વારકા નગરીના ખલ નામક રાજ અને સુભપ્રા નામની રાણીના પુત્ર તથા દ્વિપૃષ્ઠ વાસુદેવના ઓરમાન ભાઈ હતા. તેઓ ૭૫ લાખ વર્ષનું આયુષ્ય ભોગવી વાસુપૂજ્ય સ્વામીના વખતમાં મોક્ષ ગયા.

૨૦૩ વિમળનાથ.

કાંપિલપુર નગરમાં કૃતવર્મા રાજની શ્યામા નામક રાણીની કુક્ષિએ ૮ મા દેવલોકથી ચ્યાનીને વૈશાક શુદ્ધ બારણે તેઓ ઉત્પત્ત થયા. માતાએ ચૌદ સ્વમ દીહાં. ગર્ભકાળ પૂરો થયે મહા શુદ્ધ ત્રીજે તેમનો જન્મ થયો. માતા પિતાને આનંદ થયો. છિદ્રોએ જન્મોત્સવ ઉજવ્યો. પિતાએ ‘વિમળનાથ’ એવું નામ આપ્યું. યૌવનવય પામતાં અનેક રાજકન્યાઓ તેમને પરણાવવામાં આવી. ૫૮૨ લાખ વર્ષની ઉંમરે તેઓ પિતાની ગાદીએ આવ્યા. ૩૦ લાખ વર્ષ રાજ્ય કર્યું. લોકાંતિક દેવોની પ્રેરણાથી પ્રભુએ વાર્ષિક દાન આપ્યું અને મહા શુદ્ધ ૪ ને દિવસે એક હજાર રાજાઓ સાથે સહસ્રાન્ન ઉદ્ઘાનમાં પ્રભુએ દીક્ષા લીધી. એ વર્ષ ૪૬૮મસ્થ-પણ્યામાં રણા પણી, પોશ શુદ્ધ છટે છટુની તપશ્ચર્યામાં પ્રભુને કૈવલ્ય-રાન થયું. તેમને મંદ્ર વગેરે ૫૭ ગણુધરો થયા. પ્રભુના શાસન પરિવારમાં ૬૮ હજાર સાધુઓ, એક લાખ આઠસો સાધીઓ, ૨ લાખ ૮ હજાર આવડો અને ૪ લાખ ૩૪ હજાર આવિડાઓ હતા. અંત સમયે સમેતશિખર પર છ હજાર સાધુઓ સાથે પ્રભુએ એક માસનું અનશન કરી, અશાડ વદિ ૭ મે સિદ્ધિપદ

પ્રામ કર્યું. વિમળનાથ તીર્થેકરતું એકંદર આયુષ્ય ૬૦ લાખ
વર્ષતું હતું.

૨૦૪ શાલિહીપિતા.

આવરિત નગરીમાં શાલિહીપિતા નામે મહાઋદ્વિવંત ગાથાપતિ
હતા. તેમને ઇલ્લગુની નામે સુશીલ અને સુસ્વરૂપવાન સ્વી હતી. એકદા
પ્રભુ મહાવીર તે નગરીમાં પદ્ધાર્યા. શાલિહીપિતા પ્રભુને વંદન
કરવા ગયા. પ્રભુએ વ્યાખ્યાન આપ્યું. સાધુનો અને આવકનો એમ
એ પ્રકારનાં ધર્મો પ્રભુએ સંભળાવ્યા. શાલિહીપિતાએ વિચાર્યું કે
મહારાથી સાધુધર્મ ગ્રહણ કરી શકાય તેમ નથી. પણ આવક ધર્મ
તો હું જરૂર અંગીકાર કરે. એમ ધારો તેમણે પ્રભુ પાસે આવકના
ઘાર પ્રત ધારણ કર્યા અને ધર્મ ધ્યાનમાં, વ્રતનિયમમાં અડગપણે
રહેવા લાગ્યા. કેટલાક વર્ષ વિત્યાભાદ તેમને ઉપાધિમુક્ત થવાના
ધૂન્ધા થઈ. તેથી ધરનો સધણો કારભાર પોતાના જ્યેષ્ઠ પુત્રને સૌંપી
તેઓ પૌષ્ઠથાળામાં જઈ ધર્મધ્યાન કરવા લાગ્યા.

છેવટે તેમણે આવકની અગીયાર પ્રતિમા ધારણ કરી, સાધુ
જીવન ગાળવું શરૂ કર્યું. તપશ્ચર્યાથી શરીર ક્ષીણ થતાં સંથારો કર્યો.
એક માસનો સંથારો ભોગવી અને આત્માની ઉચ્ચયતમ દશાને
ભાવતાં શાલિહીપિતા કાળધર્મને પામ્યા અને ભરીને ૧૮ દેવલોકમાં
ગયા. લાંથી ચ્યાણી મહાવિદેહમાં અવતરી તેજ ભવમાં તેઓ
મોક્ષ જરૂર.

૨૦૫ શાંતિનાથ.

વર્તમાન ચોવિસોના સોણમા તીર્થેકર અને પાંચમા ચક્રવર્તી
હસ્તિનાપુર નગરના વિશ્વસેન રાજની અચિરા (અચળા) દેવી
રાણીની કુક્ષિમાં સર્વાર્થસિદ્ધ વિમાનમાંથી ચ્યાણીને ઉત્પન્ન થયા.

તે વખતે દેશમાં ભરકી ચાલતી હતી, તે બંધ પડી ગઈ, તેથી તેમનું 'શાંતિનાથ' એવું નામ પાડ્યું. શ્રી શાંતિનાથ પૂર્વભવમાં મેધરથ રાજ હતા, તે વખતે તેમની અહિંસાપ્રિયતાની પ્રશંસા ત્રિભુવનમાં થઈ રહી હતી. ઈદ્રસલામાં તેમની પ્રશંસા થતાં એક ભિથ્યાત્મી દેવે મેધરથની પરીક્ષા કરવા એક પારેવું બનાવી તેમના આશ્રયમાં ઉરાડી મૂક્યું હતું, પાછળથી તે દેવે આજરપ કરી રાજ પાસે પોતાનું લક્ષ્ણ માગ્યું. રાજએ કહ્યું કે શરણાગતને રક્ષણ આપવું, એ મારો ધર્મ છે. બાજપક્ષીએ કહ્યું કે માંસ એ મારો ખોરાક છે. જે પારેવું ન આપી શકે તો તેનાં શરીરના લારોભાર તારા શરીરનું માંસ કાપી આપ. રાજએ તે કણુલ કર્યું. એક બાજુ એક પદ્ધામાં પારેવું મૂક્યું, બીજી તરફ બીજા પદ્ધામાં રાજ છરીવતી પોતાના શરીરનું માંસ કાપીને મૂક્તો, પણ દેવ-માયાથી પારેવાવાળું પલ્લું નીચું જ રહેતું. પ્રણમાં હાહાકાર વર્તાયો. પ્રધાન વગેરેએ રાજને તેમ ન કરવા સમજાવ્યા, પરન્તુ મેધરથરાજ બીજના જીવના બચાવ આગળ પોતાના શરીરને અલ્પ ઉપયોગી ગણુંતા. છેન્ટે રાજના પ્રણામ શુદ્ધ જાણી દેવ પ્રસન્ન થયો. તેણે મેધરથની મારી માગી. રાજએ અનુકૂમે અહિંસાધર્મમાં સર્વોદૃષ્ટ બની દીક્ષા લીધી, અને સખ્ત તપ કરી દેવગતિમાંથી અહિયાં જન્મ લીધો. યુવાનસ્થા પામતાં તેઓ ૧૪૦૦૦ સ્ત્રીઓ પરણ્યા. અને છખંડ સાધી ચક્રવર્તી થયા. તેઓ ૨૫ હજાર વર્ષ કુમારપણે રહ્યા. ૫૦ હજાર વર્ષ ચક્રવર્તીપણે રાજ્ય લોાગ્યું. તે પછી કોકાંતિક દેવોની પ્રેરણાથી વરસીદાન આપી એક હજાર પુરુષો સાથે દીક્ષા લઈ ચાલી નીકળ્યા. સર્વ સમૃદ્ધિનો લાગ કર્યો. સખ્ત તપક્ષયાં કરતાં પ્રલુને એક જ માસને અંતે કૈવલ્યજીવન થયું. તે પછી ચતુર્વિધ સંધની સ્થાપના કરી. તેમને ૬૦ ગણુધરો હતા.

શાંતિનાથ પ્રભુના શાસનપરિવારમાં ૬૨ હજાર સાધુઓ,

૮૬ હજર સાધ્વીઓ,* ૨૬૦ હજર આવકો અને ૩૮૩ હજર આવિકાઓ હતા. ૨૫ હજર વર્ષનું ચારિત્ર પાળી, એક ભાસના અનશને, સમેતશિખર પર ૬૦૦ મુનિઓ સાથે જેઠ વદ્દિ તેરસે પ્રલુબ મોક્ષમાં ગયા.

૨૦૬ શાળીભદ્ર.

રાજગૃહિમાં ગોભદ્ર નામના વિપુલ સંપત્તિશાળી શેડ હતા. તેમને ભદ્રા નામની સુશીલ પત્ની હતી. તેમને એક પુત્ર થયો. નામ પાડ્યું શાળીભદ્ર. તેઓ મહા પ્રજાવંત અને યુદ્ધશાળી હોઈ શ્રીઓ વખતમાં જર કળાઓ શાળી પ્રવિષ્ટ બન્યા. ધૂવાવસ્થા પામતા પિતાએ તેમનું ઉર સ્વરંપવાન કન્યાઓ સાથે લમ કર્યું. સ્ત્રીઓ સાથે સાંસારિક સુખો લોગવતાં દિવસ કે રાત્રિ ક્રેવી રીતે પસાર થાય છે, તે પણ તેઓ જાણુતા ન હતા; અર્થાત્ તેમને ત્યાં દુઃખ ક્રેવી વસ્તુનું નામ નિશાન ન હતું. કેટલેક કાળે ગોભદ્ર શેડ દીક્ષા લઈ મૃત્યુ પામ્યા અને દેવકોકમાં ગયા. તેમને પુત્ર પર અતિશય સ્નેહ હોવાથી શાળીભદ્ર અને તેની પત્નીઓના લોગોપલોગ માટે હમેશાં તેઓ વસ્તુ, ધરેણું અને મીઠાઈ-ઓથી ભરેલી ૮૮ પેટીઓ મોકલાવતા. શાળીભદ્ર દેવ જેવું સુખ લોગવતા, અને લાવવા લઈ જવા વગેરેનું સર્વ ગૃહકાર્ય લદ્રા-માતા કરતાં.

એક દિવસ ક્રેદી એક વેપારી રતની કંંખોના લઈને રાજ-ગૃહમાં વેચવા આવ્યો. તે કંંખોના અહુમૂલ્યવાન હોવાથી શહેરનો ધનિક વર્ગ તો ન ખરીદી શક્યો, એટલું જ નહિ પણ રાજગૃહના રાજ શ્રેણીઝે પણ તે રતન કંંખોના ખરીદી નહિ. વેપારી નિરાશ

* ધીન એક પુસ્તકમાં ૬૧ હજર છસો સાધ્વીઓ અને ૩ લાખ ૬૩ હજર આવિકાઓ લખેલ છે.

થઈ શાળીભરના મહેલ આગળ નીકલ્યો. ભદ્રા ભાતાએ તે વેપારોની સંઘળી કંંખળો ખરીદી લીધી. વેપારી શેડની ઝાંઢિ જેઠને અજાયથ થયો.

બીજે દિવસે શ્રેણિક નૃપતિની રાણી ચેષ્ટણું તે રનકંખળ કેવાનો રાજને આગ્રહ કર્યો. એટલે રાજાએ તે વેપારીને બોલાવ્યો, પરન્તુ રાજાએ જાણ્યું કે શાળીભર શેડની ભાતાએ બધી કંંખળો ખરીદી લીધી છે! આ જાણી રાજના આશ્રયનો પાર ન રહ્યો કે પોતાના નગરમાં આવા સમૃદ્ધિશાળી રતનો અસ્તિત્વ ધરાવે છે. ત્યારપણી તેમાંની એક કંંખળ રાણી માટે લઈ આવવા રાજાએ અભયકુમારને શાળીભરને ધેર મોકલ્યા. ભદ્રાએ મંત્રીનો ભાવપૂર્વક સત્કાર કરતાં કહ્યું કે મંત્રીજી, ધન્ય લાગ્ય અમારાં કે આપે અમારે ત્યાં પગલાં કર્યા, પરન્તુ દીલગીર છું કે તે કંંખળો શાળીભરની સ્ત્રીઓએ સનાન કર્યા પછી, તે વડે અંગ લૂછીને ગરરમાં ફેંકી દીધી છે. આ સાંભળતાં અભયકુમારના આશ્રયનો પણ પાર રહ્યો નહિ. તેણે સંઘળી વાત શ્રેણિક રાજને કહી. શ્રેણિક શાળીભરનો આવાસ જેવા જવાનો વિચાર કર્યો, તેથી તેઓ શાળીભરને ધેર આવ્યા. મહારાજ તથા મંત્રીશર વગેરેનું ઉચ્ચિત સ્વાગત કરી ભદ્રાએ તેમને ચોગ્ય આસને એસાડ્યા. શ્રેણિક શાળીભરના મુખદર્શનની ઈચ્છા વ્યક્ત કરી, એટલે ભદ્રાભાતા ઉંચા પ્રાસાદના છેક ઉપરના લાગમાં શાળીભર પાસે ગયા અને કહ્યું:—ભાઈ! આપણે ત્યાં શ્રેણિક આવ્યા છે તો નીચે આવો. જેમને દુનિયાનો લેશ પણ ખ્યાલ નથી એવા શાળીભરે ભાતાનું વચ્ચન સાંભળીને કહ્યું: ભાતાજ! શ્રેણિક આવ્યા હોય તો નાખો વખારે, એમાં મને પૂછવા જેવું શું હોય? ભદ્રા સમજ્યા કે શાળીભરને શ્રેણિક કોણ છે તેની ખખર નથી. એટલે તેમણે કહ્યું:—ભાઈ, શ્રેણિક મહારાજ! રાજગૃહના ભૂપતિ, આપણા ભાલીક પદ્ધાર્યા છે. શાળીભર આ સાંભળી ચમક્યા. તેઓ વિચારમાં પડ્યા કે મહારે આટાટલી સાચ્ચબી, છતાં શું મહારે ભાથે ભાલીક?

હું માલીક વગરનો કેમ બનું ? એમ વિચાર કરતાં તેઓ વૈરાગ્ય વાન બન્યા. થોડીવારે તેઓ રાજ પાસે આવી પ્રણામ કરી ચોગ્ય આસને એડા. રાજ શ્રેણીક શાળીભદ્રનું મુખ, તેમની રિષ્ટ્છ સિદ્ધિ, વગેરે જોઈ આનંદ પામ્યા અને રજ લઈ સ્વર્થાનકે ગયા.

કેટલાક સમય પછી ત્યાં ધર્મધોષ નામના સ્થવીર મહાત્મા પધાર્યા. તેમનું વ્યાખ્યાન સાંભળી શાળીભદ્રે દીક્ષા કેવાનો વિચાર કર્યો, અને ભાતા પાસે રજ ભાગી. ભાતાએ તેમને ધીમે ધીમે ત્યાગવૃત્તિ કેળવવાનું કહ્યું, એટલે ભાતાના સ્નેહને વશ થઈ શાળીભદ્ર દરરોજ એક એક સ્વીનો ત્યાગ કરવા લાગ્યાઃ તેવામાં તેમના બનેવી ધજાએ આવી તેમને ચેતવ્યા અને કહ્યું કે ઉડો, સાવધાન થાવ. રોજ એક એક સ્વીને ત્યાગવાની કાયરતા વીર પુરુષને સંભવે નહિ, હું આઉદ્ય સ્વીચ્છાને ત્યાગીને ચારિત્રક્ષેવા માટે ઉદ્ઘૂરુત થયો છું. આ સાંભળી શાળીભદ્રના જ્ઞાનયક્ષુએ સતેજ થયાં. તેઓ ધજા સાથે ત્યાં બિરાજમાન પ્રલુબ મહાવીર પાસે ગયા અને દીક્ષા લીધી. સખ્ત તપ જ્યે કિયાએ કરી, અંતિમ સમયે વૈભારગીરી પર અનશન કરી શાળીભદ્ર સર્વાર્થસિદ્ધ વિમાનમાં દેવ થયા.

૨૦૭ શિવરાજ ઋષિ.

હસ્તિનાપુરના શિવ નામના રાજાએ, પોતાના પુત્ર શિવભદ્રને રાજ્ય સોંપી, તામલીની માઝક તાપસ દીક્ષા અંગીકાર કરી, અને યાવનજીવ છઠું છઠુની તપસ્થા કરતા વિચરવા લાગ્યા. ઉથ તપશ્રથ્યાને લીધે તેમને વિલંગજ્ઞાન ઉત્પત્ત થયું, જે વડે તેમણે સાત સમુદ્રો અને સાત દ્વાપો જેયાં. આથી તેમણે પોતે જેયેલી વર્સુથી જગત પર કાંઈ વધારે નથી એવી પ્રરૂપણા કરવા માંડી. એવામાં બીજો મહાવીર હસ્તિનાપુરમાં પધાર્યા. ગૌતમ સ્વામી ગામભાં ગોચરી કરવા નીકળ્યા; ત્યાં લોકોના મુખે તેમણે શિવરાજની પ્રરૂપણા સાંભળી.

અગવાનને મૂળતાં તેમણે કહ્યું કે દીપ સંમુદ્રો સાત નથી, પણ અસંઘાતા છે. આથી ગૌતમે કોડોને સત્ય સમજાવ્યું. એટલે શિવરાજ પ્રભુ મહાવીર પાસે આવ્યા. મોટી ધર્મસલા સમક્ષ અગવાને દેશના આપી, તેમાં શિવરાજનો સંશય ટલ્યો, તેથી તેમણે આરાધક બની અગવાન પાસે દીક્ષા લીધી; અને તેજ ભવમાં તેઓ મોક્ષે ગયા.

૨૦૮ શ્રી દેવી

રાજગૃહ નગરમાં સુદર્શન નામે મહાઋદ્વિવંત ગાથાપતિ રહેતો હતો, તેને પ્રિયા નામે સ્ત્રી હતી. તેનાથી તેને એક પુત્રી થઈ હતી. તેનું નામ ભૂતા. ભૂતા જન્મથીજ વૃદ્ધ જેવી, કુમારપણામાં પણ વૃદ્ધ જેવી દેખાતી. શરીર પણ જરૂર જેવું, તેથી ક્રાઈપણ પુરુષ તેને પરણ્યો નહિએ. તે સમયે પાર્વતીનાથ પ્રભુ પધાર્યા. ભૂતા વંદન કરવા ગઈ. પ્રભુના ઉપહેશથી વૈરાગ્ય પામીને ભૂતાએ દીક્ષા લીધી અને પુણ્યચુલા નામે સાધીજીની શિષ્યા થઈ. સમય જતાં ભૂતા શિથિલાચારી બનવા લાગી. હાથપગ મરતક મોહું વગેરે વારંવાર ધોવા લાગી, અને એ રીતે શરીરની શુશ્રૂષા કરવા લાગી. પુણ્યચુલા સાધીજીએ તેને સાધુનો ધર્મ સમજાવીને તેમ ન કરવા સૂચાવ્યું. અને પ્રાયશ્રિત કેવાનું કહ્યું છતાં ભૂતાએ તે ગણુકાર્યું નહિ, અને તેમનાથી જુદી પડીને એક જુદા ઉપાશ્રયમાં સ્વર્ચંદ્રપણે વિચરવા લાગી. લાં છઠ અહુમ આદિ તપશ્ચર્યા કરતાં કરતાં ધણ્યા વર્ષ સંયમ પાળી, કાળકરીને તે સૌધર્મ દેવકોકમાં દેવીપણે ઉમત થઈ, ત્યાંથી મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈ. દીક્ષિત બનીને આખરે તે સિદ્ધગતિને પામશે,

૨૦૯ શિતળનાથ

અદ્વિતીપુર નગરના દફરથ રાજની નંદાદેવી નામક રાણીની કુલ્લિભાં દશમા દેવકોકથી ચ્યવી, વૈશાક વદિ ૧ની રાત્રીએ પ્રભુ ઉત્પન્ન થયા. માતાએ ચૌદ સ્વર્જ જેયાં. અનુકમે મહાવદિ ૧૨ ના રોજ

પ્રભુનો જન્મ થયો. ધર્મોચે જન્મોત્સવ ઉજવ્યો. પ્રભુ ગર્ભમાં હતા ત્યારે રાજનું તમ થયેલું શરીર નંદાહેવીના સ્પર્શથી શિતળ થયું હતું, તેથી પુત્રનું શિતળનાથ એવું નામ આપ્યું. બાલ્યકાળ વીતાવી તેઓ ચુવાવરથા પાંચા લારે પોતાની અનિચ્છા છતાં પિતાના આગ્રહે તેમણે લગે કર્યું. ત્યારાદ ૨૫ હજાર પૂર્વની ઉમરે તેઓ રાજ્યાસને એડા. ૫૦ હજાર પૂર્વ સુધી રાજ્ય ભોગવ્યું. પછી વાર્ષિક દાન આપી મહા વદિ બારશે એક હજાર રાજાઓ સાથે પ્રભુએ સંયમ ગ્રહણ કર્યો. માત્ર ત્રણ માસ છદ્મસ્થપણામાં રહ્યા પછી શિતળનાથ સ્વામીને પોશ વદિ ૧૪ ના રોજ કૈવલ્યજીન થયું. તેમને આનંદ વગેરે ૮૧ ગણુધરો હતા.

પ્રભુના સંઘપરિવારમાં ૧ લાખ મુનિ, ૧ લાખને ૬ સાધ્વીઓ, ૨૮૮ હજાર શ્રાવકો અને ૪૫૮ હજાર આવિકાઓ હતા. અંતિમ સમયે સમેત શિખર પર એક હજાર મુનિઓ સાથે, એક માસનું અનશન પાળી વૈશાક્વદિ બીજે પ્રભુ નિર્વાણ-મોક્ષ પધાર્યા. શિતળનાથ જિનનું એકંદર આયુષ્ય એક લાખ પૂર્વનું હતું.

૨૧૦ શ્રેયાંસનાથ

સિંહપુર નગરના વિષણુરાજ રાજની વિષણુ નામક રાણીની કુક્ષિમાં ઉમા દેવલોકથી ચ્યાવીને જેઠવદિ છે તેઓ ઉમન થયા. માતાએ ચૌદ સ્વખન દીઠાં. ગર્ભકાળ પૂરો થયે દ્વારાણ વદિ ૧૨ પ્રભુનો જન્મ થયો. ધર્મોચે જન્મોત્સવ કર્યો. યૌવનાવરસ્થામાં તેઓ અનેક રાજકન્યાઓ પરણ્યા. પછી લોકાંતિક દેવોની પ્રેરણાથી વરસીદાન આપી, ૧ હજાર રાજાઓ સાથે દ્વારાણ વદિ ૧૩ સંયમ અંગીકાર કર્યો. તેઓ ૨૧ લાખ વર્ષ કુમારપણે રહ્યા; ૪૨ લાખ વર્ષ રાજ્ય કર્યું. ૭ માસ છદ્મસ્થાવરસ્થામાં રહ્યા પછી મહા વદિ અમાસે પ્રભુને કૈવલ્ય જીન થયું. ૨૧ લાખ વર્ષમાં એ માસ ઓછા સમય સુધી કૈવલ્ય પ્રજન્યામા વિચરી વણ્ણા જીવોનો પ્રભુએ ઉદ્ધાર કર્યો. છેવટે એક હજાર

મુનિઓ સાથે, સમેતશિખર પર એક ભાસના અનશને આવણું વહિ ત્રીજે પ્રલુબ મોક્ષ પહેંચ્યા. તેમનું કુલ આયુષ્ય ૮૪ લાખ વર્ષનું હતું.

શ્રેયાંસનાથ સ્વામીના સંધ પરિવારમાં ૮૪ હજાર સાધુઓએ ૧૦૩ હજાર સાધ્વીઓ, ૨૭૬ હજાર શ્રાવકો અને ૪૪૮ હજાર શ્રાવકાઓ હતા.

૨૧૧ શ્રેયાંસકુમાર.

કૃપલદેવ ભગવાનના પુત્ર બાહુબળ; અને બાહુબળના પુત્ર સોમપ્રલ, જેઓ હસ્તિનાપુરના રાજ હતા, તેમને શ્રેયાંસકુમાર નામે પુત્ર થયો હતો. આદિનાથ પ્રલુબે દીક્ષા લીધા પછી, આહાર આપવાને વિધિ કોકો જાણુતા ન હોવાથી ભગવાનને એક વરસ સુધી આહાર મળ્યો નહિ. પ્રલુબ કૃતા કૃતા ગજપુર-હસ્તિનાપુરમાં પધાર્યા, કોકો પ્રલુને જુદી જુદી વસ્તુઓ લેટ ધરતા, તે પ્રલુબ કેતા ન હતા. આથી કોકોમાં ઝાલાહલ થયો. તે શ્રેયાંસકુમારના જાણવામાં આવ્યું; એટલે પ્રલુબ પધાર્યા જાણી તે હર્ષભેર પ્રલુબ પાસે હોડી ગયા. પ્રલુનું સ્વરૂપ જોતાં ‘પૂર્વે મેં આવું ક્યાંક દીકું છે’ એમ વિચારતાં તેમને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. એ અરસામાં પોતાને ત્યાં શેરડીનો રસ આવ્યો, તે નિર્દોષ હોવાથી તેમણે પ્રલુને વહેરાવ્યો. પ્રલુબે તે હસ્તપાત્રમાં લઈ, તેનું પાન કરી પારણું કર્યું. શ્રેયાંસકુમારની સર્વત્ર પ્રશંસા થઈ, તે દિવસ વૈશાક શુદ્ધ ત્રીજનો હતો, જેને લઈ આજે જૈતધરીઓ વરસી તપનું પારણું તે દિવસે કરે છે, જેને અક્ષય તૃત્યા કહે છે. શ્રેયાંસકુમાર સુપાત્ર દાનના પ્રલાવે સહગતિ પામ્યા.

૨૧૨ શ્રેણીકરાજ (બિંધીસાર).

કુશાગ્રપુરના રાજ પ્રસેજનિતનો સૌથી નાનો કુમાર, તે શ્રેણીક. તેમની ભાતાનું નામ ધારિણી. ભાઈઓની ધર્મને લીધે તેઓ

કુશાગ્રપુર છોડીને વેણુાતટ નગરમાં ગયા. ત્યાં પુષ્યયોગે ભર નામના એક શ્રેષ્ઠિયે તેમને પરોણા તરીકે રાજ્યા, એટલું જ નહિ પણ શ્રેણ્યિક રાજની સરળતા, ખુદ્ધિમતા તથા મુખની તેજસ્વીતા આદિ જોઈ ભર શેડે શ્રેણ્યિકને પોતાની નંદા નામની પુત્રી પરણાવી. પ્રસેનજીત રાજ પાછળથી રાજગૃહ નગર વસાવી ત્યાં રહેવા લાગ્યા. તેવામાં તે માંદા પડ્યા. આ સમાચાર શ્રેણ્યિકે સાંબળ્યા, તેથી તે પોતાના પિતા પાસે શાધ જઈ પહેંચ્યા. પિતાને તેમના પર પ્રેમ હોવાથી રાજગૃહનું રાજ્ય શ્રેણ્યિકને સેંપી, તેઓ સ્વર્ગવાસ પામ્યા. આ વખતે નંદા ગર્ભવતી હોવાથી તેણીએ ‘અભયકુમાર’ નામના મહા ખુદ્ધિવંત પુત્રનો જન્મ આપ્યો. ગાઢીએ એડા પછી શ્રેણ્યિકે રાજ્યમાં ઘણો વધારો કર્યો અને તે મહર્દીક રાજ થયો. તેને ચિલ્દણ્ણા, નંદા, ધારિણી, કાલી વગેરે ઘણી રાણીએ હતી; તથા અભયકુમાર, ક્રેણિક, કાલી, મેધ આદિ ઘણા કુમારો હતા. શ્રેણ્યિક પહેલાં બૌદ્ધધર્મના ઉપાસક હતા, પરન્તુ પાછળથી અનાથી મુનિના સંસર્ગ તેઓ જૈનધર્મ અન્યા. લ૦ મહાવીરના તેઓ પરમ લક્ષ્ય હતા; તેમજ દદ સમક્રિતી હતા; તેમણે પોતાના રાજ્યમાં કસાઈની દુકાનો બંધ કરાવી હતી.

એક વખત દેવે શ્રેણ્યિકની પરીક્ષા કરવા માંસાહારી જૈન-સાધુ અને સગર્ભા જૈન સાધ્વીનો દેખાવ રજુ કર્યો, પણ શ્રેણ્યિક ડગ્યા નહિ. તેમના પુત્રોમાંના મેધકુમાર, નંદિષેણ, અભયકુમાર, જાલી વગેરે ઘણુએએ દીક્ષા લીધી હતી. કાલી, નંદા વગેરે રાણીએ પણ દીક્ષા લીધી હતી. આખર અવસ્થામાં દુર્ભુદ્ધ ક્રેણિકે શ્રેણ્યિકને કેદમાં પૂર્ણ હતા. પુત્રના હાથથી મૃત્યુ ન પામવા માટે શ્રેણ્યિકે પોતાની મુદ્રિકામાં રહેલ કાલકુટ વિષ ચૂસીને પોતાના ફેદનો અંત આપ્યો હતો. તેમણે મૃગલીના શિકાર વખતે નિકાયિત કર્મનો બંધ કર્યો હોવાથી મૃત્યુ પામીને તેઓ પહેલી નરકે ગયા, પરન્તુ

તेमણે શાસનની ભક્તિથી તીર્થેકર નામ કર્મ ઉપાજ્ઞન કર્યું હતું, તેથી તેઓ આવતી ચોવિસીમાં પહેલાં નામના પહેલા તીર્થેકર થશે.

૨૧૩ શાંખરાજા

તે કાશીદેશની વારાણસી નગરીના રાજ હતા. પૂર્વલવમાં મહાઅલના પુરણું નામના તે મિત્ર હતા; અને સંયમ પાળી જ્યંત વિમાનમાં ગયા હતા. ત્યાંથી ચ્યાવી અહિં ઉત્પન્ન થયા હતા. એકવાર અહિંનક નામના વેપારીએ ભિથિલાના કુંભરાજને મહીકુંવરી માટે એ દિવ્ય કુંડલો લેટ આપ્યા હતા, તેમાંના એક કુંડલની સાંધ તૂઠી જવાથી કુંભરાજએ તે સાંધી આપવા માટે ભિથિલાના સોનીઓને બોલાવ્યા, પણ તેમાંના ડોઈ આ સાંધ સાંધી શક્યા નહિ, આથી રાજએ ગુસ્સે થધને સોનીઓને દેશનિકાલ કર્યા. તેઓ ઇરતા ઇરતા વારાણસી નગરીમાં આવ્યા અને લાં રહેવા માટે રાજની આજા માગી. રાજએ કારણ પૂછતાં તેમણે સર્વ હકીકત કહીને મહીકુંવરીના ઇપનું વર્ણન કર્યું. આથી તે કુંવરીને પરણવા માટે શાંખ રાજએ હૃત મોકલી કુંભરાજને કહેણું મોકલ્યું. રાજએ ન માન્યું, એટલે શાંખે, જિતશત્રુ વગેરે રાજએ સાથે સંધી કરીને ભિથિલાને વેરો ધાલ્યો. આખરે મહીકુંવરીની યુક્તિથી તેઓ બોધ પામ્યા અને દીક્ષા લઈ, સખત તપક્ષર્યા કરી મોકશમાં ગયા.

૨૧૪ શાંખ અને પોખલી

શ્રાવસ્તિ નગરીમાં શાંખ અને પોખલી નામના એ ધનાઢ્ય શ્રાવક્રો વસતા હતા. તેઓ જીવ અજીવ આદિ નવતરત્વના જાણ તથા ધર્મિષ અને ક્ષમાની મૂર્તિસમા હતા; તેઓ બંને સ. મહાવીરના અનન્ય ઉપાસક હતા.

એકવાર પ્રભુ મહાવીર તે શ્રાવસ્તિમાં પધાર્યા. પરિપદ વંદન

કરવા ગઈ. તેમાં શંખ અને પોખ્લી આદિ આવકો પણ ગયા. પ્રભુએ દેશના આપી. સહભોગ સાંલળી સૌ પાછા કર્યાં. તે વખતે રસ્તામાં શંખ આવકે પોખ્લી આદિ ખીજ આવકોને કહ્યું કે તુમે વિરસીણું અજ, પાણી, મેવા, સુખડી આદિ ચાર પ્રકારના લોજન કરાવો: ને જમ્યાબાદ આપણે પાક્ષિક પૌષ્ઠ કરી ધર્મ જગ્યાકા કરીશું. શંખનું કહેવું સૌએ કખુલ કર્યું. તે પછી તેઓએ ચાર પ્રકારનું અજ નીપગળવ્યું અને સમય થતાં શંખ આવકના આગમનની વાટ જેવા લાગ્યા.

ખીજ તરફ શંખ આવકે ઘેર જઈને વિચાર કર્યો કે પૌષ્ઠ નિમિત્ત આવો સમારંભ કરાવવો યોગ્ય નહિ, તેમજ ભારે પદાર્થો ખાઈને પૌષ્ઠ કરવો ઉચ્ચિત નથી. પણ સર્વ આભરણુ, વિકેપન, છોડીને, કોધ કષાય રહિત, અલયર્યું સહિત, દાલની પથારી પર એસીને ધર્મધ્યાન ભાવતાં પૌષ્ઠ કરવો ઉચ્ચિત છે. એમ વિચારી તેઓ જમવાના સ્થાને ન જતાં, પોતાની સ્ત્રીને કહીને પૌષ્ઠશાળામાં ગયા અને પૌષ્ઠ ગ્રહણ કરીને આત્મ ભાવના ભાવવા લાગ્યા.

વખત થઈ જવા છતાં શંખશ્રાવક જમવા ન આવ્યાથી અન્ય આવકોની રજી લઈ પોખ્લી આવક શંખને ઘેર આવ્યા. તેમને જોઈ શંખની પતનીએ તેમનો આદર સત્કાર કર્યો અને કહ્યું કે શંખજીએ પૌષ્ઠ કર્યો છે. આ સાંલળી પોખ્લી આવક શંખ પાસે પૌષ્ઠશાળામાં ગયા. લાં કેટલીક વાતચિત કરી, શંખ પૌષ્ઠમાં હોવાથી પોખ્લી ચાલ્યા ગયા. રાતે શંખ આવકે વિચાર કર્યો કે ભારે લગવાનના દર્શન કર્યો પછીજ પૌષ્ઠ પારવો. આથી પ્રાતઃકાળ થતાં તે પ્રભુના દર્શને ગયા, જ્યાં પોખ્લી આદિ આવકોથી પરિપદ ચિકાર હતી. પ્રભુએ દેશના આપી. દેશનાને અંતે પોખ્લીએ શંખને કહ્યું કે તુમે ગઈકાલ જમવા ન આવ્યા, ભારે અમે તમારી નિંદા કરીશું. આ સાંલળી પ્રભુએ કહ્યું: હે દેવાનુપ્રિય, શંખ આવક નિંદવા લાયક નથી. તે ધર્મમાં દદ છે. પ્રમાદ, નિદ્રા રહિત તે ધર્મજગ્યાકા કરનાર

છે. તેના વિચારો કપટ યુક્ત ન હતા; પણ ધર્મભય હતા. આ સાંભળી સર્વ આવકોએ શાંખજીની ક્ષમા માગી. તે પછી લગવાનને શાંખ-જીએ કેટલાક પ્રમેલા પૂછી ખુલાસા મેળવ્યા, અને પ્રલુને વંદન કરી ઘેર ગયા.

આ વખતે શ્રી ગૌતમે લગવાનને પૂછ્યું:-હે પ્રલુ, શાંખ આવક સાધુ થશે? પ્રલુએ કહ્યું:-ના. શ્રી ગૌતમે પૂછ્યું:-ત્યારે તેઓ ગૃહસ્થ-પણામાં કાળધર્મ પામી કયાં જશે? શ્રી પ્રલુએ કહ્યું કે તેઓ દેવ-ગતિમાં જશે અને ત્યાંથી મહાવિદેહમાં જન્મ લઈ તેજ લવમાં મોક્ષ જશે.

૨૧૫ સદાલપુત્ર (સકડાલપુત્ર)

પોલાસપુર નગરમાં ગોશાળાના ભતનો ઉપાસક સદાલપુત્ર નામે એક કુંભાર રહેતો. તેને એક કોડ સોનામહોર જમીનમાં, એક કોડ વ્યાપારમાં અને એક કોડ ધર વખરામાં એ રીતે ત્રણ કોડ સોનામહોરો હતી. દશ હજાર ગાયોનું એક ગોકુળ તેને ત્યાં હતું. તે મહા ઋદ્ધિવંત હતો. તેને કુંભારના ધંધાની પાંચસો દુકાનો હતી. અગ્રભિત્રા નામની સુશીલ અને સુસ્વરઙ્ગવાન સ્વી હતી. આ સર્વ સુખભય સામગ્રીમાં સદાલપુત્ર સમય વ્યતીત કરતો હતો. એક સમયે સદાલપુત્ર પોતાની અશોક વાડીમાં આવી ગોશાળાના કહેલા ધર્મની ચિંતવણા કરતો હતો, તે સમયે એક દેવ તેની પાસે આવ્યો અને કહેવા લાગ્યો. હે સદાલપુત્ર, આવતી કાલે સવારમાં ત્રિકાળજીની શ્રી અર્હત-નિનેશ્વર અહિં આવશે, માટે તું તેમની સેવા અકિત બરાબર કરનો, તથા પ્રલુને પાટ પાટલા મકાન વગેરે ને જોઈએ તે આપનો. એટલું કહીને દેવ ત્યાંથી ચાલ્યો ગયો. સદાલપુત્રે વિચાર કર્યો કે અહારા ધર્મચાર્ય મહા રૂન ધારક.

ગોશાલક ભંખલીપુત્ર આવશે, માટે હું તેમને વંદન કરીને સેવા જાહેર કરીશ.

ગ્રાતઃકાળ થયો. પ્રભુ મહાવીર તે નગરના ઉદ્ઘાનમાં પધાર્યા. સહાલપુત્રે વાત જણ્ણી, તેથી તે પરીવાર સહિત પ્રભુને વાંદવા ગયો. પ્રભુએ દેશના આપી. પ્રભુ જણુતા હતા કે સહાલપુત્ર ગોશાલકના ભતનો અનુયાયી છે અને કે વસ્તુ બનવાની હોય છે તેજ બને છે, તેમ માનનારો છે; પણ ઉદ્ઘાન, પુરુષાર્થને માનતો નથી. તેથી સહાલપુત્રને સમજવવા પ્રભુ મહાવીર તેને ત્યાં ગયા. અને ત્યાં પડેલા માટીના ધડા સહાલપુત્રને બતાવીને કહ્યું:-ણુઓ, આ માટીના ધડા શા રીતે બન્યા ? સહાલ પુત્રે કહ્યું, પ્રભુ, એતો બનવાના હતા ને બન્યા. પ્રભુએ કહ્યું, ઉદ્ઘાન કરવાથી થયાને ? ત્યારે સહાલપુત્રે જવાબ આપ્યો:-પ્રભુ, જગતમાંને બનવાનું હોય છે તે કુદરતી રીતે બન્યેજ જાય છે, તેમાં પુરુષાર્થને કાંઈ લાગતું વળગતું નથી. સહાલપુત્રને પ્રભુએ સમજવવાનો ગ્રયતન કર્યો છતાંતે સમજ્યો નહિ. તેથી દ્રીથા પ્રભુએ ગ્રશ કર્યો:-ને કોઈ પુરુષ તહારા માટીના વાસણેને ફાડી નાખે, અથવા તહારી સ્વી સાથે લોગવિલાસ કરે તો તું શું કરે ? સહાલપુત્રે કહ્યું:-“ હું તેને પૂરતી શિક્ષા કરું. ” પ્રભુએ કહ્યું. શિક્ષા કરવાનું કાંઈ કારણ ? ને બનવાનું છે તે બન્યેજ જાય છે ને ! સહાલપુત્ર તરત ચ્યમકયો. તેણે પ્રભુ મહાવીરની વાત સત્ય માની, અને પુરુષાર્થને માનનારો થયો. પ્રભુએ તેને ધર્મ સંભળાવ્યો. સહાલપુત્ર બારવતધારી શ્રાવક થયો. આ વાતની ગોશાલકને ખરર પડી. તેથી તે સહાલપુત્ર પાસે આવ્યો. પોતાના ભતને મનાવવા તેણે ધણ્ણા ગ્રયતન કર્યા, પણ તે સર્વ હૈગાટ ગયા. એકવાર સહાલપુત્ર પૌષ્પધશાળામાં ધર્મધ્યાન કરતો હતો, તે વખતે અર્ધ રાત્રીએ એક દ્રોવ આવ્યો, તેણે લયંકર રૂપો કરી સહાલપુત્રને ધર્મથી ચણાવવા ધણ્ણા ગ્રયતનો કર્યા; છતાં સહાલપુત્ર ડંયો નહિ. સહાલપુત્રના તેણે પુત્રોને

લાવી દેવે તેમનો સંહાર કર્યો, છતાં તે જરા પણ ઉચ્ચો નહિ. છેવટે દેવે તેની સ્ત્રીને મારી નાખીને તેનું ભાંસ તળી તેના શરીરપર કોઈ છાંટવાનો લય જ્યારે બતાવ્યો, ત્યારે સદ્ગલપુત્રને ધાણું જ લાગી આવ્યું; તેથી તે દેવને પકડવા ઉછ્યો, તરત જ દેવ નાસી ગયો અને સદ્ગલપુત્રના હાથમાં એક સ્તંભ આવ્યો. સદ્ગલપુત્રે કોલાહલ કર્યો. આ સાંલળી તેની સ્ત્રી દોડી આવી. સદ્ગલપુત્રે હકીકત ઝડી. એ સર્વ દેવની માયા હોવાનું તેની સ્ત્રીએ કહેવાથી સદ્ગલપુત્રે પ્રાયશ્રિત લીધું. તે પછી ૧૧ પ્રતિમા ધારણ કરીને, એક માસનો સંથારો ભોગવી, સદ્ગલપુત્ર કાળ ધર્મ પામ્યા, અને મરીને પહેલા દેવલોકમાં ગયા. ત્યાંથી ચ્યારી મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈ તેજ ભવમાં તેઓ મોક્ષ જરો.

૨૧૬ સનંતકુમાર ચક્રવર્તી.

હસ્તીનાપુર નગર હતું. ત્યાં અશ્વસેન નામે રાજ રાજ્ય કરતો હતો. તેને સહદેવી નામે સુસ્વરશ્વરાન રાણી હતી. એક રાત્રીએ આ રાણીએ ચૌદ સ્વખ જોયાં. તરત રાણી જાગૃત થર્ધ અને દીકેલ સ્વખનનું રચણ કરવા લાગી. પ્રભાત થતાં રાણીએ રાજ પાસે જઈને સ્વખનની વાત કરી. રાજએ સ્વખનપાડકોને ઓલાવી સ્વખનનું ઇળ પૂછ્યું. સ્વખ પાડકોએ કહ્યું કે ચૌદ પ્રકારના સ્વખો તીર્થેકરની માતાને કે ચક્રવર્તીની માતાનેજ આવે. તેથી તમારે ત્યાં એક ભાગ્યશાળી પુત્ર અવતરશે. કાંતો તે તીર્થેકર થશે, અગર ચક્રવર્તી થશે. રાજએ સ્વખનપાડકોને પુષ્કળ દ્રવ્ય આપી વિદાય કર્યો.

અનુક્રમે નવમાસ પૂર્ણ થયે સહદેવી રાણીએ એક તેજસ્વી, દૈદિયમાન પુત્રનો જન્મ આયો. રાજએ કુમારનો જન્મોત્ಸવ ધામ-ધૂમપૂર્વક ઉજવ્યો. રાજને રિદ્ધિ સિદ્ધિનો પાર ન હતો, તેથી તેણે ગરોઅ ગુરાધારાને ઘૂણ દાન દીધું અને પુત્રનું ‘સનંતકુમાર’ એવું નામ પાડ્યું.

સનંતકુમાર આનંદપૂર્વક વૃદ્ધિ પામ્યા. કેટલાક વખત પછી ઝૂતાપિતાના મૃત્યુ ખાદ તે રાજ્યાસન પર આવ્યા. આવતાંજ તેમણે અનેક દેશોપર લડાઈ શરૂ કરી. મોટા મોટા રાજ્યોને હરાવી તેમણે છ ખંડ ધરતીમાં ચોતરણ પોતાની આણ વરતાવી. કેમકે ચક્રવર્તીને ચક્રરત્ન, છત્રરત્ન આવ્યિ નવરત્નનો, તથા દેવો વગેરે સહાય હોય છે. આવી રીતે ચક્રવર્તી થર્ફ ને તેઓ સુખપૂર્વક રાજ્યમાટી ભોગવવા લાગ્યા.

સનંતકુમારનું શારીરિક રૂપ અદ્ભુત હતું. તેમના રૂપની જોડી સારાયે જગતમાં પણ ન મળે. એકવાર સુધર્મ દેવદ્યોકમાં સભા હતી, તેમાં ઈદ્ર મહારાજાએ સનંતકુમારના રૂપની ધણ્યોજ પ્રશંસા કરી. તેમાંના એક દેવને અતિશયોક્તિ લાગવાથી તે સનંતકુમારનું રૂપ જોવાનો વિચાર કરી એક વ્યાખ્યાણનું રૂપ ધરીને સનંતકુમારને જોવા આવ્યો. આ વખતે સનંતકુમાર સનાન કરતા હતા, અને નહાવાના કેટલાક પદાર્થો ચોપડવાથી તેનનું શરીર જોઈએ તેવું સુંદર ન હતું, છતાં તેવું શરીર દેખીને પણ આ દેવના આશ્રયનો પાર ન રહ્યો. સનંતકુમારે આ વ્યાખ્યાણને જોઈને પૂછ્યું:-મહારાજ, કેમ પધારવું થયું છે? વ્યાખ્યાણ જવાબ આપ્યો:-મહારાજ! મેં સાંભળ્યું હતું કે આપનું રૂપ બહુ તેજસ્વી અને સુંદર છે, તેથી જોવા માટે હું અત્રે આવ્યો છું, અને ખરેખર મેં સાંભળ્યું હતું તેથી ઓછું નહિ પણ વિશેષ દેહિભ્રમાન આપનું રૂપ અને કાંતિ છે. આ સાંભળી સનંતકુમારને અલિમાન આવ્યું અને ઓલ્યા:-મહારાજ, અસારે તો હું સનાન કરું છું અને શરીરે લેપ કરેલો છે, પરન્તુ હું વખ્તાલુષણો સજી જ્યારે રાજ્યસભામાં આવું ત્યારે આપ મારું રૂપ જોવા પધારનો. વ્યાખ્યાણ કહ્યું: ભલે, મહારાજ, હું આવીશ.

સનંતકુમાર સનાન કરી, સુંદર વખ્તાલુષણો પહેરી રાજ્યસભામાં દ્વાર્ઘલ થયા. આ વખતનું તેમનું રૂપ સાક્ષાત દેવતાઓને પણ શરમાવે તેવું હતું. રાજ રાજ્યસભામાં એહા છે તેવામાં પેદો વ્યાખ્યાણ આવ્યો.

અને તેણે મહારાજના રૂપ સામે જોયું. સનંતકુમારે વિચાર્યું કે હમણા આ મહારાજ મહારાજ રૂપની ખૂબ પ્રશંસા કરશે; પરંતુ ઉકા આલણે તેનું રૂપ જોઈને નિસાસે નાખ્યો અને બીજી બાળુ કરીને ઉભો રહ્યો. આ જોઈ સનંતકુમારને આશ્વર્ય થયું. તરત જ તેમણે આલણુને પૂછ્યું, મહારાજ, આમ કેમ ? પહેલી વખત તો તમે ખુશ થયા હતા અને આ વખતે દીલગીર થવાનું કારણ શું ? આલણે કહ્યું, મહારાજ, પહેલા તમાડું શરીર અમૃતમય હતું. અને અત્યારે તે જેરમય છે. સનંતકુમારે વિસ્તિત થતાં પૂછ્યું. એમ શાથી મહારાજ ? આલણે કહ્યું:-મહારાજ, પરીક્ષા કરવી હોય તો તમે મહેંભાંથી થૂંકો. તે થૂંક પર માખી બેસતાંનો સાથે તે મરણ પામશે. આ સાંલળી સનંતકુમાર થૂંક્યા, તરતજ માખી તે પર બેસી મરણ પામી. સનંતકુમારને જ્ઞાન થયું. તે સમજયા કે ખરેખર અલિમાન રૂપી જેરનું મિશ્રણ થવાથી આ સ્થિતિ થઈ. તો પછી કોધ, માન, માયા, લોભ, રાગ દ્વારા એ બધી વસ્તુઓ જ્યાં સુધી આત્મામાં હોય, ત્યાંસુધી શા કામનું ? તેમજ આ નાશવંત અને ક્ષણિક શરીર પર આટલો બધો મોહ શા માટે હોવો ઘટે ? આ શરીર મળમૂત્રનું લાજન છે, તેમાંથી જેર પણ પ્રગમે છે. આવા ગંદા શરીરનો લરોસો શો ? માટે તે પરથી મમતા ઉતારી નાખવાની અને આત્માના સ્વસ્વરૂપ જ્ઞાન, દર્શન અને ચારિત્રમાં તહીન બનવાની આવશ્યકતા છે. તરતજ સનંતકુમારને વૈરાગ્ય થયો. અને તેઓ સર્વ રિદ્ધિસિદ્ધ છોડીને દીક્ષા લઈને ચાલી નીકળ્યા.

એકવાર તેમના શરીરમાં રોગ ઉમજ થયો. એક દેવ વૈદનું રૂપ ધરીને આવ્યો અને સનંતકુમારને કહ્યું. હે મુનિ ! આપને રોગ થયો છે. તો હું આપની દવા કરી તે રોગ મટાડું. સનંતકુમારે જવાખ આવ્યો. વૈદરાજ, કર્મ રૂપી અસાધ્ય રોગને મટાડી શકવા તમે સમર્થ હો, તો લખે મટાડો. બાકી આ રોગને તો હું પણ મટાડી શકું છું; એમ કહી તરતજ તેમણે પોતાની આંગળી થૂંકવાળી કરીને પેદા રોગ પર વસી. પરિણામે સનંતકુમારનો રોગ શાંત થઈ

ગયો. દેવ આશ્ર્ય પામ્યો અને સનંતકુમારને વંદન કરીને સ્વસ્થાનકે ગયો. સનંતકુમાર મુનિ ભહાન તપશ્ચર્યાઓ કરીને નિર્વાણ પદને પામ્યા.

૨૧૭. સગર (ચક્રવર્તી)

અયોધ્યા નગરીમાં વિજય નામે રાજ હતા. તેમના ભાઈ સુભિત્રની યરોભતી રાણીની કુક્ષિએ સગર ચક્રવર્તીનો જન્મ થયો. વિજય રાજને ‘અન્જિતનાથ’ (ખીજ તીર્થકર) નામે પુત્ર હતા. સગર અને અન્જિતનાથ એકજ દિવસે જન્મ્યા. રાજ્યમાં આનંદ ફેલાઈ રહ્યો. વિજય રાજએ પોતાનું રાજ્ય અન્જિતનાથને સોંપી દીક્ષા લીધી; તેમજ સુભિત્ર રાજએ પણ દીક્ષા લીધી; શ્રી અન્જિતનાથ રાજગાઢી પર આવ્યા. કેટલાક વખત પછી તેઓ પણ પોતાનું રાજ્ય સગરને સોંપી ધર્મતીર્થ પ્રવર્તાવવા દીક્ષા લઈ ચાલી નીકળ્યા. ત્યારપછી સગરે પોતાના રાજ્યનો વિસ્તાર વધારવા છખંડ સાધ્યા અને ચક્રવર્તી થયા. સગરને સાઠ હજાર પુત્રો હતા. એકવાર સગર ચક્રવર્તી દેશાટન નીકળ્યા, તે વખતે અણ્ણાપદ પર્વત પાસે તેમણે એક ખાઈ બનાવરાવીને તેમાં ગંગાનો પ્રવાહ વાલ્યો, આથી નાગકુમાર દેવતાઓ, પોતાને અડયણું પડતી હોઈ, સગર પર કોધાયમાન થયા, અને તેના સાઠ હજાર પુત્રોને બાળીને ભર્મ કર્યો. આ વખતે તેઓ સધળા અયોધ્યામાં હતા. સગર જ્યારે દેશાટનથી પાછા ફરતા હતા, ત્યારે એક ઈંદ્ર આલણું ઇપ ધરી સગર પાસે આવ્યો, અને રડતાં રડતાં બોલ્યો, કે અરેરે, મહારો પુત્ર ભરી ગયો, હું શું કરીશ ? આ સાંભળી સગરે કહ્યું: મહારાજ, આ જગત વિનાશી છે, મૃત્યુ કોઈને છોડતું નથી, તો પછી આટલો વિલાપ શાને કરો છો ? મહારે ૧૦૦૦૦ પુત્રો છે, જો તેઓ સધળાય મૃત્યુ પામે, તોપણ મને શોક થાય નહિ. આ સાંભળી તે આલણે કહ્યું:-રાજન, મેં સાંભળ્યું છે કે આપના સાઠ-હજાર પુત્રો દેવના ડેપથી બળાને ભર્મ થયા છે. એમ કહી દેવ અદસ્ય થયો. સગર રાજને આથી ધર્ણો શોક થયો. રાજ્યમાં

આંધ્રા પછી પ્રધાનો વગેરેના સમજાવવાથી તેઓ શાંત થયા, તે સાથે જ તેમને જગતના વિનાશિપણાની ખાત્રી થઈ અને દીક્ષા કેવાનો વિચાર થયો. એવામાં અનિતનાથ પ્રલુ ઇરતા ઇરતા ત્યાં આવી ચડ્યા; સગરે તેમની પાસે દીક્ષા અંગીકાર કરી. ત્યારબાદ ખૂબ તપશ્ચર્યાઓ કરીને, ભાવનાના ભહાશિખરે ચડતાં, સગર ચક્વતી કૈવલ્યજીન પામ્યા. અને એકંદર હર લાખ પૂર્વનું આયુષ્ય ભોગવી, તેઓ મોક્ષમાં ગયા.

૨૧૮ સગડકુમાર

સોહંજણી નામની નગરીમાં ભહચંદ નામનો રાજ રાજ્ય કરતો હતો. તે નગરીમાં એક સુદર્શના નામની વેશ્યા રહેતી હતી. સુલક્ષ્ણ નામનો એક મોટો શાહુકાર પણ રહેતો હતો. આ શાહુકારને પોતાની ભદ્રા નામની સ્ત્રીથી એક પુત્ર થયો હતો. તેનું નામ ‘સગડકુમાર’. એક સમયે પ્રલુભહાવીર તે નગરીમાં પધાર્યા. ગોચરી અર્થે શ્રી જૈતમ સ્વામી નીકળ્યા. તેમણે નીચે પ્રમાણે રાજમાર્ગપર એક દસ્ય જોયું.

‘ધણ્યા હાથી ધોડા અને માણુસોની વચમાં એક સ્ત્રી અને એક પુરુષને બાંધ્યા રાખ્યા હતા. પુરુષને સ્ત્રીની પાછળ બાંધેદ્વો અને બંનેના નાક કાપી નાખ્યા હતા. તેઓ બોલતા કે અમે અમારા પાપકર્મથી ભરી જઈએ છીએ,’ શ્રી જૈતમ ત્યાંથી નીકળી પ્રલુ પાસે આંધ્રા અને જોયેલ દસ્યની વાત કરીને પૂછ્યું:— હે લગવંત. તેઓ પૂર્વે ડ્રેણ હતા? અને શાં પાપ કર્યા હતા? કે નેથી તેઓ આવું ઇણ ભોગવે છે! પ્રલુએ તે પુરુષનો પૂર્વભવ વર્ણવતાં કહ્યું:—છગલપુર નામનું નગર હતું. ત્યાં સિંહગિરી નામે રાજ હતો. તે નગરમાં છનિકનામનો એક કસાઈ રહેતો હતો. તે ધનવાન હતો, પાપી હતો અને દુરાચારી હતો. તેણે પોતાના વાડામાં અકરા, બકરી, ગાય, બળદ, લેંસ, પાડા, હરણ, રોઝ, મેર, મોરલી વગેરે લાખો જનવરો ભારવા માટે એકઢાં કર્યાં હતા. બીજા

પાસે દ્રવ્ય આણી એકદાં કરાવતો, અને ભાંસ વગેરે ખરીદતો હતો. પછી તે કસાઈ તે જનવરોને કાપી તેનાં ભાંસને કઢાઈમાં તળાને, અમિપર સેકીને બજરમાં વેચવા નીકળતો અને પોતાની આજવિકા ચલાવતો. એવી રીતે તે સાતસો વર્ષનું આયુષ્ય ભોગવી મરોને ચોથી નરકમાં ઉમન થયો. ત્યાંથી નીકળીને તેણે સુલદ્રશાહુકારને ત્યાં જન્મ લીધો. સગડ ઉમર લાયક થતાં તેના આતા પિતા ભરી ગયાં. સગડ ધીમે ધીમે દુર્વ્યસની બન્યો. ચોરી, જુગાર, વ્યાલિયાર આદિ દુષ્ટ વ્યસનોનું સેવન કરવા લાગ્યો. સમય જતાં તે સુદર્શના નામની ગણિકાના પ્રેમમાં પડ્યો. આ વાતની પ્રધાનને ખખર પડી, તેથી તેને ત્યાંથી હાંકી કાઢ્યો અને પ્રધાને તે વેશ્યાને પોતાના જનાનામાં રાખ્યો.

સગડ હડ્યૂત બનવાથી અહિં તહિં લટકવા લાગ્યો. તેને ક્યાંઈ ચેન પડ્યું નહિં. તેથી મોહને વશ થઈ તે વેશ્યાને ત્યાં જવાનો લાગ શેધવા લાગ્યો. એકદા તે લાગ સાધીને વેશ્યાના ઘરમાં પેસી ગયો. તેવામાં પ્રધાન ત્યાં આણી પહોંચ્યો. અને આ સગડને વેશ્યા સાથે રમણું કરતો દેખીને તેને ખૂબ માર્યો, તથા માણસો મારકૃત પકડીને બાંધ્યો. પ્રધાને રાજને વાત કરી. રાજ પણ કોધે ભરાયો. તેથી તેને 'આકરામાં આકરી શિક્ષા કરવાનું પ્રધાનને સૂચયંયુ.' તે પરથી પ્રધાને ઉપર પ્રમાણે તેને શિક્ષા કરી હતી.

શ્રી જીતમને સગડનું પશ્ચાત જીવન જાણવાની છંચા હોવાથી પ્રભુએ કહ્યું:-સગડ પ્રેરણ વર્ષનું આયુષ્ય ભોગવી આજ ત્રીજ પહેલે દ્વારાંડની બદ્ધીમાં હોમાઈને મરણું પામશે અને પહેલી નરકમાં જશે. ત્યાંથી નીકળી રાજગૃહનગરમાં ચંડાળને ત્યાં એક જોડલું ઉમન થશે. તેમાં તે પુત્ર રૂપે જન્મશે. પુત્રનું નામ સગડ અને પુત્રીનું નામ સુદર્શના રાખશે. સુદર્શનાનું રૂપ દેખીને સગડ મૂર્છિત થશે અને તે પોતાની બહેનની સાથે લોગ ભોગવશે. એ રીતે તે મહાન પાપ કર્મને સેવશે. ત્યાંથી અનુંત સંસાર પરિબ્રહ્મણ કરશે. આખરે તે મનુષ્યલભવમાં આવો કર્મ રહિત થશે.

૨૧૯ સમુદ્રપાળ મુનિ

ચંપાનગરીના પાલિત નામના વણિક સાર્થવાહના તેઓ પુત્ર હતા અને ભ. મહાવીરના પરમ લક્ષ્ય હતા. એકવાર આ પાલિત શેડ કરિયાણાના કેટલાક વહાણો લઈ બ્યાપારથો પિંડ નગરમાં ગયા. ત્યાંના એક વણિક શેડો પાલિત શેડને પોતાની દીકરી પરણાવી; તે ગર્ભવતી થઈ ત્યારે પાલિત તેણું લઈને પોતાના દેશમાં આવતા હતા, તે વખતે સમુદ્રમાં પુત્રનો પ્રસ્તુત થયો, આથી તેનું સમુદ્રપાળ એવું નામ પાડ્યું. બાલ્યકાળ વિતાવી, જર કળામાં પ્રવિષુ થઈ સમુદ્રપાળ યુવાન થયા ત્યારે તેમને ઇપિની નામે સ્વી પરણાવવામાં આવી. સમુદ્રપાળ તેની સાથે દેવ જેવાં સુખ લોગવવા લાગ્યા. એક પ્રસંગે સમુદ્રપાળ ગોખમાં બેદા છે, તે વખતે તેમણે કોઈ એક ચોરને બાંધીને લઈ જવામાં આવતો જેયો, આથી તેમને વિચાર થયો કે એ ચોર પોતાના કર્મનું કળ લોગવે છે, તેવીજ રીતે ભારે પણ કર્મનો ઉદ્ય આવતાં તેવાં ઇણો લોગવવાં પડશે. આમ વિચારતાં તેમને જાતિ રમરણ જ્ઞાન થયું; જેથી તેમણે ભાતા પિતાની રજ લઈ ચારિત્ર ગ્રહણ કર્યું, ને સિંહની પેરે ચારિત્ર પાળવવામાં દદ થયા. અનુકૂમે ચારિત્રની વિશુદ્ધ આરાધના કરી, સર્વ કર્મને ક્ષય કરી તેઓ કૈવલ્ય જ્ઞાન પામ્યા અને મોક્ષમાં ગયા.

૨૨૦ સ્વયંભૂ

તેઓ દારિકાના ભદ્રરાજની પૃથ્વી દેવીના પુત્ર હતા. મેરુક નામના પ્રતિવાસુદેવને ભારી, ત્રીજ વાસુદેવ તરિકે તેઓ પ્રસિદ્ધ થયા. ૬૦ લાખ વર્ષનું આયુષ્ય લોગવી, ભ. વિમળનાથના સમયમાં તેઓ ભૂત્ય પામીને છઢી નરકે ગયા.

૨૨૧ સથૂળીભદ્ર.

વીર સંવત. ૨૧૫ ની આ વાત છે. મગધહેરની રાજ્યધાની પાટલીપુત્રમાં નંદરાજ રાજ્ય કરતો હતો. તેમને શકડાલ નામનો બુદ્ધિશાળી મંત્રી હતો. તે મંત્રીને એ પુત્રો હતા. એકનું નામ સથૂળીભદ્ર, અને બીજાનું નામ એયક.

રાજ્યનો માનિતો મંત્રી અને રાજ્યનો સુખ્ય સલાહકાર, એટલે તેને સાં શી કમીના હોય ! ધન, લક્ષ્મી, ખાગ, અગ્રીચા, સુંદર આવાસો, નોકર ચાકર ધૃત્યાદિથી આ કુદુંઘ આનંદ લોગવતું હતું.

તે નગરમાં કોશ્યા નામની એક સુવિષ્યાત વેશ્યા રહેતી હતી. તે સાંદર્થનો ભંડાર હતી, ગાનતાનમાં કુશળ હતી, કટાક્ષ કળામાં પ્રવિષુ હતી. બલબલા પુરષો તેને જોઈને એ ધડી સ્થંભી જતા. તેની જ્યાતિ દેશ પરદેશમાં પહોંચી ગઈ હતી. આ વાત સથૂળીભદ્રના જણવામાં આવી. સથૂળીભદ્રને તે કોશ્યાને જોવાનો લાવ થયો. વખ્તાલંકારો પહેરી એકવાર તે કોશ્યાના આવાસમાં ગયા. કોશ્યાએ સથૂળીભદ્રનું સ્વાગત કર્યું. કોશ્યાને જોઈને સથૂળીભદ્ર જગતનું ભાન ભૂલી ગયા. કોશ્યાના ઇપમાં તે મુગધ બન્યા અને તેમણે ત્યાંજ રહેવાનો નિશ્ચય કર્યો. ધેરથી પુષ્કળ ધન ભંગાવ્યા કરે, કોશ્યાને આપે. કોશ્યા પ્રેમથી તેને ચાહે. આ રીતે અને જણા પ્રેમવિલાસમાં સમય પસાર કરે.

આમ કરતાં કરતાં બાર વર્ષના બહાણા વીતી ગયા. સથૂળીભદ્રના પિતા મૃત્યુ પામ્યા. એયકે આવીને બન્યર આપ્યા કે લાઈ, “હવે તો સમજો, આપણા પૂજ્ય પિતા તહારો જપ જપતાં મૃત્યુ પામ્યા છે !” આ સાંભળી સથૂળીભદ્ર ચમક્યા. એક વેશ્યાના પ્રેમમાં પડી ધરખાર, માતાપિતા, બધાને ભૂલી ગયા બદલ તેઓ પશ્ચાતાપ કરવા લાગ્યા, એટલુંજ નહિ પરંતુ મૃત્યુ આગમય પિતાનો મેળાપ ન થયો, એ તહેમને ભારે દુઃખ લાગ્યું. એકદમ જેમ સાપ કાંચળી છાડીને નાસે તેમ સથૂળીભદ્ર વેશ્યાભૂવનમાંથી પલાયન કરી ગયા.

धर तो तेमने समशानवत् लागवा मांडयुं, अने पोतानी जतने भ्रष्ट करी, ऐथी तेमने पारावार ऐद थयो। संस्कारी होवाथी तेमणे आत्माना स्वरूपनो विचार करवा मांडयो। जगत् तेमने निःसार जणायुं। अने तेनाथी मुक्त थवानो लाव सूर्यो। तटाण ते वर्षते त्यां बिराजतां संभूतिविज्य नामना मुनि पासे तेझो गया अने तेमणे दीक्षा लीधी। दीक्षा लाई तेमणे घूम जान भेणयुं। शास्त्र सिद्धांतो लणी, आत्म भावमां समय पसार करवा लाग्या।

यातुर्भासनो समय हुतो। संभूतिविज्य मुनिना चार शिष्योऽमे जुदा जुदा स्थले यातुर्भास रहेवानो निश्चय कर्यो। चार भासना उपवास करी चारे शिष्यो जुदां जुदां स्थाने रखा। तेमांना एक रखा सिंहनी गुद्धाना भोढा उपर, भीज सापना राहडा आगण, त्रीज कुवाना मंडाणु उपर अने चोथा स्थुणीबद्ध डोक्या नामनी वेश्याना धेर यातुर्भास गाणवा भाटे गया।

स्थुणीबद्ध डोक्याना आवासे पहोँच्या। तेमने जोर्दने डोक्याने धणे हृष्ट थयो। पोताने छोर्ने चाली गयेला स्वामी भणवा आव्या एम धारी तेणुये तेमनुं स्वागत कर्युं; पण स्थुणीबद्धने मुनिवेशमां जोर्द वेश्याए धर्षाभिथी भणवा मांडयुं। स्थुणी-बद्धल्लाए चोभासु गाणवा भाटे डोक्याना आवासनी भागणी करी। डोक्याए ते स्वीकारी। स्थुणीबद्ध त्यां रखा। डोक्या सोण शणुगारो सज, खणी हणी, जोरमां पग उपाडती, स्थुणीबद्ध सभीप आवी अने अनेक ग्रेकारना हावलाव, कटाक्ष करवा लागी। स्थुणीबद्धने यणाववा तेणे धणु धणु प्रयत्नो कर्या। पण अधा हेकट। ते निराश थर्द। जुनो ग्रेम ताळे करवा अने पोतानी साथे लोग लोगववा तेणुये धणी आल्ल करी, विनंती करी, धुंटणीए पडी, पण अधूं निरर्थक! स्थुणीबद्ध समज्या के आने भुजववी। एम चिंतवी तेमणे वेश्याने उपदेश आयो। अने जर कर्मना भडान पाप कर्मथी पाणा हडवा समजायुं। वेश्या हणुकर्मी हती, तेथी मुनिनो आ

ઉપદેશ કોશ્યાના હૃદયમાં હાડોહાડ વ્યાપી ગયો, તેણીને માનવહેણે કરવા યોગ્ય કાર્યોનું ભાન થયું. જુંદગીમાં કરેલાં વ્યલિચારના અગણિત પાપો માટે તેણીને પશ્ચાત્તાપ થયો. તેણીનું હૃદય વૈરાગ્ય રસથી પ્રેરિત બન્ધું અને મુનિની ક્ષમા માગી તેણીએ મુનિ પાસે આવિકાના બાર પ્રતો ધારણ કર્યાં. સ્થૂળીભદ્ર અને કોશ્યા પોતા-પેતાના પ્રતોનું રક્ષણ કરતાં માનવજીવનની સાર્થકતા સાધવા લાગ્યા.

અનુક્રમે ચાતુર્માસ પુરુષ થયું. ચારે મુનિવરો તપના પ્રભાવે આખાદ રહ્યા. અને ગુરુ પાસેઆવી, સૌઅંતે તેમને વંદન કર્યું. ગુરુએ ત્રણે જણુને એકેકવાર ધન્યવાદ આપ્યો. અને સ્થૂળીભદ્રજીને ત્રણવાર ધન્યવાદ આપ્યો. પાસે ઉલેલા તેમાંના એક મુનિવરને આ સાંભળી અહેખાઈ આવી. તેમણે વિચાર્યું કે હું સિંહની ગુફાના મોઢે ચાતુર્માસ રહ્યા, છતાં મને એકવાર ધન્યવાદ, અને આ સ્થૂળીભદ્રને ત્રણવાર! તેથી બીજું ચોમાસું આવતાં તે મુનિએ કોશ્યાને લાં ચાતુર્માસ રહેવાનું નક્કી કર્યું, અને તે માટે ગુરુની આજા માગી. ગુરુએ કર્યું કે તે કામ માત્ર સ્થૂળીભદ્રથીજ થઈ શકે, તમે નાહક તમારું ચારિત્ર ગુમાવી એસરો. શિષ્યે માન્યું નહીં અને બીજું ચાતુર્માસ આવતાં તેએ કોશ્યાને ત્યાં રજ લઈને ચાતુર્માસ રહ્યા.

કોશ્યા તો હવે જાની બની ગઈ હતી. તેણે વિચાર્યું કે આ મુનિ સ્થૂળીભદ્રની હરિદ્રાઈ કરવા આવ્યા લાગે છે. માટે તેમની પણ કસોટી કરી એટલે હિરો ઝટ પરખાઈ આવશે. આમ વિચારી કોશ્યા સુંદર વસ્ત્રાભૂષણો સજી, હાથમાં ભિષ્ટ લોજનનો થાળ લઈ, હાવ ભાવ અને કટાક્ષ કરતી ઉક્ત મુનિ પાસે આવી પહોંચી. મુનિ જ્યાં કોશ્યાના મુખચંદ્ર સામે દશ્ટિ કરે છે, ત્યાંજ તેએ સ્થંભી ગયા. તેમને વિકાર-ભાવના જગૃત થઈ. વેશ્યાએ થાળમાંથી લોજન આપવા માંડયું. મુનિએ ન લીધું. વેશ્યા તરત તેમનો ભાવ સમજ ગઈ. મુનિએ વેશ્યાના પ્રેમની

માગણી કરી. વેશ્યાએ કહ્યું:-મહારાજ, તમારે મારી સાથે સુખ ભોગવવું હોય તો હું કહું તેમ કરો. મુનિએ કહ્યું, શ્રી આજા છે, કહો. મરણાંતે પણ તમારી તે આજા પાળવા હું તૈયાર છું. વેશ્યાએ કહ્યું:-મહારાજ, તમે જણો છો કે અમે વેશ્યાએ ધન વિના કોઈને પેસવા ન દઈએ.

‘પણ અમે તો ત્યાગી સાધુ ! અમારી પાસે ધન કયાંથી હોય?’
મુનિએ કહ્યું.

‘ત્યારે તમે નેપાળ દેશના રાજ પાસે જાઓ. તે રાજ સાધુને રતનની કાંખળ આપે છે, તે મારે માટે લઈ આવો. તો હું તમારી સાથે જરૂર ભોગવિલાસ કરશે.’ વેશ્યાએ કહ્યું.

‘કાભાંધી નૈવ પશ્યતિ,’ એ સુત્રાનુસાર તે મુનિ સ્થિરવાસ રહેવાના ચોમાસાના સમયને તરછોડી વિહાર કરી નેપાળમાં ગયા, અને ત્યાંથી કાંખળ લઈ, ચોરાથી ઘેરાયેલા છતાં બચીને સહિસલાભતે વેશ્યા પાસે આવી પહોંચ્યા.

વેશ્યાએ તે કાંખળ લીધી. પછી તેણીએ સ્નાન કરીને તે રતન જરૂર કાંખળથી પોતાનું શરીર લુછ્યું, અને તે કાંખળ ગટરમાં ફેંકી દીધી.

મુનિ આ જોઈ આશ્વર્ય પામીને ઘોલ્યા:-રે, કોશ્યા, જીવના જોખમે આ કાંખળ હું લાવ્યો, તેની આ દશા ? આ તે કેવી મૂર્ખતા !

વેશ્યાએ સ્થિત કહ્યું અને ઘોલી. મહારાજ, રતનકાંખળની કિંમત વધારે કે તમારા સંયમની ? મુનિ વિચારમાં પડ્યા. પુનઃ વેશ્યાએ કહ્યું: મહારાજ, વિચાર શો કરો છો ? રતન કાંખળની ચિંતા કરવા કરતાં, તમારાં સંયમ રતનને દુર્ગધથી લરેલી સત્રીશપ આ ગંદી ગટરમાં ફેંકી દેવાને તૈયાર થયા છો, તેની ચિંતા કરોને ! અસંખ્યકાળ સુધી

સ્વર્ગનાં કામભોગ લોગવ્યાં, છતાં જીવની તૃપ્તિ ન થઈ, તો શું આ ક્ષળિક અને તુચ્છ મનુષ્યના વિષયભોગથી જીવની તૃપ્તિ થશે ખરી? વિચાર કરો, મહારાજ, આપને નેપાળમાં મોકલવાનો મહારો એજ ઉદેશ હતો. હું તો સ્થૂળીભરજીના ઉપદેશથી આવિકા થઈ છું; એટલે હજુથે તમને મહારી સાથે ભોગ લોગવવાનો મનોભાવ હોય તો મહારાથી તે તૃપ્તિ નહિ થઈ શકે મહારાજ. આપ સાધુ ધર્મથી બ્રહ્મ બન્યા; એટલુંજ નહિ પણ ભર ચોમાસામાં આપ નેપાળમાં ગયા. માટે આપ આપના ગુરુ પાસે જઈ ક્ષમાપના લ્યો અને પવિત્ર થાઓ! મનુષ્યભર, સંતસમાગમ, શાસ્ત્રવિજ્ઞાન, અને સંયમદશા આ જીવને અનંતકાળે પણ મળવા હુલ્લાલ છે એ સમને.

સાધુ આ સાંભળી સ્થિર થઈ ગયા. તેઓ પવિત્ર ક્રોષ્યા અને સ્થૂળીભરને ધન્યવાદ આપવા લાગ્યા. તત્કાળ તેઓ લાંધી ગુરુ પાસે આવ્યા અને ગ્રાયશ્રિત લઈ શુદ્ધ થયા.

ધન્ય છે, સ્થૂળીભરસમા નિશ્ચળ વૈરાગી મહાપુરુષને!

૨૨૨ સીતા

વિદેહદેશના જનક રાજને સીતા નામે પુત્રી હતી. તે મહા પતિ-પત્રા સતી હતી. તે ઉભર લાયક થતાં જનક રાજએ સ્વયંબર રચ્યો, જેમાં અનેક રાજાઓ આવ્યા. ત્યાં અચોધ્યાપતિ દશરથ રાજના પુત્ર શ્રી રામ ધનુષ્ય તોડી સીતાને પરણ્યા. સુખનો સમય આવ્યો તે વખતે રામચંદ્રજીને પિતાના વચનને ખાતર રાજ્યગાદીને સ્થાને વનવાસ સ્વીકારવો પડ્યો. ‘પતિ લાં સતી’ એ ન્યાયે સીતા રામચંદ્રજીની સાથે વનમાં ગયા, અને વૃક્ષનાં ઝળ, ઝૂલ, પાન વગેરે આઈ જીવન નિર્વાહ ચલાવવા લાગ્યા. તેવામાં એક કૃત્રિમ અદૌકિક મૃગને જોઈ તેને પકડવાનું સીતાજીને મન થયું અને રામને આગ્રહ કરી તે મૃગ ક્ષેવા મોકદ્યા; પાછળ લક્ષમણુ પણ ગયા. આ તકનો લાલ લઈ લંકાનો રાજ રાવણ કુપટ યુક્તિથી સીતાજીનું હરણું કરી લંકામાં

લઈ ગયો. અતિશાય ધાક, ધમકી, વિનવણી છતાં સતી સીતાએ પોતાના શિયળનું રક્ષણ કર્યું. પાછળથી રામ તથા લક્ષ્મણે સુગ્રીવ, હૃતુમંત વગેરે રાજાઓની મદદ લઈ લંકા પર ચાઈ કરી. અને ત્યાંના રાજ રાવણને ભારી સીતાજુને ઘેર લઈ આવ્યા. આ વખતે તેમોનો વનવાસકાળ પૂરો થયો હતો. દોકો માંહામાંહે બોલતા કે લંકાના રાજ રાવણને ત્યાં સીતાજુ પવિત્ર કેમ રહ્યી શકે ? આ સાંલળી રામચંદ્રજીએ સીતાને અભિમાં પડી પોતાની પવિત્રતા સાખીત કરી આપવાનું કર્યું. સીતાજુ અભિકુંડ પાસે આવી પંચ પરમેષ્ઠિનું સમરણ કરી બોલ્યા:-“હે અભિદેવ, જે હું આજસુધી પવિત્ર હોઉં, તેમજ મેં ભન, વચન, કાયાથી અન્ય પતિની ઈચ્છા સરખી પણ ન કરી હોય તો આ અભિન મને રક્ષણ કરનાર થનો.” એમ કહેતાંજ તેમણે અભિનમાં પ્રવેશ કર્યો. શિયળ રક્ષિત દેવોએ તરતજ તે અભિન બુઝાવી નાખ્યો. સીતાજુ તેમાંથી સહિસલામત બહાર નીકલ્યા. દોકોએ સતીનો જ્યથ્વનિ ઉચ્ચાર્યો. તે પછી એક ધોખીની ચર્ચા સાંલળી સીતાજુને રામે વનવાસમાં મોકલ્યા. આ વખતે તેમને ગર્ભ હતો; વનમાં વાલ્મીકી નામના ઋષિએ સતીને આશ્રય આપ્યો. સીતાએ અહિંયા ‘લવ અને કુશ’ નામક એ મહાસમર્થ પુત્રોને જન્મ આપ્યો. તેઓ મોટા થયા, તે વખતે લક્ષ્મણ (વાસુદેવ રૂપે) દેશ સાધતા હતા ત્યારે આ બંને કુમારો લક્ષ્મણના સૈન્યની સામે થયા અને સૈન્યને હરાયું. આથી લક્ષ્મણે પોતાનું ચક મૂક્યું, પણ ચક ગોત્રધાત ન કરે તેથી તે ચક પાછું આયું. આથી તે કુમારોની ઓળખાણ પડી. સધળાં મળ્યાં, લેટયાં, આખરે સીતાજુ પોતાના પુત્રોને લઈ રામ સાથે અચોધ્યા આવ્યા અને સુખપૂર્વક દિવસો વ્યતિત કરવા લાગ્યા. કાળાન્તરે સીતાજુ ચારિત્ર લઈ દેવદોકમાં ગયા.

૨૨૩ સુકોશલમુનિ

સાકેતનગરમાં (અયોધ્યા) કીર્તિધર નામે રાજ હતા. તેમને સહદેવી નામની રાણી હતી. તેમનાથી સુકોશલ નામના પુત્રનો જન્મ

થયો. તે કિશોરાવસ્થાએ પહોંચ્યા, ત્યારે કીર્તિધર રાજએ તેને રાજ્યાસને સ્થાપીને વિજયસેન નામક મુનિની પાસે દીક્ષા અંગીકાર કરી. એકવાર કીર્તિધર મુનિ ભાસક્ષમણુને પારણે બિક્ષાર્થે શહેરમાં નીકળ્યા, તેવામાં તેમની પત્ની સહદેવીએ તેમને રાજમહાલયની અગાશીમાંથા જોયા. જેતાંજ તેણીને વિચાર થયો કે ભારા પતિને મુનિ વેશમાં જોઈને, જે ભારો પુત્ર સુકોશલ પણ દીક્ષા દેશે તો મહા અનર્થ થશે, એમ ધારી કોઈ વેશધારીએ પાસે તેણીએ કીર્તિધર મુનિને નગરની બહાર કઢાવી મૂક્યા. આ સમાચાર જાણી સુકોશલની ધાવમાતા રૂદ્ધ કરવા લાગી. સુકોશલે તેણીને રૂદ્ધનું કારણું પૂછતાં, તેણીએ કહ્યું કે જ્યારે તહેં નહાની વયમાં હતા લારે તમારા પિતાએ તમને રાજ્યાસને બેસાડીને દીક્ષા લીધી હતી. તેએ આને બિક્ષાર્થે નગરમાં આવ્યા હતા, અને જે તહેં તેમને જુઓ તો તહેં પણ દીક્ષા લઈ લ્યો, એ હેતુથી તમારી ભાતાએ તે ક્ષમાશીલ મુનિને નગરની બહાર કઢાવી મૂક્યા છે. આ વાત જાણી સુકોશલ પિતાના સ્થાને ગયો; અને ઉપરે સાંબળી વૈરાગ્ય પામી તે પણ દીક્ષિત થયો. આથી તેની ભાતા સહદેવીને અતિશય સંતાપ થવા લાગ્યો. અનુકૂમે આર્તિધ્યાનથી તે મૃત્યુ પામીને કોઈ ગિરિની ગુઝરમાં વાધણું થઈ.

એકવાર આ બંને પિતા પુત્ર સાધુ એક પર્વતની ગુઝરમાં ચાતુર્માસ કરીને રહ્યા. ચાતુર્માસ પૂરો થતાં તેઓ બંને બિક્ષા મેળવવા માટે બહાર ચાલ્યા. ત્યાં ભાર્ગભાં યમહૂતી જેવી પેલી વાધણે તેઓને દીડા. તેનામાં પૂર્વલવનું વૈર જાગૃત થયું. મોટી ત્રાડો ભારતી તે દુષ્ટ વાધણું સુકોશલ મુનિ સામે ધુરકીયા કરતી દોડી આવી. પોતાને ઉપરસ્ગ આવેલો જાણી બંને મુનિઓ ધર્મધ્યાનમાં સિથર અની કાચોતસર્ગભાં રહ્યા. વાધણે સુકોશલ મુનિનું શરીર શરીને ભાંસનું લક્ષણું કરવા માંડયું. સુકોશલ મુનિ ‘વાધણ મને કર્મક્ષય

કરવામાં સહાયભૂત છે' એમ માની શુક્લધ્યાને ચડ્યા; કે તરતજ તેમને કૈવલ્યજ્ઞાન થયું. વાધણે તે પછી કૃત્તિધર મુનિને પણ કૃતી આધા. કૃત્તિધર મુનિ પણ શુક્લધ્યાન ભાવતાં કૈવલ્યજ્ઞાન પામી મોક્ષમાં ગયા.

૨૨૪ સુદર્શન (બળદેવ)

તેઓ અશ્વપુર નગરના શિવરાજ રાજનો વિજય રાણીના પુત્ર અને પુરુષસિંહ નામક વાસુદેવના ઓરમાન ભાઈ હતા. તેઓ પાંચમા બળદેવ તરીકે પ્રસિદ્ધ થયા. તેઓ ધર્મનાથ પ્રભુના વખતમાં ૧૭ લાખ વર્ષનું આયુષ્ય લોગવી મોક્ષમાં ગયા.

૨૨૫ સુધર્માસ્તવામી.

તેઓ પ્રભુ મહાવીરના પાંચમા ગણુધર હતા. કોક્ષાક ગામના રહિશ, અગ્નિ વેશ્યાયન ગોત્રમાં જન્મ્યા હતા. તેમના પિતાનું નામ ધનમિત્ર અને માતાનું નામ લહિલા. ઉત્તરા ક્ષાત્ર્યની નક્ષત્રમાં તેમનો જન્મ થયો હતો. તેઓ અતિશય ખુદ્ધિમાન હેવાથી ૧૪ વિદ્યામાં પારંગત થયા. તેમને એવો સંશય હતો કે—ને પ્રાણી નેવો આ ભવમાં હોય તેવોજ તે પરભવમાં થાય છે કે ખીજ સ્વરૂપે ? લ. મહાવીર તેમનો આ શંસય દ્વાર કર્યો, નેથી તેમણે પણ ૧૬ અને ૪૪ ગણુધરની ભાઈક પ્રભુ વર્ષે પ્રભુની પાસે દીક્ષા લીધી. તેમણે ૪૨ વર્ષ સુધી છદ્મભર્યપણું ભોગવ્યું. તેમાં ૩૦ વર્ષ સુધી વીરપ્રભુની સેવામાં અને ૧૨ વર્ષ સુધી ગૌતમભર્ત્વામીની સેવામાં રહ્યા. ૬૨ વર્ષ વીલા બાદ તેઓ કૈવલ્યજ્ઞાન પામ્યા. ૮ વર્ષ કૈવલ્યપણે વિચરી શ્રી જંખૂસ્વામી આદિ ધણુા ભવ્ય જીવોને પ્રતિષ્ઠાધી ૧૦૦ વર્ષનું આયુષ્ય પુરું થતાં વૈભારગિરિ પર એક માસનું અનશન કરી તેઓ વીરપ્રભુના નિર્વાણ પછી ૨૦ વર્ષે મોક્ષમાં ગયા. પ્રભુ મહાવીર મોક્ષમાં ગયા તે સમયે ૧૧માંથી આત્ર

૨ ગણુધરો હ્યાત હતા. જેમાં ગૌતમને તરત કેવળજાન થયું, જેથી ભ. મહાવીર પછી તેઓ પાઠપર બિરાજ્યા હતા. જેમ શ્રી ગૌતમે મહાવીર પ્રલુને અનેક પ્રશ્નો પૂછી, શાંકાઓનું સમાધાન કરી જાન મેળવ્યું હતું, તેમ શ્રી જંયુસ્વામીએ સુધર્મા સ્વામીને અનેક પ્રશ્નો પૂછી અનેક વિષયોનો નિર્ણય કર્યો હતો.

૨૨૬ સુદર્શન શેઠ

અંગ દેશની ચંપાનગરીમાં દખિવાહન રાજ રાજ્ય કરતો હતો. તેને અલયા નામની રાણી હતી. તેજ નગરમાં સુદર્શન નામનો એક ધનશ્રેષ્ઠ વસતો હતો. તેનું ઇપ સાક્ષાત્ કામહેવ જેવું સુંદર અને મોહક હતું, છતાં સુદર્શન અલ્લયર્યનું રક્ષણ કરવામાં એક્ઝો ગણુઠો હતો. પોતાની પાસે અઢળક લક્ષ્મી હોવા છતાં શિયળનું રક્ષણ એજ તેની મહેાટી સંપત્તિ હતી. હુંકમાં તે સત્યવાદી, ધર્મગ્રેભી, શીલવંત અને ગુણવંત હતો.

એકવાર સુદર્શન શેઠ ક્રોદ્ધ કામ પ્રસંગે શહેરમાં જતાં રાજમહાલથના પાછળના રસ્તેથી પસાર થતો હતો, તે વખતે અલયા રાણીએ તેને જેથો, જેતાંજ તેના હૃદયમાં કામ વિકારની ભાવના ઉમન થઈ. તહેણીએ ક્રોદ્ધપણું ભોગે સુદર્શન સાથે સુખલોગ લોગવવાની છુંચા કરી. તહેણે પોતાની કપિલા નામની દાસીને કહ્યું કે દાસી, જ, પેલા પસાર થતાં ઇપસુંદર પુરુષને બોલાવી લાવ. રાણીનો હુંકમ થતાં દાસી સત્વર નીચે ઉતરી અને સુદર્શન પાસે જઈ પહેંચીને કહ્યું: શેઠ, તહેમને અમારા રાણી સાહેબ કાંઈ કામ માટે બોલાવે છે. ભાડ્રિક સુદર્શન પોતાની માલિકિનીને અનાદર ન કરવાના કારણે મહેલમાં ગયા. રાણીએ શેઠનું સુંદર સ્વાગત કર્યું અને ઉચિત સ્થાને બેસાડી પોતાની કામેચા તુમ કરવાની વિનંતિ કરી. આ સાંલળી સુદર્શન શેઠ ચભક્યા. તહેમને ધર્મસંકટ આવ્યું.

તેમાંથી બચવાનો વિચાર કરતાં એક યુક્તિ સુણી આવતાં તે બોલ્યા:- રાણીસાહેબ, ધન્યધડી, ધન્યભાગ્ય, કે તહે મારા જેવા પામર કિંકરને બોલાવીને ઉપકૃત કર્યો છે, પરંતુ વાત એવી છે, કે તે સંભળી આપને હુંઘ થશે, માટે મને માઝ કરજો. ‘શી વાત છે ?’ રાણીએ આશ્ર્યચકિત બની પૂછ્યું. સુદર્શને કહ્યું: એજ કે હું નપુસક છું એટથે આપની છુંચા મારાથી તૃપ્ત નહિં થઈ શકે. આ સાબળી રાણીએ ગુર્સે થઈને શેડને કાઢી મૂક્યા.

કેદ્યોક સમય વિત્યા આદ શહેરમાં કૌસુદિ ઉત્સવ આવ્યો. રાજ્ય-વંશી કુદુંઘ અને આખું શહેર આનંદમળ બની આમ તેમ ક્રી રહ્યું છે, તેવામાં સુદર્શન શેડના કામહેવ જેવા છ પુત્રો, સુંદર વસ્ત્રાલંકારો પહેરીને રાજમાર્ગ પરથી પસાર થતા હતા, તે અભયારાણીએ જોયા. દાસીને પૂછતાં રાણીએ જાણ્યું કે તે સુદર્શન શેડના પુત્રો છે. આથી રાણીને સુદર્શન પર અતિશય કોધ થયો. તેણીએ કોઈપણ રીતે સુદર્શનનું વેર વાળવાનો નિશ્ચય કર્યો.

રાજ રાત્રે અંતઃપુરમાં રાણી પાસે આવ્યા. અભયારાણી કૃત્રિમ રદ્દન કરી રહી હતી. રાજીએ તેણીને શોકનું કારણ પૂછ્યું. રાણી બોલી: આ નગરનો સુદર્શન નામનો શેહ મહાદુષ છે, તેણે ગઈ રાત્રે મારા મહેલમાં ધૂસી જઈને મારાપર બળાતકાર કરવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ મેં તેને ધમકાવ્યો. તેથી તે ન્હાસી ગયો. નાથ, હવે મારે પ્રાણુહત્યાજ કરવી પડશે: આપની હાજરીમાં સતીઓનાં શિયળો લુંટાય એના જેવું રાજનું ખીજું અધેર કયું કહેવાય? રાજ અત્યંત ગુર્સે થયો, તરતજ માણુસેને મોકલી તેણે સુદર્શનને પકડી મંગાવ્યો અને રાણીની હાજરીમાં તેને કંડુ વચનો કહી સંભળાવો શરીરનો હુકમ કરમાવી દીધો.

શહેરમાં હાહાકાર થયો. સુદર્શનનું કુદુંઘ રહી રહ્યું હતું; પણ સુદર્શન દદ હતો. તેને દુધ્યાન દેશ માત્ર ન હતું. આનંદથી તે

શળી પર ચડવા તૈયાર થયો. તેને શળી પર ચડાવવામાં આવ્યો, ત્યાં તેણે હુદ્ધના એકાગ્રલાવે પરમ પવિત્ર પંચપરમેષ્ઠિ દેવોનું આરાધન કરવા માંડયું. પવિત્ર નવકાર મંત્રના પ્રલાવે શળી એક સિંહાસનના રૂપમાં ફેરવાઈ ગઈ. અર્થાત દેવોએ તેના શિથળના ગ્રતાપે શળાને સિંહાસન બનાવી દીધું. રાજ આ જોઈ દિંગમૂઠ બની ગયો. તેણે સુદર્શનને સત્ય હકીકત કહેવાનું કહ્યું: અભયારાણીને અભયદાન આપવાની શરતે સુદર્શને રાજને સર્વ હકીકત કહી. આખરે સુદર્શન શેઠ દીક્ષા અંગીકાર કરી દેવલોકમાં ગયા.

૨૨૭ સુપ્રભ (બળદેવ)

તેઓ દ્વારિકા નગરીના સોમરાજની સુદર્શના રાણીના પુત્ર, અને પુરુષોત્તમ નામક વાસુદેવના ઓરમાન ભાઈ હતા. તેઓ ચોથા બળદેવ તરીકે પ્રસિદ્ધ પામ્યા. તેઓ પ્ર્યુમ લાખ વરસનું આયુષ્ય બોગવી અનંતનાથ પ્રલુના સમયમાં ચારિત્ર લઈ મોક્ષમાં ગયા.

૨૨૮ સુપાર્શ્વનાથ

વારાણુસી નગરીમાં પ્રતિક્ષ નામે રાજ હતા. તેમને પૃથ્વી નામે રાણી હતી. તેના ઉદ્દરમાં છુટી ગૈવેયકથી ચ્યવી લાદરવા વદિ અષ્ટમિએ તેઓ ઉમન થયા. માતાને ૧૪ સ્વાન આવ્યાં. જેઠ શુદ્ધ ખારશે પ્રલુનો જન્મ થયો. ધૂદ્રોએ મેરપર્વત પર જઈ જન્મોત્સવ ઉજવ્યો. પિતાએ જન્મોત્સવ કરી પુત્રનું ‘સુપાર્શ્વનાથ’ એવું નામ પાડયું. થૌવનવય થતાં પિતાની આજાથી તેમણે અનેક રાજ્યકન્યાઓ સાથે લગ્ન કર્યું, તે પછી તેઓ રાજ્યાસને આવ્યા. લોાગાવલી કર્મ પૂર્ણ થતાં લોકાંતિક દેવોએ પ્રલુને પ્રેરણા કરી, એટલે તેમણે વરસીદાન આપી, જેઠ શુદ્ધ તેરસે એક હજર રાજ્યા સાથે સંયમ અંગીકાર કર્યો. નવમાસ છદ્મસ્થ અવરથામાં વીતાવતાં પ્રલુને ક્ષાગળું વદિ છહુને રોજ કૈવલ્યજ્ઞાન થયું. તેમને ૮૫ ગણુધરો હતા. તેમાં વિદ્ધર્સ સૌથી મોટા

હતા. તેમના પરિવારમાં ૩ લાખ સાધુ, ૪૩૦ હજાર સાધીઓ, ૨૫૭ હજાર આવકો અને ૪૮૭ હજાર આવિકાઓ હતા. પ્રભુ પાંચ લાખ પૂર્વ કુમારપણે રહ્યા. ૧૪ લાખ પૂર્વ અને ૨૦ પૂર્વાગ સુધી રાજ્ય કર્યું. એક લાખ પૂર્વમાં વીસ પૂર્વાંગ અને નવમાસ એછા, સમય સુધી કેવળી તરીકે વિચાર્યા. લાર પછી સમેત શિખર પર જઈ, ૫૦૦ મુનિઓ સાથે એક ભાસનું અનશન કરી દ્રાગણુ વદ્દ ઉમે પ્રભુ મોક્ષ પદ્ધાર્યા. તેમનું કુલ આયુષ્ય ૨૦ લાખ પૂર્વનું હતું.

૨૨૬ સુખાઙુકુમાર

હર્ષતીનાપુર નામનું નગર હતું. ત્યાં સુમુખ નામનો ગાથાપતિ રહેતો હતો. તે નગરના સહસ્રવન નામના ઉદ્ઘાનમાં ધર્મધીષ નામના સ્થવીર ખીરાજતા હતા. એકદા તેમના પદ્ધશિષ્ય શ્રી સુદર્ત અણુગાર આજા લઈ ને લિક્ષાર્થી નીકળ્યા. ઇરતાં ઇરતાં તેઓ સુમુખ ગાથાપતિને દેર આવી પહેંચ્યા. નૈત મુનિને દેખી ગાથાપતિને ધણોજ આનંદ થયો. આસન પરથી તરત ઉભા થઈ સાત આડ પગલાં આગળ જઈ તેમણે મુનિને ભાવપૂર્વક વંદન કર્યું, અને અત્યંત પ્રેમપૂર્વક મુનિને ચાર પ્રકારનો આહાર વહેઠાવ્યો. સુપાત્રદાનના પ્રભાવથી, ગાથાપતિના ધરમાં સાડાઆર કોડ સોનામહોરો, અને પાંચ પ્રકારના પુષ્પોની વૃષ્ટિ થઈ. આ દ્રશ્ય ધણ્ણાએ જેયું. કોકો દિંગમુઢ બન્યા, અને સર્વ કોઈ સુમુખ ગાથાપતિને દાન આપ્યા બદલ ધન્યવાદ આપવા લાગ્યા. ધણ્ણા વર્ષનું આયુષ્ય ભોગવી, સુપાત્ર દાનનું ભહાન પુષ્ય ઇળ ઉપાજ્ઞન કરી, સુમુખ ગાથાપતિ ભરીને હર્ષિતશાર્થ નામના ભહા ઋદ્ધિવંત નગરમાં અદીનશત્રુ રાજની ધારિણી રાણીની કુકીમાં પુત્રપણે અવતર્યા. નામ ‘સુખાઙુકુમાર’.

પાંચ ધાવમાતાઓ અને અનેક દાસ દાસીઓના લાલન પાલન વડે કુમાર વૃદ્ધ પામવા લાગ્યા. અનુકૂમે બાલ્યાવસ્થા વીતાવી

ચુવાવસ્થાને પામ્યા, ત્યારે તેમને પુષ્પચુલા આદિ ૫૦૦ રાજકન્યાઓ પરણાવવામાં આવી. પાંચસો મહેસો બંધાવી આપવામાં આવ્યા. જેમાં કુમાર સુખલોગ ભોગવવા લાગ્યા.

એકદા પ્રભુ મહાવીર તે નગરના ઉદ્ઘાનમાં પધાર્યા. પ્રજાગણુના ટોળે ટોળાં પ્રભુના દર્શન કરવા જવા લાગ્યાં. આ દ્રશ્ય સુખાહુકુમારે જોયું; પરિવાર સહિત સુખાહુકુમાર દર્શનાર્થે ગયા. પ્રભુએ ઉપહેશ આપ્યો. સુખાહુકુમાર આવક થયા. બીજુ વાર પ્રભુ પધાર્યા. સુખાહુકુમાર દર્શનાર્થે ગયા. પ્રભુના અદ્ભુત ઉપહેશની અસર હૃદયમાં હાડોહાડ વ્યાપી ગઈ, સંસારની અસારતાએ તેમનામાં ગંભીર ઝપ લીધું. પ્રભુને વંદન કરી તેઓ ધેર આવ્યા. રાજ-મહાલયો, સૈંદર્ઘ્યવાન સ્વોએ, રાજ્યની વિપુલ લક્ષ્મી, એ સધળા પર તેમને અભાવ છુટ્યો. સુખાહુકુમાર સ્વસ્થ થયા. જેમ કપડાં ઉપરથી ધૂળ ખંખેરી નાખે તેમ સર્વ મોહ તજ સંસારથી તેઓ વિરક્ત થઈ ગયા. માતાપિતાની દીક્ષા માટે રજ લીધી. માતાપિતાએ કુમારને ધણું સમજાવ્યાં પરન્તુ કુમાર એકના એ ન થયા, પરસ્પર સંવાદ થયો, તેમાં કુમાર સફળતા પામ્યા. દીક્ષાની તૈયારીએ થઈ, અનેક પ્રકારનાં વાજિન્દ્રો વાગી રહ્યાં, સર્વ કોઈ સુખાહુકુમારને ધન્યવાદ આપવા લાગ્યા, પણ સુખાહુકુમારને જગતનો ધન્યવાદ ક્યાં જોઈતો હતો? તેમને તો જન્મ ભરણુના ફેરા ભિટાવવા હતા. આ સ્વાર્થભ્ય સંસારનો ત્યાગ કરવો હતો, તેથી તેઓ પુષ્કર ઉદ્ઘાનમાં ગયા, જ્યાં પ્રભુ મહાવીર બિરાજતા હતા. પ્રભુ પાસે સુખાહુકુમારે દીક્ષા લીધી અને આત્મ દશામાં વિચરવા લાગ્યા. ધણા વર્ષ સંયમ પાળો, ખૂબ તપશ્ચર્યાએ કરી, સુખાહુકુમાર કાળ કરી સુધર્મ દેવલોકમાં ગયા. ત્યાંથી મનુષ્ય જન્મ પામી દેવતા અને મનુષ્ય એ એજ ગતિના થોડાક બવો કરી તેઓ મહાવિદેહમાં જન્મ લઈ મોક્ષ જરો. ધન્ય છે, એ સુખાહુસમા રાજપુરષને, તેમને આપણા વંદન હોનો!

૨૩૦ સુભદ્રા.

વસંતપુર નગરમાં જિનદાસ નામે આવક હતો. તેને જિનમતી નામની ખ્રી હતી. તેનાથી તેમને એક પુત્રી થઈ હતી. તે પુત્રીનું નામ સુભદ્રા. સુભદ્રા રોજ ઉપાશ્રયમાં જાય, વ્યાખ્યાન સાંલળે, સામાયક કરે, ધાર્મિક પુસ્તકો વાંચે, અને ખૂબ લણે. તે સામાયક શાખી, પ્રતિક્રિમણુ શાખી, જીવાળવનું સ્વરૂપ જાણ્યું, નવતરન જાણ્યાં, કર્મપ્રકૃતિ જાણી, એટલું જ નહિ પણ તે સદ્ગ્યાર શાખી, ગૃહજીવનની ઉત્ત્રતિ શાખી. તેનો સ્વભાવ મોડો અને મધુરો. વખત જતાં તે ઉંમર લાયક થઈ; એટલે તેના પિતાએ તેને માટે લાયક પતિની તપાસ કરવા માંડી.

એકવાર ચંપાનગરીના બુદ્ધદાસ નામનાં એક બૌદ્ધમાર્ગી ગૃહસ્થે, સુભદ્રાને સુશીલ અને સ્વરૂપવાન જાણીને તેનું માગું કર્યું. જિનદાસે પરધમ માં તેને આપવા ના પાડી. તેથી બુદ્ધદાસ આવક થયો. જિનદાસે સુભદ્રાનું તેની સાથે લગ્ન કર્યું. સુભદ્રા સાસરે આવી. તેની નણુંદ સાસુ વગેરે બૌદ્ધધર્મી, અને સુભદ્રા જૈનધર્મી, તેથી બંનેનો મેળ મળ્યો નહિ. પરિણામે સાસુ નણુંદ રોજ કંકાસ કરવા લાગી અને સુભદ્રાને સત્તાવવા લાગી. તેમજ સાચા ઘોટા વાંક કાઢી સુભદ્રાને ઠપકો અપાવવાના પ્રયત્ન કરવા લાગી. છતાં બુદ્ધદાસને તેના પતિપત્ર-પણ્ણાની તથા તેની સરળતાની ખાત્રી હતી. તેથી તે સુભદ્રાને કંઈ કહેતો નહિ. સાસુ નણુંદનું લોર વધ્યેજ જરૂર. સુભદ્રા બધું સમભાવે મહન કરતી. અને સાસુ વગેરેના વિશેષ કંકાસથી સુભદ્રા નિત્ય નિયમ સાચવી પોતાના કર્મનો જ દોષ કહાડતી દિવસો પસાર કરવા લાગી.

એકવાર કોઈ જૈન સાધુ સુભદ્રાને ઘેર વહોરવા પધાર્યો. સુભદ્રા એ મુનિને પ્રેમપૂર્વક વંદન કર્યું. તેવામાં વંટોળાયો થયો. ખૂબ પવનના વાવાથી મુનિની આંખમાં એક તણુખલું પડ્યું જેથી મુનિને

પીડા થવા લાગી. આ મુનિ જિનકલિપત સાધુ હતા, એટલે તેઓ શરીરના સંરક્ષારથી વિમુખ હતા. સુભદ્રાને દ્યા આપી. તેથી સુભદ્રાએ ચોતાની જીબના ટેરવાથી મુનિની આંખ માંહેનું પેણું તણુખણું ઉપાડી લીધું; પણ સુભદ્રાનું કૃપાળ અચાનક મુનિના કૃપાળ સાથે અરી ગયું. તેથી સુભદ્રાએ કરેલા કંદુના ચાંદાની છાપ મુનિના કૃપાળમાં પડી. મુનિ લાંથી લિક્ષા લઈને અહાર નીકળ્યા.

એવામાં જ સુભદ્રાની સાસુ તથા નણંદે મુનિના કૃપાળમાં ચાંલ્યો જોયો. તેઓ તો સુભદ્રાના છિદ્રો શોધતી જ હતી. તેથી સુભદ્રાના પ્રમાણનો લાલ આ રીતે તેઓએ મેળવ્યો. તરત જ તેમણે આ દસ્ય બુદ્ધદાસને બતાવ્યું, અને કહ્યું કે અમે નહોતા કહેતા કે સુભદ્રા કેવી પતિપત્રા છે ?

બુદ્ધદાસનો વહેમ સાચો હ્યો. સરળ સન્નારો પર સંકટ આવ્યું. તે પતિની આંખમાં કણ્ણાની જેમ ખૂંચવા લાગી. કાચા કાનના બુદ્ધદાસે તેનો લાગ કર્યો. સુભદ્રાના હુઃખનો પાર ન રહ્યો, તે કર્મને જ દોષ દેવા લાગી અને કોઈ રીતે ભાથે આવેલું કલંક દૂર કરવાના વિચાર કરવા લાગી. તેણે અઠમ તપ આદર્યો, અને શાસન દેવીનું આરાધન કર્યું. છેદ્ધી રાત્રિએ દેવીએ આવીને કહ્યું: ઇકર ન કર. બહેન, સવારે સધળું સારું થશો.

સવાર થતાં જ ચંપાનગરીના દરવાજા ઉઘડયા નહિ. દોકોને જવા આવવાની હરકત પડી. રાજએ પણ વાત જાણ્યો. સૌ કોઈ સ્તરખ થઈ ગયાં. ધણ્ણા મંત્ર-ઉપયારો કર્યાં, પણ દેઝકટ. બધાએ દેવતાઓનું રમરણ કર્યું. ત્યારે આકાશવાણી થઈ કે કોઈ મહાસતી કાચા સુતરના તાંત્રણાથી ચારણીને બાંધી કૂવામાંથી પાણી કાઢે; અને તે પાણી દરવાજાને છાંટે તો દરવાજા ઉધડે.

રાજએ શહેરમાં દેઢેરો પીટાવ્યો અને આ વાતની રૈયતને જાણુ કરી. સ્ત્રીઓનાં ટોળે ટોળાં ચારણીથી પાણી કાઢવા માટે હાલી નિકળ્યાં. પણ જ્યાં સુતર બાંધી ચારણી ફૂવામાં નાખે કે તરત સુતર તૂઠી જાય; અગર ન તૂટે તો ચારણીના છિદ્ર દારા પાણી નિકળી જાય. પરિણામે આખા ગામની સ્ત્રીઓભાંથી કોઈ એવી પતિવ્રતા ન નીકળી કે જે ફૂવામાંથી સહિસલામત પાણી કાઢી શકે. આ જાણી સુભદ્રાએ ફૂવામાંથી પાણી કાઢવા માટે સાસુ તથા પતિની આજા ભાગી. સાસુ તો આ સાંભળતાં જ લભકી ઉડી. અને બોલીઃ—હવે જોઈ જોઈ તને, પતિવ્રતાપણું બતાવવા આવી છે તે ! સુભદ્રાએ આજુજુ કરી અને મહામુશીભતે રજ મેળવી. સુભદ્રા કુવા આગળ આવી પહોંચી.

સુભદ્રાના પ્રયાસથી ચારણી પાણીથી ભરાઈને બહાર આવી. ગામ કોડો આશ્ર્ય પામ્યા. તરત જ તેણીએ રાજગૃહી નગરીના ત્રણ દરવાજને પાણી છાંટયું. દરવાજાને એકદમ ઉધડી ગયા. ચોંધો દરવાજે સુભદ્રાએ બંધ રહેવા દીધો અને કહું કે હજુ કોઈ સ્ત્રી પતિવ્રતા હોવાનો દાવો કરતી હોય તો તેમના માટે આ દરવાજે બંધ રાખ્યો છે, તો તે પોતાની ઉમેદ પાર પાડે, છતાં કોઈ તૈયાર થયું નહિ.

સુભદ્રાને સૌ કોઈ ધન્યવાદ આપવા લાગ્યાં. તેની સાસુ નણું-દના મહોં કાળાં થયાં અને બધાં તેમને ધિક્કારવા લાગ્યાં. છેવટે રાજએ પણ તે મહાસતીને ધાણું માનપાન પહેરામણી આપ્યાં અને વાજતે ગાજતે તેને ધેર પહોંચાડી. આખરે સુભદ્રાએ દીક્ષા લઈ આત્મકલ્યાણ કર્યું.

સાર—પરધર્મમાં કન્યા આપવાથી કેવું તુકસાન થાય છે, તેમજ સંસ્કારી સ્ત્રીઓ વાતાવરણ કેવું સુવાસિત બનાવે છે, અને અસંસ્કારી સ્ત્રીઓ કેવું દુર્વાસિત બનાવે છે તેનો આ વાત પુરાવો આપે છે. —સં.

૨૩૧ સુમતિનાથ

વનિતા નામની નગરીમાં મેઘરાજની મંગળા નામની રાણીની ઉદ્ધરમાં આવણું શુદ્ધ ભીજે, વિજય વિમાનમાંથી ચ્યવીને, તેઓ ઉત્પજ થયા. માતાને ચૌદ સ્વપ્ન આવ્યાં. અનુકુમે ગર્ભકાળ પૂરો થયે વૈશાક શુદ્ધ આઠમે પ્રલુનો જન્મ થયો. સુમતિનાથ નામ પાડવામાં આવ્યું. યૌવનવય થતાં માતાપિતાએ ધર્ણી કન્યાએ તેમને પરણાવી. દશ લાખ પૂર્વ સુધી તેઓ કુમારપણામાં રહ્યા. પછી પિતાએ તેમને રાજ્ય સોંપી દીક્ષા લીધી. ૨૬ લાખ પૂર્વ અને ૧૨ પૂર્વીંગ સુધી રાજ્ય લોગવ્યું. પછી પ્રલુએ વરસીદાન આપી ૧ હજાર રાજાઓ સાથે વૈશાક શુદ્ધ ૮મે દીક્ષા લીધી. ૨૦ વર્ષ છદ્રસ્થપણે રહ્યા પછી ચૈત્ર શુદ્ધ ૧૧ ના રોજ તેમને કેવલ્યજીન થયું. તેમને ચમર આદિ ૧૦૦ ગણધરો હતા. પ્રલુના શાસન પરિવારમાં ૩ લાખ ૨૦ હજાર સાંધુ, ૫ લાખ ૩૦ હજાર સાંધ્વી, ૨ લાખ ૮૧ હજાર આવકો અને ૫ લાખ ૧૬ હજાર આવિકાઓ હતા. પ્રલુ ૧ લાખ પૂર્વમાં ૧૨ પૂર્વીંગ અને ૨૦ વરસ ઓછા, એટલો સમય કેવળાપણે વિચચ્ચા. તે પછી સમેતશિખર પર એક હજાર સાંધુએ સાથે એક માસના અનશનના અંતે ચૈત્ર શુદ્ધ ૮ ના દિવસે પ્રલુ સિદ્ધ થયા.

૨૩૨ સુરાદેવ

વારાણસી નગરીમાં સુરાદેવ નામે ગાથાપતિ હતા. તેમને ધના નામની સ્ત્રી હતી. રિદ્ધિસિદ્ધિમાં તેઓ કામહેવ સમાનજ હતા. એકવાર પ્રલુ મહાત્મિર તે નગરીમાં પધાર્યા. સુરાદેવ પ્રલુને વાંદવા ગયા. પ્રલુની અમોદ વાળીથી પ્રતિભોદ્ધ પામી, તેમણે આવકના પ્રારવત અંગીકાર કર્યા. તેમની સ્ત્રી પણ આવિકા બની. બંને જણું પ્રત નિયમનું પાલન કરવા લાગ્યા. કેટલાક વર્ષો વિલાયાદ સુરાદેવ, ગૃહનો સધળો કારલાર પોતાના

જ્યેષ્ઠ પુત્રને સોંપી પૌષ્ઠ્રશાળામાં ધર્મધ્યાન કરવા લાગ્યા. સુરાદેવ એક વખત ધ્યાનમાં લીન હતા, તે વખતે અર્ધ રાત્રિએ તેમને ચળાવવા માટે એક દેવ આવ્યો. તેણે રાક્ષસનું ભયંકર રૂપ કરીને બત લંગ કરવાનું સુરાદેવને કહ્યું; પણ સુરાદેવ ધ્યાનથી ડગ્યા નહિ, તેથી દેવે સુરાદેવના એક પછી એક ત્રણે પુત્રને લાવીને તેની સમીપમાં ઉલા રાખી તરવારથી કાપી નાખ્યા. અને તેમના માંસને કડાઈમાં સેક્ઝને, લેમનું લોહી સુરાદેવના શરીર પર છાંટ્યું, છતાં સુરાદેવ જરા પણ ચલાયમાન થયા નહિ; તેથી તે દેવે વધારે ક્રોધિષ્ટ બનીને સુરાદેવના શરીરમાં સોળ ભયંકર રોગો ઉત્પન્ન કરીને પીડા પમાડવાનું કહ્યું. આથી સુરાદેવ ત્રાસ પાખ્યા અને તે દેવને પકડવા દોડચા. દેવ નાસી ગયો અને સુરાદેવના હાથમાં એક સ્તંભ આવ્યો. તેથી સુરાદેવે કોલાહલ કર્યો. આ સાંલળી તેમની ખ્રી ધજા સફળે જગીને ત્યાં દોડી આવી; અને કોલાહલનું કારણ પૂછ્યું. સુરાદેવે વાત કહી. ધજાએ કહ્યું. આપણા ત્રણે પુત્રો તો નિરાંતે ઉંઘે છે. માટે દેવે તમને ધ્યાનથી ચળાવવા ઉપસર્ગ આય્યો છે. માટે પ્રાયશ્રિત લઈ શુદ્ધ થાયો. સુરાદેવે પ્રાયશ્રિત લીધું. તે પછી તેમણે ૧૧ પ્રતિમા ધારણું કરી અને અંતિમ કાળે એક મહિનાનો સંથારા કર્યો. પ્રાંતે આયુષ્ય પૂર્ણ કરીને સુરાદેવ સૌધર્મ દેવલોકમાં ગયા અને ત્યાંથી મહાવિદેહ ક્ષેત્રમાં અવતરી તેઓ મોક્ષગતિ પામશે.

૨૩૩ સુષુમાદારિકા

શ્રેણિક મહારાજની રાજગૃહી નગરીમાં ધજા સાર્થવાહ નામે એક માડા ઋદ્ધિવંત શેડ રહેતો હતો. તેને પાંચ પુત્રો અને એક પુત્રી હતી. તે પુત્રીનું નામ સુષુમાદારિકા, તે ધર્ણી સુંદર હતી. તે ધજાસાર્થવાહને ચિલાત નામનો એક નોકર હતો. તે બાળકોને હંમેશાં કીડા કરાવતો હતો. કંમેકે આ નોકર બાળકોનું ધરેણું, કૃપડાં વગેરે ચોરવા લાગ્યો. શેડને આ વાતની ખ્યાર પડવાથી શેડે

તે ચિલાતને હપકો આપી ધરમાંથી કાઢી મૂક્યો. ચિલાત નોકર ગોમભાં જ્યો ત્યાં રખડવા લાગ્યો અને તે ચોરી, માંસ, દાર, બુંગાર, પરસ્પીગમન છલાહિનો વ્યસની બની ગયો અને સ્વર્ણંહે વર્તવા લાગ્યો. તે નગરીથી થોડેક દૂર એક ચોરાને રહેવાની ગુફા હતી. તેમાં વિજયસેન નામનો ચૌર્યકળાભાં કુશળ એવો ચોર રહેતો હતો. તેની સાથે ખીંચ પાંચસો ચોરા હતા. આ ચિલાત નોકર ત્યાં ગયો અને તે ચોરને મળ્યો. તેની સાથે રહીને તે પણ ચોરી કરતાં શાખ્યો અને ચૌર્યકળાભાં પ્રવીણ થયો.

કળાન્તરે તે વિજયસેન ચોર મરણ પામ્યો. તેથી પાંચસે ચોરાએ ભળાને આ ચિલાત ચોરને પોતાનો અધિપતિ બનાવ્યો. એક વખત તે ચિલાત ચોર પોતાના પાંચસે ચોર સાથીએને લઈને રાજગૃહી નગરીભાં ધનાસાર્થવાહને ઘેર ચોરી કરવા આવ્યો. ધના સાર્થવાહ પોતાના પાંચ પુત્રોને લઈ લયલીત થઈને એકદમ ધરમાંથી દૂર જતો રહ્યો. ચિલાતે ધનાના ધરમાંથી પુષ્કળ દ્વય લીધું એટ-લું નહી પણ સુષુમાદારિકા નામની તેની કન્યાને લઈ તે ત્યાંથી પૈલાયન કરી ગયો.

ચોરના ગયા બાદ ધનાસાર્થવાહ ઘેર આવ્યો અને ક્રોટવાળ પાસે ગયો. તેણે ક્રોટવાળને ચોરીની તથા પુત્રીહરણની વાત કરીને, પોતાની સાથે તપાસ કરવા આવવાનું કહ્યું. ક્રોટવાળ હથીયાર તથા માણસો લઈને ધનાસાર્થવાહ સાથે પેલી ગુફાભાં ગયો. ત્યાં ચોરા જાથે યુદ્ધ થયું. પરિણામે બધા ચોરા નાસી ગયા. ચિલાત પણ ગબરાયો તેથી તે સુષુમાદારિકા નામની કન્યાને સાથે લઈ ભીજે રસ્તેથી જગત ભણી પસાર થઈ ગયો. આ દશ્ય ધના તથા તેના પુત્રોના જોવાભાં આવ્યું, તેથી તેઓ તેની પાછળ પડ્યા. દૂર અટવીભાં ગયા પછી ચિલાત થાક્યો. કન્યા સાથે આગળ જલદીથી નાસી શકાશે નહિ, એમ ધારી તેણે પેલી કન્યાનું તલવાર વતી ભર્તક ઉડાવી

દીધું અને તે દૂર અટવીમાં નાસી ગયો. ધનાસાર્થવાહ પેલી કન્યાના શબ્દ આગળ આવી પહોંચ્યો. શબ્દને જેતાંજ તે મૂર્છિત થઈને નીચે પડ્યો અને આકંદ કરવા લાગ્યો. કેટલીકવારે તે શુદ્ધિમાં આવ્યો. આ વખતે ધનાને તથા તેના પુત્રોને ખૂબ દોડવાથી ભૂખ અને તૃપ્તા લાગી હતી. અને પાણી વિના તેઓ મૃત્યુના મુખે આવી લાગ્યા, ત્યારે ધનાએ તેના પુત્રોને કહ્યું:-હે પુત્રો, આપણું ધણી ખૂખ અને તરસ લાગી છે, અને અહિં પાણી મળે તેમ નથી. તો આપણે મરી જઈશું અને રાજગૃહીમાં પહોંચી શકશું નહિ. માટે તમે મને મારી નાખો અને મહારા માંસ, ઇધિરનો આહાર કરી સાન્ત્વન પામો અને ઘેર જઈ સુખ લોગવો. ત્યારે તેના મોટા પુત્રે કહ્યું, પિતાજ, તમે પરમ ઉપકારી છો; માટે તમે મને મારી નાખો. ત્યારે ખીંચાએ કહ્યું કે મને મારી નાખો. એમ વારાફરતી પાંચે પુત્રોએ કહ્યું. ત્યારે વિચાર કરી ધનાએ જવાબ આપ્યો:-પુત્રો, કોઈને પણ મારવાનો વિચાર હવે નથી. પણ આ પુત્રી, જે હવે મરી ગઈ છે. માટે તેના માંસ ઇધિરનો આહાર કરી આપણે ઘેર પહોંચીએ. બધાએ આ કણુલ કર્યું. એટલે આસપાસથી લાકડા વીણી લાવી તેઓએ અભિસંગાવ્યો, અને તે પુત્રીનું માંસ વગેરે પકડ્યી તેનો તે સધળાએ આહાર કર્યો. પરિણામે તેઓ જીવતાં રહ્યા અને રાજગૃહી નગરીમાં પહોંચ્યા.

એકવાર પ્રભુ મહાવીર તે નગરમાં પદ્ધાર્યો. રાજ ઐણિક, ધના સાર્થવાહ વગેરે વંદન કરવા ગયા. પ્રભુએ દેશના આપી. ધના-સાર્થવાહને વૈરાગ્ય થયો. અને તેણે દીક્ષા લીધી. સખત તપ જપ ધ્યાન ધરી, સંથારો કરી તે પહેલા હેવલોકમાં ગયો, ત્યાંથી કાળ કરી મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ પામી મોક્ષમાં જશે.

ન્યાય-નેમ ધનાસાર્થવાહે શરીર, વર્ષુ, રૂપ, બળ કે વિષયને માટે સુષુ-
માદારિકાનો આહાર નહોતો કર્યો, પણ માત્ર રાજગૃહ નગરમાં

પહોંચવા માટેજ કર્યો હતો, તેમ સાધુ સાધ્વી ઉદ્ઘારિક શરીરને વળું, રૂપ, બળ, નિષ્યને માટે પોથે નહિ, પરંતુ માત્ર સિદ્ધિ-મૂક્તિને માટે સાધનભૂત જણી નિઃસ્વાદ રૂપે આહાર કરે. ચિલાતીપુત્ર વિષયમાં શુદ્ધ અની અટવીમાં રખડી મહાદુઃખ પામ્યો, તેમ નિષ્યન્માં ગૃહ્ય અનેલ જવો મહાદુઃખને પામે અને સંસાર પરિષ્કરમણ કરે.

૨૩૪ સુલસા

રાજગૃહ નગરમાં નાગ નામના રથિકને સુલસા નામે પતિભક્ત અને ધર્મપરાયણ સ્વી હતી. એકદા નાગ રથિક ગુરુસન્મુખ એવો નિષ્યમ કર્યો કે 'હવે મહારે બીજી સ્વી કરવી નહિ.' એ દંપતી પરસ્પર સ્નેહયુક્ત હતા. નાગ રથિક એણિંક રાજની સેવા કરતો હતો. એકદા પોતાના આંગણા પાસે કેટલાક દેવકુમાર જેવાં બાળકોને જોઈ પુત્ર વગરની એવી સુલસા પોતાને પુત્ર ન હોવા બદલ એદ પામી, ચિંતાથી તેનું મુખ ઉતરો ગયું, ત્યારે નાગરથિકે તેણીને દેવ વગેરેની બાધા રાખવાનું કહ્યું. આ સાંલળી જૈનધર્મમાં ૬૬ એવી સુલસાએ કહ્યું. મિથ્યા દેવહેવીએણી બાધા વ્યર્થ જ છે, માટે અરિહંત ધર્મ ઉપર શ્રદ્ધા રાખો, તેનાથી સર્વ સિદ્ધિ ભળશો. આમ સત્ય ધર્મની શ્રદ્ધાવડે પતિ-પત્ની બંને દિવસો વિતાવવા લાગ્યા.

એકવાર કોઈ દેવે સુલસાની ધર્મશ્રદ્ધાની કસોટી કરી. તે એક જૈન સાધુનું ઇપ ધરીને સુલસાને ત્યાં આવ્યો. સુલસાએ મુનિ ધારીને વંદન કરી તેમનો સતકાર કર્યો. સાધુએ કહ્યું: હું લક્ષપાક તેલની યાચના કરવા આવ્યો છું, જે હોય તો વહોરાવશો. સત્પાત્રને જોઈ મૂલ્યવાન વસ્તુ પણ ગ્રેમપૂર્વક વહોરાવવા સુલસા તત્પર થઈ. તેણીની પાસે તેલના ચાર શીશાઓ હતા, તેમાંથી એક લધને તે આવી. આવતાં જ દેવની માયાથી તેને ઉમરામાં ડેસ વાગ્યાથી શીશા પડીને ફૂટી ગયો, એટલે હેંશલેર સુલસા બીજે શીશા લઈ આવી, પણ તેની પણ એવી જ દશા થઈ. એમ દેવે માયાવડે તેના ચારેય

શીશા ઝોડવી નાખ્યા, છતાં સુલસાના અનમાં મુનિ પ્રત્યે કિંચિતું
પણ અભાવ ન થયો, કે વહેરાવવા પ્રતિ અરુચિ ન થઈ. દેવ તેની
ધર્મશ્રદ્ધાથી પ્રસન્ન થયો, અને તેણે પ્રકટ થઈ, તેલના શીશાં પાછા
આપી, સુલસાને વરદાન માગવા કહ્યું: સુલસાએ કહ્યું: હે દેવ, તમે
જ્ઞાનધ્યાનથી મારો મનોરથ જાણી શકો છો. આથી દેવતાએ તેણુંને
૩૨ ગોળીઓ આપી અને કહ્યું કે ત્હારે આમાંથી એકેક ગુટિકા
ખાવી, એના પ્રભાવથી તને ઉરું પુત્રો થશે. તેમજ તને જ્યારે
સંકટ પડે ત્યારે મને સંભાળજો. હું તારું વિધન દૂર કરીશ. એમ
કહીને તે દેવ અંતર્ધ્યાન થઈ ગયો.

હવે સુલસાએ વિચાર કર્યો કે મારે ઉરું પુત્રો શું કરવા છે?
કરણું કે તેથી તો તે બધાના મળમૂત્ર ધોવામાં મારો સમય ચાલ્યો
જય અને ધર્મધ્યાન થાય નહિ; તેના કરતાં બત્તીસ લક્ષણો એવેં
એકજ પુત્ર ઉત્પન્ન થાય તે વધારે સારું. એમ વિચારી સુલસા બત્તીસે
ગોળીઓ. એકી સાથે ગળી ગઈ, આથી તેના ઉદ્દરમાં ઉરું ગર્ભ
પ્રકટ થયા. પરિણામે તે મહાવેદના અનુભવવા લાગી, તેથી સુલસાએ
પેલા દેવને યાદ કર્યો. દેવ આવ્યો. સુલસાએ પોતાની ગર્ભવેદનાની
વાત કહી. દેવે તને કહ્યા પ્રમાણે કામ ન કર્યો બદલ દૃપ્રકો આપ્યો.
સુલસાએ અવિત્તવ્યતાનો નિયમ કહ્યો. છેવટે દેવે તેની વ્યથા દૂર
કરી. અનુક્રમે તેણુંએ ઉરું પુત્રોનો જન્મ આપ્યો. નાગરથિકે મહાદાન
દર્ઢ પુત્રોનો જન્મોત્સવ કર્યો. પાંચ પાંચ ધાવમાતાઓથી ઉછેરતાં
તે પુત્રો વૃદ્ધિ પામ્યા; ધર્મ, કર્મ અને શાસ્ત્ર સંબંધી સર્વ કળાઓ
શીખ્યા; પિતાએ તેમના લમ્બ કર્યા. તેઓ બ્રેણ્ડિક રાજના સેવકો
થયા. પુત્રવધુઓથી સુલસા સુખી થઈ.

એકવાર બ્રેણ્ડિક રાજ સુન્યેધાનું સુરેગદારા હરણું કરવા ગયો
હતો, ત્યારે તે સુલસાના આ ઉરું પુત્રોને સાથે લઈ ગયો
હતો. ચૈટક રાજના સૈન્યને યુદ્ધ થયું. તેમાં સુલસાનો એક

પુત્ર મૃત્યુ પામતાં બ્યાંગીસે પુત્રો મૃત્યુ પામ્યા. આથી સુલસાના શોકનો પાર રહ્યો નહિં. છેવટે અભયકુમારના ઉપદેશે સુલસા શોક મુક્તા થઈ. ત્યારબાદ ધર્મભાં નિશ્ચલ શ્રદ્ધા છે એવી તે સુલસાને લ. મહાવીરે અંબડ સન્યાસીદ્વારા ધર્મલાભ કરેવડાવ્યો. અંબડે પરીક્ષા કરી, તેમાં તે સફળ થઈ. છેવટે અંત સમયે સર્વ પાપની આદોયના લઈ, મૃત્યુપામી સુલસા દેવલોકમાં ગઈ, ત્યાંથી એવી તે અરતક્ષેત્રમાં આવતી ચોવીસીભાં નિર્મભ નામે ૧૫ મા તીર્થીકર થશે.

૨૩૫ સુભૂમ ચક્વર્તી

શ્રી અરનાથ પ્રલુના શાસનમાં સુભૂમ નામે આઠમા ચક્વર્તી થયા. તે હસ્તીનાપુરના કૃતવીર્ય રાજાની તારા નામક રાણીના પુત્ર હતા. તેમનો જ્ઞન-મ જ્ઞંગલમાં તાપસના આશ્રમમાં થયો હતો. સમય જતાં વૈતાઠય પર રહેનારા મેધનાદ વિદ્યાધરે તેમને પોતાની પદ્મશ્રી નામની કન્યા પરણ્યાવી હતી. તે વખતે તેનો પ્રતિસ્પદ્ધી પરશુરામ નામે પ્રતિવાસુહેવ હતો, તેણે સુભૂમના પિતાને ભારી પૃથ્વીને નિઃક્ષત્રિયા કરી હતી એ વાત સુભૂમે પોતાની ભાતાદ્વારા સાંભળી, તેથી તે કોધવશ બની હસ્તિનાપુરમાં આવ્યો. ત્યાં તેને ચક્રતલની પ્રામિ થવાથી તેણે પરશુરામને ભાર્યો. જેમ પરશુરામે પૃથ્વીને સાતવાર નિઃક્ષત્રિયા કરી હતી, તેમ તેનાં વેર ઇપે સુભૂમે પૃથ્વીને એકવીસ વાર નિર્ઝાલણી કરી.

અનુક્રમે સાઠ હજર વર્ષના આયુષ્યવાળા સુભૂમે ચાર દિશામાં ઝરી અનેક રાજાઓને પરાજ્ય પમારી છ અંદની સાધના કરી અને તે ચક્વર્તી થયો. અનેક પ્રાણિઓની હિંસા કરતો તે સુભૂમે કોલને વશે સાતમો અંડ સાધવા ગયો, જ્યાં દરિયામાં ઝૂખવાથી તે મૃત્યુ પામ્યો. અને મરીને તે સાતમી નરકમાં ગયો.

૨૩૬ સુવિધિનાથ (પુષ્પદત).

કાડંદી નગરીના સુશ્રીવ રાજની રામાદેવી નામક રાણીની કુક્ષિ-
માં વૈજ્યંત વિમાનમાંથી ચયવીને દ્વાગળું વહિ હ ના રોજ તેઓ ઉત્પજ
થયા. માતાને ૧૪ સ્વમ આવ્યાં. ભાગશર વહિ પાંચમે જન્મ થતાં
દેવદેવીએ પ્રભુનો ઉત્સવ કર્યો. ગલ્લ વખતે માતા સર્વ વિધિમાં
કૃશણ હતાં, તેમજ તેમને પુષ્પના દોહદથી પુત્રને દાંત આવ્યા હતા,
તે પરથી તેમનાં સુવિધિ અને પુષ્પદત એવાં એ નામ રાખવામાં
આવ્યાં. ઘોવન પામતાં પિતાના આગ્રહથી તેઓ અનેક રાજકન્યાએ
પરણ્યા. પછી પિતાની ગાહીએ આવ્યા. ૫૦ હજાર પૂર્વ કુમારપણે
રહ્યા, તથા ૫૦ હજાર પૂર્વ ઉપર ૨૮ પૂર્વાંગ સુધી તેમણે રાજ્ય
ભોગયું. તે પછી દોકાંતિક દેવોની પ્રેરણાથી પ્રભુએ વાર્ષિકદાન
આપી ભાગશર વહિ હ ના રોજ એક હજાર રાજાએ સાથે સંયમ
અગીકાર કર્યો. ચાર માસ છદ્રસ્થપણે રહ્યા પછી પ્રભુને મહાપ્રકાશ
આપનાં એવું કૈવલ્યજ્ઞાનથયું. તેમને વરાહ આદિ ૮૮ ગણુધરો હતા.

પ્રભુના સંધ પરિવારમાં ૨ લાખ સાંધુ, ૧૨૦ હજાર સાંધ્વી,
૨૨૬ હજાર આવકો તથા ૪૭૨ હજાર આવિકાએ હતા. કેવળજ્ઞાન
થયા પછી સુવિધિનિને એક લાખ પૂર્વમાં ૨૮ પૂર્વાંગ અને ચારમાસ
ઓછા, સમય સુધી કેવળીપણે વિચરી અનેક લભ્ય જીવોનો ઉદ્ધાર
કર્યો. અંતે સમેતશિખર પર, એક હજાર સુનિએ સાથે, માસિક
અનશને કારતક વહિ હ મે પ્રભુ નિર્વાણ પદ્ધાર્યા. તેમનું કુલ આ-
યુષ્ય એ લાખ પૂર્વનું હતું.

૨૩૭ સોમિલ*.

લ. પાર્શ્વનાથના સમયમાં વારાણશી નગરીમાં સોમિલ નામે આ-
લણું હતા. તે મહાસમૃદ્ધિવંત, તથા ચારવેદાદિ છ શાસ્ત્રમાં પારંગત હતા.

* અજસુકુમારને ઉપસર્ગ આપનાર, બીજ સોમિલનું વત્તાંત અજસુકુ-
મારની કથાના અંતરભાગમાં આવી જતું હોઈ તે અહિ લીધું નથા. —દ્વ.

એકવાર લ. પાર્શ્વનાથ ત્યાં પખારતાં સોમિલ પ્રલુની દેશનામાં ગયા. દેશના પૂરી થયા બાદ તેમણે પ્રલુને પૂછ્યુઃ—તમારે યાત્રા છે? તમારે ઈદ્રિયોને જીતવાનું છે? તમારે રોગરહિત પણું છે? તમારે નિર્દેષ વિહાર છે? તમારે સરસવ ખાવા ચોગ્ય છે કે નહિ? તમારે માંસ ખાવા ચોગ્ય ખરું કે નહિ, ફૂલકુળ તમારાથી ખવાય કે નહિ? તહેમે એક છો કે એ? અક્ષય છો કે અભ્યય છો? વગેરે પ્રશ્નો પૂછ્યા. પ્રલુને તેના બરોખર જવાબો આપ્યા, આથી સોમિલે પ્રલુ પાસે જૈન ભાર્ગના બાર વ્રતો અંગીકાર કર્યા, તથા જવ, અજીવાદિ નવ તત્ત્વનું જાણુપણું કર્યું. લારબાદ સોમિલને લાંઝા કાળ સુધી સાધુનો સમાગમ થયો નહિ, તેથી તેમનામાં મિથ્યાત્વના પર્યાય વધ્યા, તે પછી તેમણે શહેર બહાર બગીચા બનાવ્યા, તેમાં અનેક અકારના વૃક્ષો તથા છોડવાઓ ઉછેર્યાં. તે પછી કેટલેક સમયે સ્વજન, ભિત્ર અને કુંભ-ધીઓને લોજન જમાડી, તાપસના સાધનો અનાવરાવી, મોટા પુત્રને ગૃહકાર્યભાર સૌંધી તેમણે તાપસની દીક્ષા અંગીકાર કરી, અને તામલી તાપસની પેઠે તેઓ સધળી કિયાઓ કરવા લાગ્યા. એકવાર એક હેવે આવીને તેમને કહ્યું કે—સોમિલ, તહારી પ્રવજ્ઞાઓટી અને અજ્ઞાન-કષ્ટ સહન કરવા જેવી છે. આમ હેવે લાગલાગટ ચાર રાત્રિ સુધી ત્રણ ત્રણ વખત કહ્યું. છેવટે પાંચમી રાત્રિએ કહ્યું કે પહેલાં તેં પ્રલુ પાર્શ્વનાથ પાસે વ્રત અંગીકાર કરેલાં, તે મૂકી દઈને મિથ્યા કષ્ટમાં કેમ પડ્યો? આથી સોમિલ સમજ્યો. હેવ નમસ્કાર કરી ચાલ્યો ગયો. પછી પુનઃ સોમિલે આવકના વ્રત ગૃહણ કરી ધણો તપ કર્યો. અંત સમયે અનશન કરી, પૂર્વ વ્રતલંગની આલોચના લીધા વગર, તે કાળ કરીને શુક નામે અહ થયો. ત્યાંથી ચ્યાવી તે મહાવિદેહમાં જન્મી મોક્ષ જરો.

૨૩૮ સોમિયદ્ધ ભચ્છીમાર.

નંદીપુર નામનું ગામ હતું. ત્યાં ભિત્ર નામે રાજ હતો. તે રાજને એક સીરીયા નામનો રસ્યો હતો. તે ધણો જ પાપી હતો.

રસોઈના કામમાં તેણું પોતાના હાથ નીચે માછલીને પકડવાવાળા, હરણુને ભારવાવાળા વગેરે હિંસાનું કામ કરનારા માણુસો રાખ્યા હતા. જેઓ અનેક પણ પક્ષીઓએ લાવો આપતાં, સીરીયા ભરધાં, મોર, તેતર, વગેરે પખીઓને પાંજરામાં પૂરી રાખતો, તથા જીવતાં પંખી-ઓની પાંખ ઉખાડીને વેચતો, એટલું જ નહિ પણ ગાય, બેંસ, કુઝર, બકરાં વગેરે પશુઓનાં ભાંસના હુકડા કરી, તેને તેલમાં તળી રસોઈ બનાવતો, તે પોતે ખાતો અને રાજને પણ ખવડાવતો. આવી રીતે ધણ્ણા વર્ષોં સુધી હિંસાકારી કૃત્યો કરીને તે ભરણું પામ્યો અને ભરીને તે છૂટી નરકમાં ઉત્પન્ન થયો.

ત્યાંથી નીકળાને તે સોરીપુર નગરમાં સમુદ્રદાતા નામના મર્યાદા-ભારને ત્યાં તેની સમુદ્રદાતા નામની જીને પેટે જન્મ્યો. તેનું નામ સોરિયદાત પાડ્યું. યુવાવસ્થા પામ્યો, ત્યારે તેના માખાપ ગુજરી ગયાં, તેથી તે મર્યાદાભારોમાં અગ્રેસર તરીકે રહેવા લાગ્યો. તેણું ધણ્ણા માણુસો નોકર તરીકે રાખ્યા. જેઓ પાસે માછલાંઓ પકડવાનું કામ કરાવતો. પછી તે સોરિયદાત પકડાયેલાં માછલાંઓને તાપમાં સુકવતો અને તેઓને પકડીને બજારમાં વેચવા લઈ જતો.

એકવાર સોરિયદાત માછલીને સેકીને ખાતો હતો, તેવામાં તે માછલીનો કાંઠો તેના ગળામાં ભરાઈ ગયો. તેનાથી તેને તૌથ વેદના થઈ. ગળામાં કંઈ પણ પદાર્થ જઈ શકે નહિ, જેથી તે ભૂખ અને તૃપ્યાથી પીડાવા લાગ્યો. ઝારાક ન લઈ શકવાથી તે દિન પ્રતિદિન સુકાવા લાગ્યો. તેનું શરીર ક્ષીણ થવા લાગ્યું. તેથી તેણું ધણ્ણા વૈદોને ઉપયાર અર્થે ઝાલાવ્યા. વૈદોએ ખૂબ ઉલ્લિંઘો કરાવી તથા ખીજ ધણ્ણા ઉપયારો કર્યો. પણ તે કાંઠો ગળામાંથી કાઢવા કોઈ સંમર્થ થયું નહિ. પરિણ્યામે તે મર્યાદાભાર ભરણું પામ્યો અને પહેલી નરકમાં

ઉત્પન્ન થયો. ત્યાંથી નીકળી અનંત સંસાર પરિભ્રમણ કરતાં કરતાં છેવટે મનુષ્ય જન્મ પામી તે મોક્ષમાં જરો.

૨૩૬ સંયતિરાણ.

પંચાલ દેશના કપિલપુર નગરમાં સંયતિ નામનો રાજ હતો. એકવાર તે પોતાની ચતુરંગી સેના સાથે પોતાના કેશરી નામના ઉદ્ઘાનમાં શિકારાર્થી ગયો. ત્યાં તેણે ધણ્ણા મૃગલાઓનો સંહાર કર્યો. તે ઉદ્ઘાનમાં ગર્દલાળી નામના એક સુનિ ધ્યાનદશામાં લીન હતા. મૃત્યુના ભયથી શિકારના પંજામાંથી નાસી ધૂટેલું એક મૃગ ધ્યાનસ્થ સુનિ તરફ હોડવા લાગ્યું, તેવામાં રાજાએ તેને એક ખાણ વડે ધાયલ કર્યું. મૃગ ત્યાં જ લગભગ સુનિ સમિપ પહોંચી મૃત્યુને શરણ થયું. તેને લેવા માટે રાજ તે જગ્યાએ આવ્યો, તેવામાં તેણે એક ધ્યાનસ્થ જૈન મહાત્માને તે જગ્યાએ જોયા. આથી રાજ મનમાં ભય પાય્યો અને એદપૂર્વક વિચારવા લાગ્યો કે અહો ! મેં પાપીએ ભાંસમાં ગૃહ્ણ બનીને સુનિના મૃગને ભાર્યા ! આ મૃગ સુનિનું જ હોવું જોઈએ, નહિ તો તે સુનિ પાસે આવે નહિ. અરે, હવે શું થાય ? જે આ સુનિ ક્રાપાયમાન થશે તો તેઓ પોતાના તપોભણથી ભને અને ભારાં સૈન્યને બાળી મૂકશો. એમ બ્હિને તે સુનિ પાસે આવ્યો અને તેમના પગમાં વંદન કરી નમૃતાપૂર્વક બોલ્યો :—હે સુનિ ! હે તપસ્વી ! મહારા. અપરાધ ક્ષમા કરો, મેં આપના મૃગને ઓળખયું નહિ. સુનિ ધ્યાનસ્થ હોવાથી રાજના કથનથી કાંઈ પણ બોલ્યા નહિ, આથી રાજ વધારે ભયભીત બન્યો; ને વધારે નમૃતાથી કહેવા લાગ્યો :—હે મહારાજ ! કરણ્ણસાગર ! મહારા સામે જુઓ, હું આ નગરનો સંયતિ રાજ છું. મહને બોલાવી મારો ઉદ્વેગ ટાળો. થોડીવારે ગર્દલાળી સુનિએ કાચોતસર્ગ પાય્યો અને કહ્યું :—રાજન ! તેને અલય છે; અને તું

સર્વ જીવોને અભયદાનનો દાતાર થા. આ અનિત્ય મનુષ્યથોકને વિષે હિંસામાં કેમ પ્રષ્ટત થયો છે? કર્મના વરો સર્વ જીવોને સધળી પૌહગલિક વસ્તુઓ છોડીને જવાનું છે, તો પછી તું રાજ્યમાં આટલો બધો આસક્તા કેમ બન્યો છે? હે રાજ! તું જીવિતબ્ય અને રૂપને વિષે આટલો બધો કેમ મૂર્ખી પામે છે? આયુષ્ય અને રૂપ તો વિજળીના ચમકારા જેવું ક્ષણિક છે. સ્વી, પુત્ર, પરિવાર અને ઉપાર્જન કરેલું ધન સાથે આવતું નથી, પણ તે સર્વ મૃત્યુ પછી અહિં જ પરી રહે છે. જે સ્વી પોતાના પતિ પર અતિશય ખાર કરે છે, તેજ સ્વી તેના પતિના મૃત્યુ પછી અન્ય સાથે સુખ ભોગવે છે; જે મહાપાપ કરી ધન ઉપાર્જન કર્યું હોય છે, તેનો ભોક્તા બીજો બને છે, વગેરે હિત શિખામણો વડેરાજને મુનિએ બોધ આપ્યો. આ સાંભળી સંજતિ રાજ પ્રતિઓધ પામ્યો. તેણે ગર્દલાણી મુનિ પાસે ચારિત્ર અંગિકાર કર્યું; અને તેઓ ગીતાર્થ થર્ઢ સાધુની સમરસત સમાચારી શાખી, ગુરુની આરા લઈ એકાકીપણે વિચરવા લાગ્યા. એકદા સમયે તેમને ક્ષત્રિયરાજ ઋષિ મળ્યા; તેમણે સંયતિ મુનિની તેજસ્વી પ્રભા લોઈ કર્યું: હે મુનિ! તમારું રૂપ અને મન નિર્વિકારી દેખાય છે, તો તમારું નામ શું છે તે કૃપા કરી કર્દેશો? સંયતિ બોલ્યા:—મારું નામ સંયતિ, મારું ગોત્ર ગૌતમ, તથા શ્રુતરાન અને ચારિત્રના પારગામી એવા ગર્દલાણી ભગવાન મારા ધર્મગુરુ-ધર્માચાર્ય છે. હિંસાથી બચવા માટે મેં સંયમ આદર્થો છે. તે પછી સંયતિ રાજએ સાધુના ઉત્કૃષ્ટ ગુણો, ભિદ્યાતના પ્રકાર વગેરે જૈન તત્ત્વનું રહસ્ય કહી, પોતાને જાતિસ્મરણું શાન થયું હોવાથી કર્યું કે હું સમ્યક્ પ્રકારે મારા આત્માનો પૂર્વ-ભવ જાણું છું. હું પાંચમા અલ્ફેવોકમાં મહાપ્રાણુ નામના વિમાનમાં દેવપણે હતો, ત્યાંની દર્શા સાગરોપમની* સ્થિતિ પૂરી કરી હું આ

* ચાર ગાંનો લાંઘો, પહોણો અને ઉંડો એવો એક કુંબો હોય, તેમાં દેવકુર, ઉત્તરકુર યુગલીયાના સાત દ્વિસના જન્મેત્રાં બાળકના એકે

મનુષ્યભવ પાયો છું. આ પ્રમાણે વાર્તાલાપ થતાં ક્ષત્રિયરાજ ઋષિને ધણો આનંદ થયો અને તેઓ દ્શટા પદ્ધા. અનુકમે સંયમ માર્ગમાં વિચરતાં સંયતિ રાજર્વિને કૈવલ્યજ્ઞાન થયું અને તેઓ મોક્ષમાં ગયા.

૨૪૦ સંભવનાથ.

વર્તમાન ચોવીસીના ત્રીજા તીર્થકર શ્રી સંભવનાથ, આવરસ્તી નગરીના જિતારી રાજની સેનાહેવી રાણીની કુક્ષિમાં, નવમા હેવલ્લોકમાંથી ચ્યવીને ઉત્પન્ન થયા. માતાએ ચૌદ સ્વખન દીઠાં. માગશર શુદ્ધ ૧૪ ના રોજ પ્રભુનો જન્મ થયો. ૫૬ દિગ્કુમારી હેવીએઓ સુતિકાકર્મ કર્યું. ધૂદ્રોએ પ્રભુને મેરુ પર્વત પર લઈ જઈને જન્મોત્સવ ઉજવ્યો. પિતાએ સંભવનાથ એવું નામ આપ્યું. યૌવનાવસ્થા થતાં તેઓ અનેક રાજકન્યાઓ પરણ્યા. ૫૮ રાખ વર્ષો સુધી કૌમાર્યાવસ્થામાં રહ્યા પછી પિતાએ તેમને રાજ્યગાઢી પર એસાડી દીક્ષા લીધી. ૪૪ લાખ પૂર્વ અને ૪ પૂર્વાગ સુધી રાજ્ય ભોગવ્યું, તે પછી લોકાંતિક હેવેની પ્રેરણાથી વરસીદાન આપી, પ્રભુએ માગશર શુદ્ધ પૂર્ણિમાએ એક હજાર રાજાઓ સાથે દીક્ષા લીધી. ચૌદ વર્ષ છહેમસ્થપણામાં રહ્યા પછી કાર્તિક વદિ પાંચમે તેમને કૈવલ્યજ્ઞાન થયું. તેમને ચારુ વગેરે ૧૦૨ ગણુધરો હતા.

સંભવ જિનના સંધ પરિવારમાં ૨ લાખ સાંધુ, ૩૭૬ હજાર સાંધ્રીએ, ૨૮૭ હજાર શ્રાવકો અને ૬૩૬ હજાર આવિકાએ હતા. અંતિમ સમયે પ્રભુએ સમેતશિખર પર એક હજાર મુનિએ સાથે માસિક અનશન કર્યું અને ચૈત્ર શુદ્ધ પાંચમે તેઓ મોક્ષ પદ્ધાર્યો. સંભવનાથ પ્રભુનું એકંદર આયુષ્ય ૬૦ લાખ પૂર્વનું હતું. વાળના અસંખ્યાતા ખંડ કરી, ઢાંસી ઢાંસીને તે કુવામાં ભરે, પછી તેમાંથી એકુક ખંડ સો સો વરસે કાઢે અને જન્મારે તે કુવો ખાલી થાય ત્યારે તેને એક પદ્ધોપમ કહેવાય. એવા દરા કોડા કોડી (દરાકોડને દરાકોડે ગુણીએ) કુવા ખાલી થાય ત્યારે એક સાગરોપમ કહેવાય, એમ અન્યકાર વર્ણિંદે છે.

૨૪૧ હરિસેન (ચક્રવર્તી).

કષિલપુર નગરમાં મહા હરિ નામે રાજ હતો. તેને મેરા નામની રાણી હતી. તેમને મહાન શક્તિશાળી પુત્ર થયો. તેનું નામ હરિસેન. યૌવનવય પામતાં હરિસેન રાજ્યાસને આવ્યા અને અન્ય ચક્રવર્તીઓની જેમ પોતાની આયુદ્ધશાળામાં ચક્રરત્ન ઉત્પન્ન થવાથી, તેની મદ્દદ વડે છખંડ જતી દશમા ચક્રવર્તી થયા. અંતે સર્વ રાજ્યરિષ્ટિ છોડી તેમણે દીક્ષા લીધી અને કૈવલ્યજ્ઞાન પામી તેઓ મોક્ષમાં ગયા.

૨૪૨ હસ્તિપાળ.

પૂર્વ ભરતના ભગધ દેશમાં પાવાપુરી નગરી હતી; ત્યાં હસ્તિપાળ નામનો જૈનધર્મી રાજ હતો. તે લ. મહાવીરનો પરમભક્ત હતો. ભગવાનને છેલ્લું ચાતુર્માસ પોતાની નગરીમાં કરવાની તેમણે વિનંતિ કરી હતી. ભગવાને તે માન્ય રાખી. પ્રલુબ મહાવીર તેજ ચાતુર્માસમાં પાવાપુરીમાં આશો વઢી ૦)) ના રોજ નિર્વાણ પામ્યા.

૨૪૩ હરિકેશબળ.

ગંગાનદીના કિનારા પર એક નાનું ગામડું હતું. તેમાં ચંડાળ જતિના મનુષ્યો રહેતા હતા. ત્યાં બળક્ષાટ નામે એક ચંડાળ હતો. પોતાની ન્યાતનો તે આગેવાન હતો. તેને એ સ્ત્રીઓ હતી. ૧ ગૌરી અને બીજી ગાંધારી. ગાંધારીથી તેને એક પુત્ર ઉત્પન્ન થયો. તેનું નામ હરિકેશબળ.

હરિકેશ પૂર્વ ભવમાં આલણું હતો અને દીક્ષા લઈને તે દેવલોકમાં ગયો હતો; પણ આલણું જતિમાં તેણે પોતાના ઉત્ત્ય કુળનો અને અથાગ રૂપનો મદ કર્યો હતો. તેથી તે આ ભવમાં નીચ

કુળમાં ઉત્પન્ન થયો, અને ઇપના મદથી તે એડોળ, કાળો અને કદ્વારો થયો. તેનું એડોળપણું જોઈને તેના માબાપ અને સ્વપર જનો સૌ ક્રોધ તેની સામે તિરરકારની નજરે જોતું. એકવાર ગામમાં કંઈક ઉત્સવ હતો. એટલે અધા ચંડાળો એક સ્થળે એકડા થઈ મોઝ શોખ કરી રહ્યા હતા. નાના છોકરાએ નિર્દોષ રમ્મત રમતા હતા. તેવામાં હરિકેશ તેમની પાસે આવ્યો. હરિકેશનો સ્વભાવ તોદ્ધાની હતો, તેથી તે છોકરાએને ભારીને રંભડવા લાગ્યો. છોકરાએ રડતાં રડતાં પોતાના માબાપ પાસે ગયા અને હરિકેશ માર્યાનું કહ્યું: તેમના માયાપોએ બળકોટને ઇરિયાદ કરી. એટલે બળકોટ કોધાયમાન થઈને હરિકેશને ભારવા દોડ્યો. પણ હરિકેશ ત્યાંથી દૂર નાસી જઈને ધૂળના એક ઉંચા ફગલા પર એઠો, અને એકડા થયેલાં સ્વજાતિજનો તરફ દૂર નજરથી તે જેવા લાગ્યો. સધળા ચંડાળો ટોળે મળીને આનંદ કરી રહ્યા હતા, તેવામાં લયંકર પુંઝડા ભારતો એક વિષધર સર્પ તે ટોળામાં આવ્યો. માણુસો લયલીત બનીને આમ તેમ નાસવા લાગ્યા. એક જોરાવર ચંડાળે આવી તે વિષધર સર્પ ઉપર લાકડીનો ઇટકો લગાવ્યો અને સાપના દુકડે દુકડા કરો નાખ્યા.

થાડીવારે ફરીથી લાં એક ખીનો સર્પ આવ્યો. એક એ માણુસો ખોલી ઉઠ્યાઃ—ભારો, ભારો. ત્યારે ખીનાએ કહ્યું:—ભાઈએ, આ સર્પને ક્રોધ ભારશો નહિ, કારણું કે તે એરો નથી. એટલે તે ક્રોધને ઘુંજ કરશો નહિ. સર્પ ધીરે ધીરે ત્યાંથી ચાલ્યો ગયો. માણુસો પુનઃ પ્રમોદ કરવા લાગ્યા.

આ સધળું દશ્ય ધૂળના ફગલા પર દૂર એઠેલો હરિકેશ જોઈ રહ્યો હતો. તેણે વિચાર્યું કે, અહો ! જેનામાં એર હોય છે, તેની ખુરી દશા થાય છે, અને જેનામાં એર હોતું નથી, જે સર્વદા શાંત છે, તેને ક્રોધ સત્તાવતું નથી. ખરેખર, હું એરો છું. મહારો સ્વભાવ

તોષાની છે. તેથીજ લોકો ભને સતાવે છે. માટે મારે આ સ્થાનમાં રહેવું ઉચિત નથી. એમ ધારો હરિકેશ ત્યાંથી જગત માર્ગે હૂર ને હૂર ચાલવા લાગ્યો. ત્યાં રસ્તામાં તેણે એક શાંતમુર્તિ સાધુ મહાત્માને એડેલાં જોયો. જોતાંજ તેનામાં સહભાવ ઉપન થયો. તેણે મુનિના ચરણુમાં શિર ઝૂકાવીને વંદન કર્યું. મુનિ બોલ્યાઃ—હે વત્સ, તું કોણું છું અને અહિં કયાંથી આવી ચડ્યો? હરિકેશો જવાખ આપ્યો: મહારાજ! હું ચંડાળનો પુત્ર છું. મહારા તોષાની સ્વભાવથી વડિલોએ મહારો તિરસ્કાર કર્યો છે, પરંતુ ભને હવે ખાત્રી થઈ છે કે જગતમાં એર અને કંકાસથી જીવની દુર્દ્દશા થાય છે, અને નમૃતાથી જીવનું કલ્યાણ છે. મહારાજ, મેં હવે જ્યાં શાંતિ ભણે ત્યાં જવાનો નિશ્ચય કર્યો છે. તો કૃપા કરી ભને શાંતિનો માર્ગ બતાવશો?

મુનિ સમજ્યા કે આ હળુકમી જીવ છે, તેથી તેમણે હરિકેશને ઓધ આપતાં કહ્યું:—હે વત્સ ! તું શાંતિની શોધમાં છે, તે તને બહાર શોધવાથી નહિ ભણે. ખરી શાંતિ તહારા આત્મામાં રહેલી છે. આ જીવ અનંત કાળથી ૮૪ લાખ જીવ યોનિમાં રખડ્યો છે. અને કલેશ, પ્રપંચ, નિંદા, કષાય, પ્રમાદ વડે સંસારમાં દુઃખ પામે છે. માટે ભાઈ, તહારે ખરી શાંતિ જોઈતી હોય, તો જગતની સર્વ ઉપાધિ, સર્વ માયાનો પરિલાગ કર અને મહારી જેમ ત્યાગદરશાને આધિન થા, તોજ તહારું કલ્યાણ થશો. આ સાંભળી હરિકેશ બોલ્યાઃ—પણ ગ્રહુ, હું ચંડાળ છું ને ! શું તમે ભને દીક્ષા આપી શકશો?

‘હા, ચંડાળ હો તેથી શું થયું ? પ્રલુ મહાવીરના માર્ગમાં સર્વ ક્લેશને આત્મ કલ્યાણ કરવાનો હકુ છે. મુનિનું કથન સાંભળી હરિકેશએ ત્યાંજ મુનિ પાસે દીક્ષા અંગીકાર કરી અને એકાંત તપ કરવા તેઓ જગતમાં નીકળી પડ્યા. લાંથી કરતાં કરતાં હરિકેશમુનિ વારાણશી નગરીના તિંદુક નામના ઉઘાનમાં પધાર્યા, અહિં તિંદુક નામના યક્ષનું

મંદિર હતું, તેમાં હરિકેશ મુનિ કાચોતસર્ગ ધ્યાનમાં લીન રહ્યા. તિંદુક નામનો યક્ષ હરિકેશ મુનિની તપશ્ચયર્થી અને ચારિત્રથી પ્રસન્ન થઈ તેમનો લક્ષ બન્યો અને મુનિની સેવા ચાકરી કરવા લાગ્યો.

હવે તે નગરના રાજની પુત્રી ભદ્રા કેટલીક સખીઓ સાથે તિંદુક યક્ષની મૂળ કરવા આ ઉદ્ઘાનમાં આવી. ત્યાં તેણે મેલાં ધેલાં વખ્તવાળા અને કદ્દરપા શરીરવાળા હરિકેશને જોયા, તેમને જેતાંજ તે ધૂણા પામી અને મુનિની નિંદા કરવા લાગી. પેલા યક્ષથી મુનિની થતી નિંદા સહન થઈ નહિ. તેથી તે રાજપુત્રી પર ગુર્સે થયો, અને ક્ષણબરમાં તેને જમીન પર પછાડી ઢીધી. બાળા મૂર્છા પામી, અને એહોશ બની ગઈ. તેના શરીરમાંથી ઇધિર નીકળવા માંડયું. આ જોઈ તેની સખીઓ ગલબાઈ ગઈ અને રાજ પાસે જઈ સધળી વાત નિવેદન કરી. રાજ તિંદુક ઉદ્ઘાનમાં આવ્યો. તેણે જાણ્યું કે પુત્રીએ આ તપસ્વી સાધુની નિંદા કરી હશે, તેથી સાધુએ કોપાયમાન થઈ આ પ્રમાણે કર્યું લાગે છે. એમ ધારી રાજ એ હાથ જોડી મુનિ પ્રત્યે કહેવા લાગ્યો. હે મહારાજ, મહારી પુત્રીનો અપરાધ ક્ષમા કરો. તરત પેલે યક્ષ રાજપુત્રીના શરીરમાં પેસી ગયો. અને બોલ્યો:-હે રાજન! નો, તું તહારી પુત્રીને આ મુનિ સાથે પરણુવે તોજ તે બચે. આ સાંલળી રાજ પોતાની પુત્રીને મુનિ સાથે પરણુવવા કણુલ થયો, એટલે યક્ષ તે બાળાના શરીરમાંથી નીકળી મુનિના શરીરમાં પેડો. પુરોાહિતને બોલાવી રાજએ મુનિ સાથે તે બાળાનું લમ્બ કર્યું. તરતજ તિંદુક યક્ષ મુનિના શરીરમાંથી નીકળી સ્વસ્થાનકે ગયો. બાળાએ મુનિને કહ્યું: મહારાજ! મેં તમારી નિંદા કરી હતી, તો મારો અપરાધ ક્ષમા કરો અને મારો ગ્રેમ સ્વીકારો. આ સાંલળી હરિકેશ મુનિ બોલ્યા:-હે બાળા, હું પંચ મહાવતધારી સાધુ છું અને ધ્યાનધારી છું. અમારાથી મન વચન કાયાએ સ્વી સમાગમ થઈ શકે નહિ. બાળા! મેં તારી સાથે

લમે કર્યું નથી. પણ આ યક્ષ મારા શરીરમાં પ્રવેશવાથી આમ બન્યું છે, માટે કૃપા કરી તમે કૃતી આવું વચ્ચન મારો સાથે બોલતા નહિ. બાળા મુનિના વચ્ચનથી નિરાશ થઈ, અને ધેર આવી તેણે રાજને સર્વ વાત વિદ્ધિત કરી. રાજએ પુરોહિતને ખોલાવ્યો. પુરોહિતે જણાવ્યું:—મહારાજ ! યક્ષથી ત્યન્યેલ બાળા પુરોહિત-ધાલણું આપી શકાય છે. રાજએ પોતાની પુત્રીને રક્ષણ નામના પુરોહિત સાથે પરણાવી. પુરોહિત રાજકન્યા ભળવાથી ધણે. રાજ થઈ ગયો.

પુરોહિતે આ કન્યાને પવિત્ર કરવા માટે એક પ્રચંડ યજી આરંભ્યો. અનેક ધાલણોને તે યજીમાં તેણે નોતર્યા. તે સર્વની જમવા માટે અનેક પ્રકારના સ્વાદિષ્ટ લોજનો રંધાવ્યાં. ધાલણો યજી મંડપમાં વેદ મંત્રોચ્ચાર બોલવા લાગ્યા. તેવામાં હરિકેશ મુનિ લિક્ષાર્થી કૃતા કૃતા આ યજ્ઞપાડામાં આવી પહેંચ્યા.

જા હોઠ અને લાંબા દાંતવાળા આ કદ્દરપા અને બેડોળ મુનિને દેખી કેટલાક અલિમાની ધાલણો ગુરસે થઈ બોલી ઉડ્યાઃ અલ્યા, તું કોણું છે ? અને આ વાધરી જેવા વેશો અહિં કેમ આવ્યો છે ? ચાલ્યો જ અહિંથી જલ્દી, નહિ તો જીવતો નહિ રહેવા પામે.

આ સાંભળી હરિકેશ બોલ્યા:—ભૂદેવો ! કોધ ન કરો. હું અહિં લિક્ષા બેવા સાડું આવ્યો છું.


‘લિક્ષા બિક્ષા અહિં નહિં ભળે. તારા જેવા ભામટા માટે અમે ભોજન નથી બનાવ્યું. આ ભોજન તો અમારા જેવા પવિત્ર ધાલણોને જમવા માટે છે. કદાચ આમાંનું ભોજન વધે તો અમે તે ફેંકી દઈએ; પણ તારા જેવા બેડોળ બિખારીને તો હરગીજ નહિ આપીએ. માટે આવ્યો તે રસ્તે ચાલ્યો જ, નહિતો જેરજુલમથી અમે તને મારીને હાંકી કહાડીશું.’ ઉક્ત કઠિન શંખો ધાલણના મુખેથી સાંભળી હરિકેશ બોલ્યા:

‘હે ભૂહેવો, હું અલ્લયારી છું, નિરંતર તપશ્ચર્યા કરે છું, આસત્ય બોલતો નથી, અને વધેલાં અન્નમાંથી નિર્દોષ ભોજન લઈ છું. તમે તો યજ્ઞમાં ડિંસા કરો છો, જુહું બોલો છો, અલ્લયાર્ય પાળતા નથી, માટે હું પવિત્ર છું તો મને તમારા માટે નીપળવેલાં ભોજનમાંથી થોડુંક આપો.’

આ સાંલળતાં આલણો વધુ ગુર્સે થયા અને મુનિને લાંથી હાંકી કાઢવા તત્પર થયા. યુવાન આલણો એકદમ યજ્ઞ મંદુપમાંથી અહાર નીકળી આવ્યા, અને સૌ કોઈ મુનિને ભારવા લાગ્યા. આ આ દશ્ય તિંહુક યક્ષના જેવામાં આવ્યું. તેથી તે મુનિની બહારે આવ્યો અને મુનિના શરીરમાં પેસી ગયો. પેસતાં જ તેણે પોતાના પ્રચંડ ઘળથી અનેક આલણોને લોંય લેગા કરી દીધા. કેટલાકના નાક, કાન, મહેં છુંદી નાઘ્યાં, કેટલાકના શરીરમાંથી લોહિની ધારાઓ વહેતી કરી દીધી. એટલામાં ઇદ્રદાત આલણ અને રાજકુન્યા લદ્રા લાં આવી પહોંચ્યા. લદ્રા હરિકેશ મુનિને ત્યાં ઉલેલા જોઈ આશ્ર્ય પામી અને તેમને એળાખી તેમના ચરણમાં તેણીએ વંદન કર્યું.

લદ્રાએ ખીજ ભૂહેવોને કહ્યું: તહે આ મહામુનિની નિંદા શા માટે કરો છો ? આ તો મહાપ્રતાપી તપસ્વી મહાત્મા છે, અને બાળ અલ્લયારી છે. યક્ષના પ્રભાવે તે મહને પરણ્યા હતા, પરંતુ પોતે અલ્લયારી હોવાથી તેમણે ભારો લાગ કરેલો. માટે આ પવિત્ર મુનિને જે જોઈએ તે ખુશીથી આપો. એમ કહી તે લદ્રા મુનિની ક્ષમા માગવા લાગી. યક્ષ આ વખતે મુનિના શરીરમાંથી પલાયન કરી ગયો. એટલે મુનિએ બાળાને કહ્યું:-હે બાળા, હું ત્યાગી અને તપસ્વી છું, મહારાથી કોધ થઈ શકે નહિ; પણ યક્ષના પ્રવેશવાથી આમ ઘન્યું હતું. ભારે માસક્ષમણું આને પારણું છે. માટે તમે યજ્ઞ માટે નિપળવેલાં અન્નમાંથી મને થોડુંક આપો. તરત રાજકુન્યાએ હરિકેશ મુનિને લિક્ષાદાન આપ્યું. સુપાત્ર દાનના પ્રભાવે ‘અહો-દાનં, મહાદાનં’ એવો ત્યાં આકાશ ધ્વનિ થયો. યજ્ઞ પાડામાં

દિવ્ય સુવર્ણની વૃષ્ટિ થઈ સૌ કોઈ સ્તબ્ધ બનોને મુનિની ક્ષમા ભાગવા લાગ્યા. હરિકેશ મુનિએ તેમને ધર્મભોધ આપ્યો. ક્રિટલાક જાલણેને મુનિનો ઉપદેશ રચ્યો, તેથી તેમણે દીક્ષા લીધી. એમ અનેક જનોને પ્રતિભોધ પમાડી, અદ્ભુત તપશ્ચર્યા કરી, હરિકેશખળ મુનિ ચંડાળ કુળમાં ઉપજેલા છતાં આત્માની ઉચ્ચ્યતમ ભાવનાને ભાવતાં કૈવલ્યજ્ઞાન પામ્યા, અને નિર્વાણપદને પહોંચ્યા. ધન્ય છે ! હરિકેશ મુનિ સમા મહાન તપસ્વી ક્ષમાશ્રમણુને ! તેમને આપણા અનેક વંદન હો !!!



સમાપ્ત.

કલ્યાણ સાધના

તારાં સગાંસઅંધી, વિષયભોગો કે દ્વયસંપત્તિ તાં રક્ષણુ કરી શકતાં નથી, કે તને બચાવી શકતાં નથી; તેમજ, તું પણ તેમનું રક્ષણુ કરી શકતો નથી, કે તેમને બચાવી શકતો નથી. દરેકને પોતાનાં સુખ દુઃખ જાતેજ લોગવવાં પડે છે. માટે, જ્યાં સુધી પોતાની ઉંમર હળ્ણુ મૃત્યુથી ધેરાઈ નથી, તથા શ્રોત્રાદિ ધનિદ્રયોનું બળ તેમજ પ્રરૂપ સ્મૃતિ-જ્ઞાન શક્તિ વગેરે કાયમ છે, ત્યાં સુધી, અવસર ઓળખી. શાણા પરંથે પોતાનાં કલ્યાણ માધી લેવં લોભિયો.

—શ્રી આચાર્ણગ સૂત્ર.

* * *

જેને તું હણવાનો વિચાર કરે છે, તે તું પોતેજ છે; જેને તું આજા આપવા માગે છે, (જેના પર તું અધિકાર લોગવવા માગે છે) તે તું પોતેજ છે; જેને તું સંતાપ આપવા ચાહે છે, તે તું પોતેજ છે; જેને તું દબાવવા ધર્યાછે છે, તે તું પોતેજ છે અને જેને તું ઉપક્રમ કરવા માગે છે તે પણ તું પોતેજ છે.

સજજન માણસ આ પ્રમાણે સમજુને પોતાનું જીવન વીતાવતો છતો, કોઈ પણ જીવને ભારતો નથી, ખીણની પાસે ભરાવતો નથી અને (ખીણ જીવ પ્રતિ આચરેલું દુઃખાદિ) પોતાને-આત્માને પાછળથી ભોગવવું પડે છે એમ સમજુને તેને ચાહતો પણ નથી.

—શ્રી આચાર્ણ સૂત્ર.

* * *

अंतःकरण्यपूर्वक सत्यनी अन्वेषणा कर! अने सर्व जुवे पर
भैत्रीलाव धारणा कर! —श्री उत्तराध्ययन सूत्र.

* * *

પીળું જીર્ણું પાંદડું નેમ રાત્રિના સમૂહો પસાર થયે (કાળ પૂરો થઈ ગયા પછી) પડી જાય છે. તેમ મનુષ્યોનું જવિત પણ આચુષ્ય પૂર્ણ થયેથી પડી જાય છે. માટે હે ગૌતમ, સમય માત્રનો પ્રમાણ ન કર. —શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર.

— श्री उत्तराध्ययन सूत्र,

વાંચવા લાયક જન પુસ્તકો.

આદર્શ રત્નો	૦—૮—૦
જન્યુસ્વામી ચરિત્ર	૦—૮—૦
શ્રીમહે રાજયંક વિચાર નિરીક્ષણ	૦—૧૦—૦
સમકિત સાર ભા. ૧-૨	૧—૦—૦
પ્રગાપના સૂત્ર ભા. ૧-૨-૩	૧૬—૦—૦
ઉત્તરાધ્યયન સૂત્ર (અનુવાદ)	૦—૬—૦
આચારાંગ સૂત્ર „	૧—૦—૦
રાયગ્રશીય સૂત્ર „	૦—૧૦—૦
ત્રિપદીશલાકા પુરુષ પર્વ-૧ થી ૧૦ પુસ્તક ૫	૧૨—૦—૦
ઉપમિતિ ભવપ્રપંચા કથા ભા. ૧ થી ૩	૮—૮—૦
સૂયગાંગસૂત્ર ભા. ૧ થી ૫ (ટીકા સાથે)	૬—૪—૦
કલ્પસૂત્ર સચિત્ર ગુજરાતી	૩—૦—૦
પ્રશ્નોત્તર મોહનમાળા (ઉત્તરાધ્ય)	૧—૮—૦
શ્રી સિદ્ધાંતસાગર (થોકડાઓ)	૧—૦—૦
વિવેકવિલાસ (ન્યોતિષ)	૨—૮—૦
અધ્યાત્મ કલ્પદુમ	૨—૮—૦
શ્રીપાળનો રાસ (સચિત્ર ભાષાંતર)	૧—૪—૦
પ્રત્યેક બુદ્ધ ચરિત્ર	૧—૪—૦
મહાવીર અને શ્રેણીક	૧—૮—૦
જૈન સજ્જાયમાળા ભા. ૧ થી ૪	૫—૦—૦
જૈન ધર્મ	૨—૦—૦
ઉપાસક દશાંગ (કરાંચીનું ટીકાવાળું)	૨-૧૨-૦
પુંડરિક ચરિત્ર	૨—૦—૦
મહાવીર જીવન વિસ્તાર (સચિત્ર)	૧—૦—૦
ઉપરાંત જૈન સૂત્રો, અંથો, ચરિત્રો, રાસો, પાઠ્ય પુસ્તકો આદિનો સારો સ્ટોક હમેશાં શિલિકમાં રહે છે. વધુ માટે સ્નેહિપત્ર મંગાવો. પત્રવ્યવહાર—જીવનલાલ છગનલાલ સંઘર્ષી પંચલાઈનીપોણ : અમદાવાદ	

૧ ત્રીકુમળ અભીયંદ
 ૧ ભયાશંકર લીલાધર
 ૧ પારેખ ઉત્તમયંદ ત્રીલોવન
 ૧ સંધવી ગોકળિદાસ નેણુશી
 ૧ લાલજી સુંદરજી નાથડા
 ૧ શેઠ છગનલાલ લાલયંદ

૮ વાંકાનેર

૧ સંધવી ઝુંઝાલાધ સોમયંદ
 ૧ વખારીયા જટાશંકર જગળુવન
 ૧ સંધવી વીકુમયંદ જેયંદ
 ૧ સંધવી મોહનલાલ શામળ
 ૧ સંધવી અભ્રતલાલ શામળ
 ૧ મેતા કંતિલાલ કુપુરયંદ
 ૧ મેતા વાધજી ગુલાબ્યંદ
 ૧ શા. મગનલાલ કાલીદાસ

૯ કન્તાસગદ

૧ દેવયંદ અમુલખ મહેતા
 ૧ કુલયંદ કીરચયંદ દોશી
 ૧ પાનાચંદ ઘોડીદાસ મહેતા
 ૧ રતીલાલ કેસવજી મહેતા
 ૧ હરસુખલાલ હરખયંદ દોશી
 ૧ શંકરલાલ ઉમિયાશંકર મહેતા

૧૦ ઊરીએા

૧ જયાશંકર કાલીદાસ ખોખાણી
 ૧ જગળુવન માણેકુયંદ મહેતા
 ૧ નાગરદાસ એચ શાહ
 ૧ લવજી વલ્લમળ માટલીયા

૧૧ રાયપુર

૧ લાઈ સુલતાનયંદ લખમીયંદ
 ૧ લાઈ જસકરણજી ડાગા

૧ લાઈ ખુશાલયંદ માણેકુયંદ
 ૧ લાઈ છગનલાઈ મુળયંદ
 ૧ લાઈ નાગજી પાનાચંદ
 ૧ લાઈ પરસોતમ જીવન
 ૧ લાઈ શામળ કાલીદાસ

૧૨ સરસાધ

૧ શ્રી સરસાઈ નૈત લાયબેરી
 ૧ ગાંધી જેયંદ ટીડાલાધ
 ૧ શાહ મોતીયંદ સોમળ
 ૧ શાહ મોનજી પરસોતમ
 ૧ શાહ રતીલાલ શામળ
 ૧ ખદાણી રામજી છીરાચંદ
 ૧ ગાંધી રાધવજી કાલાલાધ
 -મોણીયા

૧૩ ગઢડા

૧ નારણદાસ ભીખાલાઈ પોસ્ટ
 માર્ટર
 ૧ કામદાર માણેકુયંદ ટોકરશી
 ૧ ગોસલીયા નરસીદાસ ગોકળ
 ૧ શા મોહનલાલ પ્રેમયંદ
 ૧ એન સાંકળી વર્ધમાન
 ૧ કેરોસીન નૈતશાળ હ.
 પોપટલાલ

૧૪ રાધવજી

૭ પુના

૭ કાવેડીયા ગુલરાજ સંતોકુયંદજી
 સાદડીવાળા

૧૫ ઉપદેયા

૨ દોશી દેવયંદ હરખયંદ
 ૧ દોશી મુળજી મકનજી
 ૧ દોશી નેમયંદ શવજી

- ૩ શા વનમાળિદાસ હરજીવન
 ૧ કુપુરચંદ ખેતરથીભાઈ
 ૧ શા કુરાલાલ જેચંદ
 ૧ પારેખ મોનણ જવેરચંદ
 -તણુસવા
 ૧ કામદાર નેમચંદ જીવરાજ
 -મુળીલા

૪ ગોંડલ

- ૨ જેસુખલાલ કે આટલીયા
 (મુનસર સાહેખ)
 ૨ શેઠ કુપુરચંદ ગોવિંદજી
 (મોલમૈન)

૪ વઢવાણુકેન્દ્ર

- ૨ દોશી ઇતેચંદ ત્રીલોલન
 ૧ શ્રી સ્થા. રૂનવર્ધક લાયથેરી
 ૬. ત્રીલોલન ઉજમશી કોડારી
 ૧ ગોસલીયા મનસુખ રાધવજી
 -ગોદાવરી

પરચુરણ

- ૧ વોરા ચત્રભુજ મગનલાલ
 વઢવાણ શહેર
 ૧ ગાંધી છોટાલાલ તરલોલન „
 ૧ પા. લાધલાલભાઈ મથુરભાઈ
 ઘોટાલા
 ૧ પા. ડાલ્લાભાઈ ત્રિલોલન „,
 ૨ ભા. શીવલાલ નરશીદાસ સુરત
 ૧ ચંદુલાલ ગુલાબચંદ દેસાઈ: મુંબાઈ
 ૧ શા. છગનલાલ કેશવજી „,
 ૧ પુનાતર નરલેરામ વી. દેવજી-
 ભાઈ જામનગરવાળા મોભાસા

- ૧ શાંતિકુમાર જૈન-સુલતાનપુર
 ૨ ગણેશમલજી ગણીરામજી-
 બારમેર
 ૧ શાંતિલાલ હાકરશી પરીખ
 રંગપુરવાળા-ગોવાપંજ
 ૧ મહેતા દુર્લભજી જીવરાજ-
 કલકૃતા

- ૨ શા. છગનલાલ નેમચંદ-દલાણી
 ૩ શા. ઇકીરચંદ મોતીચંદ આમોદ
 ૧ શા. કાલીદાસ ભાઈચંદ-
 સતારારોડ
 ૧ જૈન ગુરુકુળ-ધ્યાવર
 ૧ પારેખ રેવાશંકર દુર્લભજી-કલટન
 ૧ શેઠ ગંગાદીન જગજીવન-કાનપુર
 ૧ અગવાનજી ગોવિંદજી-ખામગામ
 ૧ ધીરજલાલ મોતીચંદ મહેતા
 દીલહી

- ૧ શા. રાયચંદ ધનજીભાઈ-
 ઉમરાયા

- ૧ શા. પરસોતમ કાલીદાસ
 ૬. પદમશી-હડાલા

- ૧ શ્રી સ્થા. જૈન લાયથેરી ૬.
 ડો. મુળજી રામજી-જેતલસર

- ૧ જેઠાલાલ વસનજી મહેતા-
 જેતપુર

- ૧ નંદલાલ ધારથીભાઈ કોડારી „,
 ૧ શા. વાડીલાલ નાનચંદ રંગપુર
 ૧ હીરાચંદ કશળચંદ સુલ
 માસ્તર-પોલારપુર

૧ શા. વીરજુલાઘ ખીમચંદ-	૧ શા. પ્રેમચંદ વસનજી-
નાવડા	વેરાવળ ખંદર
૧ કામદાર મોહનલાલ હીરાચંદ	૧ સ્થા. જૈન ઉપાશ્રય હ. શા.
બાખરા	વાલજી મનજી-કાટકોરા
૧ શા. ત્રંખુકલાલ કુંવરજી-રખોલ	૧ લલુભાઈ નાગરદાસ-ચંદરવા
૧ હેસાઈ જગજુવનજીચંદભાઈ-	૨ શ્રી શ્રે. સ્થા. જૈન પાર્શ્વનાથ
બગસરા	મિત્ર મંડળ-ખદનાવર
૧ શા કુંવરજી જાદવજી-પાલેજ	૧ અંબાલાલ રણુછોડભાઈ
૧ ડોડારી વણરાજ કાલીદાસ-	શીવરાજપુર
વડાલ	૧ સ્થા. જૈન સંધ. હ. પુંજુલાલ
૧ ગુલાખચંદ તુલસીદાસ ગાંધી	હિંમતલાલ-પ્રાંતીજ
ધોઘલા (દીવ)	૧ શેડ આત્મારામ મોહનલાલ કલોલ
૧ શા દામોદર મુળચંદ „	૧ શ્રી લવજી સ્વામી જૈન ફ્રી
૧ શા ધીરજલાલ લખમીચંદ-	લાયથેરી-ચોટીલા
વીધીયા	૧ શ્રી લવજી સ્વામી સ્મારક
૧ સ્થા. જૈન સંધ—સુદામડા	લાયથેરી-જુનાગઢ
૧ શા. મગનલાલ લખમીચંદ	૧ થી લવજી સ્વામી સ્મારક જૈન
ઓડેલી	લાયથેરી-આણંદપુર
૧ ગો. રવજી નારણજી, સેકેટરી	૧ „ „ „ ભાડલા
સ્થા. જૈન સંધ-માંગરોળ	૧ „ „ „ ખીરસરા
૧ છોટલાલ ગુલાખચંદ શાહ-	૧ „ „ „ ખાટડી
નાર	૧ „ „ „ રામપુરા
૧ દોશી જીવરાજ લાલચંદ-	૧ „ „ „ સેજકપુર
સાણુંદ	૧ „ „ „ ખેડુ
૧ શા વાડીલાલ આશારામ „	૧ „ „ „ વસતડી
૧ ઝપાણી પ્રાગજ રવજી પુસ્તકા-	૧ „ „ „ દેદાદરા
લય-લોસાણુ	૧ „ „ „ અંકેવાળીયા
૧ વોરા મુળચંદ હરખચંદ-	૧ „ „ „ રાજપુરા
જસદણ	૧ „ „ „ જમકુરાણુ
૧ ભા. ચંપકલાલ મગનલાલ-વસો	
૧ શા. હરગોવન ધરમશી-પીપરડી	

- ૧ „ „ ચુડા
 ૧ „ „ કર્ણ-અંજાર
 ૧ શ્રી પાનાચંદ્ર સ્વામી રમારક
 નૈત લાયથેરી--ચણુકા
 ૧૫ વડોદરા
 ૧ મણીલાલ ભાઈભાઈચંદ્ર મહેતા
 ૧ શા અભીચંદ્ર ભાણુકચંદ્ર
 ૧ શા એચરભાઈ છોટાલાલ
 ૧ શા મોતીચંદ્ર છોટાલાલ
 ૧ શા કસ્તુરચંદ્ર છોટાલાલ
 ૧૦ શા નાથલાલ ગોરધન
 યુક્સેલર ટે. કરોળાયાપોળ
 ૧૧ વણુષ્ઠરા
 ૧ શા. હીરાલાલ શામળાસ
 ૧ શા. હીરાલાલ ભવાનીદાસ
 ૧ શા. મહાસુખભાઈ શીવલાલ
 ૧ શા. ચુનીલાલ કણીદાસ
 ૧ શા. મગનલાલ ભાણુકચંદ્ર
 ૧ શા. લખમીચંદ્ર રામદાસ
 ૧ શા. હીમતલાલ કુલચંદ્ર
 ૧ શા. મહાસુખભાઈ લલુભાઈ
 ૧ શા. મગનલાલ ભવાનીદાસ
 ૧ શા. ભાયચંદ્રભાઈ અમરચંદ્ર
 ૧ શ્રી નૈત લાયથેરી ખાતે
 ૭ વીરમગામ
 ૧ શા ટોકરશી છગનલાલ
 ૧ શા ઓધિલાઈ કેશવજી
 ૧ શા ચંદુલાલ જેસિંગભાઈ
 ૪ શા નથુલાઈ નાનચંદના વિધવા
 ભાઈ જીવીએન
 ૭ ધારી
 ૧ શાહ જગળવન ગોવિંદજી

- ૧ શાહ અમૃતલાલ સુંદરજી
 ૧ ગાંધી દલીચંદ્ર કશળચંદ્ર
 ૧ ગાંધી કશળચંદ્ર હ. બાઈ ગોદાવરી
 ૧ શાહ રણુષોડ જુદાલાઈ
 ૧ બહેન કેશર બહેન
 ૧ કામદાર દેવચંદ્ર હેમચંદ્ર બગસરા
 ૧૬ કર્ણ
 ૧ શા. રવજી ડાલ્ખાલભાઈ-દેશલપુર
 ૧ મેતા છગનલાલ દેવચંદ્ર દરશકી
 ૨ દોશી શાંતિલાલ ભાવજી—
 માંડવી બંદર
 ૧ ડો. મોહનલાલ એસ હેસાઈ—
 ગઢસીસા
 ૧ મેતા વેલજી વીસનજી ભાન કુવા
 ૧ શ્રી ચંદ્રોડા નૈત સ્થાનક
 હ. મેતા નેરામ લગવાનજી
 ૧ મેતા પ્રતાપશી ગલાલચંદ્ર ભુવડ
 ૧ મેતા વેલજી આશકરણ „
 ૧ શા વદ્ધમજી ઘેંગાર લાખાપુર
 ૧ મેતા ડાકરશી જાદવજી ઘેડોઈ
 ૧ શા જીવરાજ કચરાણી ”
 ૧ શામજી મેધજી ચંદીઆ
 ૧ ગાંધી ઓધિવજી અજરામર ભથડા
 ૨ શા શંભુલાઈ પરસોતમ અંનર
 ૩ પડધરી
 ૧ પડધરી રૂન લંડાર
 ૧ પટેલ નેઠાલાલ પાનાચંદ્ર
 ૧ મેતા લીમજી ગોવિંદજી

પુરવાળી અને શુદ્ધિ

વાર્તા નં. ૧—અકંપિત ૩૦૦ શિષ્યોના અધ્યાપક હતા. ૪૮ મા વર્ષે દીક્ષા લઈ, ૫૮ મા વર્ષે કૈવલ્યજ્ઞાન પામ્યા. ૨૧ વર્ષ કૈવલ્ય પ્રવન્ના પાળી, ૭૮ વર્ષની ઉંમરે મોક્ષમાં ગયા.

વાર્તા નં. ૨—ગોઅરગામ મગધદેશનું હતું. અમિભૂતિ ૫૦૦ શિષ્યોના અધ્યાપક હતા. ૪૭ મે વર્ષે દીક્ષા લઈ ૫૮ મા વર્ષે કૈવલ્યજ્ઞાન પામ્યા. ૧૬ વર્ષ કૈવલ્ય પ્રવન્ના પાળી, ૭૪ વર્ષે વૈલા-ભારગિરિ પર એક ભાસના અનશનને અંતે મોક્ષમાં ગયા.

વાર્તા નં. ૩—કૌશાંથી નહિ, પણ કોશલા (અયોધ્યા) નગરી જોઈએ. અચળભાતાને ૩૦૦ શિષ્યો હતા. ૪૭ મા વર્ષે દીક્ષા, ૫૮ મા વર્ષે કૈવલ્યજ્ઞાન, ૧૪ વર્ષની કૈવલ્ય પ્રવન્ના અને ૭૨ મા વર્ષે મુક્તિપદ પ્રાપ્ત કર્યું.

વાર્તા નં. ૪—અજુતનાથ છેદ્વા તીર્થીકર નહિ, પણ ખીજ તીર્થીકર છે.

વાર્તા નં. ૨૮—અલગગ્રસેન અથવા અલગ્રસેન.

વાર્તા નં. ૨૦—અલિય, અલિયિ અથવા અલિજ પણ કહે છે.

વાર્તા નં. ૩૦—અર્તુનમાળીના છ મિત્રો હતા એમ નહિ, પણ ખીજ કોઈ છ મિત્રો હતા.

વાર્તા નં. ૫૩—અંબડ સાથે નહિ, પણ અંબડ વિના શિષ્યો તૃપ્તાતુર હતા.

વાર્તા નં. ૫૬—આનણ ચંડાલ નહિ, પણ કરકંડુને ચંડાલ ધારી દધિવાહન ઉશકેરાયો હતો.

વાર્તા નં. ૭૨—ગૌતમસ્વામી ક્રેશાસ્વામી પાસે આવ્યા, પણ વંદન કરવા જવું જોઈએ અને લાવયુક્ત વંદન કર્યું એ હકીકત આગમપાઠે નથી. વ્યવહાર હોવો સંભવિત છે.

વાર્તા નં. ૮૨ તથા વાર્તા નં. ૨૫૬—ગર્દાબાળમુનિ અને સંયતિરાજ સંબંધીની વાત આ ગ્રંથમાં લખ્યા અનુસાર પરંપરાથી

ચાલી આવી છે; પરન્તુ આ બાયત વિદ્ધાન અનુભવીઓ પ્રકાશ પાડે છે, કે મૃગ મુનિનું હશે, એવું ધારીને સંયતિ રાજ દિલગીર થયો, એમ નહિ; પરન્તુ હરિણુના ટોળા પાછળ ગઈલાળી મુનિ ધ્યાનસ્થ એહા હતા, રાજએ સામેથી બાણો ફેંકી મૃગને માર્યું. તે મૃગ કેવા જતાં રાજએ મુનિને જેયા અને તે ગભરાયો કે અવસ્થ આ મહાત્માને માર્યા બાણ વાગ્યું હશે! એવા સંબ્રમથી રાજ ગભરાઈને મુનિ પાસે જય છે.

વાર્તા નં. ૧૧૬—બલિયંચાના ઈદ્રનું આસન ચલિત થયું નથી, પણ લાં ઈદ્રનો અભાવ છે, તેથી ત્યાંના દેવ દેવીઓએ ત્યાં આવવાનો સંકલ્પ કરવાનું તામલી તાપસને કહ્યું. (પૃ. ૧૫૫) દેવદેવીઓ ઈશાન ઈદ્ર પાસે આવ્યા નથી, પણ ત્યાં રહી ક્ષમા માગી, એટલે તેમને છોડી મૂક્યા.

વાર્તા નં. ૧૪૭—નંદીષેણુને ભોગાવલી કર્મ બાકી છે, માટે દીક્ષા કેવાની દેવે ના કહી એ વાર્તા અંથકથાની છે. લ. મહાવીરે તેને ધીરજ ધરવાનું કહ્યું તે બરાબર નથી.

વાર્તા નં. ૧૮૯—રાજેમતી દીક્ષિત થર્ધને જયાં આગળ ચાલ્યા જય છે, ત્યાં વર્ષાદ થવાથી પર્વતતી ગુઝામાં જય છે, એમ સમજવું.

વાર્તા નં. ૧૯૪—તમારા વાસણુમાં એ પાક થાડો ચોંટેલો રહ્યો છે તે વહોરાવો, એ અર્થ પરંપરા બરાબર નથી; પણ એ પાક અન્યને અર્થ કરેલો છે, તે કેવો છે. ત્યારે રેવતી તે પાક પુષ્કળ હતો તેટલો વહોરાવી નાખે છે.

વાર્તા નં. ૨૧૫—પ્રભુ મહાવીર સક્રાલને ત્યાં સમજવવા ગયા નથી; પણ ત્યાં ધર્મોપદેશ વખતે સમજવવા પ્રયત્ન કરે છે.

વાર્તા નં. ૨૨૧—સથૂળીભદ્રની વાત જે કે મહાવીર નિર્વિષુ પદ્ધતિની છે અને કથાગંથે પરંપરાથી ચાલી આવે છે; પણ વેશ્યાને ત્યાં ચાતુર્માસ રહેવું એવી પ્રભુઆજા સંભવતી નથી, એવો વિદ્ધાનોનો ભત છે.

અગાઉથી થયેલા ચાહકોની નામાવળી

૧૫૨ ચાટીલા

- ૧૫૧ શેઠ નેમચંદભાઈ ઢાકરશી
 ૩૪ બોણાદ
 ૧ વૃજલાલ ભુદરભાઈ શેઠ
 ૧ વકીલ હિંમતલાલ વેલશી
 ૧ દોશી સોમચંદ માણેકચંદ
 ૪ સ્થા. જૈન પાઠશાળા
 ૧ શા. લખમોચંદ દેવશી
 ૧ વૈદ ગીરધરલાલ છગનલાલ
 ૧ વોરા વખતચંદ લક્ષ્મીચંદ
 ૧ શા જ્યંતિલાલ ધનજીભાઈ
 ૧ શા ગાંડલાલ નાનચંદ
 ૧ શા ગાંડલાલ જશા
 ૧ ખંધાર મોહનલાલ જીવાલાઈ
 ૧ ખંધાર ચતુર કલાણ
 ૧ ગોપાણી ભુદર ઢાકરશી
 ૧ ગોપાણી લખમીચંદ ચતુર
 ૧ ગોપાણી ઓઘડ મુળચંદ
 ૧ દોશી નરોતમ નરશી
 ૧ માસ્તર સુખલાલ શીવલાલ
 ૧ શા ગુલાખચંદ કાળીદાસ
 ૧ ગોપાણી નાગર વિઠલ
 ૧ શા અપ્રતલાલ દીપચંદ
 ૧ પા. રતનશી નથુ ભાવસાર
 ૧ ભાવસાર વીઠલ નરશી
 ૧ „ ખીમચંદ નીમજી

- ૧ ગાંધી અનોપચંદ ચત્રભુજ
 ૧ મણીયાર નાનચંદ ખાવાલાઈ
 ૧ પારેખ જગજીવન નાનચંદ
 ૧ વસાણી કસ્તુર હરીચંદ
 ૧ નાગલપુર સ્થા. જૈન સંધ
 ૬. સલોટ મોહનલાલ
 પાનાચંદ

૧ શા. મુળચંદ હીરાચંદ
 એડી પીપરડી

- ૧ શા. પ્રેમચંદ તારાચંદ
 ૧ ભા. ત્રીલોલન વેલશી

૩૭ અમદાવાદ

- ૫ શેઠ આત્મારામ માણેકલાલ
 ૫ હિંમતલાલ ગીરધરલાલ
 પારેખ
 ૨ ભા. છગનલાલ શામળાસ
 સરસપુર
 ૨ સંધવી ધરમશી માણેકચંદ
 ૨ મોતોચંદ ધારશીભાઈ દોશી
 ૧ મોરારજ ધનજીભાઈ પડીયા
 ૧ સ્થા. જૈન ભિત્ર મંડળ
 ૧ લખમીચંદ જવેરચંદ
 સંધવી
 ૧ શા પ્રેમચંદ સાંકળચંદ
 ૧ શા માણેકલાલ પ્રેમચંદ
 ૧ મોદી નાથલાલ મહાદેવ

૧૬ રાજકોટ

૧૫ સ્થા. જૈનશાળા ખાતે

૬. ગુલાખયંદલાઈ

૧ બોધાણી રતીલાલ ભાણજી

૮ મેંડરડા

૧ હીરાણી ત્રીકમજી પરસોતમ

૧ શા. આણુંદજી ડાલ્ખાલાઈ

૧ શેઠ કુંવરજી કલાણજી

૧ હીરાણી વદ્ધભાજી રતનશી

૧ ભાઈચંદ જસરાજ અજમેરા

૧ શા. જગળુવન શવચંદ

૧ માવાણી પોપટલાલ તલશી

૧ ગાંધી કપુરચંદ ઝવેરચંદ

૧ બેન નંદુલાઈ ઢાકરશી હીરાણી

૮ ખંલાત

૧ શા. નગીનચંદ અનોપચંદ

૨ શા. છગનલાલ રતનચંદ તર-
દ્ધી ૬. શા. છોટલાલ
દોલતચંદ

૧ શા. છોટલાલ તારાચંદ

૧ શા. ચતુરભાઈ છોટલાલ

૧ ગાંધી મોહનલાલ દોલતચંદ

૧ શા. મોહનલાલ છુંઘાલાલ

૧ તો. લુદ્દરદાસ બી. વોરા

૮ કરાંચી

૧ તો. ન્યાલચંદ રામજુલાઈ દોશી

૧ વૈઘ કાનજી ઝુંગાલાઈ

૧ ત્રીકમજી લધાલાઈ

